

હરિ: ઊં આશ્રમ પ્રેરિત
શ્રીઅંબુલાઇ પુગળી સ્મારક ગ્રથ એલી
યોગામ વિજ્ઞાન કોષ-પ.



આસ્મા



કૃષ્ણા



ગુજરાત રાજ્ય સરકારની આધ્યક્ષ સાધ્યથી પ્રકાશિત

હારિ : અં આશ્રમપ્રેરિત

[શ્રી અંબુભાઈ પુરાણી સ્મારક ગ્રંથશ્રેણી]

વ્યાયામ વિજ્ઞાન કોષ

ગ્રંથ : પાંચ મો

કલ્યાણ
(EXERCISES)



શરીર એ તો આત્માનું મંદિર છે.

—શ્રી અરવિંદ

પ્રકારાક :

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજ્યપીપલા (જિલ્લો : લાદુંગ)

ચોજનાદાન : હરિ : અં આશ્રમ, નડિયાદ

અનુદાન : ગુજરાત રાજ્ય સરકાર

● સલાહકાર સમિતિ : શ્રી સુકુંદલાઈ ર. પટેલ
ડા. અણતકુમાર પટેલ
શ્રી હસિત બૂધ
શ્રી રસ્થમલાઈ શાહ
શ્રીં સોમાલાઈ ભાવસાર

*

● સંપાદક મંડળ : શ્રી છાડુલાઈ ગિ. ભંડ
શ્રી ચિનુલાઈ પુ. શાહ
શ્રી પ્રમોદરાય હ. દવે
શ્રી કરણુસિંહ ર. ગાહિલ

*

● પરામર્શદાન : શ્રી ચિનુલાઈ પુ. શાહ

*

● પ્રકારીકારક : શ્રી ચિનુલાઈ પુ. શાહ
મંત્રી, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજ્યપીપલા

*

● મુદ્રક અને
મુદ્રણસ્થાન શ્રી નરેન્દ્રકુમાર જ. ચોકસી, અનુપમ પ્રિન્ટિંગ પ્રેસ
સરસીઆ તલાવ પાસે, યાકુતપુરા, વડોદરા-૬

પૃષ્ઠ સંખ્યા ૨૬૮ + C

*

સપ્ટેમ્બર, ૧૯૮૨

કિંમત : રૂ. ૩૦૦.૦૦/-

પ્રતિ : ૧૩૫૦

પ્રાપ્તિકસ્થાન : ● ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજ્યપીપલા ● 'વ્યાયામ' કાર્યાલય, ઘોળીકુઈ,
જાજવાડા, વડોદરા ● સી. જમનાદાસ એન્ડ કું. રીલીઝ રોડ, અમદાવાદ ● સસ્તુ
કિતાઅધર, રીલીઝ રોડ, અમદાવાદ ● મનુલાઈ એન. મસાલાવાલા, પદ, સત્યમનગર,
નાગરવેલ હનુમાન, અમદાવાદ-૨૩ ● વિનાયકરાવ શુક્લ, લગ્નાનદાસની ચાલી,
માદલપુર, અમદાવાદ-૬ ● લોકમિલાએ ટ્રૉસ્ટ, લાવનગર.

નિવેદન

વિશ્વના વ્યાયામ અને રમતગમતજગતનો પરિચય કરાવતી વ્યાયામવિજ્ઞાનકાળ યોજના નીચે ગત એ વર્પ દરમાન પ્રથમ અંથ : વ્યાયામ વિકાસ દર્શાન, દ્વિતીય અંથ : લોકરમતો, તૃતીય અંથ : મૈદાની રમતો તથા ચતુર્થ અંથ : ઐલફૂદ પ્રગટ કર્યા પણી ચાલુ વર્પે આ પંચમો અંથ : કસરતો પ્રગટ કરતાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ ગોરવ અનુભવે છે.

‘કસરત’ને વ્યાયામની પરિભાષામાં ‘મહેનત’ કહે છે, અને એ દિશાને શરીરને સ્વસ્થ, સુંદર, ચપળ, ખડતલ તેમજ બળવાન બનાવવા માટેની હેતુલક્ષી મહેનત એટલે કસરત (Exercise). ડોઈ પણું રમતગમત માટે કસરત એ પાયાની અને અનિવાર્ય બાબત છે. આ અંથમાં આ બધી બાબતોની તલસ્પશી વિચારણા કરવામાં આવી છે, એટલું જ નહિ પણ દેશવિદેશમાં, અગાઉ અને અત્યારે પ્રચલિત એવી કસરતપદ્ધતિઓ તથા તાલીમપ્રકારોની તુલનાત્મક સમીક્ષા ઉપરાંત, વિવિધ રમતગમતો માટે શરીરને તૈયાર કરવાના ક્ષમતાવર્ધક કસરતપ્રકારો, આખાલવૃદ્ધ સૌ ઘરમાં કરી શકે તેવા સરળ સ્વાર્થ્યરક્ષક કસરતપ્રકારો, ચાલવા, હોડવા તથા તરવા નેવા સાહજીક કસરતપ્રકારો, શાળાઓમાં વિદ્યાર્થીઓને સમૂહમાં કરાવી શકાવ તેવા શારીરિક યોગ્યતાવર્ધક કસરતપ્રકારો, જૈનિકની અત્યારે કિંન કામગીરી અને ફરને માટે શરીરને ચપળ અને ખડતલ બનાવતા ધનિષ્ઠ તાલીમના જૈન્યોપ્યોગી કસરતપ્રકારો, શરીરની સ્વ્યોગ્ય ટટારીરક્ષક તથા તે સંબંધી ઐડ કે ખામી સુધારક કસરતપ્રકારો, શરીરને ધાટદાર અને સનાયુબૃદ્ધ બનાવવા માટેના વજનઉચ્ચ તથા સ્પ્રોંગઝેંચ નેવા સેન્ટો પદ્ધતિના કસરતપ્રકારો વગેરેનું વિશદ વિવરણ કરવામાં આવ્યું છે. આ સિવાય આદર્શ શરીરવિકાસ, સનાયુસંચાલન અને કલાત્મક અંગવિન્યાસ તથા વેષ્ટલીશ્ટીંગ અને ઐડી બિલ્ડીંગ (અંગ સૌધક) ની સ્પર્ધાઓ તથા વિક્રમો અંગે પણ ઉપયોગી માહિતી સમાવી છે. આ બધી માહિતી જિજાસ્તુઓને ઉપયોગી, વ્યાયામ શોખીનોને પ્રેરક અને કાર્યકરોને પથદર્શક બની રહેશે, તેવી અદ્ધા છે.

અંથ તૈયાર કરવામાં અનેક અભ્યાસી, અનુભવી અને અધિકૃત લેખકોનો સ-રસ સહયોગ સાંપડ્યો છે. ચિત્રો તૈયાર કરવામાં નિર્ધારાન ચિત્રકાર શ્રી જ્યંતી ચુર્જરે તથા આવરણ છ્પાઈમાં એશિયન પ્રિન્ટરીએ સ્વજનની આત્મીયતા દાખની છે. અનુપમ પ્રિન્ટીંગ પ્રેસના શ્રી નરેન્દ્રકુમાર ચોક્સીએ મુદ્રણની કામગીરી ખૂબ નિષ્કાપૂર્વક સંભાળી છે. ગજર પ્રોસેસ સ્ટુડિયોએ સમયસર ફ્લોક્સ તૈયાર કરી આપ્યા છે; તથા કુમાર ખુક બાઈન્ડ્સેર્સ ખાસ રસ લઈ અંથનું સુંદર બાઈન્ડીંગ કરી આવ્યું છે. આ સૌના સુલગ સહકારે આ અંથનું પ્રકાશન સુરચિકર અને શક્ય બન્યું છે.

અમારા આ પ્રયાસમાં પૂજ્ય શ્રી મોટા દારા હરિ અંગ આશ્રમ તરફથી તથા ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ-એ યોજના નીચે રાજ્ય સરકાર તરફથી ને આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે તથા શિક્ષણ સંસ્થાઓએ ને સહકાર આપ્યો છે, તે બદલ તે સૌના અમે અંતઃકરણપૂર્વક આભારી છીએ. વાસ્તવમાં આની ખીજભૂમિકાનું યથાયોગ્ય શ્રેષ્ઠ પૂજ્ય શ્રી મોટા તથા પૂજ્ય શ્રી નંદુલાઈને ધટે છે.

વ्यायाम विज्ञान કોષ યોજના પાછળ પ્રેરણા મૂર્તિઓ છે—પુ. શ્રી મોટા, પુ. શ્રી છાદુભાઈ પુરાણી, પુ. શ્રી અંબુભાઈ પુરાણી તથા પુ. શ્રી દત્તાત્ર્ય મુજુમદાર. આ પ્રાર્થ પુરુષોએ ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ्’ એ મંત્રને વ्यાયામપ્રવૃત્તિના મુદ્રાલેખ તરીક અપનાવી ‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉત્ત્યતમ આદર્શ માટે’ એ રાહ પ્રણોધ્યે; એઠલું જ નહિ પણ વ्यાયામપ્રવૃત્તિને કસરતો, રમતો, ખેળકૂદ તથા લયથદ્ધ ગતિઓ એ પ્રમાણેની અભિલાઘમાં તથા સમગ્ર માનવીની એટસે કે શરીર, મન અને આત્માની ડેળવણી સાધતી જીવનોપયોગી પ્રવૃત્તિ રૂપે સ્થાપી આળવન પ્રવાર કર્યો. વ्यાયામ વિજ્ઞાનકોષ યોજના તેચોના મહાપુરુષાર્થીની ઇલથુતિ છે. આ યોજના શરૂ કરવામાં અને તેને આગળ ધ્યાવવામાં સ્વ. શ્રી ચન્દ્રશંકર ભટ્ટ, સ્વ. શ્રી લાધ્યાલભાઈ ડાન્ટ્રોકટર તથા સ્વ. શંખુપ્રસાદ ભટ્ટની સેવાઓ ચીરસ્મરણીય રહેશે.

વ्यાયામ અને રમતગમત શોખાન જનતા, શિક્ષણ સંસ્થાઓ તથા પુસ્તકાલયો અમારાં અગાઉનાં પ્રકાશનોની કેમ આ પ્રકાશનને પણ આવકારશે તેવી આશા છે.

ગુજરાત વ્યાયામ પ્રવારક મંડળ,
રાજ્યપીપળા, તા. ૨૫-૬-૮૨.

સંપાદકો,
વ્યાયામ વિજ્ઞાન કોષ યોજના.



The basic programme will be to build a body, beautiful in form, harmonious in posture, supple and agile in its movements, powerful in its activities and resistent in its health and organic functions. —The Mother

શારીરિક શિક્ષણનો પાયાનો કાર્યક્રમ એવા શરીરનું ઘડતર કરવાનો રહેશે, કે કેમાં હેઠળું સૌધિક હોય, તેની જિન્ન જિન્ન અવસ્થાઓમાં સુસંવાહિતા હોય, તેના હલનયલનમાં લાધવ અને ચ્યણતા હોય, તેની પ્રદૂતિઓમાં સામર્થ્ય હોય, તથા તેના સ્વાસ્થ્ય તેમજ ચૈત્ય વ્યવહારોમાં પ્રતિકારશીલતા હોય. —શ્રી માતાજી


વ्यायामविज्ञानकोष યોજનાની પ્રેરણમૂર્તિઓ



શ્રી મેહા
યોજનાદાન



શ્રી અંબુભાઈ પુરાણી
પ્રેરણા




શ્રી છોકુભાઈ પુરાણી
આધ્યાત્મિક



શ્રી દત્તાત્રેય ચ. સુદર્શાન
પુરુષાર્થ

સંપાદક - લેખક પરિવાર



શ્રી છાડુલાઈ ગ્રી. પટેલ
જી.આ.જી.એડ.




શ્રી ચીનુલાઈ પુ. શાહ
જી.આ. માનદ
વ્યાયામ વિશારદ




શ્રી પ્રમોદરાય હ. દવે
એમ.ગ્રી.એમ.પી.ઇ.




શ્રી કરમાલસિંહ ડૉ. ગોહિલ
જી.આ.એસ.રી.રી.પી.એડ.
એમ.પી.ઇ.



શ્રી અનિલકુમાર ચિ. શાહ
એમ.ગ્રી. જી.એડ.
વ્યાયામ વિશારદ



શ્રી મનુપ્રસાદ હી. પટેલ
જી.આ.જી.એડ.જી.પી.એડ.
એમ.પી.ઇ.



શ્રી સુકુંદલાઈ ઓ. શાહ
જી.આ.જી.પી.એડ.એમ.પી.ઇ.



શ્રી ચંદુલાઈ મં. પટેલ
જી.આ.ડી.પી.એડ.



શ્રી ડૉ. પી. ડી. શર્મા
એમ.ગ્રી.પી.એચ.ડી.જી.પી.ઇ.
ડી.જી.એડ. ડી.એડ.રી.(જર્મની)



શ્રી આત્મારામ જી. પટેલ
જી.એસ.સી.જી.એડ.ડી.પી.એડ.
એમ.પી.ઇ.

લેખક પરિવાર

આ અંથની રચનામાં નીચે મુજબ તજ્રૂર લેખકોએ તેમના નામની સામે દર્શાવેલાં વિવિધ પ્રકરણો માટે લખાણું તૈવાર કરી આપી સ-રસ સહયોગ આપ્યો છે, તેની સાલાર નોંધ લેતાં પ્રકાશક સંસ્થા ગૌરવ અનુભવે છે.

- શ્રી મનુપ્રસાદ હી. પટેલ, ખી. એ., ખી. એડ., ડી. પી. એડ., એમ. પી. છ. (પ્રાધ્યાપક, શ્રી છો. પુ. વ્યાયામ મહાવિદ્યાલય, રાજ્યપીપલા) : ૬. સાહિત્યક વ્યાયામ ૧૪. શાળાપ્યોગી જિગ્નેસ્ટિક ટ્રેન્ડ્સ.
- શ્રી ચંદુભાઈ અ. પટેલ, ખી. એ., ડી. પી. એડ. (મદ્દનીશ પ્રાધ્યાપક, શ્રી છો. પુ. વ્યાયામ મહાવિદ્યાલય, રાજ્યપીપલા) : ૧૦. દંડ-બેઠક-સૂર્યનમસ્કાર.
- શ્રી અનિલકુમાર ચિ. શાહ, એમ. એ., ખી. એડ., વ્યાયામ વિશારદ (શિક્ષક, અ. પુ. હાઇસ્કૂલ, રાજ્યપીપલા) : ૧૨. ધરમાથદ શકે તેવી હળવી આરોગ્યદાયી કસરતો. ૧૩. પેટની સારશેરી કસરતો. ૨૦. રોમન પીલર, રોમન ચેર, રોમન બોડ્સ.
- શ્રી આત્મારામ જે. પટેલ, ખી. એસ.સી. ખી. એડ., ડી. પી. એડ., એમ. પી. છ. (પ્રાધ્યાપક, ચી. ન. વ્યાયામ વિદ્યાલય, અમદાવાદ) : ૨૦. વેદિટ ટ્રેનિંગ.
- શ્રી મુકુંદભાઈ એ. શાહ, ખી. એ., ડી. પી. એડ., એમ. પી. છ. (પ્રાધ્યાપક, શ્રી છો. પુ. વ્યાયામ મહાવિદ્યાલય, રાજ્યપીપલા) : ૨૦. ભારે ડંબેલ્સ; સ્વીંગ બાર; લેગ બેલ્સ; ફેડ સ્ટ્રેપ-આર્નિંશ્શ-બન્યન્ટ ફુશર-એપ્ટોમિનલ બોડ; શ્રીપટેવલપર; પુલીવેદ્ધિટ.
- ડા. પી. ડી. શર્મા, એમ. એ., પી. એચ. ડી. ખી. એડ., ડી. પી. એડ., ખી. પી. એડ., ડી. એડ. સી. (પ્રાધ્યાપક, ચી. ન. વ્યાયામ

વિદ્યાલયન, અમદાવાદ) : ૨૨. દોરડાં કૂદ;
દોરકું ચઢ; વોલણાર્સ; મેડિસીન પોલ.

પી. ઈ. (પ્રાચ્યાર્થ, શ્રી એ. પુ. વ્યાયામ
મહાવિદ્યાલય, રાજ્યપીપલા); ૨૫. એડી
બિલ્ડિંગ અથવા થરીર સૌધાવ સ્પર્ધા.

● આ પ્રમાણરાય હુ. હવે, એમ. એ., એમ.



સંદર્ભ ગંથ સૂચિ

૧. શારીરિક ક્રેણવણી ફર્શન : ખંડ ૧, ૨, ૩ : ચિતુલાઈ પુ. શાહ
૨. ધરમાં અને શાળામાં કસરત અને સ્વાસ્થ્ય : ,
૩. રેઝ કરવાની હળવી કસરતો : ડૉ. સુમંત ભડેતા
૪. વ્યાયામ જ્ઞાનકોશ (મરાઠી) : ખંડ ૪-૯ : દ. ચિ. મુજુમદાર
૫. ભારતીય વ્યાયામ (હિન્દી) : પ્રો. માળિકરાવ
૬. Our Physical Activities : T. I. P. E. Kandivli
૭. Gymnastic Tables : T. I. P. E. Kandivli
૮. Handbook of Physical education : Ministry of Education;
Govt. of India
૯. Scientific Weight Training for
Sports and Games : Dr. J. P. Thomas
૧૦. Weight Training in Athletics : Murrey and Karpovich
૧૧. Scientific Foundations of
Physical Fritness Programmes : L. A. Golding and R. R. Bos
૧૨. Physical Training : Dept. of Army, U. S. A.

અનુક્રમ


ક્રમ	પ્રકરણ	પૃષ્ઠ	ક્રમ	પ્રકરણ	પૃષ્ઠ
૧	વ્યાચામ શા માટે ?		૧	૧૫ સૈન્યોપ્યોગી કસરતો	૧૨૮-૧૩૬
૨	વ્યાચામ અને વૈષ્ણવી શક્તિ	૧૩		સામાન્ય કસરતો	૧૨૬
૩	વિવિધ વ્યાચામ પદ્ધતિઓ : તુલનાત્મક સમીક્ષા	૧૬		રાયક્ષલ સાથેની કસરતો	૧૩૧
૪	આરોગ્યપ્રાપ્તિના પાચામાં	૩૩	૧૬	પ્રતિનોર, ગાત્રપ્રસારણ તથા શિથિલીકરણ વ્યાચામ	૧૪૦
૫	શારીરિક ક્ષમતા : વૈજ્ઞાનિક વિચારણા	૪૦	૧૭	સુચોગ્ય ટટારી અને સુધારણા કસરતો	૧૪૮
૬	આદર્શ શરીરવિકાસ	૪૭	૧૮	પથ્થરનાં ભારે સાધનોવાળો	
૭	કસરતના અભ્યાસીને	૬૦		ભારતીય વજન વ્યાચામ ૧૫૪-૧૬૪	
૮	સુસ્થિતિ તાલીમની પ્રયોગિત પદ્ધતિઓ	૬૬		પથ્થરના ગોળા	૧૫૫
૯	સાહજિક વ્યાચામ	૭૧-૮૦		નાળા	૧૫૭
	ચાલવું	૭૧		ચક્કો	૧૬૦
	શિથિલ દોડ (જોગિંગ)	૭૨		એક્ઝો	૧૬૧
	દોડવું	૭૩		ગઢા	૧૬૨
	દોડ-ચાલ	૭૪	૧૯	કાણનાં ભારે સાધનોવાળો	
	દીધ્યશ્વસન	૭૫		ભારતીય વજન વ્યાચામ ૧૬૫-૧૮૫	
	તરવું	૭૫		સંતોલા	૧૬૫
૧૦	ફંડ-એઠક-સૂર્ય નમસ્કાર	૮૧		જડ જોડી	૧૭૧
૧૧	ક્ષમતાવર્ધક કસરતો	૮૮		કરેલા	૧૭૮
૧૨	ઘરમાં થઈ શકે તેવી હળવી આરોગ્યદાયી કસરતો	૧૦૨		જડ લાડી	૧૮૧
૧૩	પેટની સવિશેષ કસરતો	૧૧૩		જડ લેજુમ	૧૮૨
૧૪	શાળોપ્યોગી જિસ્ટનેસ્ટિક ટ્રેનિંગ	૧૨૦	૨૦	પાશ્વાત્ય વજન વ્યાચામ ૧૮૬-૨૨૦	
				વેઈટ ટ્રેનિંગ	૧૮૬

ક્રમ	પ્રકરણ	પૃષ્ઠ	ક્રમ	પ્રકરણ	પૃષ્ઠ
૧	વજનવાળા ડંબેલ્સ વ્યાયામ	૧૬૪		ખુલ્લવર્કર	૨૫૫
	સ્વોગણારનો વ્યાયામ	૧૬૬		સ્વમાલિસ	૨૫૭
	દેગબેલ્સનો વ્યાયામ	૨૦૩	૨૩	શરીર સૌછઠ્ય અને કલાત્મક અંગવિન્યાસ	૨૬૧-૨૮૨
	હેડ સ્ટ્રેપ, આર્થર્ન થ્યુ, જાયન્ટ ફાર			સપ્રમાણ શરીર	૨૬૧
	એપ્ટેન્નિનલ બોડ, ઓપ ડેવલપર્સ	૨૦૭		સપ્રમાણ અંગોનાં માપ	૨૬૫
	પુલી વેઈટ	૨૧૦		સનાયુનિયમન	૨૭૦
	રેમન પિલર, રેમન ચેર, રેમન બોડ	૨૧૩		કલાત્મક અંગમુદ્રાઓ	૨૭૪
૨૧	સ્ટીલ સ્પ્રીંગ એક્સ્પાન્ડર		૨૪	વેઈટ લીક્ટીંગ : સ્પર્ધા અને નિયમો	૨૮૩
	અથવા રણર કેખલ				
	એક્સ્પાન્ડરનો વ્યાયામ	૨૨૧	૨૫	ઓઢી બિંડીંગ અથવા શરીર સૌછઠ્ય સ્પર્ધા	૨૮૬
૨૨	પ્રક્રીણ્ણ કસરતો	૨૨૬-૨૬૦	૨૬	નેંધપાત્ર આંક અને વિક્રમો	૨૮૩-૨૮૬
	જપાની પદ્ધતિની કસરતો	૨૨૬		વેઈટ લીક્ટીંગ	૨૮૩
	દોરડાં ઝૂદ	૨૩૩		શરીર ચૌષ્ટન	૨૮૫
	દોરડું ચઢ	૨૩૭			
	વોલણાસ્ટ	૨૪૨			
	બેંગ પંચિંગ	૨૪૪			
	મેડિસીન બોલ	૨૫૦			

૧ : વ્યાયામ કાર્ય માટે !

વ्यાયામ શહુદ અનેકાર્થી છે. તેમાં એ શહુદો છે-
વિ + આયામ. ‘વિ’ ઉપસર્ગ છે. તેનો અર્થ
‘વિશેષ’ અને ‘આયામ’ શહુદનો અર્થ ‘નિગર્હ’
અથવા ‘નિયમન’ છે. આમ ‘વ્યાયામ’ શહુદનો અર્થ
‘વિશેષ નિયમન’ એવો થાય છે. ‘વિશેષ નિયમન’
એટલે ‘મનસહિતનું’ નિયમન’. શરીર ઉપર મનતું
શાસન હોય છે અને તેથા મનસહિત કરેલું શરીરનું
સમ્યક નિયમન તે જે ‘વ્યાયામ’ કહેવાય છે. આ
દિને વિચારીએ તો વ્યાયામનું કાયલેન વિશાળ

બની રહે છે અને તેમાં શરીરનાં વિવિધ અંગો
અને અંગતાંત્રોનો વિકાસ સાધતી કસરતો ઉપરાંત
વિવિધ પ્રકારની રમતગમતોનો તથા નૃત્ય પ્રકારોનો
તેમજ સ્વાસ્થ્ય વિશાળનો સમાવેશ થાય છે. આ
બધી વ્યાયામ પ્રવૃત્તિઓ માટે માનવશરીર પાયાની
બાધત છે. શરીર એ તો આત્માનું ભાંદ્દી છે તથા
ધર્મપાલનનું પ્રથમ સાધન છે અને તેથા વ્યાયામ
પ્રવૃત્તિ વિષે વિચારતાં પહેલાં માનવશરીરની ખાસિયત
તથા અગત્યની બાધતો જાળવી જરૂરી છે.



માનવ શરીર

માનવ શરીર :

માનવશરીર ખરેખર બહુ અજ્ઞન થંત્ર છે. એ ખૂબ જ સંક્રિય થવા સર્જાઓલું થંત્ર છે. બીજાં થંત્રોને ચાલુ કરવા માટે, બગડે ત્યારે તેની ભરામત કરવા માટે તેમજ તેને વ્યવસ્થિત રીતે કામ કરતું રાખવા માટે ડોઈ આદમીની જરૂર પડે છે; પણ માનવશરીર પોતાની મેળે ચાલુ થાય, પોતાની ભરામત પોતે જ કરી લે તથા પોતાનાં કાર્યોનું નિયમન જીતે કરી લે તેવું થંત્ર છે. બીજાં થંત્રો પોતાની મેળે પોતાનાં શરીરની વૃદ્ધિ કરી શકતાં નથ્યા, પણ બીજાં સંજ્ઞવ પ્રાપ્તીઓ ચેઠે માનવ શરીર પોતાની વૃદ્ધિ કરી શકે છે.

દુનિયાનાં બીજાં પ્રાપ્તીઓની સરખામણીમાં, કેટલીક વાનર જતિઓનાં પ્રાપ્તીઓ બાદ કરતાં એકલો માનવી જ એ પગ પર શરીરને સમતોલ ટેકવી, ઘડની બંને બાજુ હાથ ઝૂલતા રાખી ચાલવાની શક્તિ ધરાવે છે. હાથના અંગૂઠાને અંગળીઓ સામે લાવવાની શક્તિની બાબતમાં તો દુનિયાનાં બીજાં તમામ પ્રાપ્તીઓથાં તે જૂદો તરી આવે છે. આવી જતનો હાથ હેવાને કારણે તે વિવિધ ઓન્નરો વાપરી શકે છે. એ પગ પર શરીરને સમતોલ રાખી જિલા અને ટટાર રહી ચાલવાને કારણે તેની અંખ શરીરના મિનારાની ટાચે ગોઠવાય છે; અને તેમ થતાં તે મોટા વિસ્તારને જોઈ શકે છે. મોટા વિસ્તારને જોવાને કારણે સ્થૂલ દર્શિની ભર્યાદા વિસ્તારવાની સાથે સાથે તેની કલ્પનાસૂદ્ધિના પ્રદેશનો વિસ્તાર પણ વધે છે. એ પગ પર શરીરને સમતોલ રાખી ચાલવાની શક્તિ, તેને કારણે વધતી દર્શિ ભર્યાદા અને અંગૂઠાઓ સામે અંગૂઠા લાવવાની સગવડથી ઓન્નર વાપરવાની શક્તિ ધરાવતો હાથ—આ તણું માનવશરીરની બહુ અગત્યની ખાસિયતો છે.

હાથી, કે જિટ જેવું માનવીના શરીરનું મેટું કદ નથ્યા; સિંહ કે વાધની ચેઠે તેને તીણું દાંત, અને ન્ડાર નથ્યા; ગેડા ચેઠે શરીર પર જાડી ચામડીનું કવચ નથ્યા; નાગની ચેઠે જેરી દાઢો નથી અને ધોડા

જેવી જડપી દોડ નથ્યા. ટૂંકમાં ખચાવ કે આકમણુનાં સાધનોના બાબતમાં તેનાથી ચઠીઆતાં પ્રાપ્તીઓને જેર કરવામાં તે સફળ થયો છે, કારણું તેનામાં ખુદ્ધિ છે અને તે ખુદ્ધિના હથિયાર ૩૫ ઓન્નર વાપરવાની શક્તિવાળો હાથ છે.


માનવીની વિવિધ ગતિઓ :

ઉપર જણુાવી તેવી ખાસીયતવાળું માનવશરીર અમુક ગતિઓ કરવાની શક્તિ ધરાવે છે. તે ચાલે છે, હોડે છે, ઝૂંદે છે, તરે છે, ચેટે સરે છે કે ધૂંટણુંઓ ચાલે છે, નાચે છે, તથા આડ પર ચઢે છે. હાથથા તે ચીનેને પકડે છે, ઝેંકે છે, જેંચે છે, ધક્કેલે છે, અદ્ધાળે છે; તથા જિચ્કે છે. આ મોટી ગતિઓ ઉપરાંત તે અંગળીઓથાં સીવે છે, 'ટાઈપ' કરે છે, વાળંત્રા વગાડે છે, બોલે છે, ગાય છે અને ગળા તથા અંખની ધણી નાની ગતિઓ કરી શકે છે, જેમાં અલિનથનો સમાવેશ થાય છે.

હાથ અને ગગની ઉપર જણુાવેલી ગતિઓને આપણે માનશરીરની મૂળભૂત ગતિઓ કહી શકીએ, કારણું કે તેના અત્યનિર્વાહ માટે તે અનિવાર્ય જરૂરીઓાત રૂપ છે. આ ગતિઓ વર્ષેથી તેનામાં ૩૮ થયેલી છે. આવાં કારણોને લઈને આ અને એવી ગતિઓ કર્યી તેને ખૂબ ગમે છે. ધણીખરી રમતોમાં આ ગતિઓનાં વિવિધ મિશ્રણો હેવાથી રમતો માટે માનવીને કુદરતી આકર્ષણું છે અને તેનાથી તેને ખરો આનંદ મળે છે.

માનવશરીરમાં માંસપેશીઓનું સ્થાન

(૧) ઉપર જણુાવેલી વિવિધ ગતિઓનો આધાર માનવશરીરમાં આવેલી માંસની પીડીઓ અથવા માંસપેશીઓ પર છે. એ જાણુને આશ્રય થશે કે માનવીના શરીરના કુલ વજનનો અર્ધથાં કાઈક વધારે લાગ માંસપેશીઓનો છે. માનવીના અવનમાં માંસપેશી કેવું અગત્યનું સ્થાન લોગવે છે તે બતાવવા માટે આ એક જ હકીકત પૂરતી છે.




માનવશરીરની વિવિધ ગતિઓ

(૨) માનવીના શરીરમાં હૃદય છે, ફેઝસાં છે, કલેજું છે. ગુર્હા છે, અન્તનળી છે; તેમજ ખીજનાં નાનાં મોટા આંગો છે. પણ આ આંગોમાંનું એકપણું પોતાને માટે કામ કરતું નથી. આપણા શરીરનાં ધણુંખરાં અગત્યનાં આંગોને માંસપેશી આની જરૂરીઓને પૂરી કરવા જ જણે પેદા કર્યાં હોય એમ જણ્ણાય છે.

માંસપેશીઓ આપણા શરીરમાં આવેલાં એન્ટ્રીનો નેવા છે. તેમનું કામ વારાફરતી લાંબાં અને ટૂંકાં થવાનું છે. આમ લાંબાં અને ટૂંકાં થતાં ને હડકાં સાથે તે જોડાયેલ હોય છે તેને હલાવી વિવિધ ગતિઓ કરે છે. એન્ટ્રીન શક્તિ પેદા કરી, તેનાથી જત જતના સાંચા ચલાવે છે; પણ એ શક્તિ પેદા કરવા માટે કોલસો ડે તેલ બાળવાં પડે છે. માંસપેશી રૂપી એન્ટ્રીનમાં બહારથી આવેલું બળતણું બળતું નથી પણ તેનો અમુક ભાગ જ બળી બળતણુની ગરજ સારે છે. તેનો પોતાનો અમુક ભાગ બળવાથી પેદા થતી શક્તિથી જ તે લાંખીટૂંકી થાય છે.

પોતાનો અમુક ભાગ બળવાથી માંસપેશી લાંખીટૂંકી થવાની શક્તિ મેળવે છે; પણ સાથે સાથે તેમ થવાથી તેને ઘટ લાગે છે તથા વિવિધ અશુદ્ધિઓ પેદા થઈ તેની અંદર જમા થાય છે. તેને લાગેલી ઘટ પૂરી કરવામાં ન આવે તથા તેની અંદર જમા થયેલી અશુદ્ધિઓને જરૂર ઘટ કરવામાં ન આવે તેમજ તેના દર્શને બળવા માટે ઓક્સિજન વાયુ પૂરો પાડવામાં ન આવે તો માંસપેશી તેનું કામ ચાલુ રાખી શકે નહીં, એ હેણીતું છે. લોહીના પ્રવાહ તેને લાગેલી ઘટ પૂરવા તેને અન્ન દર્શયો પૂરાં પાડે છે. તે જ પ્રવાહ તેને જોઈતો ઓક્સિજન વાયુ પૂરો પાડે છે અને તે જ તેની અંદર જમા થયેલી અશુદ્ધિઓને તેમાંથી ઘાઈને વહી જય છે. લોહીના પ્રવાહને શરીરમાં વહેવડાવનાર બંધો હૃદય છે. તે ધયકાને લોહીને વહેવડાવે છે. ફેઝસાંની પાતળા ભીંતો પર આવેલી લોહીની નળીઓની જળીમાંથી લોહી વહે છે ત્યારે તેમાંની અશુદ્ધિઓ ફેઝસામાંની હવામાં ચાલી જય છે અને ફેઝસામાંની



માંસપેશી તંત્ર

હવામાંથી તને આકસ્મીજન વાયુનો જોઈતો જથ્યો મળા રહે છે. લોહીના પ્રવાહી રસમાંથી માંસપેશીઓ પોતાની ઘટ પૂરવા ને પોષક દર્ખ્યો. લે છે તે લોહીનો રસીની ઘટ અન્નનળી પૂરી કરે છે. ખારાકને પચાવી, પ્રવાહી કરીને તને લોહીના પ્રવાહમાં ફેસાં, ગુર્દા, કલેજ, ચામડી વગેરેમાં લઈ જય છે અને તે અંગો તે અશુદ્ધિઓને લોહીમાંથી જૂદી પાડી શરીરની વહાર ઠાઢી નાંબે છે.

આ ઉપરથી સમજય છે કે ફદ્ય, ફેસાં,

1. દ્વિમસ્તક સ્નાયુ (Biceps)
2. ત્રિમસ્તક સ્નાયુ (Triceps)
3. પ્રકોષ્ઠના આકુંચક સ્નાયુ (Islexors of fore arm)
4. પ્રકોષ્ઠના પ્રસારક સ્નાયુ (Extensors)
5. ઉરોજ સ્નાયુ (Pectoralis)
6. મેસીટર સ્નાયુ (Masseter)
7. સ્ટનોસ્મેસ્ટોઇડ સ્નાયુ (Sternomestoin)
8. ખલાનો ત્રિકોણાકાર સ્નાયુ (Deltoid)
9. પેટના સ્નાયુ
10. થાપાના સ્નોયુ (Gluteal)
11. ચતુર્મસ્તક સ્નાયુ (Quadriceps)
12. પીંડીના સ્નાયુ (Gastro-neminius)
13. ટેંડો એક્ચિલિસ (Tendo-achillis)
14. સાથળના આકુંચક સ્નાયુ (Flexors of thigh)

કલેજ, ગુર્દા, અન્નનળી વગેરે અંગો માસપેશીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ પેદા થયાં છે. માનવશરીરમાં માંસપેશીનું સ્થાન કેવું જાંચું અને અગત્યનું છે તે આ ઉપરથી સમજય છે.

(3) પોતાના જીવનની જરૂરીઓનો મેળવવાને તેમજ દુશ્મનોથી પોતાનો બચાવ કરવા માટે માનવીને પોતાના ઉધ્યમને અનુલક્ષ્ણાને જતનતની દ્રિયાઓ અને ગતિઓ કરવી પડે છે. તેની આ સક્રિયતા તેના શરીરની અંદરનાં અંગોને પૂરતાં

વ्यायाम શા માટે ?


સક્રિય રાખ્યા સારી અને ચાલુ હાલતમાં રાખે છે. માનવશરીરની રચના જ બતાવી આપે છે કે તે સક્રિય જીવન જીવવા જ રચાયું છે.

માનવજીવનની સક્રિયતાનું ધોરણ શું ?

એકવાર એક વિદ્યાન મિત્રે મને પ્રશ્ન કર્યો હતો કે ‘હું ખાઉ છું, મને ખાદેલું પચે છે; હું ક્રોલેજમાં જઈ શીખવવાનું કામ કરું છું, ક્રોલેજથી ઘેર આવું છું, ઘરમાં જરૂરી કામો કરું છું. હું લાગ્યે જ માંદો પડું છું. હવે તમે કહો કે મારે ખાસ વ્યાયામ કરવાની શી જરૂર છે ? આવો પ્રશ્ન આજના ઘણ્યા ખુબાનોના મનમાં જઠે છે. આ પ્રશ્નનો ભારો જવાબ એવો છે કે, ‘નિત્ય જીવનના વ્યાપારો ઉપરાંત તમારે ડોઈ ખાસ વ્યાયામ કરવો કે નહીં તનો આધાર તમે તમારા જીવનને કઈ સપાઈએ રાખવા માગો છો તેની ઉપર છે. તમે વર્ષુંબ્યું તે જતનું જ જીવન જીવલું તમને ગમતું હોય તો તમારે ડોઈ ખાસ વ્યાયામની જરૂર નથી; પણ એક વાત યાદ રાખજો : આવું જીવન જીવવાથી તમારામાં જોર, જોસ અને જોમતું પ્રમાણ બહુ નીચું રહેશે; જીવનના ઉત્સાહ અને ઉમંગ માણવા તમે ભાગ્યશાળી નહીં થાવ; જીવનમાં મસ્તી અને ઉલ્લાસ તમે કદી અનુભવી નહીં શકો. નદીમાં તરવાની, હોડી હંકારવાની, પ્રવાસ જેડવાની, પહાડો પર ચઢવાની મોજ તમે નહીં માણ્યી શકો. આવું જીવન જીવવા માટે જોમની માત્રા વધારે હોવાની જરૂર છે; અને તે તમારામાં નહીં હોય. રોગના જરૂરોના હુમલા સામે ટકવાની જીવનશક્તિનો સંઘરો તમારી પાસે નહીં હોય. વળો તમે કહો છો તેવું સરળ અને શાંત જીવન જીવલું શક્ય છે કે કેમ એ પણ પ્રશ્ન પ્રશ્ન છે. જોર તથા જોમનો ઉત્થેાગ કરવાના પ્રસંગો જીવનમાં નહીં આવે તેની ખાત્રી શી ? તેવા પ્રસંગો આવશે ત્યારે તમારી શી વલે થશે ? દેશના રક્ષણુમાં તમે શો ઝાળો આપી શકશો ? તમારાં વહુ-બેટીની ઈજન્જત કે માલમતાનું રક્ષણ કરાવનો પ્રસંગ આવતાં તમે અસહાય થઈ માથે હાથ

દઈ બેસશો તે તમને શોભશો ? અને આવા પ્રસંગો જીવનમાં નથી આવતા શું ? તેવે વખતે તમને તમારી કમન્જેરી પર જરૂર ધિક્કાર આવશે.

માટે મારી તો એવી સલાહ છે કે, જીવનના મસ્તી અને આદ્યલાદ અનુભવાય તેવું જોર, જોસ અને જોમથું જીવન જીવો. માત્ર નિરામય રહી રોજાયરોજનાં કામો કરતાં જીવલું એ જીવનની બહુ નીચી સપાઈએ જીવવા બરાબર છે. જીવનની આ નીચી સપાઈએ નહીં પણ જાંચી સપાઈએ જીવો. વ્યાયામ વગર તેવી સપાઈએ જીવન જીવલું શક્ય નથી. મોટી ફાંદ હોય, જડપથી ચાલતાં કે દાદર પર ચઢતાં હાંકું ચડતી હોય, દોડવાનો પ્રસંગ



જીવનનો આનંદ

આવતાં મહાન આદ્યત આવી પડવા જેવું લાગતું હોય, ઝૂદ્ધો મારી ખાડો ઓળંગવાની છાતી ન ચાલતી હોય... ...તો આવું પરાવલંખી અને નિરૂપયોગી શરીર શા કામતું ?

તે જ પ્રમાણે છાતીનાં કંઈ ટેકાણું ન હોય, હૈયા માચ્યો નીકળો હોય, આંખો જાંદી ઉતરી ગઈ હોય, હાથ પગની માંસપેશીએ ઝૂલ્લી પડી હોય, આંખો નિસ્તેજ હોય અને મોટા નંબર વિના દૂરની વસ્તુ જોઈ ન શકતો હોય, નાક અને પગના અંગુઠાને દોરીથી સાંધતાં કામઠી બને એવું વાંકું વળેલું શરીર હોય, જોરથી ચાલતો લડુ આદમી


અથવાતાં તેના પર ખૂનનો કે મહાવ્યથાનો આરોપ આવે એવું શરીર હોય તો તમને ગમે ખડું? હરગીજ નહિ. હાલના જમાનામાં મહામહેનતે મળેલી આજાદીની રક્ષા કરવી હોય ત્યાં ઉપર જણાવ્યાં છે તંવાં નણણાં શરીરા ન ચાલે; ધડીભર ન ચાલે. આપણે તો જોઈએ છે એવા યુવાનો જેની ચાલે ધરણી ધ્રૂબે, તથા જેનાં તેજસ્વી પ્રતાપી મેં સામે જોતાં સામે માણુસ અંનાઈ જય તથા ચુંડાની ચુંડાગીરી વિનયમાં ફેરવાઈ જય; તથા જેનો સામનો કરવો એ તેને મહાસાહસ જેવું જણાય. માત્ર યુવાનો જ નહિ પણ દેશની યુવતીઓ પણ તેવી જ તેજસ્વી અને અળવાન હોવા જોઈએ. આવાં તેજસ્વી યુવાન અને યુવતીઓ ઘડવાની તાકાત વ્યાયામમાં છે—જે તે નિયમિત રીતે તથા યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો.

વ્યાયામ કાને કહેવો?

‘વ્યાયામ’ શાબ્દ સાંભળતાની સાચે આખાડો, કુસ્તી કરતા કે મોટા મગદળો ફેરવતા કે દંડ, ઐકડો કરતા મલ્લોનું ચિન મન આગળ ખડું થાય છે. ધણું જૂના સમયથી ‘વ્યાયામ’ શાબ્દ આપણા દેશમાં આવી પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવે છે. દંડ, ઐકડ, મગદળ, મલ્લખાંલ, કુસ્તી, લેઝીમ વગેરે

વ્યાયામના પ્રકારો તો છે જી, પણ માત્ર એ જ વ્યાયામપ્રકારોનો સમાવેશ ‘વ્યાયામ’માં થાય છે, એમ નથી. ખીજ પણ ધળું વ્યાયામપ્રકારોનો સમાવેશ ‘વ્યાયામ’માં થાય છે. ‘વ્યાયામ’ શાબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે, શરીરની માંસ પેશીઓ સાધારણું કરતાં વધારે ખેંચાય અથવા કસાય એવી પ્રવૃત્તિ. આ રીતે તો વિવિધ દેશી અને વિદેશી રમતો પણ વ્યાયામના જ પ્રકારો છે. તરવું, હોડી હંકારવી, પ્રવાસ ઐડવો, પહાડ પર ચડવું, ધોડેસ્વારી કરવી એ પણ વ્યાયામ જ છે. ઝડપો કે ધીમી ચાલે ફરવું કે દોડવું, વિવિધ પ્રકારના કૂદકા તથા ચોંઝે ઝંકવાની કિયાએ જો પણ વ્યાયામના પ્રકાર જ છે. બાથંબાથા, લકડીપટા, તીરંદાળ, અનો સમાવેશ પણ વ્યાયામમાં જ થાય છે. અલિનય, નૃત્ય અને સંગીત પણ વ્યાયામના હળવા પ્રકારો જ છે. ત્યારે દણવું, ખાડવું, પાણી ભરવું વગેરે ધરકામોનો શું વ્યાયામમાં સમાવેશ ન થાય? મિલો કારખાનાં તથા ખેતરોમાં મજૂરી, એ પણ એક પ્રકારનો વ્યાયામ જ છે. ટૂંકામાં જે જે પ્રવૃત્તિથી શરીરની માંસપેશીઓને સાધારણું કરતાં વધારે કામ કરવું પડે તે તમામ પ્રવૃત્તિઓ વ્યાયામના પ્રકાર કહી શકાય.

આવી બધી પ્રવૃત્તિઓથી શરીરની માંસ પેશીઓ



વિશ્વવ્યાપી વ્યાયામ પ્રકારો

વधारे કે ઓછા પ્રમાણુમાં કસાય છે અને તે પ્રવૃત્તિઓ કરનારનાં શરીર, શક્તિ, ઉંમર તથા સમાજના પ્રમાણુમાં તે વધારે કે ઓછી આકર્ષક હોય છે. ઉપર જણાવેલા વ्यાયામ પ્રકારોમાંના-(૧) રમતો જેવા ડેટલાય તં કરનારને આનંદ આવે એવા અને તે કારણે આકર્ષક હોય છે અને સાથે શરીર વિકાસ પણ સાધે છે; (૨) ડેટલાક વ्यાયામ પ્રકારો રમતો જેવા આકર્ષક હોતા નથી, તેમ છેક વેઠ જેવા પણ હોતા નથી, પણ શરીરની સપ્રમાણ અને વ્યવસ્થિત વૃદ્ધિ કરવાની શક્તિ ધરાવે છે; (૩) ડેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે કે તે વધારે કે ઓછે અંશે શરીરવિકાસ સાધે છે; પણ ડાઈ પણ જતની વિવિધતા વગર અને યંત્રવત્ત કરવાના હોવાથી તદ્દન નીરસ અને કંટાળો આવે એવી હોય છે. એવી પ્રવૃત્તિઓ માણુસ ન છૂટકે જ અને વેહની પેઠે કરે છે. આવી બધી પ્રવૃત્તિઓમાં પહેલા પ્રકારના પ્રવૃત્તિઓ શરીરવિકાસની સાથે સાથે આનંદ આપી, મન અને આત્માનો વિકાસ પણ સાધે છે. નીંળ પ્રકારની પ્રવૃત્તિઓ એથી ઉલ્લંઘન અને નીરસ હોવાથી મન અને આત્માનો વિકાસ દંધે છે. બાંન પ્રકારની પ્રવૃત્તિઓ રમતો જેવી આકર્ષક નથી તથા નીંળ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી તદ્દન વેઠ રૂપ પણ નથી, પણ શરીરની સપ્રમાણ વૃદ્ધિ સાધવાની શક્તિ ધરાવવાને કારણે તને કાંઈક અંશે આકર્ષક બનાવી શકાય છે. દંડ, ઐટક, તથા વજન ભિચકવા જેવી પ્રવૃત્તિઓ આ વર્ગમાં આવે છે. સમજપૂર્વક અને ખુશીથી કરવામાં આવતી ધરકામ તથા બીજી ઉપયોગી પ્રવૃત્તિઓનો સમાવેશ વ્યાયામમાં કરી શકાય, પણ તે સિવાય ન છૂટકે કરવી પડતી પ્રવૃત્તિઓનો સમાવેશ વ્યાયામમાં નહીં પણ વેઠમાં જ થઈ શકે.

દૂંકામાં, વ્યાયામનો મુખ્ય હેતુ આનંદ આપવાનો તથા સાથે સાથે શરીરવિકાસ સાધવાનો છે. રમતો દરભ્યાન રમનાર એક જતની, તમામ નિયંત્રણ વિનાની, સ્વતંત્રતા અનુભવે છે અને પોતાને ગમતું કરી શકે છે એ જ તેના આકર્ષણુના ભૂમાં રહેલી મુખ્ય બાળત છે.

ઉપર જણાવેલા વ્યાયામપ્રકારોમાંના રમતો જેવા ડેટલાક પ્રકારો આનંદ આપે છે, પણ તેનાથી શરીરનો વિકાસ સપ્રમાણ અને વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. બીજા દંડ ઐટક જેવા વ્યાયામપ્રકાર શરીરનો સપ્રમાણ અને વ્યવસ્થિત વિકાસ સાધવાની બાળતમાં ખૂબ કાર્યસાધક હોવા છતાં રમતો જેવું તેનું કુદરતી આકર્ષણું હોતું નથી; આમ છતાં તેની ઉપયોગિતાની દાખિયે તેનું સેવન કરવું જરૂરી થઈ પડે છે.

વ્યાયામ એ રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિ છે

હાલની ડેણવણી પદ્ધતિનો મોટો બાંધે એવો અને અક્ષમ્ય દોષ એ છે કે આપણે વકીલો, ડાક્ટરો, શિલ્પિઓ, વૈજ્ઞાનિકો, વાણીજ્ય વિશારદો વગેરે વગેરે જુદા જુદા ધંધા હુન્નરતા નિષ્ણાતો તૈયાર કરીએ છીએ; પરંતુ ભાણુનારામાં માણુસાઈના ગુણો વિકસાવવાનો કાર્યસાધક પ્રયત્ન આપણે કરતા નથી. આજે ગુજરાતમાં તેમજ આપણા દેશમાં, ચોમાસામાં જગી નીકળતા બિલાડીના ટોપની પેઠે, ડામ ડામ ડ્રાલેને બલી કરવામાં આવે છે. વિધાપીઠો ઉલ્લંઘન કરવાના પ્રયત્નો થતા જેવામાં આવે છે. એ બધી સંસ્થાઓમાં જુદા જુદા હુન્નર ઉદ્ઘોગોના નિષ્ણાતો તૈયાર થશે; પણ સાચા નાગરિક ધર્મની સમજણું તથા તે ધર્મને અનુસરવાની વૃત્તિ એ નિષ્ણાતોમાં પેદા થાય એમ કરવાનો કેાંઈ કાર્યસાધક વિધિ આપણે વિચારેં છે ખરો ?

આજે આપણી આગળ ઢગલાયંધ કામ પડયું છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં, કરવાનાં કામને વિવિધ દાખિફાળુથી જોઈ તપાસી તે જડપથી અને કાર્યસાધક રીતે થાય એવી વ્યવસ્થા કરવાની શક્તિવાળા, જે પણ કામ કરે અને બીજા પાસેથા પણ કામ લે, જેની તેની શક્તિને યોગ્ય કામ સોંપે અને એ બધું કરવા છતાં મનમાં અભિમાન ન આણે એવી નિષ્કામ સેવાવૃત્તિ ધરાવતા નેતાઓ આપણી પાસે છે ? કુલહાર પહેરવા ગરદનો લંબાવતા, છટાદાર વક્તવ્ય શક્તિ ધરાવવારા અને

સત્તાનાં સ્થાનના લોભી નેતાઓ તો જોઈએ તેટલા છે, પણ ખરા નેતાઓ એટલે કે ખરા સમાજસેવકોની ધર્ષણી તંગી છે. આ કિરિયાદ માત્ર આપણું દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. અણુચિંતની અડચણું આવી પડતાં તેમાથી ઉકેલ કાઢવાની સુઝવાળા, આંતર છોલવાળા આદમીઓ આજે કેટલા થોડા છે? પ્રસંગમાં આવતા માણુસોના સ્વભાવની પરખ કરવાની શક્તિ કેટલા થોડા આદમી ધરાવે છે? જડપી નિર્ણયો લેવાની શક્તિ કેટલા થોડા આદમીમાં હોય છે! ખરા શિસ્તનું ભાન તથા શિસ્ત પાળવાનો આગ્રહ કેટલા થોડા આદમીમાં જોવામાં આવે છે। ઉદાર જેલદિલીને ગદલે ઠામ ઠામ ખોદણી અને હરીકુને શક્તિથી નહીં પણ પ્રપંચથા હેડો પાડવાના પ્રયોગો લોડા ઠામ ઠામ કરતા જોવામાં આવે છે અને તીવ્ય હરીકાઈના હાલના જમાનામાં દરેક જણું પોતાને જ માટે જીવતો હોય તેમ જીવે છે; એટલે સહકાર વૃત્તિનો તો લોપ જ થયો જણ્યાય છે.

ઉપર જણુંબેલા ગુણો માણુસાધને દિપાવનાર છે. એવા ગુણોનું આરોપણું કરદું એ કેળવણીનો ખરા હેતુ હોવો જોઈએ. શાળા-કાલેજના શિક્ષણ-ખર્દાની ચાર દિવાલો વચ્ચેના ઠંડા વાતાવરણમાં આવા ગુણોનો વિકાસ થવો શક્ય નથી. માણુસાધના આ ગુણો જિપદેશ કે વ્યાખ્યાનોથી નહીં, પણ જીવંત વ્યક્તિઓના સંસર્થી, જીવનમાં અથડાતાં, કુટાતાં મળતા અનુભવથી પ્રાપ્ત થાય છે.

પણ એ તો જીવનમાં પડ્યા પછીની વાત થઈ. જીવનની પૂર્વતીયારી રૂપે એવા ગુણોનો વિકાસ સાધી શકાય ખરા? રમતનું મેદાન અને તેનાથી પણ વધારે સુભ્યવસ્થિત વ્યાયામશાળા વ્યક્તિમાં આવા ગુણોનું આરોપણું કરવાની કાર્યસાધક શાળા થઈ શકે એમ છે. રમત દરમ્યાન રમનાર રમતમાં જોવો તો એકરસ થઈ જય છે કે તે સમય પૂરતું તો રમત અતું ખરું જીવન બની જય છે. વેપાર ધંધામાં નફો મેળવવાના પીઠ ધંધાદારીઓના

હેતુ નેટલો જ રમતમાં સક્ષળ થવાનો હેતુ રમનારને માટે ખરો અને સળવ બની જય છે. રમતના ઉશ્કેરાટ, ઉત્સાહ તથા ગરમી રમનારના આંતરને વિકસાવી જુદી જુદી અસરોની છાપ લેવા માટે તૈયાર બનાવે છે.

આવા વાતાવરણમાં વ્યક્તિઓ પોતાની આસપાસ જિબો કરેલો કૃત્રિમતાનો પડ્દો ખસી જય છે અને તે તેના ખરા સ્વરૂપમાં રજુ થાય છે. આવી રીતે સંસર્ગમાં આવતી વ્યક્તિઓના સ્વભાવની પરખ કરવાના પ્રસંગો રમતના મેદાન પર મળે છે. તેવા ભાગ્યે જ ખીજે કોઈ સ્થળે મળે છે. જડપી નિર્ણયો કરવાના પ્રસંગો રમતના મેદાન પર સારા પ્રમાણુમાં હોવાથી તે શક્તિનો વિકાસ બહુ સારો સધાય છે. બાસ્કેટબોલ, કણણી, હોકી તથા કૂટબોલ જેવી સંઘ રમતોમાં એકનો એક જેલાડી, તે પછી ગમે તેવો હોશિયાર હોય તો પણ પોતાની જ હોશિયારી હેખાડવા ભથતો હોય તો અનુભવે જણ્યાય છે કે તેવી રીતથી આખરે તુકશાન થાય છે અને હાર ખમવાનો પ્રસંગ જિબો થાય છે. અનુભવે એ પણ જણ્યાય છે કે એમ કરવાને ગદલે દરેક જેલાડી અમુક હદમાં કામ કરી, ત્યાર ખાદ ખીજ જેલાડીના હાથમાં રમતનો દોર સોંપી હે અને એવી રીતે સહકારમાં કામ કરે તો રમતમાં સક્ષળ થવાનો સંભવ વધારે રહે છે. આવી રીતે રમતના મેદાન પર જેલાડી સહકારનો પાડ પ્રત્યક્ષ અનુભવથી શરીએ છે; અને નેતાગીરી તથા આંતરઉકેલના ગુણો કેળવવાના પ્રસંગો તો રમતના મેદાન પર એટલા અધા મળે છે કે એ ગુણોની તાલીમ માટે તે બહુ કાર્યસાધક શાળા થઈ પડે છે.

ઉપર ને કહ્યું તેનો અર્થ એવો નથી કે રમતો દ્વારા વ્યક્તિમાં નવેસરથી આવા ગુણોનું આરોપણ થઈ શકે છે. કહેવાની મતલબ એવી છે કે, વ્યક્તિમાં એવા ગુણો અંકુર રૂપે હોય છે તો રમત દ્વારા બહુ સારી રીતે વિકાસ સાધી શકાય છે.

માણુસમાં માણુસાધના ગુણોનો વિકાસ સાધ-



સમૂહ વ्यાયામ

વાની અને તેમ કરી તેનું ચારિત્રય ઘડવાની શક્તિ વ्यાયામમાં છે તેથી વ्यાયામનો વ્યવસ્થિત કાર્યક્રમ ખરી ડેળવણીનો ખૂબ કાર્યસાધક વિધિ બની શકે. આથી જ વ्यાયામશાળા માત્ર અખાડો નથી, પણ એક સુયોગ્ય ડેળવણીની સંસ્થા છે. શાળા તથા ડેલેને દ્વારા મળતી ડેળવણીની ધણી તુટિઓ તે પૂરી શકે છે.

પણ આવાં પરિણામ લાવવા માટે વ्यાયામના હેતુઓ સ્પષ્ટ રીતે સમજ લેવાની અને તે પ્રમાણે વ્યાયામના આખા કાર્યક્રમમાં મૂળગત ફેરફાર કરવાની જરૂર છે. વ्यાયામનો સીધો સંખ્યાંધ શરીર જોડું છે અને તેના સીધી અસર શરીર પર થાય છે. એટલે સામાન્ય જનતા એમ માની લે છે કે વ्यાયામનો એકમાત્ર અથવા મુખ્ય હેતુ શરીર વિકાસ છે; પણ એ માન્યતા બરાબર નથી. આપણે આગળ જોયું તેમ વ्यાયામ ખરી ડેળવણી આપવાનો ખૂબ કાર્યસાધક વિધિ થઈ શકે એમ છે. ડેળવણીની વ્યાખ્યા એઠિ બાંધેલી હોવાને કારણે આપણે આવત સમજ શક્યા નથી. અત્યાર સુધી આપણે એમ જ માનતા આવ્યા છીએ કે માનસિક શક્તિ-આનો વિકાસ અને ઉપયોગી માહિતીઓનું લંડેળ એક્ઝું કરવું એ જ ડેળવણી છે. પણ મનુષ્ય કંઈ માત્ર મન નથી. એ તો શરીર, મન તથા આત્માની ત્રિમૂર્તિ છે. માનવજીવનમાં એવી ડોઈ પ્રવૃત્તિ નથી કું ને માત્ર તેના શરીર પર કે માત્ર તેના મન પર

જ અસર કરે. માનવજીવન એક અને અખંડ છે. તેના શારીરિક, માનસિક અને નૈતિક એવા ખંડ તો આપણે આપણી સગવડ ખાતર પાડ્યા છે.

જુના જમાનામાં વ્યાયામનો હેતુ શરીરવિકાસ લેખાતો હતો; એટલે તે જમાનાના અખાડાઓમાં શરીર વિકાસ તથા હરીએને કુસ્તીમાં હરાવવાની કળા એ જ તેની તાલીમમાં મુખ્ય અને મહત્વની બાધ્યતો હતી. આના પરિણામે ઉસ્તાદનું સ્થાન તેવી સંસ્થાઓમાં અહુ મહત્વનું હતું. ઉસ્તાદો પોતાના ચેલાઓને શીખવવામાં પક્ષપાત કરતા અને ધણ્યાવાર પોતાની વિદ્યા વેચતા. ધણ્યા ખરા ઉસ્તાદો પોતાનું મહાર નું સ્થાન જળવવા કસઅચોરી કરતા. જુદી જુદી વ્યાયામશાળાઓ વચ્ચે હરીકાઈના પરિણામે અદાવતો બંધાતી અને હરીએને હરાવવા માટે કળા કરતાં પ્રપંચ અને યુક્તિનો આશ્રય વધારે લેવામાં આવતો. આથી ખેલદિલીનો જુસ્સો પેઢા થઈ શકતો જ નહિ. શરીરવિકાસને વધારે પડતું મહત્વ આપવાને કારણે એ સંસ્થાઓમાં ચારિત્રય ઘડતર પ્રત્યે દુર્લ્લક્ષ આપવામાં આવતું. અખાડાઓમાં બિલત્સ ભાપા વપરાતી. વ્યસનો પર અંકુશ મૂકવામાં આવતો નહિ; એટસે અખાડા અનાચારના અખાડા થઈ જવા પાઢ્યા. શરીરવિકાસ એ પ્રદર્શનનું તથા નંબળાને સત્તાવવાનું ગુડાગીરીનું સાધન થઈ પડ્યો.

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની વિશિષ્ટતા એ છે કે તેણે શરીર-વિકાસને જ વ્યાયામનો એક માત્ર હેતુ ન માનતાં, માણુસમાં માણુસાધના શુણેનું આરોપણ કરી તેનું ચારિત્રય ઘડવાની તેની શક્યતા પિછાણી, ડેળવણીના કાર્યસાધક વિધિ તરફેની તેની કાર્યસાધકતાની કદર કરી અને તેના દ્વારા ચારિત્રયવાન, દેશગ્રેમી, નીડર અને સાહસિક તથા સેવાલાવી યુવાનો તૈયાર કરવાનો ઉદ્દેશ રાખી કામ કર્યું. વ્યાયામના આ હેતુને મહત્વ આપી કલાનું સ્વામીત્વ મેળવવાની બાધતને તેણે ગોળું સ્થાન આપ્યું.

આમ વ્યાયામ એ રાજ્યધરુતરનો કાર્યસાધક વિધિ છે, એ પ્રગતિશીલ રાજ્યોના સંચાલકો સારી ચેઠે સમજે છે. સમજને ઉપયોગી થવાની વૃત્તિ-વાળા તથા તેને માટે જરૂરી નાગરિક જવાબદારીના લાનવાળા ખુલાનો રાજ્યના સફળ વિકાસ અને પ્રગતિ-શીલ જીવન માટે કરોડરઙ્જુ સમાન છે.

સંપ્રત કાળમાં વ્યવસ્થિત વ્યાયામ કાર્ય-કર્મની નિતાંત આવશ્યકતા

૧૯૪૭માં સ્વતંત્ર ભન્યા પછી ભારતે સર્વોપરિ લોકશાહી પ્રજાસત્તાક શાસન અપનાવ્યું છે અને તે અનુસાર સર્વ પ્રજાજનને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે, વિચાર, વાણી, માન્યતા,



સમૂહ દોડનો આનંદ

આસ્થા અને ધર્મની સ્વતંત્ત્રતા મળે, પ્રતિષ્ઠા અને તકની સમાનતા મળે તથા રાજ્યની એકતા અને વ્યક્તિના ગૌરવને સાચનીને પ્રજાજનમાં ભાતૃત્વની લાવનાનો વિકાસ થાય-તેની બંધારણુમાં બાંહેધરી આપેલી છે. ભારતના બંધારણુની આ ભૂમિકાને નજર સમક્ષ રાખીને માનવીની શારીરિક, માનસિક, આવેગિક સામાજિક તથા આધ્યાત્મિક મૂળભૂત જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તથા સામાન્ય ડેળવણીની નીતિ, કાર્યક્રમ અને કાર્યવાહીનું અવસોધન કરીએ તો સ્પષ્ટ ભાલમ પડશે કે ભારતને આને જો કશાનો પણ જો સૌથા વધારે જરૂર

હોય તો તે તેના દરેક પ્રજાજનની સમગ્ર શક્તિઓના સર્વાંગી વિકાસની છે. સમગ્ર ડેળવણીના સુયોજિત અને સુસંચાલિત કાર્યક્રમ દારા આ જરૂરિયાતને ઉત્તમ રીતે પહેંચી વળી શકાય તેમ છે અને સમગ્ર ડેળવણીના આ કાર્યક્રમમાં વ્યાયામ અને રમતગમતો-એ નિતાંત મહત્વનો ફાળો આપવાનો હોય તે સહેલે સમજી શકાય તેવા બાબત છે.

પ્રાચીન સમયમાં આપણા પૂર્વજ્ઞોની શારીરિક પ્રવૃત્તિઓ માટેની જરૂરિયાત માટે ભાગે તેમના રોજંદા મહેનતકશ જીવનમાંથી સંતોષાતી. હવે આને વિજ્ઞાનમાં તથા સામાજિક વ્યવસ્થામાં વિકાસના પરિણામે આપણામાંના ધણ્ણા શારીરિક શક્તિ ખરચ્યા વિના પોતાનું રોજંદુ કાર્ય કરે છે અને કમાય છે. આમ હતાં પોતાનું વૃદ્ધ માટે તથા સ્વાસ્થ્ય જળવણી માટે દરેક જાળુને શારીરિક પ્રવૃત્તિની જરૂર તો રહે છે જી. વ્યક્તિ નેમ નેમ પોતાનાં શરીર અને મનને કસરત આપે છે, નવા વિચારો અને કૌશલ્યો પ્રાપ્ત કરે છે તથા તેમાં જીન અને કૌશલ્યાનો અસરકારક ઉપયોગ કરે છે તેમ તેમ તેમનો વિકાસ થાય છે.

અત્યારની આપણી સમાજ વ્યવસ્થાએ વ્યક્તિનો લાગણીગત અને જીનતંતુગત સ્થિરતા માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. આને ઉન્નત જીવન જીવન માટે વ્યક્તિએ સમાજ સાથે સુસંખ્યે ડેળવવા, પોતાના લાગણીઓને નિયમનમાં રાખવા તથા સ્વત્વપ્રગટીકરણુના માર્ગ મેળવવા શક્તિમાન બનાવું જોઈએ. અગાઉના ડોધ પણ સમય કરતાં આને વધારે લોડાને વધારે સમય ક્રાંતિ મળે છે; અને તેથી પોતાના કુરસદના સમયનો રચનાત્મક રીતે સદ્ગ્યોગ કરતાના માર્ગદર્શનની અત્યારે પારાવાર આવશ્યકતા છે. સુયોજિત વ્યાયામ અને રમતોનો સુસંચાલિત કાર્યક્રમ આ દિશામાં અત્યારે ઉપયોગી થવાની અનેકાનેક શક્યતાઓ ધરાવે છે.

વ્યાયામ પ્રવૃત્તિનું દ્યેય

ઉપરોક્ત દિશાએ વિચારતાં વ્યાયામ પ્રવૃત્તિનો

સુયોગ્ય કાર્યક્રમ કે જેને શારીરિક ડેળવણી તરફે ઓળખવામાં આવે છે તે સામાન્ય ડેળવણી સાથે સંબંધ ધરાવતો વ્યવસ્થિત અનુભવ છે, કે જે વ્યક્તિને તથા સમૂહને આંગિક જોમપ્રાપ્તિ, ઉપયોગી ગતિમેળ શિક્ષણું, ઈષ્ટ સામાજિક વલણુંનો વિકાસ તથા સર્જકું પ્રગટીકરણના આનંદની અનેક તક્ષે પૂરી પાડે તેવી પરિસ્થિતિ તરફ દોરી જવાનો પ્રયત્ન કરે છે. વ્યાયામનો પાયાનો કાર્યક્રમ એવા શરીરનું ધડતર કરવાનો હોયો જેઠાં કે જેમાં દેઢનું સૌષ્ઠવ હોય, તની બિન્ન અવસ્થા-ઓની સુસંવાદિતા હોય, હળવન્યલનમાં લાઘવ અને ચપળતા હોય, પ્રવૃત્તિઓમાં સામથ્ય હોય, તથા તેનાં સ્વાસ્થ્ય અને અંગતાંત્રિક વ્યવહારોમાં પ્રતિકારશીલતા હોય.

વ્યાયામ પ્રવૃત્તિનું ધ્યેય વ્યક્તિને સમૂહને શારીરિક દાખિયે ઈષ્ટ, માનસિક દાખિયે પ્રેરક અને સંતોષકારક તથા નૈતિક અને સામાજિક દાખિયે સંગીન એવા સંજોગોમાં કાર્ય કરવાની તક્ષે મળી રહે તેવી સુયોગ્ય સગવડો અને નિષ્ણાત નેતૃત્વ પૂરાં પાડવાનું છે. ટૂંકમાં વ્યાયામ પ્રવૃત્તિ એ માનવીનાં વૃદ્ધિ, વિકાસ અને વર્ત્નનાં મૂલ્યોને અનુલક્ષણોને પસંદ કરાએલી તથા સંચાલિત થયેલી શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા ડેળવણી આપવાની રીત છે અને તે સમગ્ર ડેળવણીના કાર્યક્રમનું પાસું હોવાથી તેતું ધ્યેય શાળા તથા મહાશાળાના અન્ય શૈક્ષણિક અનુભવો પાણણ રહેલા ધ્યેયની જેમ દરેક બાળક અને યુવાનનો આપણા લોકશાહી સમાજ માટેના જવાબદાર નાગરિક તરફે વિકાસ સાધવાનું છે.

વ્યાયામ પ્રવૃત્તિના હેતુઓ


વ્યાયામ ક્ષેત્રના વિશાળ કાર્યક્રમની અનેકવિધ પ્રવૃત્તિઓ અનુસાર તેના હેતુઓ પણ અનેકવિધ છે. આમ છતાં વ્યવસ્થિત વ્યાયામના ઈષ્ટ કાર્યક્રમમાં સ્વીકૃત થયેલા લઘુતમ હેતુઓ નીચે મુજબ ગણ્યી શકાય.

૧. મહત્તમ શારીરિક ક્ષમતાનો વિકાસ અને જાળવણી : શારીરિક ક્ષમતા ધરાવનાર વ્યક્તિ - અ. શરીરનાં વિવિધ તંત્રોની સંગીન અને આરોગ્યમય કામગીરી અનુભવે છે; બ. સુધારી શકાય તેવી ઝોડથી મુક્ત હોય છે; ક. બળ, સહનશક્તિ, ત્વરિત પ્રત્યાઘાત, ઝડપ, સમતોલનશક્તિ, ચપળતા, શરીરનો યોગ્ય ઉકાવ, તથા સુવ્યવસ્થિત અવયવો ધરાવે છે; ડ. પોતાની શારીરિક શક્તિ અને ઉંમરને અનુલક્ષીને શક્તિ-ઓનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથાં પ્રવૃત્તિ, દાર્ય અને ૨૦૦૮ વર્ષે સમતુલા જળવાઈ રહે છે; ઇ. પોતાની ન સુધારી શકાય તેવી ડેઢ ઝોડ હોય તો તે અશક્તિને બંધ બેસતું, સુખી અને ઉપયોગી જીવન જીવી શકાય તે દર્શિયે પોતાની અદર રહેલી શક્તિઓને વિકસાવવાનું શાખી લે છે.

૨. ઉપયોગી કૌશલ્યાનો વિકાસ : કૌશલ્ય-નિષ્ણાત વ્યક્તિ-અ સંક્ષણતાપૂર્વક અને સલામતી-યુક્ત જીવન જીવા માટે આવસ્યક એવાં અનેક મૂળભૂત કૌશલ્યો જેવાં કે ચાલવું, દોડવું, કૂદવું, ચૂકવવું, હાલતી ચાલતી વસ્તુઓનું માપ કાઢવું, જિચકવું વગરેમાં નિપૂણ હોય છે; બ. જીવનના દરેક પગથિયે શારીરિક અને સામાજિક ક્ષમતા વિકસાવવામાં કણો આપી શાંક તેવી અનેક પ્રવૃત્તિઓ જેવી કે, સાંધિક અને વૈયક્તિક રમતગમતો, તરફું, લોકનૃત્યો વગરે માટે તે શક્તિ ધરાવે છે.

૩. યોગ્ય અને સમાજમાન્ય વર્ત્ણાંકનો વિકાસ : યોગ્ય વર્ત્ણાંક ધરાવનાર વ્યક્તિ-અ ખેળદિલીપૂર્વક વર્તે છે; સમૂહના કલ્યાણ માટે કાર્ય કરે છે તથા પોતાના સાથીઓના વ્યક્તિત્વને માન આપે છે (સાંધિક રમતોમાં અને અન્ય સમૂહ પ્રવૃત્તિઓમાં આ ગુણોને અમલમાં દાખલવાની અનેક તક્ષે સાંપ્રદે છે.); બ. અનેક સામાજિક સંજોગોમાં તે યોગ્ય અને સ્વભાવિક રીતે વર્તે છે તથા કણો આપે છે. (મિશ્ર રમતગમતો, ગૃહ્ય, તરણ, તથા એવી અન્ય પ્રવૃત્તિઓ આ માટેના

શિક્ષણ અનુભવો પૂરા પાડવામાં સરસ સહાય કરે છે.); ક. માનસિક દાખિએ હિતેજી તથા ધખુલાવાર લાગણી માટે તીવ્ર એવી પરિસ્થિતિ દરમયાન સંયમ દાખવે છે; દબાણ આવતાં ત્વરિત અને ઉણપણુંકત પ્રત્યાધાત દરાવે છે; ડીંમતાજ તથા યુક્તિથાજ હોય છે (જે ચોંચ નેતૃત્વ હોય તો રમતો, સ્પર્ધાઓ તથા અન્ય હરીકાઈ પ્રવૃત્તિઓ આ ગુણો વિકસા-પવામાં મફદ કરે છે.); ડ. રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવે છે (દેશી રમતો, વ્યાયામ અને લોકનૃત્યો આ ગુણો તેળવવામાં ઉપયોગી નીવડુ છે.)



નૃત્યમય વ્યાયામ

૪. કલ્યાણકારી રસણતાનો વિકાસ :

૨ંજનનિપુણ વ્યક્તિ - અ. પ્રેરક, સર્જનાત્મક તથા આંતરિક સંતોષ આપે તેવી પ્રવૃત્તિઓનો પોતાના રોળંદા જીવનમાં સમાવેશ કરે છે; બ. અનેકવિધ ૨ંજનાત્મક શોખ, જાન, કદરદાની તથા કૌશલ્યોની પ્રાપ્તિ કરે છે.

કાર્યદક્ષ વ્યાયામ શિક્ષક પોતાને મળતી અનેક તકો પૈકી મોટાલાગની તકોનો ઉપયોગ કિશોરો તથા કિશોરીઓને તેમજ યુવકો અને યુવતીઓને તથા પુસ્તોને ઉપયુક્ત મૂલ્યો પ્રાપ્ત કરવામાં સહાય કરવા અર્થે કરે છે. તે બરાબર જણે છે કે વીર્યવાન, બળવાન અને ચારિત્રશીલ વ્યક્તિ સાધારણ સંનેગોમાં રાષ્ટ્રની મહાન સંપત્તિ છે અને કટોકટીના પ્રસંગે તો તેમની અનિવાર્ય આવસ્થકતા હોય છે. કોઈ પણ રાષ્ટ્ર માટે તેના સર્વ નાગરિકોનું સમગ્ર બળ તે રાષ્ટ્રની સલામતીનું રક્ષક હોય છે; અને સમગ્ર ચોંચતાના વિકાસમાં ચુંચોનિત વ્યાયામ અને રમતગમત પ્રવૃત્તિઓનો ઝાળો સૌથી વિશેષ હોય છે. મજબૂત અને બળવાન રાષ્ટ્રજી રાષ્ટ્રીય સલામતી અને આંતરાષ્ટ્રીય શુલ્કેચ્છા હાંસલ કરી શકે છે, તે કઢી ભૂન્ફું ન જોઈએ.



૧ : વ્યાયામ અને વૈષ્ણવી શક્તિ

હિન્દુ ધર્મશાસ્કો અનુસાર જગતની ઉત્પત્તિ માટે અલ્લાને, સ્થિતિ માટે વિષ્ણુને અને પ્રલય માટે મહેશને કારણુભૂત ગણવામાં આવે છે. જગતની સ્થિતિ એટલે સંરક્ષણું અને સંવર્ધન. વિષ્ણુની જે શક્તિ આ કાર્ય સંલાણે છે તે વૈષ્ણવી શક્તિ. આ વૈષ્ણવી શક્તિ ગુણોત્તું સંવર્ધન કરે છે અને વિકૃતિ તથા દુષ્ણોમાંથા સંરક્ષણું કરે છે.

વ્યક્તિના સ્વાસ્થ્યની દાખિએ વિચારીયે તો આ વૈષ્ણવી શક્તિ શારીરિક, માનસિક, સામાજિક તથા આવેગિક ક્ષેત્રે સ્વાસ્થ્યનું સંરક્ષણું અને સંવર્ધન કરે છે. વ્યક્તિ જેમ જેમ પોતાના શરીરને અને મનને કસરત આપે છે, નવા વિચારો અને કૌશલ્યો પ્રાપ્ત કરે છે તથા તેનાં જીબ અને કૌશલ્યોનો અસરકારક ઉપયોગ કરે છે તેમ તેમ તેની શક્તિઓનો વિકાસ થાય છે.

“ વ્યાયામ એટલે ધ્યેયને અનુલક્ષીને પસંદ કરેલી કસરતો અને અસરકારક રમત ગમતોનો સુસંચાલિત કાર્યક્રમ ”—એમ અર્થે ધર્મવાવામાં આવે તો નિયમિત વ્યાયામ કરનાર વ્યક્તિમાં વૈષ્ણવી શક્તિનો ભારોભાર વિકાસ થાય છે, જેના પરિણામે તેનાં અગો અને અંગતનો આરોગ્યમય અને કાર્યક્ષમ રહે છે; રોળંદા જીવન માટે જરૂરી શક્તિ અને અસાધારણું પ્રક્ષણોએ વધારાની શક્તિ મળી રહે છે; જીવન પ્રત્યે સ્વસ્થ દાખિ ડેળવી સમાજમાન્ય રીતે તથા એલદિલીપૂર્વક વતો છે તેમજ અન્યના કલ્યાણ માટે તત્પર રહે છે; સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદર ઢેળવે છે તથા કટોકટીના પ્રસંગે મનની સ્થિરતા જળવી હિંમત, ડહાપણું અને સમયસ્કુચકતા દાખવે છે. આ બધું કુની રીત બને છે તે વિગતે તપાસીએ.

૧. વ્યાયામ ક્ષારા શારીરિક વિકાસ : વ્યાયામની સીધી અસર તેમાં વપરાતી માંસપેશી ઉપર થાય છે. તેનાથી તેનાં ક્ષે, કાર્યશક્તિ અને પરસ્પર મેળમાં કામ કરવાની શક્તિમાં વધારો થાય છે. ખૂખીની વાત તો એ છે કે વ્યાયામમાં વપરાતી માંસપેશીઓને જ નહિ પણ આડકતરી રીતે અન્નનળીની ભીંતોના અંદર તેમજ શરીરની અંદરના ખીંચ ભાગોમાં આવેલી માંસપેશીઓા ઉપર પણ વ્યાયામની ઉત્તોજક અને હિતકર અસર થવા પામે છે. આ થવાથી પાચન સુધરે છે, કારણું કે પાચનનો આધાર નેટલો ખોગાક પર અરતા પાચક રસનાં



ચુદ્દ શરીર વિકાસ

જાત અને જથ્યા પર છે તેટસો જ ને કેળે તે અનુનનળીમાં આગળ ધંડલાય છે તેની ઉપર પણ છે. અનુનનળીની બીંતમાં આવેલી માંસપેશીઓએ દીલ્લા અને કુમળેર હોય તા તે ખોરાકને ગોઝ્ય અડપે આગળ ધંડલી શકે નહિએ; અને તેમ થતાં તે ખોરાક અનુનનળીમાં જોઈએ તે કરતાં વધારે સમય સુધી રહે અને પરિષ્ઠમાં સડવા માંડે. એજ રીતે મળના ડોડાર્પ મોટાં આતિરકાની બીંતની ચાંદર આવેલી ગાંસપેશીઓએ શિથિલ થઈ ગઈ હોય છે તા આદમીને કણનિયાત થવા પામે છે કણનિયાત મોટે લાગે નોકાંપણુંનો રોગ છે.

જ્યાપાગથા શરીરની માંસપેશીઓએ પર સીધી અસર થાય છે, એટલું જ નહિ પણ સાથે સાથે પરિણ, રક્તવહન, શ્વસન, મળોત્સર્જ તથા નાડી-તંત્રના કાર્ય ઉપર આડકલરી અસર થાય છે, કારણ કે એ બાંધાં કાગ કરનારાં અગો અથવા અંગ-સમુકોને ને કાગ કરલું પડે છે તેમાંનું અધો કરતાં વધારે કાગ તો માંસપેશીઓને એંગે કરવાનું હોય છે. શરીરના કુલ વજનનો અધો કરતાં કાંઈક વધારે લાગ માંસપેશીઓનો હોય છે. માંસપેશીઓએ વધારે કાગ કરે તો તેને વધારે પોથણું તથા વધારે ઓક્સિજનની જરૂર પડે અને તેમ થતાં લોપિના પ્રવાહના જથ્યા અને વેગમાં તેમજ શસન-કિયાના ઊડાણું અને વેગમાં વધારો થાય અને તેમ થતાં ફેસસાં અને લદ્યને વધારે નોર અને અડપથી કાગ કરલું પડે. વધારે કાગને એંગે ગાંસ-પેશીના દસ્યનું દહન થઈ જાય અને તેને ધસારો લાંબો એટસે તે ધસારાની ધાર પૂરવા વધારે પોથણ દસ્યની જરૂર પડે; તેમ થતાં ખાવાની રિચ થાય અને ખાંધિલા અનુનું પાચન થાય. વ્યાયામ એંગે શરીરના લુદા લુદા ભાગમાં આતેલો માંસપેશીઓને વિવિધ ગતિઓના મેળમાં કામ કરલું પડે તેથા જ્યાપાગથા નાડીતંત્રને પણ વધારે કાગ કરલું પડે છે. આ બધા વિવેચન ઉપરથી સમજાય છે કે શરીરનો અંદર ચાસતી રિવિધ ક્રિયાઓ કરનારાં એંગેને કસરત આપવાનો એક જ રસ્તો છે અને

તે વ્યાયામ છે. વ્યાયામ વગર બીજુ કઈ રીતે તમે તમારી હથ્ય, ફેસસાં, ગુર્દા, નાડીતંત્ર તથા પરિણ-તંત્રને વધારે અડપથી તથા વધારે નોરથી કામ કરવા રૂપ કસરત આગળ શકો તેમ છેના?

આમ વ્યાયામથી શરીરની અંદરનાં વિવિધ કાર્ય કરનારાં અંગો પર ઉત્તોજન અને હિતકર અસર થાય છે અને પરિષ્ઠમાં તેમની કાર્યશક્તિ વધે છે. અને પરિષ્ઠમાં શરીર વધારે કાર્યસાધક બને છે.

(૨) વ્યાયામ દ્વારા માનસિક વિકાસ :

ગાનધીએ માનસિકશક્તિ એટલે કે બુદ્ધિને નોર કુદરતનાં બળો પર કાણું મેળવ્યો છે અને તેમ કરીને પ્રાણુંસૃષ્ટિમાં ઊંસું સ્થાન મેળવ્યું છે. તેથા શરીરિક વિકાસ કરતાં માનસિક વિકાસ વધારે ઉપયોગી અને ચન્દિયાતો છે, એવી માન્યતા પ્રાપ્તિનિકાળથી જાંધારા પામાં છે.

ખરી વાત એ છે કે, શરીર તથા મન અન્યોન્યાથ્યા છે. (૧) ડોઈ કારણે શરીરની થવી જાઈએ. તેવી ગુદ્ધ ન થવા પામાં હોય તેવાં બાઃળડો માનસિક શક્તિએના વિકાસના બાળતમાં પણ પણાત હોય છે, એમ તેટ્ટાઈટની શાળાએમાં હોઈએ અને સ્વિફ્ટઅલેન્ડ તથા જમ્બનીની શાળાઓમાં ગોડિન તથા શ્રીડીરે કરેલાં અવલોકનો પરથી સિદ્ધ થયું છે. (૨) પણાત જણ્ણાતાં બાળંડામાં ભણુતરનો સમય એછો કરી ક્રાન્સ પડેલા સમયનો ઉપગોપન રમતો રમતો ગાંધારાના કરવાથી તે બાળડાનાં શરીર સુધ્યાં, એટલું જ નહિ પણ તેમના માનસિક વિકાસમાં પણ પ્રગતિ થયેલી જણ્ણાઈ. (૩) નિમારીથા શક્તિઓ હીથી થયેલી જણ્ણાય છે અને માનસિક બેનની અસર શરીર પર થાય છે. માનસિક બાધાઓના ઉપગારમાં રમતોનો સફળતથા ઉપયોગ થયો છે.

સ્મૃતિ, કલ્પના, તક, વિચાર એ હિન્દી માનસિક શક્તિઓ ગણ્ણાય છે. આદમીને ને ઈન્દ્રિય-

બોધો અને અનુભવે થયા હોય છે, તે તેની સ્મૃતિઓનાં મિશ્રણ અને કદ્યનાનો કાટમાલ છે. કાટમાલમાંથી સાહિત્ય અને કળાનું સર્જન થાય છે વિચારનો પાયો પણું ઈન્ડ્રિયબોધો અને અનુભવોની સ્મૃતિઓ છે. વિજ્ઞાનની શોધેના મૂળમાં અવલોકના કુદરતના દસ્યોના ધનિદ્રયબોધો જ હોય છે. ઈન્ડ્રિયબોધો નાડીતંત્ર ઉપર છવાય છે અને એ હાપો સ્મૃતિઓપે ઉત્પન્ન થાય છે. આ જેતાં જીંચી માનસિક શક્તિઓનો પાયો વ્યક્તિને થતા ઈન્ડ્રિયબોધ અથવા અનુભવો છે. એવા ધનિદ્રયબોધો અને અનુભવોનું ક્ષેત્ર નેમ વિશાળ તેમ જીંચી માનસિક શક્તિઓના વિકાસની મર્યાદા વધારે વિશાળ બને છે નેમ આદમી વધારે દરે, વધારે પર્યાટન કરે તેમ તેના અનુભવોની મર્યાદા વધે છે; અને પરિણામે તેની માનસિક શક્તિઓના વધારે વિકાસ શક્ય બને છે.

રમતો દરમ્યાન રમતારને સાથીદારોના માનસનો પરિચય થાય છે એથી જ નહિ પણ રમત દરમ્યાન જિસા થતા વિવિધ પ્રસંગોએ અડપી નિર્ણયો થાંખવાની, બ્યૂડરચના કરવાની તથા વ્યવસ્થિત રીતે પરસ્પર સહકાર કરવાનો મહાવરો થાય છે. આર્થિક માનવસ્વભાવનો પરિચય થાય છે એથી જ નહિ પણ તેની પરીક્ષા કરવાની શક્તિ વધે એ અને એ રીતે વ્યવહારકુશળતાની ડેણવણી મળે છે.

આવી રીતે વ્યાયામ માનસિક શક્તિઓના વિકાસમાં કિંમતી દ્રાગો આપે છે.

(૩) વ્યાયામ દ્વારા ચારિત્ર ઘડતર

શિક્ષણના ખીલ ડેઈપણ વિપ્યક્તિ કરતાં વ્યાયામ પ્રવૃત્તિમાં ચારિત્ર શિક્ષણુની શક્યતા ધણ્યા વધારે પ્રમાણુમાં જોવામાં આવે છે. રમત-વ્યાયામ દરમ્યાન બાળકોમાં ખૂબ ઉત્સાહ તથા ઉમંગ હોય છે. તેઓ પોતાની ઉમરનાં ધણ્યાં બાળકોના સહવાસમાં આવે છે. સંઘળા સંઝેગો ખૂબ પ્રેરક અને

ઉત્તોજક હોય છે. માત્ર પોતાના જ આનંદ તથા સુખનો વિચાર કરવો, સાચું જ બોલવું હે તુરતનો લાલ મેળવવો, જુહું બોલવું, ગમે તેમ કરીને સારા કે માઠ ઉપાયેથી જીતવું કે ન્યાય અને નિયમને વળગી રહી પોતાની હેશિયારીના બળે જીતવું, પ્રપંચનો આશ્રય લેવો કે નહિ; પક્ષના હિતના કારણે પોતાની મહત્વાકાંક્ષા જતી કરવી કે ક્રમ-આવા જટાજટ નિર્ણય માગતા પ્રશ્નો રમતના મેદાન પર જિસા થાય છે. વર્ગના ઓરડાના કંડા અને નિયંત્રિત વાતાવરણુમાં એવા પ્રસંગો બાળયે જ મળવા સંભવે છે. કુશળ વ્યાયામશિક્ષક રમતો દરમ્યાન પોતાના વર્તનથી, દીકા, સૂચના કે ઉપદેશથી તથા ખીજ રીતે બાળકોને નિઃસ્વાર્થ બનવાની, નખળાને મદદ કરવાની, ભાતૃભાવ તથા પ્રેમ ડેળવવાની, ન્યાયવૃત્તિ તથા સરચાઈ ડેળવવાની, પક્ષને વફાદાર રહેવાની તથા સહકાર વૃત્તિની તાલીમ આપી શકે છે. વળી એ ઉપરાંત રમતો દરમ્યાન નેતાજીની શિસ્ત, આજાધારકતા તથા વ્યવસ્થાશક્તિ ડેળવવાની સુંદર તર્ફી મળે છે. ઉપર જણાવેલા પ્રસંગોમાં બાળકો માત્ર ડેઈનાં દોરાન્યાં નહિ, પણ સ્વયંસ્કૃતિથી પોતાની જતને દોરવણી આપી વતો એવી ટેવો પાડી શકાય છે. સારા તથા માઠ અનુભવોથી સમૂહમાં સંકળતાથી કામ કરવા માટે કયા ચુણો જરૂરી છે, તેની તેને સમજ પડે છે અને અસામાનિક વૃત્તિઓ ખુદી થાય છે; અથવા સાવ ધસાઈ જય છે.

(૪) વ્યાયામ દ્વારા બાળગુનાવૃત્તિનું ઉંબી-કરણું

આને વિશ્વના દરેક દેશોમાં વિદ્યાર્થીના અશિસ્ત તથા વિદ્યાર્થીઓનાં તોઢાને અને ગુનાઓ વિષે આપણે ધણ્યું ધણ્યું સાંભળોએ છીએ. અમેરિકાની ડેડરલ પણુરો ઓઝ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર જેન એડગર ફુલર જણાવે છે કે અમેરિકામાં ગુનાઓનું પ્રમાણું વધતું જય છે અને જલ્દી તથા આનંગી શિક્ષણ પાણી જેટલાં નાણું ખર્ચાય છે



રમતગમતમાં તન્મય

તેનાથી ચાર ગણ્યું નાણ્યું ગુનાઓ પાછળ ખર્ચય છે. ધરપકડ અંગેના રોજના અંકડા દર્શાવે છે કે હું કરતાં પણ વધારે ગુનેગારો ૨૧ વર્ષથી નીચેની ઉમરના હોય છે. ગઈ કાલે બાઈસિકલ ચોરનાર ખુવાન આને મોટર ચોરતો થાય છે તથા બેન્કો પર તેમજ વેપારી પેઢીઓ પર ધાડ પાડે છે. અમેરિકાની રાષ્ટ્રીય ડેંચેસના શક્ષણું અને મજૂર પ્રશ્નો અંગેની સમિતિના હેવાલ મુજબ સૌથી વધુ ખાળ ગુનાઓ ૧૭ વર્ષ્યાં ૪ માસની ઉંમરે થાય છે તથા બાળગુનાઓની શરદ્યાત સરેરાશ ૮ વર્ષ્યાં ૭ માસની ઉંમરથી થાય છે.

બાળ ગુનાઓની આ વિકટ સમસ્યા સંબંધમાં વ્યાયામ અને રમતો શું કરી શકે? બાળક ગુનો કરવા પ્રેરાય છે તે માટેનાં મુખ્ય કારણો વિચારીએ તો હોઈ પ્રવૃત્તિનો અભાવ, પ્રેરક અને સાહસિક કાયનો અભાવ, હોઈ સંસ્થા સાથે આત્મિયતાની

ભાવનાનો અભાવ, તેની કાયં તમનના તથા શક્તિના આવિલ્લાવ માટેની તકનો અભાવ આ બધાં કારણો જવાબદાર હોય છે. યુવાન પ્રવૃત્તિ માગે છે; તેને સાહસ જોઈએ છે; તેને હોછ મંડળાના કે સંધના સભ્ય હેવાના ખેવના હોય છે. જો વ્યાયામ અને રમતગમતો માટે વિપુલ સાધન સગવડો અને ચોગ્ય નેતૃત્વની જોગવાછ હોય તો સામાન્ય યુવક-યુવતી માટે પોતાની નવરાશનો સમય ગાળવામાં તે ઉત્તમ રીતે મદ્દરસ્પ બની શકે. સંગીન શારીરિક પ્રવૃત્તિ-ઓભાં ભાગ લેવાની જો યુવક વર્ગ માટે હોઈ સગવડ નહિ હોય તો, પોતાની ઈચ્છાઓને સંતોષવા તે સ્વાસ્થાવિક રીતે શુના તરફ વળે છે. દરેક યુવક તથા યુવતીને હોડલું, ફૂદ્ધું, બાસ્કેટબોલ, વોલીબોલ, ઐડમિટન, ટેનિસ, તરખું, કુસ્તી વગેરે પ્રચલિત રમતગમતોમાં પોતાનું કૌશલ્ય દર્શાવવાની તીવ્ર ઈચ્છા હોય છે. તથી યુવક વર્ગ માટે આવી પ્રવૃત્તિઓભાં કૌશલ્ય દાખવવાની જોગરાઈ કરવી, તે

વ्यायाम અને વैધગુવી શક્તિ

દરેક સમાજનો જવાબદારી છે. કોઈ વિદ્યાર્થીને કોઈ રમતમાં કૌશલ્ય હોય તો તેમાં ભાગ દેવા તે પ્રેરાય છે તથા નવરાશના સમયનો મોટા ભાગ તેમાં ગાળે છે. વ્યાયામ અને રમતગમતોના વિવિધ પ્રકારોમાં પ્રવૃત્તિ, રસ, અને સાહંસિકતાનો થન-ગનાટ વિપુલ પ્રમાણુમાં હોય છે. રમત કલખો તથા સાંધિક રમતો મારક્ષતે કોઈ મંડળીના સભ્ય હોવાની ભાવના સંતોષાય છે. વળી પોતે કોઈક પ્રગતિ કે સિદ્ધિ હાંસલ કરી હોય છે, તેવો અનુભવ પણ તેને આમાંથી મળે છે, નેને પરિણામે જીવન ઈષ્ટ અને સહેતુક બની રહે છે.

(૫) વ્યાયામ અને વર્ત્માન જીવનની તંગ સ્થિતિ

ઈ. સ. ૧૯૦૦ની સાલમાં માનવજીતના ધાતકોની સાથે વર્ત્માન સમયના ધાતકોની તુલના કરીએ તો પ્રતીતિ મળશે કે તંગ સ્થિતિ માનવજીતને માટે જોખમકારક અને ધાતક છે. એ તો આપણે જાણુંછે કે ૧૯૦૦ની સાલમાં માનવજીતના અગ્રણી ધાતકો અનુકૂમે હતા : ન્યુમેનિયા અને ચન્કલ્યુઓન્ઝા, ક્ષય, અતિસાર, આંતરડાનો સોજે અને આંતરડાનાં ચાંદાં, ચેપારોગો, મોટા-મગજમાં રક્તસાવ તથા મૂત્રપિંડનો સોજે. હવે વર્ત્માન સમયમાં આ કુમમાં થાડો ફેરફાર થાય છે. હૃદયરોગોએ હવે અગ્રસ્થાન જમાવ્યું છે અને તે કુમમાં આવે છે ડેન્સર, ખાપરીની અંદરની રક્તવહન સંખ્યક ચંબણો, મૂત્રપિંડનો સોજે, ન્યુમેનિયા વગેરે. એ અંગે નોંધપાત્ર છે કે ન્યુમેનિયાનું સ્થાન જે પ્રથમ હતું તે હવે પાંચમું આવે છે અને હૃદયરોગો ને ચોથે સ્થાને હતા તે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. આ યાદીમાંથી એટલું માલમ પડે છે કે દાક્તરી વ્યવસાયે ચેપી રોગોને કાણું નીચે આણ્યા છે; પરંતુ હૃદય, રક્તવાહિનીએ તથા મૂત્રપિંડા સંખ્યક રોગો વધુ ફેલાયા છે, અગ્રેસર બન્યા છે તથા કાણું નીચે આણુવા મુશ્કેલ બન્યા છે. ધણું નિષ્ણાતો માને છે કે આ રોગોને

પરિણામે થતા મૃત્યુ માટે વર્ત્માન જીવનની તંગ મનઃસ્થિતિ જવાબદાર છે.

આજના કાંતિકારી જીવનની ઝડપી ઝૂચ સાથે સામાન્ય માનવી પોતાના જીનતંતુ તંત્રને તથા સંવેદનતંત્રને સુમેળમાં રાખવાને અશક્ત પૂરવાર થયો છે. તે પોતાની જતને ધિક્કાર, ચિંતા તથા લયમાંથી મુક્ત રાખી શકતો નથી. ચિંતામુક્ત બની જીવન માણુવાનું તેને માટે સુશ્કેલ બન્યું છે અને પરિણામે માનવી તેની પોતાની જીવનસરણીનો ભોગ બની રહે છે. આજના સમયની આંધળી દ્વારા સાથે તે મેળમાં રહી શકતો નથી અને પોતાની જતને મૃત્યુ તરફ હડસેલે છે. ધસમસ્તી શહેરી જીવનની વધતી જતી ઉશ્કેરાટલરી પરિસ્થિતિની સાથે સાથે હૃદયરોગો પણ વધતા જય છે. આરોગ્યમય જીવન જીવવા માટે માનવીએ તીપ્રસ્પર્ધાસુક્ત જીવન જીવવું ન જોઈએ તથા ધનના ગુલામ બની તેની પાછળ દ્વારા મૂક્ષી ન જોઈએ. પરંતુ તેને બદલે પોતાના કુદુંબ તથા પડોશી સાથે હળીમળાને જીવન માણુવું જોઈએ તથા રમતગમત દ્વારા રોજંદા જીવનમાંથી આનંદ મેળવતાં શીખવું જોઈએ.

વર્ત્માન જીવનની તંગ દશામાંથી સુક્તિ મેળવવામાં વ્યાયામ અને રમતગમતો અગત્યનો કણો આપી શકે છે. જ્યારે માનવી રમતગમતમાં પ્રવૃત્ત હોય છે ત્યારે પોતાની સર્વ ચિંતાએ અને ઉપાધિએ ભૂલી જય છે અને પરિણામે માનસિક અને શારીરિક તંગદશામાંથી સુક્તિ મેળવે છે.


વ્યાયામ તથા રમતગમતો શાળા તથા કોલેજ જીવન દરમ્યાન જ હોઈ શકે અને તે પછી નહિ, યુવાનો માટે જ હોઈ શકે અને મોટેરાઓ માટે નહિ, એ માન્યતા ભૂલભરેલી છે. જતિ કે ઉમરના બેદભાવ વિના દરેક વ્યક્તિ માટે તેના સમગ્ર જીવન દરમ્યાન રોજંદા જીવનના એક અંગ તરીકે શારીરિક ડેળવણી અને રમતગમતનું સ્થાન અગત્યનું છે; અને સંપૂર્ણ તથા સમૃદ્ધ જીવન જીવવા

માટે સહાયક નીવડે તેવા અનેક થારીરિક, માનસિક અને સામાજિક લાભ તેમાંથી મળ્ણ શકે છે.

ઉપસંહાર

આ બધા વિવેચન ઉપરથી સહેને સમજશે કે ધૈર્યલક્ષી અને સુસંચાલિત વ્યાયામપ્રકારો અને

રમતગમતોના સંગીન કાર્યક્રમમાં સંજીવની શક્તિ રહેલી છે, જે વિદ્યાર્થોઓમાં વૈધ્યુવી શક્તિ વિકસાવે છે. આ વૈધ્યુવી શક્તિ જ સુખી સમૃદ્ધ જીવનની ચાવી છે. બાળકો અને યુવક-યુવતીઓની અનેકનિધિ પ્રવૃત્તિઓથી કિલ્લોલત્તી વ્યાયામ સંસ્થાઓ ખરેખર વૈકુંઠધામ છે.



બાળકોનું વૈકુંઠ ધામ

૩. વિવિધ વ્યાયામ પદ્ધતિઓઃ

તુલનાત્મક સમીક્ષા

શરીરને કસવા માટે આજે દુનિયાના જુદા જુદા દેશોમાં વિવિધ વ્યાયામ પદ્ધતિઓ પ્રયોગ છે. સ્વીડન નેવેંભાં સ્વીડિશ પદ્ધતિ પ્રચારમાં છે. જર્મની માં તે દેશની ખાસ વ્યાયામ પદ્ધતિ જર્મન પદ્ધતિનો ખાસ પ્રચાર છે. છંલેંડ તથા અમેરિકાની સેક્સન પ્રજાઓની ડેઢ ખાસ વ્યાયામ પદ્ધતિ નથી; પણ તેઓ પ્રાચીન શ્રીસના મર્દાની તથા મેદાની એકોને પસંદગી આપે છે. જપાનમાં સર્વત્ર જ્યુજુત્સુ પદ્ધતિનો પ્રચાર છે. આપણું દેશમાં ધણું પ્રાચીન સમયથી એક ખાસ વ્યાયામ પદ્ધતિ ચાહું છે અને તેમાં કેન્દ્ર સ્થાને કુસ્તી છે. એ આપણું વ્યાયામ પદ્ધતિને 'મહાવિદ્યા' એવું નામ આપવામાં આવેલું છે. આ ઉપરાંત સેન્ડોની પદ્ધતિ, ચ્યુલર તથા વેન્ફરની પદ્ધતિઓ, વજન ભયક્વાનો વ્યાયામ તથા પંદર મિનિટ વીશ મિનિટના અને એવા વિવિધ ટૂંક સુદૃદ્ધિઓ વ્યાયામોના પ્રચાર પણ વધારે એણા પ્રમાણમાં જેવામાં આવે છે. આ વિવિધ વ્યાયામ પદ્ધતિઓનાં ખાસ લક્ષણું તથા ગુણદોષની અગે સંક્ષેપમાં સમાલોચના કરીશું.

સ્વીડિશ વ્યાયામ પદ્ધતિ


સ્વીડનનો વતની પીઠર હેત્રી લિંગ આ પદ્ધતિનો ઉત્પાદક છે. પોતાના દેશનાં બાળકો તથા યુવાના તંદુરસ્ત અને સુદૃદ્ધ બને તથા પ્રસંગ આવ્યે પોતાની માતૃભૂમિનો, દુઃમનોનાં આક્રમણ સામે બચાવ કરી શકે એવી દેશપ્રેમભરી લાવનાથી

પ્રેરાધ તેણું પોતાની વ્યાયામ પદ્ધતિની યોજના કરી હતી.

આ વ્યાયામ પદ્ધતિના શાળોપયોગી, યુદ્ધોપયોગી અને વૈદ્યકીય એવા ત્રણ વિલાગ છે. પ્રથમ આપણે શાળોપયોગી વિલાગનો ર્થાના કરીશું.

શાળોપયોગી સ્વીડિશ વ્યાયામ :—આમાં ખાસ પ્રકારનાં સાધનો કે ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ શરીરને એવા પ્રકારની ગતિઓ આપવામાં આવે છે કે નેથી માથું, ગરદન, ધડ, હાથ તથા પગ વગેરે શરીરનાં જુદાંજુદાં અંગના સ્નાયુ-સમૂહો કસાય અને મજબૂત થાય. નીચે એ પદ્ધતિના વિવિધ વ્યાયામોની રૂપરેખા આપી છે.

(૧) પ્રારંભિક વ્યાયામ :—વગેરે એક કતારમાં જોઠવવાની, હરોળોનાં મુખ જુદી જુદી દિશામાં



સ્વીડિશ કસરતનો એક નમૂનો

ફેરવવાની તથા વિવિધ પ્રકારની કૂચનાં કદમ ભરાવવાની હીલચાલોનો સમાવેશ, આ મથાળા નીચે કરવામાં આવે છે.

(૨) કમાન વ્યાયામ :-આમાં શરીરના ધડને કમાનના આકારમાં પાછળી બાજુએ વાળવાનું હોય છે,

(૩) છાતીની પેટી કુલાવવાનો વ્યાયામ :- આમાં દોરડાં જાલી લટકવાની તથા જાંચે અફવાની હીલચાલોનો સમાવેશ થાય છે. એવી હીલચાલોથી છાતીની પેટીનું કદ વારાફરતી વધે છે તથા ધરે છે અને પરિણ્યામે તેના સ્થિતિસ્થાપકતા વધી તે કસરત કરનારની શસનશક્તિમાં વધારે કરે છે.

(૪) સમતોલનની કસરતો :-આવી કસરતોમાં એક ડેંબને પગે શરીરને સમતોલ રાખવાનું હોય છે. આવી કસરતોમાં બળ કરતાં શરીરનાં જુદાં જુદાં અંગોના સનાયુસમુહને પરસ્પર મેળમાં કામ કરવાની શક્તિની વધારે જરૂર પડે છે. આવી કસરતોથી શરીરનાં ઉઠાવ તથા ટટારી સુધરે છે.

(૫) ખલાની હીલચાલો અથવા હાથની કસરતો :-આમાં આખી ભૂલને આગળ, પાછળ તથા જાંચે જાયકવાની તથા નીચી કરવાની હોય છે. એવી હીલચાલોથી પાંસળીઓ જાયકાય છે અને છાતીની પેટી પહોળી થાય છે.

(૬) પેહુની કસરતો :-આમાં પેહુના સનાયુએની ગતિઓ છે અને તેથા તે કસાય છે. એ સનાયુઓ કસાવાથી પેટની અંદરના અવયવોને સારો ટેકા મળે છે; એટલું જ નહિ પણ તેના પર એકંદરે હિતકર અસર થાય છે.

(૭) ધડની પાર્શ્વગત હીલચાલો :-આમાં ધડને ડાબા કે જમણ્યા પડખા તરફ વાળવાની અથવા તો જોળ ફેરવવાની ગતિ આપવામાં આવે છે.

(૮) પગની હીલચાલ :-થાંકા પગની કૂલેદી

અશુદ્ધ લોહી વહી જનારી શિરાઓને આશાયેસ આપવાનો આ હીલચાલોનો હેતુ હોય છે.

(૯) દોરી પરથી કૂઢી જવાની હીલચાલ.

(૧૦) શસન હીલચાલ :-શસન તથા તેને સહાયકારી ગતિઓનો આમાં સમાવેશ થાય છે. વ્યાયામથી તજ થયેલી શ્વસનદ્વિયાને તેના શાંત સ્વરૂપમાં પાછી લાવવાનો આ વ્યાયામનો હેતુ હોય છે.

આ દશ વ્યાયામો ઉપરાંત ઘણી વાર સમતોલન કસરતો પછી કૂચ તથા દોડ ઉમેરીને અથવા ધડની પાર્શ્વગત હોલચાલો પછી છાતીની પેટી કુલાવનારા વ્યાયામની ડેલીક શ્રેણીઓ ઉમેરીને ઉપર જણુંવેલા કમમાં કાંઈક ફેરફર કરવામાં આવે છે.

ઉપર જણુંવેલા વ્યાયામના દરેક પ્રકારમાં સાદીથી માંડી વધારે અટપટી થતી હીલચાલોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. પછી ઉપલાબ્ધ પ્રકારના વ્યાયામમાં દરેકની સૌથી સાદી હીલચાલો લઈ એક ડોડા, પછી તેનાથી વધારે અટપટી હીલચાલોનો ખીજો ડોડા, એમ સૌથી સાદીથી માંડી સૌથી અટપટી હીલચાલ સુધીની એક એક લઈ કુમેકમે વધતી જતી હીલચાલોના ડોડા બનાવવામાં આવે છે. એક ડોડાની કસરતો પહેલાં દરેક વિદ્યાર્થીને કરતાં શીખવી, દરેકને તે બરાબર આવડી ગયા બાદ કેટલાક દિવસો સુધી તે પાકી થાય ત્યાં સુધી રોજ કરાવવામાં આવે છે. આવી રીતે એક એક ડોડાનો એક કે વધારે અઠવાડિયા સુધી ઉપયોગ કરવામાં આવે છે. એક ડોડાનો કસરતો બરાબર આવડી ગયા પછી તેનાથી જરા વધારે અધરી કસરતોનો ડોડા લેવામાં આવે છે. આ બધી કસરતો કરાવતી વખતે કસરત કરનારને તે તે કસરતના હુકમ આપવામાં આવે છે; અને તે કાને સાંલળેલા હુકમેને અનુસરી તે કસરતો કરવાની હોય છે. શિક્ષક કસરત કરે તે અંચે જેઠને કરવાનો રીત આ પદ્ધતિમાં નથી હોતી.

આ ઉપરથી જણુંશે કે આ વ્યાયામ પદ્ધતિની

મુખ્ય ખાસિયતો એ છે કે, તેની કસરતો ક્રમે ક્રમે સાંભળી માંડી અધરી સુધીનાં કસરતોના ડ્રાઇના રૂપમાં ગોડવેલી હોય છે તથા એ બધી કસરતો કસરત કરવામાં આવે છે. વળી આ પદ્ધતિમાં ને જે વિવિધ હીલચાલોનો સમાવેશ કરવામાં આવે છે, તે શરીરનાં જુદાં જુદાં અંગોને કસે એવી રીતે યોજેલી હોય છે તથા ને જે અંગો પર તેની અસર થતી હોય તેને અનુસરી તેનું વર્ગીકરણ કરેલું હોય છે.

આ પદ્ધતિના વ્યાયામને આપણે શિક્ષણુત્તમક (એડિયુકેટિવ) કહી શકીએ, કારણું કે તેમાં સાંભળેલા હુકમોને તૃરિત અમલ કરવાનો હોય છે. અને તેથી મગજને સારી તાલીમ મળે છે. વળી એ કસરતો અસુક નિશ્ચિત નિયમને અનુસરી ચોક્સસ ક્રમમાં ગોડવેલી હોય છે; તથા પણ તેવી કસરત કરનારને સારી તાલીમ મળે છે. શરીરને સીધું અને ટટાર રાખવાની બાબત પર આ વ્યાયામ પદ્ધતિમાં ખૂબ ભાર મૂકાય છે.

આ વ્યાયામ પદ્ધતિ શિક્ષણુત્તમક છે એટલું જ નહિ, પણ તેમાં ડાઇ પણ જતનાં ખાસ સાધન જોઈતાં નથી. તે શીખવી સહેલી છે તથા ધણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકી સાથે તે કસરત કરી શકે છે. બધી રીતે આટલા બધા ગુણો હોવા છતાં આ વ્યાયામ પદ્ધતિ કાંઈ દોષેથી મુક્ત નથી. તેના ડેટલાક સહેલે આંખે ચઢે એવા દોષ નીચે મુજબ છે.

(૧) આ પદ્ધતિમાં થતી હીલચાલો, અઝુક તથા ખૂણુદાર હોય છે. તાલુખ તથા ગોળ રેખા-ચામાં થતી હીલચાલોનો તેમાં અભાવ છે.

(૨) તેમાં વિદ્યાર્થીને ઈરાદાપૂર્વક ધ્યાન આપી, માનસિક તંગ દરશામાં બહુ વાર સુધી રહેવું પડે છે; તથા છુટથી અને તૃરિત ગતિઓથી મળતા આનંદથી તે વંચિત રહે છે.

(૩) સહનશક્તિ ખીલવવા માટે આ પદ્ધતિમાં જોઈએ તેથેથી ભાર મૂકવામાં આવ્યો નથી.

(૪) શરીરના ઉડાન તથા ટટારીની ચોક્સાઈ પર બહુ ભાર મૂકવાને પરિણામે આ પદ્ધતિએ તૈયાર થતાં છાકરાંઓમાં વધારે પડતી અઝુકાઈ તથા હદ બહાર છાતી કાઢી ચાલવાની તથા ચિલા રહેવાની ટેવ આવવાનો ભય રહે છે.

(૫) આ વ્યાયામ પદ્ધતિમાંની ધણી હીલચાલો કૃત્રિમ હોઈ નિત્ય જીવનમાં બહુ જોવામાં આવે એવી હોતી નથી.



ડંબેદસની કસરતો

આવા ગુણુદોષોવાળી પદ્ધતિ ઈંગ્લેંડ તથા અમેરિકાની ધણી શાળાઓમાં દાખલ થયેલી છે. આપણે ત્યાં પણ એ પદ્ધતિ ક્રેટલીક શાળાઓમાં ચાલુ છે. દંડા કવાયત (વોન્ડ ડ્રીલ્સ), વાંસ કવાયત (પોલ ડ્રીલ્સ) તથા ડંબેદસ કવાયત આનંજ રૂપાન્તરો છે.

છુટથી રમવાની મૈદાની રમતો તથા મર્દાની ઘેલો ઉમેરવાથી આ પદ્ધતિની અપૂર્ણતાઓ દૂર થવાનો સંભવ છે. આપણું આસન, લેજુમ તથા મગદળથી આ પદ્ધતિના વ્યાયામથી થતા લાલ

વધારે આનંદ્ધાયી તથા સંગીન રીતે આપી શકાય એમ છે.

અત્યાર ચુંધી વણુંવેલા શાળાપયોગી વ્યાયામ ઉપરાત આ પદ્ધતિમાં મુદ્દવિષયક તથા વૈદ્યકીય વ્યાયામનો પણું સમાવેશ કરવામાં આવ્યો છે. મુદ્દવિષયક વ્યાયામમાં લકડી, તલવાર તથા સંગીનની પટાણાજી (ઇન્સંગ), ઘોડેસ્વારી તથા ભીજી લસ્કરી કસરતોનો સમાવેશ થાય છે. પણું આ બાબતોમાં આ પદ્ધતિ ભીજી મુદ્દવિષયક વ્યાયામ પદ્ધતિથા ડેઈ ખાસ પ્રકારે જુદી પડતી નથી.

વૈદ્યકીય વ્યાયામ આ પદ્ધતિની ખાસિયત કહી શકાય. માલીશ તથા કસરતોથી અમુક રેંગો મટાડવાની રીતોનો એમાં સમાવેશ થાય છે.

જર્મન વ્યાયામ પદ્ધતિ

હેરિઝોન્ટલ બાર, પેરેલલ બાર્સ, વેલિંગ તથા સાઈડ હેર્સ, લટકતી કડીઓ તથા ટ્રેપિઝ, આ સાધનોથી કરવાની કસરતો જર્મન વ્યાયામ પદ્ધતિની ખાસિયત કહી શકાય. ખરં જેતાં જર્મનો જ આ સાધનોથી કરવાની કસરતોના આદ્ય પ્રયોજનો છે.

આ ભારે અને સંગીન પદ્ધતિસરના વ્યાયામ ઉપરાત જર્મન વ્યાયામ પદ્ધતિમાં ખીજાં પાંચ અંગોનો સમાવેશ કરવામાં આવે છે. તે નીચે સુજખ છે :—

(૧) ફૂચ :— આમાં ફૂચના વિવિધ પ્રકારોનો સમાવેશ થાય છે.

(૨) છૂટી કસરતો :— લાંબા-ટ્રૂંકા દંડ, ડંફેલ્સ, જિડી કડીઓ, તથા મગદળ જેવાં સાધનો હાથમાં લઈ કરવાની કસરતોનો આમાં સમાવેશ થાય છે.

(૩) નાચનાં પગલાં :— નાચનાં સાદાં પગલાંથી માંડી નિપુણ ચૃત્ય કરનારનાં અટપટાં પદ્ધવિન્યાસ તથા અંગવિક્ષેપનો સમાવેશ આમાં થાય છે.

(૪) લાંબો તથા જિંયો ફૂદકો, દોડ, ગોળાદેંક, બરધીદેંક, વાંસકુદકો, તરવું, લકડી, કુસ્તી, તીરંદાજ વગેરે મર્દાની ઘેલો.

(૫) મૈદાની રમત ગમતો.

આ ઉપરથી જણાશે કે જર્મન વ્યાયામ પદ્ધતિમાં સંગીન વ્યાયામ ઉપરાત સર્વો પ્રકારના



મગદળની કસરતો

મૈદાની તથા મર્દાની જેલોનો સમાવેશ થાય છે. સંગીન વ્યાયામ માટેનાં સાધનો હેરિઝોન્ટલ તથા પેરેલલ બાર્સ અને વોલ્ટિંગ હોર્સ અથવા ધોડા એ તેમનાં જ યોજેલાં સાધનો છે.

જર્મન સંગીન વ્યાયામની કસરતોમાં શરીરનો ભાર હાથ તથા ખલા પર તોલાય છે શરીર ગોળ ચક્કર ફરતું હોય, કે જોલાં ખાતું હોય કે ઉછાળાને ડાખી કે જમણી ખાલુ પડતું હોય તે સૌ પ્રસંગે તેમજ શરીરને સીધા કે જલટા સમતોલનમાં રાખવાની થતી ગતિઓમાં મેટે લાગે હાથનો જ ઉપયોગ થાય છે. આમ હોવાથા આ વ્યાયામથી છાતી તથા ખલાના સનાયુઓની સારી ખીલવણી થાય છે તથા શરીરની સમતોલ રહેવાની શક્તિ પણ સારી ઢેળવાય છે. સ્વીડિશ વ્યાયામ પદ્ધતિના વૈદ્યકીય વ્યાયામ સિવાયના ધણું ખરા ભાગનો આ પદ્ધતિમાં સમાવેશ થઈ જય છે.

આ પદ્ધતિમાં વ્યાયામ કરનારનાં ઉંમર તથા જીતને અનુકૂળ થાય એવી રીતે વ્યાયામ યોજવામાં આવેલો છે. છ થા દશ વર્ષની વયનાં બાળક-ભાગિકા-એ વિવિધ સાદી રમતો, સાદી છૂટી હિલચાલો, વિવિધ ફૂદકા, દોરડાં આલી ચંદ્રાની કસરતો તથા વ્યાયામનાં સાધનો પરતી મૂળભૂત પ્રારંભિક કસરતો કરે છે. ઉંમર વધતી જય છે, તેમ તેમ તેને કરવાનો વ્યાયામ વધારે અટપટો અને અધરો થતો જય છે. પટાળાળ છેક ઉપલા વર્ગેમાં શીખવવામાં આવે છે.

જર્મન વ્યાયામ પદ્ધતિમાં મૈદાની રમતોને મૂળથી જ સ્થાન બાપવામાં આવેલું છે. પણ ૧૮૮૧ની સાલથી જર્મન યુવાનો એમાં અસાધારણું રસ લેતા થયા છે. ૧૯૧૪ના મહાયુદ્ધ પછી મૈદાની જેલોમાં યુવાન જર્મન ઝી પુરુષો બહુ મોટી સંખ્યામાં લાગ લેતાં થયાં છે; અને દ્યાલેંડ્યા દ્યાખલ કરવામાં આવેલાં કિંટ, ફૂટબોલ તથા નૌચાલનમાં અતિરાય રસ લેવાને પરિણામે, જર્મન

પ્રભનું લક્ષ સંગીન વ્યાયામ પર પહેલાનાં કરતાં એણા પ્રમાણુમાં એકાત્મ થયેલું જણ્ણાય છે.

જર્મન વ્યાયામ પદ્ધતિની એક વિશેષતા એ છે કે વ્યાયામ શિક્ષણું સાથે સંગીતનો હંમેશાં ઉપયોગ કરવામાં આવે છે.

સંધ વ્યાયામના સર્જડા પણ જર્મનોને જ



વૈજ્ઞાનિક કસરતો

ગણી શકાય. ૧૮૧૧માં ક્રીડરીખ લુડવિંગ જહાને બર્લિનની પાસે આવેલાં પાઈનનાં વનમાં તેની 'ટર્નાલ્ફાટ્ઝ'ની અથવા 'ટર્નરો'ની પહેલી દુક્કડી જભી કરી હતી. એ દુક્કડીના સભ્યે જંગલ પ્રદેશોમાં સ્વચ્છાં બ્રમણું કરતા અને જોસદાર તથા લડાઈને મળતી આવતી રમતો રમતા. જહાનની હીલચાલનો હેતુ જર્મનીના બચાવ માટે સ્વધારણાં જભી કરવાનો હતો. ૧૮૧૮માં આખા પ્રશિનામાં આખી ટાળીઓ માટે અનુકૂળ ક્ષેત્રો જિલાં કરવાની યોજના ઘડાઈ, પણ એ ટાળીમાંના એક સભ્યે કરેલા ડોષ અમલદારના ખૂનને પરિણામે એ મંડળીઓની પ્રવૃત્તિ પર કડક નિષેધ મૂકાયો.

જર્મનીની સંધ વ્યાયામની આ હીલચાલ 'સ્લાવ' જીતને બહુ ગમી ગઈ અને ૧૮૧૪ ચુંધી તથા મહાયુદ્ધ પત્યા પછી દર પાંચ વર્ષે તેમના ખાસ સમપોષાકમાં (ખુનિઝેર્માં) સંજ થઈ જોડાસ્લોવેક્ઝિયાના પાટનગર પ્રાગમાં એ 'સોઝાલો' ધણી મોટી સંખ્યામાં એકઢા થઈ સંધ કવાયત તથા સંધ વ્યાયામ કરે છે. આ

સંધ કવાયત તથા વ્યાયામમાં વીસ વીસ હજર નેટલા સભ્યો એક્ઝા સાથે ભાગ લે છે. શ્રીઓનાં અલાયદાં ‘ સોઝોલ મંડળો ’ હોય છે. તેમનો આ પંચવર્પીંય સમારંભ પાંચ છ દહાડા ચાલે છે. સંધ કવાયત અને સંધ વ્યાયામ ઉપરાંત ડેરિઝેન્ટલ બાર, પેરેલલ બાર્સ, વોલ્ટિંગ હેસ્ટ તથા વિનિધ મર્દાની એલોમાં તેઓ વ્યક્તિગત તેમજ ટોળીખ્ખદ્ધ થઈ સ્પર્ધામાં જિતને છે. સ્ક્રુથ થયેલા હરીફેની ટોળીઓને માળા તથા પ્રમાણુપત્રના ઇપમાં ઠનામો આપવામાં આવે છે.

જમ્ભનીમાં આવી ટોળીઓના સભ્યો ‘ ટન્રો ’ કહેવાય છે અને તેમના સમારંભ ‘ ટન્રેસ્ટ ’ કહેવાય છે. એમાં એ વર્ગના સભ્ય હોય છે. પહેલા વર્ગમાં ઊંઠી થી ૧૬ વર્ધની ઉમરના સભ્યો હોય છે અને ખીંચમાં સોણથી ઉપરનો ઉમરના સભ્યો હોય છે. દરેક વર્ગને અમુક નાના વિલાગોમાં વહેંચો નાખવામાં આવે છે અને તેવા દરેક નાનો વિલાગ ‘ સ્કવેઅ ’ કહેવાય છે. દરેક ‘ સ્કવેઅ ’નો એક નાખક હોય છે. પોતાની ટોળીના દરેક સભ્યને બને તેથ્યો વધારેમાં વધારે નિષ્ણુત કરવાની તથા દ્યાર અને સીનેદારીથી ચાલતો થાય એમ કરવાની જવાબદારી તેને શિરે હોય છે. આ સ્થળે એક વાત વાત યાદ રાખવાની જરૂર છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં દુંગલેંડ તથા અમેરિકાના યુવાનો સ્વેચ્છાએ રમવાનો મૈદાની રમતોમાં ભાગ લેતા હતા ત્યારે જમ્ભન યુવાનો તેને બદલે શરીરને કસનાર તથા ન્યવહારે રીતે યુદ્ધોપયોગી વ્યાયામમાં લાગ્યા રહેતા હતા; અને તેમાં તેમના છવનનાં ઉત્તમ વર્ધોના ઉત્તમ કલાકો વ્યતીત થતા હતા. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધના આરંભમાં જમ્ભન સેનાએ બાતવેલી અદલુત કાર્યક્રમતાનો આધાર તેમણે લીધેલી ઉપર જથ્થુવેલા પ્રકારની તાલીમ પર હતો.


મર્દાની એલો (એથ્લેટિક્સ)

મર્દાની એલોમાં માટે ભાગે સ્પર્ધાત્મક વૈધિકિક

એલોનો સમાવેશ થાય છે. લાંબો ફૂદકો (લેંગ જંપ), લાંબો ફૂદકો (હાઈ જંપ), લાંબી ટૂંકી ટ્રાઇ, વિઘ્ન-હ્રાઢ (એથ્લેટિકલ રેસ), વજન ફેંક (પુટીંગ ધ શોટ), બરછી ફેંક (નેવેલીન થ્રો,) તીરદાઢ, ઘોડેસ્વારી, કુસ્તી, પટાબાળ, વગેરે વ્યાયામોનો સમાવેશ આ વર્ગમાં થાય છે.

આ જતનો વ્યાયામ, પ્રાચીન શ્રીસમાં, બહુ પ્રચલિત હતો. જહેર તહેવારોને દિવસે આવી જતના એલો એલવાનો તે દેશમાં રિવાજ હતો. આવા એલો માટે યુવાનો તૈયાર કરવા માટે ખાસ શાંખાઓ રાન્ય તરફથી સ્થાપવામાં આવી હતી. અને તેમાં યોગ્ય શિક્ષકોની નીમળુંક કરવામાં આવતી હતી. ડેળવણીના ક્ષેત્રમાં શારીરિક ડેળવણી ધણું અગત્યતું સ્થાન ભોગવે છે, એ વાત ગ્રીકો બહુ સારી રીતે સમજતા હતાં અને તેથો કરીને શરીરને ડેળવણું તથા બાળોની તેમજ ઉછરતા યુવાનોનાં આરોગ્ય અને શરીરખણ ટકાવી રાખવાં એ પ્રાચીન ગ્રીક ડેળવણીનો મુખ્ય ભાગ હતો. શ્રીસના તે સમયના યુવાનો દિવસના એ ત્રણું કલાક વિદ્યા-ભ્યાસમાં ગાળતા અને તેથ્યો જ સમય વ્યાયામમાં ગાળતા.

આને યુરોપમાં જમ્ભનીમાં મર્દાની એલોનો



પ્રાચીન શ્રીસમાં એથ્લેટિક્સ

સારો શોખ છે, અને જર્મનીને અનુસરી, તેને મળતી વ્યાયામ પદ્ધતિ જ્યાં જ્યાં દાખલ કરવામાં આવી છે ત્યાં ત્યાં આ પ્રકારના વ્યાયામ પર ખાસ લક્ષ આપવામાં આવે છે. સેક્સન કગતાં ટ્યુટન પ્રન્યાનોને આ પ્રકારનો વ્યાયામ વધારે પ્રિય જણ્ણાય છે.

મૈદાની એલો (સ્પેન્સ)

ખૂલ્હી હવામાં તથા મૈદાનમાં રમાતી સર્વ રમતોનો સમાવેશ આમાં થાય છે. ગેડીંડા, આટા-પાટા, કબ્બૂદી, ખોખો, લંગડી, આંબલીપીંપળી વગેરે અનેક મજની દેશી રમતોનો તેમજ કુટખોલ, હેંકી, બેઝ્બોલ, બાસ્કેટખોલ, કિકેટ, ટેનિસ, વોલીબોલ વગેરે પાશ્ચાત્ય રમતોનો સમાવેશ આ વર્ગમાં થાય છે. વ્યાયામના આ પ્રકારમાં બે તરવે આગળ પહુંચાં તરી આવે છે. એક સાંધિકત્વ અને ખીલું આનંદપ્રાપ્તિ. વ્યક્તિગત કરવાના કરતાં આ પ્રકારના વ્યાયામમાં ટાળીમાં કામ કરી પોતાના પક્ષ ખાતર જતનાં યશ તથા માનને જતાં કરવાની તથા પક્ષનાં માન અને ઉત્કર્ષને મારે પોતાની સર્વ શક્તિ પદ્ધતિસર વિકાસ કરતાં આનંદપ્રાપ્તિનો હેતુ વધારે આગળ પડતો હોય છે.

ઇંલેંડ તથા અમેરિકામાં આ પ્રકારનો વ્યાયામ વધારે લોકપ્રિય છે. આપણે આગળ નેયું ડે જર્મન વ્યાયામ પદ્ધતિમાં આ પ્રકારના વ્યાયામને પ્રથમથી જ સ્થાન આપવામાં આવ્યું હતું. પણ સંગીન અને પદ્ધતિસરના વ્યાયામની સરખામણીમાં તેનું સ્થાન ગૌણું હતું. છતાં ૧૮૬૧ પછી અને ખાસ કરીને મહાયુદ્ધ પછી આ પ્રકારના વ્યાયામનો શોખ તે દેશનાં યુવાન સ્ક્રીપુર્ખેને બહુ વધારે પ્રમાણમાં લાગ્યો છે; અને તે એટલે સુધી કે તેની સરખામણીમાં સંગીન વ્યાયામનો શોખ ગૌણું પદ લેતો થયો છે. મૈદાની એલોથી શરીરનું કદ વધે છે તથા બહુ નાની વયમાં સંગીન અને ભારે વ્યાયામ કર્યાથી શરીર ખડતલ થાય છે, પણ કદમાં વધતું નથી, એ માન્યતાને અનુસરી આજકાલ

જપાનમાં પણ આ વ્યાયામનો સારો પ્રચાર થઈ રહ્યો છે.

મર્દાની તથા મૈદાની એલોના ગુણ દોષની ચર્ચા

મર્દાની તથા મૈદાની એલોની બાઅતમાં નિષ્ઠુતોના એવો અભિપ્રાય છે કે વ્યાયામની શરીર પર થતી અસરની દર્શિએ, અથવા તેના જરૂરી વિકલ્પનાં દર્શિએ જેતાં આ પ્રકારના વ્યાયામ અચોક્સ પરિણામ આપવાવાળા તથા લાલના પ્રમાણુમાં સમયનો બહુ લોગ માગે એવા હોય છે. આ દર્શિએ એ પ્રકારના વ્યાયામ, શરીરના લુદા લુદા અવયવોના સનાયુંએ ઉપર શીખ અને ચોક્સ અસર કરનાર પદ્ધતિસર વ્યાયામની સરખામણીમાં ન્યૂન માલૂમ પડે છે. બેઝ્બોલની રમતમાં બધારની મર્દાં પર ચોક્સ કરનાર એલાડીએ તેમજ કિકેટનો એકસ્ટોપર કે લોંગ પરના એલાડીને બેકલાકની રમતમાં ખૂલ્હી હવા, ટાંટીઆતોડ તથા જમણ્ણા હાથ અને ખલાના થોડા વ્યાયામ ઉપરાંત વધારે લાલ હાંસલ થતો નથી.

અન્ય મૈદાની રમતોની સરખામણીમાં કિકેટ શરીરવિકાસની દર્શિએ બહુ જ ઓછી લાલદાયી છે એટલું જ નરહ પણ એમાં ખીંચ કેટલાક દોષ છે. એમાં સારા બોલર તથા બેટસમેનને તેમજ વિકેટ કીપર, તથા સ્લિપ, પોઇન્ટ, તથા કવર જેવાં અગત્યના ચોક્સ સ્થાનના એલાડીએ હુદ બહાર અમ વેટવો પડે છે, જ્યારે બાકીના રમતનારાએ ખૂલ્હી હવાના લાલ ઉપરાંત બહુ જ થોડો વ્યાયામ મળવા પામે છે. એ રમત ભારે તમાસાની હોવાથી રમવા કરતાં જેવી વધારે ગમે એવી છે; અને તેમાં લાગ લેનાર તમારો જેનાર મેદનીની વાહ વાહ મેળવવા ઘણું વાર હુદ બહાર અમ લે છે. એમ કરવાથી એના શરીરને વ્યાયામનો લાલ ન મળતાં અતિ વ્યાયામની અહિતકર અસર લોગવવાની થાય છે.

આમ મદાની અને મૈદાની એલો કિંમતી તો છે જ, પણ તેની મર્યાદાઓ સમજુ લેવાની જરૂર છે.

જ્યુઝુલ્યુટ્સુ

આ જપાનની રાષ્ટ્રીય વ્યાયામ પદ્ધતિ છે. એનો મુખ્ય ઉદ્દેશ મનુષ્ય શરીરના સાંધારોની રૂચનાનો અભ્યાસ કરી, અપળતાથી હરીકના શરીરના કાંડાં, ડેણી, ખલા, ગરદન, ધુંટી, ધુંટણ, જંધ તથા કમરના સાંધારો મજબૂત કરવા માટે દાવ કરે છે. એક દિનાંતથી આ વાત ઠીક સમજશો. અને આપણે પ્રથમ 'કાંડાક્સ' વ્યાયામ લઈએ. આમાં એક હરીક પોતાના પ્રતિસ્પદ્ધિના કાંડાને પોતાનું કાંડું અડકાડી, તેના કાંડાને જમણુથી ડાખી બાજુ ઢેલવા પોતાનાથી બનતો પૂરો યત્ન કરે છે; પ્રતિસ્પદ્ધિ પણ તેના ઢેલા સામે જોર કરે છે, પણ તે એટલું નહિ કે તેનું કાડું તેની ભૂણ જગ્યાએથી હું જ નહિ કે પેલા હરીકના કાંડાને પાછું હકાવે. તે પોતાના હરીકના ઢેલાનો વિરોધ તો કરે જ છે; છતાં ધીર ધારે પોતાના કાંડાને જમણુથી ડાખી બાજુ ઢેલાવા દે છે. આવું જ ખીજ સાંધારોની બાબતમાં સમજવું. વ્યાયામનો આ પ્રકાર ખરેખર બહુ ઉત્તમ છે, અને તેને 'આયસો ટોનિક ટ્રેનિંગ' કહે છે.






જપાનીજ વ્યાયામ-જ્યુઝુલ્યુટ્સુ

વ્યાયામની જરૂર રહેવી જોઈએ. જપાનીઓનો એ બળવર્ધિક વ્યાયામ કર્યો તેની જણું થઈ નથી.

જપાનીજ સ્ત્રીઓ જ્યુઝુલ્યુટ્સુ શીખતાં પહેલાં એ બળવર્ધિક વ્યાયામ કરે છે તેની જણું છે. તેઓ જોડી જોડી બંધાય છે અને પછી કાંડાં, ડેણી, ખલા, ગરદન, ધુંટી, ધુંટણ, જંધ તથા કમરના સાંધારો મજબૂત કરવા માટે દાવ કરે છે. એક દિનાંતથી આ વાત ઠીક સમજશો. અને આપણે પ્રથમ 'કાંડાક્સ' વ્યાયામ લઈએ. આમાં એક હરીક પોતાના પ્રતિસ્પદ્ધિના કાંડાને પોતાનું કાંડું અડકાડી, તેના કાંડાને જમણુથી ડાખી બાજુ ઢેલવા પોતાનાથી બનતો પૂરો યત્ન કરે છે; પ્રતિસ્પદ્ધિ પણ તેના ઢેલા સામે જોર કરે છે, પણ તે એટલું નહિ કે તેનું કાડું તેની ભૂણ જગ્યાએથી હું જ નહિ કે પેલા હરીકના કાંડાને પાછું હકાવે. તે પોતાના હરીકના ઢેલાનો વિરોધ તો કરે જ છે; છતાં ધીર ધારે પોતાના કાંડાને જમણુથી ડાખી બાજુ ઢેલાવા દે છે. આવું જ ખીજ સાંધારોની બાબતમાં સમજવું. વ્યાયામનો આ પ્રકાર ખરેખર બહુ ઉત્તમ છે, અને તેને 'આયસો ટોનિક ટ્રેનિંગ' કહે છે.

ભારતીય વ્યાયામ પદ્ધતિ

વ્યાયામની પ્રવૃત્તિ આપણું દેશમાં અતિ પ્રાચીન કાળથી ચાલતી આવે છે. ભારતીય વ્યાયામ પદ્ધતિનું કેન્દ્ર કુસ્તી છે, અને ભારતીય વ્યાયામ પદ્ધતિનાં ખીજ અંગ એની આસપાસ યોજનેલાં છે. કુસ્તી એ બહુ કુદરતી વ્યાયામ છે. સામસામા બાજું તથા હરીકને પાડવા મથવું એ કુદરતી ગ્રેરણું છે. કુસ્તીમાં ડેંચ પ્રકારનાં સાધનની જરૂર નથી તેનાથી શરીર બહુ સારં કસાય છે, એટલું જ નહિ પણ તેનાથી બંધાચેલું શરીર લાંબા સમય સુધી ટકી રહે છે. એનાથી શરીર સુદૂર અને મજબૂત થાય છે અને તે ઉપરાંત તેનાથી પોતાની જતાનો બચાવ કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે.



ભારતીય વ્યાયામ-કુસ્તી

કુસ્તીમાં સહૃદાતા મેળવવા માટે જરૂરનાં અંગથા તથા ચપળતા મેળવવા દંડ, બેઢક તથા મલખમની કસરતો યોજય છે. ચેરેલેલ બાર્સથી થતી શરીરવૃદ્ધિને મળતી શરીરવૃદ્ધિ દંડથા થાય છે. આમાં છાતી તથા ખલાના સાંધા દઢ અને સારા અભિવૃદ્ધિ થાય છે. માત્ર આમાં ઓલા ખાતા શરીરના અંચકા ખમવાનો અનુભવ થતો નથી, એટલે અંશે તે પેરેલેલ બાર્સ કરતાં હળવી છે. બેઢક એ દંડની પૂરક કસરત છે. એનાથી પગના મોટા સનાયુઓના સમલેણ સારી રીતે કસાઈ મજબૂત બને છે. મલખમથી જંધના સનાયુઓની પકડશક્તિમાં ખૂબ વધારો થાય છે તથા હાથના ટેકા પર શરીરને ઉચ્કવાની શક્તિ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત એનાથી ચેટના સનાયુઓને બહુ સારી કસરત મળે છે. બળવાન તથા ચપળ મહલોનાં શરીર ધણી વાર મોટા ગાગર જેવા ચેટથી બેઠાળ જણ્ણાય છે, તેના કારણમાં એક તો તેમનો વધારા પડતો મેદટરટ્વોવાળો ખારાક છે અને ખીલું મલખમ જેવા ઉદર પર અસર કરનાર વ્યાયામનો અભાવ છે.

આ ચાર પ્રકારના વ્યાયામના સંયોગથી શરીરની બહુ સારી અને સપ્રમાણું ખીલવણી થાય છે તથા શરીરમાં ખૂબ બળનો સંચય થાય છે. આ વ્યાયામ પદ્ધતિમાં માત્ર સનાયુવિકાસ થતો નથી, પણ જેઠે જેઠે હંદ્ય, ફેઝસાં, ચામડી, ચુદા વગેરે શરીરનાં તમામ અંગોને લાલ પહોંચે છે અને પોતપોતાનું કામ તે સારી રીતે કરતાં થાય છે.

ઉપર જણાવેલી ચાર કસરતો ઉપરાંત ભારતીય વ્યાયામ પદ્ધતિમાં લકડી, લાડી, લેળુમ, મગદળ તથા દાંડપદ્દાની કસરતોનો પણ સમાવેશ છે. એમાંથી મગદળ તથા લેળુમ જેવી ડેટલીક કસરતો નાની વયના બાળક માટે યોગ્ય છે, જ્ય.રે લકડી, લાડી તથા દાંડપદ્દો એ જરૂર બચાવની કસરતો છે.

આ સિવાય યૌગિક ક્રિયાઓ તથા સૂર્યનમસ્કાર પણ ભારતીય સંસ્કૃતનો અમૂલ્ય વારસો છે. યૌગિક ક્રિયાઓનું નિર્ધારિત ધ્યેય આમ તો યોગ એટલે કે ઈશ્વર સાથે જોડાણું સિદ્ધ કરવાનું છે; અને તે માટે યમ, નિયમ, આસન, પ્રાણ્યાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-યોગ આડ પગથિયાં છે. યોગની આ પ્રક્રિયામાં શરીરને પાયારુપ સાધન તરીકે સ્વીકારી યોગસાધના માટે શરીરની અને મનની વિકાર રહિત સ્વસ્થ સ્થિતિને અનિવાર્ય માનવામાં આવી છે. શરીર અને મન અરસપરસ ગાઢ રીતે સંકળાયેલાં છે અને યોગ માટે જરૂરી શારીરિક તથા માનસિક સ્વસ્થ યમ, નિયમ, આસન તથા પ્રાણ્યાયામથી પ્રાપ્ત થાય છે. ભારતીય શારીરિક ડેળવણીના કાર્યક્રમમાં આ કારણે આસન, પ્રાણ્યાયામ, વગેરે યૌગિક ક્રિયાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


ઉપરોક્ત વિવેચન પરથી સમજશે કે ભારતીય વ્યાયામ પદ્ધતિમાં એ હેતુ સચ્ચવાય છે. એક સ્વુદ્ધિય શરીરવૃદ્ધિનો તથા ખીનો સ્વનબ્રચ્ચાવની શક્તિ અથવા કળા પ્રાપ્ત કરવાનો. વ્યાયામની આ પદ્ધતિએ આપણા દેશમાં વીરતા જીવાંત રાખી છે, અને અનેક યુધ્ઘવીરો પેદા કર્યા છે. શ્રી શિવાજી

મહારાજ અને તેના વીર સાથી તાનાજ માલુસરે, બાળ દેશપાંડે, નેતાજી પાદકર વગેરે આ વ્યાયામ પદ્ધતિથી કેળવાયેત્વા વીર હતા. ત્યાર પછીના યુગમાં રેખાશાખાઓ પણ એ વ્યાયામ પદ્ધતિ ચાલુ હતી. એટથું જ નહિ, પણ રાજમાન્ય હતી, અને તેનાથી અનેક તાલીમણ્ડ વીરો પાકતા હતા. આને શીખ તથા મરાઠા સિપાહી આખી દુનિયામાં અનેક વીર ચોધ્યો ગણ્ય છે. તેમના વર્ચસ્વનો બાધાર તેમણે ભારતીય વ્યાયામ પદ્ધતિની લીધેલી તાલીમ પર છે. વ્યાયામકેસરી ગામાએ દુનિયાના સર્વશ્રેષ્ઠ પૂર્વલાગોને પરાસ્ત કરી ભારતીય વ્યાયામ પદ્ધતિની શરીર કસવાની એઝ શક્તિ પૂરવાર કરી છે.

ભારતીય વ્યાયામ પરંપરા સંબંધમાં પ્રત્યક્ષ અભ્યાસ કર્યા પછી જર્મનીની ૧૯૭૬ની વિશ્વ એલિમ્પિક્સના જનરલ સેક્રેટરી અને ડૉ.લોનની શારીરિક શિક્ષણ ડાલેજના ડીરેક્ટર પ્રો. ડૉ.

કાલ્ટોમનો અભિપ્રાય જણ્યા નેવો છે. તેઓ જણ્યાવે છે કે, “ભારતીય વ્યાયામ એ સમગ્ર દૃષ્ટિએ નેતાં ખરેખર આરોગ્ય વ્યાયામ છે, જે અન્ય વ્યાયામ પ્રકારો કરતાં એક અનોએ વ્યાયામ પ્રકાર છે. તેનું સુખ્ય ધ્યેય ધડ અને કરેડની શક્તિં વિકસાવવાનું, સીનાનોસુંદર વિકાસ સાધવાનું, અંથીઓને ઉત્તોજિત કરવાનું અને સમગ્ર શરીરની સુવલન શક્તિ (Flexibility)ને સંપૂર્ણ વિકસાવવાનું છે.... .

“જે બાબત મને સૌથી વધુ આકર્ષેક અને રસપ્રદ લાગી તે એ છે કે, ભારતીય વ્યાયામ—પરંપરામાં જ્યારે એક બાળુ મકાનની રચના (ડિઝાઇન) બાળતમાં સાદગીને પસંદ કરવામાં આવે છે ત્યારે બીજુ બાળુએ ઉત્તમ સગવડયુક્ત ક્રીડાંગણો માટે વિશેષ આગ્રહ સેવવામાં આવે છે. આ બાબત ભારતીય માનસનું-જીવનની ભૌતિક



ભારતીય વ્યાયામશાળા

વિવિધ વ્યાયામ પદ્ધતિઓ

ચુખ સગવડોને બાજુએ રાખી સર્વો પ્રયત્નોને માનવપૂર્ણતાની પ્રાપ્તિ માટે કેન્દ્રિત કરવાનું-પ્રતિશ્રિબ પાડે છે. આમ જોતાં-(૧) ભારતીય વ્યાયામપરંપરા ભારતીય પ્રજનનના વ્યક્તિત્વ સાથે એકરૂપ છે. (૨) ભારતીય વ્યાયામના પ્રેરોગોએ મને ખૂબું પ્રલાભિત કર્યો છે; અને શારીરિક કુળવણીના જે સિદ્ધાંતો મેં કર્યા દરમિયાન દર્શાવ્યા છે તે બધા જ આ વ્યાયામ પ્રકારોમાં સમાવિષ્ટ છે. પ્રથમ તો આ ભારતીય વ્યાયામ (જિગ્નેસ્ટિક્સ) પ્રકારોમાં એક વિશિષ્ટ અંતરિક તાલખદ્ધતા છે. ભારતીય વ્યાયામમાં શારીરિક ક્રિયા, સંગીત અને નૃત્ય એ સર્વો મળોને માનવીના સર્વાંગી અને સંવાદી વિકાસની રબ્જુઆત કરે છે. વ્યાયામવીરોને ફક્ત ઐલફ્રૂદસિદ્ધ પૂરતો મર્યાદિત અને ઉત્સાહિત રાખવા માટે તેમજ જીવનની કઠીન વાસ્તવિકતા-માંથી મોઝશોખ તરફ ચલિત કરવા માટે જે એકાંગી વિકાસ ભયસ્થાનરૂપ છે તેની સામે ઉપરોક્ત સર્વાંગી વિકાસ રક્ષણું આપે છે. (૩) આધ્યાત્મિક વિકાસ માટે સમગ્ર શરીરને સહીય અને સુવિકસિત બનાવવા માટે સહેતુક શારીરિક કસરતો કરવાનો સિદ્ધાંત યોગિક વ્યાયામમાં રહેલો છે. એ જોતાં તંદુરસ્ત પ્રજનન ઘડતર માટે આ વ્યાયામપ્રકાર અત્યંત ઉપયોગી છે. આ કસરતોની ઉપયોગિતા ફક્ત શરીર અથવા ગ્રંથીઓની કાર્યક્ષમતા અથવા રક્તવહનતંત્ર પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે તો સમગ્ર શરીર માટે ઉપયોગી છે, કે જેથી તે તેના દરેક કાર્યમાં તાલીમબદ્ધ શરીરની જેમ નિયમનમાં રહી શકે...

“ભારતીય વ્યાયામમાં મલખમનો વ્યાયામ અત્યંત અસરકારક અને આનંદપ્રદ છે; કુસ્તીમાં ઉમદા સ્પર્ધા છે; ઢાલલકડી તથા અનેકવિધ લડંત પ્રકારો સ્વરક્ષણુની કળા શીખવે છે; અને આ બધું રમતોના સર્વો પ્રકારો માટે આવસ્થક એવા જીવંત સંવાદી વિકાસમાં પરિણમે છે. શ્વસન કસરતોના અંકુરો સમાન પ્રાણ્યાયામ તથા કંબફુની રમત પાછળ પણ આ જ હેતુ રહેલો છે. દૂંકમાં શારીરિક

કુળવણીના સર્વ વિશ્વમાનવ ખુનિયાદી સિદ્ધાંતો ભારતીય વ્યાયામમાં સમાચેલ છે.”

ભારતીય વ્યાયામ પદ્ધતિ આમ ઓષ્ઠ હોવા છનાં બધી વાતે સંપૂર્ણ છે એમ કહી શકાય નહિ. મૈદાની તથા મર્દાની ઘેલોનું યોગ્ય સંમિશ્રણ થતાં તે આખી દુનિયાની સર્વાંગી વ્યાયામ પદ્ધતિનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે.

વજન ઊંચકવાનો વ્યાયામ (વેઈટ ટ્રેનિંગ)

આ વ્યાયામમાં કુમે કુમે વધતા વજનને અમુક સમય સુધી રેઝ ઊંચકવાનું હોય છે. આ વ્યાયામથી સ્નાયુઓ ઐશક બહુ જડપથી વધે છે, પણ આખા શરીરને એકંદર લાલ પહેંચાડવામાં એ વ્યાયામ એફ્લો ઉપયોગી નથી. વળી એ ઉપરાંત જે શરતચૂક થાય અને ઊંચકવાનું વજન કુમવાર ન વધારતાં, વધારે પ્રમાણુમાં વધારવામાં આવે તો લાલને સ્થાને હાનિ થવાનો લય રહે છે.

સેન્ડોની પદ્ધતિ

સેન્ડોની વ્યાયામ પદ્ધતિ શરીરથંત્રના બહુ શીખુવટલર્યા અને વૈજ્ઞાનિક અભ્યાસ પર રચાયેલી છે. તેની જુદી જુદી હીલચાલેથી શરીરનાં જુદાં જુદાં અંગના સ્નાયુઓને બહુ સારી કસરત મળે છે અને પરિણામે તેની બહુ ત્વરિત અને સુંદર અલિવૃદ્ધિ થાય છે. આ પદ્ધતિએ બંધાયેલું શરીર સપ્રમાણુ વૃદ્ધિના ઉત્કૃષ્ટ નમુના રૂપ હોય છે. આમ છતાં એ પદ્ધતિએ વ્યાયામ કરનારાઓનો સામાન્ય અનુભવ છે કે તે વ્યાયામ છોડી દેતાં શરીર જડપથી ઉત્તરી જથું છે અથવા ફૂલી જથું છે. એ વ્યાયામ એકની એક જગ્યાએ સ્થિર રહી કરવાનો હોય છે તથા તેની દરેક ગતિમાં ઈચ્છા-પૂર્વક ધર્ન કરવાનો હોય છે. તેથી મગજ પર ખૂબું ઘોંલે પડે છે. આ વ્યાયામથી શરીરના સ્નાયુઓની જડપી વૃદ્ધિ થાય છે; પણ હુદય,

ફેફસાં તથા શરીરની અંદરનાં ખીંબ અંગો પર બણું અસર થના પામતી નથી અને તેથી એકંદરે આખા શરીરને જોઈતો લાભ થતો નથી.

વેખર તથા મ્યુલરની પદ્ધતિઓ

વેખર તથા મ્યુલરની અને તેને મળતી અનેક ખીંબ પદ્ધતિઓમાં સ્વીડિશ વ્યાયામ તથા સેન્ટોના વ્યાયામની ચાલેને મળતી ચાલેા હોય છે, પણ એ પદ્ધતિઓ છાંડા શ્વાસ લેવાની વાત પર ખૂબ લાર મૂકે છે. એવી વ્યાયામ પદ્ધતિઓ પુષ્ટ ઉંમરનાં માણુસો માટે સારી છે.


ટૂંક મુદ્દતીઓ વ્યાયામક્રમો

આજાલ ધંધાદારી લોડોમાં ટૂંક મુદ્દતીઓ વ્યાયામ વધારે પ્રિય થતા જય છે. નહિ વ્યાયામ કરતાં એટલો ય વ્યાયામ સારો છે. બાકી પંદર તથા વીસ મિનિટના વ્યાયામક્રમોના જહેરાતમાં તેનાથી જે ત્વરિત તથા જન્હુઈ ક્ષાયદા થતા વર્ણવેલા હોય છે તે તો અતિશ્યેાંકિતલય્યો હોય છે, તથા તેમાં લોડાપકાર કરતાં ધંધાદારી દાઢિ વિશેષ હોય છે. આખા દહાડાના ચોવીસ કલાકના જીવન દરમિયાન શરીરમાં એકન થયેલો કચરો કાંઈ એ ટૂંક મુદ્દતીઓ વ્યાયામથી દૂર થાય નહિ, છતાં કાંઈ વધારે ન જ બની શકતું હોય તો કાંઈ વ્યાયામ ન કરવા કરતાં રાજ એટલો વ્યાયામ થાય એ પણ ઠીક છે.

વિવિધ વ્યાયામ પદ્ધતિઓના ચુણવોધની અંકણી

દંડ, કુસ્તી, દોડ, ઝૂટણોલ કે એઓ જેવો કોઈ જોરદાર વ્યાયામ કરવા માંડીએ છીએ, ત્યારે આપણા શરીર પર શી શી અસર થાય છે, તે તપાસવાથી સફળ વ્યાયામનાં શાં શાં પરિણામો નીપજવાં જોઈએ તેની આપણુને સમજજું પડે છે. આ બાબતમાં ગ્રીણુવટથી નિરીક્ષણ કરતાં જણાય છે કે વ્યાયામની પહેલી અસર તો એ થાય છે કે શ્વાસ જગ્યથી અને જોરથી ચાલવા લાગે છે. આનાં

એ સ્પષ્ટ પરિણામ નીપજે છે. એક તો એ, કે ફેફસામાં વધારે પ્રમાણમાં શુદ્ધ વાયુ જય છે અને તેમાંને અશુદ્ધ વાયુ વચારે પ્રમાણમાં બહાર નીકળે છે, અને તેથી શરીરનું લોહી વધારે પ્રમાણમાં સ્વચ્છ બની આખા શરીરને મળતું થાય છે. ખીજું એ કે, લિડા શ્વસન દરમિયાન છાતી તથા પેટની વચ્ચેનો પડદે ઉદ્વરપટલ (ડાયાફ્રામ) ખૂબ જોરથી જાંચો નીચો થાય છે; અને નીચે દળાતાં, પેટની અંદર આવેલાં જઠર, નાનાં મોટાં આંતરડાં, કલેજુ (લીપર), બરોળ વગેરે અંગોને ગદડે છે; અને તેથી તે ભાગોમાં ભરાઈ રહેવાથા બાંધિયાર થયેલું અસ્વચ્છ લોહી તેમાંથી બહાર નીકળી આગળ વહેવા માંડે છે; અને તેને સ્થાને ખીજું નવું તાઙું લોહી તેમાં આવે છે. ઉપર જણુવેલી શ્વસન પર થયેલી અસરને અનુસરી હંદ્ય વધારે ઝડપ અને જોરથી



સેન્ટો પદ્ધતિના ડાયેલ્સ

ધ્યાનકવા માંડે છે અને તેથા તે વધારે પ્રમાણુમાં અશુદ્ધ લોહીને શુદ્ધ થવા માટે ઇંસામાં ધોકે છે અને ત્યાં શુદ્ધ થયેલા લોહીને આખા શરીરમાં વહેવા મોકલી હે છે.

ઇંસાં તથા હૃદય પર થતી આ અસરો ઉપરાંત શરીરની ગરમી પણ વધે છે. આ ઘટાવી આપે છે કે, વ્યાયામ દરમિયાન શરીરના જુદા જુદા ભાગોમાં એકઠો થયેલો કચરો તે તે ભાગમાં ઓક્સિજન વાયુનો સંયોગ થતાં બળવા માંડે છે. વળી આ ઇંરક્ષારો ઉપરાંત ચામડીની અંદરની લોહીની નળા-ઓમાં લોહી વધારે પ્રમાણુમાં જવાથા તે રાતી થયેલી જણ્ણાય છે. વ્યાયામ દરમિયાન ચામડી પર ખૂબ પરસેવો વળે છે. એ પરસેવાથી શરીરની ગરમી ઘટે છે એટલું જ નહિ, પણ તેનો વાટે શરીરમાંનું ટેટલુંક જેર બહાર નીકળા જય છે.


સક્રણ થતા ચોંચ વ્યાયામનાં લક્ષણો

ઉપરના વિવેચન પરથી જણ્ણાય છે કે વ્યાયામની અસર માત્ર સનાયુઓ ઉપર નહિ, પણ આખા શરીર પર ખાસ કરીને હૃદય, ઇંસાં ચામડી, મગજ તથા મજનુના નાડીતંત્ર (સીસ્ટમ ઓફ નર્વ

શાઈબ્સ્) પર થાય છે. (૧) ને વ્યાયામ આ રીતે આખા શરીર પર અસર કરી તેની સહન-શક્તિ તથા કાર્યશક્તિ વધારે તે વ્યાયામ : સક્રણ તથા ચોંચ ગણી શકાય. (૨) વળી વ્યાયામમાં ગાળેલા સમય તથા શક્તિનો ફુલ્ફેલ ન થતાં તેનો પૂરેપૂરો લાલ મળે રહેવો વ્યાયામ ઈંદ્ર ગણું જોઈએ. (૩) વ્યાયામ કરતાં શરીર બહુ વખત સુધી તંગ તથા નિશ્ચલ સ્થિતિમાં ન રહેવું જોઈએ. સ્કૂર્ટ-લરી તથા તાલથદ્ધ ગતિ સાથે કરવામાં આવતો વ્યાયામ વધારે હિતાવહું તથા રોચક છે. (૪) વ્યાયામને અંગે થતી ગતિઓ કુદરતી અને જીવનમાં થતી ગતિઓને મળની અથવા તેની સહાયકારી હોય તે વ્યાયામ વધારે ઇચ્ચિકર થઈ પડે છે.

ચોંચ વ્યાયામની આ કસોટી હાલના વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી છે. પણ પ્રાચીનકાળમાં આયુર્વેદના જાળુકાર આપણા મુનિઓને તેની ફાંઝીક અંશે ખબર હતી એમ જણ્ણાય છે. વ્યાયામથી શરીર પર થવી જોઈતી અસર નીચેના શ્લોકમાં વર્ણવવામાં આવી છે.

લાધવં કર્મસામર્થ્યં દીપ્તોર્ગ્નમેર્દસઃ ક્ષયઃ ।
વિભક્તં ઘનગાત્રત્વં વ્યાયામાદુપજાયતે ॥



સક્રણ વ્યાયામ પ્રકાર દોડ

અર્થાત् ચપળતા, ધમ કરવાનું સામથ્યું, યોગ્ય પાચન, મેદનો નાથ અને સશક્ત અથવા તરી આવતા અને પોષાયેલા સ્નાયુ આ સ્થિતિ વ્યાયામથી પેડા થાય છે.

આ ઉપરથી જણુશે કે, ભારતીય વ્યાયામ પદ્ધતિમાં માત્ર અલિવૃદ્ધ સ્નાયુની સ્થિતિ જ નહિ, પણ તે ઉપરાંત યોગ્યઅન્ન પાચન થાય તથા શરીરના ડ્રેઈ ભાગમાં મેદનો જમાવ ન થવા પામે એવો પોરાક અને વ્યાયામ વચ્ચેનો સંબંધ તથા પરિણામે સ્કૂર્ટિંભય તથા ઉલ્લસાલરી પ્રકૃતિ-એ સુયોગ્ય વ્યાયામનાં લક્ષણું મનાયેલ છે.

દ્વોંકમાં માત્ર શરીરના સ્નાયુઓના કદ પરથી નહિ, પણ તે ઉપરાંત શરીરની ખીજ કિયાઓ પણ વધારે સારી રીતે કાલે, એવી આખા શરીર પર અસર કરનાર વ્યાયામ જ યોગ્ય અને છષ્ટ છે. આ છષ્ટ સાધવા ઉપરાંત ને વ્યાયામ તેના સેવનારને પોતાની જતનો બચાવ કરવાની શક્તિ આપે છે તેને વધારે છષ્ટ ગણુવો જોઈએ.

આ કસોટી લાણુ પાડતાં ભારતીય વ્યાયામ પદ્ધતિ દુનિયાની ખીજ બધી વ્યાયામ પદ્ધતિઓ કરતાં

શ્રોષ જણુશે. એની બાબતમાં ટીકા કરવામાં આવે છે કે તેમાં મૈદાની રમતો જેઠલો રસ પડતો નથી. પણ રસ એ વ્યાયામનું અનિત્રાર્ય લક્ષણું ન લેખાવું જોઈએ. આનો અર્થ એવો નથી કે સક્ષમ વ્યાયામ-માં રસનું તત્ત્વ નકારું અથવા ન ઈચ્છવા જેવું કે બાધક છે. કહેવાનો હેતુ માત્ર એટલો જ કે તે હેતુ ગૌણુ હોવો જોઈએ, અથવા ગૌણુ હોય તો વાંધો નથી. શુધ્ધ શાસ્ત્રીય સંગીત કરતાં ગળલો અને ટોળ ટપ્પા વધારે આનંદ આપે એવા લાગે છે, પણ તેથી અ પણું તેના પ્રચારને ઉત્તેજન નાહ આપીએ, ભસાલાથી અન્ન લહેજતદાર થાય છે, પણ તેથી આપણે અન્નને બદલે ભસાલો નહિ વાપરીએ. વ્યાયામમાં રસનું તત્ત્વ હોય એઈછ્ય છે, પણ આનંદદાયી છતાં શરીરનો યોગ્ય વિકાસ ન સાધતા વ્યાયામ કરતાં, શરીરનો યોગ્ય વિકાસ સાધતા અને ઓછા આનંદ આપતા વ્યાયામને પસંદ કરીશું. ભારતીય વ્યાયામ પદ્ધતિમાં મર્દાની તથા મૈદાની જ્ઞાનો ઉમેરવામાં આવે તો તે ખરેખર આદર્શિક થાય એમ છે. એ પદ્ધતિ ઓછામાં ઓછી ખર્ચાળ, ગમે તે સ્થિતિના આદમીને પાલવે એવી તથા સર્વાંગ લાલદાયી છે.



૪. આરોગ્ય પ્રાપ્તિતિની પાચામાં

શરીરની સંભાળ રાખવાની અગત્ય :

તમારી સાયકલની તમે ડેટલી બધી સંભાળ રાખો છો ? લુધી, આટકી, તેને વળગેલી ધૂળ દૂર કરો છો તથા તેને લાગેલો કચરો દૂર કરી તેને સાફ્સ્ક્રેન રાખો છો તથા જોઈતી જગાએ તેમાં તેથી પૂરો છો. તમારી ધડિયાળ તથા ઈન્ડિપેનની પણ તમે ડેટલી બધી સંભાળ રાખો છો ? સાયકલ, ધડિયાળ તથા ઈન્ડિપેન એ બધાં ઉપયોગી પણ નિર્જવ યંત્રોની આટલી બધી સંભાળ શા માટે રાખો છો ? એ યંત્રો સારાં હોય તો તમને સારું કામ આપી શકે તેઠલા માટે તમે તેની આટલી બધી સંભાળ રાખો છો. તમારું શરીર એ તમારા મનતું આશાધારી યંત્ર છે. તમારા મનની આશાએ તથા મનોરથો એ શરીર દ્વારા ઇલિત થાય છે. તમારું જીવતું શરીર સાયકલ તથા ધડિયાળ જેવાં નિર્જવ યંત્રો કરતાં ડેટલું બધું કીમતી તથા ડેટલું બધું ઉપયોગી છે ? શરીર સારું હોય તો જ તમે જીવનનાં સુઝો લોગની શકો છો. તમારા સુખ દુઃખનો આધાર તમારા શરીરની સ્થિતિ પર છે. જેના સાથે આટલો બધો નિકટ અને નિત્યનો સંબંધ હોય તે શરીરને સારું રાખવાની બાબતમાં તમે બેદરકાર રહો એ ડેટલું કહેવાય ? અને તમારું શરીર કાંઈ નિર્માલ્ય કે તુચ્છ વસ્તુ નથી. એ તો આત્માનું મંદિર છે. અને ખૂબ સ્વર્ચિ, દદ અને સુંદર રાખવું જોઈએ. શરીર સારાં રાખવું એ આત્માનાં પૂજનનો વિધિ છે.

આરોગ્ય એટલે શું ?

હવે પ્રશ્ન થાય છે કે આરોગ્ય કોને કહેવું ? આરોગ્ય એ શરીરની અમુક સ્થિતિ દર્શાવવા માટે વપરાતો શણ છે. તો એ સ્થિતિ ડેવી ? આરોગ્ય

એ સંસ્કૃત ભાષાનો શણ છે અને તેની વ્યુત્પત્તિ અરોગસ્ય માચ આરોગ્યમ् છે. ‘રોગથી મુક્ત એવી શરીરની સ્થિતિ તે આરોગ્ય’ એવો તેનો અર્થ થાય છે. માત્ર આપણે ત્વાં જ નહિ પણ સામાન્ય રીતે આખી દુનિયામાં સામાન્ય જનતામાં આરોગ્યનો આવે જ પ્યાલ છે. માણુસને કોઈ રોગ ન હોય તથા તે પથારીવશ ન હોય એટલે તેને આરોગ્યમય ગણ્ણી શકાય એવી સામાન્ય જનતાની આરોગ્ય વિષે માન્યતા છે. અદ્રોગ્યની આ વ્યાખ્યા ખરાખર અને ચોક્કસ નથી. રોગરહિત શરીરવાળા તથા પથારીવશ ન હોય એવા તમામ આદમીઓને આરોગ્યવાળા કહેવામાં આવે તો તે વર્ગમાં એવી જુદી જુદી શરીરની સ્થિતિઓના આદમીઓ આવે કે બધાને આરોગ્યવાળા કહેવા એ દેખીતું જેરવ્યાજખી ગણ્ણાય. રોગ વગરના તથા પથારીવશ ન હોય તેવા આદમીઓના વર્ગમાં તો માયકાંગલા, કુંક મારે તો જરૂર જય એવા ભરવાને અભાવે જવતા, દરળના ગજ જેવા પાતળા આદમીઓ પણ આવે, મોટી કાંદવાળા ગણ્ણુપતિ જેવા બેડોળ અને કડંગા શરીરવાળા બેઠાકુ દુકાનદારો પણ આવે અને જેર, જેસ અને જોમથી છલબલતા પડછંદ શરીરવાળા નવલોહિયા હુવાનો પણ આવે. જેમાં આવી અને આટલી બધી એક એકથી જુદી શરીર સ્થિતિવાળી વ્યક્તિઓનો સમાવેશ થાય એવી આરોગ્યની આ વ્યાખ્યા વ્યાજખી નથી એ સહેને સમજય એવી વાત છે. ખરું જેતાં શરીરની અંદરનાં હૃદય, ફેઝસાં, અત્નનણી, ગુર્દી વગેરે અંગો, શરીરની માંશપેશીઓ તેમજ દૂંકમાં આપું શરીર વધારેમાં વધારે કામ કરી શકે એવી શરીરની સ્થિતિને ‘આરોગ્ય’ કહેવું જોઈએ. ‘પણ અહીં એક પ્રશ્ન એવો જરૂર છે કે શરીરનું આવું આરોગ્ય રાખવાનો હેતુ શો ! માંદા ન

રહીએ એટલેથી ન ચાલે ? દૂરીએ, ઉરીએ, લખીએ, રોજનાં નિત્ય કર્મ કરીએ તો પછી જોર, જોસ અને જોમની શી જરૂર છે ? એવું પણ કહેનારા છે કે નથળા પણ ભરવાના અને સંબળા પણ ભરવાના...તો પછી શરીરને મજબૂત કરવાની માથા-ડ્રેડ શા માટે કરવી ? આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે. આપણું જીવન દરમિયાન એવા પણ પ્રસંગો જીવા થાય છે કે જે વખતે સાધારણું પ્રસંગના કરતાં ધણું વધારે બળ વાપરવાની જરૂર જણ્યાય છે. આવા પ્રસંગે બળ ન હોય તો જતનો બચાવ કરી શકતો નથી, કોઈ દુઃખીને મદ્દ કરી શકતી નથી, તેમજ રાષ્ટ્રની સેવા પણ થઈ શકતી નથી. ઉદ્ઘાસભ્યું જીવન જીવી વધારેમાં વધારે સેવા કરી શકાય એટલા માટે આરોગ્યની જરૂર છે; એ જ આરોગ્યની કિંમત છે. આરોગ્ય પોતે કાંઈ ઈષ્ટ નથી. ‘આરોગ્યની ખાતર આરોગ્ય’ એમ કહેવાનો કાંઈ અર્થ નથી. ખરી વાત તો એ છે કે ઉપર જણ્યાંયું છે તેમ ઉદ્ઘાસભ્યું જીવન અને વધારેમાં વધારે સેવા એ ઈષ્ટના સાધન તરીકે જ આરોગ્યની કિંમત છે. નથળાંઓને પીડવા માટે, દાદાગીરી કરવા માટે કે ગવ્યાભ્યાં સંતોષ માટે બળવાન શરીર નથી. આ ચર્ચા ઉપરથી એટલું સમજય છે કે આરોગ્યની વ્યાખ્યા માત્ર શરીરની સ્થિતિ પૂરતી ન આપી શકાય, પણ સાથે સાથે શરીરના ઉપરોગની દર્શિયે પણ તે યોજવી જોઈએ. દૂંડમાં ‘શરીર ખાતર શરીર નહિં, પણ સેવા ખાતર શરીર’ એ મુદ્રાલેખ નજરે આગળ રાખી, સેવા કરવા માટે વધારેમાં વધારે લાયક બનાવે એવી શરીરની સ્થિતિ માટે ‘આરોગ્ય’ શરૂદ્વ વાપરવો જોઈએ.

આદર્શ આરોગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ?

જોર, જોસ, અને જોમથી છલખલતું આરોગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ? તમારામાંના ધણું એમ માનતા હશો કે વ્યાયામ અથવા કસરતથી એવું આરોગ્ય પ્રાપ્ત થઈ શકે. આરોગ્યપ્રાપ્તિ માટે


વ્યાયામ એ બહુ સારો ઉપાય છે, એ વાતની ના નાહ પણ માત્ર કસરત કરે પૂણું આરોગ્ય પ્રાપ્ત થાય, એમ માનવાની ભૂલ ન કરશો. કસરતથી શરીરની જીવનશક્તિ વધે છે એ વાત ખરી, પણ ડેન્સર, ક્ષય, દમ, કોગળિયું, ટાઢિયો તાપ, વિષમ-જવર (ટાઈફ્લોડ) એવા રોગનાં જંતુઓથી થતા રોગો સામે ટકવાની શક્તિ વ્યાયામથી આવતી નથી. ખાવાપીવામાં, નાહવાધોવામાં, કપડાં પહેરવામાં વજેરે ખાખતોમાં આરોગ્યને લગતા નિયમો ન પણો તો કાંઈ માત્ર વ્યાયામથી શરીરને કસરત બનાવવાથી તમારામાં રોગનાં જંતુઓ સામે ટકવાની શક્તિ ન આવે. શરીરને આરોગ્યમય રાખવા માટે તમારે વ્યાયામ કરવો જોઈએ; તથા સાથે સાથે આરોગ્યના નિયમો જણી લઈ તેને અનુસરી વર્ત્વાનું પણ રાખવું જોઈએ.

તમે કસરત કરતા હો અને તમારો ઝોરાક કંગાળ અને ફૂચા જેવો હોય તો તમારું શરીર ડેમ કરી સારું અને બળવાન થાય ? તમે જે ધાન્ય વાપરો તે ખાતર વિનાની, જિતરી ગયેલી જમીનમાં પકાવેલું હોય અથવા તેને જોઈએ તેટલું પૂડું પાણું ન મળું હોય તો તેવું કસ વિનારું ધાન્ય તમારા શરીરનું પોષણ સારી રીતે ડેમ કરીને કરી શકે હોય વણી તમે મિલછડના આપેલા ચોખા, સંચે દળેલો લોટ, વાસી શાકભાજી, બેળસેળીયા ધી અને તેથી તથા ‘સેપરેટ’ દૂધ પીતા હો તો તેવા ઝોરાકથી તમારું શરીર ડેમ કરીને આરોગ્યમય અને બળવાન થાય ? કસરતના પ્રમાણમાં તમને પૂરતો ઝોરાક ન મળતો હોય, તમે દહાડામાં એક શેર જેટલું દૂધ પીતા ન હો તો તમારું શરીર ડેમ કરીને બંધાય ? આવા સંજોગોમાં કસરત કરવા છતાં તમારું શરીર ન ખીલે અને તમે કસરતનો વાંક કાઢો એ વ્યાજખી નથી. તમે સારો અને પૂરતો ઝોરાક ન લો અને પરિણામે તમારા શરીરનો બાંધો સારો ન થાય તો તેમાં કસરત બિચારી શું કરે ? ખીજ બાજુ તમે કાંઈ ધોરણ વગર ખૂબ દાખીને ખાવાની ટેવ રાખો; તમને ફંભજિયાત રહે; તો આના પરિણામે પણ તમારું

શરીર ખરાખર સારી સ્થિતિમાં રહી શકે નહિ. તમે પીવાનું પાણી તથા દૂધ અને ખીજ ખાવાની ચીને તદ્દન સ્વર્ચ હોય એ બાળતની દરકાર ન કરો, તો એ ચીને વાટે શરીરમાં દાખલ થતાં રોગનાં જરૂરોને કીધે તમને જત જતના રોગ થાય તો તેમાં વાંક છેનો? તમારા ધર અંગણામાં તથા ધરને ફૂરતી જગા ગંઢી અને ગોળ હોય અને

પરિણામે સ્વર્ચ નહિ પણ અશુદ્ધિઓ તથા જરૂરોથાં લદાયેલી હવા તમને મળતી હોય, તો તમારું લોહી પૂરું સ્વર્ચ ન થાય અને પરિણામે તમને શરીર લારે લાગે, તમારું માથું ચઢેલું રહે, તમે નિરત્સાહી રહેણ તેમાં શી નવાઈ?

આ બધી ચર્ચા ઉપરથી તમને સમઝશે કે,



સુદઢ શરીર (જહેન ત્રિમેક : અમેરિકા)

કસરત ઉપરાંત ચોખખી હવા, ચોખખું પાણી, ચોખખો અને પોશ્ટિક ખારાક, હવા ઉજાસ-વાળું ધર, શરીરની ગરમી એક સરખી રાખે એવાં જાતુને અનુસરતાં કૃપડાં તથા જીવનની બધી બાળતોમાં જિંયું ધોરણું જળવવાની ટેવ એ બધા સંન્દેગો હોય ત્યારે જ કસરત પૂરેપૂરો ક્ષયદો આપે છે.

તમારે કસરત પ્રમાણુસર અને માફકસર કરવી જોઈએ. કસરતથી શરીર દઢ અને આરોગ્યવાન થાય છે એ વાત ખરી, પણ સાથે સાથે એ યાદ રાખવું જોઈએ કે પ્રમાણસરની કસરત અમૃતતુલ્ય છે; જીવનનું રસાયણ છે; જ્યારે હદ બહારની વધારે કે જોઈએ તે કરતાં પણ ઓછી કસરત એ જેર રૂપ છે. વળી કસરત નિયમિત રીતે રોજ થાય તો જ ગુણ આપે છે. એક ભડીનો કસરત કરી, વળી પંદર દહાડા ન કરી, એમ અનિયમિત રીતે કરેલી કસરતથી શરીરને કઠી ક્ષયદો થતો નથી.

વ્યાયામ હેવા હોવા જોઈએ ?

છેદ્દે પ્રશ્ન એ જિબો થાય છે કે વિદ્યાર્થીઓએ હેવા વ્યાયામ કરવો જોઈએ ? આ પ્રશ્ન ખરેખર બહુ રસિક તેમજ મુદ્દાનો છે. ડેટલાક લોડો એમ માને છે કે શરીરની માંસપેશીઓ મોટી થાય અને પરિણામે શરીર ધારદાર અને ધીંગુ થાય તથા આદમી બળવાન થાય એવી કસરત આદમીએ કરવી જોઈએ. શરીર ભરાવદાર, ડોળદાર અને બળવાન થાય એ વાત જોટી નથી. એલું શરીર કંઈ અનિષ્ટ નથી. પણ એવો એક જ હેતુ લક્ષમાં રાખ્યા કસરત કરવાથી શરીરનો પૂરો અને છષ્ટ વિકાસ થતો નથી. આપણું શરીરની માંસપેશીઓનો ગ્રાન્યુ પ્રકારે વિકાસ થઈ શકે એમ હોય છે-૧. કદ વધે તથા પરિણામે તેની ઠાર્યશક્તિ વધે; ૨. તેની કામ કરવાની જડપ વધે; તથા ૩. શરીરની માંસ-પેશીમાં પરસ્પર મેળમાં કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય. માંસપેશીઓનાં કળ તથા અળ વધારવા માટે

૬૦૩ ઐક્ક તથા મલખમ સર્વશ્રેષ્ઠ કસરત છે. એ કસરતથી શરીરને ખૂબ મજબૂત અને બળવાન બનાવી શકાય છે. માંસપેશીઓની જડપ વધારવા માટે દોડવાની કસરત છે. શરીરની બધી માંસ-પેશીઓ પરસ્પર મેળમાં કામ કરે તથા પરિણામે સૌ ગતિઓ સુંદર તથા લાલિત્યલરી થાય એટલા માટે દોડ, વિવિધ ઝૂદકા, દડા તથા ચીને ફેંકવાની તેમજ ફેંકડો મારવાની રમતો તથા સાંધંક રમતો બહુ ઉપયોગી છે તમારે ૬૦૩, ઐક્ક, મલખમથી શરીર દઢ અનાવવું જોઈએ. દોડવાની તથા અન્ય જડપી હીલચાલેલાણી રમતોથી જડપ વધારવી જોઈએ; અને કબુદ્ધી, જોણો, ફૂટબોલ, બાસકેટ બોલ વગેરે વિવિધ રમતોથી શરીરની માંસ પેશીઓને પરસ્પર મેળમાં કામ કરવાનો અભ્યાસ કરાવવો જોઈએ. આવી કસરતાથી તૈયાર થયેલા શરીરનો ઉપયોગ અક્ષમાત તથા જોખમના પ્રસંગોમાં થઈ શકે તેટલા માટે તમારે જતના બચાવની શક્તિ ડેળવવી જોઈએ. સ્વભચાવને માટે જુડો-કરાટે, લકડી તથા લાઢી વગેરે અત્યંત ઉપયોગી છે. આપણું પર ઓછા કે વધારે આદમીઓએ હુમલો કર્યો હોય તેવા પ્રસંગે જેની આંખ તેવા હુમલાથી ટેવાયેલી હોતી નથી તે જોર હોવા જ્તાં ગલરાઈ જાય છે. આમ હોવાથી એવા પ્રસંગ માટે આંખ ટેવાય તેટલા માટે વ્યાયામશાળામાં ટેકરીયુદ્ધ, ધ્વજયુદ્ધ જેવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ.

આરોગ્યપ્રાપ્તિ માટે પાયાની ખાખતો

શરીરનાં બધાં અંગો તેમનાથી બની શકે તેથું વધારેમાં વધારે કામ કરે તો જ આદર્શ આરોગ્ય પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ શરીર પૂર્ણ કાર્ય-સાધક બને છે. આ હેતુ કેની રીતે પાર પાડી શકે તે જોઈએ.

આપણે બહારથી ખારાક, પાણી અને હવા શરીરની અંદર લઈએ છીએ. ખારાક પચવાથી થયેલા રસો લોહીના પ્રવાહ વાટે આખા શરીરનાં

તમામ નાનાં મોટાં અંગોને પોષણ દર્શયો પૂરાં પાડે છે. આ ઉપરથી સમજય છે કે શરીરનાં તમામ અંગોના પોષણુનો આધાર આપણા ઝોરાક પર છે. આપણુને પૂરતો ઝોરાક ન મળતો હોય અથવા તો તેમાં શરીરને જોઈતાં બધાં પોષણ દર્શયો ન હોય અથવા જોઈએ તે કરતાં આછા પ્રમાણુમાં હોય તો શરીરનું આરોગ્ય જોઈએ તેવું ન થાય એ દેખીતું છે. આપણું પીવાનું પાણી સ્વચ્છ ન હોય તો શરીરમાં રોગનાં જંતુ અથવા શરીરની શક્તિની વૃદ્ધિમાં આડે આવે તેવાં તરત્વે શરીરમાં દાખલ થવા પામે છે. ક્ષાસ વાટે શરીરમાં લીધેલી હવા સ્વચ્છ ન હોય, અને તેમાં જંતુઓ તથા બીજી અશુદ્ધિઓઓ હોય તો ક્ષસનક્રિયા કરનારાં ફેઝસાંને તેમજ સાથે સાથે અશુદ્ધિઓ લોહીના પ્રવાહમાં દાખલ થતાં શરીરનાં ખીજાં અંગોને પણ તુકશાન થવાનો લય રહે છે. આ ચર્ચા ઉપરથી સમજય છે કે આપણા શરીરનું આરોગ્ય સારું રાખવા માટે જરૂરી બાધાનો તે ચોંગ અને પૂરતા સ્વચ્છ ઝોરાકની, સ્વચ્છ જલની અને સ્વચ્છ વાયુની છે.

આપણા શરીરનાં તમામ અંગો જીવતા ડોપોના જોડાવાથી બનેલાં છે. એ ડોપોના જીવનને અંગો રાસાયણિક ક્રિયાઓ નિરંતર ચાલતી હોય છે. એ ક્રિયાઓ દહનને મળતી હોય છે; એટલે દહનને પરિણામે ધૂમાડો, કાબ્દન ડાયોક્ષાઈડ વાયુ, અને પાણીની વરાળરપી અશુદ્ધિઓ તથા દહનને અંતે બળતણુમાં નહિ બળે એવાં દર્શ્યોની રાખ રહે છે. તેમ ડોપોમાં પણ અનેક અશુદ્ધિઓ પેદા થાય છે. એ અશુદ્ધિઓને નેમ બને તેમ જલદી શરીરમાંથી કાઢી નાંખવી જોઈએ. ઝોરાકનાં દર્શ્યોમાંનો નહિ પચેલો ભાગ મળરપે શરીરની બહાર ફેંકાય છે. કાર્બન ડાયોક્ષાઈડ વાયુરપી અશુદ્ધ ઉચ્છવાસ વાટે શરીરની બહાર નીકળે છે. આ ઉપરાંતની બીજી અશુદ્ધિઓને મોટે ભાગે ચુદ્દા (કિડની) લોહીમાંથી છૂટી પાડી પેશાબરપે શરીરની બહાર કાઢી નાંખે છે. કંઈક નાના અંશમાં એ કામ પરસેવો કાઠનારી ચામડી પણ કરે છે. ચોંગ તથા પૂરતો ઝોરાક,

સ્વચ્છ પાણી તથા સ્વચ્છ વાયુની આરોગ્ય માટે છે, તેટલી જ અગત્ય તેને માટે શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની છે.

આપણા શરીરનાં અંગો તેમનાથી બની શકે તેટલું વધારેમાં વધારે કામ કરી શકે તેટલા માટે—
(૧) તેમને પૂરતા જ્યથામાં અને સ્વચ્છ પોષણ-દર્શયો તથા એક્સિજન વાયુ મળવાં જોઈએ; એટલું જ નહિ પણ (૨) તેમને પૂરતું કામ રોજ મળવું જોઈએ. શરીરનાં કાર્યોના અભ્યાસીઓ અવલોકન તથા અભ્યાસને આધારે જણાવે છે કે શરીરનાં અંગોનાં કદ અને કાર્યશક્તિ વપરાશે વધે છે.

આપણા શરીરના કુલ વજનનો લગભગ અર્ધા જેટલો અથવા તેથી કંઈક વધારે ભાગ શરીરની માંસપેશીઓનો છે. એટલે અન્ન પાચન, શ્વસન, રક્તવહન અને શરીરમાંની અશુદ્ધિઓ દૂર કરનારાં અંગોને જે કામ કરવાનું થાય છે, તેમાંનું અધું તો માંસપેશીઓને અંગે કરવાનું હોય છે. માંસ-પેશીઓ આછી વપરાય તો તેને પોષણ આછું જોઈએ; એટલે તેની અંદર જતા લોહીના પ્રવાહનું પ્રમાણ આછું થાય; તે એક્સિજનવાયુ પણ ઓછો વાપરે અને તેમાં અશુદ્ધ પણ ઓછી થાય. આમ થાય તો માત્ર માંસપેશીઓને જ નહિ પણ એ બધી ક્રિયા કરનાર અંગોને આછું કામ કરવાનું મળે અને તેમ થતાં તેની કામ કરવાની શક્તિ વધવાને બદલે ઓછી થાય. આ ઉપરથી સમજય છે કે વ્યાયામથી માંસપેશીઓ પર જ નહિ પણ અન્ન-પાચન, શ્વસન, રક્તવહન તથા શરીરમાંથી અશુદ્ધિઓને કાઢી નાંખનાર અંગો પર તેની કાર્યશક્તિ વધારે એવી અસર થાય છે. શરીરને આરોગ્યમય રાખવામાં વ્યાયામ શો ભાગ લજવે છે તે આ ઉપરથી સમજય છે. શરીરની અંદર આવેલાં હદ્દય, ફેઝસાં, ચુદ્દા તથા અન્નપાચનનાં અંગોને વધારે કામ આપી વ્યાયામ કરાવી તેમની કાર્યશક્તિ વધારવાનો, વ્યાયામ સિત્રાય બીજો ડોઈ વધારે કાર્યસાધક ઉપાય નથી.


આરોગ્યપ્રાપ્તિ માટે વ્યાયામ કેવળ જરૂરી છે એ વાત તો ધ્યાન સ્વીકારશે તથા ધ્યાનાનુભૂતા પણ હશે; પણ આરોગ્યપ્રાપ્તિ માટે કૂર્તી નિદ્રા અને આરામ તેના નેટલાં જ અગત્યનાં છે, એ જાણી ધ્યાને નવાઈ લાગશે; પણ એ વાત તદ્દન ખરી છે. આખા દ્વિવસભરની સતત જગતી સેવાને અંતે થાકુણ ગણેલાં નાડીતંત્રને નિદ્રાથી પૂરતો વિસામો ન ભણે તો તેને લાગેલા ધસારાની ધર્ય પૂરી કરી તાજ થવાનું તેનાથી ન બને એ સ્પષ્ટ છે. નિદ્રા ઉપરાંત, શરીર કે મગજને વધારે પડતું ક્રામ કરતું પડતું હોય છે, તેવે વખતે તેને વેળાસર વિસામો આપવામાં નથી આવતો, તો શરીર પર અને ખાસ કરીને મગજશક્તિ પર સ્થાયી માઢી અસર થવા પામે છે. લારે શારીરિક કે માનસિક અમને અંતે જોઇતો વિસામો ન લેવાથો હુંમેશને માટે થરીર લથડ્યાના ધ્યાન દાખલાયો જેવામાં આવે છે.

રાદ્વિચાર, સદ્વાંચન તથા સત્તસંગ આરોગ્ય માટે જરૂરનાં છે એ જાણી ધ્યાને નવાઈ લાગશે; અને ડાખ ડાઈ તો પ્રશ્ન પણ કરશે કે એ વસ્તુઓ અને આરોગ્ય વચ્ચે શો સંખ્યા છે ? શાંત અને સ્વખાં વગરની નિદ્રા, એકી જીંઘે વહાણું વાય એવી ધસધસાટ જીંઘ, મન શાંત તથા ઉશોરણી વગરનું હોય તો જ આવી શકે છે. ભોગવિલાસ અને કામવાસનાના તથા ભીજને જીંઘા નાખવાના કે તેમનાં ધનદરણ કરવાના અથવા તેમને જહેરમાં ઉતારી પાડવાના કાવાદાવાના વિચારા, નેને અગવદ્ધીતાના સોણમાં અધ્યાયમાં આસુરી સંપત્તિને નામે વર્ણિત્યા છે, તે નેના મનમાં ચાલ્યા કરતા હોય છે, તેવાનાં મન ણાં નણાં, આળાં અને સહેલાઈથા ઉશોરાધ જ્યા એવાં થઈ જ્યા છે. આવી મનોધૂત્તિવાળાને શાંત અને સ્વાનાં વગરની જીંઘ કેવી રીતે આવે ? સદ્વિચાર, સદ્વાંચન, અને સત્તસંગનો અર્થ એવો છે કે ઉપર જણાવેલી ભોગવિલાસ તથા કામવાસનાની તેમજ ભીજને ફ્સાવવાની, લુંટવાની કે ઉતારી પાડવાની કાવાદાવાસરી મનોધૂત્તિને ઉતોજન મળે

એવા વિચાર, વાંચન તથા સોણતી આદમીઓએ ન રાખવા જોઈએ, અથવા તો તેવાના સંસર્ગમાં જાઓ વખત ન રહેવું જોઈએ. ઉપર જણાયા પ્રમાણે મનોધૂત્તિને નથળી બનાવી હે અથવા હદ બહાર ઉસ્કેરે એવાં નાટક સીનેમા તથા સંગીત આ જ કારણે અહિતકર છે.

વ્યાયામ તથા જરૂરનમાં જેવાનો જીવ્ય આદર્શ એ આદમીને આવાં પ્રલોબનોથી બચાવવામાં અને નિર્દોષ આનંદ આપવામાં ણાં ઉપયોગાં સાધન થઈ પડે છે. સારા ચારિત્રનો અર્થ જતને તથા સમાજને હિતકારી, ન્યાયી અને સત્યપ્રિયવૃત્તિ તરફનો ઓક એવો થાય છે. આ દાખિએ સદાચાર અને ચારિત્ર આદર્શ આરોગ્ય માટે જરૂરી બાળતો છે. આ ઉપરાંત દાંત, મોં, આંખ, કાન, નાક તથા આપું શરીર સ્વચ્છ અને મેલરહિત રહે એટલા માટે દાતણું, મુખમાર્જન, સ્નાન તથા શરીરની ગરમી હદ બહાર વેક્ઝાધ જ્યા નહિ તથા શરીરની અંદર ચાલતાં કાર્યમાં અંતરાય ન નહે એવાં વચ્ચે, જોડા, રૂપી વગેરે વાપરવાની ટેવ પાહવી જરૂરની છે.

આ બધી ચર્ચા ઉપરથી સમજશે કે આરોગ્ય પ્રાપ્તિ માટે-(૧) યોગ્ય અને પૂરતો યોરાક (૨) સ્વચ્છ પાણી (૩) સ્વચ્છ હવા (૪) શરીરમાંથી અશુદ્ધિઓ બને તેટલી વહેલી શરીરની બહાર નીકળી જ્યા એવી મળોત્તસરીની ટેવો (૫) વ્યાયામ (૬) નિદ્રા અને વિશ્રાંતિ (૭) સ્વચ્છતાની ટેવો તથા (૮) માનસિક સ્વાસ્થ અને પ્રસંનતા, આ બધી બાળતો જરૂરી છે. આદમી યોગ્ય વ્યાયામ ગમે તેટલો કરે પણ આરોગ્ય પ્રાપ્તિની ઉપર જણાવેલી બાળતોમાંની એક કે વધારેના પાલનમાં બેદરકાર રહે તો માત્ર વ્યાયામથી ધાર્યાં પરિણામ ન આવે. એ જ રીતે આરોગ્યપ્રાપ્તિની ખીજ બધી બાધતો પળાતી હોય પણ વ્યાયામનું સેવન ન કરવામાં આવતું હોય તો પણ આદર્શ આરોગ્યનો ઈષ્ટ હેતુ સિદ્ધ ન થાય. એ ખૂબ યાદ રાખવું ધરે



સ્વાસ્થ્ય સોપાન

કે, વ્યાયામ એ આરોગ્યપ્રાપ્તિનો અગત્યનો છતાં એક માત્ર ઉપાય નથી. અને આરોગ્યપ્રાપ્તિની ખીલ ખાખતોમાં બેદરકારી રાખવાથી વ્યાયામનો ભણવો જોઈએ તેથ્યો લાલ ભણવા પામતો નથી. વ્યાયામ-

થી આદશો આરોગ્ય અને સારી શરીરસંપત્તિ મેળવવાની ઈચ્છા રાખનાર આદમીએ આરોગ્ય-પ્રાપ્તિના નિયમો બરાબર જાણી લઈ તેનું પાલન કરવાની ટેવ પાડવાની જરૂર છે.

પ. શારીરિક ક્ષમતાઃ વૈજ્ઞાનિક વિચારણા

રૂપલાવણ્યબલવજ્રસંહનતત્ત્વાનિ કાયસંપત્તિ ।

—પતંજલિ

શારીરિક ક્ષમતા વિષે આપણે ધણું ધણું સંભળાએ છીએ. સામાજિક કાર્યકરો, કેળવણીકરો, રાજકારણીય નેતાઓ વગેરે સૌ રાષ્ટ્રના વિકાસ માટે શારીરિક ક્ષમતાને પાયાની બાબત ગણે છે અને તેને વિકસાવવા માટે વારંવાર અનુરોધ કરે છે. તેઓ સમજે છે કે, રાષ્ટ્રે મજબૂત જનથું જ જોઈએ; અને રાષ્ટ્રીય સલામતી તથા આંતરરાષ્ટ્રીય શુભેચ્છા સિદ્ધ કરવા માટે આ અનિવાર્ય બાબત છે.

તો આ શારીરિક ક્ષમતા એટલે શું ? જડા શરીરને શારીરિક ક્ષમતા કહીશું ? વધારે ખોરાક ખાય તેને શારીરિક ક્ષમતા કહીશું ? પથ્યર લાંગના અને સળિયા વાળવા તેને શારીરિક ક્ષમતા કહીશું ? કુસ્તીનાં દંગલો જીતવાં તેને શારીરિક ક્ષમતા કહીશું ? સૌશ્રી વધારે વજન છિયકી શકે તેને શારીરિક ક્ષમતા ગણીશું ? શારીરિક ક્ષમતા સંનાખમાં આવા સ્પષ્ટ-અસ્પષ્ટ ઝ્યાલો આપણે ત્યાં પ્રચલિત છે; તો સાચા અર્થમાં શારીરિક ક્ષમતા આપણે કેને કહીશું ? શારીરિક ક્ષમતા એ વ્યક્તિ, સમાજ તથા રાષ્ટ્રના વિકાસ માટે જો અગત્યની બાબત હોય તો તેના વિષે સ્પષ્ટ વૈયાનિક ઝ્યાલ આપણું સીને હોય તે અત્યંત આવસ્યક છે.

વિશાળ અર્થમાં જોઈએ તો તોછ નિયત કાર્યકરો, કરવા માટે વ્યક્તિની કાર્યશક્તિ (Capacity) ને શારીરિક ક્ષમતા છૂટી શકાય. આ દણ્ઠાં જોતાં

શારીરિક ક્ષમતાનું ધોરણું વ્યક્તિ પર તથા નિયત કાર્ય પર આધારિત છે; અને તેથા સમાજને નજરમાં રાખો શારીરિક ક્ષમતાનો વિચાર કરતાં બધા જ માટે એક સરખું શારીરિક ક્ષમતાનું ધોરણું નક્કી કરી શકાય નહિ; પરંતુ વ્યક્તિ અને તેના કાર્યને અનુલક્ષીને શારીરિક ક્ષમતાનો વિચાર કરવો જોઈએ. આ માટે સામાન્ય જનસમાજને નીચે મુજબ સાત વિલાગમાં વહેંચ્યો શકાય :-

૧. વ્યાયામવીરો અને કસરતવીરો
૨. મહેનતકશ અમળવીરો અને મજૂરાં
૩. વિશિષ્ટ ટેકનિકલ કામગીરી અભિવનારાઓ (જેમ કે, મોટર ડ્રાઇવર, એરપાઇલેટ, મિક્રોનિક, વગેરે.)
૪. બેઢાદું કામ કરનારાઓ (જેમકે, શિક્ષક, કારકૂન, વગેરે.)
૫. શારીરિક ખોડવાળા (જેમકે, આંધળા, લાંગડા, વગેરે.)
૬. કાયમી રોગવાળા (જેમકે, ક્ષ્ય, લોહીનું પાણી વગેરે.)
૭. પ્રૌઢો અને વૃદ્ધો.

ઉપરોક્ત વિલાગ મુજબ વ્યક્તિનો અનુલક્ષીને વિવેકપૂર્વક તેમની શારીરિક ક્ષમતા વિચારવી જોઈએ અને તે મુજબ માપવી જોઈએ.

આમ છ્ટાં સામાન્ય તંદુરસ્ત જનસમૂહને દશી

શારીરિક ક્ષમતા: વૈજ્ઞાનિક વિચારણા

સમક્ષ રાખીને શારીરિક ક્ષમતાની સ્પષ્ટ અને વૈજ્ઞાનિક વિચારણા કરીએ તો તેના ઉપલક્ષમાં ઉપરોક્ત બધા જ પ્રથારના જનસમૂહો માટે શારીરિક ક્ષમતાનું વિવેકયુક્ત હોય તું વિચારવું સરળ થઈ પડે. આ દાખિએ વિષ્યાત અમેરિકન શારીરિક ડેળવણીકાર મેસન અને ભિન્નેલ શારીરિક ક્ષમતાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “ જ્યારે પરિસ્થિતિ આરોગ્યને અનુકૂળ હોય ત્યારે બળ, ઝડપ, કોશલ્ય અને સહનશક્તિના શારીરિક ગુણોમાંથી જે સ્થિતિ પરિણામે તેને ‘શારીરિક ક્ષમતા’ કહે છે. ”

સાચું પૂછો તો શારીરિક ક્ષમતા એ વ્યક્તિની સમગ્ર ક્ષમતા (Total fitness) નું એક પાસું છે. સમગ્ર ક્ષમતાના અન્ય અંગોમાં સામાજિક ક્ષમતા, બૌધ્ધિક ક્ષમતા, સાંવેદનિક ક્ષમતા વગેરેનો સમાવેશ થાય છે. શારીરિક ક્ષમતાના વિવિધ અંગો નીચે મુજબ છે :—

(૧) રોગપ્રતિકાર શક્તિ Resistance to disease) : બિમારી કે રોગનો પ્રતિકાર કરવાની શક્તિ એ શારીરિક ક્ષમતાનું અંગ છે. સંપૂર્ણ શારીરિક ક્ષમતા અટલે સર્વધાતક અને ચેપારોગાથી બિલકુલ મુક્ત શારીરિક સ્થિતિ. રોગનો સામનો કરવાની શક્તિ આનુવંશિક બાળત હોવા છૂટાં પરિસ્થિતિ પણ તેના વિકાસમાં ભાગ ભજવે છે. પરિસ્થિતિગત બાબતો નેવી કે ઘોરાક, કપડાં, આરામ, વિશ્રામ, શારીરિક પ્રવૃત્તિ, તથા વ્યક્તિગત આરોગ્ય એવે વગેરે રોગ પ્રતિકાર શક્તિ માટે અગત્યની બાબતો છે. રોગપ્રતિકાર શક્તિના સંરક્ષણ અને વિકાસ માટે નીચેની બાબતો જરૂરી છે.

- (અ) સંગીન વારસાગત શક્તિ.
- (બ) સમતોલ અને પૂરતો આહાર.
- (ક) સંગીન શારીરિક પ્રવૃત્તિ કાર્યક્રમ.
- (ડ) ઝડપ અનુસાર યોગ્ય કપડાં.

(ઝ) પૂરતો આરામ અને વિશ્રામ.


(ફ) સર્વ પ્રકારના કચરાને તથા તાણુ (Strain) અને દબાણને (pressure) ને દર કરતી આરોગ્ય ટેવો.

(૨) સ્નાયુભળ અને સ્નાયુ સહનશક્તિ (Muscular strength and muscular endurance) : સ્નાયુભળ અને સ્નાયુ સહનશક્તિ એટલે ઉપયોગમાં લેવાતા સ્નાયુસમૂહો ઉપર ભાર મૂકાયેલી સ્થિતિમાં વ્યક્તિની સતત મહેનત ચાલુ રાખવાની શક્તિ. બધી ગત્યાત્મક કિયાઓ માટે સ્નાયુસમૂહોનાં વિવિધ સંખ્યા અને માત્રાવાળાં સંકુચનો કારણભૂત હોય છે. ડેટલીક ગત્યાત્મક કિયાઓ સંકુચનની સંખ્યા અને માત્રાના પ્રમાણમાં કરાય છે. આવા દાખલાઓ (જેમ કે, ઊંચક) માં સ્નાયુભળ એ શારીરિક ક્ષમતાનું અગત્યનું અંગ બની હોછે, કારણ કે મહેનત માટે જે અનુકૂલન (adjustment) કરવામાં આવે છે તેના માત્રા સ્નાયુપેશીના કદ અને ગુણવત્તાના પ્રમાણમાં હોય છે. સ્નાયુભળ માટે નીચેની બાબતો જરૂરી છે—

- (અ) સ્નાયુતંતુઓનો પૂરતો જથ્યો અને ગુણવત્તા.
- (બ) જરૂરી સંખ્યામાં સ્નાયુતંતુઓને ઉતેજિત કરવાના શક્તિ
- (ક) ઉચ્ચાલન અંગે કાર્યક્રમ આંતરિક અને બાલ્ય તંત્ર.
- (ઙ) લારના પ્રમાણમાં કાર્યની તાલખદ્ધતા.
- (ઇ) આંતરિક પ્રતિકારનું ન્યૂનતમ પ્રમાણ.
- (ફ) કાર્યક્રમ ગતિમેળ પ્રકાર.

જે વ્યક્તિમાં ઉપરોક્ત બાબતો ઉચ્ચ કક્ષાએ વિકસેલી હોય છે તે સ્નાયુભળ સંખ્યાંધક ડોષ પણ પ્રકારનું અનુકૂલન અત્યંત સરળતાથી કરી શકે છે.

(૩) રક્તવહન-ચૈસન સંખ્યાંધક સહન-



ગુળવાન શરીર (પરિમલ વોય : ભારત)

શક્તિ (Cardio-Vascular-respiratory endurance) : રૂક્તવહુન-વ્યાસન સંખ્યાંધક

સહનશક્તિ એટલે રૂક્તવહુન અને વ્યાસન કાર્ય

ઉપર માંગ ઉત્પન્ન કરે તેથી સમય ચુંધી અને

નેમાં અનેક સ્નાયુસમૂહોના તીવ્રતાપૂર્વક પ્રયત્ન

જનતા હોય તેવાં જતત સંદૂચ્યનોને લાંબા સમય

ચુંધી ચાલુ રાખી શકવાની વ્યક્તિની શક્તિ.

રૂક્ત-વહુન-વ્યાસનતંત્ર સંખ્યાંધક ક્ષમતા અવનમાં અને

શારીરિક ડેળવણીના ક્ષેત્રમાં બે કારણોને લઈને
અગત્ય ધરાવે છે-

(૧) સ્નાયુઓને જો ગુણતણું અને પ્રાણુવાયુ
ન મળે તો સંદૂચ્યન ચાલુ રાખી શકે નહિ. (૨)
સ્નાયુકોષોને ગુણતણું અને પ્રાણુવાયુ રૂક્તવહુન-વ્યાસન
તંત્ર મારફતે પડેંચાડવામાં આવે છે. લાંબા સમય
ચુંધી ચાલતી કિયામાં વ્યક્તિનું અનુદૂલ્લન મહદે

અંશો આ તંત્રોના વિકાસ પર નિશ્ચર્ય હોય છે, કારણું હેઠારે ઉચ્ચ કક્ષાએ વિકસિત રક્તવહન-ખેસનતંત્ર વધારે લાંબા સમયના સ્નાયુધાયે (સ્નાયુસંદૂચન) માટે પાયારપ છે. દાખલા તરીકે, નેઓ સામાન્ય તાલીમ પામેલા છે તેમના કરતાં એક માઈલ દોડનાર એક મિનિટમાં વણ્ણથા ચાર ચલું વધારે લોહી ભ્રમણું કરી શકે છે. સહનશક્તિ મોટે ભાગે એક મિનિટમાં લોહાનો જરૂરી ભ્રમણ થાય તેની શરીરની પ્રાણુવાયુની જરૂરીઆત સાથેના પ્રમાણ્યથા નક્કી થાય છે. શરીરવિજ્ઞાન પ્રતિતી આપે છે કે, રક્તવહન-ખેસન તંત્ર સંધારક ક્ષમતા ધરાવનાર વ્યક્તિમાં નીચેની આનુષ્ઠાનિક સંગીતાઓ હોય છે—

- (અ) એક મિનિટમાં લોહી વધારે પ્રમાણુમાં ધડકણી શકે છે; પરિણુંમે વધારે બળતથું અને પ્રાણુવાયુ સ્નાયુકોપોને પહોંચ્યો શકે છે; તથા કયરાનો નિકાલ પણ વધારે ચોંચ્ય રીતે થાય છે.
- (બ) નાડીવેગ ધીમે હોય છે; આને લઈને ક્લેપક (Ventricle)ને વિસામા માટે તથા ભરાવા માટે વધારે સમય મળે છે.
- (ક) લોહિતું સામાન્યતાઃ દળાણું નીચું હોય છે; અને તેથી દળાણું લયજનક સપાટીએ વધવાની શક્યતા ઓછી રહે છે.
- (ડ) ફેઝસાંમાં સપાટીક્ષેનશન વિશીળતર હોય છે અને તેથી લોહિમાં વધારે પ્રાણુવાયુ ભળી શકે છે.
- (ઇ) લોહિમાં રક્તકણો અને હિમોલોઝિન વધારે સંખ્યામાં હોય છે; અને તેથી સ્નાયુકોપોને વધારે પ્રાણુવાયુ મળે છે.
- (ફ) લોહી અને સ્નાયુઓની સંરક્ષક (બિકર) શક્તિ વધારે હોય છે; અને તેથા થાક મોડા લાગે છે.

૪. વિસ્ટેન્ડ્રાઇક શક્તિ (Power) :- વિસ્ટેન્ડ્રાઇક શક્તિ એટલે ન્યૂનતમ સમયમાં મહત્વમાં બળ અમલમાં મૂકવાની શક્તિ.

શક્તિ (Power) = બળ (force) x વેગ (Velocity). અસરકારક ક્રિયા માટે જરૂર અને ગાળ અને સંયોજન્યાં લેધાયે. જડપોડા, વજન કેંક, બિંચી કૂદ, દોઢ કેંક, વગેરેમાં ક્ષમતાના આ પ્રકારની જરૂરીઆત રહે છે. ઉપરોક્ત શક્તિ-સ્તરમાં બાળ એ માનવ-પ્રવતનમાં સ્નાયુખળ દર્શાવે છે; અને વેગ એ જરૂર દર્શાવે છે. આમ શક્તિથાળી માનવીમાં નીચેની બાળતો હોય છે—

(અ) ઉચ્ચ કષાનું સ્નાયુકોવત (Strength)


(બ) ઉચ્ચ કક્ષાની જરૂર

(ક) જરૂર અને સ્નાયુકોવતના સંયોજનતું ઉચ્ચ કષાનું કૌશલ્ય.

૫. નમનીયતા (Flexibility) : અનેક-વિધ પ્રવૃત્તિઓમાં વ્યક્તિની અનુદૂલ્ખનશક્તિની અસરકારકતા તેના સમગ્ર શરીરની અથવા નિશ્ચિત સાંધારોની નમનીયતા ઉપર અવલંબે છે. સરસ નમનીયતા એટલે કે વિશાળ ગતિક્ષા શરીરતંત્રની દાખિયે તથા શરીરયંત્રની દાખિયે મહત્વની બાબત છે. તરવાની પ્રવૃત્તિમાં વિવિધ કૌશલ્યો માટે ઉચ્ચ કક્ષાની નમનીયતા જરૂરી અની રહે છે. ઓછી નમનીયતાવાળી વ્યક્તિ વધારે શક્તિ ખર્ચવા છતાં જરૂરી કૌશલ્ય અનુદૂલ્ખન લાગે જ મેળવી શકે છે, જ્યારે વધારે નમનીયતાવાળી વ્યક્તિ કૌશલ્યોની કામગીરીમાં ઓછી શક્તિ ખર્ચો છે. તરવાની જરૂર અને સહનશક્તિનો વિકાસ વ્યક્તિની નમનીયતાની શક્તિના વિકાસ સાથે સમાંતર હોય છે, તે પૂરવાર થયેલી બાબત છે. તુલસાડ શરીરવિજ્ઞાનીઓ મત ધરાવે છે કે, ઉમરના પ્રમાણુમાં ઓછા શરીર-વિકાસવાળી વ્યક્તિમાં અન્ય શારીરિક બાબતો પૈકી ઉચ્ચ કક્ષાની નમનીયતાનો પણ સમાવેશ થાય છે. આ બાબત અલખત વધુ અજ્ઞાસ માંગી લે છે.

૬. ઝડપ (Speed) : ઝડપ એટલે ન્યૂનતમ સમયમાં ડાઈ એક પ્રકારની ગતિ સતત કરવાની વ્યક્તિત્વની શક્તિ. સમયના ડાઈ નિયત એકમ દરમાન ગતિનો સંખ્યા એટલે ઝડપ; દા. ત. ઝડપી દોડમાં સમયના નિયત એકમ દરમાન પગની સતત ગતિ સંખ્યા એટલે ઝડપ. અન્ય કિયાઓમાં હોય છે તેમ અન્ય બાબતો પણ સંકળતામાં ફૂળો આપે છે. સનાયુશક્તિ અને ઝડપ અરસપરસ ગાડ રીતે ચંકળાયેલ છે ઝડપી દોડમાં પગની ઝડપી ગતિ માટે જરૂરી સનાયુશક્તિ વિના સંકળતા પ્રાપ્ત થઈ શકે નથી. સનાયુશક્તિ અને ઝડપ, વગેરેનો વિચાર સાથે જ ડરવેલ ધરે. ધણ્ણાં ખરાં એલક્રૂદ કૌશલ્યમાં ઝડપનું તત્ત્વ રહેલું જ હોય છે; દા. ત. બાસ્કેટબોલ, ફૂટબોલ, બેઝબોલ વગેરે.

૭. ચપળતા (Agility) :- ચપળતા એટલે સ્થિતિ બદલવાની વ્યક્તિત્વની શક્તિ; દા.ત. ફૂટબોલમાં દો ચુકવવો, વગેરે. ચપળતામાં દિયા બદલવાની શક્તિનો પણ સમાવેશ થાય છે, કે ને ફૂટબોલ, બાસ્કેટબોલ, હોકી, સોફ્ટબોલ, વગેરે એલક્રૂદ રમતોમાં અગત્યની બાબત હોય છે. ચપળતા-પૂર્વકના કાર્યમાં ઝડપ એક અગત્યની આવસ્યકતા છે. ને વ્યક્તિ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં દેરખદ્દી મહત્તમ ઝડપે અને મુખેળપૂર્વક કરી શકે




અસિ નૃત્ય

છે તે ઉચ્ચ કક્ષાની ચપળતા ધરાવે છે, એમ કઢી શકાય. ફેટલીક બાગતોમાં ચપળતા માટે બળ અને સહનશક્તિ પણ આવસ્યક બની રહે છે

૮. ગતિમેળન (Co-ordination) : વિવિધ પ્રકારની ગતિઓને અખંડ એકમ તરીકે એકત્રિત કરવાની વ્યક્તિત્વની શક્તિ એટલે ગતિમેળન. આ સંબંધમાં દરેક પ્રવૃત્તિ માટે જુદી જુદી જરૂરીઆત હોય છે; જેમ કે બાસ્કેટબોલના કૌશલ્યમાં ડીબલીંગ, ક્રીંગ અને શ્રીંગનો સુભેળ જરૂરી છે. આ કૌશલ્યની યોગ્યતા ધરાવનાર વ્યક્તિ આ સમગ્ર કૌશલ્યનો દરેક લાગ તો સરસ રીતે કરી શકે, એટલું જ નહિ પણ એક કૌશલ્ય પ્રકારમાંથી બીજી કૌશલ્ય પ્રકારમાં બહુ જ અસરકારક રીતે સંકાન્તિ (દેરખદ્દી) કરી શકે છે. ગતિમેળની શક્તિની કક્ષા એક કૌશલ્યપ્રકારમાંથી બીજી કૌશલ્યપ્રકારમાં સંકાન્તિ કરવાની વ્યક્તિત્વના વિકાસ સાથે સીધું પ્રમાણું ધરાવે છે. મોટા લાગના ગતિમેળન-પ્રકારામાં ડેટલાક પ્રમાણુમાં ચપળતા, સમતોલન અને ઝડપ જરૂરી હોય છે. ગતિમેળની પ્રવૃત્તિ લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવી ન હોય તો સામાન્યતા: વધારે પ્રમાણુમાં સનાયુભળની તથા સહનશક્તિની જરૂર પડતી નથી. ધણ્ણી ખરી એલક્રૂદ પ્રવૃત્તિઓમાં કૌશલ્યપ્રકારોના ગતિમેળ જરૂરી હોય છે. આ સિવાય ચાલવું, મોટર ચલાવવી વગેરે જીવનમાં જરૂરી કૌશલ્યોમાં પણ ગતિમેળ અગત્યની બાબત છે.

૯. સમતોલન (Balance) — સમતોલન એટલે સનાયુ-રાનતંતુ સુભેળથી જીવંત લાગતું નિયમન કરવાની વ્યક્તિત્વની શક્તિ. હાથ ઉપર ઊંઘે માથે રહેવાની કસરત Hand Stand) સમતોલન શક્તિનું મૌલિક ઉદાહરણ છે સ્કેરીંગ, સ્ક્રીંગ, તથા ગોળમટાં તેમજ સાધન ઉપરની ધણ્ણી કસરતોમાં ઉચ્ચ કક્ષાની સમતોલન શક્તિની જરૂર રહે છે. સારી સમતોલનશક્તિ હોય તો ચાલવાની કિયામાં બંગ પડતાં પડવામાંથી વ્યક્તિ બચી જય છે, તથા




નટવિદ્યા

ઘોડેસ્વારીમાં સમતોલન જળવાય છે. સમતોલનશક્તિ ગતિમેળ સાથે તથા ડેટલાંક કૌશલ્યોમાં અપણતા સાથે સંકળાયેલ છે.

૧૦. ચોક્સાઈ (Accuracy) :- ચોક્સાઈ એટસે ડોઈ લક્ષ્ય પ્રતિ એચિછક ગતિઓનું નિયમન કરવાની વ્યક્તિત્વની શક્તિ. આ લક્ષ્ય અંતર હોઈ શકે; જેમણે દા વડે નિશાનતાક; અથવા શરીરના ભાગ સાથે સીધા સંપર્કમાં પણ હોઈ શકે; જેમણે ચિન્હ હોરવું વગેરે. બાસ્કેટબોલમાં શૂટિંગ, ફૂટબોલમાં ગોల ક્રીક, બેઝબોલમાં ફ્લાઇટર્લેન્દો દડો ઓલવો વગેરેમાં ચોક્સાઈ જરૂરી છે. મોટરને પાર્કિંગ કરવામાં, ગીરદીમાં વાહન ચલાવવામાં વગેરે જીવનના અનેક પ્રસંગોએ પણ ચોક્સાઈ શક્તિત્વી જરૂર પડે છે. ચોક્સાઈશક્તિ સમતોલન શક્તિ સાથે સંકળાયેલી છે.

શારીરિક ક્ષમતાના વિકાસમાં વિવિધ રમતગમતોનો ફોનો છે. ફોનો છે તે સંબંધમાં એમેરિકાની 'પ્રેસિડન્ટ્સ કાઉન્સીલ ઓન ફિઝિકલ ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ' તરફથી નીચે મુજબ ડોડો તૈયાર કરવામાં આવ્યો છે.



ફુટિંગ

ઉપરોક્ત ડોડાની વિગતો લક્ષ્યમાં લઈને દરેક વ્યાયામ-રમત સંસ્થાએ પોતાની સંસ્થાના વિદ્યાર્થીઓ માટે શારીરિક શિક્ષણુનો ડોઈ કુમ એવી રીતે ઘડવો જોઈએ કે શારીરિક ક્ષમતાના દરેક દરેક અંગના વિકાસ માટે તેમાં પૂરતી જોગવાઈ હોય, એટલું જ નહિ પણ તેને અનુલક્ષીને સર્વ સગવડો વિકસાવવી જોઈએ. એ કદી ન ભૂલવું જોઈએ કે, રાષ્ટ્રના ડોઈ પણ વિકાસ કાર્યક્રમના સફળ આયોજન માટે શારીરિક ક્ષમતા અનિવાર્ય છે; અને નહિ કે નિર્ભળ રાજ્ય પરંતુ મજબૂત અને ખળવાન રાજ્ય જ રાજ્યોથી સલામતી તથા અંતરરાષ્ટ્રીય શુલ્કોચ્છા હાંસલ કરી શકે છે.

શારીરિક ક્ષમતાના ઉપરોક્ત વિવિધ અંગોના


રમત નમત	કદ્ય	સનાયુ સહન- શક્તિ	સનાયુ વિસ્કેટક શક્તિ	ગતિમેળ	સમતોલન	નમનીયતા
એરોનિક ડાન્સીંગ	+	+	+	+	+	+
આર્ચરી (તીરંદાજ)			+			
બેડમિન્ટન	+	+		+		
ખાયસીકલ રાઈડીંગ	+	+	+		+	
બોલિંગ				+	+	
ડોનોઇંગ (બો)	+	+			+	
ડોનોઇંગ (સ્ટન્ટ)	+	+	+	+	+	
ફ્લાય ફ્રીશીંગ	+	+	+			
ગોલ્ડ (વેક્ઝીંગ)	+	+			+	
ગોલ્ડ (વાથ કાટ્ટ)					+	
હેન્ડબોલ	+	+	+	+	+	+
હાયક્રીંગ	+	+	+		+	
હોર્સબેક રાયડીંગ			+		+	
નોગીંગ	+	+			+	
લેંગ બ્રિસ્ક વોક	+	+				
માઉન્ટન કલાઇમ્પિંગ	+	+	+	+	+	
રોઇંગ	+	+	+	+		
સેટ્ટલીંગ	+		+	+		
શોટ વોક	+					
સોફ્ટ બોલ		+		+		
સ્ક્રેચ ડાન્સીંગ	+	+		+	+	
સાર્ક્રો-કાસ્ટ્રીંગ		+	+	+	+	
સ્વીમીંગ (તરણુ)	+	+	+	+		+
ટૈલ્સ ટેનિસ	+			+		
ટેનિસ	+	+	+	+	+	+
અપલેન્ડ ગેમ્બ હન્ટીંગ	+	+			+	
વોક-રન-વોક	+	+			+	

+ આ ચિહ્ન ને તે બાબતના વિકાસમાં તે પ્રષ્ટતિનો ઝાળો દર્શાવે છે.

૭. આદર્શી શરીર વિકાસ

આદર્શી શરીરવિકાસ એટલે સુંદર આકારવાળું, સંવાદમય અંગવિન્યાસવાળું, સૂક્ષ્મ ચપળ ગતિ વાળું, બળવાન પ્રકૃતિવાળું તથા આરોગ્ય તેમજ અવયવોની ડિયાઓમાં રોગ વગેરે સામે વિરોધ કરવાની શક્તિવાળું, એવું શરીર તૈયાર કરવું તે; અને આપી શરીરસંપત્તિ પ્રાપ્ત કરવી તેને પ્રાચીન કાળથી દરેક પ્રગતિશીલ દેશમાં વ્યાયામસાધના પાણીનો પાયાનો ઉદ્દેશ ગણુવામાં આવ્યો છે. આદર્શ શરીર વિકાસ સંબંધમાં જે વિવિધ દસ્તિઓ વિચાર કરવામાં આવ્યો છે તેની સંક્ષિપ્ત માહિતી નીચે આપી છે.

ધર્માંથોમાં ખલોપાસના : આપણા દેશમાં વેદ, ઉપનિષદ, ભગવદ્ગીતા, વૈદ્યક્ષાસ્ત્ર તથા સાહિત્યમાં શરીરને આત્માનું મંદિર ગણુવામાં આવ્યું છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ



અદ્ભુત શરીર વિકાસ : યુજેન સેનો

ચારેય પુરુષાર્થના પાયા તરીકે તેને સ્વીકારવામાં આવ્યું છે તથા ધર્મપાલના પ્રથમ સાધન તરીકે તેનું સ્થાન કંડારવામાં આવ્યું છે; એટલું જ નહિ પણ જીવનમાં નિરામય, બળવાન અને સુંદર શરીરનું ગૌરવ કરવામાં આવ્યું છે.

ऋગ્વેદમાં બળ અને વેગની જુદી જુદી માત્રા તથા પ્રકારો જીતાવનાર ધણ્ણા શષ્ટ્રો છે. બળ, વીઠ, જેમ, શત્રુનો પરાજ્ય કરવાની શક્તિ તેમજ બળવાન સંતતિ માટેની ધણ્ણી પ્રાર્થનાઓ જેવામાં આવે છે. બલમસ્તિ બલ મયિ ધેહિ । નાડ્યમાત્મા બલહીનેન લભ્ય : । એવાં વાક્યો ઉપરથી જગ્યાય છે કે પ્રાચીન આર્યો બળના ઉપાસક હતા।

બલ બલવતામસ્તિ કામરાગવિવજિતમ् । (ભગવદ્ગીતા : ૭-૧૧) આ વાક્ય પણ અળની મહત્ત્વાની વિષેનો શ્રી ગીતાકારનો ઘ્યાલ સ્પષ્ટ દર્શાવે છે પ્રાચીનો શરીરણળ અને આત્મણળ એમ બંનેની કીમત સમજતા હતા. યોગસાધના કરનાર માટે પણ શરીર સ્વાસ્થ્ય આવશ્યક હતું અને યોગાસનોનો હેતુ શરીરના વિકારોને દૂર કરી તેને કાર્યસાધક બનાવવાનો હતો।

‘પાતંજલ સૂત્ર’ માં શરીરસંપત્તિની બાબતમાં રૂપલાવણ્યબલવજ્રસહનત્વાનિ કાયસંપત્ત . એવું સૂત્ર છે. તે દર્શાવે છે કે, આદર્શ શરીર-સંપત્તિનાં ઇપ, લાવણ્ય, બળ અને વજસંહનત્વ – એ ચાર લક્ષણો છે. શ્રીકોણી જેમ ઇપ (symmetry of form and grace) ને સૂત્રકાર શરીર-સંપત્તિના આદર્શમાં સ્થાન આપે છે. લાવણ્ય એ મોતીનાં પાણી પેઢે અમૂક પ્રકારના તેજસ્વીપણુની ઝાંચ દર્શાવેલો શષ્ટ્ર છે. લાવણ્ય શરીરની અંદર ચાલતી સર્વ ડિયાઓના તેમજ અંતરજીવનના સુભેણનું પરિણ્ણામ જગ્યાય છે. બળ શષ્ટ્ર આપણુંને

સારી રીતે પરિચિત છે. છેલ્ખું લક્ષ્ણ વજસંહનનત્વ એ ખડતલપણુંની એટલે કે અમ અને આધાતો સહન કરવાની શક્તિ સૂચવે છે.

શરીરબળને ઈષ્ટ ગણુવા છતાં શાસ્ત્રકારોએ તેને જીવનતું ઈષ્ટ સાધ્ય નહિ, પણ માત્ર ધર્મના સાધન રૂપ માન્યું છે. શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમં । એ વાક્યથી શરીર માટે શરીર નહિ, પણ ધર્મના સાધન તરીકે શરીર, એ બાબતનું સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે. માત્ર શરીરબળ નહિ પણ ધર્મની સાધનામાં વપરાતું શરીરબળ આપણા દેહમાં ઈષ્ટ ગણ્યાયું છે.

આદર્શ વીર : ડોઈ આદર્શ વીરને અંજલિ આપવામાં આવે છે ત્યારે તેની સ્તુતિ કરવામાં આવે છે; તેના ખાસ અને મહત્વના તથા અનુસરણ કરવા જેવા ગુણોનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે અને એ જ સ્તુતિગીતોની અગત્ય છે. શરીરબળના ઉપાસ્ય દેવ શ્રી મારીતિની સ્તુતિમાં એ આદર્શ વીરના કયા ગુણ ઉપાસના માટે યોગ્ય ગણ્યાયા છે, તે જેવામાં આવે છે. સ્તુતિ નાચે પ્રમાણે છે-

**મનોજવં મારૂતતુલ્ય વેગ
જિતેન્દ્રિયમં બુદ્ધિમતાં વરિષ્ઠમં ।
વાતાત્મજં વાનરયુથમુહ્યં
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે ॥**

આ સ્તુતિમાં શરીરબળ ઉપરાંત ખીજા ડેટલાક ગુણોને વીરતા માટે જરૂરી ગણ્યા છે. એમાંનો પહેલો ગુણ મનોજવ એટલે કે શીધગ્રાહીપણું છે. ખીજે ગુણ મારીતતુલ્ય વેગ છે. જે કાર્ય કરે તેમાં અડય અને કાર્યસાધકતા એ મારીતતુલ્ય વેગથી સુચિત થાય છે. ત્રીજે ગુણ છે જિતેન્દ્રિયપણોનો. ધણું વીર પુરુષો આ ગુણ નહિ હોવાને લીધે જીવનમાં ખરાણે ચઢેલા છે અને તેમનાં જીવન નિષ્ફળ ગયેલાં છે. સંયમ વગરનું બળ પાંગળું છે; એટલું જ નહિ પણ તે અવળે રહ્યે રહ્યે લઈ જનારં



આદર્શવીર મારીતી

થઈ પડે છે. સંયમ વગરના શરીરબળની અવસ્થા એક વગરની સાયકલ અથવા સદ કે સુકાન વગરના નાવ જેવી થાય છે. ચોંધો ગુણ છે. બુદ્ધિમત્તાનો. આદર્શ વીર પહાડ જેવા શરીરનો પણ બળદિયા જેવો મંદ્યુદ્ધિ હોય તે ન ચાલે. તે બુદ્ધિમાન હોવા જોઈએ. વળી તે સામાન્ય જનતામાંનો એક નહિ, પણ વાનરયુથનો મુખ્ય એટલે કે ઉત્સાહથી જરૂરાં હુવાનો અથવા સૈનિકાના નેતા થવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. નેતાગીરીના ગુણ આદર્શ વીર માટે આવશ્યક છે. આવાં લક્ષ્ણજોવાળો એ વીર, વળી રામદૂત અને નહિ કે રાવણુદ્વાત હોવો જોઈએ. એનો અર્થ એવો કે તેનામાં પોતાની શારીરિક અને માનસિક શક્તિઓનો ઉપયોગ રામના એટલે કે સત્યના પક્ષની હિમાયતમાં કરવાની વૃત્તિ હોવી જોઈએ. પોતાની શક્તિઓનો ઉપયોગ રાવણુના એટલે કે દાદાગીરી કે સ્વાર્થના પક્ષમાં દરવાની


જુતિ ન હેઠી જોઈએ. આમ આદર્શ વીરતા અને તેના સાધન રૂપ વ્યાયામ પાછળ જીવનદિષ્ટ ડેવી હેઠી જોઈએ તે આ માર્ગતિસ્તુતિ પરથી સ્પષ્ટ સમજય છે.

વ્યાયામથી સધાતા શરીરવિકાસ સંખ્યમાં વૈદકશાસ્ક્રાની દર્શિએ વિચારીએ તે વાગ્બદૃ જણાવે છે કે - લાઘવં કર્મસામર્થ્ય દીપ્તોર્ગ્રિનમેં દસ : ક્ષય : । વિભક્તધનગાત્રત્વં વ્યાયામાદુપજાયતે ॥ આ શ્લેષાક્રમાં વ્યાયામથી થતા જૌતિક લાભોનું વર્ણન છે, ને દર્શાવે છે કે માંસપેશીએના કદનો વધારો એ સફળ વ્યાયામનું એક માત્ર અથવા અગત્યનું પરિણામ લેખાયું નથી. શ્રી વાગ્બદૃના મતે લાઘવ એટલે ચપળતા, કર્મસામર્થ્ય એટલે કામ કરવાની શારીરિક કાર્યસાધકતા, સરસ પાચનશક્તિ, વધારે પડતી ચરખીનો ક્ષય અને છેલ્લે વિલક્ષ્ણ અને ધન માંસપેશીએ એ વ્યાયામનાં જૌતિક પરિણામે અથવા લાભો જણાય છે. વધારે પડતા ચરખી એ આપણે ત્યાં શરીરવિકાસના દુપણ રૂપ લેખાઈ છે; તથા પાતળી પણ ચપળ અને બળવાન કાયા આદર્શ ગણ્યાઈ છે, એમ મેદચ્છેદકૃષોદર લઘુ ભવત્યુત્થાનયોર્ગ્યં વપુઃ । એવા મૃગયાના લાલનું વર્ણન કરતા કવિ શ્રી કાલીદાસના 'શાકુન્તલ' નાટકની ઉપર જણાવેલી શ્લેષાક્રમંકિથા જણાય છે. આ વિચારસરણી વાગ્બદૃની વિચારસરણીને મળતી આવે છે.

સંસ્કૃત સાહિત્યમાં આદર્શ વીરતાની બાળતમાં ડેવા વિચારો છે તેતું દર્શન કવિ શ્રી ભવભૂતિ 'ઉત્તરરાભ્યરિત' માં શ્રીરામચંદ્રજીના વીર પુત્ર કુશના કરેલા નીચેના વર્ણનમાં થાય છે—

દૃષ્ટસ્તૃણીકૃત જગત્ય સત્ત્વ સારા
ધીરોદ્ધતા નમયતીવ ગતિર્ધરિત્રીમ ।
કૌમારકેર્પિ ગિરિવદ્ગુરૂતાં દધાનૌ
વીરો રસ : કિમયમેત્યુત દર્પ એવ ॥

અર્થાત્ કુમાર કુશમાં માત્ર શરીર બળ જ નહિ, પણ ત્રણેય જગતના સત્ત્વના સારને તૃણુવત ગણે



સર્વદમન ભરત

એવી આત્મશક્તિયુક્ત પરાક્રમની છાયા તેની દર્શિભાં હતી અને સાથે સાથે ગિરિ જેવી ગંભીરતા હતી. ટૂંક્રમાં મૂંગી અને છાક વિનાની અને તે કારણે આત્મશક્તિયુક્ત પરાક્રમની, વીરતાની છાપ તેની અંખ્યમાં હતી. વીરતાનાં ખરાં લક્ષ્ણાની પ્રશંસા છે. એ જ શ્લેષાક્રમાં કાયાના કદનું નહિ, પણ ચાલતાં ધરણી ધુંજાવે એવી ચાંપ-ઉછાળ ચાલની છટા, જેમાં બળની સાથે ચપળતા અને લાલિત્યનું મિશ્રણ થયેલું છે, તેવી શરીરસંપત્તિનું વર્ણન છે.

વીરશ્રીનો ખીને ઉદ્દેખ કવિ શ્રી કાળીદાસના મહાકાવ્ય 'રધુવંશ'માં દિલ્લીપ રાજના વર્ણનમાં આવે છે, તે નીચે મુજબ છે.

વ્યૂહોરસકો વૃષસ્કંધ : શાલપ્રાંશુ મહાભૂજ : ।
આત્મકમંક્ષમં દેહં ક્ષાત્રો ધર્મ ઇહાશ્રિત : ॥
સર્વતિરિક્તસારેણ સર્વતેજોર્ગમિભાવિના ।
સ્થિત : સર્વોન્તતેનોર્વી ક્રાન્ત્વા મેહરિવાત્મના ॥

બાકાર સહશા પ્રજા પ્રજપા સહશાગમઃ ।
આગમઃ સહશારંમ આરંમ સહશોવયઃ ॥

અથાત् પદોળી છાતી, સાઢની ખાંધ નેવો (જંચો) ખભાનો ભાગ, શાલ વૃક્ષ નેવી જંચાધ અને લાંબા ડાયવાળો તે જણે ક્ષાત્રવમેં પોતાના કાયંને લાયક દેહ ધારણું કર્યો હોય તંવો હતો. (૧)

બળમાં તે સર્વથી અધિક હતો; પોતાના તેજથા અન્યના તેજનો પરાભવ કરનાર હતો; સર્વથી ઉન્નત (એવા આત્મા) વડે પૃથ્વાને વશ કરીને મેરુ નેવો જબો હતો. (૨)

નેવી શરીરની આકૃતિ હતી તેવી તેવી ખુદ્ધિ હતી; ખુદ્ધિ હતી તેવું શાઅર્ગાન હતું; શાઅર્ગાન નેવું ચરિત હતું અને ચરિતના નેવો ઉદ્ઘાટન હતો. (૩)


આ શ્લોકામાં પણ ખુદ્ધિ, અભ્યાસ તથા

ચારિત્રના ચુંયોગવાળા શરીર તથા શરીરખળને આદર્શ ગણેલું છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે. આમ આપણી સંસ્કૃતિમાં વ્યાયામસાધના પાછળનો ઉદ્દેશ શરીરવિકાસની સાથે સાથે આંતર-જીવનની શુદ્ધિ સાધી તેજસ્વીતા-આધ્યાત્મિકતા વધારવાનો છે તેવી પ્રતીતિ મળે છે.

બત્રોસ લક્ષણો પુરુષ

હવે લોક સાહિત્યની દિલ્લિએ આદર્શ શરીરનો વિચાર કરીએ. સર્વોત્તમ પુરુષને 'બત્રોસ લક્ષણો પુરુષ' તરફ એળખવામાં આવે છે. આ બત્રોસ લક્ષણો કયાં તે સંબંધમાં 'ચૈતન્ય ચરિત્રાભૂત' માં નીચેનો શ્લોક આપેલો છે.

પञ્ચદીર્ઘઃ પञ્ચસૂક્ષ્મઃ સપ્તરવૃત્તઃ ષદ્ધુન્તતઃ ।
ત્રિહૃસ્વઃ પૃથુગંભીરો દ્વાત્રિંશલ્લક્ષણો મહાન् ॥



છલખલતું જોમ (કમલ ભંડારી લારત)

પંચ હીંદ્રી: પંચ અવયવો લાંબા હોવા જોઈએ તે નાક, હાથ, હનુ, આંખ અને જન્મ. નાક બૂણું, ચપડું, નાતું હોય એ નિંઘ ગણુઓહું છે. સ્યેનપક્ષીની ચાંચ જેવું નાક સરસ મનાય છે. હાથ માટે તો આજનાહુ-ધૂંટણ સૂધી પહેંચે એવા લાંબા હાથ ઓછ મનાય છે.

હનુ એટલે હડપચી. દ્વિરદપતિ હનુ : હાથીના જેવી હનુ એ વિપુલ બલયુકૃત પુરુષનું વિશેપણ છે. આંખ વિશાલ-વિશાલાક્ષ. જનુ એટલે ધૂંટણ પણ લાંબા હોવા જોઈએ.

પંચ સૂક્ષ્મ : પંચ અંગ સૂક્ષ્મ હોવાં જોઈએ તે ચામડી, વાળ, આંગળીના વેઢા, દાંત અને તુંવાટી. ચામડી અતિ ખૃદુ અને સુંવાળા હોવી જોઈએ. શ્રુક્ષણ ત્વક્ અત્યંત મુલાયમ ચામડી એ આદર્શ ચામડી છે શરીરમાં હંદ્રીથી ખીંચ નંબરનો ઉપયોગી અવયવ કોઈ હોય તો તે ચામડી છે. જરી ખડુભયડી ચામડી અદ્વાયુપની સૂચક છે.

વાળ પણ બહુ બારીક, મુલાયમ હોવા જોઈએ. ખરસટ વાળ અદ્વાયુપધોતક છે. શરીર ઉપર પણ બહુ અદ્વાય વાળ હોવા જોઈએ.

આંગળીના વેઢા (પર્વ) બહુ લાંબા હોય તે ટીક માનવામાં આવતું નથી. દાંત ધારીદા, નાજુક, દૂધ જેવા શ્વેત, દાડિમના દાણણની જેમ ગેડવેલા જોઈએ. લાંબા દાંત અદ્વાયુપ અને ગરીબાઈ સૂચવનાર મનાય છે.

તુંવાટી (રોમ) એટલે કે શરીર ઉપરના વાળ ધણ્ણા ઓછા હોવા જોઈએ. કેટલાક પુરુષોના શરીર ઉપર અતિશય વાળ હોય છે તે અદ્વાયુપ અને અદ્વાયાભસ્યક છે.

સૂપ્ત રૂક્ત : સાત અવયવો લાલ રંગના હોવા જોઈએ તે આંખના ખૂણા, હાથનાં તળિયાં, પગનાં તળિયાં, તાલુ, ઓછ, જીબ અને નખ. આંખના ખૂણા (અપાજ્ઞ) લાલ હોવા જોઈએ.

હાથ અને પગનાં તળિયાં માટે તો કરારવિંદ, પાદારવિંદ વિશેપણો જ બસ છે. તાળિંદું, હોઠ, જીબ અને નખ આ બધાં લાલચોળ હોવાં જોઈએ. નખ ઉપરથી અનેક પ્રકારના રોગો પારખી શકાય છે. જડા, શુષ્ક હોક નિંઘ ગણ્યાય છે. જીબ પણ બહુ જરી ન હોવી જોઈએ. નખ ઉપર કાતરા કે ચીરા પડેલા ન હોવા જોઈએ.

ષડુન્નત : જ અવયવો ઉન્નત-ઉપડતા હોવા જોઈએ તે છાતી, ખભા, નખ, કેડ અને મુખ. બેસી ગયેલી છાતી એ પુરુષ માટે લંજાસ્પદ છે. વ્યૂઢોરસ્ક ઉપસેલી મજબૂત છાતી આદર્શ પુરુષ શરીરમાં અવસ્થ હોય.

ખભા વૃષસ્કંધ એટલે કે સાંધની કંધ જેવા જિંચા હોવા જોઈએ. આદર્શ શરીરસૌષ્ઠવના ફોટોઓમાં આ જેવા મળે છે. નખ અંદર બેઠેલા ન હોવા જોઈએ. નાક ઉન્નત તથા કેડ અને મેઢાં પણ ઉન્નત અને લરાવદાર હોવાં જોઈએ.

ત્રિહૂસ્થ : ડોક, જંધ અને ઉપસ્થ આ ત્રણ કદમાં નાનાં હોવાં જોઈએ. લાંખી ગરદન પ્રશસ્ત નથી. ચતુરજ્ઞલોત્સેધા દ્વાવિંશત્યજ્ઞ પરિણાહા શિરોધરા । (ચરક) અર્થાત ગરદન પોતાના ચાર આંગળ જેટલી જિંચી અને ૨૨ આંગળ ઘેરાવાવાળી હોવી જોઈએ. પુરુષનું લિંગ પણ કદમાં નાતું હોવું જોઈએ. ઝોષ ષડ્જલદીધ પઞ્ચાજ્ઞલ પરિણાહ । (ચરક) અર્થાત પુરુષનું લિંગે પોતાની જ આંગળોએ જેવકું લાંખું અને પંચ આગળ ઘેરાવાવાળું હોવું જોઈએ. બહુ લાંખું લિંગ અનારોગ્યકર મનાય છે.

જંધ ૧૮ આંગળ લાંખી અને ૧૬ આંગળ ઘેરાવાવાળી હોવી જોઈએ (ચરક)

ત્રિપુષ્ટ : આમાં કેડ, લલાટ અને છાતીનો સમાવેશ થાય છે.

ત્રિગંભીર : આમાં નાલિ, સ્વર અને બુદ્ધિનો સમાવેશ થાય છે.

આદર્શ શરીરવિકાસ

છે. આમ જોતાં સોમેટોટાઈપ ૭૧૧ મહત્વમાં મેન્પ્રધાનતા દર્શાવે છે; ૧૧૭ મહત્વમાં સ્નાયુપ્રધાનતા દર્શાવે છે; ૧૧૭ મહત્વમાં અસ્થિપ્રધાનતા દર્શાવે કે અને ૪૪૪ નાણ્ય પ્રકારોના મધ્યમતા દર્શાવે છે. આગળથી, પાછળથી અને બાજુ પરથી લીધેલા વ્યક્તિના ડેટોગ્રાફ ઉપરથી શરીરની બાંધાની કક્ષા નક્કી કરી શકાય છે.

પોષણ (Nutrition): શરીરના વિકાસની પ્રક્રિયામાં ઈષ્ટ પોષણ એ પાયાની બાગત છે. સમગ્ર સંજ્ઞન શરીર અથવા તેના ડોઈ લાગતી વૃધ્ધિ, જગવણી, અને દુરસ્તી સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયાનો સરવાળો એટલે પોષણ. પોષણની કામગીરી શરીરના વ્યક્તિગત ડોપો સાથે હોય છે, તેમજ પોષક તત્વોના સતત વિનીમય સાથે હોય છે. વાસ્નવિક રીતે વિચારીએ તો પોષણ એટલે આહારનો ગોઝ્ય પુરવડો એટલું જ નહિં, પણ તે ઉપરાંત ને પ્રક્રિયાઓ દ્વારા જરૂરી પોષક ઘટકો શરીરના વિવિધ ડેપન્શી (Tissue)નું ધડતર તથા દુરસ્તી કરવા પણેંચી જન્ય છે, શારીરિક પ્રક્રિયાઓને નિયમિત રૂપે છે તથા શરીરના

મુશ્કુરું પોષણ

૧. મુનિકસિત શરીર.
૨. જીંચાઈના પ્રમાણમાં લગભગ પ્રમાણુસર વજન.
૩. મુનિકસિક અને દદ સ્નાયુઓ.
૪. તેજસ્વી અને રતાશયુક્ત ચામડી.
૫. ચામડી નીચે ચરખીનું યોગ્ય પડ.
૬. અંખ અને મોંઢાની અંતસ્તવચા ચુલ્લાભી રંગની.
૭. ચુંબણા અને ચાળકાટવણા વાળ.
૮. ચોઠળા અને નીચે ઢાળાં ફૂંડાળાં વિનાની આંગો.


આંતરિક તથા જાદ કાર્ય માટે ગ્રાનીલ્સ તરફે કાર્ય આપે છે તે ને જીવી પ્રક્રિયાઓની સમગ્ર સંક્ષાળ

પોષણની આ સમ્માનનામાં જ્યારે કંઈ જાંગાણું પડે છે ત્યારે તે વિકૃત પોષણમાં પરિણામે છે. આના કારણું ક્ષેપે અભૂતતો બોગાડ. અયોગ્ય વા જિન્સમંતોલ બોગાડ અથવા બોગાડ પૂરતો દોવા છ્ટાં ક્રાઇચ આંતરિક વિકૃતિના કારણે શરીર તેને સમાવી ન શકે-આ પેઢી ડોઈને ક્રાઇચ કારણું હોઈ શકે. શરીરના ડોઈ લાગતે પોષિક બોગાડનો યોગ્ય અને પૂરતો પુરવડો ન મળે તો તેના પોષણમાં વિકૃતિ આવે છે. યોગ્ય અને અનુદૂળ પરિસ્થિતિમાં ઉછરેલાં બાળકો અયોગ્ય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછરેલાં તેણી જ ઉંમરનાં બાળકો કરતાં શિયાં, વજનદાર અને ચુંબિકાલિત દેશ છે, એમ મોટે લાગે માલમ પડે છે.

ઇષ્ટ પોષણ અને નમગ્ના પોષણ સંબંધમાં અમેરિકન વૈજ્ઞાનિક શ્રી બોગર્ડ નીચે મૂજાં લક્ષ્યો દર્શાવે છે.

નખળું પોષણ

૧. અદ્યવિકસિત શરીર અથવા નમગ્નો બાંધી અથવા ચારીરિક ખામી.
૨. સામાન્યતાઃ સુકુલડી શરીર; ડોઈઃ વાર વધારે પડતી ચરખી.
૩. નાના અને ચેચા સ્નાયુઓ.
૪. ટીલી અને દિક્કો વા નિસ્તેજ ચામડી.
૫. ચામડી નીચે ચરખીના અલાવ.
૬. અંતસ્તવચા દિક્કો.
૭. એરાજું અને પુંખરા વાળ.
૮. અંખ નીચે ઢાળાં ફૂંડાળાં.



મેદપ્રધાન (૬૪૧)

સનાયુપ્રધાન (૧૬૧)

અસ્થિપ્રધાન (૧૧૬)

આમ અત્રીસલક્ષણું પુરુષો એટલે આદર્શ શરીરવાળા પુરુષો અને આવા પ્રમાણુરાળાં શરીરે ને દેશમાં હોય તે દેશમાં આયુષ, બળ, એજ, ચુખ, એસ્ટ્રેચ, ધન અને ખીજ છાટ ભાવે અવશ્ય હોય જ. તત્ત્વ આયુ: બલં ઓજ: સુખ એશ્વર્ય: વિત્ત ઇષ્ટાશ્રપરા ભાવા: ભવન્ત્યદત્તા: પ્રમાણવતિ શરીરે । (ચરક).

શારીરિક ખાંડો (Somato type) :- ડેઝ પણ એ માનવશરીર કઢી પણ સર્વીત : એક સરખાં હોતાં નથી, એ એક સર્વવિદ્ધિ હક્કીકત છે. શરીરના બાંધાની સાથે સ્વભાવની ખાસિયતોને જોડવાનું સામાન્ય વલણ લેઠામાં છે; જેમ કે જડા માણુસો આનંદી અને વિનોદપ્રિય હોય છે, જ્યારે પાતળા માણુસો જાનતાંતુપ્રધાન અને ચંતાસહજ હોય છે. વિઘ્યાત શારીરિક કેળવણી-કાર શેલુને શરીરના બાંધાને અનુલક્ષીને મેદપ્રધાન (Endomorph) એટલે કે ચરખીવાળા, સનાયુપ્રધાન (Mesomorph) એટલે કે કસરતગાજ

અને અસ્થિપ્રધાન (Ectomorph) એટલે કે સૂક્લકડી એમ ત્રણુ વિલાગ પાડ્યા છે. (૧) શરીરની મુલાયમતા અને ગોળમટોળપણું એ મેદપ્રધાન શરીરની વિશિષ્ટતા છે. ચરખીના ભરાવાને લઈને છાતી અને પેટ ભરાવદાર લાગે છે. (૨) કક્ષા, ખડતલ અને વિકસિત સનાયુઓ એ સનાયુપ્રધાન શરીરની ખાસિયત છે. હાડકાં લાંબાં અને ભરાવદાર માંસપેશીઓથી ઢંકાએલાં તથા છાતી વિશાળ અને સિંહકટિ હોય છે. (૩) શરીરની નાજુકતા અને સૂક્લકડીપણું એ અસ્થિપ્રધાન શરીરનું લક્ષણ છે. આમાં હાડકાં નાનાં અને સનાયુઓ આણા તથા હાથ પગ લાંબા અને ધડ દૂંકું હોય છે.

દરેક વ્યક્તિના શરીરમાં ઉપરોક્ત ત્રણેય પ્રકારોનું અસ્તિત્વ વધતા ઓછા પ્રમાણુમાં હોય છે જ અને તેથી આ દશ્ચિએ શરીરના બાંધાનું મૂલ્યાંકન કરવા સંબંધમાં ત્રણ આંકડાની રીત પ્રયોગિત છે, જેમાં દરેક આંકડો ૧ થા ૭ ના ચઢતા ફરમાં ઉપરોક્ત દરેક પ્રકારની માત્રા દર્શાવે

છે. આમ જોતાં સોમેટોટાઈપ ૭૧૧ મહત્તમ મેન્પ્રધાનતા દર્શાવે છે; ૧૧૭ મહત્તમ સ્નાયુપ્રધાનતા દર્શાવે છે; ૧૧૭ મહત્તમ અસ્થિપ્રધાનતા દર્શાવે છે અને ૪૪૪ વળેય પ્રકારોની મધ્યમતા દર્શાવે છે. આગણથી, પાછળાથી અને બાજુ પરથી લીધેલા વ્યક્તિના ફોટોઓઝ ઉપરથી શરીરની બાંધાની કક્ષા નક્કી કરી શકાય છે.

પોષણ (Nutrition): શરીરના વિકાસની પ્રક્રિયામાં ઈષ્ટ પોષણ એ પાયાની બાખત છે. સમગ્ર સજ્જવ શરીર અથવા તેના ડોઈ લાગની વૃધ્ધિ, જગ્ગાવણી, અને દુરસ્તી સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયાનો સરવાળો એટલે પોષણ. પોષણની કામગીરી શરીરના વ્યક્તિગત ડોષો સાથે હોય છે, તેમજ પોષક તત્ત્વોના સતત વિનીમય સાથે હોય છે. વાસ્નવિક રીતે વિચારીએ તો પોષણ એટલે આહારનો યોગ્ય પુરવડો એટલું જ નહિં, પણ તે ઉપરાંત ને પ્રક્રિયાઓ દ્વારા જરૂરી પોષક ઘરડો શરીરના વિવિધ ડોપનણ (Tissue)નું ધડતર તથા દુરસ્તી કરવા પહોંચી જય છે, શારીરિક પ્રક્રિયાઓને નિયમિત રાખે છે તથા શરીરના

ઈષ્ટ પોષણ

૧. સુનિકસિત શરીર.
૨. જાંચાઈના પ્રમાણમાં લગભગ પ્રમાણુસર વજન.
૩. સુવિકસિક અને દઢ સ્નાયુઓ.
૪. તેજસ્વી અને રતાશયુક્ત ચામડી.
૫. ચામડી નીચે ચરખીનું યોગ્ય પડ.
૬. આંખ અને મોંઢાની અંતસ્તવચા ચુલાણી રંગની.
૭. સુંવાળા અને ચળકાટવાળા વાળ.
૮. ચોકળી અને નીચે છાળાં ઝુંડાળાં વિનાની આંખો.

આંતરિક તથા બાબ્ધ કાર્ય માટે અળતણું તરિકે કાર્ય આપે છે તે બધી પ્રક્રિયાઓની સમગ્ર સંકળ

પોષણની આ સમગ્ર ઘટનામાં જ્યારે કંઈ ભંગણું પડે છે ત્યારે તે વિકૃત પોષણમાં પરિણામે છે. આના કારણું ઇથે અપૂરતો ખોરાક, અયોગ્ય યા બિનસમતોલ ખોરાક અથવા ખોરાક પૂરતો હોવા છતાં ડોષ આંતરિક વિકૃતિના કારણે શરીર તેને સમાવી ન શકે—આ પૈકી ડોષને ડોઈ કારણું હોઈ શકે. શરીરના ડોઈ લાગને ચૌચિક ખોરાકનો યોગ્ય અને પૂરતો પુરવડો ન મળે તો તેના પોષણમાં વિકૃતિ આવે છે. યોગ્ય અને અનુકૂળ પરિસ્થિતિમાં ઉછરેલાં બાળડો અયોગ્ય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછરેલાં તેટલી જ ઉંમરનાં બાળડો કરતાં જિચાં, વજનદાર અને સુવિકસિત હોય છે, એમ માટે લાગે માલમ પડે છે.

ધ્યાન પોષણ અને નખળા પોષણ સંબંધમાં અમેરિકન વૈજ્ઞાનિક શ્રી બોગર્ટ નીચે મુજબ લક્ષણો દર્શાવે છે.

નખળું પોષણ

૧. અદ્વિકસિત શરીર અથવા નખળો બાંધો અથવા શારીરિક બામી.
૨. સામાન્યતઃ સુકલડી શરીર; ડોઈક વાર વધારે પડતી ચરખી.
૩. નાના અને ચોચા સ્નાયુઓ.
૪. ઢીલી અને ફિક્કી યા નિસ્તેજ ચામડી.
૫. ચામડી નીચે ચરખીનો અલાવ.
૬. અંતસ્તવચા ફિક્કી.
૭. બરછટ અને ધુંધરા વાળ.
૮. આંખ નીચે કાળાં ઝુંડાળાં.

૬. મેં ઉપર સ્વસ્થતા અને હળવાણ.

૧૦. શરીરનો ટટાર ઉઠાવ (ઉત્કૃષ્ટ શિર, ઉધ્ઘૃત છાતી, સમાન ખલા તથા પેદુ ચાંદર)

૧૧. સુંદર સ્વભાવ અને ભરપૂર પ્રાણુશક્તિ.

૧૨. ધસધસાટ જાંધ આવે છે.

૧૩. ઈષ્ટ પચન અને ભળોત્સર્ગ.

૧૪. સરસ ભૂખ લાગે છે.

૧૫. સામાન્ય તંદુરસ્તી ઉત્તમ.

૬. મેં ઉપર બોને, ચિંતા અને અમની લાગણું।

૧૦. શરીરનો અમિત વા ખામીયુક્ત ઉઠાવ (આગળ ઢણતું માથું, સાંકડી-ચપટી છાતી, ગોળાકાર ખલા તથા આગળ ઢણતું પેટ)

૧૧. ચીઢિયો તથા અતિ ચંચળ સ્વભાવ, નિરૂત્સાહી, જલદી થાકી જય તથા એકાગ્ર થવાની અશક્તિ

૧૨. જાંધ આવતી નથી યા જાંધમાં અશાંતિ રહે છે.

૧૩. જ્ઞાનતંતુજીવિય અપચો અને કળજિયાતથી પીડાય છે.

૧૪. ઝોરાકથી કદી સંતોષ થતો નથી

૧૫. ચેપી રોગનો લોગ બને છે; સહનશક્તિ અને નુસ્સાનો અભાવ.

ઇષ્ટ ઉંમર - જાંચાઈ-વજનના કોઠા :-
આદશે શરીરવિકાસ માટે ઈષ્ટ પોષણ એ પાયાની બાબત છે અને વજન એ પોષણનું સૂચક છે એ હુકાતને અનુલક્ષીને એક જ જાતિ (sex) ઉંમર અને જાંચાઈવાળા અનેક બાળકોના વજનના આંકડા એકડા કરવામાં આવે છે અને તે ઉપરથી સરેરાશ વજન તારવી આ વજનને તે જાતિ, ઉંમર અને જાંચાઈવાળા લોકોને માટે સામાન્ય વજન તરિકે ગણુવામાં આવે છે અને આ રીતે બંને જાતિમાં વિવિધ ઉંમર અને જાંચાઈ માટે પ્રમાણુભૂત કોડા તૈયાર કરવામાં આવે

છે. આવા ડોઠામાં અમૂક ઉંમર અને જાંચાઈ માટે દરશાવેલા વજન કરતાં ૧૫ ટકા સુધી ઓછું કે વધારે વજન હોય તો તેને યોગ્ય વજનની કક્ષામાં ગણુવામાં આવે છે. આ સંબંધમાં ‘અમેરિકન ચાઈલ્ડ હેથ એસોસીએશન’ તન્દ્ધા પ્રગટ થયેલા પુડ-બાલ્ડવિન ડોઠાઓ ખૂબ જાણીતા અને પ્રચલિત છે. નીચે છોકરાઓ તથા પુરુષો માટે તેમજ છોકરી-ઓ તથા સ્ત્રીઓ માટેના ડોડા આપવામાં આવ્યા છે.

(અલખત આ ડોડા અમેરિકન ધોરણુને અનુલક્ષીને છે; પરંતુ આપણું દેશ માટે ૧૦ ટકા ધોરણ નીચું ગણીને તે ઉપરોગમાં લઈ શકાય.)

પુષ્ટ વયના પુરુષો માટે ઉંમર-ગ્રાંચ-વજન દર્શાવું કેઠો.

ઉંમર (વર્ષ)	૦	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮
	૦	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮
૧૫	૧૦૭	૧૦૮	૧૧૨	૧૧૪	૧૧૮	૧૨૨	૧૨૬	૧૩૦	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૭	૧૫૨	૧૫૭	૧૬૨	૧૬૭	૧૭૨	૧૭૭	
૨૦	૧૧૭	૧૧૮	૧૨૨	૧૨૫	૧૨૮	૧૩૨	૧૩૬	૧૪૦	૧૪૪	૧૪૮	૧૫૨	૧૫૬	૧૬૧	૧૬૬	૧૭૧	૧૭૬	૧૮૧	૧૮૬	
૨૫	૧૨૨	૧૨૪	૧૨૬	૧૨૮	૧૩૩	૧૩૭	૧૪૧	૧૪૫	૧૪૮	૧૪૩	૧૪૭	૧૬૨	૧૬૭	૧૭૩	૧૭૮	૧૮૪	૧૮૮	૧૯૪	
*૩૦	૧૨૯	૧૨૮	૧૩૦	૧૩૩	૧૩૬	૧૪૦	૧૪૪	૧૪૮	૧૫૨	૧૫૬	૧૬૧	૧૬૬	૧૭૨	૧૭૮	૧૮૪	૧૯૦	૧૯૬	૨૦૧	
૩૫	૧૨૮	૧૩૦	૧૩૨	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૬	૧૪૦	૧૪૫	૧૫૦	૧૬૪	૧૭૦	૧૭૬	૧૮૨	૧૮૮	૧૯૬	૨૦૧	૨૦૭	
૪૦	૧૩૧	૧૩૩	૧૩૪	૧૩૮	૧૪૧	૧૪૫	૧૪૮	૧૫૩	૧૫૮	૧૬૩	૧૬૮	૧૬૮	૧૭૪	૧૮૦	૧૮૬	૧૯૩	૨૦૦	૨૦૬	
૪૫	૧૩૩	૧૩૪	૧૩૭	૧૪૦	૧૪૩	૧૪૭	૧૫૧	૧૫૫	૧૬૦	૧૬૫	૧૭૦	૧૭૬	૧૮૨	૧૮૮	૧૯૫	૨૦૨	૨૦૮	૨૧૫	
૫૦	૧૩૪	૧૩૬	૧૩૮	૧૪૧	૧૪૪	૧૪૮	૧૫૨	૧૫૬	૧૬૧	૧૬૬	૧૭૧	૧૭૭	૧૮૩	૧૮૩	૧૮૦	૧૮૭	૨૦૪	૨૧૧	
૫૫	૧૩૪	૧૩૭	૧૩૮	૧૪૨	૧૪૫	૧૪૮	૧૫૩	૧૫૮	૧૬૩	૧૬૮	૧૭૩	૧૭૮	૧૮૪	૧૮૧	૧૮૮	૨૦૫	૨૧૨	૨૧૬	

* ૩૦ વર્ષની ઉંમરના વજનને મોટા ટાઇપમાં છાયા છે, કારણ કે પણીનાં વર્ષો દરમાન આરોગ્ય જળવવા કેટલું વજન આદર્શ ગણ્ય તે આ વજન દર્શાવે છે.

પુષ્ટ વયની સ્ત્રીઓ માટે ઉંમર-ગ્રાંચ-વજન દર્શાવું કેઠો.

ઉંમર (વર્ષ)	૦	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮
	૦	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮
૧૫	૧૦૧	૧૦૩	૧૦૪	૧૦૬	૧૦૭	૧૦૮	૧૧૨	૧૧૫	૧૧૮	૧૨૨	૧૩૦	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૭	૧૫૨	૧૫૭	૧૬૧	
૨૦	૧૦૬	૧૦૮	૧૧૦	૧૧૨	૧૧૪	૧૧૬	૧૧૮	૧૨૨	૧૨૪	૧૨૮	૧૩૨	૧૩૬	૧૪૦	૧૪૩	૧૪૭	૧૫૧	૧૫૬	૧૬૧	
૨૫	૧૦૮	૧૧૧	૧૧૩	૧૧૪	૧૧૭	૧૧૮	૧૨૧	૧૨૪	૧૨૮	૧૩૧	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૭	૧૫૧	૧૫૪	૧૫૮	૧૬૧	
*૩૦	૧૧૨	૧૧૪	૧૧૬	૧૧૮	૧૨૦	૧૨૨	૧૨૪	૧૨૭	૧૩૧	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૮	૧૪૯	૧૫૦	૧૫૪	૧૫૭	૧૬૧	
૩૫	૧૧૪	૧૧૭	૧૧૮	૧૨૧	૧૨૩	૧૨૫	૧૨૭	૧૨૯	૧૩૦	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૬	૧૫૦	૧૫૪	૧૫૭	૧૬૦	૧૬૩	
૪૦	૧૧૮	૧૨૧	૧૨૩	૧૨૫	૧૨૭	૧૨૮	૧૩૨	૧૩૪	૧૩૮	૧૪૨	૧૪૬	૧૪૯	૧૫૦	૧૫૪	૧૫૭	૧૬૧	૧૬૪	૧૬૭	
૪૫	૧૨૨	૧૨૪	૧૨૬	૧૨૮	૧૩૦	૧૩૨	૧૩૪	૧૩૮	૧૪૧	૧૪૬	૧૪૮	૧૪૯	૧૪૫	૧૪૮	૧૫૧	૧૫૧	૧૫૮	૧૬૧	
૫૦	૧૨૫	૧૨૭	૧૨૮	૧૩૧	૧૩૩	૧૩૪	૧૩૮	૧૪૧	૧૪૬	૧૪૮	૧૪૨	૧૪૮	૧૪૬	૧૫૧	૧૫૬	૧૬૧	૧૬૬	૧૭૩	
૫૫	૧૨૫	૧૨૭	૧૨૮	૧૩૧	૧૩૩	૧૩૪	૧૩૮	૧૪૧	૧૪૬	૧૪૮	૧૪૮	૧૪૩	૧૪૮	૧૫૩	૧૬૩	૧૭૧	૧૭૭		

* ૩૦ વર્ષની ઉંમરના વજનને મોટા ટાઇપમાં છાયા છે, કારણ કે પણીનાં વર્ષો દરમાન આરોગ્ય જળવવા કેટલું વજન આદર્શ ગણ્ય તે આ વજન દર્શાવે છે.

આદ્ય શરીર વિકાસ

ନାନ୍ଦୁ—ଅପି ନିଶାନିଧିତା ଆଂକଳା ଏହି ତେ ବ୍ୟଗ୍ରଥମାଂ ସାମନ୍ୟ କରିବାରେ ଭାଙ୍ଗା କୁ ନିଯା ଛୋକରେଣ୍ଟିଲ୍ ପରିଚାରି ଦେଖିଲେ

આદર્શ શરીરવિકાસ

(નાંબં:- * આની નિશાનીવાળા અંકડા ને તે રચણ્યમાં સમાચાર કરતાં વધારે ભર્યા તે નિયમ છોકરીએટું વર્જન દર્શાવે છે.

૭. કસ્ટરતળી આનુચ્છાક્ષીનો

વ્યાયામાલલમતે હ્યાયુર્બલ વીધીં પરાક્રમમ् ।
શાન્તિ પુષ્ટ ધૂતિં કાન્તિ ચિરારોગં ન સંશયः ॥

અર્થાત् વ્યાયામથી દીધીયુધ્ય, ણલ, પરાક્રમ, શાન્તિ, પુષ્ટિ, ધૂતિ તથા તેજસ્વીતા અવસ્થ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિએ કસરતના અભ્યાસીને મહત્તમ લાલ થાય તે હેતુથા ડેટલાંક માર્ગદર્શક સૂચના અને આપ્યાં છે.

૧. વિવિધ કસરતોના હેનિં કુમની હેતુલક્ષી અને રુયોગ્ય પસંદળી કરવી જોઈએ.

શરીર, આરોગ્ય અને સૌષ્ઠવ માટે નમસ્કાર, પેટના વ્યાયામ, સર્વાગસુંદર વ્યાયામ, દંડ, ણેટક, જોડી, કરેલા, સમતોલા, બારખેલ, સ્થ્રિંગ, દોડવું, તરખું વગેરે પૈકો અનુદૂળ કસરતો કરવી આવસ્યક છે, જ્યારે શીર્ય, ધીર્ય, ચપળતા વગેરે ગુણોના વિકાસ માટે વેયકિતક અને સાંધિક રમતગમતો, જિન્મેસ્ટિક્સ, તથા લડંત વ્યાયામ પ્રકારોનો આશ્રય લેવો જોઈએ.

૨. હળવા વ્યાયામથી શરૂઆત કરી પછી ધીમેધીમે ભારે વ્યાયામ પ્રાત પ્રગતિ કરવી.

શરૂઆતમાં ભારે પ્રકારનો વ્યાયામ ન કરવો, વ્યાયામશાળામાં જતાં વેંત જ દંડ, એટક કે વજન વિચક્કવાની કસરત કરવા મંડી ન જવું. શરૂઆતમાં પથી ૧૦ મિનિટ હળવા પ્રકારનો વ્યાયામ કરવો, જ્યથી શરીરમાં ઉષ્ણિતા વધે અને શરીરનું વંત ભારે વ્યાયામ માટે તૈયાર થઈ શકે. શરીરને યોગ્ય રીતે હળવા પ્રકારના વ્યાયામથી ગરમ (warming up) કરવામાં આવે તો આખા શરીરમાં સ્કૂર્ટિં અને જોમ વ્યાપે છે અને પણીથા ભારે પ્રકારનો વ્યાયામ કરવામાં આનંદ આવે છે. પેટની કસરત, જંડા

શ્વેસોચ્છ્વાવાસનો વ્યાયામ અને એવા પ્રકારના વ્યાયામથી શરૂઆત કરવી, અને કુમશઃ ભારે પ્રકારનો વ્યાયામ કરવો, પાંચ-દશ મિનિટના આ પ્રકારના વ્યાયામથી સનાયુઓ અને આખા શરીરના તંત્ર પર નીચે મુજબ અસર થાય છે—


૧. શરીર નિષ્ઠિ સ્થિતિમાં શિથિલ અને કોઈ પણ પ્રકારના ઝડપી અને ભારે કામ માટે લાયક હોતું નથી. સનાયુઓ ચેતન વિનાના, રક્ત-ભમણ મંદ અને જ્ઞાનતંતુઓ નિસ્તેજ હોય છે. શરીરને ગ્રબ કરનાર વ્યાયામ મળનાં જ એ નખામાં નવીન પ્રાણું સંચાર થાય છે. સનાયુઓની આકુંચન (contracting) શક્તિ વધે છે.

૨. શરીરની ઉષ્મા કુમશ : વધતી હેવાથી, સનાયુઓના કાય માટે યોગ્ય ઉષ્ણિતા ઉત્પન્ત થાય છે.

૩. એકદમ ભારે વ્યાયામ શરૂઆતમાં જ કરવામાં આવે તો હદ્ધય, ફેઝસાં ઈત્યાદિને તુકશાન થાય છે. સનાયુઓ એકદમ આવી પડેલા દાખાણું અને જેરથા તૂટી જય છે, એંચાય છે અને દીધીકાળ પણ તંત્રની મુશ્ણિણત આવી પડે છે.

૩. જમ્યા પછી તરત વ્યાયામ કરવો નહિં; વ્યાયામ કર્યા પછી પછી તરત જમ્યા નહિં.

જમ્યા પછી વ્યાયામ કરવાથી પાચનતંત્રના અનેક રોગો થાય છે. ખોરાક પેટમાં જતાં જ જફરરસ, આંત્રરસ, ઈત્યાદિ પાચક રસો કામે લાગે છે. રક્તનો ધસારો પેટ તરફ હોય છે. રક્તના ધસારથી પાચક રસો, હેઝરી અને આંતરડાં સ્કૂર્ટિંથી કામ કરે છે. આ વખતે મગજ અને સનાયુ તરફ લોહીનો ધસારો બહુ જ એછો હોય



છે, આથી સારી રીતે જરૂરી પછી જાંધવાની છર્છા થાય છે; અથાતું શરીરને આરામ જરૂરી છે એમ સાખીત થાય છે. જો આવા સમયે વ્યાયામ કરવામાં આવે તો શરીરમાં અધ્યવસ્થા જલ્દી થાય છે. વ્યાયામ કર્યા પછી તરત જમવાથી એનાથી ઉલ્લિપણ પરિસ્થિતિ હોય છે. આથી વ્યાયામ અને બોજન વચ્ચે બે કલાકનું અંતર તો અવસ્થય રાખવું.

૪. કસરતના અભ્યાસીને યુક્તાહારની કાળજી રાખવી જોઈએ.

કસરતાભ્યાસીના સમતોલ આહારમાં યોગ્ય પ્રમાણુમાં પ્રોટીન, કાર્બોઝિટ, ચરણી, વિટામિન્સ તથા ક્ષારો હોવાં જોઈએ તેમજ આ ખોરાક ઓછામાં ઓછા ૩૦૦૦ ડેલરી ધરાવતોહોવો જોઈએ.

૫. કસરત દરમ્યાન તરસ લાગે તો અદ્ય પ્રમાણુમાં ધીમે ધીમે પાણી પી શકાય.

સાધારણું રીતે કેટલું પાણી પીવું તેના માપ-દંડ તરીકે તરસ પર આધાર રાખી શકાય. તરસ અને ચુખ્દ અનુભવ આ બાળતમાં નિર્ણયિક છે. અડપથી ખૂબ પાણી પીવામાં આવે તો તંગ અવસ્થા હોવાથી જલદી કે ગલરામણ થવાનો સંભવ રહે છે.

૬. કસરત કર્યા પછી યોગી વારે સ્નાન કરવું જોઈએ.

કસરત કર્યા બાદ શરીરની ગરમી સમધારણ થઈ રહે તેટલો સમય જવા દઈ સ્નાન કરવું હીતાવહ છે, કે જેથી પરસેવો અને કચરો દૂર થઈ જય.

૭. કસરતના અભ્યાસીએ ધુમ્રપાનથી સહંતર દૂર રહેવું જોઈએ.

ધુમ્રપાન દરમ્યાન નિકોટીન લોડીમાં શોષણ છે અને તેનાથી હૃદયની કિંયા ઝડપી બને છે તથા સાથે હૃદયની રક્તવાહિનીઓ સંકોચાય છે અને હૃદયને મળતો રક્તપ્રવાહ ધીમે પડે છે. એકસરખા કસરતના પ્રમાણથી હૃદયની જેટલી ઝડપ વધે છે તેના કરતાં ધુમ્રપાન કાર્ય પછી જેટલી જ કસરતથી હૃદય ઘણું વધારે ઝડપી કાર્ય કરતું હોય છે. આ બધું જીવરાબિસરણ પર બોને લાગે છે અને પરિણામે હૃદયના કાર્યમાં ખલેલ જિલ્લી થાય છે.

૮. મનની આળનું વૃત્તિને દૂર રાખો.

શરીર બનાવવામાં જુની ખરાળ ટેવેને બાજુ પર મૂકી નવી સારી ટેવે પાડવાની જરૂર છે. વ્યાયામ શરૂ કરતાં, શરદ્યાતમાં કંટાળો અને આળસ આવે છે. શરદ્યાતમાં દશ વીશ દંડ કાઢતાં ચક્કર આવે છે, શ્વાસ ચઢી જય છે, આંખે અંધારાં આવી જય છે અને નાડીના ધણકારા વધી જય છે. એવે સમયે જો તમે વ્યાયામ કરવાનો છોડી દો તો કદી શરીર બનાવો શકવાના નથી. ઉપરની સ્થિતિ બહુ લાંબો સમય રહેતી નથી. થોડા સમયમાં જ તમામ પરિસ્થિતિ બદલાય છે; શરીરમાં એકાએક નવીન પ્રાણુસંચાર થાય છે. શરીરમાં એકાએક કામ કરવાનું જેમ આવી જય છે; ધણકારા સામાન્ય સ્થિતિ પર આવી જય છે. શ્વાસોર્થિવાસની કિંયા વ્યવસ્થિત થઈ જય છે; કંટાળો, આળસ અને ઐચેનીની જગ્ગાએ ઉત્સાહ, ઉમંગ અને આનંદનો અનુભવ વ્યાયામ કરતી વખતે થાય છે. શરીર ટૂંકમાં નવી પરિસ્થિતિને યોગ્ય રીતે અતુંદળ બની જય છે. આથી વ્યાયામશાળામાં આવી, વ્યાયામ આને કરવો કે નહિ, એવા મંથનમાં પડી રહેવા કરતાં, કપડાં ઉતારી કામે લાગી જવું. થોડી જ મિનિટામાં તમારી મનો-વૃત્તિ બદલાઈ જરો.

૯. નિયમિત વ્યાયામ કરો.

જીવનના દરેક ક્ષેત્રમાં નિયમિતપણું અગત્યનું છે અને તેમાંય વ્યાયામ જાળતની નિયમિતતા વિશેપ જરૂરી છે ૪-૬ દિવસે કુરસફ મેળવી એક એ કલાક વ્યાયામ કરો જવાથી કંધ લાભ થતો નથી. શરૂર કંધ મોટર નથી કે એમાં પૂરેલું વ્યાયામ રૂપી પેટ્રોલ બેચાર દિવસ કામ આપે-રોજ નિયમિત વ્યાયામ કરવામાં આવે તો જ ક્ષાયદો થાય.

૧૦. આરામ અને સામન્ત વ્યાયામ સંખ્યમાં વચ્ચે માર્ગ સ્વીકારો.

ધણું વ્યાયામનીરો એમ સમજે છે કે થોડા વગર વ્યાયામ કરવાથી ક્ષાયદો થાય છે. આથી તેઓ વ્યાયામશાળામાં આવતાં જ દંડ-બેઠક લગાવે છે. હજુ તો વાસ અટક્યો નહિ હોય ત્યાં જ મગદળ દેરવા મંડી પડે છે. આમ એક પછી એક કસરત કરવાથી શરૂર થાકીને લોથ થધ જય છે. આવા લોડા જ્યારે દંડ કાઢવા બેસે છે ત્યારે ૪૦૦-૫૦૦ દંડ થોડ્યા વગર કાઢે જય છે. આ જતની પદ્ધતિથી શરીરને નુકશાન થવાનો ભય રહે છે.

આથી વિરદ્ધ કેટલાક વ્યાયામવારો ૨૦-૨૫ દંડ કે એવી જતની કસરત કરી વચ્ચે ૫-૧૦ મિનિટ ગપ્પાં હાંડ છે. શરીર આથી વ્યાયામની સ્થિતિમાં ગરમ થયેલું હોય તે લાંબા સમય સુધી નિષ્ઠિય પડી રહે તો ઠંડું થધ જય છે. આમ શરીરના યંત્રને વારંવાર વિચિત્ર પરિસ્થિતિમાં પસાર થવું પડે છે અને તેથી તેમાં હરકત પહોંચે છે. આ રીતે શરીર બનતું નથી, પણ જીલદું કાળાંતે તે નથું પડે છે.

વ્યાયામ કરતી વખતે જ્યારે ખૂણ પરસેવો થાય અને શરીર થાક તથા હાંડ અનુભવે ત્યારે જરા વાર થોલી જઈ પરસેવો લૂધી ચંપી કરી થોડી વાર પછી કસરતની ફરી શરદ્યાત કરવી.

કસરતના અભ્યાસીને

૧૧. લાંખા ઉપવાસ અને માંદળી પછી વ્યાયામ બાખ્યત સંભાળ રાખવી.

લાંખા ઉપવાસ અને માંદળી પછી જ્યાં જુધી શરીરમાં થોડી ઘણી તાકાત ન આવે ત્યાં જુધી વ્યાયામ ન કરવો. જે ટોચ કારણુસર વ્યાયામ થોડી હોય તો ઇંગ્રેઝ શરૂઆત કરતી વખત ધીમે ધીમે સમય બધારવો અને ભારે વ્યાયામ થોડો થોડો કરવો.

૧૨. વ્યાયામની શરૂઆત સંભાળીને કરવી.

જેએ વ્યાયામ કરનારાઓમાં નવા જ હોય તેમણે અતિઉત્સાહ અને જોઈ વેલાથી બચવું. શરીર આડી રાજમાં બનતું નથી. એમાં ધીરજ અને શાન્તિની જરૂર છે. શરૂઆતમાં થોડા દિવસ આસનો, પેટના વ્યાયામ, શ્વાસોચ્છરાસની કસરત અને સૂર્યનમસ્કાર કરવાં. શરીર વ્યાયામ માટે લાયક બનતું જય તેમ તેમ ભારે પ્રકારના વ્યાયામનો ઉમેરો કરતા જવું. શરીરના ભોગે કોઈ પણ કાર્ય કરવું નહિએ.

૧૩. આયના સામે કસરત કરો.

કસરત કરતી વખતે શરીર પર લંગોટ કે ચર્ચી સિવાય કશું રાખવું નહિ. હંમેશાં વ્યાયામ આયના સામે કરવો. આયનો શરીરવિકાસ માટે અત્યંત જરૂરી સાધન છે. અરીસામાં જોઈ મનને સહેલાધ્યથી સનાયુઓના વિકાસ તરફ એકાથ કરી શકાય છે. આપણાં શરીરની ખામી અને વિકાસનો સારો ખ્યાલ આયનો આપો શકે છે.

૧૪. વ્યાયામ માટે યોગ્ય સ્થાનની પસંદળી કરો.

વાતાવરણુની અસર મન અને શરીર પર થાય છે. ગંદા, અસભ્ય અને મલિન વાતાવરણ વચ્ચે શરીર કદી પણ બની શકતું નથી. જે વાતાવરણ વ્યાયામ કરનારને ઉત્સાહ, શુભ વિચાર અને

શુલાચાર તરફ પ્રેરે તે શરીરવિકાસ માટે આશીર્વાદ સમાન થઈ પડે છે. વ્યાયામ કરવાના ઓરડામાં કે વ્યાયામશાળામાં સ્વચ્છતા, સફાઈ અને સદાચારતું વાતાવરણ હોવું જરૂરી છે. યુઝેન સેન્ટો, ગામા, ધમામણક્ષ, જેન થ્રીમેક, ચાલ્સ એટલાસ, કે. વી. આય્યર, ઈલ્યાદિ હેલ્થારીઓનાં ચિન્તો તથા આસન, સૂર્યનમસ્કાર, ઈલ્યાદિના નકશાઓ દિવાલેા પર ચારે તરફ લટકાવવા કે જે હંમેશાં પ્રેરણું અને ઉત્સાહ આપતાં રહે.

૧૫. કસરત જીવનની વેઠ નથી, પણ જીવનનો આનંદ છે.

વ્યાયામ સફળ બનાવવો કે નિષ્ઠળ એ તમારા પર આધાર રાખે છે. જે વ્યાયામ આનંદ, ઉત્સાહ અને પ્રેમથા કરવામાં આવે તો પરિણુભવ શુભ અને જરૂરી આવે છે. તમારી સામે “આદર્શ શરીર ”નું ચિન્ત હંમેશાં રાખો. તમારો કસરતમાં પ્રાણ રહો. કસરત કરતી વખતે મનને લટકવા ન હો.

૧૬. શરીરની ચોંચ દયારી (Posture) રાખો.

કમરમાંથી વળેલો, કદી પણ સીધી ગરદન રાખી ન ચાલનારો, ખલામાંથી ખૂંધો. ચાલતો માનવી અન્યને આકષીં શકતો નથી. વાંકા બેસવાની કે ચાલવાની જોઈ રવથી છાતી સાંકડી, ખલા ઢાળી પડેલા, પેટના સનાયુ નખળા થયેલા અને પાચનતંત્રને તુકશાન પહોંચેલું સામાન્ય રીતે નજરે પડે છે. આવા માનવીનું રક્તભંષુ શરીરમાં સુયોગ રીતે થતું નથી. ઇંસાન અવિકસિત અને નાણાં હોય છે અને શરીરનો બાંધો કદોંગો થધ જય છે. તમે જ્યારે ચાલો ત્યારે છાતી કાઢીને માયું ભાંચણીને અને એક વ્યાયામ-વીરને શાલે તેવી રીતે ચાલો અને હંમેશાં જીવંત તથા જોમવંત દેખાઓ.

૧૭. કુદરતી હજતની નિયમિત ટેવ પાડો.

કસરત શૌચ પહેલાં કે પછી એ પ્રશ્ન ધણુંને મુંજવે છે. સવારમાં ઉહતાની સાથે જાડે કુરવાની ટેવ પાડો. ધણું લોકો ઉહતાની સાથે કોઈ પણ નિત્ય કમ્ પૂર્ણ કર્યા વગર વ્યાયામ કરવા મંડી જય છે, એ સારું નથી. ૭-૮ કલાક પથારીમાં નિષ્ઠિ અને ૪૫ સિથિતમાં રહેલા શરીરને વ્યાયામ દારા એકદમ ગતિમાં મૂકવું સારું નથી. જાડે કર્યા વગર વ્યાયામ કરવામાં દિલ લાગતું નથી. શરીર ભારે ભારે લાગે છે. ધણું વાર ભારે વ્યાયામથી આંતરડાંનો મળ શરીરની ગરમીથી ચૂસાઈ જય છે અને કબજિયાત લાગુ પડે છે. આથી કસરત અગાઉ જગ્ર જવાની ટેવ પાડવી જોઈએ.

૧૮. આરોગ્ય અને શરીર મફૂત મળતાં નથી.

શરીરના ધડતર માટે નિયમિતતા, એકાગ્રતા, ખાંત વગેરેની ખાસ જરૂર છે. પરિણામ માટે ધીરજ રાખવી ધરે. શરુ શરીરમાં થોડી થોડી સિદ્ધિ મળે તેમાંથી પ્રેરણા મેળવી પૂર્ણતાએ પહેંચવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગમે તેમ, પદ્ધતિ અને નિયમ વિના વ્યાયામ કરી નાંખવાથી ફળપ્રાપ્ત થતી નથી.

૧૯. દવા એ તો દર્દું થીંગાડું છે.

વ્યાયામથી આદર્શ શરીર અને ઉચ્ચ આરોગ્ય મેળવવું હોય તો તોકટરો અને દવાના ઝેરી વાતાવરણથી બચવું જરૂરો. દવાવાદની ભ્રમજળમાં ન પડશો. દવા જર અને જીવનનો નાશ કરે છે. સાચું આરોગ્ય દવાના ધૂંટડામાં કે શક્તિવર્ધિક ગોળામાં નથી. એ બધાં શરીરનાં વિનાશકો છે.

૨૦. એક ને એક પ્રકારનો વ્યાયામ ન કરો.

ધણુા વ્યાયામબીરો રોજ રોજ એક જ જતનો વ્યાયામ કરું છે. વ્યાયામ, પણ તે ગમે તેટલો શાસ્ત્રીય હોય જ્તાં જો એમાં વિવિધતા અને

કુરાધ્દીનો નિયમ રાખવામાં ન આવે તો તેની સર્વાંગી અસર થતી નથી. આપણા શરીરમાં અનેક સનાયુઓ છે. એ બધા સનાયુઓની રચના એક સરળી નથી. આથી જુદા જુદા પ્રકારનો વ્યાયામ કરવો આવશ્યક છે. હવે જો તમે હાથની ત્રણ કસરત, પેટની બે ત્રણ કસરત, અમૂક નક્કી કરેલાં આસનો કે વજન ઊંચકવાની કસરત પસંદ કરી રોજ ને રોજ એક જ જતની કસરત નિયમ પ્રમાણે કરો અને નક્કી કરેલી કસરતમાં કશો કેરાજ ન કરો તો સનાયુઓનો અમૂક સમય પણી વિકાસ અટકી જશો. સનાયુઓ એકને એક પ્રકારનો વ્યાયામ કરવાથી આંતે ટેવાઈ જવ છે. શરૂઆતમાં એ સનાયુઓને વ્યાયામ મળો છે; પણ પછીથી એક જ જતની કસરતથી સનાયુઓ ટેવાઈ જવાથી વાંનિક રીતે કામ કર્યા કરે છે. સનાયુઓ પર દાાણ અને ઘંચાણુંની કંદું અસર થતી નથી. કસરતમાં વિવિધતા ન હોવાને કારણે મનમાં ઉમંગ, એકાગ્રતા કે આનંદ જણુતો નથી. લુહાર જેમ વંતૃત હોયાએ લોઢા પર મારતો જય છે, મજૂર કુહાડાથી લાકડાં ફૂડતો જય છે અને હાથલારીવાળો આંખ માંચી માર્ગ કાપતો જય છે; પણ એ બધાં જેમ મન અને તનની સાચી તાલીમથી વંચિત રહે છે તેમ જ એકજ પ્રકારનો વ્યાયામ કરનાર વ્યાયામવીર પણ વ્યાયામના સાચા લાલોથી વંચિત રહે છે.

સનાયુઓના સંપૂર્ણ વિકાસ અને કુશળતા માટે પ્રગતિશીલ વ્યાયામનો નિયમ દાખલ કરવો જોઈએ. એ નિયમ એવો છે કે ૧૫ થી ૩૦ દિવસ માટે અમૂક કસરત હાથ માટે, છાતી માટે કે પેટ માટે નક્કી કરવી અને એ પ્રમાણે તે કસરત કરવી. ખીંજ ૧૫ થી ૩૦ દિવસ એ જ સનાયુઓ માટે ખીંજ પ્રકારનો કસરત કરવી. આમ કસરત અવારનવાર બદલતા રહેલો એ જ પ્રમાણે આસન અને અન્ય વ્યાયામ માટે સમજવું. એક અઠવાડિયામાં ૩-૪ આસનો જેવાં કે પ્રશ્નમોત્તાનાસન, શલસાસન ઘત્યાદિ કરવાં; તો ખીંજ અઠવાડિયામાં એથી જુદાં જ આસનો કરવાં. આ નિયમમાં એક અપવાદ એ

છે કે અમૃક ચોક્કસ પ્રકારનો વ્યાયામ જેમ કે શીર્ષાસન, સીધા દંડ ઈત્યાદિ તો હંમેશાં જ કરવાં. વજન ઊચકવા માટે પ્રગતિશીલ વ્યાયામનો સિદ્ધાંત ને બતાવ્યો છે તે પ્રેમાળે અનુસરલું.

૨૧. વ્યાયામ કરતી વખતે જુદા જુદા સ્નાયુઓએ વચ્ચે કામ અને આરામનો નિયમ રાખો.

ધણુા વ્યાયામવીરો વ્યાયામ કરતી વખતે શરીરના અમૃક સ્નાયુઓને ખૂબ ખૂબ થકવો નાખે છે, જ્યારે ખીંચ સ્નાયુઓ લાંબો વખત સુધીનિષ્ઠિય હાલતમાં રહે છે. આથી રૂતભમણ અને રદત વહેંચણીની કિંબા સમતોલ રહેતી નથી. દાખલા તરીકે ધણુા વ્યાયામવીરો પહેલાં દંડ મારે છે, પછી મગદા દેરવે છે, પછી સ્પ્રોંગની કસરત કરે કે રોમન રીંગની કસરત કરે છે. આમ શરીરનો ધડનો ભાગ અર્થાત હાથ, છાતી, ખલા વગેરેને લાંબા વખત સુધી એક સરફો વ્યાયામ મળતો હોવાથી એ થાકી જથું છે. એ ભાગના અવયવોને આરામ મળતો નથી. ખીંચ આજુ પગ આ બધો વખત નિષ્ઠિય અને નકામા જેવા બની રહે છે. આથી સ્નાયુઓના કામની યોજ્ય ફ્લાઇવણી વ્યાયામ કરતી વખતે કરવી જોઈએ. હાથનો વ્યાયામ કર્યા પછી દ્રી પાછો હાથનો વ્યાયામ કરવાને બદલે પગનો વ્યાયામ કરવો. છાતીના વ્યાયામ પછી પેટનો વ્યાયામ કરવો. આમ વ્યાયામ કરતી વખતે જો બધા જ સ્નાયુઓને એક પછી એક એમ વારા-કરતી કામે લગાડવામાં આવે તો શરીરમાં લોહીનું દળાણું એક સરખું રહે, કોઈ એક ભાગના સ્નાયુએ

થાકી ન જથું અને વિવિધ અવયવો પર વ્યાયામની શુભ અસર થાય. આ રીતથી વ્યાયામ લાંબો સમય કરી શકાય અને થાક પણ એછો લાગે તથા કંટાળો પણ ન આવે. આ દસ્તિએ દંડ પછી બેઢક કરવાનો અને બેઢક પછી મગદા કરવાનો નિયમ આપણી વ્યાયામશાળામાં પ્રવર્તો છે તે વખાળું યોજ્ય છે.

૨૨. સુદૃઢ અને સપ્રમાણ શરીર એ તમારો આદર્શ હોવો જોઈએ.

ધણુા વ્યાયામવીરો શરીરને બાલ્ય દેખાવ માટે ધડતા હોઈ ધણુા વાર શરીરના એક આગના લોગે ખીંચ ભાગનો વિકાસ સાધવાનો પ્રયત્ન કરે છે. ધણુા વ્યાયામવીરોનો છાતી, પીડ અને ખલાનો ભાગ અતિ સુંદર અને પૂર્ણવિકસિત હોય છે, જ્યારે પોંડી અને જંધનો ભાગ અતિનિર્માલ્ય હોય છે. વજન ઊચકવાની કસરત, પેરેલલ બાસ્, સીંગલથાર તથા રોમનરીંગની કસરત કરનારાઓ પોતાના પગના વિકાસ તરફ ધ્યાન આપતા નથી, જ્યારે ફૂટબોલ ઈત્યાદિ રમનારાઓના પગ સ્નાયુયુક્ત અને મજબૂત હોય છે અને ધડ નખળાં હોય છે. આવી જતના શરીરના અપ્રમાણુસરના ધડતરથી ફેઝસાં તથા હૃદયના નાજુક ધંતને નુકશાન પહેંચે છે. શરીરના એક ભાગના લોગે ખીંચ ભાગને વિકસાવવો એ ડહાપણનું કાર્ય નથી. શરીરના રક્તની અયોજ્ય વહેંચણી લાંબે ગાળે નુકશાન પહેંચાડે છે અને તેથી સર્વાંગી વ્યાયામ અપનાવી સપ્રમાણ શરીરધડતર માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.




C. સુસ્થિત્વાત્મક તાલીમની

પ્રચલિત પદ્ધતિઓ

સુસ્થિત્વાત્મક તાલીમ એટલે ડોષ આસ રમત કે એક કૂદણી સ્પર્ધા માટે જેલાડીને ઉપકારક ક્ષમતા તાલીમ. આ તાલીમથી શરીરની તાકાત, સહનશક્તિ, અડફ, ચપળતા અને કાર્યક્ષમતા વિકસે છે. રમતમાં પ્રગતિ ઉત્સુક જેલાડીઓએ શરીરને તંયાર કરવા માટે સુયોગ્ય તાલીમી કાર્યક્રમ નિયમિત રીતે અપનાવવો જોઈએ. રમતથેતે અસરકારક તાલીમ પદ્ધતિઓ નીચે મુજબ છે.

(૧) સરકીટ ટ્રોનીંગ : શારીરિક ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આ તાલીમપ્રકાર ખૂબ પ્રચલિત થતું રહ્યો છે. આ માટેનો યથ લીડજ-યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના શ્રી. આર. ઈ. મોણિન અને શ્રી. ગુ. ગી. એડમસનને ક્રાંતે જાય છે. આ એક એવી તાલીમ પદ્ધતિ છે, જેમાં જેલાડીને અદ્ય સમયમાં કસરતના મહત્વમાં લાભો સંપ્રાપ્ત થાય છે. જેલાડી માટે વિવિધ કસરતપ્રકારો નિયત થયેલા.



સરકીટ ટ્રોનીંગ

સુસ્થિતિ તાલીમની પ્રયોગિત પદ્ધતિઓ।

હોય છે અને તે દરેક કસરતસ્થળે જ્ઞ નિયત કસરતાં કરી તેણે ચક્કર (સરકીટ) પૂર્ણ કરવાનું હોય છે. નિયત સમયમાં આ પ્રમાણે એક, એ વા નણું આવર્તન પૂર્ણ કરવાનાં હોય છે. આ માટે સામાન્ય રીતે ૪૦ થી ૫૦ મિનિટ નેટલો સમય આપવામાં આવે છે. દરેક કસરત પ્રકાર માટેની આવર્તન સંખ્યા નક્કી હોય છે. ખેલાડીએ અને તેટલી વધુ ઝડપથી આ કસરતો કરવાની હોય છે.

દરેક કસરતની માત્રા ખેલાડીના શક્તિના અધી ભાગ નેટલી રાખવામાં આવે છે. એટલે કે કોઈ ખેલાડી વધુમાં વધુ ૨૦ બિચક કરી શકતે! હોય તો સરકીટ ટ્રેનિંગમાં કસરતની માત્રા તેને માટે ૧૦ બિચકની રાખવામાં આવે છે. સરકીટ ટ્રેનિંગમાં ૧૦-૧૨ નેટલા કસરત પ્રકારો હોઈ શકે. જેમ કે બિચક, ડિફેસ દંડ (સ્ક્રોટ અસ્ટ) શયનોત્થાન, નીચક, ખડી લાંખી દૂદ, દોરડું ચઢ, વજન બિચક, ઈત્યાદિ. ખેલાડી માટે કસરત પ્રકારો નક્કા કરતી વખતે તેની શક્તિ અને જરૂરીઆતને અનુલક્ષીને નક્કી કરવા જોઈએ. ખેલાડીને કસરતની ટેકનિક અંગે યોગ્ય સહાય આપવી જોઈએ; તેમજ તેની પ્રગતિની નોંધ લેવી જોઈએ. ખેલાડીએ પણ પોતાની પ્રગતિ નોંધવી જોઈએ. ચાર થી ૭ સપ્તાહ આદ દરેક કસરત માટે તેની મહત્તમ સિદ્ધિની કસોટી લઈ તેના અનુસંધાનમાં કસરતાની પુનર્યોજના કરવી જોઈએ. જે રમત માટે ખેલાડીએને તૈયાર કરવાના હોય તેને સહાયક કસરતો રાહખરે નક્કી કરીને ખેલાડીને આપવી જોઈએ.

આમ કસરત પ્રકારમાં ખેલાડી પોતાની પ્રગતિ માપી તથા જાણી શકતો હોઈ તેને માટે તે પ્રેરક અને ઉત્સાહવર્ધક નીવડે છે.

(૨) પ્રેરક ટ્રેનિંગ : આ તાલીમ પ્રકારના પ્રચારનો યશ ફૂટબોલ એસોસીએશનના રાહખર 'વિન્ટર બોટમ' ને ક્રાંતે જાણ્ય છે. આ એવી તાલીમ પદ્ધતિ છે, જેમાં ખેલાડીને થોડીક મિનિટોમાં નિયત કૌશલ્યનો પર્યાસ, પચાસ કે સો વખત રિયાં

કરવાની તક મળે છે. દાખલા તરીકે એ કે ત્રણ જણુને ફૂટબોલ આપવામાં આવે, જેને તેઓ ગોલકીપર તરફ વારાફરતી એવી રીતે ભાગે હોય કે જેથી ગોલકીપરને તે દરેક દાને રમવા માટે એક સ્થળેથી ખીંચ સ્થળે ઝડપથી હોડવું પડે. આમ ગોલકીપર તરફ દાને સતત મારો ચાલુ રહે છે તથા ગોલકીપરે દરેક વખતે આમથી તેમ હોડને દાને રમવાનો રહે છે, જેને પરિણામે તેને ધનિષ્ટ મહાવરો મળે છે. આજ પ્રમાણે વોલીબોલ, બાસ્કેટબોલ, હોકી, બેડમિંટન ઈત્યાદિ રમતોમાં કૌશલ્યો કે ટેકનિક વિકસાવવા માટે આ ટ્રેનિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. કોઈ ખેલાડી અમૃક કૌશલ્યમાં નથેણા હોય ત્યારે રમત દરમ્યાન એવા ખેલાડી માટે તે કૌશલ્ય કે ટેકનિક અમલમાં મૂકવાની પરિસ્થિતિ વારંવાર ભલી થતી નથી. પરિણામે તે કૌશલ્યમાં તે પ્રગતિ સાધી શકતો નથી. પરંતુ પ્રેરક ટ્રેનિંગ દારા થોડા જ સમયમાં તેને તે કૌશલ્યનો સુંદર મહાવરો મળી રહે છે અને સંગીન પ્રગતિ સાધી શકાય છે.

(૩) ફોર્ટ લેક : આ સ્કેનિડનેવિયન શહેદ-પ્રયોગ છે અને તેમાં ટ્રેક તથા સ્પર્ધાના વાતાવરણથી દૂર ફર વૃક્ષોની વચ્ચે આ તાલીમ અપાય છે. પાઈન વૃક્ષોની ડાળીએથી આચાદિત જમીન ખેલાડીઓના પગ માટે જમીનની ગરજ સારે છે અને ખેલાડીએ સામાન્ય રીતે હોડ, શિથિલ હોડ, ઝડપની ડાળીએ ઉપર લટકોને કસરત સાથે ઓલા, તથા દીધ્ય વાસોચ્છવાસ વગેરે કરે છે. આ જતની તાલીમનો મોટામાં મોટા શાયદો એ છે કે ખેલાડી એક જ જગ્યાએ તાલીમ લઈને કંટાળી ગયા હોય તેમને કુદરતી વાતાવરણમાં, પ્રાકૃતિક ઉપકરણોનો ઉપયોગ કરીને કસરતો કરવા મળતી હોવાથી તે ઉત્સાહ સાથે તાલીમ લે છે. વૈધિક (ફોર્મલ) પ્રકારની ટ્રેક ઉપરની હોડ કરતાં આ ટ્રેનિંગ વધારે નૈસગીક હોઈ જૂદી તરી આવે છે.

(૪) પ્રાન્થરલ રનીંગ : ખાસ કરીને

અડ્યાથી નણ માઈલ સુધોના અંતરની દોડના ખેલાડીઓ માટે આ એક અધ્યતન તાલીમપદ્ધતિ છે. દાખલા તરીકે ચાર મનિટમાં એક માઈલ દોડવાનું લક્ષ્ય રાખનાર દોડવીર ૪૦૦ મીટરનું એક ચક્કર ૬૦ સેકંડમાં પૂરું થાય તેમ એ ચક્કર દોડી એક ચક્કર શિથિલ હેડ (નોગીંગ) કરશે, અને એમ ચાર આવર્તનનો અભ્યાસ રાખશે.

(૪) વેદ્ધટ ટ્રેનિંગ : પ્રતિરોધ વ્યાયામ (રેઝીસ્ટન્સ ટ્રેનિંગ)નો આ પ્રકાર વર્તમાન સમયમાં ખૂબ પ્રચલિત બનેલો છે. ખગવૃદ્ધિ અને સનાયુઓને વધારે મજબૂત તથા સહનશિલતાવાળા બનાવવા માટે-(૧) તેમને વધારે વજન જિયકવાનો અભ્યાસ આપવો તથા (૨) વધારે લાંબા સમય સુધી કસરત જરી રાખવી. એક રીતે જોઈએ તો ૬રેક બાળવર્ધક કસરત વેદ્ધટ ટ્રેનિંગ છે. કસરતમાં આપણે સનાયુ દારા શરીરના વજનને એક ઠેકાણેથી બીજે ટેકાણે ખસેડીએ છીએ; અને તેમ કરવામાં શરીરના કેટલાક ચોક્કસ સનાયુએ શરીરનું સમગ્ર અથવા કેટલુંક વજન વહે છે તે જે પ્રમાણે આપણે મેડિસિન બેલ, રેતી ભરેલી ડોથળીએ, પાટડા વગેરેનો સનાયુએ દારા વજન ખસેડવા, ઇંકવા કે જિયકવા તરીકે ઉપયોગ કરી શકીએ. કુહાડીથી કાપવું, લાકડાં વહેરવાં, વગેરે પણ વેદ્ધટ ટ્રેનિંગની છીયા-ઓજ છે. અને તે જે પ્રમાણે કુસ્તી કે જેમાં પ્રતિસ્પદ્ધીના પ્રતિરોધ બળની સામે સનાયુએ કાર્ય કરે છે અને અવારનવાર દરેક કુસ્તીઓજને પોતાના પ્રતિસ્પદ્ધીને ચીત કરવાને માટે જિયકવો પડે છે, તે પણ વિશાળ અર્થમાં ‘વેદ્ધટ ટ્રેનિંગ’ જે છે.

પરંતુ ‘વેદ્ધટ ટ્રેનિંગ’ શબ્દપ્રયોગ લોખંડના બારખેલ તથા ડમ્પેલ્સ વડે કરવામાં આવતી કસરતો કે જેમાં ધીમે ધીમે વજનની પ્લેટો વધારતા જઈ જિયકવાના વજનને ઉપર કે નીચેની દિશામાં લઈ જવામાં આવે છે, તેને માટે વિશેષ કરીને વાપરવામાં આવે છે. બારખેલની કસરતો સામાન્ય રીતે એ હાથે બારખેલને વર્ચેથી પકડી કરવામાં

આવે છે, જ્યારે ડમ્પેલ્સની કસરતો દરેક. હાથમાં એકું ડંખેલ પકડી કરવામાં આવે છે.

આ ટ્રેનિંગમાં એ સહેલે જોઈ શકાશે કે જેમ જેમ તાકાત વધતી જથું છે તેમ તેમ બારખેલ કે ડમ્પેલ્સ ઉપરનું વજન વધારી શકાય છે; અને તે રીતે સનાયુની વજન જિયકવાની તાકાત અને વિકાસ માપી શકાય છે તથા આ વિકાસનો સંખ્યાંધ અન્ય ક્ષેત્રે સનાયુશક્તિઓ સાથે હોછ વેદ્ધટ ટ્રેનિંગનો પ્રકાર કન્ડીશનીંગની કસરતોમાં બહુમૂલ્ય ફાળો આપે છે.

આમ છતાં, અન્ય તાલીમ પ્રકારાને છોડીને કુસ્ત વેદ્ધટ ટ્રેનિંગનો જ કાર્યક્રમ કોઈ અપનાવે તો તેમાં અનિષ્ટ પરિણામ આવવાનો સંભવ છે. વેદ્ધટ ટ્રેનિંગથી થતા સનાયુએ.ના વિકાસને પરિણામે કસરતબાજ ખેલાડી વેદ્ધટ ટ્રેનિંગને લક્ષ્ય પ્રાપ્તિનું સાધન ગળુવાને બદલે લક્ષ્ય ગળ્યી લે છે, અને તેથી તંડુરસ્ત રમતગમતો અને જીવનના ઉદ્દેશો પ્રત્યે બેદ્રકાર બને છે અને સનાયુવિકાસમાં જ રચ્યો પણ્યો રહે છે. છતાંથે એ ભૂલબું ન જોઈએ કે બાળવર્ધક કસરતોમાં વેદ્ધટ ટ્રેનિંગનું સ્થાન અત્યધિક મહત્વનું છે; અને તેમાંથી જ્યાં સ્થળ અને સમય મર્યાદિત છે ત્યાં તો ખાસ.

(૬) થ્રૂવીંગ ધી સ્ટ્રોક : આ પદ્ધતિમાં રમતનું કૌશલ્ય અલગ તારવવામાં આવે છે અને ખેલાડી તેમાં પ્રલુત્વ મેળવવા મહાવરો કરે છે, તે દર્શિએ આ ટ્રેનિંગ પદ્ધતિ પ્રેશર ટ્રેનિંગને મળતી આવે છે. પરંતુ આમાં ખેલાડી રાહજરના માર્ગદર્શન નીચે વ્યક્તિગત રીતે કૌશલ્ય કે ટેકનિકનો મહાવરો કરે છે અને કૌશલ્ય ધાર્ત્રિક અનતાં પ્રલુત્વ મેળવે છે. જડપતું કોઈ દબાણું તેના ઉપર લાદવામાં આવતું નથી.

(૭) રેઝીસ્ટન્સ ટ્રેનિંગ : બાળવર્ધક કસરતો કે જેમાં સનાયુએ કુસ્તીની જેમ પ્રતિસ્પદ્ધી તરફ્થી અથવા વેદ્ધટ લીફ્ટીંગની જેમ કોઈ સાધન

સ્થિતિ તાલીમની પ્રચલિત પદ્ધતિઓ

તરફથી પ્રતિરોધનો સામનો કરવાનો હોય છે, તેનો રેઝિસ્ટર્ન્સ ટ્રેનિંગમાં સમાવેશ થાય છે. જિયક, નીચક, દંડ, શયનોત્થાન ઈત્યાદિમાં શરીર કે તેનો ભાગ વજન યા પ્રતિરોધ રૂપે રહે છે અને ને તે સનાયુઓને, તેને જાંચે કે નીચે લઈ જવામાં રેઝિસ્ટર્ન્સ ટ્રેનિંગ મળી રહે છે.

(૮) આઈસોમેટ્રિક ટ્રેનિંગ : રેઝિસ્ટર્ન્સ ટ્રેનિંગમાં જેમ પ્રતિરોધ હોય છે, તેમ આમાં પણ પ્રતિરોધ હોય છે; પરંતુ તે પ્રતિરોધના સામનાની સ્થિતિ અમૂક સમય સુધી જનળી રાખવામાં આવે ત્યારે તેને ‘આઈસોમેટ્રિક ટ્રેનિંગ’ કહે છે. ગજગ્રાહમાં જ્યારે બન્ને પક્ષો દ્રોગ્કું જેંચે છે ત્યારે આ પરિસ્થિતિ આવે છે. તે જ પ્રમાણે સ્પ્રોંગન જેંચી રાખવામાં આવે કે વજનને અમૂક સ્થિતિમાં જિયકી રાખવામાં આવે, વગેરે કસરતોનો સમાવેશ આ તાલીમપ્રકારમાં કરવામાં આવે છે. કન્ડીશનીંગ માટેનો આ તાલીમપ્રકાર અધતન છે અને તેને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

આ તાલીમ પદ્ધતિની શોધ જર્મન શારીરિક શિક્ષણ શાસ્ત્રીઓ શ્રી હેનીન્જર અને શ્રી સુલ્લર ઠ. સ. ૧૯૫૦માં કરી. તેમણે સંશોધન કરીને સાબિત કર્યું કે દરરોજ આ તાલીમ દર વખતે પાંચ સેકંડના સમય સુધી પાંચથી દસ વખત કરવામાં આવે તો ૩૩% થી ૧૮૧% જેટલી શક્તિ વધી શકે છે.

આ જાતની કસરતો કરતી વખતે જેલાડી પોતાનો વિકાસ જોઈ શકતો નથી, જેને કારણે ઘણી વાર હતોત્સાહ થઈ જય છે; અને તેથી આ તાલીમ પદ્ધતિમાં ધીરજની ખૂબ આવશ્યકતા રહે છે.

(૯) આઈસોટેનિક ટ્રેનિંગ : આ શબ્દ-સમૂહ ‘આઈસો’ અને ‘ટેન’ એવા ઐ શબ્દોનો બનેલો છે. ‘આઈસો’ એટલે એક સરખું (સમાન) અને ‘ટેન’ એટલે સનાયુ (મસલ)

ઉપર તનાવ. આમ સનાયુ ઉપર એક સરખો તનાવ યા જેંચાણ આપવાની કસરત પદ્ધતિને ‘આઈસો-ટેનિક ટ્રેનિંગ’ કહેવાય છે. આ જાતની તાલીમમાં સનાયુ ઉપર એક સરખો જેંચાણુની કિયા થાય છે. આપણે કોઈ પણ વજન ઉપાડીએ ત્યારે આઈસો-ટેનિક કસરત થાય છે. આ કસરતથી સનાયુનો વિકાસ થાય છે, ને જેલાડી પ્રત્યક્ષ નિષાળી શકતો હોવાથી તેનો રસ જળવાઈ રહે છે.

આઈસોટેનિક કસરત માટે વજનની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવી જોઈએ. જે વજનની પસંદગી જોઈ થાય તો લાભને બદલે નુકશાન થવાનો સંભવ છે. આ તાલીમ પદ્ધતિનો ઉપયોગ માટે લાગે શક્તિ અને સહનશક્તિ વધારવા માટે કરવામાં આવે છે. જ્યારે સહનશક્તિ વધારવાની હોય ત્યારે વજન ઓછું રાખવું અને આવર્તનની સંખ્યા વધારે રાખવી. પરંતુ શક્તિ વધારવાની હોય ત્યારે એ પ્રમાણે વજન રાખવું કે જેથી ને તે કસરતના ૪ થા ૮ આવર્તન કરી શકાય.

(૧૦) આઈસોકાધનેટિક્સ : તાજેતરનાં વિષેમાં તાકાત વધારવા માટેનો એક નવો જ્યાલ અરિતત્વમાં આવ્યો છે, જેને ‘આઈસોકાધનેટિક્સ’ તરીકે એળખવામાં આવે છે. આમાં આઈસોમેટ્રિક અને આઈસોટેનિક ટ્રેનિંગના તમામ સારાં પાસાંએનું મિશ્રણ કરવામાં આવ્યું છે. સનાયુની શક્તિના વિકાસ માટે આ તાલીમ પ્રકારમાં સનાયુ પાસે બારખેલ જિયકવા કરતાં વધારે સળંગ, સંપૂર્ણ ગતિનો ક્ષેત્રવિસ્તાર માગી લે છે. આઈસોકાધનેટિક્સના કાર્યક્ષેત્રની મર્યાદામાં સનાયુનો પ્રતિકાર, જેંચવો, ધક્કો મારવો ઈત્યાદિ આપોઆપ અનુકૂળ થઈ કસરતની આપેકી ગતિમાં કિયારીલ થઈ જય છે. ખીંચ શરીરોમાં, સનાયુ વડે પ્રતિકારનો જે એકદંડ જથ્યો ઉત્પન્ન કરવામાં આવે છે તે હંમેશાં જે તાકાત વાપરવામાં આવી હોય તેના જેટલો સમાન હોય છે. નવા પ્રકારનાં યાંત્રિક સાધનોના સંશોધન અને વિકાસને પરિણુંમે હવે

આઈસોકાઈનેટિક કસરતો શક્ય બની છે. યાંત્રિક સાધન સામે ધક્કો મારવામાં આવે કે ખેંચવામાં આવે એટલે નેટલું શારીરિક બળ વાપર્યું હોય તેટથો પ્રતિકાર મળે છે. ઓટોમેટિક ગવર્નર મીડનીઝમ માત્ર પ્રતિકારને જ નિયંત્રિત કરતું નથી, પરંતુ કસરતની અડપને પણ નિયંત્રિત કરે છે.

વિષ્યાત અમેરિકન સ્વભિંગ ડો. નેસ કાઉન્સીલમેનના અભિપ્રાય મુજબ આઈસોકાઈનેટિક કસરતો બળવૃદ્ધિ માટે ખીંચ ડોઈ પણ કસરત પ્રકારો કરતાં ઉત્તમ પૂર્વાર થઈ છે. એક જ મુશ્કેલી છે કે, આ કસરતો માટેનાં યાંત્રિક સાધનો મેંધાં હોએ દરેક માટે સહેલાઈથી લભ્ય બનતાં નથી.



૬. સ્વાસ્થીક વ્યાયામ

પ્રવૃત્તિ એ સળવ પ્રાણીની વિશિષ્ટતા છે. મનુષ્ય જન્મે છે ત્યારથી શરીરી મૃત્યુ પર્યંત કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરવાનું ચાલુ રહે છે. સામાન્ય શીતે એમ માનવામાં આવે છે કે વ્યક્તિને જીવના માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે; પરંતુ એ પૂરતું નથી. વ્યક્તિને હવા, પાણી અને ખોરાક સાથે કસરતની પણ તેઠી જ જરૂર છે. ચાલવું, દોડવું, તરવું, શ્વસન વગેરે મૂળભૂત પ્રવૃત્તિઓ છે અને માનવીના જીવન સાથે વણ્ણાઈ ગયેલી છે. આ મૂળભૂત પ્રવૃત્તિઓને સ્વાસ્થ્ય રક્ષાના તથા ક્ષમતાવિકાસના દેખુથી વૈજ્ઞાનિક દ્રષ્ટે કરવામાં આવે તો તે 'સાહજિક વ્યાયામ' ગણ્યાય છે.

ચાલવું (Walking)

આખાલવૃદ્ધ સૌ કોઈ સાતુર્ફળતાથી કરી શકે તેવી કોઈ કસરત ને હોય તો ન છે ચાલવાની કસરત. ચાલવાની કસરતથી શરીરનાં અંગતંત્રો પર લાલદાયી અસર થાય છે, ને શરીરને નિરામય રાખવામાં મદદરૂપ નીવડે છે તથા સહનશક્તિ વિકસાવે છે.

ચાલવું એટલે જમીન સાથે સતત સંપર્ક



સમૂહમાં ચાલવાનો આનંદ

જળવાઈ રહે તેવી રીતે પગલાં મૂકી આગળ ગતિ કરવી તે. આમાં પાણગનો પગ જમીન સાથેનો સંપર્ક છોડે તે પહેલાં આગળના પગનો જમીન સાથે સંપર્ક થઈ જય છે. ચાલવાની ગતિ એકધારી, સામાન્ય ઝડપવાળી અને દરેક પગલે શક્તિનો ઉપયોગ થયો હોય તે રીતે થની જોઈએ.

નિયમિત ચાલવાની કસરતના પરિણામે વ્યક્તિના હૃદય અને ફેઝસાંની શક્તિમાં શનેઃ શનેઃ વધારો થાય છે; હૃદયના ધબ્ધકારાનો દર ધટે છે અને હૃદય પ્રત્યેક ધબ્ધકારે વધારે પ્રમાણુમાં લોહી મોકલવાની શક્તિ પ્રાપ્ત કરે છે. ડેરોનરી રક્તવાહિની. કે ને હૃદયરોગના હુમલા સમયે અગત્યનો લાગ લગવે છે તે ધમનીનો વિકાસ થતાં તેનો વિસ્તાર પહોળો બને છે અને હૃદયરોગના હુમલાને અટકાવવામાં મદદરૂપ બને છે. ઇધિરાલિસરણું પ્રમાણુ વધવાથી સનાયુઓ તથા ચામડીને પૂરતા પ્રમાણુમાં એકિસજન મળી રહે છે અને તેમનો વિકાસ થાય છે.

ધુમ્રપાન કરનાર વ્યક્તિઓમાં નિકાટિન અને કાર્યાન મોનોકસાઈડનું પ્રમાણુ વધારે હોય છે. ચાલવાની કસરત દરમિયાન ઉચ્છવાસ દારા તે બહાર ફેંકાય છે; ફેઝસાંની સંકુચન અને વિસ્તરણું શક્તિ વિકસે છે; રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે અને પરિણામે લોહીનું ભમણુ વધે છે તથા સનાયુઓના અંતિમ છેડા સુધી એકિસજન પહોંચી જઈ પ્રાણુનો સંચાર કરે છે.

ચરંબીપ્રધાન વ્યક્તિનું શરીર સ્થૂલ હોય છે તથા શરીરમાં ચપળતા એધી હોય છે. જો શરીર લાંબા સમય સુધી કામ કરવાનું બંધ રાખે તો કસરતના

અભાવે શરીર મધુપ્રમેહ, લોષીનું દાખાણુ, તથા જીંચા શ્વાસોશ્વાસ વગેરે વિકારોનું ભોગ બને છે. આમાંથી બન્યા માટે વ્યક્તિત્વે ચર્ચિનું પ્રમાણ ઘટાડવું જોઈએ; અને ચર્ચિ ઘટાડવા માટે ચાલવું જોઈએ. નિયમિત ચાલવાની કસરતથી વજન ઘટશે અને શરીર નિરામય તથા સપ્રમાણ બનશે.

જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ અને ૩૦ વર્ષની ઉમર પછી પ્રત્યેક ૧૦ વર્ષો હૃદયના ધર્મકારાનો ૬૨ થા ૮ ટકા વધે છે; ૨કઠદાણુ ૫ થા ૬ ટકા વધે છે; સનાયુઆના જ્યથામાં ૩ થા ૪ ટકાનો ઘટાડો થાય છે; ૨કઠવાહિનીઓ તેમની સ્થિતિસ્થાપકતા ધીમે ધીમે ગુમાવે છે અને જીવન જોખમબારેલું બની જાય છે. આ પરિસ્થિતિમાં શરીરને આરોગ્યમય રાખવા માટે ચાલવાની કસરત ઉત્તમ છે. મોટી ઉમરે વ્યક્તિને જીવવા માટે જેઠલી જરૂર જેન્શન અને વીમાની રકમની છે, તેટલી જ બદ્લે તેનાથી વધારે જરૂર કસરતની છે.

ચાલવાની કસરત કરનારે કસરતમાંથી મહત્તમ લાભ મેળવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ—

૧ વ્યક્તિત્વે ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી એકધારી રીતે પૂરી જડપથી ચાલવું જોઈએ. શક્તિ અનુસાર આ સમય વધારી ૩૦ થા ૪૫ મિનિટ સુધી પહેંચી શકાય તો ઉત્તમ.

૨ ચાલવાની કસરતનો કાર્યક્રમ અનુધૂળ હોય તો રોજ સવારે અથવા સાંજે રાખવો ઉત્તમ. અથવા તો પછી એકેક દિવસના આંતરે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩-૪ દિવસ તો રાખવો જ જોઈએ.

૩ જમ્યા પછી તરત ન ચાલવું અને જ્યારે વાતાવરણમાં અત્યંત ઠંડી, ગરમી, પવન કે લેજ હોય ત્યારે પણ ચાલવાનું ન રાખવું.

૪ પ્રસન્ન મન રાખી ચાલો અને ચાલતાં ચાલતાં શાસોશ્વાસ લયથદ્ધ રહે તે માટે પ્રયત્ન કરો. શાસ ચઢે તો થોડો સમય જિલ્લા રહેલો અને શાસોશ્વાસ સામાન્ય થતાં ચાલવાનું ચાલુ કરો.

૫ ચાલવાની ગતિ તમારા વજન અને ઊંચાઈને અનુલક્ષીને રાખો અને શરીર ટટાર રાખી શક્તિ પ્રગટ થાય તે રીતે સરળતાથી ચાલો.

ચાલવાની કસરતમાં આંતર મહત્વનું નથી, પરંતુ એક્ઝસ સમય સુધી દરરોજ અથવા એકેક દિવસના આંતરે ચાલવાનું રાખવું જોઈએ. એકેક દિવસના આંતરે ૧ કલાક ચાલવા કરતાં દરરોજ ૩૦ મિનિટ ચાલવામાં આવે તે વધારે લાભદાયી છે. ચાલવાની કસરતની શરદ્યાત ઓછા સમયથી કરવી અને શક્તિ અનુસાર સમય વધારતા જરૂર ૩૦ થા ૪૫ મિનિટ સુધી પહેંચવું.

૨. શિથિલ દોડ (jogging)

શરીરનાં બધાં અંગોને શિથિલ રાખી ધીમેથી દોડવામાં આવે તેને શિથિલ દોડ (નેગિંગ) કહેવામાં આવે છે. આમાં હાથ, પગ અને ધડને શિથિલ સ્થિતિમાં રાખી હળવી દોડ કરવામાં આવે છે.

નેગિંગની આ કસરત ખૂબ અસરકારક માલંક.



નેગિંગ

પડી છે અને તેનાથી સંખ્યાધકર્તા સનાયુઓને કસરત મળવા ઉપરાંત થસન અને શિધિરાલિસરણું તંત્રની ક્ષમતા વિકસે છે. અમેરિકામાં વાય. એમ સી. એ. સંસ્થાએ સમૂહ જોગિંગનો કાર્યક્રમ પ્રણને આપ્યો છે અને હંજરો યુવક-યુવતીઓ અને પ્રૌઢો આ કાર્યક્રમમાં જોડાય છે અને સ્વાસ્થ્ય રક્ષા લાલે છે. આ કાર્યક્રમને ડોક્ટરોના મંડળોએ માન્યતા આપી છે એટલું જ નહિ પણ આ સંખ્યાધમાં ઉપયોગી સાહિત્ય પણ પ્રગટ કર્યું છે. હંદ્રયરોગના નિષ્ણાતેનાં મંડળો એવા નિષ્કર્ષ પર આવ્યાં છે કે, હંદ્રયરોગ માટે આનુવંશિકતા, લોહીમાં ચરખીની અતિશયતા, લોહીનું જિચું દળાણું, વધારે પડતું વજન, મધુપ્રેમેહ, અત્યાંત ચરખીયુક્ત આહાર, કસરતનો. અલાવ અને નહિવત શારીરિક અમ-એ આડ કરણો જવાણદાર છે. તેમાં નિયમિત જોગિંગના વ્યાયામથી નિશ્ચિત લાલદાયો અસર થાય છે અને દરદીને રોગમુક્ત બનાવવામાં તે નોંધપાત્ર ફાળો આપે છે. જોગિંગની કસરત વ્યક્તિને માનસિક તાણુભાંથી મુક્ત બનાવે છે અને તાજગી બસે છે.

જોગિંગ મોટા ભાગે રસ્તા પર કરવામાં આવે છે અને તેથી પગના રક્ષણું માટે તેન્વાસના શરૂ પહેરવા જોઈએ. રસ્તાની કંઠણું સપાઈના પ્રત્યાધાતોની અસર દોડનારના પગના સનાયુઓ પર થાય નહિ તે માટે ગાડીવાળા ખૂટ હોય તો ઉત્તમ. જોગિંગ શરૂ કરતાં પહેલાં થોડી હળવી કસરતો કરવી લાલદાયો નીવડશે. જોગિંગ માટેની ઝડપ શરૂઆતમાં ધીમી અને પછી કુભિક વધારતા જવી જોઈએ અને નિર્ધારિત અંતર પૂર્વં કરવું જોઈએ. જોગિંગ દરમ્યાન શરીર શિથિલ રાખવું, પગલાં સપ્રમાણું રાખવાં તથા દરેક પગલે ઉત્તરાણું એડી પર અને શરીરનું વજન ત્યાર બાદ તે પગના પંઝ પર સંકાન્ત થાય તેવી રીતે દોડવું જોઈએ. પગને ઘૂટખુભાંથી વાળી આગળની બાબુ થોડો છિંચે લઈ જઈ પછી જમીન પર લાવવો. જોગિંગમાં ગમે તે એક પગ જમીન પર હોય તેવી સ્થિતિ માલમ

પડશે. પગની સાથે હાથની ગતિ પણ થાય છે. હાથને ડેણુભાંથી વાળવા, શરીર આગળની બાબુ સહેજ જુકેલું, ગરદન જાંચ્યા અને પગલાંની તાલખદ્ધતા સાથે શાસોચ્છવાસનો મેળ જળવવો જોઈએ. આમ શક્તિ અનુસાર વધતા જઈ રોજ ૩૦ મિનિટ સુધીનો જોગિંગનો કાર્યક્રમ અઠવાડિયામાં ૪-૫ દિવસ નિયમિત હાથ ધરવામાં આવે તો શરીર પર ધણી લાલદાયો અસર થયા વિના રહેતી નથી. જોગિંગની કસરત પૂરી કરવાની હોય ત્યારે તને ધીમે ધીમે બંધ કરવી જોઈએ.


૩. દોડવું (Running)

શરીરને કાર્યક્રમ અને સુદોળ બનાવવા માટે દોડવાનો વ્યાયામ ઉત્તમ છે. સામાન્ય રીતે દરેક રમત માટે એલાડીના ક્ષમતાવર્ધક (કન્ડીશનીંગ) કાર્યક્રમમાં દોડવાના વ્યાયામનો સમાવેશ હોય છે જ. દોડવાની કસરતથી હંદ્રય, ફેસાં, યકૃત, પ્લીહા, વગેરે શરીરના અગત્યના અવયવોને લાલસ થાય છે અને પરિણામે આરોગ્ય સુધારવામાં અને જળવવામાં ધણી મદદ મળે છે. લાંબા અંતરના દોડવીરો થોડા પાતળા હોય છે, પરંતુ તેમના સનાયુઓ અત્યાંત મજબૂત હોય છે. તાકાત (સ્ટેમિના) ડેળવવા માટે તથા ચરખી ઘટાડવા માટે દોડની બરોબરી કરી શકે તેવી ડોઈ કસરત નથી.

દોડતી વખતે શરીરના સનાયુઓ જકડાએલા નહિ પરંતુ સાહજિક સ્થિતિમાં રાખવા તથા કદમો તાલખદ્ધ લરવાં જોઈએ. ખડ સહેજ આગળની તરફ ઝૂકેલું તથા હાથ ડેણુભાંથી વાળેલા તથા પગની ગતિ પ્રમાણે આગળ-પાછળ જોલા લેશો. શાસોચ્છવાસ પગની ગતિના મેળમાં તાલખદ્ધ ચાલુ રહેશે. દરેક પગલે જમીન પર ઉત્તરાણું વખતે પ્રથમ પગના તળિયાનો ઉપસેલો ભાગ, પછી એડી જમીનને અડકશે અને છેલ્લે પગ જિચકતાં જમીન સાથે છેલ્લો સ્પર્શ પંઝનો રહેશે. આ ક્રિયાને 'ઓલ-ડીલ-ટો એકશન' કહે છે.



દોડો અને તંદુરસ્ત રહો
Run for Health
Run for Life
Run for Joy.




લાંબા અંતરની દોડમાં કદમ

કસરત તરીકે દોડમાં એકધારી અનુકૂળ જડપ રાખા દોડવું જોઈએ. દોડવાનું અંતર શક્તિ પ્રમાણે વધારતા જઈ ૪૦૦ મીટરથી શર કરી ૫૦૦૦ મીટર ચૂધી પણેંચી શકાય. અડવાડિયાના ૪-૫ દિવસ

દોડવાનો કાર્યક્રમ રાખવો જોઈએ. અંતર પૂર્ણ થતાં દોડવાની ડ્રિફ્ટ ધીમે ધીમે બાંધ કરવી. દોડવાની કસરત માટે અંતર તથા જડપ વધારવામાં ઉતાવળ ના કરવી; શક્તિ અનુસાર ધીમે ધીમે આગળ વધવું.



લાંબા અંતરનો દોડવીર



બોલ-ડીફ-ટો એક્શન

૪. દોડ ચાલ (Run-Walk)

સામાન્ય રીતે યુવાનો માટે દોડવાની કસરત અને વૃદ્ધો માટે ચાલવાની કસરત ઉપયોગી ગણ્યાય છે અને પ્રચલિત છે; ૫૨ંતુ યુવાન અને વૃદ્ધ એ

સાહજિક વ્યાયામ

એ અવસ્થાની વર્ણની મધ્યવિદી કે પ્રોફ વિકિતઓ માટે ફૂકત હોડવાની કે ફૂકત ચાલવાની કસરતને બદલે હોડવા તથા ચાલવાની મિશ્ર કસરત (હોડ ચાલ) ખૂબ ઉપયોગાં અને પ્રચલિત છે. આમાં ૧૦૦-૧૫૦ માટ્રા મધ્યમ ઝડપે હોડવું, પછી ૧૦૦-૧૫૦ માટ્રા ચાલવું અને એ રીતે નિર્ધારિત અંતર નિયત સમયમાં પૂર્ણ કરવાનું હોય છે. સામાન્ય માનવાએ ધોમે ધોમે વધારતા જાઈ આ પ્રમાણે રોઝ ૩-૪ માટ્રા. મી. અંતરની હોડ ચાલની કસરત અકરાદિયામાં ૪-૫ દિવસ કરવી જોઈએ. સ્વાસ્થ્ય અને ક્ષમતા ગણવવા માટે તથા દીવાયિ થવા માટે આ કસરત રામગાણુ છે.

૫. દીવ્ય શ્વાસન (Deep breathing)

ન્યારે અમકારી કસરત કરવામાં આવે છે ત્યારે સંખાંધિત અવયવના સ્નાયુઓના ડાંડાને વધારે લેવાના જરૂર પડે છે અને પરિણામે હદ્દયના ધર્મકારા વધે છે, રૂધિરાલિસરણ વેગ પકડે છે તથા ગ્રાણવાયુની વધારે જરૂર પડતાં આસોચ્છવાસ ઝડપથા ચાલે છે. જિંડા શ્વાસોચ્છવાસની કસરત આ પ્રક્રિયામાં મદદરૂપ નીવડે છે; એટલું જ નહિ પણ છાતીના સ્નાયુઓ તથા ફેસાં, ઉદ્દરપટ્ટ વગેરે અવયવો પર લાલદાયી અસર કરે છે. અમકારી કરારત પૂરી કર્યા જાએ જિંડા આસોચ્છવાસનો કસરત કરવામાં આવે છે. જિંડા શ્વાસ લેવાના કિયાને 'પૂર્ક' કહે છે; અંદર રોકવાની કિયાને 'કુંલક' કહે છે અને બહાર કાઢવાની કિયાને 'રચક' કહે છે.

પ્રકાર -૧ : પગ ખૂલ્લા તથા કમર પર હાથ ટેક્યા ટટાર જિલ્લા રહી જિંડા શ્વાસ લો, શ્વાસને ૨-૩ સેકંડ ધૂંટી રાખો અને પછી શ્વાસને પૂરેપૂરો બહાર કાઢો. શ્વાસ લેતી વખતે છાતી ઉચ્કાશો અને માયું સહેજ પાછળ જાશો. આ પ્રમાણે ૫-૧૦ વખત કરો.

પ્રકાર-૨ : પગ ખૂલ્લા તથા બંને હાથને

પેટ આગળ ફોસમાં રાખી ટટાર જિલ્લા રહેલો. હવે જિંડા શ્વાસ લો અને તે સાથે બંને હાથને જિંચે માથા ઉપર લઈ જઈ પહોળા કરો. આ વખતે છાતી ઉચ્કાશો અને માયું સહેજ પાછળ જાશો. શ્વાસને ૨-૩ સેકંડ ધૂંટી રાખો અને પછી શ્વાસને ઝડપથા નાક અથવા મોં દારા બહાર કાઢો. આ વખતે બંને હાથ પાછળ તે જ રસ્તે પેટની આગળ ફોસની મૂળ સ્થિતિમાં આવી જાશો. આ પ્રમાણે ૫-૧૦ વખત કરો.

પ્રકાર-૩ : પગ ખૂલ્લા તથા ધડ આગળ ઝુકેલું અને હાથ આગળ લંબાવેકા રાખી જિલ્લા રહેલો. હવે જિંડા શ્વાસ લો અને તે સાથે ધડને ટટાર કરતા જઈ હાથને જિંચે માથા પર લઈ જવ તથા ધડને થોડું પાછળ જવા દો; એટલે માયું પણ પાછળ જાશો અને છાતી ઉચ્કાશો. શ્વાસને ૨-૩ સેકંડ ધૂંટી રાખો અને પછી શ્વાસને ઝડપથા નાક અથવા મોં વાંટે બહાર કાઢો. આ વખતે ધડ તથા હાથ પાછળ તે જ રસ્તે આગળ મૂળ સ્થિતિમાં આવી જાશો. આ કિયા ૫-૧૦ વખત કરો.

૬. તરવું (Swimming)

તરવું એ સાહજિક વ્યાયામ છે અને ઓછા ખર્ચાળ હોવા સાથે અધિં અંગોને સપ્રમાણુ વ્યાયામ આપે છે. ધર્યા માયુસો માનસિક શાંતિ અને આનંદ મેળવવા માટે પણ તરવાનું પસંદ કરે છે. તરવાનો વ્યાયામ જ ફૂકત એવો વ્યાયામ છે કે જેમાં આણાલ વૃદ્ધ, સ્વી કે પુરુષ, તંહુરસ્ત, અપંગ કે



તરો અને તાજ રહો

સરાકત સૌ બેગા મળીને વ્યાયામ સાથે આનંદ માણી શકે છે.

પ્રયોગાત્મક અભ્યાસ અને અનુભવથી સાધિત થયું છે કે ઓળખમાં ઓછા ૪ વર્ષની ઉંમરથી વ્યક્તિ પોતાની જતે તરતાં શીખી શકે છે. વિદેશોમાં માતા-પિતા પોતાનાં નાનાં બાળકોને સાથે જ તરતાં શીખવા લઈ જય છે. જે ગોય દેખરેખ નીચે પદ્ધતિસરની અને કુનેહપૂર્વકની તાલીમ મળે તો આવી કુમળી વયથી જ તરવું સહજ બને છે. તરવાની કાગા એક વાર ઉસ્તગત કર્યા પછી જીવનભર કદ્દી ભૂલી જવાતી નથી.

બાળકનો સહજ સ્વભાવ પાણીમાં છુણાણિયાં કરવાનો છે અને તેમાં આનંદ પણ સવિશેષ મળે છે. એટલે સૌ પ્રથમ બાળકના મનમાંથા પાણીનો લય હું કરવો જોઈએ અને પછી તરતાં શિખવવા તરફ ધ્યાન ડેન્નિત કરવું જોઈએ. તરવાની કળા અન્ય કાગાગોની તુલનામાં થોડી કદીન હોવા છતાં સાહસિકતાની દર્શિએ ઘણી પ્રેરક હોવાથી વ્યક્તિ થોડીક સહીગતા મળતાં તે તરફ આકર્ષય છે અને નિયમિત મહાવરાથી જરૂરી તરણુકળા ઉસ્તગત કરી શકે છે.

તરવાનો વ્યાયામ એ એક મનોરંજક રમત. છે અને ઘણું રોગને મટાડનાર ઓસડ પણ છે આ વ્યાયામનું સાધન નિર્મળ પાણી હોવાથી તેના તરફની આપણી રૂચિ સહજ અને સ્વાસ્થાવિક હોય છે. શારીરિક શુદ્ધિ તેમજ તાજગી મેળવવા માટે આપણે સ્નાન કરીએ છીએ, પરંતુ સામાન્ય સ્નાન અને તરવાનું બન્નેમાં ઘણું ફરક છે. શરીરને પાણીમાં તરતું કરવા માટે તમામ સ્નાયું આને તંગ કરી આ વ્યાયામ કરવાને બદલે તેને ઢીલા મૂકીને કરવો પડે છે. તથા આ વ્યાયામથી તન અને મનનો થાક જલદી ઉત્તરી જય છે; તથા તાજગી અને તંદુરસ્તીનો અનુભવ તરત થતાં શરીરમાં સૂર્તિ, ચપળતા અને ઉભિનો વ્યાપક

સંચાર ઝડપથી થાય છે. મુખ્યત્વે તો તરવાનો વ્યાયામ કરવા તરફ આપણી રૂચિ સાહજિક હોવાથી અને સ્નાન કરવાની જરૂરીઆતમાંથી ઉદ્ભબવેલી આપણી રોજાંદી ટેવને કારણે તરવાનો વ્યાયામ સાધનશુદ્ધિવાળો તેમજ સ્વાસ્થશુદ્ધિની ટેવમાંથી ઉદ્ભબવેલો હોવાથી તાજગી અને તંદુરસ્તીનો પ્રત્યક્ષ અનુભવ થતાં વાર લાગતી નથી. તે જ પ્રમાણે ઊડા પાણીમાં જવાના વિચાર માત્રથા ને માનસિક તનાવ આવે છે, તેમાંથી મુક્ત થતાં પણ વાર લાગતી નથી. માનસિક અને શારીરિક તનાવો વચ્ચે ભી સાતા આજના આ વિપમ, ચંત્રવત્ત બનતા જીવનમાં આ તનાવોને સમર્તોલ બનાવે તેની કસરત, વ્યાયામ કે રમતોસાં તરણું કળા બેશક મોખરે છે. આ વ્યાયામ કરવા માટે સ્નાનાગારો, નદી, તળાવ સરોવર, દરિયો કે બાંન કુદરતી જળાશયોનો આશરો લેવો પડતો હોવાથી તાજગીભરી ખૂલ્ખી હવા અને સૂર્યના પ્રકાશનો લાલ આપોઆપ જ મળી રહે છે. આ સ્થાનોમાં કુદરતે ભારોભાર ખુશનુમાભરી તાજગી વેરી હોય છે. તરણુંડુંડોની ર્યાના પાણી પણ જે આવું નેસગિંક વાતાવરણ સર્જવાતી દાદ્યિ ન જળવાઈ હોય તો તે સ્થાન વ્યાયામનું એક જીવંત ધામ બનવાને બદલે ડેવળ પાણીનો નિરસ હોજ કે હવાડો બની રહે છે.

તરણ માટેના વ્યાયામનું સાધન પાણી કુદરતી અને સૌંદર્યપ્રદ હોવાને કારણે નાના મોટા સૌનું મન તે તરફ આકર્ષય છે. સૌથી મહત્વની આણત તો એ છે કે એકલો તરવાનો વ્યાયામ જ ગમે તે ઉંમરનાં સ્વી પુરુષોને એક સરખો આનંદ આપે છે. કુદુંબનાં બધા સહ્યો એક સાથે આનંદ માણી શકે તેની આ પ્રવૃત્તિ છે. દિવસના ડોઈ પણ સમયે તે કરી શકાય છે. આ વ્યાયામને સમયની મર્યાદા નહતી નથી. આજના ધાંધલિયા જીવનમાં ગમે ત્યારે કૂરસદ મળતાં તેનો આનંદ મેળવી શકાય છે. વળી આ વ્યાયામ માટે ડોઈ વિશેષ શારીરિક યોગ્યતાનું પણ બંધન નથી. બલિષ્ઠ, સ્વસ્થ,

માંદળીમાંથી ઉટેલાં, અપંગ, બહેરા, મૂંગા સૌ ક્રાઈ તનો લાસ લઈ શક છે; એટલું જ નહીં પણ તરણુંની અવનવી કસરતો આગેઝ ચુધાન્નથ્યામાં લાલદાયા નીવડે છે.

માથાનો દુઃખાવો, અનિદ્રાનો રોગ, હાઈ લકડ પ્રેસર, કરેડની વફતા, હંદ્ય ધણકારાની અનિયમિતતા, શ્વાસ અને દમના રોગ, પોલીઓ અને લક્ષવાનો રોગ, વરેરે રોગ તરફાથી મટે છે. આવા વિશિષ્ટ અને સર્વોત્કૃષ્ટ ગુણોને લીધે તરણુંનાને સ્વાસ્થ્યસુરક્ષા માટે સર્વોપરી સ્થાન મજ્યું છે; અને તેથા જ તરવાનો વ્યાયામ આને ઝકપથી ખૂબ લોકપ્રિય બનતો જય છે.

તરણું એટલે શરીરને પાણી પર તરતું રાખવાની તેમજ તને પાણીમાં આગગ ધપાવવાની કિયા. પાણીના અવરોધની સામે શરીરને આગળ ધપાવવા માટે હાથ અને પગ ઉચ્ચાલન તરીકે કામ કરે છે, જ્યારે શરીર સ્થિર ધરી કે ટેકાની ગરજ સારે છે, પદ્ધતિસર તરવાની ક્રાઈ પણ રીતમાં આ એ અવસ્થા-

એ સ્પષ્ટ હોય છે. પાણીમાં શરીરને તરતું રાખવા માટે આક્રિમિકે શાધી કાઢેલો તરણુંશીલતાનો નિયમ લાગુ પડે છે. પાણીમાં જે શરીરને જરૂર કરતાં સહેજ પણ વધારે સમય કે માત્રામાં વધુ તંગ કરવામાં આવે તો શરીરને ગુરુત્વભાર પાણી કરતાં વધે છે અને શરીર વિશેષ ગુરુત્વમધ્યકંન્ડ બિંદુ ગુમાવતાં જેમ જમીન પર પટકાઈ પડે છે તેમ પાણીમાં પટકાવા માંડે છે; એટલે કે તે દૂળવા માંડે છે. નેમ નક્કર જમીન પર પગ ટેકાની રાખવા માટે, ચાલવા માટે કે શરીરનું સંતુલન જળવી રાખવા હાથ અને પગનો ઉચ્ચાલન તરીકે ઉપયોગ કરી આપણે ગણી પડ્યા વિના શરીરને સમતોલ રાખી શકીએ છીએ, તેમ પાણીની સપાઠી પર રહેવા માટે અને તેમાં ગતિ કરવા માટે હાથ પગના સહારે તરણુંશીલતા જાગવી પાણી પર સમતોલ રહી વિહરી શકીએ છીએ.

જેંડા પાણીમાં આગળ ધપવા માટે સ્નાયુઓની હલનયલનની સ્થિતિ, જેને હડસેલવાની-આગળ ચાલવાની સ્થિતિ કહે છે તથા હલન



તરવાની કરવાનો જોટા નથી

યલન કરવા માટે ઉપયોગમાં લીધેલાં અંતોને તરત જ સ્વસ્થ કરવાની કે પુનર્ભિલયુક્ત કરવાની સ્થિતિ હોય છે. આથી એક સ્ટ્રોક પૂરો કર્યા પછી એટલે કે પાણીમાં એક કદમ આગળ ધપવા પાણીનો અવરોધ કાપીને સામે ને અવકાશ જોબો કર્યો તેમાં હલનયલન વિના બીજી સ્ટ્રોક-કદમ માટે શરીરને તૈયાર કરતાં પહેલાં તેને સરકવા દેવાની સ્થિતિ પણ આપોઆપ મળે છે. તરવાની દરેક રીતમાં હાથ કે પગને ઉપયોગમાં લેતાં પ્રમાણુસર તંગ કરવાની અને તરત જ સ્વસ્થ કરવાની દરેક આંગ માટે પૃથ્રુ પૃથ્રુ સુવિધા પણ છે; અને એ સ્ટ્રોકની વર્ચ્યે પૂર્ણ આરામથી આપમેળે આપું શરીર સરકીને આગળ વધે તેવા ગ્લાઇડ લેવાનો લાંબો ગાળો પણ છે. આ એ સ્થિતિને બરાબર સમજી લઈ તેમો ચુમેળ સાધી તરવામાં આવે તો એઓ થાકે વધુ ઝડપથી લાંખું અંતર કાપી શકાય છે અને પાણીની સપાઈ પર સમતોલ તરણ પણ કરી શકાય છે.

આમ સ્નાયુઓને પહેલી સ્થિતિમાં તંગ અને ખીંચ સ્થિતિમાં ફીલા કરવાની બંને ક્રિયાઓ તરવામાં આપમેળે થતી હોવાથી આ વ્યાયામ બીજી ડોષ પણ વ્યાયામ કે કસરતથી અલગ પડે છે. અન્ય વ્યાયામ પ્રકારો, કસરતો કે રમતો મોટે લાગે નકકરે અને સ્થિર જમીન પર રહી કરવાનાં હોવાથી શરીરનો વિશેષ ગુરુત્વભાર અને ગુરુત્વ ભધ્યબિંદુ ટકાવી રાખવા વધુ પરિશ્રમ કરવો પડે છે; અને તેવી કસરતો કરવામાં શરીરને સતત તંગ રાખવું પડે છે. તેથી તેવા વ્યાયામ કરતી વખતે સ્નાયુઓને યોગ્ય આરામ કે સ્વસ્થતાની સ્થિતિ ભળતી નથી અને લારે પરિશ્રમને કારણે તે ગંઠાં જન્ય છે અથવા આંતરિક સ્નાયુઓના લેગો શરીરના ખાલ્ય સ્નાયુઓ વિકસે છે.

તરવાની ક્રિયા વિશેષ તો શરીરને પાણીમાં આકું રાખો કરવી પડે છે. વળી નકકર પદાર્થના

ડોષ પણ ટેકા વિના તરણુશીલ બનવા પગ પરથી વિશેષ ગુરુત્વભાર હ્યી જન્ય તેને જળવી રાખવા શરીરના તમામ અવયવો એકી સાથે ક્રિયાશીલ બની જતા હોવાથી તરવામાં પાણીના આવરણુમાં તેના અવરોધાને ઉગવા કરી શરીરને આગળ ધપાવવાનું હોય છે. પાણીમાં શરીરની આડી સ્થિતિ થતાં પગ પરનો આખા શરીરનો લાર હ્યી જન્ય છે અને હંદ્ય પરથી લોહીના ભ્રમણુના દાણણુનો લાર હળવા થાય છે. નેમ આરામ કરવા આપણે શરીરને જમીન પર આકું પાડીએ છીએ, તેમ શરીરને પાણી પર તરતું રાખવા માટે શરીરના બધા અવયવો એકી સાથે કામે લાગી જન્ય છે; આડી સ્થિતિને કારણે હંદ્ય પરથી લોહીના દાણણુનો લાર ધરી આખા શરીરમાં તે સપ્રમાણ વહેહું થાય છે. છતાં તરવાની કસરતમાં જલદી થાકી જવાહું નથી. તરવામાં શરીરને ફીલું મૂઢી દઈએ તો જ તરણુશીલ રહેવાય; તંગ કરીએ તો તે પાણીમાં દૂષિતવા માર્દી. આમ શરીરને તંગ અને ફીલું કરવાનાં બન્ને સ્થિતિનો યોગ્ય ચુમેળ તરવાની ક્રિયામાં થાય છે. ઉપરાંત તરતી વખતે હલનયલનની ક્રિયાઓ થાય છે ત્યારે આખા શરીર પર ચારે બાબુલુઓથી એકું સાથે પાણીનું ને એકધારં દાણણુથી થાય છે, તેથી વ્યાયામની સાથે સાથે પૂર્ણ માલિશની ક્રિયા પણ થાય છે. આને કારણે શરીરમાં લોહીનું ભ્રમણ એકધારં અને સપ્રમાણ બને છે. તરતી વખતે શ્વાસોશ્વાસ દીધાં અને ક્રિયાઓ તાલખદ કરવી પડતી હોવાથી પણ શરીરમાં લોહીનું ભ્રમણ સપ્રમાણ બને છે. અન્ય વ્યાયામ પ્રકારો કરતી વખતે સ્નાયુઓ અને રક્ત વાહિનીઓમાંથી પરસેવા વાટે ને ઝેરી પદાર્થી ત્વચાનાં છિદ્રો દ્વારા અહાર આવે છે તેને દૂર કરવા અલગ પ્રયત્ન કરવો પડે છે; પણ તરતી વખતે આ પદાર્થી આખા શરીર પરથી આપોઆપ ધોવાતા રહે છે. આ છિદ્રો ખુલ્લાં થતાં શરીરમાં હંદ્ય પરના દાખ કે ધસારા વિનાનું રક્તભ્રમણ થાય છે;

પરિણામે ચામડી નીચેનો, વાળ જેવી ભારીક રક્તવાહિનીઓએ દ્વારા શરીરના ખૂણેખાંચરે થુઢ લેખીનો સંચાર થતો રહે છે. આથી જ વતાઓએ રક્તદ્વાણુના દર્દીઓ માટે, જોઈ ચરણી વધવાથી કે ગંધાર જવાથી બેઠોળ બનેલા શરીરના દર્દીઓ માટે તો આ વ્યાખ્યામ એક રામણીએ દીલાજ કર્યો છે.

શરીરને તંદુરસ્ત રાખવા માટે ડેઝસાં અગત્યતું અંગ છે. સ્વચ્છ તાજી હવા અને ચૂર્યના તડકા-માંથી મળતાં પ્રશ્નચક તરકો મેળવો દીર્ઘ શ્વાસે-શ્વાસની તાલખદ છિયા સાથે તરનારના ડેઝસાં તંદુરસ્ત અને મજબૂત બને છે. સાથે સાથે પાણીમાં હતા કે ઊંધા રહી ડેઝ પણ રીતથા તરતાં જણાશે કે છાતી અને પેટના સ્નાયુઓ તથા કરોડનું કે બેના પર આખા શરીરના મજબૂતનો આધાર છે તે પણ, પાણીનું ઉપર તરફનું મુલાયમ દાણું અને એકદારી માલિશની કિયાથી કામગ અને કુંબાળ બને છે. મજબૂતનું કે ચેતાતંત્રમાંથી જ્ઞાનતંત્રની નણળાઈના ને રોગ થાય છે તે તરણું કસરતથા માટી શકાય છે. તરતી વખતે વ્યાખ્યામની સાથે સાથે જ થતી માલિશની પૂણ્ય કિયાથી તેમ જ પરસેવા વાટે નીકળતી અશુદ્ધિઓ પણ ધોવાતી રહેતી હોવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.

જે આજના સાધનસંપન્તન અને આધુનિક સગ-વડોવાળા તરણું દૂરોમાં આ કસરતોનો લાલ મળે તો ચૂર્યસનાન ઉપરાંત જલધારા સ્નાનનો લાલ પણ મળે છે. આથી તરવાનો લારે વ્યાખ્યામ કરવા જતાં પહેલાં શરીરનો પરસેવા અને મેલ ધોવાઈ જવાથી લોહીનું ભ્રમણ અને શરીરમાં સચવાતી જરૂરી ઉભા સમધારણું બને છે. આવા વિશિષ્ટ ગુણોને લીધે જ તરવાના વ્યાખ્યામને એક મનોરંજક રમત અને ઉપચારક ઓસડ પણ કહ્યો છે. તરણું કળામાં ડાઇવિંગ અને વોટરપોલો જેવી રમતો ઉમેરાયાથી આ કળા સર્વાંગસુંદર બની છે. લુદા લુદા પ્રકારના

અંગમરોડો કરી. જીવા સ્થાનેથી ફૂઢી પાણીમાં પ્રવેશવાની ‘ડાઇવિંગ’ કળા હસ્તગત કથ્યથી મન પરનો કાણું અને તેની એકાત્મતા યોગસાધનાની જેમ સિધ્ધ થાય છે. ઉપરાંત માણુસની શારીરિક તાકાતનું તથા તેનું પાણી પરનું પ્રભુત્વ અને કૌશલ્ય બતાવવાનું કદી ખૂટે જ નહીં, તેવી વોટરપોલોની રમત માનવીએ શોધેલી તમામ રમતોમાં સૌથી વધુ પરિશ્રમ માંગતી, લગીરથ પ્રયત્નવાળી અને મહાપરાક્રમી રમત ગણ્યાઈ છે.

તરણ કળા વિકસાવવા માટે વ્યક્તિ ને નદી, તળાવ, સરોવર, સ્નાનાગાર કે દરિયામાં તરવા જન્ય ત્યાં વ્યક્તિની સલામતી માટેનાં પગલાં અગાઉથા જ લેવાવાં જોઈએ. જ્યાં પાણી ઊંડું હોય ત્યાં શિખાઉ તરનાર ન જથ તેવી સૂચના તેમને આપી દેવી જોઈએ. જ્યાં નવા શીખનાર હોય ત્યાં તેમને ઇંણતા અન્વાને તેવી નિષ્ણુત વ્યક્તિની હાજરી હોવી જરૂરી છે તરતાં શીખતાં ને સહેજ ભૂલ થાય તો વ્યક્તિનો જન સહેજ વારમાં જતો રહે છે; માટે આ તકેદારી અવસ્થ લેવાવી જોઈએ.

તરવાનું શરૂ કરવામાં આવે તે પહેલાં તકેદારીનાં પગલાં લેવાં જોઈએ તે ઉપરાંત વ્યક્તિને તે વાતાવરણ સાથે સાતુર્દળ થવા માટેનું માર્ગદર્શન અને કિયાએ કરવાની તક આપવી જોઈએ. વ્યક્તિ કમર સુધીના પાણીમાં જલો રહે, ચાલે, ઇંધકી મારીને એસે, પાણીમાં આંખો ખૂલ્યી રાખીને આબુઝાબુજુનું વાતાવરણ જોવાનો પ્રયત્ન કરે તો પાણીથી વ્યક્તિ માહિતગાર થાય છે અને પાણીનો લય તેને આછોથા થાય છે. તરવામાં કામ આવતાં વિવિધ અંગેને તૈયાર કરવા માટે તરણુંકુંડની બહાર કે પાણીમાં તરવાની વિવિધ કસરતોનાં આવર્તન કરાવવાં જોઈએ. તદુપરાંત વ્યક્તિને તરતાં શીખવા માટેનાં સાધનો પણ ઉપલબ્ધ બનાવવાં જોઈએ. તરતાં શીખવતી વખતે સલામતીનાં પગલાં, તરતાં

શાખવવાનાં અધતન સાધનો અને કસરતો વ્યક્તિને તરણુકલા પ્રત્યે વધુ અભિમુખ ણનાવે છે.

આમ તરણુ એ સાહજિક વ્યાયામ છે; બધાં અંગોને કસરત આપતો સર્વાંગી વ્યાયામ છે; રોગાને મટાડનાર ઉપચારક વ્યાયામ છે અને મનને આનંદ આપનાર મનોરંજક વ્યાયામ છે.

૭. માર્ગદર્શક કસરત કાર્યક્રમ

નવા શાખાઓ કસરત કરનારે પ્રથમ ત્રણ અઠવાડિયાં સુધી નીચે મુજબ કસરત કાર્યક્રમ શક્તિ અનુસાર કુભિક વધારતા જઈ આપનાવવો જોઈએ.

૧. ઉપમાયેરક કસરતો, નેમાં પગની કસરતોનો પણ સમાવેશ હોય.

૨. ૨૦૦ વાર ચાલવાની કસરત.

૩. હાથ અને ધડની ૩-૪ કસરતો.

૪. ૫૦ વાર જલદ ચાલ અને ૫૦ વાર શિથિલ દોડનાં આવર્તન ૪ થા દ વખત.

૫. દંડ ઐઠક કે સૂર્ય નમસ્કાર જેવી સર્વાંગી કસરત ૫ થા ૮ વખત.


૬. ૧૦૦ વાર જલદ ચાલ અને ૧૦૦ વાર શિથિલ દોડનાં આવર્તન ૧ થા ૩ વખત.

૭. ૧૦૦ વાર ધીમી ચાલ.

૮. દીધ્ય શસન-૫ થા ૮ વખત.

ઉપરોક્ત યોજનાનુસાર કસરતો ત્રણેક અઠવાડિયાં સુધી ચાલુ રાખ્યા જાદ શિથિલ દોડની જગતો દોડવાની કસરત કુભિક માત્રામાં દાખલ કરી શક્તિ અનુસાર અંતર વધારતા જવું.

સગવડ હોય તો ઉપરોક્ત કાર્યક્રમમાં છેદે શક્તિ અનુસાર તરવાની કસરતનો પણ સમાવેશ કરી શકાય.



૧૦. દંડ-બેઠક-સૂર્યામસુક્તા

શરીરને સનાયુણદ, બળવાન અને ખડતલ બનાવવા માટે અનેક પ્રકારની કસરતો જુદા જુદા દેશોમાં પ્રચલિત છે, તેમાં દંડ અને બેઠક એ અનેખા ભારતીય વ્યાયામ પ્રકારો છે. પ્રાચીન કાળથી કુસ્તી એ ભારતની રાષ્ટ્રીય રમત છે અને ભારતીય કુસ્તીઓને કુસ્તી માટે શરીરને કસીને તૈયાર કરવા માટે દંડ-બેઠકની કસરત અવશ્ય કરે છે. તેવી જ રાતે શરીરને આજીવન સ્વસ્થ, ચપળ અને સશક્ત રાખવા માટે સૂર્યાનમસ્કારની કસરત એ વિશિષ્ટ ભારતીય વ્યાયામ પ્રકાર છે અને પ્રાચીન-કાળથી ભારતમાં પ્રચલિત છે.

દંડ અને બેઠકની કસરત નિયમિત કરવાથી ભૂજાંઓ ભજભૂત અને ભરાવદાર બને છે, વક્ષસ્થળ ઉડાવદાર અને ધારીલું બને છે, કરોડ બળવાન અને લયીલી બને છે તથા પગની સાથળ તેમજ પોંડીઓ. દંડ અને તાકાતવાન બને છે; અને આ સમગ્ર શારીરિક વિકાસ શરીરના બણ તથા સૌષ્ઠવમાં ઓાર વધારો કરે છે.

ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રખર પ્રચારક સ્વ. શ્રી છોટુસાઈ પુરાણી વ્યાયામથી થયેલા તેમના શરીર ઘડતર વિષે વર્ણન કરતાં તેમની જીવનકથામાં જણાવે છે કે, “મારી ૧૮ વર્ષની ઉંમરે લાગલગાટ બે વર્ષ” સુધી એક પણ દિવસ પડે નહિ એવી રીતે દંડ-બેઠક કરવાનું શરૂ કર્યું. પાંચ દંડ અને દશ બેઠકથી શરૂ કરી દર અઠવાડિયે કે અઠવાડિયામાં એ વાર નિયમિત માત્રાથી વધતાં, પહેલાં પચાસ દંડ સુધી પહેંચી, પચાસ દંડ એક માસ સુધી ચાલુ રાખી, ત્યાર પછી એ માસમાં એકસો દંડની મર્યાદાઓ પહેંચી, ધીરે ધીરે બસો-અઢીસો દંડ અને ચારસો-પાંચસો બેઠક સુધી

પહેંચ્યો. આમ દંડ-બેઠક અને ખૂલ્લી હવામાં ફૂરવા-દોડવાના કાર્યક્રમને પરિણુભે મારા શરીરનો અજ્ઞાન જેવો વિકાસ થયો; અને સાથળ, પગ, ભૂજ વગેરે શરીરનાં અંગો પણ ઘન અને દંડ થવા પામ્યાં. શરીર ચપળ, સપ્રમાણું તથા બળવાન બન્યું. જેવાની શક્તિમાં ખૂલ્લી જ વધારો થયો. આવા પરિણુભ્યથી જતના અનુભવને કારણે શરીર વિકાસ સાધવાની ખાખતમાં દેશી વ્યાયામની અપ્રતિમિ શક્તિમાં મને દંડ વિશ્વાસ બેઠો.” (‘ગુજરાતમાં વ્યાયામ પ્રચાર’)


દંડ

દંડના અનેક પ્રકારો છે, પરંતુ તેમાં ‘સાદા દંડ’નો પ્રકાર સુખ્ય અને અત્યંત પ્રચલિત છે. શરીરના વિવિધ અંગોનો સંગીન વિકાસ સાધવા માટે પાંચ કે દશ ‘સાદા દંડ’થી શરીરાત કરી દર અઠવાડિયે શક્તિ અનુસાર સંખ્યા વધારતા જઈ બસો કે અઢીસો દંડ સુધી પહેંચવું જોઈએ. દંડ કરતાં બમણી બેઠક કરવાનો રિવાજ છે. દંડના અન્ય પ્રકારો શરીરના વિવિધ અંગોની ચપળતા વિકસાવવા માટે ઉપયોગી છે.

અ પ્રાથમિક સ્થિતિએ

૧. દંડ કે લિયે બૈંદ જવ : જિલેલી સ્થિતિમાંથી ઢીચણું વાળી પગના પંન ઉપર બેસી જવ અને બંને હાથ વચ્ચે હુથેલીને આગળ જમીન પર ટેકવો. (ચિત્રાંક : ૧)


૨. દંડ કે લિયે છોશિયાર : ઉપરોક્ત ‘બૈંદ જવ’ સ્થિતિમાંથી બંને હાથને થથાવત રહેવા દઈ બંને પગને ઉછાળી પાછળ લઈ જઈ



દંડના વિવિધ પ્રકાર

જમીન પર ટેકવો. શરીરનો ઊંઘો અંગેણ 'વી' આકાર બનશે. બંને પગ વચ્ચે બંને હાથ જેટલું અંતર તથા એડાઓ જમીનને અડકલી. (ચિત્રાંક : ૨)

૩. અડે છો જવ : ઉપરોક્ત હોશિયારની સ્થિતિમાંથા શરીરને સંકોચ્ચી બંને પગને ખેંચી લઈ હાથની પાસે જમીન પર લાવી જિલા થઈ જવ.



જડ ખેસ દંડ

૭. દંડ પ્રકાર

૧. ઊઠ ખેસ દંડ : ૧. ઊભેલી મૂળ સ્થિતિમાંથા 'ઊઠ જવ'ની સ્થિતિથાં આવી 'દંડ કે લિયે હોશિયાર'ની સ્થિતિ લઈ પછી ઊઠ જવ'ની સ્થિતિમાંથા મૂળ સ્થિતિમાં જિલા થઈ જવ.

૨. સાદા દંડ : 'દંડ કે લિયે હોશિયાર'ની મૂળસ્થિતિમાંથા હાથને ડ્રાઇમાંથા વાળી શરીરને જમીનની નજીક સમાન્તર લઈ જઈ જેટલું બને તેટલું આગળ લંબાવી કમરથી ઉપરના ભાગને ઉપર ખેંચી સાપની ફેણુની જેમ લાવવું; પછી પૂઠને જિયકી મૂળસ્થિતિમાં આવી જવ. (ચિત્રાંક : ૨, ૩, ૪)

૩. ગર્દન કસી : સાદા દંડ પ્રમાણે જી પરંતુ દંડ શરૂ કરતાં એડી ઊંઘી કરો. શરીરને પાણળ અને ઊંઘે ખેંચો તથા માથું અંદર લઈ જવ અને સાપની ફેણુની સ્થિતિમાં આવો ત્યારે માથું પાણળ ખેંચી મેં આકાશ તરફ લઈ જવ. (ચિત્રાંક : ૫-૬)

૪. ગૃહઠન દંડ : સાદા દંડ પ્રમાણે જી, પરંતુ દંડ શરૂ કરતાં બને પગને ઢીંચણુંમાંથા વાળી ઢીંચણું જમીન પર ટેકવવા અને પછી દંડ કરવો. (ચિત્રાંક : ૭)

૫. પાંખકસી-૧ : સાદા દંડ પ્રમાણે જી, પરંતુ દંડ શરૂ કરતાં ડાખા પગને જમીનથી લગભગ દિય જેટલો સીધો ઊંઘો કરવો અને તે સ્થિતિ જાળવી દંડ પૂરો કરવો. પછી ડાખો પગ જમીન

પર મૂકી જમણો પગ જિંચો કરી દંડ કરવો.
(ચિત્રાંક : ૮)

૬. પાંખકસી-૨ : પાંખકસી-૧ પ્રમાણે દંડ કરવો, પરંતુ જિંચા કરેલા પગને જમીન પરના પગની એડી પર ટેકની પછી દંડ કરવો.
(ચિત્રાંક : ૯)

૭. વીંઝુ દંડ : પાંખકસી-૧ પ્રમાણે દંડ કરવો, પરંતુ જિંચા કરેલા પગને વીંઝોના ડંખની નેમ જિંચો કરી પાછળ પીડ તરફ વાળી પછી દંડ કરવો.
(ચિત્રાંક : ૧૦)

૮. શેર દંડ-૧ : બંને પગના ઢીચણું ભેગા રહે તેમ ષૈક્કની મૂળસ્થિતિ લઈ બંને હાથને બને તેટલા આગળ જમીન પર રાખો. પછી સાદા દંડની નેમ શરીરને જમીનને સમાંતર લઈ જઈ કમરની ઉપરનો ભાગ જિંચકી સાપની ડેણુની સ્થિતિમાં આવી પછી મૂળ સ્થિતિમાં આવી જવ.
(ચિત્રાંક : ૧૧)

૯. શેર દંડ-૨ : શેર દંડ-૧ મુજબ જ, પરંતુ ષૈક્કની મૂળ સ્થિતિમાં બંને ઢીચણું પહોળા રાખા પછી દંડ કરો.

૧૦. સીધે દંડ : ' દંડ કે લિયે હોશિયાર ' ની સ્થિતિ, પણ પૂડ જિંચી રાખવાને બદલે ભાથાથી પગ સુધી ઢાળિયાની નેમ એક સાધી લિટીમાં શરીર રહેશે. તે પછી હાથને ડેણુભાંથી વાળી શરીરને જમીન સુધી લઈ જવ અને ડેણું સીધી કરી શરીરને જિંચે મૂળસ્થિતિમાં લઈ આવો.

૧૧. એવડ દંડ : ' સાદા દંડ ' પ્રમાણે દંડ કરવો, પણ સાપની ડેણુની સ્થિતિમાંથી સીધા

મૂળ સ્થિતિમાં આવવાને બદલે અવળ ગતિથી એટલે કે છાતી જમીન પાસે લઈ મૂળ સ્થિતિમાં આવો.

૧૨. સર્પ દંડ-૧ : ' સાદા દંડ ' પ્રમાણે શરીર જમીનને સમાંતર આવે એટલે તે સ્થિતિમાં વારાફરતી હાથ આગળ મૂકી નણું ડગલાં આગળ અને નણું ડગલાં પાછળ સરકી મૂળ સ્થાને આવી દંડ પૂરો કરો.

૧૩. સર્પ દંડ-૨ : સર્પ દંડ-૧ પ્રમાણે જ, પરંતુ વારાફરતી હાથ આગળ મૂકવાને બદલે બંને હાથ સાથે ઉડાવી આગળ તથા પાછળ નણ ડગલાં સરકી દંડ પૂરો કરો.


૧૪. જુટ દંડ-૧ : સાદા દંડ પ્રમાણે જ, પરંતુ દરેક વખતે એક પગને આગળ બે હાથ વચ્ચે જમીન પર જિલો ટેકની દંડ પૂરો કરો. અને પછીના દંડ વખતે બીજી પગને આગળ મૂકો.



જુટ દંડ

૧૫. જુટ દંડ-૨ : ' જુટ દંડ-૧ ' પ્રમાણે જ, પરંતુ બે હાથ વચ્ચે પગને મૂકવાને બદલે તે બાજુના હાથની બહારની બાજુએ હથેલી પાસે પગને મૂકી દંડ પૂરો કરો.

૧૬. અયુર દંડ : ' સાદા દંડ ' પ્રમાણે જ, પરંતુ શરીર જમીન સુધી આવી કમરનો ઉપરનો ભાગ જિંચે જિંચે ત્યારે ' જુટ દંડ-૧ ' ની નેમ એક પગને બે હાથની વચ્ચે મૂકી શરીરને ટટાર કરી, બંને પગ પર શરીરની સમતુલ્ય જણવી, બંને



સીધે દંડ

હાથને જમીનથા જાંચ્કો ડાણુભાંથા જાંચે વાળી, પંનને ને તે ખલા પાંચે લાવો; પછી હાથ જમીન પર ટેકવી પગને પાછળ લઈ મૂળ સ્થિતિમાં આવો. (ચિત્રાંક : ૧૨)

૧૭. વીર દંડ : 'મયુર દંડ' પ્રમાણે જ, પરંતુ હાથ ખલા પાંચે લેવાને બદલે ઘડને પાછળની બાજુ કમાનની જેમ વાળી બંને હાથને જાંચે સીધા કરી માથાની પાછળ નગસ્કારની મુજબમાં લેગા કરો. (ચિત્રાંક : ૧૩)

૧૮. સરક દંડ : 'દંડ' કે લિયે ઐડ જવ, ની સ્થિતિમાંથા બંને પગને પાછળ ઉણણી, પંચ જમીન પર ટેકવી, તે જ ગતિમાં 'સાદા દંડ' ની જેમ શરીરને જમીન સુધી લઈજાઈ, સાપની ઝેણુની સ્થિતિમાં આવતાં બંને પગને આગળ જેંચી લઈ ઐડ જવન 'ની મૂળ સ્થિતિમાં આવી જવ.

૧૯. પલટ દંડ : 'સરક દંડ' પ્રમાણે જ, પરંતુ 'ઐડ જવ' ની મૂળ સ્થિતિમાં આવતાં શરીરને પલટી મારી અવળી દિશામાં ઐઠકની સ્થિતિ લો.

૨૦. ચુક દંડ : 'મયુર દંડ', 'પ્રમાણે જ, પરંતુ એક પગ બે હાથ વચ્ચે ગોઠવાય એટલે બીજી પગને ઢીચણુભાંથા વાખ્યા વિના તે દિશાએથી ગોળાકારે એવી રીતે ફેરવો કે તે બંને હાથની નીચેથી પસાર થઈ એક ચક્કર પૂર્ણ કરી મૂળ સ્થાને આવી જય અને તે સાથે જ આગળ મૂકેલો પગ પણ મૂળ સ્થાને આવી જશે. પછી બીજી પગે આ પ્રમાણે કરો.

૨૧. આરામ રૂ : 'સાદા દંડ' પ્રમાણે જ, પરંતુ સાપની ઝેણુની સ્થિતિમાં આવ્યા પછી નીચા નમી શરીરને મરોડ આપી માયું બને તેટલું ડાખી બગલમાં અને પછી જમણી બગલમાં લઈ જવ અને પછી દંડ પૂરો કરી મૂળ સ્થિતિમાં આવી જવ. (ચિત્રાંક : ૧૪)

૨૨. અંગૂઠા પકડ દંડ-૧ : 'આરામ રૂ' પ્રમાણે જ, પરંતુ માયું બગલામાં લઈ જવાને બદલે ને તે બાજુના પગના અંગૂઠાને હાથ લંબાવી અડકો. આમ બંને બાજુ કરી દંડ પૂરો કરો.

૨૩. અંગૂઠા પકડ દંડ-૨ : 'અંગૂઠા પકડ દંડ-૧' પ્રમાણે જ, પરંતુ ને તે બાજુના પગને જાંચે ઉકાવી પાછળની બાજુ જમીન પર ટેકવી વિરદ્ધ પગના અંગૂઠાને હાથ લંબાવી અડકો.

૨૪. કમાન દંડ : 'આરામ રૂ' પ્રમાણે જ, પરંતુ માયું બગલમાં લઈ ગયા પછી પગને ગોળાકારે સરકાવતા જઈ તથા શરીરને મરોડ આપતા જઈ કમાન (ચકાસન)ની સ્થિતિમાં આવતાં અધું ચક્કર પૂર્ણ થશે અને તે કિયા ચાલુ રાખી, આયું ચક્કર પૂર્ણ કરી મૂળ સ્થિતિમાં આવો. (ચિત્રાંક : ૧૫)

૨૫. એક હાથ દંડ : 'સાદા દંડ' પ્રમાણે જ, પરંતુ એક હાથ જમીન પર અને બીજો હાથ કમર પાછળ રાખી દંડ પૂરો કરો.

૨૬. દિવાલ જોર સીધે : દિવાલ તરફ પીડ રહે તેમ દિવાલથા લગસાગ ૧૮ દિય દૂર ઐઠકની સ્થિતિમાં બેસી, બંને હાથને આગળ જમીન પર ટેકવી છાતી દિવાલની સામે રહે તેમ પગને પાછળ દિવાલ પર જાંચે લઈજાઈ, શરીર જાંધુ કરી વૃક્ષાસનની સ્થિતિમાં આવો અને પછી આ સ્થિતિમાં હાથ ડ્રાણીભાંથા વાળી છાતીને જમીન સુધી નીચે લાવો અને પછી દ્રાણી સીધી કરતા જઈ મૂળ સ્થિતિમાં આવો. (ચિત્રાંક : ૧૬)

૨૭. દિવાલ જોર ઊલટે : 'દિવાલ જોર સીધે' પ્રમાણે જ, પરંતુ છાતી દિવાલ તરફ પીડ રહેવાને બદલે પીડ દિવાલ તરફ રહે તેવી રીતે બે હાથ જમીન પર તથા પગની એડીઓ ઉપર દિવાલ સાથે ટેકવી વૃક્ષાસન કરી દંડ કાઢો. (ચિત્રાંક : ૧૭)

૨૮. અધ્યક્ષ દંડ : દિવાલના ટેકા વિના બંને હાથ પર શરીરને ઉડાવી વૃક્ષાસન કરો અને પછી હાથ કોણુમાંથી વાળી છાતી નીચે જમીન ચુંધી લાવો અને પછી હાથ સીધા કરી શરીર જીચે લઈ જન.

૨૯. પછાડ દંડ : જિલેલી સ્થિતિમાંથી ઝૂદ્દકો મારી શરીરને આગળ પડતું મૂકતાં બંને હાથને જમીન પર ટેકવી પગ જમીન પર નીચે આવે એટલે દંડ પૂરો કરી જિલા થઈ મૂળ સ્થિતિમાં આવો.

૩૦. વજન દંડ : 'સાદા દંડ' પ્રમાણે, પરંતુ દંડ કાઢનારના પગ || પીંડી પર પોતાના પગ તથા પૂઠ પર પોતાના હાથ ટેકવી જોડીદાર જિલો રહેશે અને આ સ્થિતિમાં દંડ કાઢનાર દંડ કાઢશે. દંડ કાઢનારના પગની એડી પર પગ રાખીને જોડીદાર જિલો રહે અને તે રીતે પણું દંડ કાઢી શકાય. (ચિત્રાંક : ૧૮)

બેઠક

બેઠકની કસરતથી પગના સાથળ, તથા પીંડીઓ ધનિષ અને તાકાતવાન બને છે, જે કુસ્તી માટે અત્યંત ઉપયોગી નીવડે છે. દંડ અને બેઠક અરસ-પરસ પૂરક કસરતો છે અને સામાન્ય રીતે દંડ કરતાં બમણી બેઠક કરવાનો રિવાજ છે. બેઠકના અનેથી પ્રકારો છે અને તે બળ તથા ચપળતા વિકસાવવા માટે ઉપયોગો છે. પરંતુ આ પ્રકારો જેકી ખડી બેઠક, સાદી બેઠક અને સરક બેઠક મુખ્ય અને પ્રચલિત છે. બેઠકની કસરત બંને પગ વચ્ચે લગભગ ૧૦ થી ૧૫ સે. મિ. જેટલું અંતર રાખી જિલા રહીને કરવામાં આવે છે; અને બેઠકની કિયાના લયબધ અનુસરણુમાં હાથને આગળ કે પાછળ જુલાવવામાં આવે છે.

૧. ખડી બેઠક : જિલેલી સ્થિતિમાંથી પગને ઢીચણુમાંથી વાળી એડી જમીનને અડોલી રહે તથા

હૂલા એડીને અડકે તે પ્રમાણે બેસી તરત જિલા થાવ. આ સમય કિયા દરમ્યાન બંને હાથનો સહેજ પાછળથી આગળ લયબધ આલો આપવો. (ચિત્રાંક : ૧-૨)

૨. પંજ બેઠક : 'ખડી બેઠક' પ્રમાણે, પરંતુ બેઠક શરૂ કરતાં પહેલાં એડી પૂરેપૂરી જાંચી કરો, પછી પંજ પર બેસો અને તે પછી જિલા થઈ મૂળ સ્થિતિમાં આવો. (ચિત્રાંક : ૩-૪)

૩. સાદી બેઠક : ખડી બેઠક પ્રમાણે, પરંતુ બેસતી વખતે એડી સહેજ જાંચી થશે તથા જિલા થતાં જમીનને અડકશે.

૪. સરક બેઠક : સાદી બેઠક પ્રમાણે, પરંતુ નીચે બેસતી વખતે બંને પગથી આગળ સરકો અને જિલા થતાં પાછળ સરકી મૂળ સ્થિતિમાં આવો.


૫. નીમ બેઠક : સાદી બેઠક પ્રમાણે, પરંતુ ઢીચણુમાંથી પગ અધ્રી વાળી અધ્રી બેઠક કરી જિલા થાવ.

૬. બેઠક સપાટે : સાદી બેઠક પ્રમાણે, પરંતુ બેઠક કરી જિલા થતાં કૂદીને બંને પગ પહોળા જમીન પર અને પછી તરત કૂદીને બંને પગ ભેગા કરી મૂળ સ્થિતિમાં આવો. (ચિત્રાંક : ૫)

૭. દિશા ફેર : સાદી બેઠક પ્રમાણે, પરંતુ બેઠક કરી જિલા થતાં બંને હાથથી તાળી પાડી કૂદીને વિરઘ દિશામાં ફરી જવ; અને ત્યાંથી એ જ પ્રમાણે ફરી બેઠક કરી મૂળ દિશામાં આવો.

૮. ઊંટ બેઠક : ધડને કમરમાંથી આગળ નમાવી પગ ઢીચણુમાંથી સીધા રાખી બંને હાથને જમીન પર મુકો અને પછી હાથની આ સ્થિતિ જળવી રાખી ઢીચણુ વાળી ખડી બેઠક પ્રમાણે બેસો તથા ઢીચણ સીધા કરી જાંચા થાવ.

૯. ટાંગ તોલ : જિલેલી સ્થિતિમાંથી ડાખા પગને ડાખી બાજુ જમીનને સમાંતર જાચો કરો તે



બેઠકના વિવિધ પ્રકાર

સાથે ધડને કમરમાંથી જમણું બાજુ નમાવી જિચા કરેલા પગની સીધી લાઈનમાં લાવો અને જમણા હાથને નીચે જમીન તરફ તથા ડાબા હાથને જિચે આકાશ તરફ રાખો; પછી મૂળસ્થિતિમાં આવી આજ પ્રમાણે જમણું પગે કરો. (ચિત્રાંક : ૬)

૧૦. ચહેરા કદમ્બી : સાઢી બેઠક પ્રમાણે બેઠક પૂરી કરી ડાબા પગથી શરીર કરી એ કદમ આગળ ચાલો.

૧૧. સપાટે લગાવ-૧ : સાઢી બેઠક પ્રમાણે બેઠક પૂરી કરી ડાબા પગથી એક કદમ આગળ આવો અને તેજ પગથી એક કદમ પાછળ ભરી મૂળ સ્થિતિમાં આવો.

૧૨. સપાટે લગાવ-૨ : સપાટે લગાવ એક પ્રમાણે જ, પરંતુ એક કદમ આગળ અને એક કદમ પાછળ ભરવાની કિયા તેજ ગતિથી કરો.

૧૩. દૌડ વન્દે : હાથને ડાણીમાંથી વાળી જગા પર દૌડ કરો. (ચિત્રાંક : ૭)

૧૪. પેટગૂંઠન : હાથને ડાણીમાંથી જિચે વાળી છાતી પાસે રાખો બંને પગને વારાદ્વરતી અથી રીતે આગળ જિચા કરો કે ઢીચણું છાતી પાસે આવે. અવ્યાસ થયા પછી આ કિયા તેજ ગતિથી (ફૂફીને) સતત કરવી. (ચિત્રાંક : ૮)

૧૫. હુહમાન ઝેઠક : જિલેલી સ્થિતિમાંથી જમણું; પગને પાછળ દૂર મૂકતાં ડાબા પગને પવિત્રા લઈ જમણું હાથને જમણું પગની સાથળ પાસે અને ડાબા હાથની મુઢી વાળી અંગૂઠાને છાતી પાસે રાખો. પછી ફૂફીને હાથ અને પગની સ્થિતિ બદલો. આમ ચાલુ રાખો. (ચિત્રાંક : ૯)

૧૬. પુટકી-૧ : જિલેલી સ્થિતિમાંથી બંને પગની એડી ફૂલાને અડકે તેમ જિચો ફૂદકો મારી મૂળ સ્થિતિમાં આવો. (ચિત્રાંક : ૧૦)

૧૭. પુટકી-૨ : પુટકી-૧ પ્રમાણે, પરંતુ

દંડ-બેઠક-સૂર્યનમસ્કાર

એકકની સ્થિતિમાંથી એડી ફૂલાને અડકે તેમ જાચો ફૂદ્દો લગાવી એકકની સ્થિતિમાં આવો.

૧૮. ફૂદ્દન બેઠક : એડી જાચી રાખેલી એકકની સ્થિતિમાં હાથને આગળ-પાછળ લયબદ્ધ ઝુલાવતા જઈ આગળ તથા પાછળ રહેંદો.

૧૯. લહેરા-૧ : ડાંબો પગ આગળ જિભો તથા એડી જાચી રાખેલો જમણો પગ પાછળ રહે તેમ બેસી મૂડી વાળેલો ડાંબો હાથ કાણીમાંથી જાચે વાળેલો છાતી સામે આગળ રાખો અને મૂડી વાળેલો જમણો હાથ શરીરની જમણી બાળુ પાછળ રાખો; પછી હળવો ફૂદ્દો મારી હાથ તથા પગની સ્થિતિ અદલી નાખો. (ચિત્રાંક : ૧૧)

૨૦. લહેરા-૨ : લહેરા-૧ પ્રમાણે બેસો, પરંતુ હાથ ને તે સાથળ પર ટેકવો. પછી હળવો ફૂદ્દો લઈ અવળો દિશામાં ફરી જવ અને પગને પણ તે દિશામાં ફેરવો. આમ ચાલુ રાખો.

૨૧ અડી ખમલી : થાંબલાને અથવા જમીન પર જિભી ટેકવેલી લાઢીને છાતી સામે બે હાથ વર્ચ્યે પદ્ધતી રાખી અડી બેઠક કરો. (ચિત્રાંક : ૧૨)

૨૨. નીમ ખમલી : ‘અડી ખમલી’, પ્રમાણે, પરંતુ અધી બેઠક કરો.

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર એટલે પ્રાતઃકાળે ઉગતા ખાળ સૂર્યની લક્ષિતભાવપૂર્વક ઉપાસના સાથે નમસ્કારની કસરત. સૂર્યનમસ્કારની કસરતના એક આવર્તનમાં ૧૨ આસનોનો સમાવેશ થાય છે. દૂંકમાં સૂર્યનમસ્કાર એ ૧૨ આસનોની મિલ્ખત (series) છે. દરેક આવર્તન વખતે સાત્ત્વિક લાવના અને શ્રદ્ધાપૂર્વક સૂર્યના જુદાં જુદાં નામો સાથે મંત્રોચ્ચાર કરવાનો હોય છે.

શાસોચ્છવાસના નિયમન સહિત નિયમિત સૂર્ય-

નમસ્કાર કરવાથી શરીરનાં સર્વ અંગોને સંગીન કસરત મળે છે, જેને પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ પણ ચિત્તની પ્રસન્નતા પણ સાંપુર્ણ છે. નિરામય દીર્ઘાયુષ્ય માટે સૂર્યનમસ્કાર અમોઘ કસરત પ્રકાર છે. સૂર્યનમસ્કારની કસરતમાંથી મહત્તમ લાભ મેળવવા માટે પાંચ સૂર્યનમસ્કારથી શરૂ કરી દર અઠવાડિયે શક્તિ અનુસાર સંખ્યા વધારતા જઈ યુવાન વ્યક્તિને ૧૦૦-૧૨૫ જુધી પહેંચવું જોઈએ

સૂર્યનમસ્કારની શરૂઆત ટટાર જિભા રહેવાની મૂળ સ્થિતિમાંથી થાય છે. સૂર્યનમસ્કારના એક આવર્તનમાં જે ૧૨ આસનોનો સમાવેશ થાય છે તેમનાં નામ છે—૧. નમસ્કારાસન ૨. પર્વતાસન ૩. હસ્તપાદાસન ૪. એક પાદ પ્રસરણાસન ૫. સમકાય ભૂધરાસન ૬. અષ્ટાંગ પ્રણિપાતાસન ૭. ભૂજંગાસન ૮. ભૂધરાસન ૯. એકપાદ સ્થિતાસન ૧૦. હસ્તપાદાસન ૧૧. નમસ્કારાસન ૧૨ દક્ષાસન (મૂળસ્થિતિ).

સૂર્યનમસ્કાર કરવાની રીતનું વિગતવાર વર્ણન પૃષ્ઠ ૮૮ ઉપર તથા પ્રત્યેક સ્થિતિ યા આસનનાં ચિત્રો પૃષ્ઠ ૮૬ ઉપર આપવામાં આવ્યાં છે, તે જેવાથી સૂર્યનમસ્કારની કસરતનો સંપૂર્ણ જ્યાલ આવી શકશે. આ બાયતમાં સર્વ રીતે સ્પષ્ટ અને સરળ સમજ માટે નીચેનો ડાડો ઉપયોગી નીવડશે.

સર્વ એ ઉર્જાનો અખૂટ મહાસાગર છે અને સમગ્ર સુધીને તેમાંથી અનેક સ્વર્ણપે ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્યનમસ્કારનું દરેક આવર્તન શરૂ કરતી વખતે એટલે કે નમસ્કારાસન વખતે નીચે પ્રમાણે સૂર્યના એકેક નામ સાથે પ્રણવ (ઠૅ) સહિત મંત્રોચ્ચાર કરવો. (ઉપરોક્ત દરેક આસન વખતે સૂર્યના આ દરેક નામનો વારાક્રતી માનસિક મંત્રોચ્ચાર કરીને પણ સૂર્યનમસ્કાર કરવાની રીત પ્રયોગિત છે.)


૧. ઠૅ મિત્રાય નમ : ૨. ઠૅ રવયે નમ: ૩.

ક્રમ	આસન	શસન ટિપ્પણી	પુષ્ટ ૬૮ વર્ણન ક્રમાંક	પુષ્ટ ૬૬ ચિત્ર ક્રમાંક	પર
—	દક્ષાસન	←— ટટાર જિલા રહેવાની મૂળ સ્થિતિ —→			
૧	નમસ્કારાસન	મંત્રાચ્ચાર			72
૨	પર્વતાસન	શ્વાસ અંદર લેા	૧		73
૩	હસ્તપાદાસન	શ્વાસ બહાર કાઢો	૨		74
૪	એકપાદ પ્રસરણુાસન	શ્વાસ અંદર લેા	૩		75
૫	સમકાય ભૂધરાસન	—	૪		76
૬	સાધ્યા પ્રણિપાતાસન	શ્વાસ બહાર કાઢો	૫		77
૭	ભૂજંગાસન	શ્વાસ અંદર લેા	૬		78
૮	ભૂધરાસન	—	૭		79
૯	એકપાદસ્થિતાસન	—	૮		80
૧૦	હસ્તપાદાસન	શ્વાસ બહાર કાઢો	૯		81
૧૧	નમસ્કારાસન	—	૧૦		82
૧૨	દક્ષાસન	←— ટટાર જિલા રહેવાની મૂળ સ્થિતિ —→			

ॐ સૂર્યાય નમઃ ૪. અં ભાનવે નમઃ ૫. અં ખગાય
નમઃ ૬. અં પુષ્ટને નમઃ ૭. અં હિરણ્યગર્ભાય નમઃ
૮. અં ભરિયયે નમઃ ૯. અં આદિત્યાય નમઃ ૧૦.
અં સવિને નમઃ ૧૧. અં અર્કાય નમઃ ૧૨ અં
ભાસ્કરાય નમઃ ।

આખાલવૃદ્ધ સૌ ડોઘ માટે સૂર્યનમસ્કારની
કસરત સુલભ, સ્વાસ્થ્યવર્ધક, શરીર વિકાસક તથા
બળપ્રદ છે. કદાચ પ્રાતઃકાળે શક્ય ના હોય તો

સાયંકાળે અને બહાર ખૂલ્ખામાં શક્ય ના હોય તો
હવા ઉજસવાળા ઓરડામાં સૂર્યનમસ્કાર કરી શકાય,
શાળામહાશાળાઓ સવારની હોય ત્યાં પહેલેઓ તાસ
અને બપોરની હોય ત્યાં છેદ્દેલો તાસ સામ્ભુહિક
સૂર્યનમસ્કાર માટે ફ્રાળવવામાં આવે તો તે ઈષ્ટ
ગણુશે અને તેનાથી વિના ખર્ચે વિદ્યાર્થીઓનાં
શરીર અને મનનું સ્વાસ્થ્ય અવસ્થય સુધરશે અને
શક્તિઓમાં અચ્ચૂક વધારો થશે.



૧૧. ક્રમતાવ્યક્ત કસરતો

[Exercise should be sound, sane, easy and pleasing.]

સર્વાંગી યોગ્યતા વિકસાવનાર બાળતોમાં કસરત તે એક અગત્યની બાળત છે. શરીરનો ઉડાન, નમતીયતા, ચપળતા, સમતોલન, બળ અને સહનંશકિત, વગેરેનો તે ઉત્તમ રીતે વિકાસ કરે છે. શરીરનાં આંતરિક તંત્રો કસરતથી સુધરે છે; સામાન્ય કિયાઓ ઉતેજિત થાય છે; થાસોચ્છવાસ અનુકૂળ જને છે; સનાયુ વિકસે છે; અનિ નાની ધમનીઓ અને સૂક્ષ્મ ડેશવાહિનીઓ પહેણી થાય છે; સનાયુમાં રક્તનો પ્રવાહ ઝડપથી વહેંતા થાય છે; ડોશનયોમાં ગરમી વધે છે; તવચા વિસ્તરે છે, જેને લઈને ગરમીનું નિયંત્રણ સુધરે છે; તથા શરીરમાં પ્રથળ કાયેને અનુકૂળ રાસાયણિક ફેરફારો થાય છે.

ક્રટલીક કસરતો અને પ્રેવૃત્તિઓ વર્ષની અમુક અનુકૂળમાં અને આભોહનામાં અનુકૂળ રહે છે પરંતુ દિવસના ક્યા સમયે કસરત કરવી તેનો આધાર સામાન્ય રીતે વ્યક્તિગત વલણું, કુરસદનો સમય, અને બીજીક્રટલાક નિર્ણયાત્મક સંભેગો પર રહેલો છે. આરોગ્યની દર્શિયે સવારે નાસ્તા પછી અને બપોરે ચાર વાગ્યા પછીનો સમય કસરતો માટે હિતાવહ ગણ્યાય. નાસ્તા પહેલાં કસરત કરવી એ 'Racing a Cold Motor' જેવું છે. આખા દિવસના કામ બાદ ઉત્પન્ન થયેલ કચરો કસરત કરવાથી દૂર થાય છે, તથા તેથા શરીરનાં તંત્રો ઉતેજિત થાય છે.

ઉચ્ચ પ્રકારનું શારીરિક સ્વાસ્થ્ય મેળવવું એ દરેક વ્યક્તિનું ધૈર્ય હોય જેઠાં જોઈએ. અતે આપવામાં આવેલી તમામ કસરતો તે માટે ઉપયોગી છે; એટલું જ નહિ પણ વિવિધ રમતગમતો માટે શરીરને સુસ્થિતિ (કન્ડિશનિંગ)માં રાખવા માટે એટલે કે વ્યક્તિમાં બળ, વિસ્થોષણકિત, સહનશક્તિ, નયનીયતા,

ચપળતા, તથા સમતોલનશક્તિ વિકસાવવા માટે પણ તે ઉપયોગી છે. કસરતોના કાર્યક્રમની શરૂઆત અદ્ય-અમદાયો કસરતોથી કરી, ધીમે ધીમે અમની ભાવા વધારતા જઈ, વધારે અમકારક કસરતો તરફ જખું જોઈએ. ને ત રમત માટેના કન્ડિશનિંગ માટે દર્શાવેલી કસરતો અટકચા વિના સળંગ કરાવવી જોઈએ, એટલું જ નહિ પણ આ કસરતોમાં થતી ગતિને અનુલક્ષીને તાલ તથા લય સચવાય તે પણ જેવું જોઈએ.

ઉભમાપ્રેરક કસરતો

દરેક રમતગમતના કાર્યક્રમ માટે એક બાળત સર્વસામાન્ય છે કે તેમાં ભાગ લેતા પહેલાં ઐલાડીએ ઉભમાપ્રેરક (Warming up) કસરતો કરવી જોઈએ, કે જેથા શરીરતંત્રાય ઈંજ થવાનો સંભવ ન રહે. આ કસરતોમાં વૈવિધ્ય લાવવું તે ઈચ્છાનીય છે. ક્રટલીક નમૂનારૂપ કસરતો નીચે આપી છે.

૧. જગાહ એ હોઇ : જગા પર દોડવું... (૨ મિનિટ) [જુઓ ચિત્ર ૧]


૨. હાથ ચક્ક : બંને હાથ સીધા આગળ, જિચે પાછળ અને નાચે-એ પ્રમાણે ગોળ ફેરવવા... (૧૦ વખત) જુઓ ચિત્ર ૨, ૩, ૪, ૫]

૩. કમર મરેાઇ : પગ પહેણા તથા હાથ બાજુ પર ખસાની સીધમાં રાખી ધડને વારાફરતા ડાખી તથા જમણી બાજુ ફેરવવું.

[જુઓ ચિત્ર ૬-૭-૮]

૪. નીમ ઘેઠક : અર્ધી ઘેઠક લઈ બંને હાથ સીધા આગળ, પછી મૂળ સ્થિતિ... (૧૦ વખત) [જુઓ ચિત્ર ૯]

૫. બાજુ જૂક : પગ પહેણા અને હાથ સીધા જિચે રાખી, ડાખી બાજુ નમી, ધૂંઠી પકડો;



પછી ટઠાર થઈ જમણી બાળુ... (૧૦ વખત)

[જુઓ ચિત્ર ૧૦, ૧૧, ૧૨]

મૂળ સ્થિતિ કસરતો

અને કુલ ૨૧ કસરતો આપેલી છે ને વિવિધ રમતગમતો માટે જરૂરી બળ, વિસ્ફોટક શક્તિ, સહનશક્તિ, નમતીયતા, ચપળતા, તથા સમતોલન, વગેરે ગુણો વિકસાનવા માટે, એટલે કે કન્ડિશાનિંગ કસરતો તરીકે પ્રચલિત છે, અને ઉપયોગી પૂરવાર થયેલ છે.

કસરત ૧ : કટિ ઉત્થાન (એટેકિંગ એલ રૂન ટ્રસ) આક સરત ગરદન, પીડ અને પેટના સ્નાયુઓ માટે ઉત્તમ છે [જુઓ ચિત્ર ૧૩-૧૪]

મૂળ સ્થિતિ : પીડ પર સ્થાયી હાથ, અને બંને હાથ પગની બાજુ પર સીધા.

૧. શ્વાસ અંદર લઈ પગ, હાથ, અને માથાના આધાર પર કમરને જમીનથી જાંચે લેવી.

૨. શ્વાસ બહાર કાઢતાં મૂળ સ્થિતિ.

(આ કસરત ૪ થી ૧૦ વખત કરવી)

કસરત ૨ : શયનોત્થાન (સિટ અસ્સ)

આ કસરત પેટના સ્નાયુઓને ભજખૂત બનાવવા માટે સરસ છે. કસરત કરતી વખતે પગ દાખી રાખવા માટે ડોઈ વ્યક્તિ કે સાધનનો ઉપયોગ કરવાથી સરળતા રહેશે. [જુઓ ચિત્ર ૧૫, ૧૬]

મૂળ સ્થિતિ : પીડ પર સ્થાયી હાથ, માથાની પાણી હાથ જમીન પર સીધા રાખવા.

૧. બેઠા થઈ પગના પંખને સ્પર્શ કરવો. આ વખતે પગ સીધા રાખવા અને શ્વાસ બહાર કાઢવો.

૨. મૂળ સ્થિતિ.

આ પ્રમાણે ૧૦ થી ૨૦ વખત આ કસરત કરવી, અને એ અડવાડિયાં બાદ તેમાં નીચે પ્રમાણે ફેરફાર કરવો.

મૂળ સ્થિતિ : સૂતેલી સ્થિતિમાં ગરદન પાણી બંને હાથના પંખને પકડવા. [જુઓ ચિત્ર ૧૭]

૧. બેઠા થઈ, જમણી ડોણું ડાખા ધૂંટણું ને અડકાડવી અને શાસ બહાર કાઢવો. [જુઓ ચિત્ર ૧૮]

૨. મૂળ સ્થિતિ.

પછી આ જ પ્રમાણે જમણી બાજુ કિયા કરવી.

કસરત ૩ : ગાંધ પાંખ પસાર (રોલ એન્ડ સિટ શ્રો)

આ કસરત પેટના સ્નાયુઓ માટે ખાસ ઉપયોગી છે. તે ચપળતા અને નરમાશને વિકસાવે છે એટલું જ નહિ, પણ શરીરના વિવિધ અવયવો પર નિયંત્રણ કેળવવામાં પણ તે ધચી ઉપયોગી છે.

[જુઓ ચિત્ર ૧૬ થી ૨૭]

મૂળ સ્થિતિ : પીડ પર સ્થાયી હાથ માથા પાણી જમીનને અડકેલી સ્થિતિમાં સીધા રાખવા.

૧. ઢીંચણું છાતી પાસે લાવી હાથ વડે મજખૂત પકડવા અને શ્વાસ બહાર કાઢવો.

૨. મૂળ સ્થિતિ.

૩. હાથ અને પગને જમીનથી દુંચિ નેટલા જાંચા રાખી સીધા એંચવા.

૪. મૂળ સ્થિતિ.

ઉપરની મૂળ સ્થિતિમાંથી ગંડી છાતી પર સ્થાયી જવું.

૫. હાથ અને પગ જમીનથી દુંચિ નેટલા જાંચા રાખવા.

૬. છાતી નજીક હાથને જમીન પર સ્થાપન.

૭. હાથને ડોણુંમાંથી સીધા કરી શરીરનું બન્ધન હાથ અને ડોણું પર રાખવું. (એટલે કે દાળિયાની સ્થિતિમાં આવવું).

૮. પગ સંકેલી પંખ પર બેકુક; હાથ ઢીંચણુંની બાજુઓ જમીન પર.

૯. પગ આગળ સીધા લંબાવીને બેસવું અને શરીરને સહેજ પાણી નમાવવું.



24

25

26

27



28


29

30

31



32




33



34




35



36



37



38



39




40



41



42



43



44

૧૦. મૂળ સ્થિતિ.

કસરત ૪ : ફૂદન એંક (સ્ટ્રેચેટ જાંપ)

આ કસરત પગના સ્નાયુઓને મજબૂત કરે છે, તથા સ્નાયુઓ અને સહનશક્તિની તે ઉત્તમ કસોટીઝપ છે.

મૂળ સ્થિતિ : પગના પંખ પર એંક; હાથ કમર પર.

નૂળ સ્થાનથી ડાખી બાજુએ એકેટ કુટ અંતરે ચાર રૂદકા લેવા એ જ પ્રમાણે જમણી બાજુ પણ ફૂદકા લેવા. [જુઓ ચિત્ર ૨૬]

કસરત ૫ : પુટકી (જાંપિંગ જેક)

આ કસરત સાથળ અને પગના સ્નાયુઓને મજબૂત થનાવે છે. (જુઓ ચિત્ર ૨૮, ૨૯)

મૂળ સ્થિતિ : પગ પહોળા, હાથ ઊંચે સીધા અને સહેજ ખૂલ્લા.

૧. ફૂદીને પંખ પર એંક લઈ હાથ કમર પર મૂકવા અને શ્વાસ બહાર કાઢવો.

૨. મૂળ સ્થિતિ.

(આ પ્રમાણે ૩૦ સેકંડ ચુંધી આ કસરત કરવી.)

કસરત ૬ : તિરછે શયનોત્થાન (પિન્સર મુવમેન્ટ)

આ કસરત દ્વારા શરીરના બધા જ સ્નાયુઓને વ્યાયામ મળે છે. સહનશક્તિ, ગતિમેળ તથા નમતીયતા માટે તેમજ પેટના સ્નાયુઓને મજબૂત કરવા માટે આ કસરત ખૂબ જ અનુકૂળ છે.

[જુઓ ચિત્ર ૩૦ થી ૩૩]

મૂળ સ્થિતિ : પીડ પર સૂઈ જઈ પગ ખૂલ્લા રાખવા અને હાથ બાજુએ ખલાની સીધમાં સીધા રાખવા.

૧. જમણી પગને ઊંચકી ડાખા હાથ તરફ લાવીને અડકાડવો અને શ્વાસ બહાર કાઢવો.

૨. મૂળ સ્થિતિ.

૩-૪. એ જ પ્રમાણે જમણી બાજુએ ઢિયા કરવી.

૫. એઠા થઈ પગ વધારે ખૂલ્લા કરવા અને હાથ બાજુએ ખલાની સીધમાં સીધા રાખવા તથા શ્વાસ બહાર કાઢવો.

૬. જમણી હાથને જોલો લઈ, ડાખા પગના પંખને સ્પર્શ કરવો.

૭. ડાખા હાથને જોલો લઈ જમણી પગના પંખને સ્પર્શ કરવો.

૮. મૂળ સ્થિતિ.

(શરાંઘાતમાં આ કસરત બે લાગમાં કરવી અને પછી કસરત ૪ થી ૧૦ વખત કરવી.)

કસરત ૭ : ત્રિસોપાન ફંડ (પેડી કેક)

આ કસરત છાતી, ખલા, હાથ, કાંકું અને પેટના સ્નાયુઓને મજબૂત કરે છે. કસરત દરમિયાન શાસ ખૂબ ઊંડો લેવા અને શરીરના નીચેના લાગને બરાબર ખેંચી રાખવો. આ કસરત ત્રણ ક્રમિક સોપાનમાં કરવાની રહેશે.

પ્રથમ સોપાન : [જુઓ ચિત્ર ૩૪ થી ૩૭]

મૂળ સ્થિતિ : સાવધાન

૧. પંખ પર એંક લઈ બંને હાથ જમીન પર, દીંચણુંની બાજુએ મૂકવા અને શ્વાસ બહાર કાઢવો.

૨. પગને પાછળ કુદાવી, જમીન પર પંખ ટેકવી, ઢાળિયાની સ્થિતિમાં આવવું.

૩. ફુમ એકની સ્થિતિ.

૪. મૂળ સ્થિતિ.

આ કસરત સરળતાથી ૧૦ વખત કરી શકાય. તે પછી દ્વિતીય સોપાનની કસરત શરે કરવી.

દ્વિતીય સોપાન : [જુઓ ચિત્ર ૩૮ થી ૪૦]

મૂળ સ્થિતિ : ઢાળિયાની સ્થિતિ.

૧. ડેણુંભાંથી હાથ વાળી શરીરને નીચે જમીન તરફ લઈ નાયો; ફુત છાતીનો લાગ જમીનને અડકે.

૨. મૂળ સ્થિતિ.



45



46



47



48



49



50



51




52




53



54



55



56



58




59



57



60




61



63




62



64



65



66

આ પ્રમાણે કસરત સરળતાથી ૧૦ વખત કરી શકાય. તે પછી તૃતીય સોપાનની કસરત શરૂ કરવી.
તૃતીય સોપાન : [જુઓ ચિત્ર ૪૧ થી ૪૫]

મૂળ સ્થિતિ : સાવધાન.

૧. પંખ પર બેઠક, પગ અંને હાથ વર્ચે, શ્વાસ બહાર કાઢવો.

૨. પગ પાણળ લંબાવી ટાળિયાની સ્થિતિમાં આવવું.

૩. હાથને ડોણીમાંથી વાળા, શેરીરને નીચે લઈ જઈ, તાતી જમીનને અડકાડવી; શ્વાસ બહાર કાઢવો.

૪. હાથ સીધા કરી, તાળી પાડી, ટાળિયાની સ્થિતિમાં આવવું.

૫. કુમ એકની સ્થિતિ.

૬. મૂળ સ્થિતિ.

(આ પ્રમાણે કસરત ૬ થી ૧૨ વખત કરવી.)

કસરત ૮ : 'વી' શયનોત્થાન

આ કસરતથી પેટના સનાયુઓ મજબૂત થાય છે. પગ અને પેટના સનાયુઓ માટેની આ ઝડપી કસરત છે. [જુઓ ચિત્ર ૪૬, ૪૭]

મૂળ સ્થિતિ : પીઠ પર સુઈ જઈ હાથને પેટ પર રાખવા.

૧. બેઠા થઈ પગ વધારે પહોળા કરવા અને જમીનથી લગભગ ૬ દંચ ઉંચા રાખવા.

૨. પગ લેગા; શ્વાસ બહાર કાઢવો.

૩. મૂળ સ્થિતિ.

(આ કસરત ૪ થી ૧૨ વખત કરવી.)

કસરત ૯ : પણાડ દંડ (હીટ થ તેક)

આ કસરત કરવા માટે હાથ અને કાંકું મજબૂત જોઈએ; તથા શરીર પર કાણૂ રાખવા માટેનું સરસ કૌશલ્ય પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. સહનશક્તિની કસોટી કરે તેવી આ કસરત છે. [જુઓ ચિત્ર ૪૮, ૪૯]

મૂળ સ્થિતિ : સાવધાન.

હવે શરૂઆતમાં ૧૦ સેકન્ડ મુખી જગ્યા પર દોડ કરવી. પછી—

૧. એવી રીતે ડાઇવ મારવી કે નેથા શરીરતું વજન હાથ પર રહે અને પ્રથમ છાતી હળવેથી જમાનને અડકે, પછી પેટનો લાગ અને છેવટે સાથળ તથા પગ અડકે.

૨. હૂદીને મૂળ સ્થિતિ.

(આ કસરત ૪ થી ૧૦ વખત કરવી.)
કસરત ૧૦ : ડોંડ બેઠક (બોટમ્સ-અપ)

આ કસરત ઢીચણુના પાણળના સનાયુઓને મજબૂત કરે છે. [જુઓ ચિત્ર ૫૦, ૫૧]

મૂળ ક્રિથતિ : પગના પંખ પર બેસી હાથ વડે પગના પંખ પકડવા.

૧. એ જ સ્થિતિમાં ઢીચણુ સીધા કરવા.

૨. મૂળ સ્થિતિ

(આ કસરત ૧૦ થી ૨૦ વખત કરવી.)

કસરત ૧૧ : વિપરીતકરણી (લેગ લિફ્ટર)

આ કસરત પીઠના પાણળના સનાયુઓને બેંચાણ આપે છે અને પેટના સનાયુઓને મજબૂત કરે છે. [જુઓ ચિત્ર પર થી ૫૪]

મૂળ સ્થિતિ : પીઠ પર સૂધ જઈ હાથ માથા નીચે રાખવા; ડોણી જમીન પર.

૧. પગ ઢીચણુમાંથી સીધા રાખી જમીનથી કાટખૂણે ઊંચા કરવા.

૨. ધડને ઊંચે બેંચવું.

૩. કુમ એકની સ્થિતિ.

૪. મૂળ સ્થિતિ.

(આ કસરત ૪ થી ૧૬ વખત કરવી.)

કસરત ૧૨ : એકેરી પાંવ સરક (સિંગલ ટ્રેક મિલ્સ.)

આ કસરત સહનશક્તિ તથા નમનીયતા કેળવવા માટે ઉપયોગી છે. [જુઓ ચિત્ર ૫૫]

મૂળ સ્થિતિ : દાના ચોપળી સ્થિતિમાંથી એક પગને આગળ લાવી રહ્યા હતું હતું રાખવા.

આ સ્થિતિમાં વારાદૂરતી રહ્યા હતું હતું પગને અડપથી આગળ પાછળ લઈ જવાની છિંદા કરવી.

કસરત ૧૩ : દોલેરી પાંખચરક (અખલ દ્રેઝ) મિલ.

કમર અને રાખવાના સનાયુઓને ઉપગોગમાં લાવતી આ કસરત સહનરાંકિત વિકસાવવા માટે ખૂબ ઉપગોગી છે. [જુઓ ચિન ૫૬, ૫૭]

મૂળ સ્થિતિ : દળિયાના સ્થિતિ.

૧. કુદીને રહ્યા હોયણી રહ્યા હોય વર્ષે છાતી નીચે લાવવા અને શાસને ખાડાર કાઢવો.

૨. કુદીને અડપથી ગુળ સ્થિતિમાં આવવું.

(આ કસરત ૧૫ થી ૩૦ સેકન્ડ સુધી કરવી.)

કસરત ૧૪ : મેરુ કરા (ચિન અપ)

આ કસરત પીડના સનાયુઓને વિકસાવવા માટે ઉત્તમ છે. [જુઓ ચિન ૫૮ થી ૬૧]

મૂળ સ્થિતિ : જગ્યોન પર જાંધા સર્જ જવું, અને દાય કમર પર રાખવા. (બોગી પર પણ દાય રાખી રાકાય.)

૧. દાઢી જગ્યોનથી લગલગ ૧ કૂટ નેટલી જાંચી દાય ત્યાં સુધી ધડને સર્જની દેખ મુજબ જાંચે ઉઠાવવું.

૨. મૂળ સ્થિતિ

(આ કસરત ૬ થી ૨૦ વખત કરવી.)

કસરત ૧૫ : પાંખનોર (ધ રશિયન)

આ કસરત પગના સનાયુઓની સહનરાંકિત વિકસાવવા માટે ઉત્તમ પ્રકારની છે. આનાથી ચપળતા, સમતોલન અને નમનીયતાનો સરસ વિકાસ દાય છે.

મૂળ સ્થિતિ : જગ્યોન પગ આગળ સીધો. એડી જગ્યોનને અડકાલી, તથા ડાખા પગના પંખ પર બેદુક; અને દાય કમર પર. [જુઓ ચિન ૬૨]

૧. કુદીને પગની સ્થિતિ ગદસની.

૨. મૂળ સ્થિતિ.

(આ કસરત ૬ થી ૨૦ વખત કરવી.)

કસરત ૧૬ : ચાદુ (જેક નાઇંડ)

આ કસરત પેટના સનાયુ માટે ઉત્તમ છે અને ઉચ્ચ કશાની ચપળતા, સમતોલનરાંકિત અને નમનીયતાને તે વિકસાવે છે. [જુઓ ચિન ૬૩, ૬૪]

મૂળ સ્થિતિ : પીડ પર ચુંદ જવું.

૧. ધડ અને પગને જગ્યોનથી જાંચાં કરવાં; ઢીંચણું સીધા.

૨. દાયની આગળાઓ પગના પંખને અડકાડવી, અને શ્વાસ ખાડાર કરવો.

૩. મૂળ સ્થિતિ.

(આ કસરત ૫ થી ૨૦ વખત કરવી.)

કસરત ૧૭ : છુપ

આ કસરત પગના સનાયુઓનો સુંદર વિકાસ કરે છે. સહનરાંકિત, ચપળતા, તાકાત અને નમનીયતા વિકસાવવા માટે આ એક નોદીલી કસરત છે. [જુઓ ચિન ૬૫, ૬૬]

મૂળ સ્થિતિ : સાવવાન

એક થી ત્રણ કાઉન્ટ સુધી જગ્યા પર વશ કૂદકા લઈ, ચોથા કાઉન્ટે ઉત્તમાં જાંચા કુદી, પગ ખૂલ્સા કરી, રહ્યા હોય દાય વડે પગના પંખને અડકવા પ્રયત્ન કરવો.


(આ પ્રમાણે ૫ થી ૧૦ વખત આ કસરત કરવી.) આ પછી એ અડવાડિયાં બાદ નીચે મુગળ દેરકાર કરવો.

મૂળ સ્થિતિ : પંખ પર બેદુક; દાય કમર પર.

૧. ઉત્તમાં જાંચે કુદી રહ્યા હોય પગને ખાડારની તરફ અને ઉપરના બાજુઓ ખૂલ્સા કરવા, તથા ઢીંચણું સીધા રાખી, દાય વડે પગના પંખને અડકવું.

૨. મૂળ સ્થિતિ.

(આ કસરત ૨ થી ૧૦ વખત કરવી.)



ક્ષમતાવધ્યક કસરતો ૬૭ થી ૮૨

કસરત ૧૮ : શયન સાયકલ. (ક્રિન્વર્ટેડ સાયકલ)

પેટ તથા ગરદનના સ્નાયુઓ માટે આ એક ઉત્તમ પ્રકારની કસરત છે. [જુઓ ચિત્ર ૬૭]

મૂળ સ્થિતિ : પોઠ પર ચતા સૂઈ જવું; હાથ સાથળની બાજુઓ જમીન પર, પગ સીધા અને ભેગા.

૧. પગને સીધા, જાંચા કરી જમીનથા છાટખૂણે આવે એટલે કમરને પણ જાંચી કરી હાથને ડોણી-માંથી વાળી, ડોણીને જમીન પર ટેકવી, કમર ને પંખ પર ટેકવવી.

૨. બંને પગ વડે સાયકલ ચલાવતા હોઈએ તેવી ક્રિયા કરવી (૧૦ થા ૨૦ વખત પગણદલ)

૩. હળવેથા મૂળ સ્થિતિમાં પાછા આવવું.

(આ કસરત ૪ થા ૬ વખત કરવી.)

કસરત ૧૯ : કમર રેલિંગ (ફીશ ફ્લોપ)

આ કસરત ચરણી ઉતારવામાં તથા કમરના લાગને ઘટાડવામાં મદદ કરે છે. [જુઓ ચિત્ર ૬૮ થા ૭૦]

મૂળ સ્થિતિ : પોઠ પર સૂઈ જઈ, હાથ ગરદન પાણી અને ઢીંચણું છાતી પર.

૧. મરોડ આપી ઢીંચણું ડાણી બાજુએ લઈ જાઓ.

૨. મરોડ આપી ઢીંચણું જમણી બાજુ દો.

(આ કસરત ૬ થા ૧૫ વખત કરવી.)

કસરત ૨૦ : ઘાણી (ટ્રાંક રેલિંગ)

પેટના તથા પોડના સ્નાયુઓને સરસ કસરત આપી સુધેાય વિકાસ કરવામાં આ કસરત અનન્ય છે. [ચિત્ર ૭૧]

મૂળ સ્થિતિ : પગ પહોળા તથા શરીરને કમરમાંથી સહેજ આગળ ઝૂકાવી બંને હાથ આગળ ઝૂલતા રાખવા.

૧. હવે આ સ્થિતિમાંથા ઘડને તથા હાથને ડાખી બાજુ, પાણી, જમણી બાજુ, પછી મૂળ સ્થિતિમાં એમ ગોળ ફેરવવાં.

૨. આ પ્રમાણે જમણી બાજુ પણ ગોળ ફેરવો. (આ કસરત ૪ થા ૬ વખત કરવી.)

કસરત ૨૧ : સૂર્યનમસ્કાર

આ કસરતનો પ્રકાર આરોગ્યદાયી તથા બળ-વર્ધક છે. જદ્ર, કલેજ, આંતરડાં, વગેરે પાચન અવયવોને, હદ્દ્ય તથા ફેસાંને તેમજ મગજ, કરોડ-રનજુ તથા નાડીતંત્રને તે સરસ રીતે કામ કરતાં રાખ્યા, શરીરને તંહુરસ્ત અને સ્વસ્થ રાખ્યે છે. આ સિવાય જીગતા સૂર્યની સામે આ કસરત કરવામાં આવે ત્યારે વધારામાં વિટામિન 'ટી'નો લાલ પણ શરીરને મળે છે. આ કસરત પગ, સાથળ, નિતંણ, પેટ, પોઠ તથા ગર્દનના સ્નાયુઓને તેમજ કરોડને સરસ વ્યાયામ આપી તેમને મજબૂત બનાવે છે.

મૂળ સ્થિતિ : 'સાવધાન' સ્થિતિમાં અથવા બંને હાથ આગળ છાતી પાસે ન્યેલસા ગાળી ટદ્દર જિબા રહેવું. શક્ય હોય તો સૂર્યોદય સમયે સૂર્યની સામે. [ચિત્ર ૭૨.]

૧. શ્વાસ અંદર લેતાં બંને હાથ માથા ઉપર જાંચે સીધા તથા શરીર જાંચે જેંચેલું. [ચિત્ર ૭૩]

૨. કમરમાંથી શરીર આગળ વાળી, હાથ નીચે લાવી, હૃદ્યેળીએ પગની બાજુએ જમીન પર ચપટ મૂકુવી અને શ્વાસ અહાર કાઢવો, તથા ઢીંચણું વાળ્યા નિના માથું અને તેટલું અંદર લઈ નાક ઢીંચણુંને અડકાવવું. [ચિત્ર ૭૪]

૩. શ્વાસ અંદર લઈ ડાળા પગને ઢીંચણમાંથી વાળી, જમણું પગને ઢીંચણમાંથી સીધે પાછળ લઈ જઈ, પંને જમીન પર ટેકવવો તથા મોં અને છાતીને સામે જાંચે ઉડાવવાં. [ચિત્ર ૭૫]

૪. ડાખા પગને ઉડાવી ઢીંચણમાંથી સીધે, પાછળ લઈ જઈ, જમણું પગની સાથે જમીન પર મૂકી શરીરને ઢાળિયાના સ્થિતિમાં લાવવું. [ચિત્ર ૭૬]

૫. હાથને ડોણ્ણીમાંથી વાળી શરીરને નાચે જમીન સુધી લઈ જવું અને શ્વાસ બહાર કાઢવો. આ સ્થિતિમાં કપાળ, છાતી, ઢીંચણું, હાથ અને પગના પંખ જમીનને અડકેલા રહેશે, જ્યારે પેટ જમીનથી બને તેઠણું જિયું રહેશે.

[ચિત્ર ૭૭]

૬. હાથને ડોણ્ણીમાંથી સીધા કરી, શ્વાસ અંદર લેતા જઈ, છાતી તથા માથાને જાંચે લઈ, છાતીને આગળ ઉપસાવવી; તથા માથાને પાણી જવા દઈ નજરને જાંચે લઈ જવી.

[ચિત્ર ૭૮]

૭. પૂઠ બીચકી ધડ તથા માથાને અંદર ખેંચી, ઘોડાની સ્થિતિમાં આવવું. [ચિત્ર ૭૯]

૮૦. જમણું પગને ઉડાની ઢીંચણુંમાંથી વાળી, બંને હાથની વચ્ચે પગને ચપટ મૂકવો; છાતી જાંચે ખેંચેલી તથા નજર સામે. [ચિત્ર ૮૦]

૯. પાણી રહેલ ડાખા પગને આગળ જમણું પગની પાસે લાવી શ્વાસ બહાર કાઢવો. કમ બેની સ્થિતિ [ચિત્ર ૮૧]

૧૦. મૂળ સ્થિતિ-સાવધાન અથવા બંને હાથ છાતી આગળ નેડેલા. [ચિત્ર ૮૨]

(આ કસરત ૬ થી ૨૪ વખત કરવી.)

વિવિધ રમતવાર ક્ષમતાવધીનું કસરતો

વિવિધ રમતો માટે અને સૂચ્યવેલી કસરતો આગામી જણાવેલી કસરતોમાંથી પસંદ કરી સૂચ્યવી છે.

૧. કણ્ણી

કણ્ણી રમતના સારા ખેલાડી માટે બળ, ચપળતા, કૌશલ્યયુક્ત વિસ્ફેટક બળ, ત્વરિત નિણ્ણયશક્તિ, ઝડપ વગેરે ગુણો જરૂરી છે. આ માટેની કન્ડીશનીંગ કસરતો નીચે મુજબ સૂચ્યવી શકાય-

ગમડ પાંચ પસાર	-	૩	૪૫	- ૧૭
પુટકી	-	૫	શયનસાયકલ	- ૧૮
તીરછે શયનોત્થાન	=	૬	કમર રોલીંગ	- ૧૯
ત્રિસોપાન દંડ	=	૭	સ્થૂર્ણનમસ્કાર	- ૨૧
એકેરી પાંચસરક	-	૧૨		

૨. ખોખો

‘ખોખો’ રમતના સારા ખેલાડી માટે પગની તાકાત, ઝડપ, સહનશક્તિ, ચપળતા, ત્વરિત નિણ્ણયશક્તિ વગેરે ગુણો ઉપરાંત મજબૂત ફેઝસાં અને હુદય જરૂરી છે. આ માટે નીચે મુજબ કસરતો સૂચ્યવી શકાય-

શયનોત્થાન	-	૨	ઓટ દંડ	- ૧૦
ગમડ પાંચ પસાર	-	૩	દોહેરી પાંચસરક	- ૧૩
પુટકી	-	૫	શયન સાયકલ	- ૧૮
તીરછે શયનોત્થાન-	=	૬	ધાણી	- ૨૦
પણાડ દંડ	-	૮		

૩. વોલીબોલ

‘વોલીબોલ’ રમતના ખેલાડી માટે નમનીયતા, ચપળતા, સમતોલન, તાકાત તથા સહનશક્તિ એ ગુણો ખૂબ જરૂરી છે. તદ્વારાંત બાળુ, પગ અને પીડના સનાયુએ મજબૂત જોઇએ. આ માટે નીચે મુજબ કન્ડીશનીંગ કસરતો સૂચ્યવી શકાય-

પુટકી	-	૫	જાંટ દંડ	- ૧૦
તીરછે શયનોત્થાન	-	૬	ચાકુ	- ૧૬
ત્રિસોપાન દંડ	-	૭	કમરરોલીંગ	- ૧૮
પણાડ દંડ	-	૮	ધાણી	- ૨૦

આ ઉપરાંત વોલીબોલના ખેલાડીએ દ્વારાં કૂદની કસરત કરવી.

૪. બાસ્કેટબોલ

બાસ્કેટબોલની રમતમાં નમનીયતા, ચપળતા, સહનશક્તિ અને સમતોલનની જરૂર રહે છે. ઝડપ

કેળવવો એ ખૂબ અગત્યની આવશ્વકતા છે. બાસ્કેટ
બોલમાં ફૂફુવાની અને અંગવિસ્તરણની પ્રવૃત્તિ
મુખ્ય છે. થકાવટબરી રમત હોવાથી છેલ્લે ચુંધો
સરસ રમત રમવા માટે સહનશક્તિ કેળવવી પણ
જરૂરી છે. આ માટેની કન્ડીશનીંગ કસરતો નીચે
મુજબ સૂચવી શકાય—

ગણડ પાંવપસાર	- ૩	એકેરી પાંવસરક	- ૧૨
પુટકી	- ૫	પાંવનેર	- ૧૫
તીરછે શયનોત્થાન-	૬	ચાકુ	- ૧૬
'વી' શયનોત્થાન	- ૮	જ્રપ	- ૧૭
પણડ દંડ	- ૯	ધાણી	- ૨૦
જાંટ બેઠક	- ૧૦		

પગના સનાયુઓ અને સહનશક્તિ વિકસાવવા
માટે ખેલાડીએ ટ્રોક અને કોસ કન્ટ્રી દોડની પ્રવૃત્તિ
ખૂબ કરવી જોઈએ.

૫. ફૂફુબોલ

ફૂફુબોલના ખેલાડી માટે સહનશક્તિ, ચપળતા,
તાકાત, સમતોલન વગેરે ગુણો ખૂબ જરૂરી છે;
તદુપરાંત ભૂઝ, ખલા, પાંઠ તથા પગના સનાયુઓ
મજબૂત હોવા જોઈએ. આ માટે કન્ડીશનીંગ કસરતો
નીચે મુજબ સૂચવી શકાય—

શયનોત્થાન	- ૨	પણડ દંડ	- ૯
ગણડ પાંવપસાર	- ૩	એકેરી પાંવસરક	- ૧૨
પુટકી	- ૫	દ્વાહેરી પાંવસરક	- ૧૩
તીરછે શયનોત્થાન	- ૬	પાંવનેર	- ૧૫
નિસોપાન દંડ	- ૭	જ્રપ	- ૧૭
'વી' શયનોત્થાન	- ૮	શયન સાયકલ	- ૧૮
		કમર રોલીંગ	- ૧૯

૬. હોકી

હોકીની રમતના ખેલાડી માટે હાથ અને
પગની તાકાત, ચપળતા, સહનશક્તિ, ઝડપ, નમતી-
ધતા, ત્વરિત નિષ્ઠાશક્તિ : વગેરે ગુણો ખૂબ

જરૂરી છે. નીચે મુજબ કન્ડીશનીંગ કસરતો સૂચવી
શકાય—

શયનોત્થાન	- ૨	એકેરી પાંવસરક	- ૧૨
ફૂફુ બેઠક	- ૪	શયન સાયકલ	- ૧૮
તીરછે શયનોત્થાન	- ૬	ધાણી	- ૨૦
નિસોપાન દંડ	- ૭		

ખેલાડીએ કાંડાંને અંદર તથા બહાર ગોળ
ફૂફુવાની કસરત પણ કરવી જોઈએ.

૭. સોક્કટબોલ

સોક્કટ બોલના સારા ખેલાડી માટે હાથ, પગ
તથા કાંડાની તાકાત ઉપરાંત નમતીધતા, ખળ, તથા
ઝડપો પ્રતિકારના ગુણો આવશ્યક છે. કન્ડીશનીંગ
કસરતો નીચે મુજબ સૂચવી શકાય—

ગણડ પાંવપસાર	- ૩	પાંવનેર	- ૧૫
જાંટ બેઠક	- ૧૦	ચાકુ	- ૧૬
એકેરી પાંવસરક	- ૧૨		

ખેલાડીએ દોરડાં ફૂફુવાની કસરત પણ કરવી
જોઈએ.

૮. માર્ગીંય અને મૈદાની ખેલફૂદ

આ માટે ખેલાડીમાં નમતીધતા, ખળ, ચપળતા,
ઝડપ, સહનશક્તિ અને સમતોલન એ બધા જ
ગુણો કેળવવા જરૂરી છે. નીચે મુજબ કન્ડીશનીંગ
કસરતો સૂચવી શકાય—

શયનોત્થાન	- ૨	જાંટ બેઠક	- ૧૦
ગણડ પાંવપસાર	- ૩	એકેરી પાંવસરક	- ૧૨
પુટકી	- ૫	ચાકુ	- ૧૬
તીરછે શયનોત્થાન	- ૬	શયન સાયકલ	- ૧૮
નિસોપાન દંડ	- ૭	કમર રોલીંગ	- ૧૯
'વી' શયનોત્થાન	- ૮	ધાણી	- ૨૦

૬. જિભનેસ્ટિક્સ

આ માટે ખેલાડીમાં નમનીયતા, અળ તથા સમતોલનશક્તિ જરૂરી બાળતા છે. ખેલાડી માટે દોર્ઝું ચઢ, સીંગલખાર પર જિયક તથા સ્ટોલખાર્સ પર હાથ પગની કસરતો ઉપરાંત નીચેની કન્ડીશનીંગ કસરતો ઉપયોગી છે.

કટિ ઉત્થાન	-૧	જાટ બેટુક	=૧૦
ગણડ પાંવપસાર	-૩	એકેરી પાંવસરક	-૧૨
તીરછે શયનોત્થાન	-૫	પાંવન્લેર	-૧૫
ન્રિસોપાન દંડ	-૭	ચાડુ	-૧૬
'વી' શયનોત્થાન	-૮	કભર રોલીંગ	-૧૮
પણાડ દંડ	-૯	ધાણી	-૨૦
		સૂર્યનભમસ્કાર	-૨૧

૧૦. તરણ

તરણના ખેલાડી માટે નમનીયતા, અળ, સહનશક્તિ આવસ્યક છે. નીચે સુજગ્ય કસરતો સૂચવી શકાય—

શયનોત્થાન	-૨	જાટ બેટુક	-૧૦
પુટકી	-૫	વિપરીત કરણી	-૧૧
તીરછે શયનોત્થાન	-૬	એકેરી પાંવ સરક	-૧૨
ન્રિસોપાન દંડ	-૭	ચાડુ	-૧૬
'વી' શયનોત્થાન	-૮		

૧૧. કુસ્તી

કુસ્તીના ખેલાડી માટે અળ, સહનશક્તિ, ચપળતા, સમતોલનશક્તિ વગેરે ગુણો ખૂબ જરૂરી છે. નીચે સુજગ્ય કન્ડીશનીંગ કસરતો સૂચવી શકાય—

કટિ ઉત્થાન	-૧	દોહેરી પાંવ સરક	-૧૩
શયનોત્થાન	-૨	મેઝક્સ	-૧૪
ગણડ પાંવપસાર	-૩	પાંવન્લેર	-૧૫
પુટકી	-૫	ચાડુ	-૧૬
ન્રિસોપાન દંડ	-૭	જ્રપ	-૧૭
'વી' શયનોત્થાન	-૮	શયન સાયકલ	-૧૮
પણાડ દંડ	-૯	સૂર્યનભમસ્કાર	-૨૧

આ સિનાય દોરડાઢૂદ, દોર્ઝું ચઢ, સીંગલખાર પર જિયક વગેરે કસરતો પણ અસરકારક ખરી.



૧૨. ઘરમાં થાઈ શકે હળવી અટોચાયાચી કસરતો

પુખ્ન વધનાં તમામ ઋઓ-પુરુષોએ તંકુરસ્ત રહેવા માટે અને શરીરમાં સ્ક્રુતી જાગવવા માટે કેટલીક જાતની કસરતો નિયમિતપણે કરવાની જરૂર છે.

આપણું દેશમાં મોટા ભાગની વસતી અમણ્ણની વર્ગની છે, અને એ અમણ્ણની વર્ગને પોતાની આજ્ઞાવિકા મેળવવા માટે શરીર કસવું પડે છે. એદૂંતા, એતમજૂરો, સેંકડો પ્રકારના કારીગરો, તથા નાનાં-માટાં કારખાનાઓમાં કામ કરતા કામડારો વગેરેનો સમાવેશ આવા અમણ્ણની વર્ગમાં કરી શકાય. આ અમણ્ણનીઓને અને સામાન્ય રીતે ગામડાઓમાં રહેતાં ઋઓ-પુરુષોને પૂરતા પ્રમાણુમાં અગ્ર ક્ષારેક તંત્ર વધારે પડતી પણ અંગકસરત મળી રહે છે.

આ રીતે અંગકસરત કે શરીરઅમ નેમને મળી રહેતાં હોય એ લોડોએ કાંઈ કસરત કરવાની ખાસ જરૂર નથી. પણ મોટાં બામેમાં તેમજ શાદેરોમાં લાણો માણુસો ધંધાઓમાં રોકાયેવા હોવાથા શરીરઅમ કે અંગકસરત વગરનું બેડાડું જીવન જીવી રવા છે. બેડાડું જીવનવાળા આવા સહુ લોડોએ એટલે કે વેપારીઓ, સરકારી નોકરો, શિક્ષકો, કારકુનો, ગુમાસ્તાઓ. મધ્યમવર્ગના લોડો તેમજ શિક્ષિત યુદ્ધિવાન વર્ગના માણુસોએ કસરત કરવાની ખાસ જરૂર છે-દરરોજ નિયમિતપણે કસરત કરવાની જરૂર છે. છેદ્દાં વીસેક વર્ષથી લાણી રહેતાં અને લાણુંતાં જીવનોએ કસરત તરફ દુલ્ખદ્દ બતાવ્યું છે અને ખાસ કરીને ગુજરાતના શિક્ષિત વર્ગની જિગતી પ્રજી નાણી, નમાલી અને ડરકુણના લાગી છે.

પણ હવે શહીલાજે વાતાવરણ ગદ્દાવા લાગ્યું છે અને લોડો વ્યાયામનું મહત્વ સમજવા લાગ્યા છે. પણ આમ વ્યાયામનું મહત્વ સમજવા છતાંથી પોતપોતાના વ્યવસાયોને કારણે તથા સામાજિક જીવનની ઉપાધિઓને કારણે ધણ્ણા લોડોને કસરત કરવા માટે જાઓ સમય મળતો નથી અને એથા એવા લોડો કસરત કરવાનું માંડી વાળ છે. અલગતા સમય ન હોનાનો મોટે લાગે તો ભ્રમ જ હોય છે.

આવા સહુ માણુસો માટે અહીં કેટલીક હળવી કસરતો સૂચવવામાં આવી છે. શરીરને પૂરતો વ્યાયામ મળી રહે એ રીત યોજવામાં આવેલી આ કસરતો હળવી છે અને સૂચવેલી રીત પ્રમાણે કરી હોય તો દરથી ૫-૬ મિનિટમાં જ પૂરી થઈ શકે એવી છે. આ કસરતો અંગે કોઈપણ જાતના કડક નિયમો કે આગહે નથી. પોતાની શક્તિ રીતે જરૂરિયાત પ્રમાણે એ હળવી કસરતો કરવાનું વધારી શકાય છે અને ધારી કસરતો કરવાનું વધારી શકાય છે એને જ કુમમાં પણ શકાય છે. ને કુમમાં એ સૂચની છે એને જ કુમમાં તે થબી જોઈએ, એવું પણ નથી. અનુદૃઢતા પ્રમાણે એનો કુમ ઝેરવી શકાય છે. સામાન્ય રીતે દરેક પ્રકારની કસરત ચારથી દર વાર કરવામાં જરાથી વાંધા નથી.

આ બધી જ કસરતો બની રહે ત્યાં સુધી ઝૂલ્લી હવામાં જ કરવી. વહેલી સવારે અને સાંજે એમ બે વાર કરી હોય તો વધારે અને જડપી શક્યદો દેખાશે.

આ કસરતો ગાળો, યુવાનો, વૃદ્ધો અને ઋઓ-સહુ કોઈથી કરી શકાય એવી છે. આ

કસરતો કરવનાથી નાનાં બાળકોનાં શરીર મજબૂત અને જુદોળ બનશે. ડિંદી સ્ત્રીઓ પહેલી જુવાની પૂરી થયા પણી શરીરના અમૃત ભાગોમાં મેદ વધવાને લાયે જાડી અને અદોદળી બની જાય છે. આવું ગંધું થતું અટકાવવા માટે બધા સાંધારોની, પેટની તથા કમરની કસરતો અહીં જુદ્ધના છે વૃધ્ધ સ્ત્રી પુરુષોને આ હળવી કસરતો કોઈ પ્રકારનું નુકસાન કરે એવી નથી. હદ્યરોગ થયો હોય એવા લોકોએ દાંતરની સલાહ લઈને આ કસરતો કરવી. ઊંડા શાસેચુવાસ કરવાની કસરત આવ! લોકોએ ખુરશી કે બાજું પર બેસીને કરવી.


છેને એક સૂચના ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ હળવી કસરતો કરનારા સહુ કોઈએ ચારેક મિનિય કસરત કર્યા પછી કસરતની અસરવાળાં અંગોને પોતાના હાથેરી ભાલીશ કરવાં; પછી ફરી બીજુ કસરતો શરૂ કરવી; અને આ રીતે બધાં

અંગોને ભાલીશ કરીને દૈનિક કમ પૂરો કરવો. આ કસરતો કરતી વેળાએ દરેક પ્રકારની હિલચાલમાં લક્ષ પરોવીને, સનાયુઓને યોગ્ય અમ પડે તેવી રીતે કસરતો કરવી. આમ કરવાથી જ કસરતોનો ઝાયદા થશે. માત્ર મુડદાલ હિલચાલથી કાંઈ જ અર્થ સરશે નહીં.

શરીરના ભાગોનાં નામ

કસરતો અંગે લખતાં પહેલાં એ કસરતો સમબન્ધવવા માટે વપરાયેલા કેટલાક શાખાએ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. કારણ કે શરીરનાં અવયવો, અંગો, સાંધારો વગેરેનાં નામ તો સૌ કોઈ જાણે છે; પણ એમ છતાંથી કેટલાક ખુલાસાએ કરવાની જરૂર છે.

સામાન્ય વપરાશમાં હથેલીને હાથ કહેવામાં આવે છે. ખરું જેતાં હથેલી તો હાથનો એક લાગ છે.




આ રીતે આંગણથી ખલા સુધીના બાગને પણ હાથ છેડે છે. આથી સ્પષ્ટતા ખાતર હાથના વજુ જુદા બાળોને આપણે જુદાના નામો આપવાં પડશે. સંસ્કૃત ભાષામાં જુદા સ્પષ્ટ રીતને છે, પણ સરળતાની ખાતર આપણે ‘ઉપદો હાથ’, ‘નીચલો હાથ’, અને ‘દુધેલી’ જોવા શરૂદોનો ઉપરોગ ફરિશું.

આજ રીતે કશભાગ ગેહુની નીચેથી તે પગની પાની સુધીના બાગને પગ છેડેવામાં આવે છે. પગના ઘૂંટથથી ઘૂંટી સુધીનો બાગ પણ પગ છેડેવાય છે. આ એંગોને માટે એ ‘નંગ’, ‘નીચલો પગ’, અને ‘પાની’ જોવાં જુદાં જુદાં નામ રાખવા પડ્યાં છે.

આ કસરતોમાં ટટાર જિલા રહેવાનું લખ્યું હોય ત્યાં નીચે પ્રમાણેના સ્થિતિમાં જિલા રહેલું:

૧. જમીન પર એડીઓ એવા રીતે રાખવા કે તે પાછળના લાગમાં લગલાગ એકખીલું અદેલા રહે, અને આગળની પાઠલીઓ આશરે ૪૫° કે ૬૦° ને ખૂબું ડોય. બંને પાઠલીઓ સમાંતર રાખની એ કુદરતી નથી.
૨. ઘૂંટથું આગળથી પગ નરાથર રીખા રાખવા; ઘૂંટથું વાળના નહીં.
૩. છાતી કુદરતી રીતે રહેતી ડોય એ પ્રમાણે કુલાવીને આગળ રાખવા; પણ ખૂબું જોર કરીને અક્કડ કે તંગ કરવી નહીં.
૪. ગેહુને કે પેટને આગળ કાઢવાં નહીં.
૫. ખલા જરા પાણી લઈ જવા અને નીચા] રાખવા; જીચે ચડાવવા નહીં.



^{અનુભૂતિ} ટટાર અથવા ‘સાવધાન’ જિલા રહેવાની રીત.

૬. હાથ પડખાંમાં સીધા લટકતા રાખવા.
૭. નજર સીધી રાખની.

ટટાર જિલ્લા રહેવાનું તથા ચાલવાનું શીખવાની આવસ્યકતા તો છે જે, પણ કસરતો કરતાં કરતાં એ આવડી જણે. એ બાબતની ચિંતા કરીને દૂનિંમ રીતે અફ્કડ થવું નહીં. ટટાર જિલ્લા રહેવા માટે ઝીલમાં ‘સાવધાન’ રાહદ વપરાય છે. એ ‘સાવધાન’ની રીતે જ આ કસરતો વેળાએ જિલ્લા રહેવાનું છે.

ડાકીની કસરતો

૧. ડાકીને આગળ પાછળ વાળવાની કસરત :

ટટાર જિલ્લા રહીને બંને હાથ કમર પર એવી રીતે ગોકુવા કે બન્ને ઢાણીએ શરીરની બહાર કાટખૂણે રહે, હથેલીને અંગડો પડખાંતી પાછળ રહે અને બીજાં અંગળાં પડખાંતી આગળ રહે.

ડાકીને બાજુએ વાખ્યા વિના માયું ભાંચું કરીને પાછળ લઈ જવાય એટલું લઈ જવું. આમ કરવાથી હડપચી જાંચી આવરો અને ગગાના આગળના લાગમાં રહેલા સનાખુએ સારી રીતે ખેંચારો.

૨. પછી માયું સીધું કરીને છાતી પર નમાવવું. આમ કરવાથી હડપચી છાતીને અડકગે.

આવી રીતે માથાને પાછળ અને આગળ લઈ જવાની કસરત છેથી આડ વાર કરવી. ડાકીની કરવતો અંગકા સાથે કદી કરવી નહીં.

૩. ડાકીને ડાખી-જમણી બાજુએ નમાવવાની કસરત :

ટટાર જિલ્લા રહીને ઉપર પ્રમાણે કમર પર હાથ રાખવા, અને સામે નજર રાખની. એ પછી માથાને ડાખા ખલા પર દળા શકાય એટલું

નમાવવું. થોડી વાર પછી તેવી જ રીતે, માથાને જમણુા ખલા પર નમાવવું. આવી રીતે માથાને ડાખી-જમણી બાજુએ છથી આડ વાર નમાવ્યા કરવું.

૪. ડાકીને ડાખી-જમણી બાજુએ લઈ જવાની કસરત :

ટટાર જિલ્લા રહીને આગળ પ્રમાણે કમર પર હાથ રાખવા અને સામે નજર રાખવી. એ પછી ડાકીને ધીમે ધીમે ડાખી બાજુએ વાળની-મચડવી. ડાખા ખલાની બાજુનો ભાગ જોઈ શકાય એ રીતે ઠીક ઠીક પ્રમાણુંમાં ડાકીને વાળની-મચડવી. એ પ્રમાણે ડાકીને ડાખા-જમણી બાજુએ મચડવી. આ પ્રમાણે ડાકીને ડાખા-જમણી બાજુએ છદી આડ વાર મચડવા કરવી.

હાથનાં અંગળાંએની કસરત

૧. હથેળીએ આગળ રહે એવી રીતે બંને હાથને લટકતા રાખવા. પછી હાથને ઢાણીમાંથા વાળીને શરીરના કાટખૂણે લાવવા.

પછી બન્ને હાથના ચારેચાર અંગળાં, નખ હથેલીમાં વોંચતા ઢોંચએ એ રીતે જોરથી વાળવાં અને અંગુડાને પણ જોરથી વાળવો. આમ વાખ્યા પછી પાછળ અંગળાં પહોળાં કરવાં. આ રીતે અંગળાં વાળવાં અને લાંબાં કરવાં.

૨. જમણુા હાથના પંખથી ડાખા હાથની અંગળીએને એવી રીતે પકડવી કે જમણુા હાથના ટેરવાં ડાખા હાથની અંગળીએની પાછળ રહે. પછી ડાખા હાથની ચારે અંગળીએને પાછળ વાળવી, જે કે એ બહુ થોડી જ પાછળ તરફ વળશે. પછી આ રીતે ડાખા હાથના પંખથી જમણુા હાથની ચારે અંગળીએને વાળવી. કંદાની કસરતો

૩. હથેલીએ આગળ રહે એવી રીતે બંને હાથને લટકતા રાખવા.. પછી હાથને સુહૃદીએ


વાળાને, ડાણીમાંથા વાળાને શરીરના કાટખૂણે લાવવા. પછી મુદ્દીઓ હાથને અડકવા લઈ જતા હોઈએ તેવા રાતે કાંડમાંથા વાળની. વળાય તેટલું વાળાને મુદ્દીઓને લઈ જવાય તેટલી પાછળા લઈ જવા. જો કે આવા રીતે મુદ્દીઓ પાછળા કે આગળ બહુ જ આછી વળાશે.

૨ બંને કાંડાને ચતા રાખાને ડાણી તથા જમણી બાજુએ હલાવવાનો પ્રયત્ન કરવા. જો કે

બહુ હાલશે નહીં, પણ તેમ છતાં યે આ જાતની કસરત કરવા નેવી તો છે જ.

નીચલા હાથની કસરત

હેઠલીઓ આગળ રહે એવી રીતિ બન્ને હાથને લકૃકતા રાખવા પછી નીચલા હાથને ડાણીમાંથા કાટખૂણે વાળાવા. મુદ્દીઓ વાળા દેણી; મુદ્દીનાં આંગળાં ઉપરની બાજુએ રહેશે. પછી મુદ્દીઓને એવી રીતે વાળની કે પહોંચાનો પાછલો ભાગ ઉપર આવે. ફરીથા આંગળાં ઉપર આણવાં.



૧. જિભા રહેવાની એદી રીત, ૨. જિભા રહેવાની સાચી રીત, ૩. ઉપલા હાથની કસરત ખીજી, ૪ કોસની આકૃતિ, ૫ તાડની આકૃતિ, ૬. ખલાની અને છાતીની કસરત આડમી, ૭. કમરની કસરત પહેલી, ૮ જાંધ અને પગની કસરત ખીજી, ૯. બેઠકની કસરત.

આ કસરત કંડાની નથી પણ નીચલા હાથની છે, અને એ કરવાથી ડોણુંના સ્નાયુઓને કસરત મળે છે.

ઉપલા હાથની કસરતો

પહેલી કસરત : ટટાર બિલા રહેવું : બંને હાથ એવી રીત રહે કે હથેલીઓ આગળથી દેખાય. લટકતા બન્ને પહેંચાની મુફ્ફીઓ વાળવી; અને પછી બન્ને હાથને ડોણીઓમાથી વાળાને મુફ્ફીઓ ખલા સુધી લઈ જવા. છેલ્લે હાથને પાણી નીચા લઈ જવા. આમ આડથી દશ વાર કરવું :

આ કસરત કદી આંચકા સાથે કરવા નહીં. આસ્તં આસ્તે અને ઉપલા હાથને-હાથના સ્નાયુઓને ઢીક ઢીક અમ પડે (જ્ઞાને કે ડાર્ઢ હાથને વાળતાં અટકાવતું હોય અને તેની સામે થઈને હાથને ગણા સુધી લઈ જતા હોયએ) એવી રીતે આ કસરત કરવાની છે.

બીજી કસરત : ટટાર બિલા રહીને બંને હાથ ડોણીમાંથી વાળ્યા વિના પડખાંથી દૂર લઈ જવા. આમ કરવાથી શરીરનો આકાર ‘કોસ’ જેવો થશે. એ રીતે હાથ વિસ્તાર્યા પછી મુફ્ફીઓ વાળવી અને બંને હાથને ડોણીમાંથી વાળાને મુફ્ફીઓ ધામે ધામે ખલા તરફ લઈ જવા અને આડાડવી. પછી બંને હાથને કોસની આડુતિમાં લાંબા કરવા. આ કસરત આડથી દશ વાર કરવા જેવી છે. (ચિત્રાંક-૩, ૪)

ખલાની અને છાતીની કસરતો

પહેલી કસરત : ટટાર બિલા રહીને ધામેથા બંને હાથને ખલાને સમાંતર કોસની માફક સીધા કરવા. પછી બન્ને હાથનીએવી રીતે મુફ્ફીઓ વાળવી કે આંગળાં ઉપર રહે. પછી બન્ને હાથને અમપૂર્વક ડોણીમાંથી વાળાને ખલા તરફ લઈ જવા. આમ કરવાથી ઉપલા હાથના સ્નાયુઓ (બાઈસેપ્સ)ને સારી કસરત મળશે. (ચિત્રાંક-૩, ૪)

બીજી કસરત : ટટાર બિલા રહીને બંને હાથ જાંચે લઈ જવા. પછી બંને હાથની મુફ્ફીઓ વાળાને ડોણીમાંથી વાળવા અને વાળતાં વાળતાં બન્ને મુફ્ફીઓને ખલા પર મૂકવી. પછી બંને હાથને પાણી જાંચે લઈ જવા. આવો રીતે આ કસરત અનેક વાર કરવી. (ચિત્રાંક-૫)

ત્રીજી કસરત : બંને હાથને શરીરની સામે સમાંતર, સીધા લાંબા કરવા અને મુફ્ફીઓ વાળવી. પછી ડોણીમાંથી હાથ વાળાને મુફ્ફીઓને ધામેથા અને અમ પૂર્વક ખલા તરફ લઈ જવી. પાણી બંને હાથ સીધા સમાંતર કરવા. આવો રીતે આ કસરત અનેક વાર કરવી.

ચોથા કસરત : તાડની આડુતિ પ્રમાણે બંને હાથ માથાથી જાંચે લઈ જવા અને પછી ડોણીમાંથી વાળાને માથાની ટોચ સુધી લાવવા. પછી ડાણા હાથનું કાંકું જમણું હાથે અને જમણું હાથનું કાંકું ડાણા હાથે પકડી. જમણું હાથને માથાથી જરા જાંચે રાખ્યાને ડાણા હાથે ખૂબ ઘેંચવો. આમ કરવાથી જમણું ખલાના, હાથના તેમજ જમણું પડખાના સ્નાયુઓ ખૂબ ઘેંચાશે. એવી જ રીતે જમણું હાથે ડાણા હાથને બના શકે એટલો ઘેંચવો.

પાંચમી કસરત : કસરત ચોથા પ્રમાણે બંને હાથને કંડાએથી માથા ઉપર પકડવા પછી એ હાથચૂડને માથાની આગળના ભાગમાં-મોઢા તરફ લાવવી અને પછી એ ચૂડને માથા પર લઈ જઈને માથાની પાછળના ભાગમાં જેટલી લઈ જઈ શકાય એટલી લઈ જવી. આમ હાથચૂડને માથાની આગળ-પાછળ લઈ જવાની ક્રિયા વારંવાર કરવી.

છુટી કસરત : ટટાર બિલા રહીને બંને હાથ લટકતા રાખવા અને મુફ્ફીઓ વાળવા. ડોણીઓ શરીરને કાટખૂણે રહે એવી રીતે ધામે ધામે બન્ને મુફ્ફીઓને બગલમાં લઈ જવી. મુફ્ફીઓને બગલમાં લઈ જતી વેળાએ પગના પંજાએ પર જરા જાંચા

થવાય તો વધારે સારું. ચુક્કીએ બગલમાં લઈ જઈને પછી પાછા હાથ સીધા કરવા અને પગના પંન જિચા કર્યા હોય તો પાછા ગરાણર મૂકી દેવા. આ કસરત ફરી ફરીને કરવી.

સાતમી કસરત : ટદ્દાર જિલ્લા રહીને બંને હાથને ક્રોસની આકૃતિ પ્રમાણે રાખવા. પછી બંને હાથને ક્રોણીમાંથી વાળ્યા વિના શરીરની સામે સીધા, સમાંતર કરવા અને પછી ક્રોણે ભેટતા હોઢુંએ એવા રીતે જમણું હાથને ડાખી તરફના પડખા સાથે દણાવવો અને એની સાથે સાથે જ ડાખા હાથને જમણી તરફના પડખા સાથે દણાવવો. પછી ધીમે ધીમે હાથને પાછા મૂળ સ્થિતિમાં કોસના આકારમાં લંઘાવો દેવા. આ પ્રમાણે આ કસરત અનેક વાર કરવી.

આઠમી કસરત : ટદ્દાર જિલ્લા રહીને હાથ લટકતા રાખવા અને એક હાથ ક્રોણીમાંથી વાળ્યા વિના બાજુએથી જિંચો કરવો. એ જિંચો કરેલો હાથ નીચે લાવવો અને એમ નીચે લાવતી વખતે જ ભીજો હાથ જિંચો કરવો. આવી રીતે એક હાથ જિંચો થતો હોય ત્યારે જ ભીજો હાથ નીચે આવતો હોય એ પ્રમાણે કસરત કરવી. (ચિત્રાંક-૬)

નવમી કસરત : ટદ્દાર જિલ્લા રહીને બંને હાથ કમરે મૂકવા અને પછી આખું પડખું, ખલા, પેટ અને કમર વગેરે ડાખી તરફ વાળનાં. આમ એક વાર ડાખી તરફ વાળ્યા પછી આખું પડખું, ખલા વગેરે જમણી તરફ વાળનાં. આ કસરતમાં માયું ખાસ ફેરવતાનું નથી; પણ કુદરતી રીતે એ જમણી-ડાખી બાજુએ જથું એમાં કંંઈ વાંધો નથી.

ઊંડા શ્વાસોચ્છ્વાસ

અમુક અડપ્થી ઊંડા શ્વાસ લઈ ટૂંક સમય માટે રોકીને પછી એ કાઢી નાંખવાની કિયા આપણા દેશમાં બહુ જણીતી છે અને તેને પ્રાણ્યાયમ કહે છે. આ 'પ્રાણ્યાયમ' શબ્દ અહીં જાણી

નેઈને વાપરો નથી; કારણ કે ને પ્રકારની હળવી કસરતો આપણે કરવી છે તેને માટે કોઈ એક ખાસ પદ્ધતિથા શ્વાસ લેવા, રોકવા અને છોડવાની કડાકૂટમાં પડવાની લેશમાં જરૂર નથી.

ઊંડા શ્વાસ લેવા માટે કોઈ પણ જાતના ખાસ આસનથા બેસવાની જરૂર નથી. સારી રીત એ છે કે ખુરશી પર, બાજીથ પર કે જમીન પર બેસવું. શરીરને ટદ્દાર તથા સ્થિર રાખવું અને પ્રયાસપૂર્વક જિંડા શ્વાસ લઈને છાતી કુલાવવી. છાતી કુલતી જથું તેમ તેને આગળ લાવવી. કુલાભ્યા પછી માત્ર બે-ત્રણ સેકન્ડ શ્વાસ રોકવો અને પછી કાઢી નાંખવો. શ્વાસ લેતી વેળાએ જરા વધારે અડપ અને શ્રમ લેવો અને પછી પ્રમાણમાં ધીમે ધીમે શ્વાસ છોડવો. એક એ સેકન્ડ રાહ નેઈને શ્વાસોચ્છ્વાસની કિયા-જિંડા શ્વાસ છાતીમાં ભરવાની ઘૂંટવાની અને થોડી જ વારમાં ધારે ધારે બહાર કાઢવાની કિયા-ફરીથા કરવો.

શરાયાતમાં આવા ઊંડા શ્વાસોચ્છ્વાસ કરવાની કિયા છ એક વાર કરી હશે તો બહુ છે. ઊંડા શ્વાસોચ્છ્વાસ કેટલા લેવા તે પણ અનુભવ પરથી સમજશે. આમ થોડી ટેવ પડે ત્યાર પછી શ્વાસોચ્છ્વાસ ખૂબ ઊંડા લેવાનો પ્રયાસ કરવો ઢીક ઢીક ટેવ પડયા પછી આ જિંડા શ્વાસોચ્છ્વાસ વીસેક વાર કરવાથી તુકશાન થતું નથી.

ચેણી કસરતો

આ કસરતોમાં ઢીક ઢીક વખત લાગે છે અને તેથા તેને દૈનિક કાર્યક્રમમાં મૂકી શકાય એમ નથી પણ કઅન્જિયાતવાળા માણ્યસોએ તો પેણો કસરતો ખાસ અજમાની જોવા નેવી છે.

પહેલી કસરત : પથારી, શેતરંજી કે ચટાઈ પર સીધા સૂધ જવું અને ઘૂટણમાંથા જરા પણ વળે નહીં એ રીતે એક પગ, ધોરે ધારે બની શકે એટલો જિચો કરવો. થોડી વાર આમ જિચો રાખવો અને

પછી ધીમે ધીમે નીચે મૂકી દેવો। એક પગ આ પ્રમાણે જાંચો લઈને નીચે મૂક્યા પછી એ જ પ્રમાણે બીજો પગ પણ જાંચો કરવો, રાખવો અને મૂકી દેવો। પગ જાંચો લઈને નીચે મૂકવા સુધીની આખી કિયા જરાયે આંચકા આગાયા વગર ધીરે ધીરે કરવો.

આ કસરત કરતી વેળાએ જાંચો કરેલો! પગ ધૂંટણુમાંથા ના વળે અને નીચે રહેલો પગ જમીન કે પાથરણું પરથી જાંચો ના થાય એ ખાડું સંભાળવાનું છે.

બીજી કસરત : ઉપર પ્રમાણે જ સીધા સૂધને બંનેય પગને સાથે, ધૂંટણુમાંથા વાળ્યા વિના ધીમે ધીમે અની શકે એટલા જાંચા કરવા; અને થોડી વાર એમ જ અદ્દર રાખીને પછી પાછા ધીમે ધીમે નીચે મૂકી દેવા.

ન્યાય કસરત : ઉપર પ્રમાણે જ સીધા સૂધને પછી ડાઢો પગ ધૂંટણુમાંથા વાળવો અને પેટ પર લઈ જવો। આમ ડાઢો પગ પેટ પર લઈ ગયા હોઈએ ત્યારે બીજો પગ પાથરણું સાથે બરાબર વળગી રહેવો નેઈએ. થોડી સેકંડ ડાઢો પગ પેટ પર રાખીને પછી એને પાછો સીધો કરીને નીચે પાથરણું પર લઈ જવો અને પછી આ જ રીતે જમણું પગની કિયા કરવો. આમ વારાફરતી અને પગ પેટ પર આગળ લાવવા અને પાછા લઈ જવા.

ચોથા કસરત : ચત્તા સૂધને ધડથી નીચેનો આગ પાથરણું સાથે બરાબર વળગી રહે એ રીતે તેમજ પગ ધૂંટણુમાંથા વળે નહીં તે રીતે ધડને ઉપાડવું. સુતેલી સ્થિતિમાંથા પ્રથમ માથું, પછી ખસા-એમ ધીરે ધીરે આખી પીઠ જમીનથી અલગ કરવાની છે. સુતેલી અવસ્થામાં શ્વાસ લેવો અને મેડાં થતાં થતાં શ્વાસ કાઢવો.

આ ચારે કસરતોથી પેટના સ્નાયુઓને યોગ્ય

ન્યાયામ મળે છે અને એથી પેટને માટે એ ધણી સારી છે.

કમરની કસરતો

પહેલી કસરતઃ સીધા, ટદાર જિલા રહીને કમરમાંથી આગળની બાજુએ નમણું અને બંને હાથનાં આંગળાં સીધાં રાખીને, પગને ધૂંટણુમાંથા જરાયે વાળ્યા વિના પગના આંગળાં તરફ લઈ જવાં. આવી રીતે કમર વાળવાથી હાથનાં આંગળાં ધૂંટી સુધો તો જરૂર પહોંચશે, અને ધીમે ધીમે ટેવ પડશે એટલે કમર વધારે વળશે અને હાથનાં આંગળાં પગના પાનીને અડકશે. આમ જ છેવટે હાથનાં આંગળાં પગની આગળની જમીનને પણ અડી શકશે. (ચિત્રાંકન=૭)

આ રીતે આંગળાં નીચેની બાજુએ લઈ જવાનો પ્રયાસ કર્યા પછી ધીમે ધીમે સીધા થઈને ટદાર જિલા રહેલું અને પછી કમરમાંથી બની શકે તેટલા પાછળની બાજુએ વળણું. ટેવ પાડવાથી કમર ધણી વાળી શકશે. જુદાનો તો કમરમાંથી પાછા વળાને કમાન પણ કરી શકશે. મોટી વયનાં જીસી-પુરુષોએ ધૂંટણુમાંથા જરાયે વાળ્યા વિના આગળ-પાછળ વારંવાર વળણું.

બીજી કસરત : પગ બરાબર સ્થિર રાખીને ધડને (કમરથી ઉપરના લાગને) કમરમાંથા ડાખી બાજુએ વાળણું. આમ ડાખી બાજુએ વાળતી વેળાએ જમણું હાથ જમણું પડખાને અડેલો જ રહે એ ધ્યાનમાં રાખવું. આમ એક વાર ડાખી બાજુએ વાળવાની કિયા કર્યા પછી એ જ પ્રમાણે જમણી બાજુએ વળણું.

નાંગ અને પગની કસરતો

પહેલી કસરત : ટદાર જિલા રહીને હાથ કમરે મૂકવા અને પછી જમણું પગ પર જિલા રહીને આખો ડાઢો પગ (નાંગ, નીચલો પગ વગેરે) ડાખી બાજુએ બની શકે એટલો જાંચો કરવો. આ

કસરત અંચકથી ન કરવી. ડાખે પગ પાછો જમીન પર મૂકીને, તે પગ પર જિલા રહીને પછો જમણું પગ જમણું બાજુએ લઈ જવો. આમ વારાકૃતી બંને પગ લઈ જવા અને મૂકવા.

બીજુ કસરત : ઉપર પ્રમાણે જ જમણા પગ પર જિલા રહીને ડાખે પગ જરા યે વાળ્યા વિના શરીરના આગળના ભાગમાં બની શકે એટલો ઊંચો લઈ જવો. પછો તે પગને નીચે જમીન પર મૂકીને જમણું પગને આગળની તરફ જાંચે લઈ જવો. આમ વારાકૃતી બંને પગ લઈ જરા અને મૂકવા. (ચિત્રાંક-૮)

ત્રીજુ કસરત : સીધા જિલા રહીને જમણું પગ પર સ્થિર થયું અને પછો ડાખે પગ ધૂંટણું માંથા વાળીને, ઊંચે લાવીને છેક પેટની સાથે દણાવવો. આ કસરત જરાય અધરી નથો. એક વાર ડાખા પગે આ કિંધા કરીને પછો તરત જ જમણા પગથા એ પ્રમાણે કરવું.

ચોથા કસરત : સીધા જિલા રહીને જમણું પગ પર સ્થિર થયું. અને ગંધી ડાખે પગ ધૂંટણું માંથા પાછળ વાળીને ડાખે હાથે પગની પાની પકડવી. એક જ પગ પર જિલા રહીને એ પાની નેટલી બની શકે એટલી જાંચી કરવી. ધીમે ધીમે દૃવ પડશે એટલે પગની પાની લગભગ કમર સુધી જાંચી લઈ શકાશે. ડાખા પગે આ રીતે કર્યા પછી એ જ રીતે જમણું પગે કરવું અને એમ વારાકૃતી બંને પગ વાળવા અને મૂકવા.

આ કસરતથી પગના બધા ભાગોને કસરત મળે છે.

ઘડકની કસરત અથવા ઊડ બેસ

ટદાર જિલા રહીને હાથની મુઢીઓ વાળવી. પછી પગનાં આંગળાંનાં ટેરવાં પર જાંચા થઈને ધૂંટણું વાળવા અને લગભગ નીચે બેસવું. આમ

કરવાથી બન્ને નિતંબ પગની એડીના પાછલા ભાગને અડકશે. આમ નીચે બેડા પછી તરત જ જિલા થથી જવું અને એ રીતે જગ અડપથી ઊડ બેસ કરવી. મુઢી વાળેલા હાથ ડોણીમાંથા વાળીને કુદરતી રીતે હાલવા દેવા તં ઉપયોગી નીવડશે. આ પ્રમાણેની બેડક અથવા કેટલાક કષે છે તેમ ઊડ બેસ આડ-દશ વાર કે એથાયે બધારે વાર કરવામાં કાંઈ વાંધો નથો. (ચિત્રાંક-૯)

ધૂંટીની કસરતો

પહેલી કસરત : પગનાં આંગળાનાં ટેરવાં પર જાંચા થયું અને પગની પાની જમીન પર મૂકવા. આમ આડથી દશ વાર કરવું.

બીજુ કસરત : એક પગ પર સ્થિર જિલા રહીને બીજી પગની પાનીને ધૂંટીમાંથા જાંચી-નીચી કરવી. પછો તેવી જ રીતે બીજી પગની પણ કસરત કરવી. આમ આડથી દશ વાર કરવું.

વિશેષ પ્રકારની કસરતો

જે કસરતો દરરોજ ૧૦ થી ૧૫ મિનિટમાં કરી શકાય એવી કેટલીક કસરતો આપણે ઉપર નેઈ. બીજુ પણ કેટલીક સ.રી કસરતો છે અને એવી કસરતો-દોરકું દૂદવાની (સ્કિપિંગ), સ્થળાન્તર કર્યા વિના દોડવાની (સ્ટેશનરી રનિંગ), દંડ, શર્પાસનની અને આંખના તેળા ઝેરવવાની વગેરે કસરતો શરીરને ઉત્તમ પ્રકારનો વ્યાયામ આપે છે. એ કસરતોનો સમાવેશ હળવી કસરતોમાં પણ કરી શકાય તેમ છે. એમાંથા કેટલી અને કઈ કસરતોને 'હળવો કસરતો' માં ઉમેરી લેવા તે કસરતો કરનારે જીતે જ નક્કી કરવાનું છે. અહોં એ 'વિશેષ પ્રકારની કસરતો' આપી છે.

આંખના ડોળાની કસરતો

ટદાર જિલા રહેલું, અગર ખુરશી પર ટદાર બેસવું. માથાને સ્થિર રાખવું. બંને આંખોની

નજુર સીમાં, સામે રાખવી. પણ માથું જરા પણ હાલે નહીં તેમ સ્થિર રાખીને બંને ડાળાથી ડાળી બાજુએ જોવાય તે રીતે ડાળા ફેરવવા. ખૂબ સાવચેતી રાખવી કે ડાળા ડાભી બાજુએ જન્ય ત્યારે માથું ડાળી બાજુએ ફેરવવાનું નથો. ડાળા જેટલા જેંચી શકાય તેટલા જેંચવા. પછી એવી જ રીતે ડાળા જમણી બાજુએ, ઉપર તેમજ નીચે ફેરવવા. જે વિદ્યાર્થીઓ કે માણુસોને ખૂબ લખવા-વાંચવાનું હોય છે તેમને ડાળાની આ કસરતોથી ખૂબ લાભ થાય છે.

ડાળાને ગોળાકારમાં ચક્કર ફેરવવાની કસરત

ઉપર પ્રમાણે માધાને સ્થિર રાંખીને બંને ડાળા ઉપરની બાજુએ લઈ જઈને તરત જ જમણી તરફ, નીચે અને છેવટે ડાળા ખુણામાં લઈ જવાની એવ પાડવાથી ડાળા આવી રીતે ગોળાકારમાં ફરશે. ઘડિયાળથી જાંબી રીતે એટલે કે ઉપર, ડાળો તરફ, નીચે અને પછી જમણી તરફ ફેરવવાથી પણ સરખો જ લાભ થશે. આ કસરત જ થી આડવાર કરવી.

દોરડાં કૂદ (રિક્પિંગ)ની કસરત

આ કસરત વિદેશી છે. જુવાન શ્રી-પુરુષો માટે આ કસરત સારી છે. આ કસરત માટે દોરડાં વેચાતાં મળે છે. એવું દોરડું અથવા બીજું ડોર્ડ પણ દોરડું ચાલી શકશે. ખલાની બંને બાજુએ બંને હાથમાં દોરડું પકડયું હોય તા તેનો વચ્ચે લાગ જમાનથી જરા જિંચો રહે તેટલું લાંખું એ દોરડું હોવું જોઈએ.

કસરતની રીત સહેલી છે. બંને હાથમાં દોરડું પકડીને માથા પરથી પાણી લઈ જઈને આંચકા સાથે આગળ લાવીએ ત્યારે એ દોરડું પગને અડકવા જન્ય તે પહેલાં કસરત કરનારે જમીન પરથી અધ્યર થોડો જ કૂદકો મારીને દોરડાને

પસાર થઈ જવા હેવું. આવી રીતે દોરડાને સતત ફેરવવાની કિયા કર્યા જ કરવાની છે.

એકાડુ માણુસોને માટે આ ‘દોરડાં કૂદ’ ની કસરત બહુ સારી કસરત છે.

ચાલવાની અને ઢોડવાની કસરત

એક સામાન્ય માન્યતા એવી છે કે જે ને આપણે ધીમે ધીમે એક માઈલ જેટલું ચાલીએ તો તેનાથી પૂરતી કસરત મળી રહે છે. આ માન્યતા અતિ-જુદ્ધોને માટે સાચી છે અથવા જેમનું હુદ્દ્ય નથીનું હોય તેમને માટે પણ સારી છે. બાકી તો ફરવામાં પણ છાતી ટટાર રાખવી જોઈએ, શક્તિના પ્રમાણુમાં ઝડપથી ચાલવું જોઈએ અને હાથ બગાળ હલાવવા જોઈએ. ચાલતી વખતે વાતો કરવી ઈષ્ટ નથો. ચાલતી વખતે જરા જિંડા શ્વાસ લીધા હોય તો તે લાલકારક છે.

જુવાનો તથા મધ્યમ વધના માણુસો માટે ધામેથા ઢોડવાની કસરત બહુ સારી છે. ઢોડતી વખતે પણ શરીર સીધું અને ટટાર રાખવું, છાતી આગળ રાખવી અને હાથના મુફ્તીઓ વાળાને કુદરતી રીતે હલાવવી. બંને મુફ્તીઓને શરીરની બાજુમાં સ્થિર રાખવાનો રીત સારી નથો. સાધારણ રીતે ઢોડવાને કારણે શ્વાસ જિંડા લેવા પડશે. પણ ખૂબ જોરથી શ્વાસ લેવા પડે તેટલી ઝડપથી ચાલવાની કે તેટલું દૂર ઢોડવાના કિયા અયોગ્ય અને અસ્થાને છે. આપણી કસરતો હળવી હોવી જોઈએ.

સ્થળાન્તર કર્યા વિના ઢોડવાની કસરત

ધરની અંદર અગાસીમાં કે ઓટલા પર આ કસરત કરી શકાય છે. ઢોડવાની કિયામાં માણુસને એક સ્થળેથી બીજે સ્થળે જયું પડે છે. પણ એમ સ્થળ બદલ્યા સિવાય, એકની એક જગ્યાએ રહીને

એક પછી ખીંચે ખગ ઉપાડીને મેદાન પર કે રસ્તા પર દોડતા હાઈએ તે રીતે, બધી કિયાઓ કરવી એ ‘સ્થળાન્તર કર્યા વિના દોડવાની’-સ્ટેશનરી રનિંગની-કસરત ફહેવાય છે.

આ કસરત વય અને શક્તિના પ્રમાણુમાં અડપથી કરી શકાય છે અને ધીમેથા થઈ શકે છે.

આ ઉપરાંત કેટલાંક સરળ આસનો અને ઉપરોક્ત જૂઘેામાં ખીજુ સરળ કસરતો શોધો જરૂરિયાત પ્રમાણે તે કરવાથી શરીર તંદુરસ્ત રહેશે એ નિર્વિંવાદ છે.

(ડૉ. સુમંત ભણેતાના લેખના આધારે)



૧૩. પેટની ભાવિશોષ કસ્ટેટો

મનુષ્યની પાચનશક્તિ સારી હોય તો જ શરીરની તંડુરસ્તી સારી રહે છે અને પાચનશક્તિ સારી રહેવા માટે પેટના બધા સનાયુઓ મજબૂત હેવાની આવસ્થકતા છે. પાચન સારી રીતે થાય તો જ તે માણુસની માનસિક શક્તિઓ સારી સ્થિતિમાં રહે છે, મનમાં સારા વિચારો ઉદ્ઘસ્ત છે અને મનુષ્ય આશાવાદી બને છે તનની અને મનતી સ્થિતિ સારી હોય તો જ મનુષ્ય પરોપકારનાં કાર્યો કરવા માટે તૈયાર થાય છે.

વેદકાળથી મનુષ્યના આયુષ્યની ભર્યાદા સો વર્ષની માનવામાં આવે છે. પણ આપણા દેશની હાલની સ્થિતિ જોઈએ છીએ તો સો વર્ષની ઉંમરનો મનુષ્ય જોવામાં આવતો નથી. ઉલ્લદુંતણું વયમાં જ ધણા લોડાને આ મૃત્યુલોકની યાત્રા પૂરી કરવી પડે છે. અકાલ મૃત્યુનું કારણ શું? તેનો બારીકાધથી વિચાર કરીશું તો એવું જણાઈ આવશે કે તેનું મુખ્ય કારણ બગડેલી પાચનક્રિયા જ છે. પાચનક્રિયા બગડવાથી અનેક વ્યાધિઓને આમંત્રણ આપવા જેવું થાય છે અને તેના પરિણામે જ અનેક પ્રકારના રોગો થવા માટે શરીરમાં અનુકૂલ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેથી પાચનક્રિયા સુધારવા માટે કયા ઉપાયો યોજવા જોઈએ તે બાબતનો વિચાર કરવો જોઈએ.

ડૉક્ટર અગર વૈદના ધેર લોડા દવા લેવા માટે જય છે. તેમને અનેક પ્રકારના જુદા જુદા રોગો થયેલા હોય છે. તેને માટે અનેક પ્રકારની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓથી રોગનાં બાબ્ધ લક્ષણો ભટે છે, પણ તે રોગનું ભૂળ દૂર થતું નથી. કાયમનો આરામ થતો નથી. કાયમનો આરામ થાય તે માટે પાચનશક્તિ સુધારવી જોઈએ.

પાચનક્રિયા સુધારવા માટે જોરાકની બાબતમાં ધણી કાળજી રાખવી જોઈએ. ખાદીલા અન્નતું પૃથક્કરણું થઈ તેમાથી કોઈ બનવાતી કિયા જેટમાં થાય છે; અને તે કામ માટે શક્તિનો વ્યય થાય છે. જેટની શક્તિ જોઈ તેના પ્રમાણુમાં તેની પાસેથી કામ લેવું જોઈએ. જરૂરાળિના પ્રમાણુમાં જ પેટમાં અન્ન નાંખવું જોઈએ. પ્રમાણ કરતાં વધારે અન્નતું સેવન કરવાથી પચનેન્દ્રિયો અશક્ત થઈ જય છે. આ પ્રમાણે ધણા દિવસ સુધી ચાલે તો પાચનક્રિયા તદ્દન બગડી જય છે. માટે માઇક્રો અન્ન લેવાની ટેવ પાડવી જોઈએ. તળેલા અને મસાલેદાર પદાર્થો પચવામાં આવે હોય છે. અને તેથી આવા પદાર્થેનું સેવન બને તેટલું એછું કરવું. આવા પદાર્થેને પાચન થવાને ધણો વખત લાગે છે અને ડેટ્લીક વખતે એવા પદાર્થો પાચન થયા વગર જેટમાં રહે છે. પરિણામે પિતના અને વાયુના વિકાર ઉદ્ઘસ્ત છે. આવા જડ પદાર્થેનું સેવન કરવાથી પાચનક્રિયાને વધારે શ્રમ પડે છે. પ્રમાણુમાં શરીરને પોષણ મળતું નથી.

ઝા, ડેશી, ખાડી, દાર વગેરે પદાર્થો પાચનક્રિયા ખરાબ કરનારા છે. આ પદાર્થેથી શરીરને પોષણ બિલકુલ મળતું નથી. આ પદાર્થો શરીરની કિયાને તાત્કાલિક ઉત્તેજે છે કે જેથી આ પદાર્થેનું સેવન કરવા તરફ લોડા વધુ આકર્ષય છે. મગજનું કામ કરનારા લોડાને આવા પદાર્થેનું સેવન કરવાથી થોડા સમય માટે સ્કૂર્ટી આવે છે અને તેથી આવા પદાર્થેનું સેવન કરવું જોઈએ એવા ભામક જ્યાલમાં લોડા રાયે છે.

તૃષા લાગે તો તેની શાંતિ ચોખ્યું પાણી પાંને જ કરવી જોઈએ. તે માટે કૃત્રિમ પેયેની જરૂર નથી.

પાણી પીવાથી પાચનક્રિયાને મદદ મળે છે. જમતાં પહેલાં અધો કલાક અગાઉ પાણી પીવાથી અનનતું પાચન સારું થાય છે. જમતી વખતે પાણી પીવામાં હરકત નથી, પણ અન્નને ચાવતી વખતે પાણી પીવું નહીં. જમતી વખતે બિલકુલ પાણી ન પીતાં પછી ૧ કલાકને અંતરે પાણી પીવાથી પણ ધજો કૃપદો છે.


નેની પાચનશક્તિ બાળકેલી હોય તેણે રોજ સવારે દૂંઠીની જમણી બાજુથી ડાખી બાજુ તરફ મોટા આંતરડાને માલીસ કરવી અને સવારે ઉઠતાં પહેલાં અધો કલાક જિધા સૂઈ રહેવું; એટલે દ્વિતી સાંજ થવામાં મદદરૂપ થશે. નાના જાળકોને આવી રીતે સુંલેલા આપણે જોઈએ છીએ; તેનું કારણ પણ કુદરત તેમને તે પ્રમાણે કરવાની પ્રેરણા આપે છે.

હાથપગના સ્નાયુઓ મજબૂત કરવા માટે નેમ તે સ્નાયુઓને વ્યાયામ આપવાની જરૂર છે, તે જ પ્રમાણે પાચનશક્તિ સારી રાખવા માટે પેટના સ્નાયુઓને કસરત આપવાની આવશ્યકતા છે. પેટની અંદરના સ્નાયુઓનો રોજના જાલ્ય કામોમાં ઉપયોગ થતો નથી; તેથા તે સ્નાયુઓ મજબૂત કરવા

તરફ લોડેનું ધ્યાન જેંયાતું નથી. અહીં ચેટને વ્યાયામ મળે તેવી કેટલીક સાવશેષ કસરતો આપી છે.

૧. ભૂનમન : બે મિટર લાંખી એક શેરંજી અગર અનુરૂપ પાથરણું લઈ જમીન ઉપર પાથરવું. પછી તેના ઉપર ચિત્રાંક-૧ પ્રમાણે ઉલયા પગ વાળા બેસવું. ગોઠણ એકખીજને અડાડી રાખવા. બન્ને હાથ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, સાંથળના બન્ને બાજુએ જમીન ઉપર મૂકવા અને છાતીનો ભાગ આગળ પડતો રાખી ટટાર બેસવું. પછી પૂર્ણ શાસ લઈ ધીમે ધીમે કમરમાંથી આગળની બાજુએ નમનું અને છાતીનો ભાગ સાથળને અડકાડવો. અને નાક જમીન ઉપર ટેકવવું. આ વખતે હાથ ડોણીમાંથી વાંકા વાળી રાખવા. શરીરનો પાણણનો ભાગ ઉંચો ન થાય તેની કાળજી રાખવી. પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવું. ઉપર ઉઠતી વખતે શ્વાસ ધીમે ધીમે છોડવો. ફરી ફરી આ ક્રિયા કરવી.

૨. ભૂનમન-૨ : કસરત એક પ્રમાણે બેઠક લેવી પણ બન્ને હાથ જમીન ઉપર ન મૂકતાં



પેટની કસરતો

ચિત્રાંક-૨ માં બતાવ્યા પ્રમાણે ડેડ ઉપર મૂકી, જમણ્ણા હાથનો પંને ડાણા હાથના પંજથી પકડવો. પછી પૂર્ણ શ્વાસ લઈ કમરમાંથી ધીમે ધીમે આગળ નમવું અને છાતી સાથળને અડકાડવી અને નાક જમીન ઉપર ટેકવવું. પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવું. ઉડતી વખતે શ્વાસ છોડવો.

૩. દૂરપાંચ ભૂનમન : ચિત્રાંક-૩ પ્રમાણે પગ એકખીનથી અને તેટલા દૂર રાખી પાથરણા ઉપર બેસવું. બન્ને પગ ગૂંઠણુમાંથી ટટાર રાખવા. પછી પગ ટટાર રહે તે રીતે કમરમાંથી નમી નાક જમીનને અડકાડવાનો પ્રયત્ન કરવો. નાક જમીનને એકદમ અડકાડી શકાશે નહીં; પણ મહાવરાથી થોડા દિવસ પછી નાક જમીનને અડકાડી શકાશે. પછી મૂળ સ્થિતિમાં આવવું.

૪. બાજુપાંચ ભૂનમન : ચિત્રાંક-૪ માં બતાવ્યા પ્રમાણે જમણ્ણા પગ જમણ્ણી બાજુએ ડાખી સાથળ સાથે કાટખૂણેણે થાય તે પ્રમાણે બાજુએ કાઢવો. પગ ગૂંઠણુમાંથી ટટાર રાખવા. પછી તે પગ મૂળ સ્થિતિમાં પાછો મૂકવો. આજ પ્રકારની કિયા ડાખી બાજુ કરવી.

૫. એકપાદ પશ્ચિમતાન : કસરત ચાર પ્રમાણે પગ બાંજુ પર લાંબો કર્યા પછી જમીન ઉપર મૂકેલા હાથ જીયકવા અને જમણ્ણી બાજુ વળી ચિત્રાંક-૫ પ્રમાણે જમણ્ણી તરફ શરીર દેરવી બન્ને હાથ પગના પંજ તરફ લઈ જવા અને માયું ગૂંઠણુને અડકાડવું. પછી મૂળ સ્થિતિમાં આવવું. આજ પ્રકારની કિયા ડાખી બાજુએ કરવી. છ વખતે આ કિયા કરવી. નીચે નમતી વખતે શ્વાસ લેવો અને ઉપર ઉડતી વખતે શ્વાસ છોડવો.

૬. એકક કમરમોડ : પગ પહોળા રાખી બેસવું. જમણ્ણા હાથ ખલાને સમાંતર પહોળા રાખી જમણ્ણી બાજુએ કમરમાંથી ચિત્રાંક-૬ માં બતાવ્યા સુજથ ધીમે ધીમે ફરવું. ડાખો હાથ

ડોણીમથી છાતીને સમાંતર વાળવો. એ જ રીતે ડાખો હાથ ખલાને સમાંતર પહોળા રાખી, ડાખી જાજુએ કમરમાંથી ઇરી જમણ્ણા હાથ ડોણીમાંથી છાતીને સમાંતર વાળવો. આ કિયા સતત ચાલુ રાખવી.

૭. ખડે કમરમોડ : પગ પહોળા રાખી જિલા રહેવું. એ પગ વચ્ચે દોઢ ફૂટનું અંતર રાખવું. પછી બન્ને હાથ છાતી સામે ખલાની લાઈનમાં ચિત્રાંક-૭ પ્રમાણે સીધા રાખવા. બન્ને હાથ તે જ સ્થિતિમાં ટટાર રાખી જમણ્ણી તરફ કમર ઉપરનું શરીર દેરવવું. એટલે સુધી દેરવવું ડેપી પાછળની વસ્તુ આપણે જોઈ શકીએ. ફરતી વખતે જ શ્વાસ જેટલો એંચવો. પછી મૂળ સ્થિતિમાં આવતી વખતે ધીમે ધીમે શ્વાસ છોડવો. આવી જ કિયા ડાખી તરફ કરવી. થાક લાગે ત્થાં સુધી આ કિયા ચાલુ રાખવી.

૮. બાજુ ઝૂક : એ પગ વચ્ચે જરૂર જેટલું અંતર રાખી પગ પહોળા કરી જિલા રહ્યા પછી બન્ને હાથ માયાની ઉપર લઈ જવા. પછી દીર્ઘ-શ્વાસ લઈ પ્રથમ જમણ્ણી બાજુ નમી જમણ્ણા પગ પાસે જમણ્ણા હાથ ચિત્રાંક-૮ પ્રમાણે મૂકવો અને ડાખો હાથ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઉપરની બાજુ ટટાર રાખવા. પછી મૂળ સ્થિતિમાં આવવું. આજ કિયા ડાખી તરફ કરવી.

૯. આગે પીछે ઝૂક : માથા ઉપર હાથ જોયા રાખી જિલા રહેવું. પછી કમરમાંથી આગળ નમી ચિત્રાંક-૧૦ પ્રમાણે માયું એ પગની વચ્ચે લાવવું અને હાથ જમીન પાસે લઈ જવા. જમીનને હાથ એટલે હાથ જમીન ઉપર ન મૂકતાં બન્ને પગની વચ્ચેથી પાછળની બાજુએ લઈ જવા. ઉપરની કિયા કરતી વખતે બન્ને પગ ગૂંઠણુમાંથી ટટાર રાખવા. પછી સીધા જિલા રધી ચિત્રાંક-૧૧ પ્રમાણે શરીર કમરમાંથી પાછળની બાજુએ નમાવવું. પાછા મૂળ સ્થિતિમાં આવવું.

૧૦. શયન પાંચસ્પશ્ચ : જમીન ઉપર ચત્તા સુઈ જવું. બન્ને હાથ બાજુએ સીધા રાખવા. પછી દીધ્ય થાસ લઈ ડાબો. પગ અને જમણો હાથ ચિત્રાંક-૧૨ પ્રમાણે ઉપર લાવવા અને હાથથી પગને સ્પશ્ચ કરવો. પછી હાથ અને પગ મૂળ સ્થિતિમાં નીચે લાવવા. પછી જમણો પગ અને ડાબો હાથ ઉપર જિયકી હાથથી પગને સ્પશ્ચ કરવો. એ પ્રમાણે કરતી વખતે પગ ગૂંઠણમાંથી ટટાર રાખવો.

૧૧. પેટ રોલ્ડીંગ : પેટ ઉપર સૂવું. પછી બન્ને પગ ગૂંઠણમાંથી વાળી પાછળની બાજુથી ઉપર આણવા અને તેની ઘૂંટી ચિત્રાંક-૧૩માં બતાવ્યા પ્રમાણે હાથથી પકડવી. આ કિયા કરતી વખતે છાતી અને ગર્દન એટલી ઉપર જિયકવી કે શરીરનો આકાર ધનુષ જેવો થાય. પછી ચિત્રાંક ૧૪ પ્રમાણે ડાખી બાજુએ શરીર લઈ જવું. પાણ મૂળ સ્થિતિમાં આવી શરીર જમણી બાજુએ નમાવવું. આ કિયા કરતી વખતે શરીરને આંચકા મારવા નહીં. આ પ્રમાણે છ વખત કરવું.

૧૨. પીઠ રોલ્ડીંગ : જમીન ઉપર ચત્તા સૂવું. પછી બન્ને પગ ગૂંઠણમાંથી વાંકા કરી પેટ ઉપર આણવા અને બન્ને પગને ચિત્રાંક-૧૫ માં બતાવ્યા પ્રમાણે હાથથી પકડવા. એ વખતે શરીરનો પૃષ્ઠ લાગ જમીનથી જાંચો રાખવો. પછી હાથ છોડ્યા વગર ચિત્રાંક-૧૬ પ્રમાણે બેસવું. પછી જમીન ઉપર મૂળ સ્થિતિ પ્રમાણે પડવું. આ પ્રમાણે આઠ વખત કરવું.

૧૩. શયન પશ્ચિમતાન : ચત્તા સૂવું. બન્ને હાથ માથાની પાછળ લાંણા કરી રાખવા. પછી બન્ને પગ ગૂંઠણમાંથી ટટાર રાખી, શરીરને આંચકો માર્યા વગર બેસતા થવું. પછી કમરમાંથી આગળ નમી ચિત્રાંક-૧૭ પ્રમાણે બન્ને હાથથી પગ પકડવા. પછો વધારે નીચે નમી માથું ગૂંઠણને અડકાડવા પ્રયત્ન કરવો. આ કિયા કરતી વખતે પગ ગૂંઠણમાંથી વળે નહીં તેની કાળજ રાખવી. પછી મૂળ

સ્થિતિમાં આવવું. ૮ થી ૧૦ વખત આ કિયા કરવી. ઉક્તી વખતે થાસ છોડવો.


૧૪. હલાસન : ચત્તા સૂવું. હાથ શરીરની બાજુએ લાંણા રાખવા. પછી બન્ને પગ ગૂંઠણમાંથી ટટાર રાખી ઉપર જિયકવા અને ચિત્રાંક-૧૮ પ્રમાણે માથાની પાછળની બાજુએ જમીનને અડકાડી રાખવા. પછી ફરી પગ જિયકી મૂળ જગ્યાએ લાવવા. આ પ્રમાણે ૮ થી ૧૦ વખત કિયા કરવી.

૧૫. કમર હાથ ધાણી : ચિત્રાંક-૧૯ માં બતાવ્યા પ્રમાણે બન્ને પગ છૂટા રાખી જિબા રહેવું. કમર ઉપર હાથ મૂકવા. પછી કમરમાંથી પાછળ નમલું અને જમણી બાજુથી ડાખી બાજુ તરફ કમરનો ઉપરનો લાગ ગોળાકાર ફેરવવો. આ પ્રમાણે ૪ થી ૬ વખત શરીર ફેરવવું અને પછી અવળી દિશામાં ફેરવવું. શરીર પાછળની બાજુએ જય તે વખતે શ્વાસ લેવો અને શરીર આગળની બાજુએ આવે ત્યારે થાસ છોડવો.

૧૬. ગર્દન હાથ ધાણી : ચિત્રાંક-૧૯ માં બતાવ્યા પ્રમાણે પગ રાખી જિબા રહેવું; પણ આ વખતે બન્ને હાથ ગર્દનની પાછળ અદળ પ્રમાણે રાખવા. પછી કમર ઉપરનો શરીરનો લાગ પાછળ નમાવી જમણી બાજુથી ડાખી તરફ ગોળાકાર ફેરવવો. ૫ થી ૬ વખત આ કિયા કર્યા પછી ડાખી બાજુથી જમણી તરફ શરીર ગોળાકાર ફેરવવું.

૧૭. જાંચે હાથ ધાણી : ચિત્રાંક-૨૦ માં બતાવ્યા પ્રમાણે પગ રાખી જિબા રહેવું તથા હાથ માથા ઉપર જાંચો રાખવા. પછી તે પ્રમાણે હાથ રાખી કમર ઉપરનું શરીર જમણી બાજુથી ડાખી તરફ અને ડાખી બાજુથી જમણી તરફ ૪ થી ૬ વખત ગોળાકાર ફેરવવું. પીડને વાળવી નહીં.

૧૮. એકપાંચ ધાણી : ચિત્રાંક-૨૧ પ્રમાણે એક પગ ઉપર જિબા રહી, સમતોલન સાચવવા માટે ખીંચે પગ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જાંચો કરવો. પછી કમરમાંથી પાછળની બાજુએ નમી બન્ને હાથ



ચેટની કસરતો

માથા ઉપર લાંબા રાખવા. પછી કમર ઉપરનો લાગ જમણી બાજુથી ડાખી બાજુએ ગોળાકાર ફેરવવો.

૧૯. દંડ વિરુદ્ધ શાયન : ચિત્રાંક-૨૨ માં

બતાવ્યા પ્રમાણે એક માણુસે કમર ઉપર હાથ મૂકી અને પગ લાંબા કરી બેસલું અને ખીંજ માણુસે તેના પગ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પકડી અને ગૂંઠણ જમીન ઉપર મૂકી અદ્દર રહેવું. પછી બેઠેલા

માણુસે પાછળની બાજુએ ચંતા સ્વર્દ જવું. તે જ વખતે ગૂંઠણું પર આડા પડેલા માણુસે હાથ ડોણીમાંથી વાંકા કરી શરીરને દંડ કાઢવા માટે નીચે લઈ જવું. સ્ત્રોતા માણુસે બેઠા થઈ પૂર્વ-સ્થિતિમાં આવવું. તે વખતે દંડ કાઢનાર માણુસે ડોણીમાંથી હાથ ટટાર કરી મૂળ સ્થિતિમાં આવવું. પાછળ સૂતી વખતે શ્વાસ લેવો અને બેસતી વખતે શ્વાસ છોડવો. દંડ કાઢવા માટે નીચે નમતી વખતે શ્વાસ લેવો અને દંડ કાઢી ઉકૃતી વખતે શ્વાસ છોડવો. આ પ્રમાણે ૮ થી ૧૦ વખત કરવું. પછી બુન્નેએ જવ્યાઓ બદલવી અને ઇરી ઉપર પ્રમાણે કિયા કરવી.

૨૦. દંડ વિરુદ્ધ શયન-૨ : આ કસરત આગળની ૧૬મી કસરત નેવી જ છે, પણ બેઠેલી વ્યક્તિએ પોતાનાહાથ ગર્દન પાછળ અદળની સ્થિતિમાં રાખવા અને સામેની વ્યક્તિએ ગૂંઠણું જમીન ઉપર ન મૂકૃતાં અદ્ધર રાખવા (ચિત્રાંક-૨૩). એક સૂઈ જઈ એઠા થવાનું છે અને ખીજણે દંડ કાઢવાના છે.

૨૧. દંડ વિરુદ્ધ શયન-૩ : આ કસરત ઉપરના નેવી જ છે. આમાં છતા સ્વર્દ જનારે બુન્ને હાથ માથાની પાછળ લાંબા કરી રાખવાના છે, અને દંડ કાઢનારે એક પગ અદ્ધર રાખી (બિલો રાખી) દંડ કાઢવાનો છે. (ચિત્રાંક-૨૪)

૨૨. ઐંચાએંચી : બે જણ્ણાએ સામસામા ઐસી એકખીજના પગને પગ આડાડી અને એકખીજના હાથ પકડી બેસવું (ચિત્રાંક-૨૫). પછી બેસનાર પેકી એક વ્યક્તિએ શરીરને પાછળ નાંખી સામેના નેડીદારને પોતાની તરફ ધીમે ધીમે ઐંચવો. ઐંચનારે થોડું જેર કરી ઐંચનારો પ્રતિકાર કરવો પણ ધીમે ધીમે આગળ (ઐંચનાર) તરફ નમવું. શરીર પાછળ જય ત્યારે શ્વાસ લેવો અને શરીર આગળ નમે ત્યારે શ્વાસ છોડવો. આ જ કિયા પછી નેડીદારે કરવી. આ પ્રમાણે વારાફરતી ૫ થી ૬ વખત આ કિયા કરવી.

૨૩. સરળ હાથ મોાડ : બન્ને પગ વચ્ચે અંતર રાખી અને બન્ને હાથ શરીરની બાજુએ લટકતા રાખી બિલા રહેવું (ચિત્રાંક-૨૬). બન્ને હાથની સુકૂંઓ વાળેલી રાખવી. પછી કમર નીચેનો ભાગ સ્થિર રાખી ઉપરનું શરીર બને એટલું ડાખી બાજુએ દેરવાનું. શરીર ડાખી બાજુએ દેરવતી વખતે શ્વાસ લેવો અને શરીર મૂળ સ્થિતિમાં આણું વખતે શ્વાસ છોડવો. આવી જ કિયા જમણી બાજુએ કરવી. આ પ્રમાણેની કિયા ૧૦ થી ૧૨ વખત કરવી.

૨૪. બાજુ હાથ મોાડ : બન્ને પગ વચ્ચે અંતર રાખી બન્ને હાથ ખલાને સમાંતર પહોળા કરી બિલા રહેવું. પછી આજ સ્થિતિમાં કમર ઉપરનું શરીર ડાખી તરફ દેરવાનું. શરીર દેરવતી વખતે શ્વાસ લેવો અને મૂળ સ્થિતિમાં આણું વખતે શ્વાસ છોડવો. આજ કિયા જમણી તરફ પણ કરવી. ૧૦ થી ૧૨ વખત આ કિયા કરવી (ચિત્રાંક ૨૭-૨૮).

૨૫. તીરછે ઝૂક : આગળની કસરત-૨૪માં બતાવ્યા પ્રમાણે ડાખી બાજુએ ઇરી પછી શરીરને તે સ્થિતિમાં રાખી કમરમાંથી નમી જમણો. હાથ જમણને અડકાડવો (ચિત્રાંક-૨૯). મૂળ સ્થિતિમાં આવ્યા પછી આજ કિયા જમણી તરફ કરવી અને ડાખો. હાથ જમણને અડકાડવો (ચિત્રાંક-૩૦).

૨૬. તીરછે મોાડ-બાજુ : ચિત્રાંક-૨૭માં બતાવ્યા પ્રમાણે કમર ઉપરનું શરીર ડાખી બાજુએ દેરવી બિલા રહેવું. પછી શરીર ડાખી બાજુએ નમાવવું (ચિત્રાંક-૩૧). એજ સ્થિતિમાં જમણી બાજુએ શરીર નમાવવું (ચિત્રાંક-૩૧ માં તૂટક રેખા). મૂળ સ્થિતિમાં આવ્યા પછી જમણી તરફ શરીર દેરવી શરીર કમરમાંથી જમણી બાજુએ નમાવવું. પછી ડાખી બાજુએ નમાવવું. આમ બન્ને તરફ આ કિયા ૫ થી ૬ વખત કરવી. આ કિયાએ કરતી વખતે નીચેનો ભાગ સ્થિર રાખી પગ ગૂંઠણમાંથી ટટાર રાખવા.

૨૭. તીરછે મોડ-પીછે : ચિત્રાંક-૨૭ પ્રમાણે કમર ઉપરનું શરીર ડાખી બાજુએ દેરવી જિલા રહેવું. પછી એ જ સ્થિતિમાં શરીર બને એટલું પાછળની બાજુએ નમાવવું (ચિત્રાંક-૩૨) અને મૂળ સ્થિતિમાં આવવું. પછી શરીરને જમણી બાજુએ દેરવવું તથા આજ સ્થિતિમાં શરીર બને તેટલું પાછળની બાજુએ દેરવવું અને આ જ સ્થિતિમાં શરીર બને તેટલું પાછળની બાજુએ નમાવવું. આ પ્રમાણે ૮ થી ૧૦ વખત આ કિયા કરવી.

૨૮. તીરછે મોડ-આગે : ચિત્રાંક-૨૭ પ્રમાણે કમર ઉપરનું શરીર ડાખી બાજુએ દેરવી જિલા રહેવું.

પછી એ જ સ્થિતિમાં શરીર બને એટલું આગળની બાજુએ દેરવવું. આ જ સ્થિતિમાં શરીર બને તેટધું આગળ નમાવવું. ડાખી અને જમણીબાજુ આ પ્રમાણે પથી ૬ વખત આ કિયા કરવી (ચિત્રાંક-૩૩).

૨૯. વિપરીત કરણી : જમીન ઉપર ચતા ચૂઈ જવું. બને હાથ કમર ઉપર રાખવા. પછી બને પગ શરીરને કાટખૂણે ઉપરની તરફ ચિચા કરવા. પછી બને પગને કોસમાં ઉલટાસૂલટી દિશામાં વર્તુળાકારે ગતિ આપી દેરવવા. આ કિયા ૫ થા ૬ વખત કરવી (ચિત્રાંક-૩૪).




૧૪. શાળોપચોગી જિગ્નેસ્ટિક ટેબલ્સ

જિગ્નેસ્ટિક ટેબલ્સ અથવા પી. ટી. ટેબલ્સ અથવા ફૂંક હેન્ડ એક્સસાઇનના નામે આળખાતી આ કસરતો બિનખર્યાળી છે; ખાસ સાધનો કે મોટા મેદાનની તેમાં જરૂર પડતી નથી; ઓછા સમયમાં વર્ગના સર્વ વિદ્યાથી ઓને કસરતનો પૂરો લાભ આપી શકાય છે તથા સર્વ અંગોને સંગીન વ્યાયામ આપી ચુંદર અને ચુંદઠ બનાવી શકાય છે; અને તેથી શાળાઓ તે માટે અત્યંત ઉપયોગી વ્યાયામપ્રવૃત્તિ ગણ્યાય છે. અલણત રમતગમતો અને ઐલફૂંડમાં દોડવા, કૂદવા તથા ઇંક્વાની ને મુક્ત ગતિઓ હોય છે અને તેમાંથી ને નિર્ભેણ આનંદ મળે છે તેવી મુક્ત ગતિઓ કે આનંદની પ્રાપ્તિ આ કસરતો આપી શકતી નથી. તેમ છ્ટાં શરીરની તંદુરસ્તી, સુધોગ્ય ટટારી, બળ, અપણતા (લાધવ) વગેરેના વિકાસમાં આ કસરતોનો ફૂળો અસરકારક છે અને

શાળાઓમાં અત્યંત સરળતાથી તેનું આયોજન થઈ શકે છે.


શાળાઓના શારીરિક શિક્ષણ પાડમાં પ્રારંભિક (Introductory) વિભાગ, કૌશલ્ય શિક્ષણ (Skill learning) વિભાગ તથા રંજક (Recreative) વિભાગ એમ તણું ભાગ હોય છે; તે પૈક્ઝ પ્રારંભિક વિભાગ માટે જિગ્નેસ્ટિક ટેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક વિદ્યાથી દરેક કસરત દરમ્યાન સાચી અને પૂર્ણ ક્રિયા કરે તે માટે વ્યાયમશિક્ષકે યોગ્ય કાળજી અને આગઢ રાખવાં જોઈએ.




ખંડિત વર્ણાકાર



કિરણાકાર



કંતારાકાર



શંકુઆકાર

વિદ્યાર્થી ગોડવણી :

અ સામાન્ય રીતે સંધ્ય વ્યાયામ માટે મેદાન પર વિદ્યાર્થીઓને ને ને વિવિધ રૂચનાઓમાં ગોડવવામાં આવે છે તે પૈકી કોઈ પણ અનુકૂળ રીતે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ગોડવી શકાય છે; જેમ કે-

૧. ચકરાવા નેવા ચક્કરાકારે
૨. એક જ મધ્યબિંદુમાંથા દોરેલા એક અથવા વધારે વત્રુંગાકારે
૩. એક અથવા વધારે અર્ધવત્રુંગાકારે અથવા ખંડિત વત્રુંગાકારે
૪. ઇલાતાં કિરણોની જેમ કિરણાકારે
૫. એ અથવા વધારે કતારમાં કતારાકારે
૬. નિકોણ અથવા શાંકુ આકારે

બ આ પછી દરેક વિદ્યાર્થી વચ્ચે આગળ, પાણી તથા બાજુએ પૂરતું અંતર હેઠળ તે જરૂરી છે. હાથ આગળ, પાણી કે બાજુ પર વિનાવરોધ લંબાવી શકાય તેના કરતાં થોડું વધારે અંતર રાખતું જોઈએ. સામાન્ય રીતે ૬ થી ૭ ફુટ જેવું અંતર પૂરતું ગણી શકાય.

ક શિક્ષકે પોતાનું સ્થાન એવું પસંદ કરવું જોઈએ કે નેથી તે બધાને જોઈ શકે અને બધા તેને સરળતાથી જોઈ શકે.

કસરતો :

અને વિવરણ કરેલી કસરતો- ૧. ફૂદન કસરતો ૨. હાથ અને ખમાની કસરતો ૩. કમર આગે ઝૂક કસરતો ૪. કમર બાજુ ઝૂક કસરતો ૫. કમર મરોડ કસરતો ૬. પગ અને સમતોલનની કસરતો. ૭. ચપળતાની કસરતો-એમ સ્તાત વિલાગોમાં ગોડવીને આપી છે. આ દરેક વિલાગોમાંથી એકું

કસરત લઈ તેમને જોડીને મિલ્લત બનાવવાથી સર્વાંગ ચુંદર જિઝનેસ્ટિક ટ્રાન્ઝસ બની શકશે.

૧. ફૂદન કસરતો :

કસરત-૧ :

૧. ફૂદીને પગ ખૂલ્લા; હાથ બાજુ પર સીધા તથા જમીનને સમાંતર
૨. ફૂદીને સાવધાન.

કસરત-૨ :

૧. ફૂદીને પગ ખૂલ્લા; હાથ બાજુ પર સીધા.
૨. ફૂદીને સાવધાન.
૩. ફૂદીને પગ ખૂલ્લા; બન્ને હાથ આગળ સીધા તથા હૃદ્યેળી સામાસામી.
૪. ફૂદીને સાવધાન.

કસરત-૩ :

૧. ફૂદીને પગ ખૂલ્લા; બન્ને હાથ બાજુ પર સીધા.
૨. ફૂદીને પગ ભેગા; બન્ને હાથ ઉપર સીધા કરી તાળી પાડવી.
૩. કમ એકની સ્થિતિ.
૪. સાવધાન.

કસરત-૪ :

મૂળ સ્થિતિ : કમર પર હાથ.

- ૧ થી ૪ : જગ્યા પર પંજ પર ચાર ફૂદકા લેવા.
૫. ફૂદીને પગ પહોળા; કમર પાસે આગળ બન્ને હાથે તાળી

૧૨૬

કસરતો

૧. કુમારી મૂળ સ્થિતિ.
 ૨. કુમ પાંચ મુજબ.
 ૩. મૂળ સ્થિતિ.

કસરત-૫ :

મૂળ સ્થિતિ : કમર પર હાથ.

૧ થી ૪ : મૂળ જગ્યાથી એક કદમ આગળ ટૂંકીને ચાર ટૂંકા લેવા.

૫ થી ૮ : એક કદમ પાઠળની બાબુ ટૂંકીને ચાર ટૂંકા લેવા.

૯ થી ૧૨ : ડાખી બાબુ એક કદમ ટૂંકીને ચાર ટૂંકા લેવા.

૧૩ થી ૧૬ : જમણી બાબુ એક કદમ ટૂંકીને ચાર ટૂંકા લેવા.

૨. હાથ અને ખાનાની કસરતો

કસરત-૧ :

૧. બનને હાથ આગળ સીધા; હથેળી સામસામી.
 ૨. બનને હાથ બાબુ પર ખલાની સીધમાં જમીનને સમાંતર; પંઝ પર ઉચ્ચા થવું.
 ૩. કુમ એકની સ્થિતિ.
 ૪. સાવધાન.

કસરત-૨ :

૧. બનને હાથ આગળ સીધા; હથેળી સામસામી.
 ૨. બનને હાથને ઓલો આપી પાછળ લઈ જવા; પંઝ પર ઉચ્ચા થવું.
 ૩. કુમ એકની સ્થિતિ.
 ૪. સાવધાન.

કસરત-૩ :

૧. બનને હાથ આગળ સીધા; હથેળી સામસામી.
 ૨. બનને હાથ ડોણીમાંથી વાળી છાતી પાસે લાવેા; ડોણી પાછળ એંચવી.
 ૩. કુમ એકની સ્થિતિ.
 ૪. સાવધાન.

કસરત-૪ :

૧. ડાખો હાથ ડાખી બાબુ સીધા; જમાનને સમાંતર.
 ૨. જમણો હાથ જમણી બાબુ સીધા; જમીનને સમાંતર.
 ૩. બનને હાથને નીચે કમર પાસે કોસ કરી ઉપર લઈ જવા.
 ૪. સાવધાન.

કસરત-૫ :

- ૧ થી ૩ : બનને હાથને ઉપરથી કોસ કરી ગણું ચક્ક આપો.
 ૪. ચાલુ ચક્ક તે જ પ્રમાણે આપી બનને હાથ બાબુ પર સીધા.
 ૫ થી ૭ : કાઉન્ટ : બનને હાથને નીચેથી ઉપર ગણું ચક્ક આપો.
 ૮. ચાલુ ચક્ક તે જ પ્રમાણે લઈ સાવધાન.
 ૯. કમર આગે જૂક કસરતો

કસરત-૬ :

- (૧) ટૂંકીને પગ પહોળા હાથ કમર પર
 (૨) કમરમાંથી આગળ ઝૂકવું.
 (૩) કુમ એકની સ્થિતિ.
 (૪) ટૂંકીને સાવધાન.

શાળાપયોગી જિગનેસ્ટિક ટેલ્ફોન

કસરત-૨ :

- (૧) કૂદીને પગ પહોળા; બન્ને હાથ બાળુ પર સીધા; જમીનને સમાંતર.
- (૨) કમરમાંથી આગળ ઝૂકી હાથ જે તે પગના અંગૂઠાને અડકાડો.
- પગ ગૂંઠનમાંથા સીધા રહો.
- (૩) કુમ એક મુજાબ.
- (૪) સાવધાન.

કસરત-૩

૧. કૂદીને પગ પહોળા, બન્ને હાથની હથેળી-આને જોડીને ડાળા ખલા પર અંગૂઠા અડકે તેવી રીતે મૂકો; વાલેકા હાથ ખલા જેટલા જિંચા.
૨. જોડેકા હાથને ઉડ્ઢાવી કમરમાંથી વળીને હાથને એ પગ વર્ચ્યે જેટલા પાછળ લઈ જવાય તેટલા લઈ જવ.
૩. કુમ એક મુજાબ.
૪. સાવધાન.

૫ થી ૮ : ડાખા ખલાને બદલે જમણું ખલા પર હાથ મૂકી કસરત કરવો.

કસરત-૪

૧. કૂદીને પગ પહોળા તથા બન્ને હાથ ઉપર સીધા અને કમરમાંથી પાછળ ઝૂકું.
૨. કમરમાંથી આગળ ઝૂકી બન્ને હાથને ઉપરથી નીચે લાંબી બન્ને પગની વર્ચ્યે અંદર લઈ જવા.
૩. કુમ એક મુજાબ
૪. સાવધાન.

કસરત ૫ :

મૂળ સ્થિતિ : પગ પહોળા.

૧. કમરમાંથી આગળ ઝૂકું, અને બન્ને હાથ આગળ બને જેટલા દૂર જમીનને અડકાડવા.

૨. કમરમાંથી સહેજ જિંચા થઈ બન્ને હાથને એ પગની વર્ચ્યે અંદરની બાળુ લઈ જઈ બને તેટલા દૂર જમીનને અડકાડવા.

૩. કુમ એક મુજાબ.

૪. મૂળ સ્થિતિ.

૪. કમર બાળુ ઝૂક કસરતો

કસરત ૧ :

મૂળ સ્થિતિ : પગ પહોળા.

૧. કમરમાંથી ડાખી બાળુ ઝૂકવું; ડાખો હાથ નીચેની બાળુ જવ.

૨. મૂળ સ્થિતિ.

૩. કમરમાંથી જમણી બાળુ ઝૂકવું; જમણો હાથ નીચેની બાળુ જવ.

કસરત ૨ :

મૂળ સ્થિતિ : પગ પહોળા; હાથ કમર પર.

૧ થી ૩ : તણુ વખત કમરમાંથી ડાખી બાળુ ઝૂકવું.

૪. મૂળ સ્થિતિ.

૫ થી ૭ : તણુ વખત જમણી બાળુ કમરમાંથી ઝૂકવું.

૮. મૂળ સ્થિતિ.

કસરત ૩ :

૧. કૂદીને પગ પહોળા; બન્ને હાથ કોણીમાંથી વાળી ગરદન પાછળ.

૨. કમરમાંથી ડાખી બાળુ ઝૂકવું.

૩. કુમ એક મુજાબ.

૪. સાવધાન.

૫ થી ૮ : તેજ પ્રમાણે જમણી બાળુ કરવું.

કસરત ૪ :

મૂળ સ્થિતિ : પગ પહેણા; હાથ કમર પર.

૧. ડાયા પગનો પવિગો, જમણો પગ સીધો.
ડાયો હાથ માથા પર રાખી કમરમાંથી જમણી બાંલુ ઝૂકવું.

૨. મૂળ સ્થિતિ.

૩. જમણું પગનો પવિગો, ડાયો પગ સીધો,
જમણો હાથ માથા પર રાખી કમરમાંથી ડાખી બાંલુ ઝૂકવું

૪. મૂળ સ્થિતિ.

કસરત ૫ :

૧. ફૂદીને પગ પહેણા, હાથ બાંલુ પર સીધા.

૨. બન્ને હાથ સીધા રાખી; ડાખી બાંલુ ઝૂકવું

૩. ક્રમ એક મુજબ.

૪. સાવધાન.

૫. કમર ભરેણ કસરતો

કસરત-૧ :

૧. ફૂદીને પગ પહેણા; હાથ કમર પર.

૨. પગને તે જ સ્થિતિમાં રાખી ડાખી બાંલુ ઝરવું.

૩. ક્રમ એક મુજબ.

૪. સાવધાન.

૫ થી ૮ : તે જ પ્રમાણે જમણી બાંલુ.

કસરત-૨ :

મળસ્થિતિ : પગ પહેણા; બન્ને હાથ ડોણી-
માંથી વાળી છાતી પાસે.

૧. ડાયો હાથ ડાખી બાંલુ દૂર સુધી લઈ
જવો અને કમરમાંથી ડાખી બાંલુ બને તેટલું ઝરવું.

૨. મૂળ સ્થિતિ.

૩. જમણો હાથ જમણી બાંલુ દૂર સુધી લઈ
જવો અને કમરમાંથી જમણી બાંલુ બને તેટલું ઝરવું.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૩ :

૧. ફૂદીને પગ પહેણા; બન્ને હાથ ઉપર સીધા.

૨. કમરમાંથી ડાખી બાંલુ ઝરી, ડાખી બાંલુ
નમવું અને બન્ને હાથ જમીન પર અડકાડવા.

૩. ક્રમ એક મુજબ.

૪. ફૂદીને સાવધાન.

૫ થી ૮ : તે જ પ્રમાણે જમણી બાંલુ.

કસરત-૪ :

મૂળ સ્થિતિ : પગ પહેણા; હાથ બાંલુ પર
સીધા.

૧. કમરમાંથી આગળ ઝૂકી, ડાયા હાથ
જમણું પગના અંગઠાને અડકવું. ^{વડ}

૨. મૂળ સ્થિતિ.

૩. કમરમાંથી આગળ ઝૂકી, જમણું હાથ
ડાયા પગના અંગઠાને અડકવું. ^{વડ}

૪. મૂળ સ્થિતિ.

કસરત-૫ :

૧. ફૂદીને પગ પહેણા તથા બન્ને હાથને
ડોણીમાંથી વાળી હુથેળી ગરદન પાછળ.

૨. કમરમાંથી આગળ તરફ ઝૂકી,
બાંલુ ઝરી, ડાયા હાથની ડોણી જમણું
ગૂંઠનાને અડકાડવી. ^{જમણું}
^{પગના}

૩. ક્રમ એક મુજબ.

૪. સાવધાન.

૫ થી ૮ : તે જ પ્રમાણે જમણું બાજુ.

૬. પગની અને સમતોલનની કસરતો

કસરત-૧ :

મૂળ સ્થિતિ : પગ લેગા; કમર પર હાથ.

૧. બન્ને પગના પંખ પર જાંચા થવું.

૨. પગને ગૂડનમાંથા વાળી, પંખ પર બેઠક લેવા.

૩. કુમ એક મુજબ.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૨ :

મૂળ સ્થિતિ : પગ લેગા; કમર પર હાથ.

૧. ડાયા પગને જોદો આપી આગળ લઈ જવો; પંખે જેંચેલો.

૨. ડાયા પગને જોદો આપી પાછળ લઈ જવો.

૩. ડાયા પગને જોદો આપી આગળ લાવવો.

૪. મૂળ સ્થિતિ.

૫ થી ૮ : તે જ પ્રમાણે જમણું પગ પર કરવું

કસરત-૩ :

૧. ડાયો પગ આગળ; બન્ને હાથ આગળ સીધા; હથેળી સામસામે.

૨. ડાયા પગનો આગળ પવિત્રો, જમણું પગ સીધા રહે; બન્ને હાથ બાજુ પર સીધા

૩. કુમ એક મુજબ.

૪. સાવધાન.

૫ થી ૮ : તે જ પ્રમાણે જમણું પગ પર કરવું.

કસરત-૪ :

૧. ડાયો પગ આગળ જિચો રાખવો; બન્ને હાથ આગળ સીધા; હથેળી સામસામે.

૨. ડાયો પગ ડાયી બાજુ લઈ જવો; બન્ને હાથ બાજુ પર સીધા.

૩. ડાયો પગ પાછળ લઈ જવો; બન્ને હાથ ઉપર સીધા; હથેળી સામસામે.

૪. સાવધાન.

૫ થી ૮ : તે જ પ્રમાણે જમણું બાજુ કરવું.

કસરત-૫ :

મૂળ સ્થિતિ : પંખ પર બેઠક; બન્ને હાથ જમીન પર આગળ ટેકવેલા.

૧. ડાયો પગ ડાયી બાજુ સીધે કરવો અને જમણું પગ પર સહેજ ફૂદકો લેવો.

૨. ફૂદીને બન્ને પગ લેગા કરવા.

૩. જમણું પગ જમણી બાજુ સીધે કરવો અને ડાયા પગ પર સહેજ ફૂદકો લેવો.

૪. ફૂદીને બન્ને પગ લેગા કરવા.

૭. ચપળતાની કસરતો

કસરત-૧ :

૧. પંખ પર બેઠક; હાથ જમીન પર; બન્ને પગ બન્ને હાથ વચ્ચે.

૨. બન્ને પગને પાછળ ફેંકવા, શરીરને કમર-માંથી નીચે તરફ વાળવું

૩. કુમ એકની સ્થિતિ.

૪. સાવધાન.

કસરત-૨ :

મૂળ સ્થિતિ : પગ લેગા; હાથ કમર પર.

૧. જમણા પગ પર કૂદકો લેતાં ડાઢો પગ ડાખી બાબુ સીધો કરવો; પંને એચેલો રહે.

૨. ડાળા પગ પર કૂદકો લેતાં જમણો પગ જમણો બાબુ સીધો કરવો; પંને એચેલો રહે.

કસરત સતત ચાલુ રાખવી.

કસરત-૩ :

૧. કૂદીને પગ ખૂદસા; બન્ને હાથ બાબુ પર સીધા.

૨. કૂદીને પગ ભેગા, બન્ને હાથ વડે પાછળ તાળો પાડવી.

૩. કુમ એક મુજબ.

૪. સાવધાન.

જમણો બાબુ પા ચકે કરી ઉપરાકત ચાર કાઉન્ટ કરવા, આમ ચારેય દિશામાં આ કસરત કરવી.

કસરત-૪ :

૧. કૂદીને પગ પહોળા; બન્ને હાથ બાબુ પર સીધા.

૨. કુદીને પગ ભેગા-હાથ સાથળ પાસે.

૩. કુદીને પગ પહોળા; બન્ને હાથ આગળ થઈને ઉપર સીધા.

૪. બન્ને હાથ પાછળથી લાવા સાથળ પાસે અને પગ ભેગા.

કસરત ૫ :

મૂળ સ્થિતિ - પગ ભેગા; કમર પર હાથ.

૧. જમણા પગના પંજ પર કૂદકો લેવો અને ડાબા પગનો પંને આગળ અડકાવવો.

૨. જમણા પગના પંજ પર કૂદકો લેવો અને ડાબા પગનો પંને બાબુ પર અડકાવવો.

૩. કુમ એક મુજબ.

૪. મૂળ સ્થિતિ.

૫ થી ૮ : તે જ પ્રમાણે ડાળા પગના પંજ પર કૂદકા લઈ જમણા પગનો પંને આગળ તથા બાબુ પર જમીનને અડકાવવો.

કસરતોની મિલજત (પી. ટી. ટેબલ)

કસરત ૧ :

મૂળસ્થિતિ : પગ ભેગા; કમર પર હાથ.

૧ થી ૪ : જગ્યા પર ચાર કૂદકા લેવા.

૫. કૂદીને પગ પહોળા. બન્ને હાથ વડે પેટ પાસે તાળો પાડવી.

૬. મૂળ સ્થિતિ.

૭. કુમ પંચ મુજબ.

૮. મૂળ સ્થિતિ.

કસરત ૨ :

૧. બન્ને હાથ આગળ સીધા; હથેળી સામસામે.

૨. બન્ને હાથ ડોણીમાંથા વાળી, બન્ને હાથની આંગળીઓ છાતી પારો મધ્યમાં.

૩. બન્ને હાથ બાબુ પર ખલાની સીધામાં સીધા.

૪. સાવધાન.

કસરત ૩ :

૧. કૂદીને પગ પહોળા; બન્ને હાથ બાજુ પર સીધા.

૨. બન્ને હાથને ઉપર થઈ નીચે જમીન પર લાવવા; કમરમાંથા આગળ ઝૂકવું.

૩. બન્ને હાથને ઉપર થઈ બાજુ પર લઈ જવા.
(કુમ-૧ ની સ્થિતિ)

૪. કૂદીને સાવધાન.

કસરત ૪ :

૧. કૂદીને પગ પહોળા; હાથ ડોણીમાંથા વાળી હથેળી ગરદન પાછળ; ડોણી પાછળ એચેલો.

૨. તે જ સ્થિતિમાં કમરમાંથી રાખી બાબુ જૂદું.

૩. કુમ એક મુજબ.

૪. દૂદીને સાવધાન.

૩. કુમ એક મુજબ.

૪. સાવધાન.

૫ થો ચ : જમણા પગ પર કસરત કરવી.

કસરત ૫ :

૧. દૂદીને પગ પહોળા; બન્ને હાથ બાબુ પર સીધા.

૨. હાથને તે જ સ્થિતિમાં રાખી રાખી બાબુ કમરમાંથી દરવું (પગ ખસેડવા કે દેરવવા નહીં).

૩. કુમ એક મુજબ.

૪. સાવધાન.

૫ થો ચ : ઉપર પ્રમાળે જમણી બાબુ કરવું.

કસરત ૭ :

૧. બન્ને પગના પંના પર બેઠક; હાથ જમીન સાથે અડકાલેલા.

૨. બન્ને હાથ જમીન પર રાખી બન્ને પગને પાણી દેંકવા.

૩. કુમ એક મુજબ.

૪. ઊમા થઈ સાવધાન.

કસરત ૮ :

૧. દૂદીને પગ પહોળા; બન્ને હાથ બાબુ પર સીધા.

૨. દૂદીને પગ લેગા; બન્ને હાથ માથા ઉપર સીધા લઈ બન્ને હાથે તાળી પાડવી.


૩. કુમ એક મુજબ.

૪. દૂદીને સાવધાન.

કસરત ૯ :

૧. ડાબો પગ આગળ; બન્ને પગ પર સરખું વજન રાખી બન્ને હાથ આગળ સીધા; હેઠળી સામસામે.

૨. ડાબા પગનો આગળ પવિત્રો; જમણો પગ સીધો તથા બન્ને હાથ બાબુ પર સીધા અને જમીનને સમાંતર.



૧૪. સૌન્યોપ્રચોગી કસરતો

સૈન્યના અધિકારીઓ એ વાત સ્વીકારે છે કે સૈનિકની દુશ્મનો સામે લડવાની ક્ષમતા તેઓની મોટા પાયા પરની સર્વાંગી સજ્જતા - ક્ષમતા ઉપર અવલંબે છે. તેઓ સામાન્ય રીતે ત્રણું પ્રકારની ક્ષમતાનો સર્વાંગી સજ્જતામાં સમાવેશ કરે છે.

૧. તાંત્રિક ક્ષમતા.

૨. માનસિક તથા આવેગિક ક્ષમતા.

૩. શારીરિક ક્ષમતા.

આ ત્રણુંનો સમન્વય તાલીમ પામેલ સૈનિકમાં થવો જોઈએ. ત્રણું પૈકી કોઈ પણ એકમાં પણ ઓછો સજ્જતા હોય તો સૈનિકની કાર્યક્ષમતા ઘટે છે તાંત્રિક ક્ષમતા વિના સૈનિક યુદ્ધના રીતન અને ક્રીશાસ્થ્યમાં જાણે. હિતરે છે. માનસિક તથા આવેગિક ક્ષમતાના અભાવે તે ઉદ્દીપનો અને લડવાની ઈચ્છાશક્તિ ફેળવી રહકરો નથી; તેમજ શારીરિક ક્ષમતા વિના લડવા માટેની શક્તિ, ચપળતા, બળમાં જાણે. પડે છે.

યુદ્ધના સમયે બળ, શક્તિ ચપળતા અને ગતિ-સ્કુમેળનો સમન્વય અત્યંત આવશ્યક બની જય છે, કારણું કે યુદ્ધમાં વિજય અને સૈનિકના જીવનની સલામતી તેના ઉપર અવલંબિત છે.

ઉપર વર્ણિતી ક્ષમતાઓ પૈકી શારીરિક ક્ષમતા માટે પસંદ કરેલી સુસ્થિત્વ કસરતોનો સમૂહ નિયમિતરૂપે કરવામાં આવે છે. આવી કસરતોના અનેક શયદા છે જેવા કે-

૧. આ કસરતો ગમે તે સ્થળે યોજ શકાય છે.

૨. આ કસરતો માટે વિશેષ પ્રકારનાં ખાસ સાધનોની જરૂર પડતી નથી

૩. આ કસરતો મોટા સમૂહોને જહેલાઈથા કરાવી શકાય છે.

૪ વ્યક્તિગત શારીરિક તથા વિજ્ઞાની વ્યક્તિઓ પણ આ કસરતો કરી શકે છે

આ કસરતોના પસંદગી યોજ્ય રીતે કરવામાં આવે તો શરીરમાં ઈષ્ટ સનાયુસમૂહોમાં યોજ્ય વિકાસ દરી શકાય છે.

કસરતોનું આયોજન :- અને સૈન્યોપ્રોગ્રામી કસરતોને મુખ્ય બે વિભાગોમાં વહેંચવામાં આવી છે.

૧. સામાન્ય કસરતો

સામાન્ય કસરતોમાં બે પ્રકારની ૧૨ - ૧૨ કસરતોના બે સમૂહ આપવામાં આવ્યા છે. ને પૈકી અ વિભાગમાં સાધન વિનાની કસરતો. જ્યારે બ વિભાગમાં રાયકલ ચાચેની કસરતોનો સમૂહ આપવામાં આવ્યો છે.

૨. ગરિલા કસરતો


ગરિલા કસરતોમાં ૬-૬ કસરતોના ચાર સમૂહ આપવામાં આવ્યા છે, ને પૈકી અ વિભાગમાં શયન સ્થિતિ કસરતો બ વિભાગમાં બેદુક સ્થિતિ કસરતો, ક વિભાગમાં ખડી સ્થિતિ કસરતો, જ્યારે ડ વિભાગમાં બે-બે ની જોડીની કસરતોનો સમૂહ આપવામાં આવ્યો છે.

કસરતોની પસંદગી નીચેના ત્રણું સુદૃઢાઓને લક્ષ્યમાં લઈને કરવામાં આવી છે; તેમજ તમામ કસરતો વ્યવસ્થિત કર્મમાં યોજવામાં આવી હોવાથી શ્રેષ્ઠ લાલદાયક પરિણામો મેળવી શકાય તેમ છે.

૧. શરીરના સુખ્ષે સ્નાયુ સમૃહને કસરતો ભોગે.
૨. કસરતો શીખવામાં અને કરવામાં સહેલી હોય.
૩. કસરતોના સંચાલન અને નિરીક્ષણમાં સરળતા રહે.

સામાન્ય કસરતો

(અ) સાધન વિનાની કસરતો : શરીરાતમાં દરેક કસરતનાં પાંચ આવર્તન કરવાં; પછી લેલે કસરત ૪ કે ૮ કાઉન્ટની હોય. સૈનિકની શક્તિ અને સહનશક્તિ વધે તે પ્રમાણે પાછળથી વધારો કરી શકાય. સામાન્ય રીતે પ્રત્યેક સપ્તાહે એક આવર્તન વધારતા જઈ વધુમાં વધુ ૧૬ આવર્તન સુધી પહોંચવું.



કસરત : ૧ (હાઇસ્ટ્રેંપ્યર)

મૂળ સ્થિતિઃ બન્ને પગ સામાન્ય, રીતે ખુલ્લા, દુટણું સહેજ વગેલા, શરીર આગળ તરફ કમરમાંથી ૪૫° ના ખૂણે ઝૂકેલું. હાથ પાછળ તરફ સીધા લંખાવેલા. (ચિત્રાંક-૧)

૧. હાથને આગળ તરફ ખલાની જિચાઈ સુધીનો ઓલેલા આપી સહેજ જિચો કૂદકો લેવો. (ચિત્રાંક-૨)

૨. હાથને પાછળ તરફ ઓલેલા આપી સહેજ જિચો કૂદકો લેવો. (ચિત્રાંક-૩)

૩. હાથને આગળ તરફ ઓલેલા આપી માથા ઉપર સીધા લઈ જવા તથા તે સાથે જ વધારે જિચો કૂદકો પણ લેવો. (ચિત્રાંક-૪)

૪. હાથને પાછળ તરફ ઓલેલા આપી સહેજ જિચો કૂદકો લેવો. (ચિત્રાંક-૫)

કસરત ૨ (એન્ડ એન્ડ રીચ)

મૂળ સ્થિતિ : બન્ને પગ સામાન્ય રીતે ખૂલ્લા, બન્ને હાથ ઉપર સીધા. (ચિત્રાંક-૬)

૧. જમીન ઉપર એકા લઈ કમરમાંથી આગળ તરફ જમીનને આંગળીઓ અડકાડવી. (ચિત્રાંક-૭)

૨. મૂળ સ્થિતિ.

૩. કાઉન્ટ એક મુજબા.

૪. મૂળ સ્થિતિ.

કસરત ૩ (સ્ક્રેચશર્ટ)

મૂળ સ્થિતિ : સાવધાન. (ચિત્રાંક-૮)

૧. પંજ ઉપર એકા, હાથની હથેળી જમીનને ટેકવી. બન્ને ધુટણ ડોણી બહાર, નજીર સામે. (ચિત્રાંક-૯)

૨. કૂદાં લઈ પગને પાણણ તરફ લઈ જવા, શરીર ટળતું. (ચિત્રાંક-૧૦)

૩. કાઉન્ટ એક મુજબા.

૪. મૂળ સ્થિતિ.

કસરત ૪ (રોલીંગ એક્સર્સાઇઝ)

મૂળ સ્થિતિ : પાડ એ લેટ જવની સ્થિતિ; હાથ પાણણ તરફ લંબાવેલા. (ચિત્રાંક-૧૧)

૧. જગ્યા ઉપર એકા થલું, ધુટણ ઉપર તરફ લઈ જવા, એડી સાથણ પાસે લાવણી, હાથ આગળ તરફ જમીનને સમાંતર. (ચિત્રાંક-૧૨)

૨. મૂળ સ્થિતિ.

૩. કાઉન્ટ એક મુજબા.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૫ (સ્ક્રેચ એન્ડર)

મૂળ સ્થિતિ : બન્ને પગ સામાન્ય રીતે ખૂલ્લા; કમર ઉપર હાથ (ચિત્રાંક-૧૩) મૂકી જિલા રહેવું.

૧. પંજ ઉપર એકા, બન્ને હાથ આગળ તરફ જમીન બાજુ હથેળી રહે તે પ્રમાણે લંબાવેલા (ચિત્રાંક-૧૪)

૨. મૂળ સ્થિતિ.

૩. કમરમાંથી આગળ તરફ જૂદી પગની આંગળીઓ સાથે હાથની આંગળીઓ અડકાડવી (ચિત્રાંક-૧૫).

૪. મૂળ સ્થિતિ.

કસરત-૬ (પુરા અય)

મૂળ સ્થિતિ : બન્ને હાથના પંજના ટેકા ઉપર શરીર રાખી પગ પાછળ તરફ લંબાવેલા અને પગના પંજનો ટેકા; શરીર ટળતું રાખવું. (ચિત્રાંક-૧૦)

૧. હાથ ડોણીમાંથી વાળો શરીરને જમીનને સમાંતર લઈ જલું. નજીર જમીન તરફ રાખવી. (ચિત્રાંક-૧૬)

૨. મૂળ સ્થિતિ.

૩. કાઉન્ટ એક મુજબા.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૭ (સાઈડ એન્ડર)

મૂળ સ્થિતિ : બન્ને પગ વચ્ચે ૬૦ સેન્ટી મીટર નેટલું અંતર રાખા રહેવું. હાથ ઉપર તરફ સીધા; બન્ને અંગુઠા એક ભીજ સાથે લીડાવેલા. (ચિત્રાંક-૧૭)

૧. કમરમાંથી ડાખી તરફ જૂકલું. (ચિત્રાંક-૧૮)

૨. શરીરને મૂળ સ્થિતિ તરફ સહેજ લાવી કરીયો તરત જ કાઉન્ટ એકની સ્થિતિ પ્રાપ્ત કરવી. (ચિત્રાંક-૧૯)

૩. કાઉન્ટ એ મુજબા.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૮ (બોડી એલીસ્ટર)

મૂળ સ્થિતિ : પીડ પર મુદ્ધ જઈ પગ કભરમાંથી ઉપર સીધા કરવા; બન્ને હાથ બાજુ પર સીધા જમીનને અડકાડેલા. (ચિત્રાંક-૨૦)

૧. પગને ડાખી તરફ વાળી જમીન સાથે અડકાડવા. (ચિત્રાંક-૨૧).

૨. મૂળ સ્થિતિ.

૩. પગને જમણી બાજુ વાળી જમીન સાથે અડકાડવા.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૯ (ટન્ડ એન્ડ બાઉન્સ)

મૂળ સ્થિતિ : બન્ને પગ વર્ષયે ૬૦ સેન્ટી મીટરનું અંતર, બન્ને હાથ બાજુ પર સીધા, હથેળી જમીન તરફ. (ચિત્રાંક-૨૨)

૧. કભર ઉપરના ભાગમાંથી શરીરને ડાખી તરફ ફેરવલું. (ચિત્રાંક-૨૩)

૨. શરીરને મૂળ દિશા તરફ સ્ટેઝ લઈ જઈ ફરીથી ડાખી તરફ ફેરવલું. (ચિત્રાંક-૨૪)

૩. કાઉન્ટ બે સુજાય ફરીવાર કરવું.

૪. મૂળ સ્થિતિ.

કાઉન્ટ ૫ થા ૮ જમણી તરફ.

કસરત-૧૦ (ફ્રોક એલીસ્ટર)

મૂળ સ્થિતિ : બન્ને પગ વર્ષયે ૬૦ સેન્ટી મીટર અંતર રાખી ટદાર ઉલા રહી, હાથના બન્ને પંન ગરદન ઉપર મૂકવા. (ચિત્રાંક-૨૫)

૧. કભરમાંથી આગળ તરફ ઝૂકવું. (ચિત્રાંક-૨૬)

૨. ઝૂકેલી સ્થિતિમાંથીજ શરીર ડાખી તરફ વાળી જમણી હાથની ડાખું ડાખી ધુટણું અડકાડવી. (ચિત્રાંક-૨૭)

૩. શરીરને ઝૂકેલી સ્થિતિમાં જમણી તરફ વાળી ડાખી હાથની ડાખું જમણું ધુટણું અડકાડવી.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૧૧ (સ્ટેશનરી રન)

મૂળ સ્થિતિ : બન્ને પગ ભેગા રાખી ટદાર ઉલા રહી હાથ ડાખુંમાથી વાળી છાતી પાસે લાવવા. (ચિત્રાંક-૨૮)

૧-૨ શરીર ટદાર રાખી જગ્યા ઉપર દોડ કરવા. (ચિત્રાંક-૨૯)

કસરત-૧૨ (એઢિટ કાઉન્ટ પુશ અપ)

મૂળ સ્થિતિ : સાવધાન. (ચિત્રાંક-૮)

૧. પંન ઉપર ઘેઠક, બન્ને હાથના પંન જમીનને અડકેલા, ડાખું બે ધુટણું વર્ષયે. (ચિત્રાંક-૮)

૨. ઝૂદ્ધક સાથે પગને પાણી લઈ જઈ પગના પંન જમીન ઉપર ટેકવવા. (ચિત્રાંક-૧૦)

૩. હાથને ડાખુંમાથી વાળી શરીર જમીનને સમાંતર લઈ જવું. (ચિત્રાંક-૧૬)

૪. કાઉન્ટ બે સુજાય.


૫. કાઉન્ટ તણુ સુજાય

૬. કાઉન્ટ બે સુજાય.

૭. કાઉન્ટ ઓક સુજાય

૮. મૂળ સ્થિતિ.

(બ) રાયક્લ સાથેની કસરતો : સૈનિકોને કન્ડીશનીંગ માટે રાયક્લ સાથે કસરતો કરાવવાથી રાયક્લના વધારાના વજનને લઘને સ્નાયુઓને વધારે કસરત મળે છે. ખાસ કરીને કભરની ઉપરના ભાગના સ્નાયુઓના વિકાસ માટે આ કસરતો અત્યંત ઉપયોગી પૂરવાર થઈ છે; અને તેમાંથે



रायक्षल साथेनी क्षरता

हाथ अने खलाना स्नायुओने आवी क्षरता द्वारा सविशेष व्यायाम भगे छे

आ बार क्षरतोनो समूह ६ थी ८ मिनिटना समयमां पूर्ण थई रहे छे. हाथने पूरता व्यायाम भगे. त्यां सुधी क्षरतो सतत चालु राखवामां आवे छे. डेटलीक क्षरतो ताल साथे क्राय छे, ज्यारे डेटलीक मान अनुकरण द्वारा करवामां आवे छे.

क्षरत-१ (क्लेक्स एन्ड थ्रस्ट अप)

मूण स्थिति : बन्ने हाथमां रायक्षल पक्डी पगना साथण पासे रहे ते प्रभाणे सावधानती स्थितिमां जिभा रहेवुँ. (चित्रांक-१)

१. बन्ने हाथ वडे रायक्षल जिभीने दाढी पासे लाववी. (चित्रांक-२)

२. बन्ने हाथमां रायक्षल पक्डी राखी हाथ माथा उपर सीधा करवा. (चित्रांक-३)

३. काउन्ट एक प्रभाणे.

४. मूण स्थिति.

क्षरत-२ (कुलनी एन्ड)

मूण स्थिति : क्षरत एक प्रभाणे. (चित्रांक-१)

१. बन्ने हाथ वडे रायक्षल जिभी ज्याची उपर लाई जवी. (चित्रांक-४)

२. रायक्षल ज्याची पर राखी पंज उपर घेऊ. (चित्रांक-५)

३. काउन्ट एक प्रभाणे. (चित्रांक-६)

४. मूण स्थिति.

क्षरत-३ (सीट अप थ्रस्ट फ्लाइवर्ड)

मूण स्थिति : पीठ उपर सुई जाई बन्ने हाथ वडे रायक्षल पक्डी साथण उपर राखवी. (चित्रांक-७)

१. कमरमांथी घेऊ थई रायक्षलने पगना पंज पासे लाई जवी. (चित्रांक-८)

૨. મૂળ સ્થિતિ.

૩. કાઉન્ટ એક પ્રમાણે.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૪ (સીટ એન્ડ ટન્)

મૂળ સ્થિતિ : બન્ને પગ આગળ તરફ ખુલ્લા લંબાવેલા રાખી બેઠક; રાયક્લ બન્ને હાથમાં પકુદેલી રાખો; હાથ જમીનને સમાંતર રાખવા. (ચિત્રાંક-૮)

૧. કમરમાંથી ડાખી તરફ શરીર રાયક્લ સાથે ફેરવવું. (ચિત્રાંક-૧૦)

૨. મૂળ સ્થિતિ.

૩. શરીર કમરમાંથી જમણી તરફ રાયક્લ સાથે ફેરવવું.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૫ (આમસ્ય ફેરવડ સાઈડ એન્ડ)

મૂળ સ્થિતિ : બન્ને પગ ૬૦ સેન્ટી મીટર નેટલા ખુલ્લા રાખી ટદાર જિસા રહેવું, રાયક્લ બન્ને હાથમાં પકુદેલી, હાથ જમીનને સમાંતર આગળ તરફ સીધા. (ચિત્રાંક-૧૧)

૧. રાયક્લ સાથે શરીર ડાખી તરફ જુકાવવું. (ચિત્રાંક-૧૨)

૨. મૂળ સ્થિતિ.

૩. રાયક્લ સાથે શરીર જમણી તરફ જુકાવવું.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૬ (લન્જ રૂટ એન્ડ)

મૂળ સ્થિતિ : બન્ને પગ ભેગા રાખી, ટદાર જિસા રહી, બન્ને હાથમાં રાયક્લ પકડી સાથળ પાસે રાખવી. (ચિત્રાંક-૧૩)

૧. ડાર્ખા ખેગને આગળ તરફ પવિત્રામાં મૂકી, બન્ને હાથનો આગળ તરફ ઝોલો લઈ, માથા ઉપર રાયક્લ સાથે સીધા લઈ જવા. (ચિત્રાંક-૧૪)

૨. કમરમાંથી આગળ ખૂકી રાયક્લ ડાખી પગની પંજ પાસે લાવવી. (ચિત્રાંક-૧૫)

૩. કાઉન્ટ એક પ્રમાણે.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૭ (સીટ અપ લેઝ્ટ એન્ડ રાઇટ)

મૂળ સ્થિતિ : બન્ને પગ સંપૂર્ણ ખુલ્લા અને લંબાવેલા રાખી પીડ ઉપર સૂર્ય જવું; હાથ પાછળ તરફ લંબાવેલા અને ખુલ્લા તથા રાયક્લ પકુદેલી. (ચિત્રાંક-૧૬)

૧. બેઠા થઈ કમરમાંથી શરીર આગળ તરફ જુકાવી, બન્ને હાથ આગળ તરફ લાવી, રાયક્લ જમણી પગના પંજ ઉપર લાવવી. (ચિત્રાંક-૧૭)

૨. મૂળ સ્થિતિ.

૩. બેઠા થઈ કમરમાંથી શરીર આગળ તરફ જુકાવી, બન્ને હાથ આગળ તરફ લાવી, રાયક્લ જમણી પગના પંજ ઉપર લાવવી.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૮ (રોવીંગ એક્સસર્ચિઝ)

મૂળ સ્થિતિ : બન્ને પગ આગળ તરફ સીધા લંબાવેલા રાખી બેસવું અને રાયક્લ છાતી પાસે. (ચિત્રાંક-૧૮)

૧. પગને ધુટણુમાંથી વાળી ઢાઢી પાસે લાવવા, હાથ આગળ તરફ સીધા લંબાવવા (ચિત્રાંક-૧૯).

૨. મૂળ સ્થિતિ.

૩. કાઉન્ટ એક પ્રમાણે.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૮ (લન્જ સાઈડ રેટરેટ એન્ડ એન્ડ)

મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિ, રાયક્લ સાથળ પાસે. (ચિત્રાંક-૧)

૧. ડાણા પગને ડાખી બાબુ પવિત્રામાં મૂક્ષી, હાથ સીધા માથા ઉપર લઈ રાયક્લ માથા ઉપર લઈ જવી. (ચિત્રાંક-૨૦)

૨. ડાખી તરફ ઝૂકી રાયક્લ ડાણા પંજ પાસે લઈ જવી. (ચિત્રાંક-૨૧)

૩. કાઉન્ટ એક પ્રમાણે.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૧૦ (સ્ક્રોટ જગ્યાસ)

મૂળ સ્થિતિ : ડાણા પગનો પંને સહેજ આગળ રહે તે પ્રમાણે બન્ને પંજ ઉપર એઠક, રાયક્લ બોચી પાસે. (ચિત્રાંક-૨૨)

૧. ઝૂદ્દો લઈ શરીર હવામાં ટંકાર કરી જિલ્લા થનું અને જમણું પગનો પંને સહેજ આગળ રહે તે પ્રમાણે જમીન ઉપર ઉત્તરાખું કરી બન્ને પંજ ઉપર એઠક લેવી. (ચિત્રાંક-૨૩)

૨. ઝૂદ્દો લઈ શરીર હવામાં ટંકાર કરી જિલ્લા થનું અને ડાણા પગનો પંને સહેજ આગળ રહે તે પ્રમાણે જમીન ઉપર ઉત્તરાખું કરી બન્ને પગના પંજ ઉપર એઠક લેવી.

૩. કાઉન્ટ એક પ્રમાણે.

૪. કાઉન્ટ બે પ્રમાણે.

કસરત-૧૧ (થ્રેસ્ટ એન્ડ એન્ડ)

મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં જિલ્લા રાયક્લ સાથળ પાસે રાખવી. (ચિત્રાંક-૧)

૧. રાયક્લ ઢાઢી નજીક લાવવી, બન્ને હાથ ઢોણુંમાંથી વળેલા. (ચિત્રાંક-૨)

૨. કમરમાંથી આગળ ઝૂકી રાયક્લ ધૂટણ પાસે લઈ જવી.

૩. કાઉન્ટ એક પ્રમાણે.

૪. મૂળ સ્થિતિ.

કસરત-૧૨ (સ્ટેશનરી રન)


મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં જિલ્લા રહી, જમણો હાથ કમરથા સ્ટેશન ઉપર અને ડાખો હાથ ડાણા કાન પાસે રહે તે પ્રમાણે રાયક્લ પકડવી. (ચિત્રાંક-૨૫)

૧-૨. જગ્યા ઉપર દોડની કિયા કરવી. (ચિત્રાંક-૨૬)

ગરિલા કસરતો

માન શારીરિક સ્વાસ્થ્ય, સુસ્થિતિ કે શારીરિક વિકાસ માટે જ ગરિલા કસરતો ઉપયોગી નથી, પરંતુ તે સિવાય ખાદ્યાં જોદ્દી, દુસ્ભનો ઉપર ઝૂભલો કરવો, છુપાઈ જલું, દુસ્ભનની શોધખોળ કરવી, ઈંજ પામેલા સાથીને જિયકી જવો, આંખી કિયાઓ માટે પણ તે અત્યંત ઉપયોગી પૂરવાર થઈ છે. સૈનિકો માટેના કન્ડીશનીંગ કાર્યક્રમમાં આ કસરતો મહત્વનો લાગ લજવે છે. ઉપરાંત કસરતો માટેની અનેકવિધતા પણ તે રજૂ કરે છે.

સામાન્ય રીતે ૬ કે ૮ કસરતોનો સમૂહ દરરોજ નિયમિતરપમાં કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે તેમાં વધારો કે ધટાડો કરી શકાય. પરંતુ એકદમ એકું સાથે ધણી બધી કસરતો કરવી નહિ જોઈએ; કારણું કે આવી કસરતો વધારે અમદાવી હોય છે. દરેક કસરત કેટલાં આવર્તન, કેટલો સમય કે કેટલા અંતર ચુધી કરવી, તે કસરત કરનારની શારીરિક ક્ષમતા અને કસરત કેટલી અમદાવી છે, તેના ઉપર અવકાશ છે. સામાન્ય રીતે દરેક કસરત ૨૦ થી



જરિલા કસરતો

૩૦ સેકંડ સુધી કરવી જોઈએ. જ્યારે કૂદકા જેવી કસરતો સંખ્યાના પ્રમાણુમાં કરવી જોઈએ.

કસરતો માટે વર્ગ રચના : સામાન્ય રીતે વર્તુળાકારે ઉલા રાખીને કે બેઠી સ્થિતિમાં આવી કસરતો કરાવાય છે. પરંતુ સુઈને આગળ વધવાનું હોય ત્યારે એક, બે કે ત્રણ સીધી લાઇનમાં કસરતો કરાવવામાં આવે છે. વર્તુળાકારે કસરતો કરાવાય ત્યારે વર્તુળ સામાન્ય રીતે મોટું અને દરેક સૈનિક વર્ષ્યે ૮ કૂટનું અંતર રહેવું જોઈએ. દરેક વર્તુળ

ઉપર ૧૦ થી ૩૦ સૈનિકો ઉલા રાખવા જોઈએ. જ્યારે બેન્ડ વર્તુળ હોય ત્યારે ૩૦ થી ૬૦ સૈનિકો ઉલા રાખી શકાય. કૂદકા લેવાની કસરતો કરાવવાની હોય ત્યારે સૈનિકોનાં મેં ડેન્ફની વિઝદ્વિશામાં રાખવામાં આવે છે અને કસરતનાં પાંચ કે ૭ આવત્તન કર્યા બાદ ડેન્ફની દિશામાં મેં ફેરવી કરી પાછાં પાંચ કે ૭ આવત્તન કરાવાય છે, કે જેથી કસરતને અંતે મૂળ જગ્યાએ આવી જવાય.

આ સિવાય ચોરસ કે નિંડાણુાકાર વર્ગ રચના

કરીને પણ ગેરિલા કસરતો કરાવી શકાય તથા હાથને પીડ ઉપર મૂકી રાખી વારાફરતી દરેક પગ પૂરટું મોદું મેદાન હોય તો એક જ લાઈનમાં જિલા વાળા પગના પંજ અને ધુટણુંની મદદથી શરીરને રાખીને પણ કસરતો કરાવી શકાય. પરંતુ ને મેદાન આગળ ધકેલવું. (ચિત્રાંક-૩)
મર્યાદિત હોય તો અમુક અંતરે જઘ પાછા ફરવાનું
અને કરી પાછા જવાનું તેમ જ આવવાનું-આ
પ્રમાણે શાટલ રીલે માફુક પણ કસરતો મારે વર્ગ
રૂચના કરી શકાય.

(જ) શયનસ્થિતિ કસરતો : આ કસરતો
એ રીતે થઈ શકે છે. (૧) જમીન ઉપર ઊંધા
સૂઈને (૨) જમીન ઉપર ચત્તા સૂઈને.

કસરત-૧

મૂળ સ્થિતિ : જમીન ઉપર ઊંધા સૂઈ જવું;
હાથ પગ સીધા.

જમીન ઉપર ઊંધા સૂઈ જાઈને માત્ર હાથ અને
પગનો ઉપયોગ કરીને આગળ વધવું. આગળ
વધતી વખતે ડાઢો હાથ આગળ લંબાવીએ તે
વખતે જમણો પગ ધુટણુંમાંથી વાળી અને પગના
અને હાથના પંજનો ટેકો લઈ આગળ વધવું.
(ચિત્રાંક-૧)

કસરત-૨

મૂળ સ્થિતિ : જમીન ઉપર ઊંધા સૂઈ જવું;
હાથપગ સીધા. જમીન ઉપર ઊંધા સૂઈ જાઈને માત્ર
બન્ને હાથના પંજનો ટેકો લઈ આગળ વધવું.
આગળ વધતી વખતે બન્ને હાથ ડોણુંમાંથી વાળી,
પંજ છાતી પાસે લાવી, પંજનો ટેકો લઈને
શરીરને આગળ તરફ ધકેલવું. (ચિત્રાંક-૨)

કસરત-૩

મૂળ સ્થિતિ : જમીન ઉપર ઊંધા સૂઈ જવું;
બન્ને હાથ પીડ ઉપર મુકેલા.

જમીન ઉપર ઊંધા સૂઈ જઈ માત્ર બન્ને પગનો
ઉપયોગ કરીને આગળ વધવું. આ મારે બન્ને

હાથને પીડ ઉપર મૂકી રાખી વારાફરતી દરેક પગ
અને ધુટણુંની મદદથી શરીરને
આગળ ધકેલવું. (ચિત્રાંક-૩)

કસરત-૪

મૂળ સ્થિતિ : જમીન ઉપર ચત્તા સૂઈ જવું;
હાથ પગ સીધા.

હાથ અને પગની મદદથી આગળ વધવું.
પહેલાં જમણો હાથ ડોણુંમાંથી અને જમણો પગ
કમર તથા ધુટણુંમાંથી બાજુમાં ઉપર તરફ વાંકો
વાળી, શરીરને માથા તરફ આગળ ધકેલવું. તે જ
પ્રમાણે બીજી હાથ અને પગ વડે કિયા કરવી.
આ રીતે આગળ વધવું. (ચિત્રાંક-૪)

કસરત-૫

મૂળ સ્થિતિ : જમીન ઉપર ચત્તા સૂઈ જવું;
હાથ પગ સીધા.

માત્ર હાથની મદદ વડે આગળ વધવું. માયું
સહેજ ઊંધું કરી બન્ને હાથ ડોણુંમાંથી એક સાથે
વાળી, ડોણી અને હાથના પંજની મદદથી શરીરને
માથા તરફ ધકેલવું અને આગળ વધવું. (ચિત્રાંક-૫)

કસરત-૬

મૂળ સ્થિતિ : જમીન ઉપર ચત્તા સૂઈ જવું;
બન્ને હાથ પેટ ઉપર લેગા.

માત્ર પગનો ઉપયોગ કરી આગળ વધવું. પહેલાં
જમણો પગને કમર અને ધુટણુંમાંથી વાળી, તેની
મદદથી શરીરને માથા તરફ આગળ ધકેલવું. એ જ
પ્રમાણે કિયા ડાબા પગ વડે કરવી અને આ રીતે
આગળ વધવું. (ચિત્રાંક-૬)

(બ) એઠક સ્થિતિ કસરતો :

કસરત-૭ (ડક-એડલ)

મૂળ સ્થિતિ : કમર ઉપર હાથ રાખી ટીર
એડલ લેવી. (ચિત્રાંક-૭)

१. डायें पर आगण मूळी आगण वधवुं. (चित्रांक-८)
२. जमणे पर आगण मूळी आगण वधवुं. (चित्रांक-७)

क्षरत-२ (कुल स्केप्ट ४३५)

- मूळ स्थिति : पंज उपर बेकड. (चित्रांक-८)
१. जव्या उपरथा आगण हृदका लेवा. (चित्रांक-१०)
 २. पंज उपर उतराणु करवुं. (चित्रांक-८)

क्षरत-३ (इंग ४३५)

- मूळ स्थिति : बने हाथने आगण टेका लई पंज उपर बेकड. (चित्रांक-११)
१. बने हाथ अने पगनी भद्रथा देका भाइक आगण तरङ्ग हृदका लेवा. (चित्रांक-१२)
 २. बने हाथ अने पंग वडे जमीन उपर उतराणु करवुं. (चित्रांक-११)

क्षरत-४ (डेप वेक ड्रारवर्ड)

मूळ स्थिति : बने हाथने पाछण जमीन उपर टेका लेवा अने बने पगनो जमीन उपर आगण टेका लेवा; में आकाश तरङ्ग.

१. डायें पर अने जमणे हाथ आगण लंबावी जमीन उपर आगण वधवुं. (चित्रांक-१३)
२. जमणे पर अने डायें हाथ जमीन उपर आगण लंबावी आगण वधवुं.

क्षरत-५ (डेप वेक एकवर्ड)

मूळ स्थिति : बने हाथने जमीन उपर शरीरना पाछण तरङ्ग टेका अने बने पगनो जमीन उपर आगण तरङ्ग टेका.

१. डायें पर अने जमणे हाथ पाछण तरङ्ग जमीन उपर लंबावी पाछण हडवुं. (क्षरत-४ करतां उल्टी गति)

२. जमणे पर अने डायें हाथ पाछण तरङ्ग जमीन उपर लंबावी पाछण हडवुं.

क्षरत-६ (चीकन वेक)

- मूळ स्थिति : वीर बेठकनी स्थितिमां ऐसी अने हाथ वडे बने पगनी धूंटी पकड़ी. (चित्रांक-१४)
१. धूंटी पकडी राखी डायें पर जिकीने आगण तरङ्ग मूळवेा. (चित्रांक-१५)
 २. धूंटी पकडी राखी जमणे पर जिकीने आगण तरङ्ग मूळवेा. (चित्रांक-१४)

(क) खडी स्थिरत क्षरतो

क्षरत-१ (डाउच रन)

मूळ स्थिति : दोड माटे खडा प्रस्थान नी स्थिति. (एक पर आगण, घीने पर पाछण, धड आगण झूळेलुं अने हाथ डोणीभाँथी वगेला.)

खडा प्रस्थान वर्खते शरीरना स्थिति हेथ ते ज स्थितिमां शरीरना कमर उपरनो लाग राखी जेगींग करता आगण दोडवुं. (चित्रांक-१६)

क्षरत-२ (डेन्ड कीक वेक)

मूळ स्थिति : सावधान.

डाया पगथा आगण तरङ्ग उपर कीक भारी छाती सामे जमणा हाथने पंजे डाया पगना अंगुठाने अडकाडवेा. ते ज अमाझेनी किया जमणा पर अने डाया हाथ वडे करवी अने आ रीते आगण वधवुं. (चित्रांक-१७ अने १८)

क्षरत-३ (स्ट्रोहल रन)

मूळ स्थिति : सावधान.

जमणा अने डाया पगनी लांझी लांझी फूलगो लरता आगण दोडवुं. (चित्रांक-१९ अने २०)

કસરત-૪ (ઓડ જન્મ)

મૂળ સ્થિતિ : બન્ને પગ ભેગા, શરીર આગળ ઝૂકેલું, હાથ પાછળ તરફ લંઘાવેલા (ચિત્રાંક-૨૧).

બન્ને પગે હવામાં લાંબો ટૂંકો લઈ. જમીન ઉપર ઉત્તરાણુ કરવું. (ખડી લાંબી ટૂંકની કિયા કરવી) (ચિત્રાંક-૨૧ અને ૨૨).

કસરત-૫ (હોખલ હોપીંગ એન્ન શેફ્ટ ફૂદ)

મૂળ સ્થિતિ : જમણું પગને કમર પાછળ લઈ ડાણા હાથ વડે પકડવો. (ચિત્રાંક-૨૩)

ડાણા પગે લંગડી દરતા આગળ દોડવું. (ચિત્રાંક-૨૩)

કસરત-૬ (હુલ-કદીક જમ્પિંગ)

મૂળ સ્થિતિ : બન્ને પગ વચ્ચે એ ફૂટનું અંતર રાખી શરીર આગળ તરફ ઝુકાવી જિલા રહેવું; હાથ ખાજુમાં જાંચા અને વળેલા. (ચિત્રાંક-૨૪)

મૂળ સ્થિતિમાંથી જાંચો ટૂંકો લઈ બન્ને પગની એડી હવામાં ભેગી કરવી અને મૂળ સ્થિતિ મુજબ જમીન ઉપર ઉત્તરાણુ કરવું. (ચિત્રાંક-૨૫ અને ૨૫)

(ડ) જોડ કસરતો

કસરત-૧ (આર્મ કેરી)

સૌ પ્રથમ જિલા રહેલા સાથીદારને ડાણા હાથે પીડ અને જમણું હાથે સાથળ નીચેથા જિયકવો. જિયકાયેલો સાથી જિયકનારના ગળાની આજુઆજુ પોતાના બન્ને હાથ વડે પકડ લેશો. આ પ્રમાણે જિયક્યા ખાદ ૩૦ થી ૬૦ ડગલાં દોડવું. આ પ્રમાણેની કિયા વારાકૃતી બન્ને સાથીદારોએ કરવી. (ચિત્રાંક-૨૬ અને ૨૭)

કસરત-૨ (ફ્રાયરમેન્સ કેરી)

જિલા રહેલા સાથીદારને ડાણા ખલા ઉપર તેના કમરનો લાગ આવે તે પ્રમાણે જિયકી, તેની સાથળ પાછળ થઈ હાથ વડે સાથાનો ડાંબો હાથ પકડવો, પોતાનો જમણો હાથ કમર ઉપર મૂકવો, આ પ્રમાણે જિયકી ૩૦ થી ૬૦ કદમ દોડવું. આ પ્રમાણેની કિયા વારાકૃતી બન્ને સાથીદારોએ કરવી (ચિત્રાંક-૨૮ અને ૨૯).

કસરત-૩ (કોસ કેરી)

નેડી પૈકી એક સાથીદાર વાંકો વળી પોતાની પીડ ઉપર ખીંચ સાથીનું પેટ આવે તે પ્રમાણે જિયકશે અને જમણું હાથ વડે, જિયકાયેલા ખીંચ સાથાની પીડ ઉપર પકડ લેશો. ત્યારથાદ તેને જિયકી ને ૩૦ થી ૬૦ કદમ દોડશો. આ પ્રમાણેની કિયા બન્ને સાથીદાર વારાકૃતી કરશો (ચિત્રાંક-૩૦ અને ૩૧).

કસરત-૪ (સિંગલ શોલ્ડર કેરી)

નેડી પૈકી એક સાથીદાર પોતાના ખલા ઉપર ખીંચ સાથીનું પેટ આવે તે પ્રમાણે જિયકને ૩૦ થી ૬૦ કદમ દોડશો. આ પ્રમાણેની કિયા વારાકૃતી બન્ને સાથીદારો કરશો. (ચિત્રાંક-૩૨)

કસરત-૫ (હીપ કેરી)

નેડી પૈકી એક સાથીદારની પીડ પાછળ ખીંચ સાથીદાર બન્ને પગ પહેલા સાથાની કમરની બન્ને ખાજુએ થઈને આગળ લંબાવશો, જ્યારે હાથ પહેલા સાથીના ગળાની બન્ને ખાજુએ થઈ છતી પાસે લાવી હાથની આંટી લગાવશો અને જિયકનાર સાથી ૩૦ થી ૬૦ કદમ દોડશો. આ પ્રમાણેની કિયા બન્ને સાથીદારો વારાકૃતી કરશો. (ચિત્રાંક-૩૩)

કસરત-૬ (શોલ્ડર કેરી)

નેડી પૈકી એક સાથીદારની ગરદનની બન્ને

ળાણુએ પોતાના પગ રહે તે પ્રમાણે ખીંચે સાથી-
દાર બેસરો અને પગ વડે સાથીદારની પીડ ઉપર
આંટી ભારશે. જિયકનાર સાથીદાર ઊંઠ થા ૬૦ કદમ
ખીંચ સાથીને જિયકુને હોડશે. આ પ્રમાણેની ક્રિયા
વારાદૃષ્ટિ બને સાથીદારા કરશે. (ચિત્રાંક-૩૪
અને ૩૫)

આ સિવાય પોતાના સાથીને આગળથી જિયકુ-
ને દેડી શકાય, તેમજ જિધા સુઈ જઈ પીડ ઉપર
જિયકુને પેટ ઉપર સરકી શકાય તથા સાથીદારને
ચત્તો સુવડાવી પોતે દુટણું અને હાથના ટેકે જિંધા
રહી, સાથીદારનો હાથ પોતાના ગળે લગાડાવી, તેને
ધસડી પણું શકાય. (ચિત્રાંક-૩૬, ૩૭ અને ૩૮)



૧૭. પ્રતિરોધ, ટાંક્રેસિન્જ તથા શિથીલીકરણ વ્યાયામ

શરીર અને મન અરસપરસ ગાડ રીતે સંકળા-
એલાં છે. શરીરને નીરોળી અને બળવાન તથા
મનને સ્વસ્થ અને પ્રકુલ્પિત રાખવા માટે કસરતો-
ની જે વિવિધ પદ્ધતિઓ પ્રચલિત છે તેમાં-૧.
પ્રતિરોધ (Resistance) કસરતો ૨. ગાત્ર
પ્રસારણ (Stretching) કસરતો તથા ૩. શિથીલીકરણ (Relaxation) કસરતો નોંધપાત્ર છે

૧. પ્રતિરોધ કસરતો


તનને તંદુરસ્ત રાખવામાં, શરીરનો કુયોંગ
ઉઠાવ જાગવવામાં, શ્વાસનાં રોળંગ તથા સવિશેષ
કાર્યો કરવામાં તેમજ સર્વપ્રકારની રમતગમતોમાં
બળવાન સ્નાયુઓની અનિવાર્ય આવસ્થાકતા રહે છે.
સ્નાયુઓને બળવાન બનાવવા માટે પ્રતિરોધ કસરતો
અત્યંત ફળદાયી પૂરવાર થઈ છે. પ્રતિરોધ કસરતો-
માં ચોક્કસ પ્રકારના પ્રતિરોધ સામે સ્નાયુસમૂહે
જરી બળ વાપરી કાર્ય કરવાનું હોય છે; અને
આના પરિણામે સામાન્ય કરતાં વધારે ભાર
(overload)ના નિયમાનુસાર સંખ્યાંધિત સ્નાયુ-
સમૂહો વિકાસ પામે છે અને બળની વૃદ્ધિ થાય છે

પથ્થર વ્યાયામ (પ્રકરણ-૧૮), કાંડ વ્યાયામ
(પ્રકરણ-૧૯), વજન વ્યાયામ (પ્રકરણ-૨૦),
સ્પ્રીંગ વ્યાયામ, તથા ખુલ્લો વર્કર (પ્રકરણ-૨૧)
દિવાલ, સ્તંભ કે સ્થિર પદાર્થ સામે પ્રતિનોર
વ્યાયામ, સીંગલભાર પર લટકીને L સ્થિતિ કે V
સ્થિતિ તથા જમીન પર પગ લાંબા કરી બેસી
V સ્થિતિ લેવી વગેરે પ્રતિરોધ કસરતોના પ્રચલિત
પ્રકારો છે. આ કસરતોના મુખ્ય તણું વિલાગ-૧.

વજન વ્યાયામ (Weight Training) કે જેમાં
બારબેલ પર કમિક વજન વધારતા જઈ વિવિધ
કસરતો કરવામાં આવે છે ૨. ડેલેસ્થનિક કસરતો
કે જેમાં શરીરના ડોઘ અવયવને જ વજન તરીકે
ઉપગોગમાં લઈ તેની સામે સંખ્યાંધિત સ્નાયુ-
સમૂહને બળ વાપરી કાર્ય કરવાનું હોય છે. અને ૩.
પ્રતિનોર (Isometric) કસરતો કે જેમાં
સામાન્ય રીતે સ્થિર પદાર્થની સામે સ્નાયુ સમૂહે
ચોક્કસ માત્રામાં બળ વાપરી નિયત સમય સુધી
સ્થિતિ બળની રાખવાની હોય છે. વજન વ્યાયામનું
નિવશણ પ્રકરણ-૨૦ માં વિગતે કયું હોવાથા તે
સિવાયની પ્રતિરોધ કસરતો અને ખાસ કરીને
અમેરિકન વ્યાયામવિદ્યા શ્રી સ્ટીન હેઝે તેમના
પુસ્તક 'હાઉ ટુ ફ્રીપ શ્રીટ એન્ડ લાઇફ ઈટ' માં
'કમાંડર સેટ' તરીકે વર્ણિત ૧૩ આયસોમેટ્રિક
કસરતોનું વિવરણ અને આપવું ઉચિત ગણયું છે.
આ દરેક કસરતની સ્થિતિ કું મહત્વમાં બળપૂર્વક
લગભગ ૧૦ સેકંડ સુધી બળવાની અને તે પછી
૮-૧૦ સેકંડ વિરામ લઈ પુનરવર્તન કરવું.

૨. ડોણી ધકેલ : દિવાલ સાથે પીડ અડકાડી
જીલા રહેા; ડોણીઓ ખલાની લાઈનમાં બાળુએ
ખેળેલી અને દિવાલને અડકાડેલી રાખી દિવાલ
સાથે જર્ઝુડ દાવો. (ચિત્રાંક-૧)

૨. હુથેલી ધકેલ : ડોણીઓ ખલાની લાઈન-
માં બાળુએ ખેલેલી તથા બંને હુથેલીઓ છાતી
સામે લેગી રાખી જીલા રહેા. હવે બંને હુથેલીઓને
જેરથી સામસામે દાવો. (ચિત્રાંક-૨)



क्रमानुसार सेटनी क्रसरते।

३. सामने संपाठ : बांने हाथने साथगनी भाऊणे राखी चता सुई जन. हवे जमीन परथी माथुं, जिला अने पगने पडेणा V आकारमां सीधा उंचा करी स्थिति जागवो. (चित्रांक-३)

४. क्रमान डीयक : झुरसी के बेन्य परं बेसी जमीन पर पगनां तणियांने अंदरनी तरळ वजेलां सामसामे अडकाडी जोरथा दृष्टावो. (चित्रांक-४)

५. सीना : झुरसीनी पाणी जिला रही झुरसीनी पीडना बांने जिला दांडा पकडी नीचेनी तरळ दृष्टाणु आपो. (चित्रांक-५)

६. पांव अंतलोर : झुरसीनी पाणी जमीन पर बेसी बांने पगने घूंटी आगणतो लाग झुरसीना पायानी बहारनी बाऊ अडकेवो. रहे तम पगने सीधा करी, पग वडे अंदरनी तरळ दृष्टाणु आपो. (चित्रांक-६)

७. पांव भहिलोर : उपर प्रभाणे ९, परंतु पग झुरसीना पायानी अंदरनी बाऊ रहेशो अने पधी पग वडे बहारनी तरळ दृष्टाणु आपो. (चित्रांक-७)

८. कलाई-१ : झुरसीनी पीड (के उणलणार) ना दांडोने ओवरहेंड पकडी डाढा हाथनी हथेलीने

दक्षिण (clockwise) गतिमां तथा जमणा हाथनी हथेलीने वाम (Anti-clockwise) गतिमां भरोड आपो. (चित्रांक-८)

९. कलाई-२ : उपर प्रभाणे ९, परंतु बांने हथेलीने बहारनी तरळ ऐंचाणु आपो, पधी ए ज प्रभाणे, परंतु अंदरनी तरळ ऐंचाणु आपो. (चित्रांक-९)

१०. पेडी भोड : द्वारनी वच्ये जिला रही एक हाथ भारसाखनी अंदरनी बाऊ अने भीले हाथ बहारनी बाऊ टेक्नी राष्ट्रो; अने पधी धडने अवणी दिशामां भरोड आपवा जोर करो. त्यार आद हाथनी स्थिति बदली भील दिशामां करो. (चित्रांक-१०)

११. पेडी प्रसरण : उंधा सूई जै बांने हाथने ऐच्ची उपर अद्यमां राखी, माथुं अने छाती जमीनथा उच्चे ऐंच्यो. तमारो ज्वेडीदार तमारी साथण पर बेसी तमारी पीडने नीचे धडेलवा जोर करे अने तमे छाती अने माथु' ऐच्ची राष्ट्रो. (चित्रांक-११)

१२. शयनेत्थान : चता सूई जै बांने हाथ ऐच्ची पर राखी अडधा ऐडा थाव त्यारे तमारो ज्वेडीदार तमारी साथण पर ऐसी तरी

ડાણી કે છાતીને પાણળ ધોલવા પ્રયત્ન કરે; તમે સ્થિતિ પકડી રાખો. (ચિત્રાંક-૧૨)

૧૩. ગૂઠન પ્રસરણ : બેન્ય કે ખુરસી પર બેસી હાથ દીચણું પર કે નીચે અનુકૂળતા મુજબ ટેકવો. તમારો જોડીદાર તમારી ઘૂંઠીને પકડીને નીચેની તરફ દ્યાવશે. તમે પગને દીચણુમાંથા સીધા કરવા જોર કરો. (ચિત્રાંક-૧૩)

ઉપરોક્તા સિવાય અન્ય અનેક પ્રકારની આયસોમેટ્રિક કસરતો શુદ્ધપૂર્વક યોળ રહાય. વિવિધ અવયવો માટેની ડેટલીક નમૂનાઓ કસરતો નીચે આપી છે.

૧. ગરદન : ૧. માથા પાણળ રાખેલા બંને હાથ વડે માથાને આગળ ધોકેલો; ગરદનના સનાયુઓ પ્રતિરોધ કરો. ૨. જિલ્લા ક્રિયા: માથા પાણળ રાખેલા હાથ વડે માથાને આગળ દાણી રાખો; ગરદનના સનાયુઓ માયું સીધું કરવા જોર કરો.

૨. હૃથ અને અભા : ૧. સીંગલબાર પર લટકી જિયક (પુલ અપ) કરો. ૨. ડાયલબાર પર બંને હાથ ટેકાની નીચ્યક (ડીપ) કરો. ૩. લટકતા દેરડા પર હાથના જોર વડે ચઢો. ૪. છાતી સામે બંને હાથના આંગળાં અરસપરસ ભેરવી વિરદ્ધ દિશામાં બેંચો. ૫. મજબૂત રીંગ માથા ઉપર બંને હાથ વડે પકડી વિરદ્ધ દિશામાં બેંચો. ૬. ટેનિસ બોલને હાથમાં પકડી જોરથી દાવાવો.

૩. પેટ અને પેટુ : ૧. દીચણુ વાળેલા અને હાથ બોચી પર રાખ્યો પીડ પર અર્ધા સૂર્ય જવ.

૨. પગ દીચણુમાંથા સીધા કે વાળેલા રાખી શયનોત્થાન (સીટ અપ) કરો.

૩. પીડ પર ચત્તા સૂર્ય જઈ પગને દીચણુ-માંથા વાળ્યા વિના જમીનથી લગભગ ૩૦ અંશને ખૂલ્યે જિયા કરો.

૪. સીંગલબાર પર લટકી બંને પગને દીચણુ-

માંથા વાળ્યા વિના આગળ કાટખૂણે સીધા કરી લ સ્થિતિ લો.

૫. સીંગલ બાર પર લટકી પગ દીચણુમાંથા વાળ્યા વિના સીધા જિયે લઇ જઈ V સ્થિતિ લો.


૪. પીડ : ૧. ઊંધા સૂર્ય જઈ હાથ બોચી પર રાખી માયું અને છાતી જિયે લો (બુજંગાસન). ૨. આગળ પ્રમાણે જ, પરંતુ બંને હાથ પૂડ પારો રાખો. ૩. ઊંધા સૂર્ય જઈ બંને પગને વાળ્યા વિના જિયે લો (શલલાસન). ૪. ઊંધા સૂર્ય જઈ બંને પગ દીચણુમાંથા વાળી ઘૂંઠી હાથ વડે પકડી બેંચાણું આપી માયું, છાતી તથા દીચણુ જિયો (ધનુરાસન).

૫. પગ : ૧. દ્વિવાલ સાથે પીડ અડકાડી જિલા રહી અર્ધા બેકડ લો. ૨. હાથ કમર પર રાખી પગને દીચણુમાંથા વાળ્યા વિના આગળ કાટખૂણે જિયો. ૩. પગને આયુ પર કાટખૂણે જિયો. ૪. પાણળના પગને દીચણુ કાટખૂણે વાળી જમીન પર ટેકની જિલડક બેસો. ૫. આગળનો પગ દીચણુમાંથા વાળી લાંબો પવિત્રો (લંજ) લો. ૬. એડી જાંબી કરી પંજ પર ચાલો.

આ જ પ્રમાણે જોડીદાર સામસામે જિલા રહી અરસપરસ પંજ લીડાવી અથવા ખલા કે બોચી પકડી સામસામે જોર અજમાવશે. તં જ પ્રમાણે પીડ પીડ જિલા રહી અરસપરસ ડાણી ભેરવી આગળ નમ્બવા જોર કરશે.

૨. ગાત્ર પ્રસરણ વ્યાયામ

શરીરના જુદા જુદા અવયવોને તાણીને લાંગા. કરવાથી શરીરમાં રક્તપ્રવાહ ચાલુ થઈને હોશિયારી આને છે. વિશ્રાન્તિ લેવાનો આ એક પ્રકાર છે. હંમેશાં સંકુચિત થતા જતા સનાયુઓનો સંડોય આવાં પ્રસરણોને લઈને દૂર થતાં તેમાં પણ રક્તપ્રવાહ શરીર થવા માટે છે. આપણુને બેડાડુ વ્યવસાયની કામગીરી વધારે વખત વખત સુધી ચાલુ



ગાત્રપ્રસારણ

રાખતાં થાક ચડે છે, તે વખતે આપણે સાહજિક પણે ચિત્રમાં દર્શાવ્યા મુજબ હાથનું લાંબા જેંચીએ છીએ, બગાસાં ખાઈએ છીએ તથા તેની અન્ય પ્રસરણ ક્રિયાએ આપણે અનાયાસ કરીએ છીએ. આ રીતનું પ્રસારણ કર્યા પછી તરત જ શિથિલીકરણ (Relaxation) કરવું. પ્રસરણ થયા પછી તેની પ્રતિક્રિયા ઇપે બધા સ્નાયુઓ શિથિલ થાય છે અને સ્નાયુઓને સરસ વિશ્રાંતિ મળે છે. આ પ્રકારના વ્યાયામની ડેટ્લીક કસરતો નીચે પ્રમાણે છે—

કસરત-૧ : બંને પગ વચ્ચે અંતર રાખી જિલા રહેણે. પછી બંને હાથને બંને તરફના ખસાની સપાઠીમાં જાંચા લાવીને તથા તાણીને શક્ય

તેટલા પાછળ લાવો. તે પછી પુનઃ સ્નાયુઓને શિથિલ કરી હાથને બાબુએ નીચે લાવો. (બુઝો ચિત્ર : પૃષ્ઠ ૧૪૪)

કસરત-૨ : બંને પગની વચ્ચે અંતર રાખો જિલા રહેણે. હવે કમરમાંથી આગળ નમી બંને હાથને જેંચી શક્ય તેટલા આગળની તરફ જમીન પર ટકવો. તે પછી સ્નાયુઓને શિથિલ કરી જિલા થઈ હાથ બાબુએ નીચે લાવો. (બુઝો ચિત્ર : પૃ. ૧૪૪)

કસરત-૩ : બંને પગ વચ્ચે વધારે અંતર રાખો જિલા રહેણે. હવે જમણા પગને ગૂડનમાંથી વાળી બંને હાથને શક્ય તેટલા તાણી જમણા પગની આગળના ભાગે લાંબા અંતરે જમીન પર ટકવો. તે પછી પુનઃ હાથને ઢીલા કરીને કમરમાંથી ટટાર થઈ જિલા થાવ અને હાથ બાબુએ નીચે લાવો. આડું પ્રગાણે બીજુ બાબુ કરો.

કસરત-૪ : ડાણા પગને ગૂડનમાંથી વાળીને બંને પગ વચ્ચે વધારે અંતર રાખો જિલા રહેણે. હવે કમરમાંથી વણીને ડાણા હાથને તાણીને શક્ય તેટલે દૂર જમીન પર ટકવો અને તે જ વખતે જમણા હાથને તાણીને પાછલા ભાગમાં જાંચો. તે પછી હાથને ઢીલા કરી જિલા થઈ જાવ અને આ જ પ્રમાણે બીજુ બાબુ કરો.

શિથિલીકરણ વ્યાયામ

શરીરના ડેટી પણ ગાત્ર કે અવયવમાંથી બળને જેંચી લઈને તેને ઢીલો કે શિથિલ જનાવવો તેને ‘શિથિલીકરણ’ કહે છે. મનુષ્ય જન્માત હોય ત્યારે પણ તેના સ્નાયુઓનું શિથિલીકરણ ઓછા વધતા પ્રમાણમાં થયેલું જ હોય છે. શરીરની વિવિધ ઢીલચાલ કરવામાં પણ સ્નાયુઓને સંકોચિત પડે છે; અને ઓમાં પણ વધતા ઓછા પ્રમાણમાં જીવનશક્તિ ખરચાય છે. માત્ર જિલા રહેવાનું હોય કે સ્વસ્થ બેસવાનું હોય તો પણ ડેટલાક સ્નાયુઓને સંકોચિત પડે જ છે. તેમ ન કરવામાં આવે તો




ગોત્રપ્રસારણ કસરત-૧ તથા ૨

માણુસને ઓલાં આવવાં લાગે છે અને તેની રહે તો તેની જીવનશક્તિનો પણ હાસ થાય અને સ્નાયુઓ શિથિલ થઈ જઈ તેની વડોડાકનો ગતથા તેને વિશ્વાનિત ભણે જ નહિ. તથી જ બાંધ શરીરનો ઓક (ટેન) જવા મંડે છે અને તે દરમ્યાન બધા સ્નાયુઓનો સંક્રાચ સ્વાભાવિક એકુદમ દળો પડે છે. શરીરનો એવો સંક્રાચ ચાલુ

પડીને સૂઈ જઈએ ત્યારે સ્નાયુઓનું સંપૂર્ણ શિથિલીકરણ સુગમતાથી થાય છે અને વિશ્રાન્તિ પણ સારી મળે છે. અનેચિછક સિવાયના સધળા સ્નાયુઓનું નિદ્રા દરમ્યાન શિથિલીકરણ થતાં તે સંક્રાય-વિસ્તરણું રહિત બને છે. જગૃતાવસ્થામાં પણ જરૂર સિવાયના સધળા સ્નાયુઓને શિથિલ રાખ્યા શક્યો તાં શરીરને સરસ વિશ્રાન્તિ મળ્યા રહે. વિના કારણું સ્નાયુઓને તંગ રાખવાથી થાક જસ્તી લાગે છે. બિનજરી સ્નાયુઓને શિથિલ રાખવાની આવડત ડેળવવાથી લાંબા સમય જુદી થાક્યા વિના શ્રમ કરી શકાય છે. શિથિલીકરણું આવડત ડેળવવાની ડેટલીક કસરતો નીચે મુજબ છે—

કસરત-૧ : ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે જીભા




શિથિલીકરણ કસરત-૧

રહીને જમણા હાથને ઉપર જાયો લો. આ વખતે આખું શરીર ટઢાર ન ગાખતાં શિથિલ રાખો. પછી જમણા હાથના બધા સ્નાયુઓને શિથિલ કરો; એટલે તે હાથ નિર્દ્વિષ નેવો થઈને નીચે આવશે; અને શરીરની બાલુમાં લટકંતા રહેશે. પછી પુનઃ તે હાથને જાયો લો અને પુનઃ તેના સ્નાયુઓને શિથિલ બનાવીને તેને નીચે પડવા હો. એ પ્રમાણે ૩-૪ વખત કરો. પછી ડાયા હાથને જાયો કરો અને તેના પણ સ્નાયુઓને શિથિલ કરીને તેને નીચે પડવા હો. આમ ૩-૪ વખત કરો.




શિથિલીકરણ કસરત-૨

કસરત-૨ : સીધા જીભા રહેલા. પછી કમરમાંથી થોડા આગળ નમો અને કમર ઉપરના બધા અવધવોના સ્નાયુઓને શિથિલ કરો. આમ થતાં કમરની ઉપરનું ધડ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે નીચે નમશે. પછી પુનઃ સ્નાયુઓને ટઢાર કરીને શરીરને જાયે લાવો અને પુનઃ સ્નાયુઓને શિથિલ બનાવીને શરીરને નીચે જવા હો. આ પ્રમાણે ૪-૫ વખત કરો.



શિથિલીકરણ કસરત-૩

કસરત-૩ : ખુરસી પર બેસો. હવે કમરના પછી પુનઃ શરીરને ટડ્ટાર કરી ઉપર લાવો અને ઉપરના ઘડના સ્નાયુઓને શિથિલ કરી શરીરને પુનઃ શિથિલ કરી નીચે જગ્વા દો. આ ચિંતમાં દર્શાવ્યા પ્રમાણે આગળ નમવા દો. આ પ્રમાણે ૪-૫ વખત કરો. આ વખતે પગના



શિથિલીકરણ કસરત-૪

સનાયુઓને પણ ટંડાર કરવા નહિ. શરીરનું બધું વજન ખુરસી પર નાખીને જેસલું.

કસરત-૪ : ચતા સૂઈ જવ. હવે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડાબા હાથને અને ડાબા પગને જીંચે લો અને તે પગના તથા હાથના સનાયુઓને શિથિલ કરો; એટલે તે પગ તથા હાથ નીચે જમીન પર આવશે. આ પ્રમાણે ૪-૫ વખત કરો. પછી જમણા પગને તથા જમણા હાથને જીંચા લાવીને તેમના સનાયુઓને શિથિલ કરો તથા તેમને નીચે જમીન પર પડવા દો. આ પ્રમાણે પણ ૪-૫ વખત કરો. આ રીતે ચતા સૂઈને સનાયુઓને શિથિલ કરવાનું સરળ પડે છે.

પછી ડેકને જરા જીંચે લાવીને, તેના સનાયુઓને શિથિલ કરો; એટલે માયું નીચે જમીન પર દળી પડશો. આ પ્રમાણે પણ ૪-૫ વખત કરો.

કસરત-૫ : જમીન પર 'શવાસન' ની નેમ ચતા સૂઈ જઈ શરીરના બધા સનાયુઓને શિથિલ કરો. યોડા દિવસના અવ્યાસથી આ છીયા સાધ્ય થઈ શકશે. એકેક હાથ ડે પગને જમીનથી ઉચ્ચી પછી શિથિલ બનાવી જમીન પર પડવા દો.

આમ સંપૂર્ણ રીતે ગાત્રોનું શિથિલીકરણ સાધ્ય થાય એટલે પ્રત્યક્ષ જંધ લીધા ચિવાય પણ શરીરને વિશ્રાન્તિ મળું છે અને શરીરને તથા મનને તાજગી પ્રાપ્ત થાય છે.



૧૭. સુયોગ્ય દર્શાવી આતો


સુધ્યારેણ્ણ કલ્યાચરાતો

સમકાયશિરોગ્રીષ: | Posture expresses personality

પણ કાર્યક્ષમતા અને કાર્યશક્તિમાં વિકાસ થાય છે.

સુયોગ્ય દર્શાવી : જીબા, ખેડા કે ચાલતા હોઈએ ત્યારે શરીરની યોગ્ય ટટારી અને સુસ્થિત્વ જળવવી આવસ્યક છે. શરીરનો ઝવાંદાર ઉઠાવ વિકસાવવા અને જળવવાથી આરોગ્ય, સૌધર્ય અને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે; એટલું જ નહિ

જેભી સ્થિતિમાં શરીર લાકડાના સાત ચોરસ દુકડા એક ખીંચ ઉપર ગોઠવી મિનારો બનાવ્યો હોય, તેના નેવું છે. જુઓને-(૧) પગનાં ચાખણાં (૨) નળા સાથે જોડાએલાં છે. નણો (૩) જાંગ સાથે જોડાએલો છે. તેના ઉપર (૪) પેટ અને પેઢ



આવેલાં છે તેના ઉપર (૫) પાંસળાનો માળો (૬) ડેકનાં હાડકાં અને (૭) માથું આવેલાં છે. ડેકનાં હાડકાં મેરુદંડ સાથે જોડાએલાં છે. કરોડ ઓ મણુષુઓનો ૧૫૦ સાંધારોવાળો નમતીય અને સ્થિતિસ્થાપક દંડ છે. તે અહારથી અને અંદરથી વગાંકમાં રહી સર્વકાર બની ધડની સમતુલ્ય જગવે છે. ગુરત્વકેન્દ્રની કંચિત રેખા આપણા માથામાંથી પસાર થઈ કાન, ખલા, કમર, દગરા, ઢીયણ ને ઘૂંઠીના મધ્યભાગમાં થઈ પગમાં જય છે. આથી શરીરની સમતુલ્ય શક્તિના ધોડા વ્યવ સાથે જળવાય છે અને શરીરનો મોહક દેખાવ રલ્યુ થાય છે.

શરીરની સુયોગ્ય ટટારી માટે નીચેનાં લક્ષણો અનિવાર્ય છે—

૧. ઉત્કૃષ્ટ શિર (High head)
૨. ઊચ્કેલી છાતી (High chest)
૩. પાણા ઘેંચેલા ખલા (Retracted shoulders)
૪. અંતર્ગત પેદુ (Abdomen in)
૫. ટટાર પીડ (Straight back)
૬. ઉફફરિત નિતંષ્ણ (Upward tilted pelvis)
૭. આગળ સીધા પગ (Feet pointed forward)

શારીરિક ઝોડો : શરીરની સુયોગ્ય ટટારી વિકસાવવા અને જળવવા માટે દફ અને સંગીત સનાયુઓ કેળવવા જરૂરી છે. સનાયુઓની નણળાઈના કારણે જે તે અવયવમાં શારીરિક ઝોડ ઉત્પન્ન થવાનો સંભવ રહે છે આ ઝોડના પરિણામે શરીરના ઉકાવમાં કદંગાપણું આવે છે. આ શારીરિક ઝોડો સામાન્ય રીતે નીચે પ્રમાણે હોય છે:-


૧. ખૂંખ (Kyphosis)
૨. કમરનો અથ વળંક (Lordosis)

૩. કરોડનો ખાજુ વળંક (Scoliosis)
૪. સપાટ પીડ (Flat back)
૫. આગળ ટગતું માથું (Drooping head)
૬. બેસી ગયેલી છાતી (Flat chest)
૭. ગોળ ખલા (Round shoulders)
૮. આગળ ટગતું પેદું (Protruding abdomen)
૯. રાંટા પગ (Bow legs; Knock knees; Back knees)


૧૦. સપાટ પગ (Flat foot)

ખામી ભર્યા ઉડાવનાં કારણો : ઉપયુક્ત શારીરિક ઝોડો અને તેના પરિણામે ઉત્પન્ન થતા શરીરના ખામીભર્યા ઉડાવને માટે નીચે પૈકી એક યા વધારે કારણો જવાબદાર હોય શકે-

૧. માથાપ તરફથી જન્મથી વારસામાં મળવાને લઈને
૨. ગુરત્વાકર્ષણને કારણે અવયવોના ઘેંચાળને લઈને.
૩. જીવનશક્તિની ખામીના પરિણામે સનાયુઓની નણળાઈને લઈને.
૪. તારણ્યાવસ્થા દરમ્યાન હાડકાં અને સનાયુઓના બિનસમતોલ વિકાસને લઈને.
૫. શિક્ષક અથવા ડ્રેચ આદર્શ વ્યક્તિનો ખામી ભર્યો ઉડાવ આદર્શ કે ફેશન હોવાના ઝોડા ઘ્યાલને લઈને.
૬. અયોગ્ય સાધન સગરડને ઉપયોગમાં લેવાને લઈને; નેમાંકે, વધારે પડતી મોટી ખુરસી કે પાઠકી, વધારે પડતા સંકડા જોડા-વગેરે.
૭. ઊલા રહેતાં, બેસતાં, વાંચતાં, કે ચાલતાં



સાચી રીત



ખોટી રીત

સાચી સ્થિતિનું અસાન અને ખોટી રીતની ટેવ પડવાને લઈને.

૮ અમૂક પ્રકારના ધંધામાં એક જ સ્થિતિ લાંણા સમય સુધી રાખવાને લઈને, જેમણે, દરજી, કારદૂન...વગેરે.

સુધારણા પાછળના હેતુઓ : થાળામાં વિદ્યાર્થીઓની શારીરિક ખોડાના સુધારણા માટે તજવીજ કરવી તે બ્યાયામ શિક્ષકની પ્રાર્થિમિક ફરજ છે. આ શારીરિક ખોડા જન્મગત, ટેવગત કું પરિસ્થિતિગત હોય છે. ટેવગત તથા પરિસ્થિતિગત ખોડા ધણા અંગે કસરતથી સુધારી શકાય છે. વિદ્યાર્થીની દાક્તરી તપાસમાં જે કંઈ ખોડ માલમ પડે તે અંગે બ્યાયામ શિક્ષકે દાક્તર સાથે વિચારણા કરી તેની સુધારણા માટે નીચે મુજબ પગલાં લેવાં જોઈએ—

૧. ખોડનો પ્રકાર શોધી કાઢો.
૨. તેનાં કારણો શોધો.
૩. ખોડમાં વધારો કરતી બાળતો અટકાવો અને દૂર કરો.
૪. જે અવયવ પર અસર થઈ હોય તે અવયવના સ્નાયુઓને ખાસ કરીને અને સમગ્ર શરીરનો ઉકાવ એ બંને બાબતોને લક્ષ્યમાં લઈને સુધારણાનો પ્રયાસ કરો.

૫. વિદ્યાર્થીનો અને તેના વાલાનો ઉત્સાહ અને સહકાર મેળવવા પ્રયત્ન કરો.

૬. વિદ્યાર્થીને તેની ખોડ પ્રત્યે સલાન અને સુધારણા માટે જન્મત કરો.

ખોડ અને સુધારણા : વિવિધ શારીરિક ખોડા અંગે અને તેની સુધારણા ડેવી રીતે થઈ શકે તે અંગે વિગતવાર માહિતી નીચે આપી છે—


૧. કરોડનો પૂછ વળાંક (Kyphosis)

અ. ખોડ અને વિગત : આમાં પડના ઉપરના લાગમાં કરોડનો વધુ પડતો વળાંક (ખૂંધ) હોય છે. આ ખામીના કારણે બેસી ગયેલી છાતી, ગોળ ખલા અને આગળ પડતું માયું, એ નણ ખામીએ ઉત્પન્ન થાય છે.

બ. ખોડવર્ધિક કારણો : ૧. શારીરિક સુસ્થિતિનું અસાન ૨. નમ્રતાનો ખોટો ઘ્યાલ ૩. પીડના સ્નાયુઓની નણળાઈ ૪. પુષ્તાવસ્થા દર્ખાન હાડકાં અને સ્નાયુઓના ઝડપી વિકાસમાં વિસંવાદિતા.

ક. સુધારણાના હેતુઓ : પીડના સ્નાયુઓને સંકુચન દારા મજબૂત બનાવો. વિદ્યાર્થીને સાચી સ્થિતિ માટે સલાન બનાવો.

ડ. સુધારણા કસરતો : ૧. હાથ ખોચી



શરીરની સુયોગ્ય ટટારી તથા અગ્ર-પૂછંગત વિકૃતિઓ

(A-સુયોગ્ય ટટારી; B-ખામી લર્ડોસિસ : અગ્ર શિર, ખૂંધ, કમરનો અગ્ર વળાંક, અગ્ર નિતંખ, પૂછ ઢીચણું; C-ખામી લર્ડોસિસ : અગ્ર શિર, કમરનો અગ્ર વળાંક, અગ્ર નિતંખ, પૂછ ઢીચણું, D-ખામી લર્ડોસિસ : અદ્ય ખૂંધ, વિચલિત સ્ક્રાંધાસ્થિ,)

પર રાખ્યા ડોણીને આગળ અને પાછળ લેા. ૨. દિવાલના ખૂણા સામે જિલા રહી બંને દિવાલ પર એકેક હાથ ખલાની જિંચાઈએ રાખી ‘પાલ દંડ’ કરો. ૩. ભૂજંગાસન અને ધતુરાસન ૪. બંને હાથને પાછળ પૂડ પાસે રાખી (‘વિશ્વામ’ની સ્થિતિ) પાછળ જેંચાણ આપો અને ઢીલા કરો.

૨. કરોડનો અગ્ર વળાંક (Lordosis)

અ. ઝોડ અને વિગત : આમાં કમર પાસે કરોડનો વધુ પડતો વળાંક હોય છે. આના કારણે કરોડના ખધા વળાંકો વધી જય છે અને પેદું આગળ ઢળી પડે છે.

બ. ઝોડવર્ધું કારણો : ૧. પેટના સ્નાયુ-


આની નથળાંછ, ૨. સુસ્થિતિનું અશાન ૩. થાક ૪. ઢળતું પેટ, ૫ ઢીચણુંની અતિટટારી...વગેરે.

ક. સુધારણાના હેતુઓ : પીડના કમર પાસેના સ્નાયુઓનું પ્રસરણ થાય અને પેટના સ્નાયુઓનું અંકુચન થાય તેવી કસરતો દારા સ્નાયુઓને મજબૂત બનાવેા. સુસ્થિતિ માટે વિધાથીને સલાન બનાવેા.

ડ. સુધારણા કસરતો : ૧. ‘કઠોલા’ કસરત એટલે કે કઠિયારો લાકડાં ફ્રાંટો હોય તેવા કુચા. ૨. ‘કમરઝૂક’ કસરત. ૩. પથ્રિમોત્તાનાસન ૪. હલાસન ૫. પોગમુદ્રા...વગેરે.

૩. સપાટ પીઠ (Flat Back)

અ. ઝોડ અને વિગત : આમાં કમર પાસે પીડના વળાંકનો અભાવ હોય છે. પરિણામે કમરની



અવયવોના વિસંવાદી પાર્થ્યપ્રક્ષેપા

(A-ખામી લર્ડોસિસ : ડાયો ખલો જાયો અને આગળ વળેલો, અદ્ય રંટા પગ, B-ડાયી બાજુ વળાંક લેતી કરોડ, ડાયો ખલો જાયો, વિસંવાદી ધડ ઇપરેખા, રંટા પગ અને સપાટ તળિયાં; C-અગ્ર નિતંખ, બેસી ગયેલી છાતી, અગ્ર શિર; D-કમરનો અગ્ર વળાંક, અગ્ર નિતંખ, નીચેની પાંસળાંએ ઉપસેલી).

કાર્યક્ષમતામાં અને કરોડની ગતિક્ષામાં ધરાડો. પેટના અંદરના અવયવોની અવ્યવસ્થા તથા દેખાવમાં દઢંગાપણું ઉત્પન્ન થાય છે.

બ. એઠવર્ધક કારણો : ૧. પોઠ અને કમર-પ્રેશના સ્નાયુઓની નણળાઈ ૨. નિતંણ પ્રેશના ભાગ વધારે પડતો પાછા રહે.

ક. સુધારણાના હેતુઓ : કમરના પીડ નીચેના સ્નાયુઓના સંકુચન તથા પ્રસરણ દારા પીડના નણળા અવયવોને સંગીન અને કાર્યક્ષમ બનાવેલા.

ડ. સુધારણા કસરતો : ધતુરાસન. ૨. સ્વધ્યાસન ઉ. શલભાસન ૪. કમાન દંડ અને કમાન વળાવાની કસરત. ૫. વજાંગ દંડ...વગેરે.

૪. કરોડનો બાજુ વળાંક (Scoliosis)

અ. એઠ અને વિગત : આમાં કરોડના બાજુ વળાંકને લઈને ખબા કરી થાપા જાચા નીચા હોથ છે; જન્મથા જ ઉદ્ભાવેલી ખામી કસરતથી સુધારી શકતી નથી; પરંતુ એઠી ટેવના કારણે હોથ તો કસરતથી સુધારી શકાય છે.

બ. એઠવર્ધક કારણો : ૧. સંખાંધિત સ્નાયુઓની નણળાઈ ૨. એઠી ટેવો ૩. સુસ્થિતિ-તું અસ્થાન.

ક. સુધારણાના હેતુઓ : કરોડના ને તે બાજુના સ્નાયુઓનું યોગ્ય સંકુચન અને વિસ્તરણ કરી કરોડની શક્તિમાં વિકાસ કરવો. સ્નાયુઓની શાયિક સ્થિતિ દૂર કરી મજબૂત બનાવેલા.

ડ. સુધારણા કસરતો : ૧. વડાસન ૨. કમર મરોડ કસરતો. ૩. સીંગલાર પર લટકીને ઓલા ૪. ખુરસી પર બેસી એક હાથ બોચી પર અને બીજે હાથ કમર પર રાખો બાજુ પર નમંદું. ૫. Klapp Method : ધૂંટણું બેસો અને

વિશ્વક દિશાના હાથ અને પગને આગળ મુક્કી ને હાથ પાછળ હોથ તે દિશામાં શરીરનો મરોડ લેતા લેતા ધૂંટણું ચાલેલા.

૫. અય પેટુ (Protruding Abdomen)

અ. એઠ અને વિગત : આમાં પેટના અવયવો નીચે દળી પડે છે અને પરિણામે કુણિયાત, પેટના અવયવોમાં અવ્યવસ્થા અને દર્દ, ચપટી છાતી વગેરે અવરોધો ઉત્પન્ન થાય છે.

બ. એઠવર્ધક કારણો : ૧. પેટના સ્નાયુઓની નણળાઈ-કસરતના અલાવે અને એતિઆહારના કારણે. ૨. ચર્બીનો વધારો. ૩. અયોગ્ય પોપાક.


ક. સુધારણાના હેતુઓ : પેટના સ્નાયુઓને સંકુચન કસરતા દારા મજબૂત જનાવે; જરૂર જણ્ણાં આહાર ઓછા કરો; યોગ્ય પોપાક પહેરો અને તંગ કપડાં કદી ન પહેરો.

ડ. સુધારણા કસરતો : ૧. 'વિપરીત કરણી' આસન કરી પગ વડે સાયકલીંગ કરો. ૨. ચતા જુઈ જઈ 'પેટ ગૂડન' કસરત કરો. ૩. પશ્ચિમોત્તાનાસન. ૪. ડલાસન. ૫. ઉત્તાનપાદાસન.

૬. સપાટ પગ (Flat foot)

અ. એઠ અને વિગત : આમાં પગનાં તળિયાંની કમાનો યોગ્ય વળાંક ધરાવતી હોતી નથી. પરિણામે ચાલતી વખતે આખા પગનું તળિયું જમીનને ચપટ અડકે છે. આનાથી પગમાં દુઃખાવો થાય છે તથા યોડી મહેનત પણી થાક લાગે છે.

બ. એઠવર્ધક કારણો : ૧. સ્નાયુઓની નણળાઈ. ૨. ચાલતી વખતે પગના પંખ ત્રાંસા મુકવાની ટેવ ૩. જાંચી એડીવાળા બૂટ પહેરવાથી. પગની કમાનને તુકશાન થાય છે. ૪. કેટલાક



સુયોગ પગ

સપાટ પગ

વ્યવસાયમાં વધારે સમય સુધી જિભા રહેવું પડતું હોવાથી થતા અતિશ્રમને કારણે. પ. અક્ષમાત પડવા કે ધક્કાના કારણે.

ક. સુધારણાના હેતુઓ: નાની ઉંમરથા પ્રયત્ન કરવામાં આવે તો સુધરી શકે. પગના સ્નાયુઓને સંકુચન આપી મજબૂત બનાવો.

ડ. સુધારણા કસરતો: ૧. પગના અંગુઠા પર ચાલવું. ૨. 'પંખ બેકુક' કરવી. ૩. જિભા રહેવાની સ્થિતિમાં પગનાં અંગળાંને વાળવાં અને સીધાં કરવાં અને રીતે ખસવું. ૪. ઝુરસી પર બેસી જમીન પરથી લખોટાને પગના પંખ વડે વારાદ્ધરતી જિયકવા અને નીચે મૂકવા.

માર્ગદર્શિકા સૂચના

જવનના દરેક તથકે શરીરનું ખુદ્દિપૂર્વક હલનચલન થાય તો શરીરની સુયોગ ટટારી જળવાઈ રહે

અને મોહક તથા કાર્યદક્ષ ટેખાવ પ્રાપ્ત થાય. આ માટે જિલતાં, ચાલતાં, બેસતાં તથા કામ કરતાં નીચેની બાણતો જણવવી જોઈએ.

જિલતાં : (૧) બંને પગ ઉપર શરીરનું વજન આવે તેવી રીતે પગ સહેજ આધા રાખી અંગળાં સીધાં રાખી જિલવું. (૨) ઢીચણું સીધા પણ અક્કડ ન રાખવા. (૩) છાતી સહેજ આગળ પડતી અને પેઢ સપાટ રાખવું. (૪) ગરદન અને માયું શરીર ઉપર ટટાર અને હડપચી અંદર પડતી રાખવી.

ચાલતાં : (૧) અંગળાં સીધાં (૨) ચાલતી વખતે પગ સીધા અને પાસે (૩) તાલણાંધ ચાલ માટે પગલાં નાનાં પાડવાં (૪) પગ જમીન પર પાડતી વખતે પ્રથમ એડી મૂકવી, પછી ચાખખાની ઘણારની બાલુ અને ચાખખાનો આગલો લાગ (૫) હાથ સાહજીક રીતે હાલવા જોઈએ

બેસતાં : (૧) પગ જમીન પરે ટેકાવા જોઈએ. (૨) જંધ ઢીચણના વળાંક સુધી ઝુરસીની બેકમાં આવવી જોઈએ. (૩) થાપાથી તે ગરદન સુધી શરીર સીધું રહે અને વાંસો ઝુરસીની પીડ ઉપર આવે તેવી રીતે બેસવું.

કામ કરતાં : (૧) સોધા, સમતુલાલવાં અને વિશ્રાન્તિલવાં જિલવું. (૨) વાંકા વળવું પડે કે શરીર ખેંચવું પડે એટલું જાચું કે નીચું ટેણલ ન હોવું જોઈએ.

વસ્તુ જિયકતાં : (૧) વસ્તુની પાસે જિલવું. (૨) વસ્તુને શરીર ભણી ખેંચવી (૩) પગ અને ખભાના મજબૂત સ્નાયુઓથી તેને જિયકવી (૪) વધારાનું વજન જિયકવા માટે પગના ચાખખા ઉપર શરીરની સમતુલા જગવવી.



૧૮. પથરનાં ભારે સાધનોવાળો મારેતીય વૃજન વ્યાયામ

હાઈ પણ વ્યાયામ કે કસરતનો પ્રકાર જો વ્યક્તિ-
નાં આરોગ્ય, શરીરવિકાસ અને શક્તિવિકાસમાં
ક્ષાળો આપી ન થાકે તો તે વ્યાયામ નિર્દર્શક છે.
વ્યક્તિનું અને પરિણામે સમાજનું સ્વાસ્થ્ય
જળવાય અને શરીરવિકાસ સધાય એ વ્યાયામ કે
કસરતના કાર્યક્રમ પાણનો મૂળભૂત હેતુ છે. જુના
વ્યાયામપ્રકારો તથા સાધનો માટે એવી ટીકા
કરવામાં આવે છે કે, તેમાં અધતન રમતો તથા

સાધનો નેટલો રસ પડતો નથી. પરંતુ રસ એ જ
વ્યાયામનું અનિવાર્ય લક્ષ્ય ન કેખાવું જોઈએ.
વ્યાયામના કાર્યક્રમમાં રસનો હેતુ ગોણું હોવો જોઈએ
શુદ્ધ શાખ્યીય સંગીત કરતાં ગજદો અને ટોળટોપા
વિશેષ આનંદ આપે તેવાં લાગે છે, પણ તેથા
આપણે શાખ્યીય સંગીતને નિસારી નહિ દઈએ.
વ્યાયામમાં રસનું તત્ત્વ હોય એ ઈષ્ટ છે, પણ
આનંદાધી છતાં શરીરનો વિકાસ ન સાધતા વ્યાયામ



પથરના ભારે જોળા ઉચ્કવાનો વ્યાયામ


કરતાં ઓછો આનંદ આપતા પણ શરીરનો સુખોઽય વિકાસ સાધતા વ્યાયામને જ આપણે પસંદ કરીશું.

અધિકાંશ ગ્રાચીન ભારતીય ઐલોની માઝક નાળ, એકડો, ચકડી, ગદા, પદ્ધતના ગોળા ધત્તાદિ ભારતીય વ્યાયામ પ્રકારને પણ પાશ્ચાત્ય દેશોના પ્રલાવ દેખુણ આપગે ભૂલી રહ્યા છીએ. પરંતુ ભારતીય વ્યાયામપદ્ધતિ સંગીન અને અસરકારક છે તથા પાશ્ચાત્ય વ્યાયામનાં સાધનો કરતાં ભારતીય વ્યાયામપદ્ધતિનાં સાધનો પ્રમાણમાં ધ્યાનાં સસ્તાં, સરળ અને સુલભ છે, એ ભૂલવું ન જોઈએ.

પદ્ધતના ગોળા

મહારાજ્ય અને સંવિશેષ હેંકણ વિસ્તારમાં ગામ

બહાર મંદિરા નજીક પદ્ધતના નાના મોટા અનેક ગોળા પડેલા હોય છે ખાસ કરીને યાત્રાસ્થળ કે પ્રાચીન મંદિર હોય, કે જ્યાં વર્ષમાં એક બે વાર મેળા ભરાતા હોય ત્યાં ધણી મોટી સંખ્યામાં આવા ગોળા દિષ્ટગોચર થાય છે. યાત્રાના પ્રસંગે સૌથી વધુ વજનના ગોળા જિયકવાની હરીકાઈઓ પણ યોજય છે. આવી સ્પર્ધાઓ દ્વારા દરેકને પોતાની શક્તિનું માપ કઢવાની અને તેનું પ્રદર્શન કરવાની તક પ્રાપ્ત થાય છે. કસરત માટેનો આ એક જૂનો પ્રકાર છે. મોટા વજનદાર ગોળા જિયકવાથી હાથ અને પગમાં સારી શક્તિ આવે છે.




પદ્ધતના ગોળાની કસરતો

ગોળા ઊચકવાની રીતો

પ્રથમ ગોળાને ઊચકીને સાથળ ઉપર લેવો. ત્યાર બાદ વધારે ઊચે લઈ છાતી તથા ખલા ઉપર લાવવો અને કેટલુંક અંતર ચાલવું. શરૂઆતમાં

હલકા વજનના ગોળાથી શરૂ કરી ધીમે ધીમે વધારે વજનના ગોળા ઊચકવાનો મહાવરો કરવો.

સૌ પ્રથમ નીચેની આકૃતિમાં દર્શાવેલ ચિત્ર-૧ પ્રમાણે બેસીને ગોળાને પકડવો, પછી ચિત્ર-૨ મુજબ




ઉલા રહીને ગોળાને સાથળ ઉપર લાવવો. ત્યારખાદ ચિત્ર-૩ પ્રમાણે છાતી ઉપર થઈને ખલા ઉપર લઈ જઈ, ચિત્ર ૪-૫ અનુસાર શરીરને પાછળ જુકાવી, પીઠ ઉપર થઈ ગોળાને પાછળ તરફ નાખવો.

નાળા :

પથરને ચૈંડાના આઢાર નેવો ગોળ બનાવી પકડવા માટે તેમાં વર્ચ્યે એક આરો બનાવવામાં આવે છે, જેને નાળ તરીકે ઓળવવામાં આવે છે. લારે વજનના લોખંડના ડમ્પેલ્સ માફક આ નાળનો

ઉપયોગ કરવામાં આવે છે. આવી નાળા વિવિધ વજનની બનાવવામાં આવે છે, જેથી નાળ સાથે કસરત કરનાર પોતાની શક્તિ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે. શરૂઆત કરનારે ઓછા વજનની નાળ બિચકવા સાથે શરૂઆત કરી કુમે કુમે વધારે વજનની નાળ બિચકવાની કસરતો કરવી. આ પ્રમાણે કરવાથી બિચકનારની શક્તિ વધે છે. શારીરિક સૌધર્ય વધારવા માટે આ એક અગત્યનો વ્યાયામપ્રકાર છે. ધણૂ ખરા જૂના અખાડાઓમાં આવી નાળા દિષ્ટગોચર થાય છે. જે કે હવે કેટલીક જગ્યાએ




બે હાથ વડે નાળ બિચકવાનો વ્યાયામ

ખેલકૂદ, જિરનોસ્ટિકસ હર્તયાહિ માટેના કન્ડીરાણીંગ કાર્યક્રમાં પણ નાળનો ઉપયોગ કરાય છે. એકદમ વધારે વજનની નાળ બિચક્વાનો પ્રયત્ન કરવો જોખમી છે, કારણું કે તેનાથી કાયદાને બાહ્યે નુકશાન થાય છે. આથી કુમે કુમે વજન વધારતા જલું હિતાવહ છે.

નાળ એ પ્રકારની આવે છે. એક સામાન્ય નાળ કે જેનું ઉપર વર્ણન કર્યું છે તે અને બીજું ‘ગરનાળ’ કે જેને ‘ચક્કી’ તરીકે પણ ઓળખ-

વામાં આવે છે. આ ગરનાળને ગળામાં ભરાવીને વ્યાયામ કરવામાં આવે છે.

કાર્શી-ઘનારસ તરફ ધ્યાય ખરા જૂના અખાડા-ઓમાં ભારે વજનની નાળા બિચક્વાનો રિવાજ વધારે પ્રયુક્તિ છે. ઘનારસમાં ‘દશાશ્રમેધ’ ધાર નષ્ટક ‘દેવા તેંબ’ નો અખાડો આવેલા છે. આ દેવા તેંબ ભારેમાં ભારે વજન બિચક્વા માટે વિષ્યાત હતા. આ અખાડામાં નેટલી મોટી નાળા છે, તેટલી મોટી ભારતલારમાં બીજી કોઈ અખાડામાં નથી.




શ્રી દેવાતેંબ, શ્રી સહદેવ તથા શ્રી લક્ષ્મીનારાયણ : તેમના અખાડાનાં પથ્થરનાં સાધનો સાથે

દ્વી તેંબના અવસાન પછી તેમનો મોટો પુત્ર સહદેવ
એ અખાડો ચલાવતો હતો અને તેમના અવસાન
બાદ તેમના પુત્ર શ્રી લક્ષ્મીનારાયણે દાદા અને
પિતાની પરંપરા ચાહું રાખ્યા હતી. આ અખાડામાં
સૌથી મોટી નાળનો ધેરાવો ૭ ફૂટ ૮ ઇંચ, ઉચ્ચાઈ

૧૫ ઇંચ, વ્યાસ ૨૦ ઇંચ અને વજન ૨૦ મણિ
નેટલું હતું.

નાળ ઊચકવાની વિવિધ કસરતો :

કસરત-૧ : બન્ને પગની સામે નાળ રાખી



નાળ ઊચકવાની કસરતો

સીધા જિલ્લા રહેવું. પછી આગળ ઝૂકી એક નાળ જમણું હાથમાં અને ખીજ ડાબા હાથમાં પકડી ચિત્ર-૧ પ્રમાણે જિલ્લા રહેવું. ત્યારબાદ ચિત્ર-૨ પ્રમાણે જમણું હાથ કોણીમાંથી વાળી નાળને જમણું ખસા પાસે લાવવી અને પાછી મૂળ સ્થિતિમાં ચિત્ર-૧ પ્રમાણે લઈ જવા. તે જ પ્રમાણે ડાબા હાથમાંની નાળને પણ જમણું હાથ માફક જ ઉપર લઈ જવી અને મૂળ સ્થિતિમાં લાવવી.

કસરત-૨ : પ્રથમ ચિત્ર-૧ મુજબ જિલ્લા રહેવું. ત્યારબાદ ચિત્ર-૩ પ્રમાણે બન્ને હાથ નાળ સાથે જિચે લઈ જવા અને મૂળ સ્થિતિમાં આવવું.

કસરત-૩ : ચિત્ર-૨માં દર્શાવ્યા પ્રમાણે જમણું હાથની નાળ ખસા પાસે લાવવી. ત્યાર બાદ જમણું હાથ નાળ સાથે ઉપર સીધે જિચે કરવો અને મૂળ સ્થિતિમાં આવવું. તે જ પ્રમાણેની ક્રિયા ડાબા હાથ વડે પણ કરવી.

કસરત-૪ : ચિત્ર-૧ માં દર્શાવ્યા મુજબ નાળ પકડીને જિલ્લા રહેવું. ત્યારબાદ બન્ને હાથ કોણીમાંથી વાળી નાળને ખસાની સામે જિચી આણવી. પછી બન્ને હાથ જિચા લઈ જઈ ટદ્દાર કરી ચિત્ર-૩ પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કરવી. ત્યાર બાદ મૂળ સ્થિતિમાં ચિત્ર-૧ પ્રમાણે આવી જવું.

ચક્કી : નાળનો આ એક પ્રકાર ગળાય છે. ઘણું સ્થળે તેને 'ગરનાળ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચક્કી પથ્થરની બનાવવામાં આવે છે. પથ્થરને ઘડીને, તેની અંદર ગળું ઘાલી શકાય તેવું ગોળ કાણું બનાવવામાં આવે છે આવી ચક્કીએ જૂદા જૂદા માફની અને વજનની બનાવવામાં આવે છે, જેથી દરેક પોતાની શક્તિ મુજબની ચક્કી સાથે ગરદનનો વ્યાયામ કરી શકે. તેઠાના સનાયુઓ મજબૂત કરવા મારે આ અત્યંત ઉપયોગી વ્યાયામની પ્રકાર છે. ઉપરાંત ચક્કીના વ્યાયામથી હાથ, પીઠ, સાથળ વગેરેના સનાયુઓને પણ વ્યાયામ મળે છે.

પહેલવાન ગામા ચક્કી સાથે-નિયમિત વ્યાયામ કરતા હતા.

ચક્કી સાથેની વિવિધ કસરતો :

૧. ચક્કી ઊચ્ચક્વી : પ્રથમ ચિત્ર-૧માં દર્શાવ્યા પ્રમાણે બન્ને હાથ વડે ચક્કી પકડીને બેસવું. ત્યાર બાદ ચિત્ર-૨ મુજબ આગળ તરફ ઝૂકીને ચક્કીને તેઠાં ઉપર લેવી. પછી ચિત્ર-૩ પ્રમાણે બન્ને હાથ જમીન ઉપર ટેઠવી ચક્કી ઊચ્ચક્વી ટદ્દાર થવું અને અદુકડા બેસી હાથના પંખ ધુટણ ઉપર મૂકવા અને હાથ વડે ધુટણ ઉપર વજન આપી ચિત્ર-૪ માં દર્શાવ્યા પ્રમાણે જિલ્લા થવું. પછી એ જ ક્રિયા ઉલટા કુમે કરતા જઈ ચક્કી જમીન ઉપર મૂકવી.

૨. ચક્કી વાલીને ચાલવું : ચિત્ર-૪ મુજબ જિલ્લા થયા બાદ ચક્કી ગળામાં પહેરી રાખીને ચાલવું.

૩. ચક્કી ઘાલીને ઢોડવું : ચિત્ર-૪ મુજબ જિલ્લા થયા બાદ ચક્કી ગળામાં ઘાલી રાખીને ઢોડવું. જો ચક્કી ભારે વજનની ઢોય તો ઢોડતી વખતે બન્ને હાથ વડે છાતીના ભાગ પાસે ચક્કીને સહેજ ટેઠા આપવો.

૪. ચક્કી સાથે એઠક કરવી : ચિત્ર-૪ માં દર્શાવ્યા મુજબ જિલ્લા થયા બાદ ચક્કી ગળામાં રાખીને એઠકો કરવી.

૫. ચક્કી ઉપર ઊચ્ચક્વી : ચિત્ર-૪ માં દર્શાવ્યા પ્રમાણે જિલ્લા રહેવું. ત્યાર બાદ ચિત્ર-૫ માં દર્શાવ્યા મુજબ ચક્કીને ઉપર ઊચ્ચક્વી; તેમજ ત્યાર પછી ચિત્ર-૪ ની સ્થિતિમાં આવવું. આ પ્રમાણેની ક્રિયા વારંવાર કરવાથી હાથના સનાયુઓને કસરત મળે છે.



ચક્કો સાથેની વિવિધ કસરતો

એક્કો

બનારસમાં આવેલા શ્રી દેવીઠેંબના અખાડામાં આ સાધનનો સો પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચિત્રમાં નાના મલખમ જેલું ને સાધન જીલું મૂકવામાં આવેલું છે, તને એક્કો કહેવાય છે.

એક્કાનો ઘેરાવો ૩૦ ઈચ્છ અને ૫૫ સુધીની લંબાઈ કૂટ નેટલી હોય છે; તેમજ તેનો પકડ લોખંડની બનાવેલી હોય છે. તને એક પ્રકારનો નાનો મલખમ અગર તો ખૂબ મોટી સાઈઝનો અગદળ પણ ગણી શકાય. શ્રી દેવીઠેંબ આ એક્કાને એક હાથે તોળાને જિલા રહેતા.



શ્રી લક્ષ્મીનારાયણું દેનીડેંબના અખાડામાંના એકઓ, નાળ, ગદાઓ અને બારબેલ વગેરે કસરતનાં સાધનો દર્શાવતા આ ચિત્રમાં પદ્માદ્ભૂમાં શ્રી લક્ષ્મીનારાયણું ડેંબ જિલ્લેલા છે.

ગદા

ગદા એ દેશી વ્યાયામ પદ્ધતિનું એક અગત્યનું અંગ છે. મહાભારતકાળમાં ભીમ, દૂર્યોધન, જરાસંધ, અલરામ ઈત્યાદિ ધીરો ગદાયુદ્ધમાં પ્રવીણ થાય છે.


હત્થો. આ યુગમાં ગદા એ યુદ્ધનું એક ધારું જ અગત્યનું શસ્ત્ર હતું. પરંતુ આધુનિક યુગમાં ગદાનો માત્ર પ્રદર્શન કે વિવિધ કસરતો પૂરતો ઉપયોગ થાય છે.

એક મજબૂત જડા લાકડા કે જડા વાંસની કાઢીને પથર કે લોખંડનો મજબૂત ગોળો એસાડીને ગદા બનાવવામાં આવે છે. જુદી જુદી શક્તિવળા માણુસો ફેરફારી શક્તિ તે હેતુથી વધારે-આણ વજનની ગદાઓ બનાવવામાં આવે છે. શોલા માટે પથરના ગોળા ઉપર કાપા પાડવામાં આવે છે.

ગદાનો ઉપયોગ બે હેતુથી કરાય છે- ૧. શક્તિપ્રદર્શન માટે અને ૨. બાહુઅળ વધારવા માટે. શક્તિપ્રદર્શન માટે ગદા જમીન ઉપર પણાડી ભાંગવાની સ્પર્ધાઓ યોજનય છે. પ્રત્યેક હરીફને બે તક આપવામાં આવે છે. આ સ્પર્ધાઓમાં હરીફના

વજન કે ભાંચાઈનો કોઈ બાધ રાખવામાં આવતો નથાઃ ગમે તે વજન અને ભાંચાઈ ધરાવનાર, હરીફ તરફાં લાગલાઈ શકે છે. વિનેતાએને ઈનામોથા નવાજવામાં આવે છે. ગદા ભાંગવામાં અત્યાર ચુધીમાં સૌથી વધુ સન્માન બનારસના શ્રી વિષણુ-રામ યાદવે પ્રાપ્ત કર્યું છે. તેમણે ઈ.સ. ૧૯૩૮માં ૬૦ ક્રીલો વજનની એક ગદા ભાંગી હતી, જે આનેય એક વિઠમણ્ણ છે. આહુઅળ વધારવા ગદા વડે નીચે નેવી વિવિધ પ્રકારની કસરતો કરાય છે.

ગદાની કસરતો: કરેલા અને ગદાની કસરતો લગભગ સરળી જ હોય છે, પરંતુ ગદાના ગોળાનું



ગદાની કસરતો

વજન તેના છેક છેડા ઉપર આવેલું હોવાથા કસરતો કરતી વખતે તેને ડેરવગામાં થોડી મુશ્કેલી પડે છે. ગદાની કસરતોથા ખલાના સ્નાયુઓ, કાંડાં અને હાથનાં આંગણાં મજબૂત બને છે.

(૧) ઇમારીનો દાવ :-

પ્રથમ ચિત્ર-૧માં દર્શાવ્યા પ્રમાણે બને ડાખ વડે ગદા પકડાને જિભા રહેવું. પછી ગદાને જિયડીને હાથની મુદ્દી નાક સામે આવે તે પ્રમાણે ઉપર લાવવી. ત્યારણાં ચિત્ર-૨ મુજબ ગદાને શરીરની જમણી બાજુએ થઈ પાણી તરફ લઈ જવી; અને તે જ ઓલાના માત્રત્ય સાથે ચિત્ર-૩માં દર્શાવ્યા પ્રમાણે ડાખી બાજુએ થઈને ચિત્ર-૧ની સ્થિતિમાં પાણી આવવું.

આ પ્રમાણે ટેટલીક વાર કર્યા બાદ ગદાને ડાખી નાનુએ થઈને જમણી તરફ લઈ જવાની કિયા કરવી.

(૨) દુલેરી મુઢે દાલ :-

ચિત્ર-૪ મુજબ બે હાથમાં બે ગદાઓ લઈ લાગે જોડીના 'દુલેરી મુઢે દાલ'ના દાવ પ્રમાણે ડેરવી શકાય છે. પહેલાં બને હાથ વડે જમણી બાજુથા લઈ, પાણી તરફ થઈ, ડાખી બાજુ અને તે જ પ્રમાણે ડાખી બાજુથી જમણી બાજુ તરફ ડેરવી શકાય છે. ગદા ડેરવતી વખતે ધ્યાનમાં રાખવું કે ગદા કરતી હોય ત્યારે શરીરને અડકવી જોઈએ નહિં; તેમજ બે ગદાઓ હોય તો બને એક ખીજન સાથે અથડાય નહિં, તેની પણ કાળજી રાખવી.




૧૯. કાણનાં ભારે સાધનોવાળો ભારતીય પૂજન વ્યાયામ

સંતોલા

આપણામાં એક લઘુતાત્રાંથિ ઘર કરી એડી છે
કે માત્ર વિદેશી વસ્તુઓ—સાધનો જ અન્ધું હોય છે.
વ્યાયામ ક્ષેત્રે પણ આપણે આ લઘુતાત્રાંથિનો ભોગ
બન્યા છીએ; નેમકે, વજન વ્યાયામ માટે ‘ભાર-
એલ્સ’ નેવાં વિદેશી સાધનોને અન્ધું સમજુ તેનો
અશ્રય લઈએ છીએ, પરંતુ આપણા ઘર અંગળે
જૂના સમયમાં શરીરસામર્થ્ય વધારવા ‘સંતોલા’

નામનું એક દેશી સાધન વપરાતું, તેને ભૂલી ગયા
હીએ માત્ર જૂઝ જૂના લોકો કદાચ આ સાધન
વિશે પરિચિત હશે. ભારબેલ્સની ભાઈક જ
સંતોલાનો ઉપયોગ પણ શરીરસામર્થ્ય વધારવાના
કામમાં ઉત્તમ પ્રકારે થઈ શકે છે. ભારબેલ્સમાં વજન
બન્ને છેડે હોય છે, જ્યારે સંતોલામાં વજન
સપ્રમાણું વહેંચાયેલું હોય છે. ભારબેલ્સમાં એક જ
સળાયા ઉપર પ્લેટસ વધારી, ઘટાડી વજનમાં વધારો,




નાના મોટા આકાર તથા વજનના સંતોલા

ઘટાડા કરી શકાય છે, જ્યારે સંતોલા દરેક વજન
માટે અલગ અલગ હોય છે.

સંતોલાનો શર્ધાર્થ જોઈએ તો—‘સ’ એટલે
સમાન, સરખું અને ‘તોલા’ એટલે તોલ, વજન,—

‘સરખું વજન’ એવો થાય. સંતોલા બનાવવા
માટે બાવળ, રાયણ જેવા મજબૂત લાકડાના જૂદી
જૂદી લંબાઈ અને જડાઈના દુંડા લઈ તેને છોલી
બાજુઓથા ગોળાકાર બનાવાય છે. આવા દુકડાને
બન્ને છેડે સપ્રમાણ જગ્યા છોડી ૬-૬ ઈંચ લાંબા



‘સંતોલા’ની કસરતો : દાવ-૧

એ ખાડા લાકડાને કેરીને એવી રીતે બનાવવા કે તેમાં હાથનો પંને વાલીને સંતોલાને પકડી શકાય.

સંતોલાનો ઉપયોગ કુસ્તીના ખાડામાં માટી સરળી કરવા માટે પણ કરવામાં આવતો હતો.

સંતોલાની કસરતો સમૂહગત તેમજ વ્યક્તિગત, એમ બન્ને પ્રકારે થઈ શકે છે.

વિદ્યાર્થીઓને સમૂહમાં સંતોલાના દાવ કરાવવાના હોય ત્યારે યોગ્ય અંતરે જિલા રાખવા માટે, ચિત્ર-૧ પ્રમાણેની સ્થિતિમાં જિલા ગણી યોગ્ય અંતર લેવડાવવું; ત્યાર બાદ દાર કરાવવા.

દાવ-૧ (પ્રકાર પહેલો)

સંજગની સ્થિતિ : ચિત્ર-૨ મુજબ બન્ને હાથમાં સંતોલેલા પકડી જિલા રહેવું.

૧. ચિત્ર-૩ મુજબ કમરમાંથી આગળ તરફ ઝૂકી સંતોલાને પગના પંખ પાસે લઈ જવો; પગના ઘૂંઠણું ટંડાર રાખવા.

૨. ચિત્ર-૪ મુજબ ટંડાર થઈ સંતોલાને છાતી નજીક દાઢી સામે લાવવો.

૩. ચિત્ર-૫ મુજબ માધા ઉપર હાથ સીધા કરી સંતોલાને ઉપર લઈ જવો.

૪. ચિત્ર-૪ મુજબ કમ-૨ ની સ્થિતિમાં ફરીથા આવવું.

૫. ચિત્ર-૨ મુજબ સંજગની સ્થિતિ પ્રાપ્ત કરવી.

દાવ-૨ (પ્રકાર બીજો)

સંજગની સ્થિતિ : આગળના દાવ પ્રમાણે (ચિત્ર-૨ મુજબ)

૧. ચિત્ર-૪ મુજબ સંતોલાને છાતી નજીક દાઢી સામે લાવવો.

૨. ચિત્ર-૫ મુજબ સંતોલાને માધા ઉપર હાથ સીધા રહે તે પ્રમાણે લઈ જવો.

૩. ચિત્ર-૩ પ્રમાણે કમરમાંથી આગળ ઝૂકી સંતોલાને પગના અંગુઠા પાસે લઈ જવો; ઘૂંઠણું ટંડાર રાખવા.

૪. ચિત્ર-૨ મુજબ સંજગની સ્થિતિ પ્રાપ્ત કરવી.

ઉપરના બન્ને પ્રકારના દાવ આડ-દસ વખત કરાવવા. તે જ પ્રમાણે ચિત્ર-૬ મુજબ હાથ વડે સંતોલાને પકડીને પણ દાવ કરાવી શકાય.

દાવ-૩

સંજગની સ્થિતિ : આગળના દાવના ચિત્ર-૨ મુજબ બન્ને હાથમાં સંતોલાને પકડીને જિલા રહેવું.

૧. આગળના દાવના ચિત્ર-૩ મુજબ કમરમાંથી આગળ ઝૂકી સંતોલાને પગના અંગુઠા પાસે લઈ જવો.

૨. ચિત્ર-૧ મુજબ છાતી સામે હાથ સીધા રહે તે પ્રમાણે સંતોલાને લાવવો.

૩. ચિત્ર-૨ મુજબ જમણો હાથ નીચે અને ડાયો હાથ ઉપર તરફ રહે તે પ્રમાણે સંતોલાને જિલા કરવો.

૪. ચિત્ર-૩ મુજબ કમરમાંથી આગળ ઝૂકી બન્ને પગ વચ્ચે સંતોલાને લઈ જવો.

૫. ચિત્ર-૨ મુજબ કુમ ત્રણની સ્થિતિમાં ફરીથા આવવું.

૬. ચિત્ર-૧ મુજબ કુમ એની સ્થિતિમાં આવવું.

૭. ચિત્ર-૩ મુજબ કુમ એકની સ્થિતિમાં આવવું.

૮. સંજગની સ્થિતિ પ્રાપ્ત કરવી.

૬૨-૩


સંતોષાને જોકા સાથે ઉપર લઈ જવો.

સજજના સ્થિતિ : આગળના દાવ મુજબ
ખાને હાથમાં સંતોષાને પડીને ટઢાર જિસા રહેણું.

૧. ચિત્ર-૪ મુજબ કમરમાંથા ડાખી બાજુએ દરી

૨. ઉપર પ્રમાણેની ટિયા જમણી બાજુએ દરીને
કરવી.

આ પ્રમાણે આડ-દસ વખત આ કસરત કરવી.



'સંતોષા'ની કસરતો : ૬૨-૨, ૩ તથા ૪


દાવ-૪

સજજની સ્થિતિ : આગળના દાવ મુજબ
અને હાથમાં સંતોલાને પકડી ટઢાર જિલા રહેવું.

૧. ચિત્ર-૫ પ્રમાણે જમણી બાજુ ઇરી સંતોલાને

ખાની સીધમાં સામે લઈ જવો.

૨. ચિત્ર-૬ પ્રમાણે સંતોલાને છાતી પાસે લાવવો.
૩..૪-૫-૬. કમ ૧ તથા ૨ મુજબ સંતોલાને આગળ
તથા પાછળ લાવવા. ડાખી તરફ ઇરી સંતોલાને
ઝોલા સાથેડાખી બાજુએ કમ ૧થી ૬ પ્રમાણે કરવું.



‘સંતોલા’ની કસરતો : દાવ-૫ તથા ૬

૬૧૪-૫

સજજની સ્થિતિ : આગળના દાવ મુજબ બંને હાથમાં સંતોલો પકડી ટટાર જિલ્લા રહેલું.

૧. જરા ડાખી તરફ કરી સંતોલોને ચિન્ત-૧ મુજબ જિયે પકડી રાખવો.

૨. સંતોલાને ડાખી તરફથી જમણી તરફ જુલાવીને લઈ જઈ જિયે રાખવો.

૩. કંડામાંથા હાથ વાળાને ચિન્ત-૨ પ્રમાણે સંતોલાને જરા પાછળ નાખવો.

૪. કંડા સીધાં કરવાં.

૫. જમણી તરફથી ડાખી તરફ ઓલો લઈને સંતોલાને જિયો લઈ હાથ વાળાને ચિન્ત-૩ પ્રમાણે જરા પાછળ નાખવો.

૬. હાથને સીધા કરવા.

આ પ્રમાણે આ દાવ બંને આખુંએ ૮-૧૦ વખત કરવો.

૬૧૪-૬

સજજની સ્થિતિ : આગળના દાવ મુજબ બંને હાથમાં સંતોલો પકડી ટટાર જિલ્લા રહેલું.

૧. ઓલો લઈને સંતોલાને ડાખી ભાજુંએ ચિન્ત-૪ પ્રમાણે જિયે લઈ જવો.

૨. ઓલો લઈને સંતોલાને ડાખી તરફથી જમણી તરફ ચિન્ત-૨ પ્રમાણે જિયે લઈ જવો.

૩. ચિન્ત-૫ પ્રમાણે હાથને વાળાને સંતોલાને ઉપરને ઉપર જ રાખીને જમણી તરફથી ડાખી તરફ ચિન્ત-૬ પ્રમાણે આખુવો.

૪. સંતોલાને આજ રાતંડાખી તરફથી જમણી તરફ આખુવો. ૫ થી ૮, આજ પ્રમાણે ખીજુ ભાજુ.

મોટા સંતોલો

નાના સંતોલા વડે ને બુદ્ધા બુદ્ધા દાવ થાય છે, તે મોટા સંતોલાથી પણ કરાય છે. આવા કારે સંતોલાને જિંબકતાં આંચડો આપવો પડે છે. નમૂના રૂપ ખાસ દાવ નીચે આપ્યા છે.



'મોટા સંતોલા'ની કસરતો

૬૧૪-૭

સજજની સ્થિતિ : ચિન્ત-૧ પ્રમાણે ચતા સૂઈને સંતોલાને માથાની પાછળ મુકીને પકડવો.

૧. સંતોલાને હાથ વાળ્યા વિના જાંચીને ચિન્ત-૨ પ્રમાણે છાતી સામે જાંચો લાવવો.

૨. હાથને ડોણીમાંથા વાળાને સંતોલાને છાતી પાસે લાવવો.

૩. હાથને ટટાર કરી સંતોલાને જાંચે લઈ જવો.

૪. સજજની સ્થિતિમાં સંતોલાને માથા પાછળ જમીન પર લઈ જવો.

સજજની સ્થિતિ : ચિન્ત-૧ પ્રમાણે પીઠ ઉપર ચતા સૂઈ પાછળ તરફ હાથ લંખાવી સંતોલાને પકડવો.

૧. ચિન્ત-૨ પ્રમાણેની સ્થિતિમાં સંતોલાને લાવવો.

૨. ચિન્ત-૩ પ્રમાણેની સ્થિતિ મુજબ બંને પગ ઘૂંઠણુમાંથા વાળી પગનાં તળિયાં ઉપર સંતોલાને મૂકવો.

૩. પગનાં તળિયાં ઉપર સંતોલાનું સમતોલન રાખી પગને ઉપર તરફ સીધા કરવા.

૪. પગને ધુટણુભાંથી વાળો કુમ-રની સ્થિતિમાં
લાવવા. આ પ્રમાણેની કસરત ૮-૧૦ વખત કરવી
આ સિવાય બારબેલ્સ વડે જ આધુનિક
કસરતો કરીએ છીએ તે તમામ કસરતો સંતોષા
વડે પણ કરી શકાય છે.

જડ જોડી (ભારે મગદળ)

સુદ્ધ શરીર બનાવવા માટે જેટકી આવશ્યકતા
દંડ પીલવાની છે, તેટલી જ આવશ્યકતા સુગઠિત
શરીર બનાવવા માટે જોડાની છે. જોડાની કસરતોથી
ખલા, હાથ, કાંડાં, પીકના સનાયુઓ, છાતીના સનાયુઓ



અનારસમાં વિખ્યાત ડાંડલટ નાનાની વ્યાયામશાળામાં જડ જોડાના દાવ કરતા વ્યાયામવીરો.

અને પગ સવિશેષ મજબૂત યાય છે. સાગ, સીસમ, જેર ઈત્યાદિના લાડામાંથા મુખ્ય એ પ્રકારની જોડી બનાવવામાં આવે છે. ૧. જૂના સમયની વ્યાયામશાળાઓમાં વપરાતી લારે વજનની જોડી; ૨. હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સમૃદ્ધ વ્યાયામ કરાવવા

વપરાતી હલકા વજનની જોડી. લારે વજનની જોડી (૪૩ જોડી) ૨૦ ક્રીલોથા માંડી ૪૦ ક્રીલો વજન સુધીની બનાવવામાં આવે છે, જ્યારે શાળાઓમાં વપરાતી જોડી વજનમાં વધુમાં વધુ ત્રણ ક્રીલો સુધીની હોય છે.




બનારસમાં શ્રી દેવી તેંબના અભાડામાં વપરાતી વિવિધ પ્રકારની જોડીઓ જેવી કે અણીચાળા ઘીલા, જડેલી જોડી, તલવારની ધારવાળાં પાનાં જડેલી જોડી, માટી લગાડીને વધારે વજનદાર બનાવેલી જોડી ઈત્યાદિ સાથેનું શ્રી લક્ષ્મીનારાયણ તેંબનું ચિત્ર.

દેરી વ્યાયામ પદ્ધતિમાં જડ લેડીની કસરતો વિશેપ પ્રચલિત છે. ખાસ ક ને દંડ-એઠકનો વ્યાયામ કરતી વખતે વચ્ચે વચ્ચે લારે મગદળની કસરતો કરવાનો રિવાજ જુના સમયમાં પ્રચલિત હતો. ઓમ મનાતું કે જ્યારે દંડ કરવાથી હાથના

સનાયુએ ભરાઈ જથ અને હાંક ચઢે ત્યારે ભારે મગદળ દેરવવાથી હાથના સનાયુએ અને શ્વાસો-દ્વારાસની કુદ્યાને રાહત મળે છે.

ખાસ કરીને બનારસ તરફ વજનવાળા લેડીએ દેરવવાનો રિવાજ વિશેપ પ્રચલિત છે. બનારસમાં



ભારે લેડીની કસરતો : લેડી બેંચથીને બાહુએ ઉપર લેવી

કેંદ્રભાગ નાનાનો અખાડો અને દેણી તેંબના અખાડામાં વિવિધ વજન અને પ્રકારની જોડીઓ ફેરવવાનો વ્યાયામ હજુએ પ્રચલિત છે. આ સાથેના ચિન્તામાં બંને વ્યાયામશાળાઓમાં વર્પરાતી ૭૩ જોડીઓના વિવિધ પ્રકારોનાં ચિન્તા પ્રસ્તુત છે.

ખીલા તેમજ તલવારની ધારવાળાં પાનાં

લગાડેલી જોડીઓ ફેરવતી વખતે વિશેષ કૌશલ્યની આવસ્થાકારી રહે છે. કારણું કે આવી જોડી ફેરવતાં જો તે શરીરને સ્પર્શી જાય તો ભારે ઈંગનોં થવાની શક્યતા છે.

૭૬ જોડીના ફાવ


જોડીઓ ઉચ્ચકીને ખાહુંઓ ઉપર લેવી :



ભારે જોડીની કસરતો : બગલો

સૌ પ્રથમ પૃષ્ઠ ૧૭૩ માં ચિત્ર-૧ માં દર્શાવ્યા પ્રમાણે જોડી સામે બન્ને પગ વચ્ચે ૪૫ ડ્રેન્ટીમીટર લેટલું અંતર રાખી ટટાર બિલા રહેવું. (જોડીના દાવ કરતી

વખતે ચઢી અને બનિયન્તે પોપાક વિશેષ સગવડ- ૩૫ છે.) ત્યાર બાદ ચિત્ર-૨ પ્રમાણે આગળ તરફ જૂડી જોડી પકડવી અને ચિત્ર-૩ માં જતાવ્યા



ભારે જોડીની ઉસરતો

પ્રમાણે ઓલા સાથે નેડી પાછળ જવા દેવી; તેમજ તેના અનુસંધાનમાં જ નેડીને આગળ ઓલા સાથે લાવી ચિત્ર-૪ માં બતાવ્યા પ્રમાણે બાહુઓ ઉપર લાવવી.

બગલી (દાવ પહેલો) :- આ દાવમાં બગલની નીચે થઈને મગદળ આગળ આવતો હોવાથી તેને ' બગલી ' કહેવાય છે.

આ દાવ શરૂ કરવા મટે નેડીઓને બાહુ ઉપર ખીધા બાદ પૃષ્ઠ ૧૭૪ માં ચિત્ર-૧ પ્રમાણે જમણુા હાથ વડે સામે લાવવી. ત્યાર બાદ નેડીનો છેડો ચિત્ર-૨ પ્રમાણે જરા પાછળ નમાલીને ખલા ઉપર થઈને પાછલી બાજુઓ લાવવો. પછી ચિત્ર-૩ પ્રમાણે તે છેડો બગલની નીચે લાવી આગળની બાજુઓ લાવવો. આ ક્રિયા પાછી ઉલ્લટો કુમભાં કરવી. નેડીને પાછળ લઈ જઈએ ત્યારે માથા કે શરીરને સ્પર્શ નહિ તેનું ધ્યાન રાખવું. તેમજ હાથના સ્નાયુઓ ઢીલા રાખવા, જ્યારે મૂકુની પકડ મજબૂત રાખવી. ત્યાર બાદ કાણા હાથ વડે પણ ઉપર પ્રમાણેની ક્રિયા કરવી.

બન્ને હાથ વડે બગલીની ક્રિયા બરાબર થવા માટે એટલે પછી ચિત્ર-૧ પ્રમાણે હાથ આગળ ન લાવતાં બાહુ ઉપરથા સીધા જ પાછળ લઈ જઈ દાવ શરૂ કરવો.

મુછે ઢાલ : (દાવ બીજો) આ દાવ કરતી વખતે પીડની બણે ઢાલ બનાવી તેનાથી અટકાવ કરતા હોઈએ તેવો દેખાવ થતો હોવાથી તેમજ ખલાના (સુદૂના) સ્નાયુઓને સવિશેષ કસરત મળતી હોવાથી તેને ' મુછે ઢાલ ' દાવ કહે છે. શરૂઆતમાં તૈયારની સ્થિતિમાં બને બાહુ ઉપર નેડી રાખી જિલા રહી, જમણુા હાથનો મગદળ પૃષ્ઠ ૧૭૫ માં ચિત્ર-૧ પ્રમાણે જિયો લઈ તેનો છેડો માથા પાછળ ડાખી બાજુઓ લઈ જવો. પછી જમણુા હાથની મુશ્કી જમણુા ખલા ઉપર રહે તે પ્રમાણે મગદળ ઇરવીને કરવો.

પકડી ડાખી તરફથી જમણી તરફ અર્ધવત્તીપાટારે ઇરવી ચિત્ર-૨ પ્રમાણે લાવવો. મગદળ પાછળ ફરતી વખતે માથા કે શરીરને અડકે નહિ તે ધ્યાનમાં રાખવું. શરૂઆતમાં જમણુા હાથે આ ક્રિયા વારંવાર કરવી; ત્યાર બાદ ડાયા હાથ વડે મગદળ ઇરવવા. પછી વારાફરતી બન્ને હાથ વડે મગદળ ઇરવવા.


દ્વાહાતી બગલી (દાવ ત્રીજો) પૃષ્ઠ ૧૭૫ માં ચિત્ર-૩ પ્રમાણે બન્ને હાથ વડે મગદળ આગળ લાવવા. પછી બગલી પ્રમાણે ચિત્ર-૪ સુજાપ બન્ને હાથના મગદળ પાછળ લઈ જઈ બગલો નીચે થઈ આગળ લાવવા; તેમજ જિલા ક્રિયા કરી પાછા મૂળ જગ્યાએ લાવવા.

દ્વાહાતી મુછે ઢાલ (દાવ ચોયો) આ દાવ મુછે ઢાલ દાવ કરતાં વધારે અધરો છે. પ્રથમ છાતી ઉપર નેડી રાખીને 'તૈયાર'ની સ્થિતિમાં જિલા રહેવું પછી શરીરનો કમર ઉપરનો ભાગ જમણી તરફ ઇરવી મગદળ જરા જિયો લઈ તેના છેડા પૃષ્ઠ ૧૭૬ માં ચિત્ર-૧ પ્રમાણે ડાયી તરફ રાખી મગદળ પાછળ તરફ લઈ જઈ પાછળનું અર્ધવત્તીપાટારે ચિત્ર-૨ તથા તે પ્રમાણે ઇરવ્યા પછી મૂળ જગ્યાએ લાવવા. આ દાવ કરતી વખતે ડાયા હાથની મુશ્કી ડાયા ખલા ઉપર અને જમણુા હાથની મુશ્કી જમણુા ખલા! ઉપર ચિત્ર-૨ તથા તે પ્રમાણે રહે છે. મગદળને પાછળથી ઇનીને જાયે આણુંતી વરખતે ચિત્ર-૩ પ્રમાણે કમર ઉપરનો શરીરનો ભાગ ડાયી બાજુએ ઇરવવો અને મગદળને આગળ લાવીને તૈયારીની સ્થિતિમાં જિલા રહેવું. આ પ્રમાણેની ક્રિયા વારંવાર કરવી. દાવ કરતી વખતે મગદળ એક ખોજને સમાંતર રહેવા જેઠીએ. ત્યાર બાદ આજ દાવ જમણી તરફથી ડાયી તરફ મગદળ ઇરવીને કરવો.

બન્ને બાજુથી દાવ કરતાં આવડે એટલે એકવાર ડાયી તરફથી અને એકવાર જમણી તરફથી-એમ વારાફરતી બન્ને તરફથી દાવ કરવો.


રમાલી (દાવ પાંચમો) : માથા ઉપર રમાલ બાંધતી વખતે જેવી હાથની કિયા થાય તેવી કિયા મગદળ ફેરવતી વખતે થતી હોવાથી આ દાવને ' રમાલી ' કહે છે. સો પ્રથમ જેડીને છાતી ઉપર ટેકવાને 'તૈયાર'ની સ્થિતિમાં જિલા રહેવું. ત્યાર

બાદ પૃષ્ઠક ૧૭૮માં ચિત્ર-૧ પ્રમાણે જમણો હાથ જાંચો કરી તેની સુંધરી કપાળની સામે આવે તે પ્રમાણે મગદળને રાખવો. પછી તેને પાછળ નાખી પોઠ પાછળ થઈ ડાખ્યા તરફથી જમણી તરફ ફેરવીને મૂળ જગ્યાએ લાવવો. આ પ્રમાણે પ્રથમ જમણા



લારે જેડીની કસરતો : દોહાતી સુંદુ ઢાલ

કરેલા



ભારે જોડીની કસરતો : ઇમાલી તથા સુદ્ધાદાવ

હાથ વડે મગદળ ફેરવવાનો મહાવરો કરવો. ત્યાર આદ ડાખા હાથ વડે મહાવરો કરવો. અન્ને હાથ વડે ખરાખર ફેરવતાં આવડી જય પછી જમણ્ણા, ડાખા એ પ્રમાણે વારાફરતી અન્ને હાથ વડે જોડી ફેરવવી. આ પ્રમાણે અન્ને હાથ વડે જોડી ફેરવીએ ત્યારે ચિત્ર-૨ પ્રમાણે દેખાશે.

મુદ્દાનો દાવ (દાવ છ્ટો) : સૌ પ્રથમ જોડી છાતીને ટેક્ઝીને 'તૈવાર'ની સ્થિતિમાં બિલા રહેવું. ત્યાર આદ જમણ્ણા હાથમાંનો મગદળ ડાખા ખલા ઉપર અને ડાખા હાથમાંનો મગદળ જમણ્ણા ખલા ઉપર ચિત્ર-૩ પ્રમાણે રાખીને બિલા રહેવું. ૫૨ંતુ આ વખતે હાથની સુદ્ધી ચિત્ર-૩ પ્રમાણે ન રાખતાં છાતી સામે રાખની. પછી અન્ને હાથ ચિત્ર-૩ પ્રમાણે ઊચા લઈ અન્ને મગદળને પાણી તરફ લઈ જવા. ડાખા હાથવાળા મગદળનું જમણ્ણી તરફથી અને જમણ્ણા હાથમાંના મગદળનું ડાખી તરફથી ચિત્ર-૪ પ્રમાણે ચંક લેવું-અને જોડી મૂળ જગ્યાએ લાવવી. આ કુસરત વારંવાર કરવી.

ગદાયુદ્ધનો જમાનો વીતી જવા સાથે તેના પ્રમાણુમાં એક હલકું સાધન અસ્તિત્વમાં આવ્યું, તે 'કરેલા'. જો કે આજની પેઢી માટે તો 'કરેલા', એ પણ અતીતની વાત બની ગઈ છે. ૫૨ંતુ કેટલાક જૂના અખાડાઓમાં વ્યાયામ માટેનાં અનેક ઉપકરણોમાં 'કરેલા' એક મહત્વનું સાધન હતું. કરેલા બાવળ, સાગ, સીસમ, ઘેર, રાયથુ ઈંઈત્યાદિ મજબૂત વૃક્ષોના લાકડામાંથી બનાવાય છે. કરેલા જૂદા જૂદા આકારનાં હોય છે. કેટલાંકને પકડવા માટે પાસે પાસે એ મૂઢ રાખેલી હોય છે. કેટલાંક ગોપુરચિના આકારનાં હોય છે. કેટલાંક મૂડમાંથી નીચે સરી ના જય તેટલા માટે તેમાં મૂડની નીચે પાંચ સેન્ટીમીટરનો ગોળાફાર ડાંડો બેસાડવામાં આવે છે. સામાન્ય રીતે મૂડની પકડ પાસે ૧૦ થી ૧૫ સેન્ટીમીટર પરિધિ, જ્યારે સામે છેડા નાલ કુદુરુતી અને ૮૦ થી ૧૦૦ સેન્ટીમીટર પરિધિ અને ૬૦ થી ૮૫ સેન્ટી-મીટર જીંચાધના કરેલા બનાવાય છે.

કરેલાના વ્યાયામથી છાતી, ગરદન, ખલા, બાંધ, પાંસળાઓ, કાંડાં આંગળીઓ ઈંઈત્યાદિને કુસરત મળે છે. શરીરાતમાં એણી વજનનું કરેલું ફેરવવું અને નેમ નેમ કાંડામાં શક્તિ આવે તેમ તેમ વધારે વજનના કરેલાંથી વ્યાયામ કરવો.

કરેલાના દાવ :

દાવ-૧ : પ્રથમ પગ કુદરતી રીતે ખુલ્લા રાખ્ણા, જમણ્ણા હાથમાં કરેલાને સીધું પકડીને બિલા રહેવું. ૫૩૦૪૧૮૦માં ચિત્ર-૧ પ્રમાણે સ્ફેર ડાખી તરફ ઝૂકાવવું. ત્યાર આદ-ચિત્ર-૨ પ્રમાણે શરીરની પાછળાની બાજુએ થઈ ડાખી તરફથી જમણ્ણી તરફ ચિત્ર-૩ મુજબ લઈ જવું. અને ચિત્ર-૪ મુજબની સ્થિતિમાં આવે એટલે નીચે આણ્ણી ચિત્ર-૫ મુજબ નાલિ આગળ મૂઢ લાવી ડાખા હાથમાં કરેલાને પકડવું. પછી ને પ્રમાણે જમણ્ણા હાથે દાવ કર્યો

હતો તેનથી ઉલ્લટી દિશામાં ડાબા હાથે કરવો; અને છેવટે ડાબા હાથને નાલિ સામે લાવવો. આ પ્રમાણે વારાફરતી બન્ને હાથ રડે થાકતાં સુધી દાવ કરવો.

દાવ-૨ : અમૂક અંશે આ દાવ પહેલા દાવને મળતો છે. ચિત્ર-૧ પ્રમાણે કરેલાને ડાખી બાજુએ થઈ પીડી તરફ લઈ જઈ ચિત્ર-૨ અને ત૩ પ્રમાણે ઝેરન્યા બાદ ચિત્ર-૪ ની સ્થિતિમાં કારેલું આવે એટલે તેને તરતજ તે ક્રિયાના અનુસંધાનમાંજ ઉલ્લટી દિશામાં એટલે કે જમણી તરફથી ડાખી તરફ થઈ ને ચિત્ર-૧ પ્રમાણે મૂળ ઝેરન્યાએ લાવવું.

અને તે જ પ્રમાણેની ક્રિયા ડાબા હાથ વડે પણ ઉલ્લટી દિશામાં કરવી. આ પ્રમાણેની ક્રિયા વારંવાર કરવી.

દાવ-૩ : બન્ને હાથમાં કરેલાને પકડી નાલિ સામે સીધું રાખવું, પછી ચિત્ર-૫ મુજાય ડાખી તરફથી પાછળની બાજુએ લઈ જઈ જમણી તરફ લાવી મૂળ ઝેરન્યાએ લાવવું. તે જ પ્રમાણે જમણી બાજુથી ડાખી બાબુ થઈ મૂળ ઝેરન્યાએ લાવવું આવી ક્રિયા વારંવાર કરવી.

દાવ-૪ : બન્ને હાથમાં કરેલાને પકડી ચિત્ર-૫ મુજાય ડાખી તરફથી જમણી બાજુ પીડી તરફ થઈ ને




ભારે વજનના કારેલાનો વ્યાયામ

લઈ જવું; અને જમણા ખલા ઉપર બનને હાથની મૂડ આવે એટલે તરતજ પાણી જિલ્લા કિયા કરી ડાખા ખલા ઉપર થઈને મૂળ જગ્યાએ લાવવું. એજ પ્રમાણે જમણી બાજુ તરફથી પણ જિલ્લા કિયા કરવો.

દાવ-૫ : બનને હાથ વડે કરેલાને પકડો

ચિત્ર-૫ સુજાય ડાખી તરફથી શરીરની પાણળની બાજુએ થઈ જમણી તરફ લાવી અને મૂડ નાક સામે આવે તે પ્રમાણે બીજું ચક્ક પણ લેવું. એજ પ્રમાણે જમણી બાજુએ થઈ જિલ્લા દ્વિશામાં બે ચક્ક લઈ મૂળ સ્થિતિમાં આવવું. આવી કિયા વારાફરતી વારાંવાર કરવો.




કરેલાની કસરતો : દાવ ૧ થી ૫

૭૩ લાઠી (ભારે લાઠી)

દેશી વ્યાયામ પ્રકારોમાં જે હાલમાં થોડા ધણું અવંત પ્રકારો હોય તો તે લાઠી અને લેઝ્રિમ

છે. પ્રત્યેક વ્યાયામશાળા અને શાળાઓમાં હજુથે લાઠીનું શિક્ષણું આપવામાં આવે છે.

લાઠી શીખનારાઓએ હલકા વજનની લાઠીથી



૭૩ (ભારે) લાઠીની કસરતો

શરૂઆત કરી ધીમે ધીમે વધારે વજનની લાડીથી દાવ કરવા જોઈએ.

ભારે વજનની લાડી મજબૂત વાંસની, તું ક્રિયા નેટલા વજનની અંન જમીનથી કાનની ખુટ્ટ સુધી પહેંચે તેટલી લાંખી હોવો જોઈએ, જ્યારે તેનો પરિધ પ સે. મી. નેટલો હોવો જરૂરી છે કે નેથી સારી રીતે પકડ લઈ શકાય. લાડીના જડા ભાગ તરફ લોખંડની જડી સર્ગી વીંટાળવામાં આવે છે. સર્ગી સરકી ન જાય તે માટે સર્ગી નીચે લોખંડના જડા પતરાનો ચાપડો બેસાડવામાં આવે છે, જ્યારે હાથ વડે પકડવાના ભાગ ઉપર પિતળનો ચાપડો બેસાડવામાં આવે છે.

ભારે વજનની લાડી ફેરવવાથી હાથના સનાયુઓ તેમજ શરીરના અન્ય અંગોને પણ વ્યાયામ મળે છે.

જડ લાડીના દાવ :

વેલ : (પ્રકાર પહેલો) : ડાયો પગ આગળ મૂકો ચિત્ર-૧ પ્રમાણે ઊભા રહેવું. પછી જમણો પગ આગળ મૂકો લાડીને ઉપરથી નીચે લાવો ચિત્ર-૨ પ્રમાણે ડાયી બાજુ ફેરવવો. પછી ચિત્ર-૩ પ્રમાણે પાછળ તરફ મોંઢું ફેરવી લાડીને ઉપર તરફ આણી જમણી બાબુથી ગોળ ફેરવીને ચિત્ર-૪ પ્રમાણે ડાયી બાજુ પાછળ લાવવો. પછી તે બાજુનું વર્તુંણ ફેરવીને લાડી ઉપર આવે કે તરત મોંઢું ફેરવાને ચિત્ર-૫ પ્રમાણે લાડીને આણવી. ત્યાર બાદ જમણી બાજુ લાડી નાખીને તેને નીચેથી ઉપર લાવવી અને ચિત્ર-૬ મુજબ રાખવી. પછી ડાયી બાજુથી લાડીને નીચેથી ઉપર વર્તુંણાકાર ફેરવવી અને ઉપર આવે કે ઉપરથી પાછળની બાજુ લાડીને નાખીને તેજ બાજુનું વર્તુંણ ફેરવવું. ત્યાર બાદ જમણી બાજુએ ઉપરથી પાછળ લાડી નાખીને અને જમણી બાજુનું ચક ફેરવીને પાછળ મોંઢું કરી ચિત્ર-૧ પ્રમાણે ઊભા રહેવું.

વેલ (પ્રકાર બીજો) : સૌ પ્રથમ ચિત્ર-૧ પ્રમાણે લાડીને પકડીને ઊભા રહેવું. પછી ડાયી તરફથી લાડીને ઉપરથી નીચે નાખીની અને તેજ વખતે આગલો ડાયો પગ પાછળની બાજુએ મૂકવો તથા જમણી બાજુનું ચક ફેરવવું. પછી ડાયી બાજુનું ચક ફેરવવું અને તે ફેરવતાં ડાયો પગ આગળ મૂકવો અને પાછળ મોંઢું ફેરવીને જમણી બાજુનું આગળ ચક ફેરવવું. તેજ પ્રમાણે પાછળ મોંઢું રાખીને ડાયી બાજુનું ચક ફેરવવું; તે સાથે જમણો પગ ઊભાવાને પાછળ મૂકવો; તેમજ લાડીનો વાર પાછળથી આગળ નાખો, પાછળ મૂકેલા જમણો પગને આગળ લાવવો અને મોંઢું ફેરવીને ચિત્ર-૧ પ્રમાણે ઊભા રહેવું.

આ પ્રકારમાં પ્રથમ ડાયી તરફનું આગળનું અને જમણું તરફનું પાછળનું ચક ફેરવવું પડે છે. પછી ડાયી તરફથી પાછળનું જમણું તરફથી આગળનું ચક ફેરવવું પડે છે. અને અંતે, તે પછી ડાયી તરફથી પાછળનું અને જમણું તરફથી પણ પાછળનું ચક ફેરવવું પડે છે. એ રીતે એકદર છ ચક ફેરવવાં પડે છે.

આ વેલ ચૌમુખો કે અણમુખો પ્રમાણે ફરવાથી સરસ કસરત મળે છે.

જડ લેઝીમ (ભારે લેઝીમ)

જુના સમયમાં યુદ્ધો વખતે ધનુષ્ય-ધાળુનો ઉપયોગ થતો, બાળુ દૂર સુધી મોકલી શકાય તે હેતુથી જડું, મજબૂત પણ વળી શાક તેથું ધનુષ્ય વપરાતું. આવું ધનુષ્ય વાપરી શકાય તે માટે હાથના સનાયુઓને વિશેષ રૂપે તૈયાર કરવાની જરૂર પડતી. આવું સામર્થ્ય હાથમાં લાવવા માટે ભારે લેઝીમના વિવિધ દાવ કરવામાં આવતા.

‘લેઝીમ’ એ ફારસી ભાષાનો શબ્દ છે; તેનો અર્થ ‘લોખંડના તાર લગાઉલું ધનુષ્ય,’ અથે થાય છે.


હાલમાં ને લેઝીમ બનાવવામાં આવે છે તેની દાંડી, વળી ન શકે તેવા લાકડાની બનાવાય છે. તેથા સાંકળ ગમે તેટલી એંચીઓ તો પણ દાંડી વળતી નથી. જૂના જમાનામાં દાંડી વળી શકે તેવા બનાવવામાં આવતી હતી. દાંડીની સ્થિતિ-સ્થાપકના ખલાસ ન થઈ જય તે માટે ધનુષની દ્વારાને નેમ ઉતારી નાખવામાં આવે છે, તેમ લેઝીમની સાંકળ પણ એક છેઠેથી ઉતારી લઈ શકાય તેવી ગોડવણું કરવામાં આવતી.

હાલમાં સંધ વ્યાયામમાં ને લેઝીમ વપરાય છે તે પ્રમાણુમાં બહુજ નાનું અને હલકા વજનનું હોય

છે. પરિણ્યામે સ્નાયુઓને ને વ્યાયામ મળવે જોઈએ તે મળતો નથા, પરંતુ લયખદ્વારાનો લાલ મળે છે.

૭૩ લેઝીમના હાન :


એંચ પહેલી : સૌ પ્રથમ પૃષ્ઠ ૧૮૪ માં ચિત્ર-૧ પ્રમાણે 'લેઝીમ પવિત્ર' સાથે હોશિયારની સ્થિતિમાં ઉભા રહેવું. પછી ચિત્ર-૨ પ્રમાણે જૂઝી લેઝીમ ડાખા પગની ઘૂંટી પાસે લાવવું અને દાંડી અને કડીને લેગી કરવી. ત્યાર આદ પાછળનો જમણું પગ બિચકી આંગળ મૂકી ડાખા પગની આગળ સવા હાથના અંતરે મૂકવો. પછી પાછળનો ડાખો પગ બિચકીને જમણું



જૂના જમાનાની ૭૩ લેઝીમના વિવિધ પ્રકારો

પગની પાણા મુકવો અને શરીરને ડાખી તરફથી પાણા વાળવું. આ રીતે પગની અદલાભદલી થાય ત્યાં સુધી ચિત્ર-૨ પ્રમાણે જૂડેલા રહેવું: પછી કુમરમાંથી ટટાર થઈ જમણો પગ આગળ લાવી પવિત્ર ઉપર ચિત્ર-૩ પ્રમાણે

લેઝીમ જેંચી જિલા રહેવું: (ચિત્ર૦૩ માં લેઝીમની દાંડી જમણા હાથમાં પકડેલી છે તે ડાખા હાથમાં જોઈએ.) ત્યાર બાદ એકદમ નીચે ઝૂકવું અને ચિત્ર-૨ પ્રમાણે લેઝીમ પકડવું: અને ડાખો પગ આગળ મૂકી જમણા પગને શક્ય તેટલો



૦૩ (ભારે) લેઝીમની કસરતો

છચો લઈ જમણી તરફથી શરીરને પાણી ફેરવવું તેમજ જમણો પગ ડાણા પગની પાણી મૂકવો તથા ટદાર થઈને ચિત્ર-૧ પ્રમાણે ઉલા રહેવું.

એંચ બીજુ : પ્રથમ ચિત્ર-૧ પ્રમાણે ઉલા રહેવું. પછી ચિત્ર-૨ પ્રમાણે ઝૂભને લેજીમ ડાણા પગની ધૂંટી પાસે લાવવું અને દાંડી અને કડી લેગી કરવી. ત્યાર બાદ પાણનો જમણો પગ આગળ લાવો ડાણા પગ સાથે મેળવી 'સાતવાન'ની સ્થિતિ પ્રાપ્ત કરવાં અને લેજીમને ચિત્ર-૪ પ્રમાણે માથા ઉપર લઈ જવું. નજર લેજીમની દાંડી તરફ રાખવી. પછી ડાણા હાથ વડે દાંડીના ભાગને નીચે લાવીને અને જમણા હાથ વડે કડીને ઉપર એંચને ચિત્ર-૫ ની સ્થિતિ પ્રાપ્ત કરવો. ત્યાર

બાદ બન્ને હાથને ઉપર સીધા બંચા કરી દાંડી અને કડી ભેગી કરવી. અંત ચિત્ર-૧ પ્રમાણેની સ્થિતિમાં આવી જવું.

એંચ ત્રીજુ : પ્રથમ ચિત્ર ૧-૨-૪-૫-૧ અને ૨ પ્રમાણેની સ્થિતિ ક્રમાનુસાર કરવી. ત્યાર બાદ ચિત્ર-૫ પ્રમાણે લેજીમને એંચવું. પછી બન્ને હાથ સાથે ઝુકવીને ચિત્ર-૨ પ્રમાણે લેજીમને નીચે એંચવું. ત્યાર બાદ આલો લઈને ચિત્ર-૩ પ્રમાણે પાણ મોઢું ફેરવી લેજીમને સામે એંચવું. ત્યાર બાદ ચિત્ર ૪-૫ પ્રમાણે કિયાઓ કરવી. અને ચિત્ર-૧ પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કરવી.

આ દ્વિમુખી એંચ થઈ. તેજ પ્રમાણે ચૌમુખી એંચ પણ કરી શકાય.




૨૦. પાશ્યાત્ય વજન વ્યાયામ

વેઈટ ટ્રોનિંગ

શરીરના સ્નાયુઓને શક્તિશાળી અને કાર્યક્ષમ બનાવવા તથા શરીરના બાંધને સુદોળ બનાવવા શારીરિક કસરતો કરવી અનિવાર્ય છે. વિવિધ સાધનોનો ઉપયોગ કરીને તથા ડોઈપણું સાધનોનું ઉપયોગ કર્યા વિના ઘણી કસરતો સ્વુચ્છવામાં આવેલી છે. અહીં આપણે સાધનવાળી કસરતો પૈકી “વજન ઉચ્ક” ની ડેટલીક કસરતો વિશે નિયાર કરીશું. વેઈટ ટ્રોઈનીંગ. પાવર લીફ્ટીંગ, બોડી જિંડીંગ, આલિભિપક લીફ્ટીંગ વગેરેનો વજન સાથેની કસરતોમાં સમાવેશ થાય છે

વેઈટ ટ્રોઈનીંગમાં શરીરના સ્નાયુઓ વજનના અવરોધ સામે કાર્ય કરે છે, અને કસરતો દરમયાન

ધીરે ધીરે વજનની માત્રા તથા આવર્તિન વધારવામાં આવે છે, નેના લીધે સ્નાયુઓના કદમાં તથા શક્તિમાં ઉત્તેના વધારે થાય છે. ડેટલાક લોડો વેઈટ ટ્રોઈનીંગનાં પરિણામોથી તથા કસરત કરવાની સાચી રીતાથી જિલ્ડકુલ, અન્ન હોવાથી તથા ડેટલાક પોતાની જતને નિષ્ણુલ સમજ ખોટી રીતો દ્વારા વેઈટ ટ્રોઈનીંગ કરવાના પરિણામે નુકશાન થતાં પોતાની ભૂલ ન સમજતાં ટ્રોઈનીંગ પ્રકારનો હોપ કાઢે છે. અને વેઈટ ટ્રોઈનીંગ દ્વારા સ્નાયુઓ જડ, અફ્કડ તથા નિષ્ટ્ય બની જય છે કે ગંધાઈ જય છે, અથવા તો ચરખીમાં ડ્રેપાંતર પામે છે, અને શરીરને બેડોળ બનાવે છે, તેવો ભ્રામક પ્રચાર કરવા લાગી જય છે. પરંતુ આ તદ્દન અસત્ય છે. વેઈટ ટ્રોઈનીંગ અને વેઈટ લીફ્ટીંગ કરનાર લગસગ ૬૦૦ નેટલી વ્યક્તિઓનો અભ્યાસ કરી ડો. કાર્પોવાચ



વિભ્યાત વેઈટ લીફ્ટર અને બોડી જિંડર : જિમ પાર્ક (અમેરિકા)

અને શ્રી ઓખસિ તારણુ કાઈ એ સાચિત કર્યું છે કે જે વ્યક્તિ પદ્ધતિસર વેદ્ધ ટ્રેઇનીંગ કરે તો તેમના સનાયુઓએ પર ડોઈ વિપરીત અસર થતી નથી; પરંતુ સનાયુઓએ શક્તિશાળી, ઝુડોળ અને ચપળ બને છે તથા સ્થિતિ સ્થાપકતાના ગુણમા વધારો થાય છે. વેદ્ધ ટ્રેઇનીંગ માટે ડો. કાર્પેનીચે યોજેલા બોણ હોક્મેનના પ્રવચન અને નિર્દર્શન દરમ્યાન વિખ્યાત લીલ્ટસ' શ્રી જહોન શ્રીમીક અને જહોન ડેવિસનાં શરીર ડેટલાં ચપળ છે તે બતાવવા માટે ચપળતાની વિવિધ કસરતોનું નિર્દર્શન કરી હાજર રહેલી વ્યક્તિઓને હસાવીને લોથપોથ કરી મુક્કી હતી અને ખાત્રી કરાવી આપી હતી કે વેદ્ધ ટ્રેઇનીંગ દ્વારા સનાયુઓએ અફ્કડ કે જડ બની જતા નથી. વેદ્ધ ટ્રેઇનીંગ દ્વારા ફક્ત હંદયના સનાયુઓએ તથા સામાન્ય સહનશક્તિનો જ વિકાસ થઈ શકતો નથી; આથા વેદ્ધ ટ્રેઇનીંગ કરનાર વ્યક્તિએ વેદ્ધ ટ્રેઇનીંગ ઉપરાંત નોળીંગ, દોરડાં ફૂદ, સાઈકલીંગ તથા તરણુ નેવી પ્રવૃત્તિઓ કરવી નોઈએ, નેથા તેના શરીરનો સર્વાળી વિકાસ થઈ શકે.


વેદ્ધ ટ્રેઇનીંગ દ્વારા શરીરની કાર્યશક્તિ તથા તાકાત વધારવાનો ઘ્યાલ અને વિવિધ રમત-ગમત માટે શરીરના સનાયુઓને શક્તિશાળી બનાવવા વેદ્ધ ટ્રેઇનીંગનો ઉપયોગ કરવાનો વિચાર પ્રાચીન ઓલિમ્પિક વિજેતા અને શ્રીક કુસ્તીથ જ માધ્યેની દૈનિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતાં આવ્યો. માધ્યેની અદ્ભુત શક્તિનું કારણુ એ હતું કે તે તેના આળપણુથી જ નાના વાણરડાને દરરોજ જિચ્કાને ફરતો. આ વાણરડો પુખ્ત ઉભરે પહોંચ્યો, પરંતુ માધ્યેલો તો તેને સહજ રીતે જ તેને જિચ્કાને ફરતો, કારણુ કે વાણરડાના વજનમાં થતા વધારા સામે માઈલોના સનાયુઓમાં શરીકત વિકસતી ગઈ. આને પણ વેદ્ધ ટ્રેઇનીંગમાં માઈલોના આ સિદ્ધાંત [ધીરે ધીરે વજનની માત્રા વધારતાં વજન જિચ્કવાની પ્રથા] નો ઉપયોગ ફરી વિવિધ રમત-ગમત માટે તથા વ્યક્તિની સામાન્ય શારીરિક યોગ્યતા માટે વેદ્ધ

ટ્રેઇનીંગને દૈનિક કસરતોના કાર્યક્રમમાં સ્થાન આપેલું છે.

વેદ્ધ ટ્રેઇનીંગનું મહત્વ

આને દુનિયામાં રમતો મોટા ભાગનો સ્પર્ધા-ત્મક રમતો માટે તથા શારીરિક સ્વસ્થતા માટે શરીરના વિવિધ સનાયુઓએ તથા સાંધ્યાઓને શક્તિશાળી બનાવવા “વેદ્ધ ટ્રેઇનીંગ”નો ઉપયોગ કરવાની દુનિયાના મોટા ભાગના નિષ્ણુત રાહખરો સલાહ આપે છે. વેદ્ધ ટ્રેઇનીંગ દ્વારા શરીરના ખાસ ભાગને જે તે રમત માટે વિશિષ્ટ કસરત આપી તૈયાર કરી શકાતા હોવાથા દરેક સારા જીવાઈ વેદ્ધ ટ્રેઇનીંગ કાર્યક્રમ અપનાવે છે. મોટી રમતાના જીવાડીઓ માટે શરીરના લગભગ અધ્યા જ સનાયુઓએ શક્તિશાળી તથા ચપળ બનવા જોઈએ. કાયું, એંસા, ફૂટબોલ, આસ્ક્રેટબોલ યોલીબોલ, સોઇટબોલ, હોકી નેવી રમતોમાં ફંદું સિવાયની રમતોમાં દોડવાનું વધારે ઢાય છે, તેથા પગના સનાયુઓએ વધારે મજબૂત થવા જરૂરી છે. વિવિધ રમતોમાં ખાસ ઉપયોગી ઢાય તેવા સનાયુઓને નીચે જણ્ણાવેલ કસરતા દ્વારા મજબૂત બનાવી શકાય છે.

ફૂટબોલની રમત માટે ગરદનના સનાયુઓ “રેસલર્સ ઓજ” નામના કસરત પ્રકારથી વિકસાધી શકાય છે. સ્કાંધ અને ભૂજનના સનાયુઓ “પ્રેસ” પ્રકારથી ચેકટોરીયલ્સ સનાયુઓ “સુપાઇન-પ્રેસ” પ્રકારથી પીડના સનાયુ “કલીન” પ્રકારથી, જંધ અને થાપાના સનાયુઓ “સ્ક્રોટ” પ્રકારથી તથા કાંક મસલ્સ બારબેલ સાથે “રાઈજ-ઓન-ટોઝ” નામના પ્રકારથી શક્તિશાળી બનાવી શકાય છે. બાસ્કેટબોલની રમતના જીવાડીઓ પોતાના ડેલોઝડ સનાયુઓને “પ્રેસ, લેટરલ-રેઈજ તથા ફાર્વર્ડ રેઈજ” કસરતપ્રકારથા, ભૂજનોના સનાયુઓને “પ્રેસ તથા કલી” પ્રકારથી, લોઅર-ઐકના સનાયુઓ “કલીન” પ્રકારથી, જંધ અને થાપાના સનાયુઓને “સ્ક્રોટ” પ્રકારથી, કાંક-



સનાયુતંત્ર (પાણિનો દેખાવ)

મસલસને “રાઈજ-ઓન-ટોઝ” પ્રકારથી વિકાસવી શકાય છે. બોડ્યોલની રમતના ઐલાડીઓએ પોતાના શરીરના સનાયુઓના વિકાસ માટે બાસ્કેટ-બોલ પ્રમાણેની કસરતો ઉપરાંત હાથના સનાયુઓને શક્તિશાળી બનાવવા “રીસ્ટ કલ્ફ” પ્રકારની કસરત કરવી જોઈએ. કુલ્લીના ઐલાડીઓ માટે પગ, જંધ, થાપાના, પીઠના તથા ભૂગના સનાયુઓ અનુકૂમે “રાઈજ-ઓન-ટોઝ, સ્ક્રોટ, સુપાઇન પ્રેસ, કલ્ફ અને કલ્લીન તથા પુલ-ઓવર” નેવા કસરત પ્રકારો અપનાવી શક્તિશાળી બનાવી શકાય છે.

ઐલક્રૂદ માટે પણ દોડ, ઝૂદ કે ફેંકની પ્રવૃત્તિ


સનાયુતંત્ર (આગળનો દેખાવ)

મુજબ ઐલાડી પોતાના સનાયુઓને વેછટ ટ્રેઈનિંગ દ્વારા શક્તિશાળી બનાવી પોતાનો આંક સુધારો શકે છે. દોડવીરો માટે ખાસ કરીને સ્કંધ અને ભૂભના સનાયુઓ, પીઠના સનાયુઓ, જંધના સનાયુઓ અને કાઝ-મસલસને શક્તિશાળી બનાવવા અનુકૂમે “પ્રેસ, કલીન, સ્ક્રોટ, અને રાઈજ-ઓન-ટોઝ” કસરતપ્રકારો ઉપયોગી છે. છાતીની સંડુચન-પ્રસરણુની શક્તિ વધારવા માટે “પુલ-ઓવર” કસરતપ્રકાર ખૂબું જ અસરકારક છે. કુસ્તિખાને, બોક્સર્સ, તરવૈયા, જોદ્ખ ઐલાડીઓ, પદ્ધાખાળના ઐલાડીઓ વગેરે માટે પણ વેછટ

ટ્રેઇનિંગ ઉપયોગી છે. તહુપરાંત ફેટલાક સાધાએઓમાં થયેલી ઈજાનોને પણ મટાડી શકાય છે. દા. ત. દુંટથુમાં થયેલી ઈજન મટાડવા પગમાં ભારે સેન્ટલ પહેરો, એથી અથવા ખુરશી પર બેકુક લઈ પગને જાંચો—નીચો કરવો આથી ઈજ મટે છે. આમ રમત-ગમત માટે શરૂરના વિવિધ સનાયુએને શક્તિશાળી બનાવવામાં “વેઇટ ટ્રેઇનિંગ” મહત્વનો ફાળો આપે છે.


સાધનો :

લારતના વ્યાયામવીરો પોતાના શરીરના વિકાસ માટે ૧૬મી સદીમાં ભારે વજનના પથ્થરો તથા ભારે ભગદળનો ઉપયોગ કરતા હતા. આ સાધનોનું લોતિક મૂલ્ય કાંઈ જ ન હતું. પરંતુ આને પથ્થરનાં સાધનોને અદ્દે લોખંડ (સ્ટીલ) નાં આકર્ષક સાધનો ઉપયોગમાં લેવાય છે. વેઇટ ટ્રેઇનિંગ માટે બારબેલ તથા ડંબેલ્સનો ઉપયોગ મુખ્ય છે. લોખંડના મજબૂત અને નજીર ૧.૫ મીટર થા ૨.૦ મીટર લાંઘા ગોળ સણિયાના છેડા પર લોખંડની ગોળ પ્લેટો લરાવવામાં આવે છે. લોખંડની ગોળ પ્લેટો વર્ચ્યે સણિયાની જડાઈ જેટલું કાણું રાખવામાં આવે છે. લોખંડની પ્લેટો આગળ-પાછળ ન સરકે તે માટે અંદર તથા અંધાર લોખંડના ડોલર (સ્કુલાળ) રાખવામાં આવે છે. લોખંડની ગોળ પ્લેટો ૧ કિ. ગ્રામથી ૧૫ કિ. ગ્રામ સુધી વજનની રાખી રાકાય. લોખંડના નાના સણિયાના અન્ને



લોખંડ્સ

છેડા પર લોખંડની પ્લેટો લગાવી હાથમાં પકડી શકાય તેવા બારબેલ તથાર કરી શકાય. આ ઉપરાંત લોખંડનાં ડંબેલ્સનો પણ ઉપયોગ થાય છે. “બેન્ચ પ્રેસ” જેવી કસરતો માટે “પાટલી” અગત્યનું સાધન છે. તે સામાન્ય રીતે જમીનથી ૪૫ થી ૬૦ સે. મી. ઊંચી, ૩૦ સે. મી. પહોળી તથા ૧ મીટર જેટલી લાંઘી હોય છે. જેના એક છેડા-પરના બન્ને પાયા પાટલી ઉપર ૬૦ થી ૭૫ સે. મી. જેટલા જિયા એવી રીતે રાખેલા હોય છે કે જેના પર બારબેલ મૂકી શકાય, જેથી બેન્ચ પ્રેસ જેવી કસરત માટે પાટલી પર પીઠ પર સૂઈ




બારબેલ

સરળતાથી બારબેલ પકડી કસરત કરી શકાય છે. આ ઉપરંતુ લેગ ગ્રેસ માટે પાઠલી તથા પુલી વગેરે સાધનો વેઇટ ટ્રેઈનિંગ માટે જરૂરી બને છે.


કસરતો :

વેઇટ ટ્રેઈનિંગ કાર્યક્રમમાં નીચેની કસરતો જરૂરિયાત પ્રમાણે નિયમિત રીતે કરવામાં આવે છે.


(૧) વોર્મ-અપ (warm-up) : કોઈ પણ લારે અમવાળી પ્રયુત્તિ કરતાં પહેલાં સનાયુઓમાં ઉધા ગ્રેરી તૈયાર કરવાની પ્રયા "ઔજાજ પ્રચલિત છે. બારબેલ્સ જાથે કસરતો કરતાં અગાઉ વોર્મ-અપ કસરત કરવી જરૂરી છે. આ કસરત કરવા માટે બારબેલ પારો એ પગ વર્ચ્યે ખલા નેટલું અંતર રાખ્યા જિવા રહેવું; પછી પૂડું નીચે નમાંની હૃદ્યેણી પગ તરફ રહે તેમ બારબેલ પર પકડ લેવી. પીછે સીધી રાખ્યા વજન ઉચ્ચાંકું શરીરને ટટારું રાખવું તથા હાથ સીધા રાખ્યા બારબેલ જમીનને સમાંતર રહે તેમ જાંખ પાસે રાખ્યા; પછી નીચે નમી બારબેલને જમીન પર મુક્યો. આ કિયા નણું થી પાંચ વખત કરો. ત્યાર બાદ બારબેલને છાતી સુધી



કલ



ગ્રેસ



રોઇંગ



સ્કવોટ

જિયો, અને પગના ઘૂંટણું સુધી લાવો. આ કિયા પણ નણું થી પાંચ વખત કરો. પછી બારબેલને છાતી પાસે લાવી માથા પર જિયે નણું થી પાંચ વખત જિયો. આમ શરૂઆતથી અંત સુધીમાં ઉપરના નણું ઘટકોમાં કુલ નવ થી પંદર વખત વજન જિયક્વાની કિયા થતાં શરીરના સનાયુઓ કિયાશીલ બને છે.

કસરત કરતાર વ્યક્તિની શક્તિમર્યાદા પ્રમાણે ધીમે ધીમે વજન તથા આવર્તન વધારતા જઈ કસરત કરવા. જમીન પરથી બારબેલને જિયક્રી છાતી પાસે અને ત્યાંથી માથા પર જિયક્રી જમીન પર મુક્યો. આગ દશ આવર્તન કરવાં.

સનાયુઓને કિયાશીલ (ગરમ-ટીથાર) કરવા માટે ખીલ પણ એક કસરત છે. બારબેલને જમીન પરથી જિયક્રી માથા પર એવા રીતે લાવો કે નેથી બારબેલ શરીરથી હાથની લંબાઈ નેટદો હું રહે.

(૨) કલ્ : [Curl] : આ કસરત દ્વારા હાયના તથા ભુજના દ્વિમસ્તક રનાયુઓ વિકસે

છે. આ કસરત કરવા હેઠળી આકાશ તરફ, આવે તેમ રાખી બારબેલ પર પકડ લેની, અને સીધા જિલ્લા રહી નંધી ઝુંધી બારબેલને ઉચ્ચકવો. કસરત કરવા માટે હાથને ડ્રાણીમાંથી વાળી બારબેલને છાતી તરફ ઉચ્ચકો અને નંધી પાસે પાંચો લઈ જવ. બારબેલની ગતિ ચાપ આકારે થશે. આ કિયાનાં આડ થી બાર આવર્તન કરવા.


આ જ કસરત બારબેલ પર હાથની હેઠળી આકાશ તરફ આવે તેમ રાખી પકડ લઈ કરતાં “રીવર્સ કર્લ” (Reverse Curl) તરીકે ઓળખાય છે. રીવર્સ કર્લ માટે પ્રમાણુમાં બારબેલનું વજન ઓછું રાખવું.

૩) પ્રેસ : (Press) : ખંખાના અને હાથના ત્રિમસ્તક સ્નાયુઓના સામાન્ય વિકાસ માટે આ કસરત કરવામાં આવે છે. કસરત કરવા માટે પગ સાધારણું ખૂલ્લા રાખો બારબેલ પાસે જિલ્લા રહેવું. હેઠળી પગ તરફ રહે તેમ બારબેલની બન્ને હાથે પકડ લેની. પૂછના ભાગને નીચે લાવી સીધા જિલ્લા થનાં વજન (આરબેલ) ને બન્ને હાથ વડે જિચ્કો. બારબેલ છાતી પાસે આવે ત્યારે માથને સહેજ પાણી નમાની બારબેલને માથા પર લઈ જવો. આ વખતે બન્ને હાથ માથા પર સીધા થવા જોઈએ. ત્યાર બાદ હાથને ડ્રાણીમાંથી વાળી બારબેલને છાતી પાસે લાવી, ફરીથી હાથ સીધા કરી બારબેલને માથા પર લઈ જવો. આમ આ કિયા સતત આડ થી બાર વખત કરવી. આ સમગ્ર કિયા દરમ્યાન હાથ સિવાય શરીરના બીજી કોઈ ભાગનું જરા પણ હલત-ચલતન થધું જોઈએ નહીં. શરીરને સ્થિર રાખવા ખુરશી અથવા અન્ય કોઈ અનુકૂળ જડ વસ્તુના પાટિયા પર કપાળ ટેક્વી આ કસરત કરી શકાય.


(૪) રોઝિંગ : (Rowing) : પીડ પરના સ્નાયુઓને તથા હાથના સ્નાયુઓને કસરત આ કસરત ઉપયોગી છે. પગ સાધારણ ખૂલ્લા રાખો જાને પગ ધૂંટણુમાંથી લગભગ સીધા રાખો, કમરમાંથી કાઢુંનું આગળ ઝુકવું. હેઠળી પગ તરફ રહે તેમ પકડ લેા અને બારબેલને જમીનથી સહેજ ઉચ્ચકો. કસરત કરવા માટે હાથને ડ્રાણીમાંથી વાળી, બારબેલને છાતી પાસે પેકટોરીઅલ-મસદસના નીચેના ભાગને સ્પર્શ કરે ત્યાં સુધી લાવો. પછી હાથને ડ્રાણીમાંથી સીધા કરી બારબેલને પ્રથમની જેમ જમીનને સમાંતર રહે તેમ લટકતો કરો. આ કિયા સતત આડ થી બાર વખત કરવી. આ સમગ્ર કિયા દરમ્યાન હાથ સિવાય શરીરના બીજી કોઈ ભાગનું જરા પણ હલત-ચલતન થધું જોઈએ નહીં. શરીરને સ્થિર રાખવા ખુરશી અથવા અન્ય કોઈ અનુકૂળ જડ વસ્તુના પાટિયા પર કપાળ ટેક્વી આ કસરત કરી શકાય.

(૫) સ્કવેટ [Squat] : સાથળ અને થાપાના સ્નાયુઓ તથા ધૂંટણુના સાંધાને મજબૂત કરવા આ કસરત વધારે અસરકારક છે. આ કસરત કરવા બારબેલ પર સીધી પકડ રાખી તેને ખલા પર મૂકવામાં આવે છે. પગ સાધારણ ખૂલ્લા રાખો સીધા જિલ્લા રહેવું. કટલીક વખત એડી નીચે ઉંઘુરી પેંચે થી પ સે. મી. જરી લાકડાની પાટલી મૂકવામાં આવે છે. આ સ્થિતિમાંથી કસરત શરીર કરવા શરીરને આગળ જુડાયા સિવાય, ધૂંટણુમાંથી તથા કમરમાંથી વાળી પગ પર બેઢક લેવામાં આવે છે. બેઢક લેતાં ધડનો લાગ સીધો રહેવો જોઈએ. શરીરને સીધું રાખી સીધા જિલ્લા થધું. આમ આ કિયાનાં જરાયાત જેટલાં આવર્તન કરવાં. આ કસરતમાં પગના આપા તળિયા પર બેઢક લેવાને બદલે, પંખપર બેઢક લઈને પણ આ કસરત કરી શકાય છે. પરંતુ પંખ પર બેઢક લઈ કસરત કરવાની હોય ત્યારે પ્રમાણુમાં વજન ઓછું રાખવું અને પગના પંખ સહેજ અહારની બાબુ રહે તેમ પગ લેગા રાખવા. આ કસરતનાં દસથી પંદર આવર્તન કરવાં.


આ કસરતમાં બારબેલ પર હાથની પકડ લેતાં એ હાથ વર્ષયે ખલા જેટલું અંતર રાખવામાં આવે છે. પરંતુ આ કસરત કરતાં બારબેલને માથા પરથી નીચે છાતી પાસે લાવવાને બદલે માથા પાણથી ખલા પર લાવી કસરત કરી શકાય છે. પરંતુ આ રીતે કસરત કરવા બારબેલ પર હાથની પકડ લેતાં એ હાથ વર્ષયે ખલા કરેતાં સહેજ વધારે અંતર નાખવું.



સ્પ્રોટ આર્મ પુલ ઓવર



રાઈઝ ઓન ટોઝ



ડેડ લીફ્ટ



ગ્રાપાઈટ રોઈંગ

(૬) પુલ ઓવર (Pull Over) : છાતીના સંક્રયન-પ્રસરણ (શ્વાસોચ્છવાસ) સાથે ઓછા વજનના બારબેલથી આ કસરત કરવામાં આવે તો જ ક્ષયદો થાય છે. ખાસ કરીને ભારે અમવાળી પ્રથમિત્તિ ક્ષયા પછી આ કસરત કરવાથી શ્વાસોચ્છવાસની કિયાને અકૃપથી સાગાન્ય માનાવવામાં ઉપયોગી થાય છે. આ કસરત જમીન પર ચત્તા (પીઠ પર) સૂધ જઈને કરવાની હોય છે. ચત્તા સૂધ હાથ માથા પાછળ સીધા કરી બારબેલ પર હુંદેણી આકારા તરફ રહે તેથી પકડ લેવા. હાથ વર્ચ્યે ખલા જેટલું અંતર રાખવું. કસરત શરૂ કરતાં ફેફસાંમાં હવા ભરો. લ્યાર નાંદ ધારે ધારે ઉચ્છવાસ નાંદાર કાઢતાં, હાથને સીધા રાખી વજનને ચાપ આકારે માથા ઉપરથી પસાર કરી છ.તી પર લાવો. આ વખતે હાથ જમીનને કાટખૂંણે અને સીધા રહેવા જોઈએ. અહીંથી કુરીથી શાસ લેતાં, વજનને મૂળ સ્થિતિમાં (માથા પાછળ) લઈ જવું. આમ આ કિયા દશથી પંદર વખત કરવી. શરદ્યાતમાં વજન ખૂબજ ઓછું રાખવું. માત્ર બારબેલનો લોખંડનો સણિયો પણ પૂરતો થઈ પડે. ધારે ધારે વજન વધારતાં આ કસરત કરવી.

(૭) રાઈઝ - ઓન-ટોઝ (Rise-on-toes) : પગની પીંડીના સ્નાયુઓ (કાફ મસદસ) ને શક્તિયાળી બનાવવા હોય તો ભારે વજનના પ્રતિકાર સામે સ્નાયુઓનું સંપૂર્ણ પ્રસરણ તથા

સંક્રયન થવું જરૂરી છે, ને માત્ર આ કસરત દ્વારા જ થાય છે. કસરત કરવા માટે પ સ્ને.મ્બી. કે થોડી વધારે જનર્ડાઈની લાકડાની પાટલી પર પગના પંન મૂકી જિલા રહેવું. પંન નણું પ્રકારે જોડલી કસરત કરી શકાય છે. બન્ને પંન સહેજ બાહારની તરફ રાખવા; બન્ને પંનને સમાંતર રાખવા; અને બન્ને પંન સહેજ અંદરની ખાજુ રાખી પાટલી પર જિલા રહેવું. આ નણું પ્રકારનો ઉપયોગ કરી કસરત કરવી. બારબેલને બન્ને ખલા પર (બોચી પર) મૂકવામાં આવે છે. શરીર સીધુ રાખ્યી પંન પર જિચા થઈ શરીરને ઉપર તરફ જેંચવામાં આવે છે. પછી ઓડી નીચે મૂકવામાં આવે છ. આમ દશથી પંદર આવતાં કરવાં.

(૮) ડેડ લીફ્ટ (Dead Lift) : કરોડ તથા પીડના નીચેના ભાગના સ્નાયુઓને મજબૂત કરવા આ કસરત ખૂબજ અગત્યની છે. આ કસરતથી હાથની પકડ, ધડ, પગ તથા યાપાના સ્નાયુઓ પણ મજબૂત જને છે. કસરત કરવા માટે પગ સામારણ ખૂબદ્વારા રાખ્યી બારબેલ પાસે જિલા રહેવું. પછી નીચા નમી બારબેલને જિચે. શરીર સંપૂર્ણ સીધુ રાખવું જરૂરી છે. હાથ સીધા રાખ્યી બારબેલને જાંધની જિચાઈએ લટકતો રાખવો. બારબેલ પર હાથની જિલટ-સૂલટ પકડ રાખીને પણ આ કસરત કરી શકાય છે. કમર, ધૂંટણ તથા યાપાને નીચે નમાવી બારબેલને નીચે લઈ જવ. આમ આઠથી બાર આવતાં કરવાં.


(૮) અપ રાઇટ રેઝિંગ : (Up right Rowing) : ટ્રેપેઝિયસ તેલોઈડ અને પીડના સ્નાયુઓને વિકસાવવા આ કસરત કરવી. પગ સાધારણ ખૂલ્લા રાખી બારબેલ પાસે જિલ્લા રહેવું. શરીરને ક્રમરમાંથી આગળ નમાવી બારબેલ પર હુથેળી પગ તરફ રહે તેમ, નજીક રાખી પકડ લેવી. શરીરને સીધું કરી બારબેલને નંધ સુધી જિયડો. કસરત શરૂ કરવા હાથને ડ્રાણીમાંથી વાળી બારબેલને છાતી સુધી જિયે લાવો. બારબેલ પેઢા, છાતી, ગળા કે દાઢી સુધી આવે ત્યારે દરેક વખતે હાથની ડ્રાણી બારબેલ કરતાં જિંચે રહેવી જોઈએ. બારબેલને ધીમે ધીમે નીચે લાવી કસરતનું આવર્તન પૂર્ણ કરો. આમ આ કસરતનાં આઠથી બાર આવર્તન કરવાં.

(૯) પ્રેસ ઓન એન્ચ્ય : (Press on Bench) : છાતીના સ્નાયુઓ તથા હાથના ત્રિમસ્તક અને તેલોઈડ સ્નાયુઓને કરવા માટે આ કસરત વધુ અસરકારક છે. આ કસરત પાટલી પર ચત્તા (પીડ પર) સુઈને કરવામાં આવે છે. કસરત કરવા પાટલી પર ચત્તા સુઈ જવું અને બારબેલ પર હુથેળી બહાર તરફ આવે તેમ પકડ લઈ, હાથ શરીરને કાટખૂણે રહે તેમ સીધા રાખી, બારબેલને છાતી ઉપર રાખો. કસરત શરૂ કરવા હાથને

ડ્રાણીમાંથી વાળી બારબેલને છાતી નજીક લાવો, પછી હાથ સીધા કરી બારબેલને ઉપર જિયડો આવર્તન પૂર્ણ કરો. આમ આઠ થી બાર આવર્તન કરવાં. પાટલીની સગવડ ન હોય તો જમીન પર ચત્તા સુઈ આ કસરત કરી શકાય.


(૧૧) એન્ટ આર્મ લેટરલ રેઇઝ-લાઇંગ : (Bent arm Lateral raise-Lying) : છાતીના સ્નાયુઓ વિકસાવવા આ કસરત ખૂલ્લા જ ઉપયોગી છે, કસરત કરવા એન્ચ્ય પર ચત્તા (પીડ પર) સુઈ જવું. બન્ને હાથમાં એક એક ડંબેલ્સ લેવો. બન્ને હાથને છાતી પર સીધા રાખી સ્થિતિ લેવી. કસરત કરવા, જિંડા શ્વાસ લેતાં હાથને બાજુ પર નીચા લાવી, જમીન તરફ શક્ય તેટલા વધારે એંચ્યો; ત્યાર બાદ શ્વાસ બહાર કાંદતાં હાથને સીધા રાખી, ડંબેલ્સ છાતી ઉપર લાવી જીવા પૂરી કરવી. આમ આઠ થી બાર આવર્તન કરવાં. ધીમે ધીમે ડંબેલ્સનાં વજન તથા આવર્તનની સંખ્યા વધારી આ કસરત કરવામાં આવે છે.

(૧૨) લેટરલ રેઇઝ-સ્ટેન્ડિંગ : (Lateral raise-Standing) ખલાના તેલોઈડ સ્નાયુઓને વિકસાવવા આ કસરત ઉપયોગી છે. કસરત કરનારે પગ સાધારણ પહોળા રાખી ટટાર જિલ્લા રહેવું તથા બન્ને હાથમાં એક એક ડંબેલ પકડવો. કસરત કરવા



પ્રેસ ઓન એન્ચ્ય

એન્ટ આર્મ લેટરલ
રેઇઝ-લાઇંગ



લેટરલ રેઇઝ
-સ્ટેન્ડિંગ

નને હાથને ડંબેલ્સ સાથે, સીધા રાખી બાજુ પરથાં કાન પારો થઈ, માથા પર લાવો. પછી હાથ સીધા રાખતાં, ડંબેલ્સને બાજુ પરથાં જ નિયે સાવધાનની સ્થિતિમાં લાવો. ડંબેલ્સની ગતિ ચાપ આકાર થશે. આ કસરતનાં આકૃથા બાર આવત્ણન કરવાં.

(૧૩) સીટ-અપ : (Sit-up) : પેઢાના (એંડ્રોમીનિલસ) સ્નાયુઓ ગજખૂટ બનાવવા આ કસરત ખૂણ જ ઉપયોગી છે. જમીન પર ચતા (પીડ પર) સૂઈ જવું. નને હાથમાં વજનની લેટ રાખી ઓછી પર (માથા પાછળ) મૂક્ણા. પગ જમીન પર જ સ્થિર રાખ્ણ પડને ઉપર જીયકી બેઠકમાં આવવું; અને ત્યાંથા કરમાંથા આગળ ઝૂકવું. ત્યાર બાદ ચતા સ્વાની સ્થિતિમાં પાણ આવવું. આમ આ કસરતનાં દસ્થા પંદર કે વીસ આવત્ણન કરવાં.

(૧૪) લેગ-રેઇઝ : (Leg-raise) : 'સીટ-અપ'ની લેગ આ કસરત દ્વારા પણ પેઢાના સ્નાયુઓ ગજખૂટ બનાવી શકાય છે. કસરત કરવા જમીન પર ચતા સૂઈ જવું. નને પગને ભેગા રાખ્ણ તથા ઘૂંઠણુંથા સીધા રાખી કરમાંથા આકાશ તરફ ધીમે ધીમે જીયકવા. પડને કાટાખૂણે આવે ત્યાં સુધી પગ જાંચો. પછી ધીમે ધીમે પગને સીધા રાખી જમીન પર લાવો. આમ આ કસરત દરથા પંદર કે વીસ વખત કરવી. નિયમિત કરતું કરતાં આવત્ણનસંખ્યા વધારવી. ડેટલીક વખત પગના પંણ પર વજન (બારભેલ અથવા લોઅંડના સેન્ડસ) મૂક્ણી આ કસરત કરવામાં આવે છે.

વજનવાળા ડંબેલ્સનો વ્યાયામ

આરે વજનવાળા ડંબેલ્સથી કસરત કરવાનો પ્રકાર કુરોપમાં ધણો જ જુનો છે. રાખ્ણી છલિઝા-બેથના સમય દરમાન લારે વજનના ડંબેલ્સ કસરત માટે ઉપયોગમાં સેવાતા હતા, એવો ઉલ્લેખ મળે છે. પણ વર્ષો પહેલાં સીસાનાં લારે વજનો દ્વારા


કસરતો કરવામાં આવતી હતી. પ્રો. સેન્ડસે પણ આરે ડંબેલ્સના ઉપયોગ દ્વારા શરીરસામર્થ્ય મેળનું હતું.

પહેલાં આ પ્રકારની કસરત કરવા માટે જુદા જુદા વજનના અનેક ડંબેલ્સ રાખવા પડતા હતા. પરંતુ હવે બારભેલ પ્રમાણે, ઓછા વતા વજનની લેટ લોઅંડી દાંડાને લગાડીને, ઓછા વતા વજનના ડંબેલ્સ બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે. ઇંગ્રેઝમાં ટર્રી (TERRY) કંપની અને અમેરિકામાં યોર્ક બારભેલ કંપની (YORK BAR-BELL CO.) આવી સગવડવાળા ડંબેલ્સ બનાવે છે, તેમજ કસરતોના જુદા જુદા પ્રકારના ચાર્ટ પણ ત્યાંથા પ્રાપ્ત થઈ શકે છે.

કસરત-૧ : નને હાથમાં ડંબેલ્સને પકડીને તેમજ હાથને સાથળની બાજુએ લટકતા રાખ્ણીને સીધા જિભા રહેવું. પછી નને હાથને ખલાની જિચાઈએ શરીરની આગળ કાટાખૂણે સીધા લાવવા અને તે જ પ્રમાણે હાથ ટટાર રાખ્ણી નિયે લાવવા. આ પ્રકારને ફેર્વર્ડ રેઇઝ (Forward Raise) કરે છે (ચિત્રાંક-૧). આ કસરતથી ખલાના સ્નાયુઓ સારા તૈયાર થાય છે.

કસરત-૨ : બોક્સિંગ કરતી વખતે ડાણીમાંથા હાથને વાળીને જિભા રહે છે, તે જ પ્રમાણે ડંબેલ્સને પકડીને જિભા રહેવું. ત્યાર બાદ ડાણા હાથને ચતો રાખ્ણી ટેંસો (Punch) મારતી વખતે હાથની છિયા ને પ્રમાણે થાય છે, તે પ્રમાણે હાથ આગળ લાંબો કરવો અને પાછળ કેવો. જમણા હાથથી પણ તે જ પ્રમાણે છિયા કરવી. આ છિયાને પંચિંગ મુવમેન્ટ કરે છે. (ચિત્રાંક-૨) આ પ્રકારથી હાથના દ્વિમસ્તક સ્નાયુ (Biceps), ખલાના આગળના ભાગના સ્નાયુ (anterior deltoid) અને છાતીના સ્નાયુ (Pectoralis Minor) ને સારી કસરત મળે છે.

કસરત-૩ : હાથને ચતા, સાથળની બાજુએ




લારે વજનવાળા ડંઘેલ્સ

લટકતા રાખીને જિલા રહેવું. પછી અને હાથને સ્થાને ક્રોણિમાંથી વાળીને, આગળથી ઉપર તરફ કમરની સીધમાં લાવવા અને પુનઃ હાથને મૂળ સ્થિતિએ લઈ જવા. આ કસરતને 'કુ આમ' રેગ્યુલર ક્લે' કહે છે. (ચિત્રાંક-૩) આ કસરતથી દ્વિમસ્તક

સ્નાયુએ મજબૂત થાય છે.

કસરત-૪ : બાંને હાથને હેઠળી પાછળની બાજુ રહે તે રીતે, સીધા બાજુ પર રાખ્યા જિલા રહેવું. પછી ચિત્રાંક-૪માં બતાવ્યા પ્રમાણે ખભાને જિચા નીચા કરીને કસરત કરવી. આ કસરતને 'શાદર'



ભારે ડંબેદસનો વ્યાયામ : કસરત ૧ થી ૪


અગ' કહે છે, આ કસરતથી પીડના ઉપરના ભાગના સ્નાયુઓ (ટ્રેપેન્ઝિલ્સ) ને કસરત મળે છે અને છાતી આગળ તથા પાછળ પહોળી બને છે.

કસરત-૫ : ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઘૂંઠણુમાંથી

પગ વાળીને આગળ જૂઝીને બંને હાથમાં ડંબેદસ પકડીને ઉલા રહેલું. ત્યાર ખાદ બંને હાથને એક સાથે, વચ્ચમાં અટક્યા વગર ઊંચે લઈ ૪૧ા, અને ચિત્રાંક-૨માં બતાવ્યા પ્રમાણે, સીધા ઉલા રહેલું; અને બંને હાથને ડોણીમાંથી ટદાર કરી માથા

ઉપર લાવવા. આ કિયાને 'કન્ટિન્યુઅસ ક્લીન એન્ડ
પ્રેસ' કહે છે. પ્રથમ ડંબેલ્સને ખલા ચુંધી જ
જાંચા લાવવા અને પછી તેને વધારે જાચા લેવા.
એવટે પુનઃ ઉલ્લંઘન કરીને ભૂગ સ્થિતિમાં
આવવું.

કસરત-૬ : આગળ ઝૂકી એ હાથને ડાણીમાંથા
વાળી ડંબેલ્સ પકડી ઊંઘા રહેવું. ત્યાર બાદ
બંને હાથથી એક સાથે હોડી ચલાવતા હોય,
તે પ્રમાણેના કિયા કરવી. આ કિયાને 'રાઇગ
મોશન' કહે છે. આ કસરતથા પીઠના ઉપરના




લારે ડંબેલ્સનો વ્યાયામ : કસરત ૫ થી ૭

ભાગનું સનાયુઓ (ડ્રેપેજિયસ) મજખૂત બને છે.

કસરત-૭ : ચિત્રાક-૪ માં બતાવ્યા પ્રમાણે ડાખેલસને ઉલા ઉપર રાખીને ઊભા રહેવું. ત્યારબાદ બને પગની એડીઓ ઊચી કરવી અને પંજ ઉપર ઊભા રહેવું. ત્યાર પછી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પંજ ઉપર એઠક લેવી અને પુનઃ ઊભા થવું.

કસરત-૮ : બને હાથને સીધા રાખી ઉલા રહેવું. બને હાથ ડાખેલસ સાથે સાથળ ઉપર રાખ્યું હુથેળી શરીર તરફ રહે તેમ પકડ લેવી. ત્યાર બાદ બને હાથને ચિત્રાક-૧ પ્રમાણે ઉપર લેવા અને પુનઃ નીચે લાવવા આ કિયા હોડી ચલાવવા જેવી થાય છે. માટે તને 'રોઈંગ મોશન' કહે છે. આ કિયા સીધા ઉલા રહીને જ કરવાની હોય છે.



ભારે ડાખેલસનો વ્યાયામ : ૧૮ થી ૧૧


કસરત-૯: ચિત્રાંક-૨માં જતાન્યા પ્રમાણે બન્ને
પગને ધૂંટણમાંથા વાળીને જિલ્લા રહેવું. ત્યાર આદ
જમણા દાયમાં ડંબેલને પકડીને એકદમ સામેથી
કંચે લાંબી, માયા ઉપર દાય સીંધો લાવવો અને
સાથે ચાંદે પગને ધૂંટણમાંથા ચોંધા કરવા. આ કિયાને
'બન દેન સ્વીંગ' કહે છે. ઉપર પ્રમાણે કિયા કર્યા આદ
કરી મૂળ સ્થિતિમાં આવાને આગ પ્રમાણેની કિયા
દાયા દાય વડે કરવી. આ પ્રમાણે દાયને બદલીને
આ કસરત વારંવાર કરી શકાય છે.

કસરત-૧૦: પગ ખૂદ્વા રાખીને વભા રહેવું.
ડંબેલને જમણા દાયમાં પકડી રાખવો. ચિત્રાંક-૩
માં જતાન્યા પ્રમાણે ડાખી જાણુ ઝૂકીને, ડાખો દાય
દાયા પગના અંશકાને અડકાડવો અને આ જાથે જ
જમણો દાય ડંબેલસ સાથે કંચે લઈ રહેવા. ત્યાર
આદ મૂળ સ્થિતિમાં આવવું. પકડી ડાયા દાયમાં
ડંબેલસને પકડી, જમણી જાણુ ઝૂકી ઉપર પ્રમાણે
કિયા કરવી.

કસરત-૧૧: ચિત્રાંક-૪માં જતાન્યા પ્રમાણે
ડંબેલસ પકડી જિલ્લા રહેવું. ત્યાર આદ જાંને દાયને
જાણુએ ખલાની હોચાઈએ લાવવા. દાયને ડોણી
માંથા ટદાર રાખવા. પક્ષી પુનઃ દાયને નીચે
લાવવા. આને 'હેઠરલ રેફા' કહે છે.

કસરત-૧૨: બન્ને લાયમાં ડંબેલસ પકડી ટાડુર
જિલ્લા રહેનું. ત્યાર આદ ડાયા દાયને ડોણીમાંથા
વાળી ખલા ઉપર જાંચે લાવવો અને પુનઃ મૂળ
સ્થિતિમાં લાવવો. ત્યાર આદ જમણા દાયને એજ
પ્રમાણે જાંચે લાવવો અને મૂળ સ્થિતિમાં લાવવો.
આ પ્રકારને "ઓફરનેટ કલ્સ" કહે છે. આ
કસરતથી ડિમસ્ટક સ્નાયુઓ (Biceps) સારા તૈયાર
થાપ છે.

કસરત-૧૩: ચિત્રમાં જતાન્યા પ્રમાણે કમરમાંથી
ઘોડા આગળ ઝૂકીને જિલ્લા રહેવું. પત્ર ધૂંટણમાંથી
ટદાર રાખવા અને બન્ને દાયને આગળ લટકતા
રાખવા. ત્યાર આદ જમણા દાયને જમણી નરક અને




લારે ડંબેલસની કસરત-૧૩

ડાયા દાયને ડાખી તરફ ખલાની સોધી રેખામાં
લાવવા. પક્ષી પુનઃ બન્ને દાયને મૂળ સ્થિતિમાં
લાવવા. આ પ્રમાણે ૭-૮ વખત કસરત કરવી. તે
દરમાન કમરમાંથી આગળ ઝૂકેલા જ રહેવું. આ
કસરતને • હેઠરલ રેફા હોએલ બેન્ડિંગ' કહે છે.
આ કસરતથી પીડની ઉપરના લાગના સ્નાયુઓને
કસરત મળે છે.

કસરત-૧૪: મુંડા કે ટેણલ પર બેસીને બન્ને
દાયમાં ડંબેલસ પકડી, હાથ ડોણીમાંથા વાળી ખલા
ઉપર રાખવા. ત્યાર આદ બન્ને દાયને ઉપર સીંધા
કરવા અને કરી નીચે મૂળ સ્થિતિમાં લાવવા. આ
કિયાને 'ડુ આર્મ' પ્રેસ 'હોએલ સીટીંગ' કહે છે.
આ કસરત બેસીને કરવાથી દાયના સ્નાયુને
વધારે અમ આપવો પડે છે.

સ્થિરંગાખારનો વ્યાયામ

ચિત્રાંક-૧: પ્રમાણે સ્થિરંગાખાર (ઓલા લઈને
કસરત કરવાનો આરણેલ) બામનું એક સાધન
અમેરિકાની યોર્ક બારણેલ કંપનીએ બનાવ્યું છે.
આ સાધનનો દાંડા લોખાંનો હોય છે; અને તેની
નડાઈ ૧ દિન તથા લંબાઈ ૧૮ દિનની હોય છે.
આ દાંડામાં બે મોટી ટેખાતી ચક્કાઓ નવીન
તરેહના સિમેન્ટ પદ્ધરના પાકા મિશ્રણથી બનાવેલી
હોય છે, ને સ્થિરંગાખાર તરીકે ઓળખાય છે. આ



સ્વંગબાર

દરેક ચક્તીનું વજન ૧૫ રતલ હોય છે. આ ચક્તીઓ કસરત કરતી વખતે નીકળી ન જય તેમજ ખસીને હાથ ઉપર ન આવે, તે માટે ચોકાંદી કમાનોનો ઉપયોગ કરી દાંડા સાથે જરૂરી રાખવામાં આવે છે. સ્વંગબારમાં વજનનો વધારો કરવા


માટે આ સાથે અણી રતલી, પાંચ રતલી, અને સાડાસાત રતલી એવી બે-બે ચક્તીઓ જુદી રાખવામાં આવે છે, જે સ્વંગબાર સાથે જોડી હેતાં દાંડાનું વજન ૩૦ રતલ સુધી વધારી શકાય છે. આમ બે ચક્તીઓનું વજન ૩૦ રતલ, દાંડાનું

વજન પર રતલ અને આ છૂટી ચકતીઓનું ૩૦ રતલ વજન ઉમેરતાં એંડાંદરે ૬૫ રતલ વજનનો આ સ્વિંગબાર કહી શકાય.

આ દાંડાથી જુદા જુદા પ્રકારની કસરતો ડેવી રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી સભર નકશો (ચાર્ટ) પણ તૈયાર મળે છે. તેમાં ૪૮ પ્રકારની

કસરતો આપેકી છે. આ ચાર્ટ અમેરિકાના “સ્ટ્રોંગ એન્ડ લેન્થ” નામના માસિકના સંપાદક બોણ હોક્કમેને તૈયાર કરેલ છે. બીજી ડોઈ પણ ઉપકરણોથાં ને સનાયુઓને ગરાણર કસરત મળતી નથા, તેને આ પ્રકારથાં સારી કસરત મળે છે.

સ્વિંગબારમાં બીજી એક વિશેષ સગવડ છે.



સ્વિંગબારની કસરતો : ૧થા ૩

તેની ભોઈ એ ચક્તીઓ સાથે રાજેલી છે. તને જુદી કરીને એ છેડે પણ જોડી શકાય છે; એટલે કે ડંબેલ બની જય છે (ચિત્રાંક-૨). આમ થવાથી ભારે વજનના ડંબેલની અનેક કસરતો પણ કરી શકાય છે; અને ચક્તીઓ જામેરીને આ ડંબેલનું વજન પણ વધારી શકાય છે.

સ્વિંગબારની કસરતથી પેટના અને કમરના સ્નાયુઓ સારા તૈયાર થાય છે; એટલું જ નહિ પણ જુદા જુદા અવયવોની કામગીરી પણ સુધરે છે; તેમજ જુદી જુદી અંથિઓના કાર્યને પણ સારી મદદ થાય છે. હંદ્ય તથા ફેસાં મજબૂત થાય છે. હનીઓ થવાનો સંભવ ઓછો રહે છે; અને ઇધિરાલિસરણ સારી રીતે ચાલે છે, તેથા પાચન શક્તિ પણ વધે છે.

કસરત-૧ : સીધા જિલ્લા રહીને દાંડને ડોકની પાછળ રાખવો (ચિત્રાંક-૧). પછી તેને તેજ સ્થિતિમાં રાખી ચિત્રાંક-૨ પ્રમાણે કમરમાંથી આગળ ઝૂક્લું; પીડ સીધી રાખવી. પછી પુનઃ કમરમાંથી ટદાર થઈને મૂળ સ્થિતિમાં આવવું. આ કસરતપ્રકારને ‘એન્ડ ઓવર’ કહે છે.

કસરત-૨ : ચિત્રાંક-૩ પ્રમાણે ‘કુસ્તીખાળે નો પુલ’, (wrestler's bridge) બનાવીને ચતા રહેવું. આ કિયામાં માથું અને પગ ટકની કમાન બનાવવાની હોય છે. માથાને ઈંજ ન થાય તે માટે માથા નીચે ઓશીકું રાખવું અને સ્વિંગબારને છાતી ઉપર રાખવો. ત્યાર બાદ હાથને ટદાર કરી સ્વિંગબારને, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે છાતી ઉપર જિચો કરવો તથા મૂળસ્થિતિમાં લાવવો.

કસરત-૩ : ચિત્રાંક-૪ માં દર્શાવ્યા પ્રમાણે ગરદનના પાછળ સ્વિંગબારને રાખી જિલ્લા રહેવું. બન્ને પગની વચ્ચે લગભગ ૧૫૫ટ જેટલું અંતર રાખવું. ત્યાર બાદ આ સ્થિતિમાંથી બેઠક લેની અને પુનઃ જિલ્લા થવું.


સૂચના :- સ્વિંગબારની ડોઈ પણ હિલચાલ આંચેકો ભારીને કે બહુ ધીમે ધીમે પણ કરવી નહીં. સહજ મધ્યમ ગતિથા દાંડને સફાઈપૂર્વક જવા દેવો. આ દરેક કસરત ૮-૧૦ વખત કરવી અને મહાવરો વધતાં ૧૬ ‘સુધી પહોંચવું’. એજ પ્રમાણે લાંબા મહાવરા બાદ જે થાસ ન ચડે તો કુમે કુમે સ્વિંગબારનું વજન વધારવું. શરદાતમાં સહજ કરી શકાય તેટલું જ વજન સેવું.

સ્વિંગબેલનો વ્યાયામ

સ્વિંગબેલ : સ્વિંગબારના જેવું. ‘સ્વિંગબેલ’ નું સાધન ઇંગ્લેન્ડની ‘જ્યોર્જ’ ગ્રાસ લિમિટેડ, લાંડન’ નામની કંપનીએ તૈયાર કરેલું છે. તેનો લોખંડી દાંડો ૧૫ દંચ લાંબો અને ૨ ફીચ જરો હોય છે (ચિત્રાંક-૧). આમાં પણ બારબેલ પ્રમાણે ઓછાવતા વજનની લોખંડી ચક્તીઓ જરૂર પ્રમાણે જોડી શકાય છે; તેથા આ સાધન દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે ઉપયોગમાં લઈ શકે છે. આ સાધનને જુદી જુદી રીત ફેરવીને તેની જુદી જુદી કસરતો બનાવવામાં આવી છે, જે પૈકી ડેટલીં નીચે પ્રમાણે છે.

કસરત-૧ : સ્વિંગબેલને બંને હાથ વડે માથા ઉપર રાખીને સીધા જિલ્લા રહેવું. પછી ચિત્રાંક-૨માં બતાવ્યા પ્રમાણે એક વખત જમણી બાજુએ તો તો બીજી વખત ડાખી બાજુએ (સ્વિંગબેલ હાથમાં રાખીને જ) કમરમાંથી વળવું. આ પ્રમાણે ૧૦ વખત કરવું.

કસરત-૨ : ચિત્રાંક-૩ માં બતાવ્યા પ્રમાણે પગને પહોળા રાખી, કમરમાંથી આગળ ઝૂકી બંને હાથમાં સ્વિંગબેલ રાખીને જિલ્લા રહેવું. આજ સ્થિતિમાંથી ત્રુટ રેખાથી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બંને હાથને શક્ય તેટલા આગળ લાંબા કરવા અને પુનઃ મૂળ સ્થિતિમાં પાછા આવવું. આ પ્રમાણે ૧૦ વખત કરવું.



સ્વિંગબેલની કસરતો : ૧ થી ૩


કસરત-૩ : ચિત્રાંક-૪માં નૂટક રેખા દારા બતાવેલ છે, તે પ્રમાણે સ્વિંગબેલને પીઠની પાછળા રાખાને જિલા રહેલું. ત્યાર બાદ તે આડૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કમરમાંથી આગળ ઝૂકીને હાથને શક્ય તેટલા આગળ લાવવા અને પછો પુનઃ સીધા જિલા રહેલું. આ પ્રમાણે ૧૦ વખત કરવું.

લેગબેલ્સનો વ્યાયામ

યુરોપ અને અમેરિકાના વ્યાયામ પ્રેમી તથા વ્યાયામ તજ્રોણાનું લક્ષ્ય પગના સનાયુઓને તૈયાર કરવા તરફ વધુ રહ્યું છે. શરદ્યાતમાં તેઓનું ધ્યાન કમરની ઉપરનો લાગ કેળવવા તરફ હતું. પરંતુ

શરીરસામર્થ્યની દ્વિપિટ્યો તંગોને પગના અનાયુઓનું મહારવ પણ વધુ લાગવાથી, પગના સ્નાયુઓને ઉતામ રીતે તૈયાર કરવા લાખડી બૃદ્ધ વાતાવાને તેમાં વજનદાર ડેગેલ્સ બંસાડવાની ચોજના કરી હતી. અમેરિકાની 'ચોક' બારળેલ કંપના ' એ


આવા બૃદ્ધ તથા તેના વડે થતી બુઢી બુઢી કસરતોના ચાર્ટ પણ તૈયાર કર્યો છે. ઇંદ્રેન્ડમાં પણ ચિ. ટ્રેવારે આ પ્રકારના લેગભેલ તથા તેના ચાર્ટ તૈયાર કર્યા હતા. તેમાં વિશિષ્ટતા એ છે, કે બૃદ્ધમાં બંસાડેલા લોણંડી વજનને વન્તું ચોછું કરવાના પણ સગવડ રાખેલી છે.



લેગભેલ્સ

કસરત-૧ : પગમાં લેગ-બેલ પહેરીને ભિસા રહેવું. પછી બને હાથને ચિત્રમાં ઉપરની તરફ જતાવ્યા પ્રમણે કમર ઉપર રાખવા. પછી જમણા પગને શક્ય તેટલો જમણી બાળુએ હાથે લેવો. અને મુનઃ નીચે મુળ સ્થિતિમાં લાવવો. (આ શરીર ૧૦ વખત કરવું) આ કિયા દરમયાન ડાણા

પગને ટદાર રાખવો અને શરીરને ડાંબા બાળુ ઝુકાવવું. આજ પ્રમાણે કસરત ડાણા પગે પણ કરવી. આ કસરતથા સાથળના આગળની બાળુના સ્નાયુઓ (quadriceps femoris) ને સારી કસરત મળે છે.




લેગબેલની કસરતો-૧ તથા .૨

કસરત-૨ : ચિત્રમાં નીચેની તરફ બતાવ્યા પ્રમાણે કમર પર હાથ રાખીને જિલા રહેલું. ત્યાર ખાદ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ડાળા પગને ધુંટણું માંથા ટદ્દાર રાખી આગળ જાંચો કરવો અને પુનઃ નીચે લાવવો. આ રીતે ૧૦ વખત કસરત કરવી;

અને ૧૦ વખત આજ પ્રમાણેની કિયા જમણું પગે કરવી.

કસરત-૩ : ચિત્રમાં ઉપર ડાખી ખાલું બતાવ્યા પ્રમાણે બાને હાથને કમર ઉપર રાખી જમણું



લેગ એલ્સની કસરતો-૩ થા છે

પગને ધૂંટણુમાંથી વળાને શક્ય તેટલો પાછળા જાયે લેવો; અને પુનઃ નીચે લાવી જમીન ઉપર રાખવો (મૂળ સ્થિતિમાં આવવું) ત્યાર બાદ ડાખા પગને પણ એજ પ્રમાણે ધૂંટણુમાંથી વળાને પાછળા જાયે લેવો અને મૂળ સ્થિતિમાં આવવું. એ રીતે બંને પગની કિયા ૧૦-૧૦ વખત કરવી. આથી કંસરતની નીચેના ભાગના બધા સ્નાયુઓને સારી કસરત મળે છે.

કસરત-૪ : ચિત્રમાં ઉપર જમણી બાજુ બતાવ્યા પ્રમાણે જમીન ઉપર ચતા સૂઈ જઈને બંને પગને જાયે લેવા. પછી એક એક પગને શક્ય તેટલા મોટા ગોળાકારમાં વારાક્રસ્તી ફેરવવા. પ્રત્યેક પગથી આ પ્રમાણે ૧૦-૧૦ ચક્કર લેવાં. આ કસરતથી સાથળના અંદરના ભાગના સ્નાયુઓ (સાર્ટેરિયસ અને એસિલિસ) ને તથા પેટના નીચેના ભાગના સ્નાયુઓને સારી કસરત મળે છે.

કસરત-૫ : ચિત્રમાં મધ્ય ભાગમાં બતાવ્યા પ્રમાણે ડાખા પડખા ઉપર સૂઈ જઈને જમણું પગને ધૂંટણુમાંથી ટઢાર કરી જાયો કરવો અને ૧૦ વખત ગોળાકાર ફેરવવો. ત્યાર બાદ જમણું પડખા ઉપર સૂઈ જઈને ડાખા પગે પણ તે જ પ્રમાણે ૧૦ વખત કિયા કરવી. આ કસરતથી સાથળના ખહારના ભાગના સ્નાયુઓ (વેસ્ટસ એક્સટન્સ) ને સારી કસરત મળે છે.

કસરત-૬ : ચિત્રમાં છેક નીચે બતાવ્યા પ્રમાણે ચતા સૂઈ જવું. પછી બંને પગને જમીનથી ઉપર જાયું રાખવા. એ વખતે ધૂંટણુમાંથી પગ ટઢાર રાખવા. પછી ડાખા પગને ધૂંટણુમાંથી વળી છતીની નજીક લાવવો અને પુનઃ લાંબો કરવો. પછી જમણું પગથી પણ એજ પ્રમાણે કિયા કરવી. દૂરેક પગથી આ કિયા ૧૦-૧૦ વખત કરવી. આ કસરતથી સાથળની અંદરના ભાગના સ્નાયુઓને તથા પેટની નીચેના ભાગના સ્નાયુઓને સારી કસરત મળે છે.

હેડસ્ટ્રોપનો વ્યાયામ

અમેરિકાની યોક્સ બારબેલ કંપનીએ ગરદનના સ્નાયુઓને જુદા જુદા પ્રકારની કસરત મળે તે માટે માથામાં પહેલવાનો એક ચામડાનો પણ્ઠો બનાવેલો છે. એ પણ્ઠાને લોાખાંડની સાંકળ લગાઉલી હોય છે. તેની સાથે બારબેલની જુદા જુદા વજનની ચક્તીએ જોરીને અથવા જુદા જુદા વજનના ડાયલસ લગાડીને કસરત કરી શકાય છે. ચિત્રાંક-૧, ૨, ૩ (પૃષ્ઠ-૨૦૮) જોવાથી આ સાધનોનો ઘ્યાલ સ્પષ્ટ થશે. આ પહેલાં ગરદનના રૂનાયુઓ માટે કસરતનાં ડાઈ સાધનો ન હતાં.

આ સાધનોથી જુદા જુદા કસરતપ્રકારો કેવી રીતે કરી શકાય તેની માહિતી ચિત્રાંક-૧-૨-૩ ઉપરથી મળી રહે છે.


ગરદનના આ સ્નાયુઓ મજબૂત થવાથી શરદીનો કે કંદનળીના સોઝનો વિકાર થતો નથી.

આ ઉપરાંત ભગજને પૂરતું રક્ત મળે છે તથા અવાજ પણ સુધરે છે.

ચિત્રાંક-૪ માં બતાવ્યા પ્રમાણે માથાનો પણ્ઠો પહેરીને એક લાંખી બેન્ચ ઉપર જાંધા સૂઈ જવું. પછી ગરદનને ઉપર નીચે કરીને આ કસરત થઈ શકે છે. આ પ્રકારની કસરતથી ગરદનની પાણણના ટ્રેપેજિયસ સ્નાયુઓને ઉત્તમ કસરત મળે છે. એ ઉપરાંત ‘ ટેરિસ મેજર ’ (Terres Major) તથા ‘ ટેરિસ માયનોર ’ (Terres Minor) ને એટલે કે પીઠની ખપાટ ઉપરના સ્નાયુઓને પણ કસરત મળે છે.

આયન્સ શ્રી, જાયન્ટ કુશાર, એણ્ડોમિનલ એડ્વાર્ડ
ચ્રિપ ઉબલપસ તથા માસ્ટર ચ્રિપ

ચિત્રાંક-૧ તથા ૨ (પૃષ્ઠ-૨૦૮) ઉપરથી આયન્સ શ્રી એવા પ્રકારનો હોય છે અને તેનાથી કુશારની કસરતો કરી શકાય તેની કલ્પના આવશે. આમાં



દેડસ્ટ્રોપ અને તેની કસરતો

પણ ઓળા વત્તા વજનની કમાનો બેસાડવાની સગવડ હાય છે. એટલે જુદી જુદી શક્તિના માણસો અનાથી મહેનત કરી શકે છે.

વિનાંક-૩ ઉપરથી જાયન્ટ કુશારની કદ્દપના આવી શકશે. એની મૂડ દાખીને અને તેને એક ખોજનની


નંબ્રક લાવીને તથા જુદી જુદી રીતે ભલા રહીને જુદી જુદી કસરતો કરી શકાય છે. આ સાધનથી વિશેષ કરીને હાથની પકડ મજબૂત થાય છે.

વિનાંક-૪ માં બતાવેલ સાધન એન્ટોમિનલ એડ પેટમાંના સ્નાયુઓને મજબૂત કરવા માટે

છ. તેનું તિરક્સ બેસાડેલું લાકડાનું પાટીયું પડે
કૂટ લાંબું અને ૧૬ ધિય પહોળું હોય છે. અને તે
એક લોખંડી સ્ટેન્ડમાં બેસાડેલું હોય છે. એ
પાઠ્યાને જરૂર પ્રમાણે લાંબું કે નીચું કરી થકાય
છ. તેની ઉપરની બાંનું ચામડાની પદ્ધી જરૂરી

હોય છે. તેમાં બંને પગ ભરાવીને અને માથું
નીચેના ભાગમાં રાખીને ચત્તા સુવાનું હોય છે; અને
કરી કરીને જઈને બેસવાની કસરત આમાં કરી
શકાય છે.

ચિત્રાંક-૫, ૬, ૭ અને ૮ એ ગ્રિપ ઉવલપસ્




૧-૨ : આયન્ શ; ૩ : જ્યાન્ટ કુશર; ૪ : એન્ડોમિનલ બોડ;
૫ થી ૮ : ગ્રિપ ઉવલપસ્

છ. ચિત્રાંક-૬, ૭, ૮માં આવી વત્તા કમાતો બેસાડેલી હેખાડેલી છે. તેની લાકડાની બંને મૂઠોને પકડમાં લઈને તથા દાખીને ગુદા જુદા પ્રકારની કસરતો કરી શકાય. છે. સ્પ્રાંગ ડંબેલ્સની નેમ જ આ સાધનોથી પણ કસરતો થઈ શકે છે.

પુલી વેઈટ


હુગ્લેન્ડના બિવરપુલ જિમ્નેશિયમના ડાયરેક્ટર શ્રી. એ. એલેકઝાન્ડર આ "પ્રકારનું" સાધન બનાવ્યું હતું. ચિત્રાંક-૧માં ખતાબ્યા "પ્રમાણેનું" આ સાધન વાપરવામાં સરળ અને સગણકવાળું છે. આ સાધન



ઉપરની ખાળું ગરગડીની સુવિધા યુક્ત પુલીવેઈટ

૭ કૂટ લાંબા અને પાંચ થુચ પણોળા લાકડાના પાઠ્યાત્મક લોખંડના સળિયા અને ગરગડીઓ જોડીને તૈયાર કરેલ છે. આ પાઠ્યાત્મક ઇમાં એકાદ થાંસલા સાથે ડે લિતમાં ઊભું જડીને વાપરી શકાય છે. તેમાં એક નીચે અને એક ઉપર એ પ્રમાણે એ લોખંડી ગરગડીઓ જોડેલી હોય છે. તેમાંની નીચેની

ગરગડીની નીચે એક ન ની લોખંડી બેઠકની ઉપર પ્રત્યેક બે રતલાનાં એવાં ૭-૮ વજન રાખવાં તે વજનો ગરગડી ઉપરની ચુતરની દોરીથી આદૃતમાં બતાવ્યા પ્રમાણે સહજ રીતે ઉપર નીચે લાવી શકાય છે.; તેમજ ઈચ્છા પ્રમાણે તેને વતાં ઓછાં પણ જોડી શકાય છે. જો વધારે વજન




ઉપર તથા નીચે ગરગડીની ચુવિધા યુક્ત પુલીવેઈએ

દેવાની ઈચ્છા હોય તો તે વજન ઉપર એકાદ લોખંડી ડંબેલ્સ મુક્કીને વજન વધારી શકાય છે.

ચિત્રાંક-૧માં બતાવેલ સાધનમાં હાથને નીચેથા વાળાને ઉપર લાવીને કસરત કરવાની સગવડ નથી. તથા ગ્રે. હોક્કેમેને આ સાધનમાં ચિત્રાંક-૨માં બતાવ્યા પ્રમાણે ભીજુ બે જરગડીઓ નીચેના લાગમાં લગાડીને જરૂરી સગવડ કરેલી છે. આ સાધનથી

અનેક પ્રકારની કસરતો કરી શકાય છે, જે પેક્ષી થાડી કસરતોના પ્રકારોનો અત્રે સમાવેશ કર્યો છે.

આ સાધનમાં વજન ટેટલું વાપરવું તે નિશ્ચિત પણે કહી શકાય નહિ. પરંતુ તાલિમ પ્રમાણે શરાયતમાં થાડી મુશ્કેલીથા વજન ઊચ્કી શકાય તેટલું વજન લેવું. પછી નેમ નેમ સ્નાયુઓ વધુ વજન ઊચ્કવાને શક્તિમાન બને તેમ તેમ વજન



પુલીવેઈટની કસરતો

અમુક તાલિમનો સમય પૂરો થતા વંદવું. ગ્રે. હોડમેનનો મત એવો છે કે, થોડું વજન લઈને જુદા જુદા પ્રકારની કિયા ઝડપથી અને વધુ વખત કરવી, એ આરોગ્ય માટે વિશેષ હિતકારક છે. કોઈ પણ વ્યાયામ કરવાથી શાસોન્નાસની ગતિ વધવી જોઈએ અને શરીરમાં રક્તપ્રવાહનું અડપી ભરમણ થવું જોઈએ. વધારે વજનથી ધીમે ધીમે અને થોડા સમય કસરત કરવાથી આ હેતુ સધાતો નથી. સ્નાયુનાં સંકુચન અને પ્રસરણ નેટલાં વધારે થાય તેટલેા વધારે લાલ થાય. વજન મૂકીને દોરી જેંચતાં બેને શરીરને વાંકુચુંકું કરવું પડે તે જાણવું કે, આપણી શક્તિ કરતાં વજન વધારે છે; માટે વજન થોડું ઓછું કરવું.

કસરત-૧ : ચિત્રાંક-૧માં બતાવ્યા પ્રમાણે દોરીના છેડાને જોડેલી રકાખીના આકારની લોખંડી મૂકુને પકડીને તેના તરફ મેંઢું રાખીને જિલા રહેવું. પછી ડાણા હાથને ડાખી બાજુ અને જમણા હાથને જમણી બાજુ જમીન જોડે સમાંતર રાખીને શક્ય તેટલેા પાછળ લાવવો તથા આગળ લાવવો. આ પ્રમાણેની કિયા ૧૦ વખત ઝડપથી કરવી. હાથને પાછળ લઈ જતાં શાસ લેવો અને આગળ લાવતાં શાસ છોડવો.

કસરત-૨ : પુલીવેઇટ સાધન તરફ પીડ રાખી તથા લોખંડી મૂકવાળા બંને હાથને પાછળ રાખી ચિત્રાંક-૨ માં બતાવ્યા પ્રમાણે જિલા રહેવું. ત્યાર ખાદ જમણા હાથને જમણી બાજુ અને ડાણા હાથને ડાખી બાજુ, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જમીન સાથે સમાંતર રાખીને આગળ લાવવો તથા પાછળ લઈ જવો.

કસરત-૩ : ચિત્રાંક-૩ માં બતાવ્યા પ્રમાણે જમણા પગને આગળ અને ડાખા પગને પાછળ મૂકીને તથા હાથમાં લોખંડી મૂકુને પકડીને જિલા રહેવું. ત્યાર ખાદ ચિત્રમાં નૂટક રેખાથી બતાવ્યા પ્રમાણે જમણા પગને આગળ મૂકવો અને તે જ વખતે

જમણા હાથને પણ આગળ લંબાવવો. પછી એ હાથ તથા પગને પાછા મૂળ સ્થિતિમાં લાવવા. આ પ્રમાણે ૧૦ વખત જમણા પગને અને ૧૦ વખત ડાણા પગને આગળ મૂકીને આ કસરત કરવી.

કસરત-૪ : ચિત્રાંક-૪ માં બતાવ્યા પ્રમાણે કમરમાંથી આગળ મૂકીને, બંને હાથથી લોખંડી મૂક પકડવી. પછી બંને હાથને એક સાથે ચિત્રમાં નૂટક રેખાથી બતાવેલ બાણુની દિશા પ્રમાણે પાછળ લઈ સાધા થવું; અને ફરીથી આગળ મૂકીને પૂર્વ સ્થિતિમાં આવવું. આ બધી કિયામાં હાથને ક્રાણીમાંથી ટદ્દાર રાખવા.

આ કસરતના દરેક પ્રકાર ૧૦ વખત કરવા તથા હાથને પાછળ જિચે લઈ જતાં શાસ લેવો અને નીચે લાવતાં શાસ છોડવો.

રોમન ચેર, રોમન પિલર, રોમન એન્ડ

કસરતનાં આ સાધનોને 'રોમન' એવું નામ શા માટે આપવામાં આવ્યું છે, તેની માહિતી મળતી નથી. રોમન સાભ્રાજ્યની ટાય ચઢ્ઠીના જમાનામાં પણ રોમન લોકોમાં આ કસરતપ્રકાર પ્રયુક્તિ ન હતો. રોમન લોકોનાં શરીર ઉત્તમ પ્રકારનાં, ઘાટદાર તથા સામર્થ્યસંપન્ત હતાં; અને આ કસરતપ્રકાર પણ કડણું અને શ્રમકારક હોવાથી આનાથી જ તેમનાં શરીરો તેવાં બન્યાં હશે, એમ માની લઈને, આની જેડે 'રોમન' નામ જોડી દીધેલું જણ્યાય છે.

રોમન પિલર : ચિત્રાંક ૧માં થાંલલાને પગની આંધી આંધીને કસરત કરનાર માથું નીચે અને પગ જિચે રાખી લટકો રહેલો જણ્યાય છે. તેણે જમીન પર રાખેલો ઝમાલ મેં વડે જિચુને, શરીર કમરમાંથી વાળી, ધડ જાંચું લઈ એસવાનું હોય છે. આ રીતે ઉપર જિડતાં કમર તથા પેટના અને પગના સ્નાયુઓને સરસ કસરત મળે છે.

‘રોમન ચેર’ : આ કસરત પિલર કરતાં વધારે અધરી છે. પોતાના વજન જેટલા વજનનો લારે ભારબેલ બોચી પર રાખીને ૮-૧૦ બેટક સહજ કાઢી શકાવી જોઈએ; અગર તો જમીન પર ચત્તા સુઈ જઘને પોતાના વજનથા અર્ધા વજનના બાર-


બેલને છાતી ઉપર રાખીને ૮-૧૦ વંખત બદલાં તથા મેસતાં આવડલું જોઈએ. આટલી શરીરની તૈયારી થયા પછી આ રોમન ચેરની કસરતો કરવાનો આરંભ કરવો, કે જેથા શરીરને ઠીંજ થવાનો સંભવ ન રહે.



‘રોમન પિલર’ની કસરત

કસરત-૧ : ચિત્રાંક ૧ પ્રમણે ખુરસીની ઉપરની લાકડાની પદ્ધોની અંદર, અગર તો ચામડાના પદ્ધામાં બંને પગના પંઝ ધાલીને અને ખુરશીના પાછવા જિલા ભાગ ઉપર ગૂડણોને ગોઢવીને બેસવું; પછી ગોડણુભાંથા પગને વાળીને શરીરને નીચે

લાવવું. એ વખતે કમર ઉપરનું શરીર તેવું જ સીધા બેસવા નેવું રાખવું; પછી પુનઃ જિચે ઘણીને મૂળ સ્થિતિમાં આવવું; અને એ રીતે ૫-૬ વખત કરવું. શરીરાતના ૪-૬ દિવસ સુધી આજ કસરત કરવી.



‘હૈમનન્યેર’ની કસરતો :૧ થી ૪

કસરત-૨ : ઉપર જણાવેલી કસરત સહજ થવા માંડે, એટલે ઝૂલા નીચે ગયા પછી કમરમાંથી પાછળ નમાને માથાને જમીન નજીક લાવવું. પછી પુનઃ : કમરને વાળોને જાચે જઈને બેસવું; અને પછી ચિત્રાંક-૧ પ્રમાણેની સ્થિતિમાં આવવું. આ કસરત રોજ ૫-૬ વખત એક અઠવાડિયા સુધી કરવી.

કસરત-૩ : ઉપરની કસરત-૨ ને સરસ અહાવરો થયા પછી ચિત્રાંક-૧ પ્રમાણે બેસીને, પગને ગોઠણમાંથી વાલ્યા વિના કમરમાંથી શરીરને પાછળ નમાવીને, ચિત્રાંક-૨ પ્રમાણે જમીનને સમાંતર સ્થિતિ માં લાવવું; પછી મૂળ સ્થિતિમાં આવવું. આ કસરત રોજ ૫-૬ વખત તુ અઠવાડિયા સુધી કરવી.

કસરત-૪ : ચિત્રાંક-૨ પ્રમાણે શરીર પાછળ ગયા પછી માથાને જમીન નજીક લાવીને બંને હાથને લાંબા કરવા; અને પુનઃ : જીલટ કિયા કરીને પ્રથમની સ્થિતિમાં આવવું. આ રીતે ૫-૬ વખત સહજ થવા માંડે, એટલે ૨૫ રતલ વજનનો જમીન પર મૂક્લો બારબેલ. ચિત્રાંક-૩ પ્રમાણે પકડીને જીયકવો અને છાતી ઉપરથી ધસડતો લઈ ચિત્રાંક-૪ પ્રમાણે પેટ ઉપર લાવવો અને પછી જઈને ચિત્રાંક-૧ માં બતાવ્યા પ્રમાણે બેસવું. આ કસરતમાં શક્તિ વધે તે પ્રમાણમાં બારબેલનું વજન પણ વધારવું. આ કસરતથી જાંધ, પેટ તથા પીઠના સ્તાયુઓની શક્તિ ઘણી વધે છે.


કસરત-૫ : ચિત્રાંક-૧ પ્રમાણે ખુરસીના ચામડાના પદ્ધામાં બંને પગ ભરાવીને અને ગોઠણના વળાંકને ખુરસીના પાછલા ભાગ ઉપર રાખીને બેસવું. પછી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે શરીરને રાખી, ગોઠણમાંથી પગને વાળોને શરીરને પાછળ જમીન તરફ લાવવું અને ડાકને ચિત્રાંક-૨ પ્રમાણે જમીન પર ટેકવની.

કસરત-૬ : પછી એજ ચિત્રમાં બતાવ્યા

મુજબ બંને હાથને સીધા રાખવા અને તેના પર જોડીદાર હસ્તવૃક્ષાસન (હેન્ડ સ્ટેન્ડ) કરશે. પછી ચિત્રાંક-૩ પ્રમાણે કમરમાંથી શરીર વાળોને જોડા થવું. આ વખતે પણ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બંને હાથને કોણામાંથી વાળોને, જોડીદારને તેના પર હસ્તવૃક્ષાસનમાં તોળી રાખવો. પછી વળી જોડીદારને તેમ જ રહેવા દઈ ખુરસી પર જીબા રહેવું.

કસરત-૭ : ચિત્રાંક-૪ પ્રમાણે એક લારે વજનની ખુરસીને જમીનની જોડે પાકી જડી લેવી. આ ખુરસીના બેસવાના પાટિયાને એ લોખાંડી કડાં જડી તેમાં એક મજબૂત ચામડાનો પઢો જોડવો. પછી ખુરસી પર જીબા રહીને, તે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બંને પગના પંનને એ ચામડાના પઢા નીચે ધાલવા; અને ખુરસીના પીઠના ગોળદાંડા ઉપર ગોઠણના પાછલા વળાંકને ટેકવીને બેસવું. પછી શરીરનો ઓંક પાછળ લઈને કમાન કરી હોય તેમ લટકતા રહેવું. આ પ્રમાણે ૫-૬ વખત કરવું; અને દસ દિવસ સુધી આ કસરત કરવી. પછી હળવા વજનનો બારબેલ ખુરસીની પાછળ રાખી, તેને જીયકુને બેસવાનો કસરત કરવી. શક્તિ વધે તેના પ્રમાણમાં આ બારબેલનું વજન વધારવું. મતુષ્યનું વજન જીયકી શક્તિ એટલી શક્તિ વધે એટલે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે મતુષ્યને સુવાડી તેને તેવો જ ઉપર જીયકુની રાખીને બેસવું. મતુષ્યના વજન નેટલા લારે બારબેલને જીયકવા કરતાં, મતુષ્યને જીયકુની લેવાથી પ્રેક્ષકો ઉપર વધારે સારો છાપ પડે છે.

આ લેખના આરંભે ખરા રોમન પિલરનું ચિત્ર આપેલું છે, તે ગોળાકાર હોય છે; પણ ચિત્રાંક-૧માં રોમન પિલરનો ખીજે એક અલગ પ્રકાર બતાવ્યો છે. તેમાં લીંતમાં એક ચોખૂણ થાંબલો છે. એ થાંબલાની આગળ પહોળી બાલુઓ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક લોખાંડી કડું જડેલું છે; અને તે કડામાં એવડી લોખાંડી સાંકળ ઘાલીને તેને નીચલે છેઠે એક મજબૂત ચામડાનો પઢો બાંધેલો.



‘રોમન ચેર’ની કસરતો : ૫ થી ૭

છે. વળી તે જ પ્રમાણે તે થાંબલાને જડેલા પહેલા કડાની નીચે, આશરે એક હાથ ઉપર ખીજાં એ કડાં એકમેકથી છ છ દીચના અંતરે જમીનને સમાંતર જોડેલાં છે; અને તે બંનેને પણ મજખૂત ચામડાના પઢા બાંધેલા છે. એ પઢામાં ચિત્રમાં જતાવ્યા પ્રમાણે બંને પગના પંજા ધાલીને, એ પગનાં તળિયાં તે થાંબલાની ઉપર બરાબર સજાડ રીતે ટેકવવાનાં છે:


પ્રથમ ઉપરની સાંકળને બાંધેલા પઢામાં બંને પગ ધાલીને એ પદ્ધો ગોઠણુંની નીચેના લાગમાં ભરાવવો; અને પછી નીચેના બંને પઢામાં પગ ધાલીને તેનાં તળિયાં થાંબલાને ટેકવવાં. પછી કસરત કરનારે ચિત્રાંક-૧ પ્રમાણે ચત્તા થઈને લટકતા રહેલું.

કસરત-૮ : ઉપર પ્રમાણે રહ્યા પછી શરીરને ઉપર જિચ્કાને બેડા થલું. એ રીતે જિચ્કે જિકતાં

પેટના, જંધના અને કમરના સ્નાયુઓને સારી કસરત મળે છે. આ પ્રમાણે ૧૦ વખત કરવાનો મહાવરો થયા પણો, હાથથી ઉચ્ચકી શક્યતા એ રીતે જમીન પર બારબેલને મૂકવા. શરૂઆતમાં તેનું વજન ઘણું યોડું રાખવું. પણ ચિત્રમાં બતાયા પ્રમાણે એ વજનને હાથમાં લઈને ભડકું અને

બેસવું. આ કસરત અઠવાડિયામાં બે દિવસ કરવી; અને શક્તિ વધે તે પ્રમાણે બારબેલનું વજન વધારવું.

કસરત-૮ : ચિત્રાંક-૧ પ્રમાણે આ થાંબલા પર લટકતા રહ્યા પછી શરીરને જાચે લઈ ચિત્રાંક-




‘રેમન ચેર’ની કસરતો : ૮ થી ૧૦

२ प्रभाषे अंने हाथने अंने बाजुओ जांध उपर राखी शरीरने जमीननी समांतर राखवुँ अने पछी पुनः शरीरने नीचे लाववुँ।

क्षसरत-१० : चित्रांक-१ प्रभाषे बारबेलने जांचकी लीधा पछी हाथथा तेने वधारे जांचे लध

चित्रांक-३ प्रभाषे तेने जांध पर राखवो। पछी जडीने बेसवुँ; अने पुनः शरीरने पाछण लावी बारबेलने जमीन पर भूकवो। पछी बारबेलने जांध उपर न राखतां छाती पर राखवा प्रथत्न करवो, पछु तेमां वधारे भडेनत पडे छे अने बारबेलने



'रोमन चेर' नी क्षसरतो : ११ थो १६

જિવકીને જાણું એ તો ખૂબ અધિક છે. માટે પ્રથમ થાડા વજનનો બારબેલ લઈને શરૂઆત કરવો... .

કસરત-૧૧ : ચિત્રાંક-૧ પ્રમાણે પગને ગોઠણું માંથી ટઠાર કરીને બેસવું. શરૂઆતમાં એ ગ્રામાણે માત્ર ૫-૧૦ સેકંડ બેસીને આગળી જ સાંકળને બંને હાથથી પકડવી અને વિશ્રાન્ત લેવી. પછી પુનઃ હાથ છોડીને બેસવું અને પુનઃ સાંકળને પકડવી. આ પ્રમાણે ૪-૫ વખત કરવું.


કસરત-૧૨ : પછી ગોઠણુમાંથી પગ વાળાને ઝૂલાને નીચે જવા દેવા; અને ચિત્રાંક-૪ પ્રમાણે રહેવું. આ વખતે હાથમાં વજન ન રાખવું. પછી પુનઃ જિયે જડીને ચિત્રાંક-૧ પ્રમાણે બેસવું; અને પુનઃ નીચે આવવું. આ રીતે ૫-૬ વખત કરવું. શરૂઆતમાં એક ઘડવાડિયા સુધી ઉપર જણાવેલા એ પ્રકારો જ કરવા.

કસરત-૧૩ : ખીને ઘડવાડિયે ચિત્રાંક-૪ પ્રમાણે નીચે ગયા પછી કમર ઉપરના શરીરને ચિત્રાંક-૩ પ્રમાણે પાછળ નીચે લાવી ચત્તા લટકતા રહેવું. પછી જિયે જડવા સાર પ્રથમ બંને હાથને જિયે આણી જંધ પકડવી; અને કમરમાંથી ઉડીને ચિત્રાંક-૪ પ્રમાણે બેસવું; અને પછી ચિત્રાંક-૧ ની સ્થિતિમાં આવવું. પછી તેવી જ જલટી કિયા કરીને ચિત્રાંક-૩ પ્રમાણે હાથને નીચે લાવવા અને પુનઃ જડવું. આ પ્રમાણે ૫-૬ વખત કરવું. ખીન ઘડવાડિયે આ પ્રકાર તથા પ્રથમના બંને પ્રકાર કરવા.

કસરત-૧૪ : પછી ખીન ઘડવાડિયામાં ચિત્રાંક-૧ પ્રમાણે બેસીને તથા ચિત્રાંક-૨ પ્રમાણે શરીરને પાછળ લાવીને, જમીનને સમાંતર રાખવું; અને પુનઃ બેડા થવું. પછી ચિત્રાંક-૨ ની સ્થિતિ-માંથી ચિત્રાંક-૩ પ્રમાણે શરીરને પાછળ નીચે લાવી લટકવું. આ વખતે શરીરને કમરમાંથી ટઠાર રાખવું.

કસરત-૧૫ : આટલા પ્રકારો ઊરાખર થયા પછી ૨૫ રતલ વજનનો બારબેલ જમીન ઉપર મૂકીને ચિત્રાંક-૩ પ્રમાણે તેને પકડવો. પછી હાથથી તેને જિવકીને છાતી સામે આપણવો; અને પછી કમરમાંથી વળાને ચિત્રાંક-૪ પ્રમાણે બેડા થવું. આ વખતે બારબેલને પગ ઉપરથી ગાંડાવિને ગોઠણું તરફ લેવો. પછી એથા જલટી કિયા કરીને તેને જમીનની ઉપર મૂકવો. આ રીતનો સારો મહાવરો થાય એટલે ચિત્રાંક-૨ પ્રમાણે રહીને અંગળાં ઉપર બારબેલને રાખવો.

કસરત-૧૬ (રોમન બોર્ડ) : જમીન પર પાકા બેસાડેલા એક જડા પાટિયાને એ કડાં લગાડીને તેમાં જોડેલા ચામડાના જડા પદ્ધામાં પગના પીંડીના ઉપરના લાગો ચિત્રાંક-૬ પ્રમાણે. ભરાવવા અને પગનાં તળિયાં એ પાટિયા ઉપર ટેકનીને જલા રહેવું. પછી પગને ગોઠણુંમાંથી વળાને શરીરને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પાછળ લાવવું; અને પુનઃ તેમાંથી જડીને જલા રહેવું. આ કસરત ધણી જ કણણ છે. અમેરિકાના પ્રચિદ્ધ કસરતથાજ સિંગમંડ કુલેને ૩૫ રતલ વજનનો બારબેલ હાથમાં રાખીને આ પ્રકાર કરી બતાવેલો.



૨૧. કટીલ સ્પ્રીંગ અથવા રબર કુબલ ઓક્સપાનડર

સ્ટીલ સ્પ્રીંગ અથવા રબર ડેણલ એક્સપાનડરથી જુદા જુદા પ્રકારની કસરતો કરી શકાય છે. આ સાધનોનું વજન વિશેષ હોતું નથી: એટલે તેને કોઈ નાની પેટીમાં પણ બહારગામ જતાં સાથે લઈ શકાય. તેમજ આ એક્સપાનડરો ભીતના કે બારણાના ચોકડાને સહજ બેસાડીને કે બેસાડ્યા વિના પણ અનેક પ્રકારની કસરતો કરી શકાય છે. ચિન્માંથી આ સાધનની કદ્દળના આવી શકશે. આ સાધનો હુદ્દેંડની ટરી કંપની તથા અમેકાની ચોઈ ખારબેલ કંપની જનાવે છે. રમતગમતનાં સાધનો વેચનારાની દુકાનોમાં આ સાધનો તથા કસરતના ચાર્ટ્સ વેચાતાં મળે છે.

આ સાધનોમાં બેસાડવા માટે જુદી જુદી શક્તિવાળાં માણસોને અનુદૂળ એવી સ્પ્રીંગો અને દોરીઓ મળે છે. અને તેને જરૂર પ્રમાણે વતી કે ઓછી લગાડી શકાય છે. એટલે જ તે પોતાની શક્તિને અનુઝપ આ સાધનો તૈયાર કરીને વાપરી શકે છે. વળી આ દોરીઓની બાબુએ લગાડી શકાય તેવા લોખંડની રકાખીઓ પણ મળે છે. તેને પગથાળીને જુદા જુદા પ્રકારની કસરતો કરવાની સુવિધા થઈ શકે છે. આ પ્રકરણમાં આપેલાં ચિન્નો ઉપરથી આ કસરતોનો ઘણાલ આવશે.

ખારબેલ કે વજનદાર ડાયલસ્થી કરી ન શકાય તેવા ડેટલાક કસરતપ્રકારો આ સાધનથી કરી શકાય છે. કસરતના અને સાધનોના પ્રકારોમાં વેવિધ હોય તે એકદરે દ્યુષ્ટ છે, કારણું કે તેનાથી શરીરના જુદા જુદા સનાયુઓને કસરત આપી શકાય છે.


આ પ્રત્યેક વ્યાધામ પ્રકાર ૮-૧૦ વખત કાઢા-

તિરેક વગર કરી શકાય, તેવી શક્તિની સ્પ્રીંગો કે દોરીઓ લઈને આ મહેનત કરવાની શક્તિની કરવી. પ્રત્યેક પ્રકાર ૨૦ વખત કરવા છતાં પણ પૂરી મહેનત યતી નથી, એવું લાગે ત્યારે સ્પ્રીંગોની કે દોરીની સંપ્રેષણ વધારવી અને જરૂર પ્રમાણે તેનાથી વધારે શક્તિની સ્પ્રીંગો તથા દોરીઓ વાપરવી. ટૂંકમાં કસરતની માત્રા સમજ અને વિવેકપૂર્વક વધારતા જરૂરી.

રાખરની દોરીઓના કરતાં સ્પ્રીંગ એક્સપાનડર ટક્કામાં વધારે સારાં હોય છે; કેમકે, રખરની સ્થિતિસ્થાપકતા જલદીથી ઓછી કે નકારી થઈ જાય છે, જ્યારે સ્પ્રીંગોની સ્થિતિસ્થાપકતા બાંધા સમય ચુંધી જળવાઈ રહે છે.

કસરત-૧ : ચિત્રાંક-૧ પ્રમાણે છાતીની સામે બંને હાથથી દોરીઓ પહ્ફીને જિલા રેહેલું. પછી બંને હાથથી દોરીઓ એંચીને તેને ચિત્રાંક-૨ પ્રમાણે છાતીની સામે રાખવી. પછી પુનઃ હાથને મૂળ જગાએ આણુવા. હાથ પહેળાણ કરતાં શ્વાસ લેવો અને મૂળ જગાએ પરત લાવતાં શ્વાસ છોડવો. આ કસરત ૮-૧૦ વખત કરવી. આનાથી ખલા, છાતી તથા પીડ વગેરેના સનાયુઓ સરસ તૈયાર થાય છે.

કસરત-૨ : ચિત્રાંક-૩ પ્રમાણે હાથને જિંચા રાખીને અને પગને પહેળાણ રાખીને જિલા રહેલું. પછી બંને હાથની દોરીઓને બાબુએ તથા નીચે એંચીની; તથા તે પીઠની પાછળી બાબુએ રહે એવી રીતે હાથને ખલાની સપાટીએ આણુવા. પછી પુનઃ હાથને મૂળ સ્થિતિમાં જિંચા લાવવા. આ કસરત



સ્થીક સ્મીંગ અથવા ૨૩૨ ક્રિષ્ણ એકસપાન્ડર

૮-૧૦ વખત કરવીઃ આનાથી ખલાના પીઠના તથા છાતીના સનાયુઓને ભહેનત મળે છે.


કસરત-૩ : ચિત્રાંક-૪ પ્રમાણે ડાયો હાથ જાચે અને જમણો હાથ નીચે રાખોને અને દોરી-આને પીઠની પાણી રાખોને જમા રહેવું. પછી

ડાયા હાથને તેમ જ રાખીને અને જમણા હાથને કોળુંમાંથી સીધો કરતાં કરતાં તથા દોરીને ઘેંચતાં ઘેંચતાં, લાંબો કરવો અને પુનઃ મૂળ સ્થાને આણુવો. આ કસરત ૮-૧૦ વખત કરવી. પછી ડાયા હાથને નીચે અને જમણા હાથને જાચે રાખી,

ડાયા હાથથી દોરીને બેંચતાં બેંચતાં, તને લાંબો કરવેા અને પછી મૂળ સ્થાને પરત લાવવેા. આ કસરત પણ ૮-૧૦ વખત કરવી. આનાથી હાથના સ્નાયુઓ મજબૂત થને છે.

કસરત-૪ : ચિત્રાંક-૫ પ્રમાણે બંને હાથને

કોણીમાંથી થોડા વાળેલા રાખીને દોરીઓને માથા ઉપર રાખવી. પછી ડાયા હાથને તેમ જ રાખીને જમણા હાથથી દોરીઓને બેંચવી અને તે હાથને બાંદુએ લાંબા કરવેા તથા પુનઃ મૂળ સ્થાને આપવેા. પછી ડાયા હાથથી દોરીઓને બેંચવી



રખર ફેઅલ એક્સપાનડરની કસરતો : ૧ થી ૬

અને જમણું હાથને તેમ જ રાખીને ડાણા હાથને બાળું ખલાની સપાઈએ લાંબો કરવો; તથા તેને પુનઃ મૂળ સ્થાને પરત લાવવા. આ પ્રમાણે પ્રત્યેક હાથની કસરત ૮-૧૦ વખત કરવી. આનાથો 'ટ્રાયસેસ' સનાયું સરસ તૈયાર થાય છે.

કસરત-૫ : ચિત્રાંક-૬ પ્રમાણે દોરીઓને પીડુની પાણી રાખીને અને હાથને ડોણીમાંથી થોડા વાળેલા રાખીને જિલા રહેવું. પછી બંને હાથથી ડોણીમાંને બાળુમાં ઝેંચવા, હાથને લાંબા કરવા અને પાણ મૂળ સ્થાને લાવવા. આનાથો દંડના, ખલાની પાણળના અને પીડના સનાયું સરસ તૈયાર થાય છે.

કસરત-૬ : ચિત્રાંક-૭ પ્રમાણે જમણું હાથને લાંબો કરીને અને ડાણા હાથને ડોણીમાંથી વાળાને દોરીઓને ઝેંચીને જિલા રહેવું. પગને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે મૂડને ખલાની નજીક લાવવી. પછી હાથને પુનઃ ડોણીમાંથી સીધા કરીને નીચે લાવવા; અને એ પ્રમાણે ૮-૧૦ વખત કરવું. આ કસરતને 'રેઝુલર કલ્સ' કહે છે. આનાથો હાથના 'બાય સેપ્સ' સનાયું સરસ કસરત મળે છે.

કસરત-૮ : ચિત્રાંક-૮ પ્રમાણે બંને રકાખીમાં પગ ધાલીને રકાખી ઉપર જિલા રહેવું. પછી દોરીને બાંધીલી મૂડમાં, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એકેક હાથ ધાલાને બંને હાથની ગૂંથથી ડોકની પાણળ બાંધવી અને આગાળા વળાને જિલા રહેવું. દોરીની મૂડને ડોણીના વળાંકમાં રાખવી. પછી પગને સીધા રાખીને, ચિત્રમાં જાંખી તુટક રેખાઓથી આરૂપિત બતાવી છે તે પ્રમાણે સીધા જિચા જિલા રહેવું. અને પછી પુનઃ નીચે વળવું. એ રીતે ૮-૧૦ વખત કરવું. આ કસરતને 'એક એકસસાઈઝ' કહે છે. આનાથો પીડના સનાયું મજબૂત બને છે.

કસરત-૯ : ચિત્રાંક-૯ પ્રમાણે રકાખીમાં એકેક પગને ધાલીને તેના ઉપર સીધા જિલા રહેવું. પછી આગાળા વળાને હાથને નીચે પગ તરફ લટકતા રાખવા. પછી કમરમાંથી તેમ જ વળેલા રહીને બંને હાથને, બંને બાળું દોરીઓને જિચી ઝેંચીને ખલાની સપાઈએ આણુવા. પછી પુનઃ નીચે આણુવા; એ રીતે ૮-૧૦ વખત કરવું. આ કસરતને 'લેટરલ રેઇઝ લીનીંગ ફેસ્ટવર્ડ' કહે છે, આનાથો લેટિસીમસ ડેસો (બગલની નીચે ધરની બાળુના) સનાયું આસ તથા છાતી, પીડ અને કમરના સનાયું પણ મહેનત થાય છે.

કસરત-૧૦ : ચિત્રાંક-૧૦ પ્રમાણે બંને પગને રકાખીમાં ધાલીને જિલા રહેવું. હાથને ડોણીમાંથી લાંબા કરીને નીચે જાંધ ઉપર મૂડ રાખવી. પછી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે હાથને જિચા લઘ દોરી-


કસરતો કરી શકાશે. અને જમણું હાથને તેમ જ રાખીને ડાણા હાથને બાળું ખલાની સપાઈએ લાંબો કરવો; તથા તેને પુનઃ મૂળ સ્થાને પરત લાવવા. આ પ્રમાણે પ્રત્યેક હાથની કસરત ૮-૧૦ વખત કરવી. આનાથો 'ટ્રાયસેસ' સનાયું સરસ તૈયાર થાય છે.

આને ઉપર બેંચવી અને પુનઃ નીચે આહુવી, એ પ્રમાણે ૮-૧૦ વખત કરવું. આને ‘અપરાઈટ રોઇંગ મોશન’ કહે છે.

કસરત-૧૧ : ચિત્રાંક-૧ પ્રમાણે પગના પંના પર બેઠક લેવી અને રકાખીમાં પગ ધાલી અને

જમીન પર દાખી રાખ્યી પંછી હારાઓ જેંચાને ભિલા થવું અને પુનઃ નીચે બેસવું. એ પ્રમાણે પંના ઉપરની ૮-૧૦ બેઠકો કરવી. આને ‘ડીપ ની બેન્ડ એન્ન રાજ’ કહે છે.


કસરત-૧૨ : ચિત્રાંક-૨ પ્રમાણે રકાખીમાં પગ



ધાલીને જિબા રહેવું. પછી નાચે બેસીને બેકુ લેવી તે વખતે પાનીઓ જમીનને ટેકવી રાખવી. એ પ્રમાણે ૮-૧૦ બેકુ કાઢવી. (ચિનમાં બેકુકની વચ્ચી સ્થિતિ અતાવેલી છે). આને 'ડીપ ની બેન્ડ ઓન ફ્લેટ ફૂટ' કહે છે.

કસરત-૧૩ : ચિનાંક-૩ પ્રમાણે ડાબો પગ

રકાખીમાં ધાલીને રકાખીને જમીન ઉપર દાખી રાખવા; અને ડાખા હાથમાં હોરીની મૂઠ પકડીને જિલા રહેવું. પછી ચિનમાં અતાંયા પ્રમાણે જમણા પગને આગળ લાંબો કરી એક પગ ઉપર જ બેકુ લેવી અને જિલા થવું. એ પ્રમાણે ૪-૫ બેકુ લેવી. પછી ડાબો પગ આગળ લંબાવીને જમણા પગ પર




બેઠક લેવી. આને 'વન લેગડ ડીપ ની બેન્ડ' કહે છે.

કસરત-૧૪ : લીંતમાં દોરીઓ ભરાવીને અને લીંત તરફ માયું કરીને ચિત્રાંક-૪ પ્રમાણે ચત્તા સૂધ જવું અને હાથને માથાની પાળળ લાંબા કરીને

રાખવા. દોરીઓને આગળ તથા ઊંચે બેંચી, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બંને હાથને ઊંચે આણવા અને પુનઃ નીચે લાવવા. એ રીતે ૮-૧૦ વખત કરવું. આને 'ટૂ લેન્ડઝ પુલ ઓવર' કહે છે.

કસરત-૧૫ : ચિત્રાંક-૫ પ્રમાણે રકાખીમાં



૨૪૨ ક્રેચલ એક્સપાન્ડરની કસરતો : ૧૬ થી ૨૨

પગ રાખીને સરિધા જિલા રહેવું. પછી ચિત્રાંક-૬ પ્રમાણે ખલાને શક્ય જેટલા જિચા અને પાછળ લઈ દ્વારીઓને ઉપર એંચવી, પછી પુનઃ ખલાને નીચે કરવા. એ પ્રમાણે વારંવાર કરવું. આને 'શોલ્ડર અગ' કહે છે.

અમેરિકાના ગ્રેન્ડ હેલ્પી ડીટ્સે રખરની દ્વારીઓની મહેનતનું એક સાધન બનાવેલું છે. તેની કસરતોના ડેટલાક પ્રકારો અત્રે આપેલા છે. ચિત્ર જેવાથી એ સાધનની કલ્પના આવી શકે. આશરે દુંગ પહેણા અને રૂંડ કૂટ લાંબા એવા એક ભડા લાકડાના પાટિયાને આવી રખરની દ્વારીયે બેસાટેલી છે; અને તેના ભીજ છેડા લાકડાના એક ગોળ દાંડામાં બેસાટેલા છે. તેને 'ટેવલપર' કહે છે. જરૂર પ્રમાણે એ દ્વારીઓ વધારી ઘણાડી શકાય છે. પાટિયા ઉપર જિલા રહીને કે સૂઈ જઈને આ કસરતો કરાય છે.

કસરત-૧૬ : ચિત્રાંક-૧ પ્રમાણે લાકડાના પાટિયા ઉપર પગ રાખી, બેદક લઈને બેસવું. પછી દાંડાની નીચે માયું વાલી, તેને તોકની પાછળ રાખી બંને હાથ વડે પકડવો. પછી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જિલા રહેવું અને પ્રથમ નીચે બેસીને પુનઃ તેવા જ જિલા થવું. આવી ૮-૧૦ બેદકો કાઢ્યો. આ બેદક પણ સાદી બેદકની પેઠે પગનાં તળિયાં જમીનને અડકાલેલાં રાખીને જ કાઢવાની છે.

કસરત-૧૭ : ચિત્રાંક-૨ પ્રમાણે પંલ ઉપર બેદક લઈ પાટિયા ઉપર બેસવું. દાંડાને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બોચી પર રાખીને બંને હાથથી પકડવો. અને પછી પંલ ઉપરની બેદક ૮-૧૦ વખત કાઢવી.

કસરત-૧૮ : ચિત્રાંક-૩ પ્રમાણે પાટિયા ઉપર જિલા રહીને બંને હાથ ચતા રાખીને દ્વારીઓની મૂડ હાથમાં પકડવી. પછી જમણા હાથને કોણીમાંથી વાળીને ખલાની નજીક લાવવો અને પુનઃ તેને લાંબો કરવો. પછી ડાણા હાથથી પણ તે જ પ્રમાણે કરવું. આ રીતે હાથની અદલાઅદલી કરી ૮-૧૦ વખત કરવું.

કસરત-૧૯ : ચિત્રાંક-૪ પ્રમાણે પાટિયા ઉપર ચતા સૂઈ જઈને, બંને પગને દાંડાની નીચે રાખવા. પછી ગોડળામાંથી પગને ટદાર કરીને દાંડાને ઉપર ધેકેલવો. અને પુનઃ પગને વાળીને નીચે લાવવો. એ રીતે ૮-૧૦ વખત કરવું.

કસરત-૨૦ : ચિત્રાંક-૫ પ્રમાણે પાટિયા ઉપર જિલા રહી, દાંડાને બંને હાથથી પકડવો. પછી કમરમાંથી ટદાર થઈને દાંડાને હાથથી એંચી માથા ઉપર લાવવો અને પુનઃ નીચે આણવો. એ પ્રમાણે ૮-૧૦ વખત કરવું.

કસરત-૨૧ : ચિત્રાંક-૬ પ્રમાણે પાટિયા ઉપર ચતા સૂઈ જઈ, દાંડાને છાતીની ઉપર રાખવો. પછી તેને માથા પાછળ લાવી પુનઃ મૂળ સ્થાને આણવો. એ પ્રમાણે ૮-૧૦ વખત કરવું.

કસરત-૨૨ : ચિત્રાંક-૭ પ્રમાણે પાટિયા ઉપર જિલા રહીને અને જમણા હાથને ચતો રાખીને દાંડાને પકડવો. પછી જમણા હાથને, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઉપર જાચે લેવો અને પુનઃ નીચે પરત આણવો. એ પ્રમાણે ૮-૧૦ વખત જમણા હાથથી અને ૮-૧૦ વખત ડાણા હાથથી કરવું.



૨૨. પ્રક્રીણી કસરત પ્રકારો

આ પ્રકરણમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના પ્રયોગિતા કસરતપ્રકારોનું વિવરણ આપ્યું છે. આ કસરતપ્રકારો નીચે મુજબ છે :

૧. જપાની પદ્ધતિની કસરતો
૨. દ્વારડાં ફૂદ
૩. દ્વારડું ચઢ
૪. વોલ બાર્સ
૫. એગ પર્નિંચગ
૬. મેડિસીન બોલ
૭. યુલવર્કર
૮. પોતાના વડે પોતાનું માલિસ

૧. જપાની પદ્ધતિની કસરતો

ઘરમાં જેમ પાયાનું મહત્ત્વ છે, તેમ વ્યાયામ કે રમતપ્રકારો માટે કસરતોનું મહત્ત્વ છે. દરેક પ્રગતિશીલ દેશોમાં શરીરને તૈયાર કરવા માટેની આગળી કસરતો હોય છે. જપાની પદ્ધતિની કેટલીક વિશિષ્ટ કસરતો અતે આપી છે. આમાં પોતાના જ કંડાથી કંડાને, દંડથી દંડને અને પગથી પગને અટકાવીને કે લરાવીને કે ધકેલોને પણ વ્યાયામ આપવાનો છે. ડેંડ પણ જેડીદારની મદદ લીધા સિવાય, એકલા પણ આ કસરત કરી શકાય છે. અતાં જેડીદાર હોય તો કસરત વધારે સારી રીત થાય અને કંટાળો ન આવે.

કસરત-૧ : ચિત્રાંક-૧ પ્રમાણે બંને જગ્યે સામસામે જિલ્લા રહીને, એકમેકના આંગળામાં આંગળાં ધાલોને અને છાતી સામે છાતી જેડીને

જિલ્લા રહેવું. વળી એવખતે પગ પહેણા રાખીને શરીરનો તોલ આગળ નાખવો; અને પછી એક જગ્યે ભીજને પાછળ ધકેલવા પ્રયત્ન કરવો. આ વખતે સામાવાળાએ શક્ય તેઠલો અટકાવ કરતાં કરતાં શરીરને પાછળ લેવું. પછી ભીજાએ પણ પહેણાને એજ પ્રમાણે પાછળ ધકેલવો અને પહેણાએ ભીજને અટકાવતાં અટકાવતાં પાછળ જવું. આ પ્રમાણે ૮-૧૦ વખત કરવું. આ કસરતને ‘સ્ટ્રગલ’ કહે છે.

કસરત-૨ : ચિત્રાંક-૧ પ્રમાણે સીધા જિલ્લા રહીને, બંને હાથને આગળ લાંખા કરવા અને જમણા હાથ ઉપર ડાણા હાથને રાખવો તથા ચિત્રમાં ખતાબ્યા પ્રમાણે બંને હાથનાં આંગળાં એકમેકમાં ભરાવવાં. પછી નીચેના જમણા હાથથી ડાણા હાથને ઉપર ધકેલવો. અને ડાણા હાથે નેર કરીને જમણા હાથની ગતિને અવરોધધી. અતાં અવરોધ એટલો કરવો, કે ડાણો હાથ ધીમે ધીમે ઉપર ધકેલાય. બંને હાથને ડાણીમાંથી ટટાર રાખવા. એ રીતે બંને હાથ માથા તરફ જાંચા જય, એટલે ડાણા હાથથી જમણા હાથને નીચે દાખાવવો અને જમણા હાથે તેને અવરોધતા અવરોધતા નીચે આવવું. આ પ્રમાણે ૫-૭ વખત કરવું.

કસરત-૩ : ચિત્રાંક-૨ પ્રમાણે જિલ્લા રહીને, જમણા હાથના કંડાની ઉપર ડાણા હાથતું કંડું રાખવું. હવે આગળ જળુબ્યા પ્રમાણે જમણા હાથને સારી મહેનત થાય એટલું નેર ડાણા હાથથી વાપરી, જમણા હાથને જાંચે જવા દેવો; અને એ રીત માથા તરફ હાથ જય એટલે ડાણા હાથથી જમણા હાથને દાખવો; અને જમણાનું હાથે જિલ્લદું નેર કરીને પ્રથમની સ્થિતિમાં નીચે આવવું. આ પ્રમાણે ૫-૬ વખત કરવું.

કસરત-૪ : બંને જણે પોતપોતાનો જમણો
પગ આગળ રાખી, જમણું હાથનાં કાંડાં એકમેકને
અડકડાને ચિનાંક-૩ પ્રમાણે સામસામે જિલ્લા રહેલું.
પછી ગ્રયમ ડાખી નાજુના કસરતાને સામાવાળાના
એ હાથને પાછળ અને જીંચે ધેઢેલવો. એ વખતે
સામાવાળાઓ પોતાના હાથને એકદમ ધેઢેલવા ન હેતાં,

તને સારી મહેનત થાય તેટલા જોરથી તને અવરોધ
કરતાં કરતાં, પોતાના હાથને જીંચે જવા દેવો; અને
એ રીતે હાથ ઉપર જાય ગોટલે તેણે પહેલાના
હાથને નીચે દાખવો. આ પહેલાંએ તેનો અવરોધ
કરતાં કરતાં, પોતાના હાથને સાવકશ નીચે જવા
દેવો. આ રીતે બંનેએ પ=૬ વખત કરલું. પછી



કસરત-૧



કસરત : ૨ થી ૫

આજ પ્રમાણે, પણ બંને જણે ડાખો પગ આગળ મુક્કી, ડાખા હાથનાં કંડાં વડે કરવું; એટલે બંને હાથને સરસ કસરત ભળશે.

કસરત-૫ : ચિત્રાંક-૪ પ્રમાણે બંને જણે જમણા હંગને આગળ રાખીને, જમણા હાથને ડોણીના વળાંકમાં એકમેકની ઉપર રાખવા. પણી ડાખી

ખાજુના કસરતથાને સામાના હાથને દાખીને સામાવાળાને પાછળ પાડવાનો પ્રયત્ન કરવો; અને આ સામાવાળાએ જરૂર નેટલું વિરદ્ધ જેર વાપરીને પછી જ પોતાનો ઓંક પાછળ જવા દેવો. આ રીતે પાછળ ઓંક જતાં જ તણે પહેલાના હાથને પાછળ દાખીને પાછળ ધકેલવો. આ રીતે બંને જણે ૫-૬

વખત કરવું; પણી એજ પ્રમાણે, પણ ડાયો પગ આગળ મૂકીને ડાબા હાથ વડે કરવું, એવું બંને હાથને કસરત ભણશે.

કસરત-૬ : પીડ સાથે પાઠને જોડાને બંનેએ જિલ્લા રહેવું. પણી ચિત્રાંક-૧ પ્રમાણે જમણી તરફના

પહેલા કસરતથાને પોતાના બંને હાથને પાછળ ઉચ્ચા લાવીને, ડાણી તરફના કસરતથાજના અલા ઉપર નાખવા; અને તે હાથને તેણે જમણા હાથથી ડાણા હાથને અને ડાણા હાથથી જમણા હાથને, એવી રીતે ચિત્રમાં બાતાવ્યા પ્રમાણે પહુંચવા; અને



પોતે કુમરમાંથા આગળ વળીને એ પહેલા કસરત-ભાજને પોતાની પીડ ઉપર જિયકવો; અને તેને લઈને આબુલાબુ ફરવું. આ પીડ ઉપર આવેલાએ પગ લાંણા. રાખેલા છે, તેને કુમરમાંથા શરીરને વાળીને વધારે છિંચે પેટ તરફ લાવવા. એથા એના પેટના સનાયુઓને સરસ વ્યાધામ મળે છે. જિયકનારે પોતાના અંને પગને ઘૂંઘરયમાંથા રદાર રાખવા.

પછી ડાખી તરફનાએ પણ એ જ પ્રમાણે જમણી તરફનાને જિયકવો અને આબુલાબુ ફરવું, કે નેથા અંનેને સરસ કસરત મળે.

કસરત-૭ : ચિત્રાંક-૨ પ્રમાણે કસરતભાનોએ પોતાના અંને હાથને બાદુમાં લાંણા કરવા અને એકમેકનાં આંગળામાં આંગળાં ભરાવવાં; તથા છાતી સાથે છાતી લગાડીને બિલા રહેવું. વળી તેમણે અંનેએ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પોતાના ડાખા પગને આગળ મુકવો. પછી ચિત્રમાંના ડાખી તરફના કસરતભાનો જમણી તરફનાને છાતીના નેરથી પાછળ ધક્કલવો; અને સામાવાગાએ તેને અવરોધતા અવરોધતા પાછળ જવું. પછી તેજ પ્રમાણે જમણી તરફના રમનારે ડાખી તરફનાને છાતીના નેરથી પાછળ ધક્કલવો અને ડાખી તરફનાએ તેને અવરોધતા અવરોધતા પાછળ જવું.

પછી અંનેએ જમણી પગને આગળ મુકી આ પ્રમાણે કરવું. એટલે અંને પગને ઉત્તમ કસરત મળશે.

કસરત-૮ : ચિત્રાંક-૩ પ્રમાણે અંનેએ પોતાના પગને લાંણા કરીને એકમેકની સામે બેસવું, અને પોતાનો એક પાછળ ન જય એવી રીતે પોતાના અંને હાથને પાછળ જમીન પર ટેકવી રાખવા. પછી તેમાંના એક પોતાના જમણી પગના તળિયાને સામેનાના ડાખા પગના તળિયાને લગાડીને, અંનેએ એકમેકને પોતાના એ નેલેલા પગથી જ પાછળ ધક્કલવા. આમાં અંનેને સારી કસરત મળે છે. પછી પગ બદલોને આ પ્રમાણે કસરત કરવી.

ડાખી બાબુના કસરતભાનો પોતાનો જમણો પગ જિયો કરવો અને તેના પગના પોંચાને, સામાવાળાએ પોતાના જમણી પગનો પોંચો અંદરથી લગાડવો. પછી વારાઝરતી એકમેકના પગને બાબુએ તથા નીચે ધક્કલીને મહેનત કરવી. પછી એજ પ્રમાણે ડાખા પગ એકમેકને લગાડીને મહેનત કરવી. આથી પગના સનાયુઓને સરસ કસરત મળે છે.

આજ પ્રમાણે બિલા રહીને પણ જુદી જુદી જગાએ પગ લગાડીને પગની કસરતો કરી શકાય.

૨. દોરડાં ફૂદ

પ્રાસ્તાવિક : દોરડાં ફૂદવાં એ એક સ માન્ય કસરતો (કલેસ્થનિકસ)નો પ્રકાર છે. ઓછી જગ્યામાં, ઓછા પૈસે અને ઓછા સમયમાં શરીરને સ્વસ્થ અને સુદોળ રાખવા માટે દોરડાં ફૂદવાની કસરત ખૂબ જ ઉપયોગી નીવડે છે. નાનાં છોકરાંએ અને ખાસ કરીને છોકરીએ આનો ઉપયોગ રમત તરીકે કરતાં હોય છે. આમાં ઉંમર અને જલિનો કોઈ તશ્શવત રહેતો નથી. અતાં પણ જે નાનપણુથી આનો મહાવરો ન હોય તો મોટી ઉંમરે આ કૌશલ્યો શીખવાં હાસ્યજનક લાગે છે. પણ જે આનો મહાવરો સતત ચાલુ રાખ્યો હોય તો મોટી ઉંમરે પણ એની વિવિધ કસરતો કરી શકાય છે. જે અમૃક સમયમાં જ વધારેમાં દોરડાં ફૂદવાનો મહાવરો કરવામાં આવે તો ‘ગતિ’ અને ‘ચપળતા’નો વિકાસ થાય છે, જ્યારે સળગ કેઠલી વાર સુધી દોરડાં ફૂદી શકાય એનો મહાવરો કરવાથી ‘સહનશીલતા’નો વિકાસ થાય છે.

દોરડાં ફૂદવાની કસરતો તાલણક હોય છે. એટલે જે એકવાર એનો તાલ બરાબર બેસી જથું તો કસરતોમાં વૈવિધ્ય સહેલાઈ કેળવી શકાય છે. દોરડાં ફૂદતી વખતે દોરડું જ્યારે પગ નીચેથી પસાર થાય, તે જ વખતે પગ ઉચ્ચા થાય, તેવું સમયનું ભાન કેળવવું એ ખાસ અગ્રથનું છે. જે એક વખત આવું સમયનું ભાન કેળવાય તો



વ્યક્તિગત. જ નહીં, પણ નેડીમાં કસરતો પણ સહેલાઈથા કરી શકાય છે. સામાન્ય દેરકાર દ્વારા આપી કસરતોમાં વિવિધતા લાવી શકાય છે. મનો-વૈજ્ઞાનિક ફાયદાએ દોરણું એં સાથીતું કામ કરે છે; એટલે વ્યક્તિને એકલાપણું લાગતું નથી. અને એ રીતે દોરણાં ફૂદ્દી વખતં કંદાળો આવતો નથી.

દોરણાની લંબાઈ નિશ્ચિત હોતી નથી, કારણું કે તે ફૂદનારની ઉંચાઈ ઉપર આધાર રાખે છે અને એવી રીતે જ જો નેડીમાં ફૂદવાનું હોય તો દોરણાની લંબાઈ થાડી વધારે રાખવી જિતાવહ છે. દોરણાના છેડા ઉપર લાકડાના ડેખાસ્ટીકના હાથા રાખવા વધુ જિતાવાહ છે, કે નેતે કારણે ફૂદી વખતે હાથના પંખને ઠંબ થવાની શક્યતા રહેતી નથી. સમય નિશ્ચિત કરીને, કાણું વધારે દોરણાં ફૂદી શકે છે, એવી હરીકાઈએ પણ ગોડવી શકાય છે. અને એનાથી ગતિ અને ચપળતાનું માપન

કરી શકાય છે. એવી જ રીતે દોરણું વધારે સમય ચૂંધી સળંગ ફૂદી શકે છે, તેવી હરીકાઈ દ્વારા ચપળતાની સાથે સાથે સહેલાઈલતાનું માપન કરી શકાય છે. નાની છેકરીએ માટે દોડની સાથે દોરણાં ફૂદવાનું કૌશળ્ય ઉમેરી શકાય છે; અને એટલા માટે જ ખાસ કરીને બહેનો માટે ૨૫ મીટર અને ૫૦ મીટર અંતરની દોરણાં દોડની હરીકાઈએ ગોડવી શકાય છે.

દોરણાં ફૂદવાની કસરતથી ફૂદ્ય, પદૃત, ગ્લીઝ, સ્વાદુપિંડ વગેરે સંધળી અંતરિન્દ્રિયોને સારી મહેનત થતાં, તે બધાંની કામગીરી સુધરે છે; દેઝસાં મજબૂત ણાની છાતી પહોળી બને છે અને આરોગ્ય સુધરે છે. આ કસરતથી પગના સ્નાયુઓને ઉત્તમ પ્રકારની મહેનત થાય છે અને તે વધારે ચપળ અને કાર્યક્ષમ બને છે. ઉપરાંત સમય શરીરને ઉત્તમ કસરત મળતાં તે હળવું અને ચાલાક બને છે. આ કારણે કુસ્તી, બોક્સિંગ, ઐલફૂદ, બાસ્કેટબોલ, વોલીબોલ, ફૂટ-બોલ, હેડો વગેરે રમતોના નામાંકિત ઐલાડીએ દોરણાં ફૂદવાની કસરતથી શરીરને તૈયાર કરે છે. ઐલાડીએ દોરણાં ફૂદની કસરતોનો મહાવરો સતત ચાલુ રાખવો ખૂબ જ હિતાવહ છે.

દોરણાં ફૂદની કસરતો


દોરણાં ફૂદની દરેક કસરત સવળા અને અવળા, એમ બે પ્રકારે કરાય છે. ‘સવળા’ એટલે નેમાં દોરણાની ગતિ આગળની બાજુ ઉપરથી નીચે અને પાછળની બાજુ નીચેથી ઉપર તરફ હોય; તથા ‘અવળા’ એટલે નેમાં દોરણાની ગતિ આગળની બાજુ નીચેથી ઉપર અને પાછળની બાજુ ઉપરથી નીચેની તરફ હોય. દોરણાં ફૂદવાનો આરંભ કરતી વખતે, બંને પગ વચ્ચે સામાન્ય અંતર રાખી બિલા રહેવું; બંને હાથમાં દોરણાના છેડા પકડવા અને દોરણાનો મધ્ય લાગ સવળા પ્રકાર માટે જમીનની પાસે પાછળ તથા અવળા પ્રકાર માટે જમીનની પાસે આગળ રાખવો. બંને પગ પર સરખું વજન રાખવું અને શરીરના સ્નાયુઓને ઢીલા રાખવા.

૧. એ પગે : આ કસરતમાં જ્યારે દોરું પગ નીચેથી પસાર થાય ત્યારે જ બન્ને પગે સાથે હૃદધામાં આવે છે. જે ખેલાડી પંજ ઉપર હુદે તો આંચકા ઓળા લાગે અને થાક પણ ઓળા લાગે છે.

૨. એસીને : આગળની કસરત-૧ : (એ

પગે દોરડાં હુદ)નો સારો મહાવરો થયા પછી ચિત્રાંક-૧ માં દર્શાવ્યા મુજબ પગના પંજ પર બેસીને આ કસરત કરવાથી પગના સ્નાયુઓ ખૂબં મજબૂત અને થપળ થને છે.

૩. એક પગે : ચિત્રાંક ૨ માં દર્શાવ્યા મુજબ




આ કસરતમાં ખેલાડી એક પગે લગડી રાખીને ઝૂદે છે; અને પછી પગ બદલે છે. સારો મહાવરો થયા પછી એક પગે, બંને પગે, ખીજન પગે એ પ્રમાણે કુમ રાખી ઝૂદે છે.

૪. સાયકલ : આ કસરતમાં ખેલાડી જગ્યા ઉપર સાયકલ ચલાવતો હોય તે પ્રકારની છિયા

કરવાની સાથે દોરડાં ઝૂદ્ધશે. પછી એ જ કરતાં કરતાં ખેલાડી આગળની ખાલુ જશે.

૫. પગની આંટી : આ કસરતમાં ખેલાડી પગના આંટી રાખીને ઝૂદે છે.

૬. બેચડી હારી : ચિત્રાંક ૧ માં દર્શાવ્યા મુજબ



પ્રકૃતીશ્વર કસરત પ્રકારો

આ કસરતમાં દોરડાને બેવડું કે તેવડું વાળીને, ૧૮-૨૦ ઇચ્છિ જેટલું બનાવી, તેના છેડા બંને હાથ વડે પકડી, તેની ઉપરથી આગળ-પાછળ ફૂદવાનું હોય છે.

૭. હાથની આંટી : આ કસરતમાં ચિનાંડ-૨ માં દર્શાવ્યા મુજબ હાથની આંટી લઈ દોરડું ફૂદવાનું હોય છે. એક વાર સાઢી અને એક વાર આંટી એમ ફૂદવાથી આનંદ આવશે.

૮. દૂર હાથ : આમાં દોરડું ફૂદનાર ચિનાંડ-૩ માં દર્શાવ્યા મુજબ બંને હાથ પહેંળા રાખીને દોરડાં ફૂદે છે.

૯. આગે સરક : આ કસરતમાં ખેલાડી દોરડું ફૂદતાં ફૂદતાં આગળની બાબુ સરકે છે.

૧૦. બાબુ સરક : આ કસરતમાં ખેલાડી દોરડું ફૂદતાં ફૂદતાં બાબુ તરફ સરકે છે. આ કુચિયા વારાફરતી બને દિશામાં કરી શકાય છે.

૧૧. અવળા : આમાં દોરડાં ફૂદના ઉપરોક્ત પ્રકારો ખેલાડી દોરડાને અવળા દિશામાં ફેરવીને કરે છે; એટલે કે દોરડું પાછગથી પગ નીચે થઈ આગળની બાજુ આવે છે.

૧૨. પગના તથા હાથની આંટી : આ કસરતમાં ખેલાડી એક સાથે હાથની અને પગની આંટી રાખીને ફૂદે છે.

૧૩. સામસામે મેં : આ કસરતમાં બને ખેલાડી સામસામે મેં રાખીને જિલ્લા રહેશે. આમાંથી એકની પાસે દોરડું હશે, પણ બને ખેલાડીઓ એક સાથે ફૂદશે. આ જ પ્રમાણે બને જોડાડારા પાડેપીડ અડકાડીને જિલ્લા રહીને તથા એકની પાછળ ખીને એમ જિલ્લા રહીને પણ દોરડાં ફૂદશે તો જોડ દોરડાં ફૂદના નવા પ્રકારો થશે.

૧૪. ફૂદનાર ઝરે : આ કસરત માટે

ખેલાડીઓ આગળની કસરત-૧૩ (સામસામે મેં) પ્રમાણે જિલ્લા રહેશે. બેમાંથા એક ખેલાડી ફૂકત દોરડું ફેરવશે અને ખીને ખેલાડી ફૂદવાની કુચિયા સાથે ફરતો રહેશે. નિયત સમય પછી બને જણુ કુચિયાની ફૂરણદલી કરશે.

૧૫. ત્રણુ જણુ લાઈનમાં : આ કસરતમાં બને છે જિલેલા ખેલાડીઓ પોતાની બહારની બાબુના હાથ વડે દોરડાંના છેડા પકડશે અને દોરડું ફેરવશે; તથા વર્ચ્યેના ખેલાડી સમેત ત્રણુય જણુ દોરડું ફૂદશે. અમૂક સમય પછી ખેલાડીઓ સ્થાન બદલી કરશે.


૩. દોરડું ચઢવું

પ્રાસ્તાવિક :—દોરડાની મદદથી ઉપર ચઢવું તે એક કૌશલ્ય છે અને કસરત પણ છે. જે સ્થળે ચઢવા માટે ડોઈ સગવડ ન હોય ત્યાં આજે પણ દોરડાની મદદથી ચઢવામાં આવે છે. પર્વતારાહણુની અંદર અને ફાયરબિંગના લોડો પણ એનો ઉપયોગ કરે છે. પર્વતારાહણુની અંદર તો દોરડું ચઢવાનું કૌશલ્ય ખૂબ જ અગત્યનો ભાગ લજવે છે, કારણું કે ખડકો ઉપર ચઢવા ઉત્તરવા માટે દોરડાં વિના ખીજુ ડોઈ સગવડો લાગ્યે જ ઉપલબ્ધ હોય છે. આ માટે અત્યારે મોટે ભાગે નાઈલોનના દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. લશ્કરમા ભરતી કરતી વખતે દોરડાં ચઢવાની કરોડીનો સમાવેશ હોય છે અને એવી રીતે તાકીમ વખતે પણ તેનાં ફૌશલ્યો શિખવવામાં આવે છે. આજે મોટા ભાગે વ્યાયામશાળાની અંદર કસરતો કરવા માટે જે સાધનો મૂકવામાં આવે છે, તેમાંતું એક સાધન દોરડું હોય છે, અને તેના પર ચઢવાની કસરતો કરવામાં આવે છે.

દોરડું ચઢવાની કસરતમાં આગળ આવવા માટે વ્યાયામવીરના હાથ અને ખલા મજબૂત દોરડાને જોઈએ, કારણું કે વ્યાયામવીર ‘ગુરુત્વાકર્ષણુના

બળ ની વિદ્ધિ કુયા કરે છે. આમાં વ્યાયામ-વારને પોતાના શરીર નેટલું વજન જીવદ્વાનું હોય છે અને એ દૃષ્ટિઓ તે 'વજન તાલીમ' નો એક પ્રકાર બની રહે છે. દોરડું ચઢવાનું કૌશલ્ય શીખ-વતી વખતે દોરડા ઉપરથી વ્યવસ્થિત ઉત્ત્વાં. તે પણ ખાસ શીખવાડવું જોઈએ, કારણ કે જે વિદ્ધિ વાસ્તવિક શીખવાડાનું હોય અને એ એક પ્રકાર બની રહે છે. દોરડું ચઢવાનું કૌશલ્ય શીખ-વતી વખતે દોરડા ઉપરથી વ્યવસ્થિત રીતે ઉત્તર નહીં અથવા હશે.

બહાર થાકી જય; તો દોરડા ઉપરથી પડી જવાની શક્યતા રહે છે. દોરડું ચઢવાની શરૂઆત કરનારાઓ માટે દોરડા નીચે ગાદ્યાં અથવા રેતી અથવા કોઈ પણ નગમ વસ્તુ ગાખવી જરૂરી છે, જેને કારણે વ્યાયામવીરનો આત્મવિવાસ વધે અને અક્સમાત વખતે ઘન થવાની શક્યતા એછી રહે. દોરડા ઉપર કામ શરૂ કરતી વખતે, દોરડું ખરાળર બાંધલું



દોરડું ચઢવાની કસરતો

છે, વચ્ચમાં કોઈ જગ્યાએ ધસારો પડ્યો છે કે કેમ, ભેજ કે તેલવાળું નથો, તેની ચકાસણી કરવી જરૂરી છે; નહીં તો અકસ્માત ચવાની શક્યતા રહે છે.

ને દોરડા ઉપર અમૃક અંતર નક્કી કરીને નિશાન કરવામાં આવે, તો ડોણ ઓછામાં ઓછા સમય લે છે તે જતની હરીકાઈ ગોડવી શકાય. એવી જ રીતે ડોણ સણાંગ કેટલા અંતર સૂધી દોરડું ચીફી શકે છે, તે જતની પણ હરીકાઈ ગોડવી શકાય. પહેલી હરીકાઈમાં ઐલાડીની ગતિ અને તાકાતનું મલ્યાંકન થશે, જ્યારે ખીજુ હરીકાઈમાં તાકાત અને સહનશીલતાનું મલ્યાંકન થશે. દોરડું ચઢવાથી હાથના, પલાના અને છાતીના સ્નાયું એને ખાસ કસરત મળે છે અને તનો ઉપયોગ જુદી જુદી રૂમતોમાં કરી શકાય છે; નેમ કે, એલુદુદમાં ઇંકનાર માટે, સુક્કાથાળ માટે, વજન જિચક માટે, ફિડેટમાં બોલર માટે વગેરે. દોરડું ચઢવાની કસરતોમાં એક દોરડા ઉપર ચઢવાની અને એ દોરડાં ઉપર ચઢવાની કસરતો પ્રયત્નિત છે.

અ. એક દોરડા ઉપરની કસરતો


૧. ખીંડ ઉપર સૂદ્ધ જવું અને ઊઠવું :- વ્યાયામવીર બન્ને પગ વચ્ચે યોગ્ય અંતર રાખીને દોરડા પાસે જિલો રહેશે અને દોરડાને બન્ને હાથ વડે માથા ઉપર પકડશે. અન્ને પગ ખસેડ્યા વિના

ધીમે ધીમે વારાક્રતી હાથ નાચે લઈને ખીંડ ઉપર સૂદ્ધ જવ તે સ્થિતિમાં આવશે. (ચિત્રાંક-૧) એ સ્થિતિમાંથી ઐલાડી ધીમે ધીમે એ જ રીતે મૂળ સ્થિતિમાં જાઓ થશે.

૨. ચિન અપ :- દોરડા પાસે જિલો રહીને બન્ને હાથ વડે દોરડાની મજબૂત પકડ લેવી. પછી બન્ને હાથની મદદથી દાઢીને હાથની ઉપર લઈ જવા અને એ સ્થિતિમાં આશરે એ થી નણું સેકન્ડ રોકાવું. (ચિત્રાંક-૨) ધીમેથી એ જ રીતે પાછા મૂળ સ્થિતિમાં આવવું. આ કસરત સીંગલ બારના ‘પુલ અપ’ નેવી છે.

૩. પગ અને પંજાની મદદથી ઉપર ચઢવું :- દોરડાને બન્ને હાથ વડે મજબૂતાઈથી પકડવું; અને શરીરને ઉપરની માજુ એંચવું. શરીરને એ જ સ્થિતિમાં રાખીને દોરડાને એ પગની વચ્ચે લેવું અને બન્ને પંજ વચ્ચે તને દળાવીને રાખવું. પગના પંજાની પકડ મજબૂત રાખીને, બન્ને હાથને સીધા કરવા અને દોરડા ઉપર હાથ સીધા રાખીને પકડ લેવી. ક્રીથી પગના પંજ વચ્ચે દોરડું લેવું અને ક્રિયા સતત ચાલુ રાખવી. (ચિત્રાંક-૩)

૪. પગનાં તળિયાંની ચૂડ ખનાવી દોરડા ઉપર ચઢવું :- આ કસરતની અંદર ઐલાડી બન્ને પગનાં તળિયાંની મદદથી દોરડા ઉપર મજબૂત પકડ



દે છે અને હાથ સીધા રાખીને લટકી જય છે. (ચિત્રાંક-૪) પછી પગની પકડ મજબૂત રાખીને શરીરને સીધું કરવું અને દોરડાને ઉપર પકડવું. ફરીથી પગના તળિયાની મદદથી મજબૂત પકડ લઈને વારાફરતી ઉપર ચઢવું. (ચિત્રાંક-૫)

૫. પગના તળિયાની મદદથી દોરડા ઉપરથી નીચે ઉત્તરવું : - આમાં કસરત-૪ની જેમ પગનાં તળિયાંથી દોરડા ઉપર મજબૂત પકડ લે છે અને ઉપર જવાને બદલે વારાફરતી હાથ નીચે લાવે છે. આ કસરત દરમયાન દોરડું સણંગ ઐલાડીના બન્ને પગના તળિયાની વચ્ચે જ રહે છે, જ્વાં સુધી પગ જમીનને સ્પર્શ ન કરે ત્યાં સુધી એ જ ક્રિયા ચાલુ રાખવી.

૬. પગની આંઠી વડે દોરડા ઉપર ચઢવું : બન્ને પગ વડે આંઠી લગાવીને દોરડાને બે પગની વચ્ચે પકડી રાખવું. બન્ને ઢીંચણું વાંકા રાખવા. પગની પકડ મજબૂત રાખીને શરીરને સીધું કરવું. ફરીથી આ જ રીતે પગની આંઠી લગાવવી અને દોરડા ઉપર ચઢવાની ક્રિયા સતત ચાલુ રાખવી. (ચિત્રાંક-૬)

૭. હૃથના મદદથી દોરડા ઉપર ચઢવું : આ કસરત આમ તો સહેલી ગણ્યાય, પરંતુ વ્યાધમનીરના હાથોમાં ખૂબ જ તાકાત હોવી જરૂરી છે. આ કસરતમાં ઐલાડી વારાફરતી હાથને દોરડાની ઉપર લઈ જશે. આ કામ કરતી વખતે એક હાથની પકડ મજબૂત હોય ત્યારે જ ખીંચ હાથની દોરડા ઉપર પકડ લેવી. અન્યથા હાથ ખ્સી જવાની શક્યતા રહે છે.

૮. બન્ને પગને શરીરના કાટખૂણે સીધા રાખીને દોરડા ઉપર ચઢવું : પ્રથમ બન્ને હાથથી દોરડાની મજબૂત પકડ લઈ, શરીરને ઉચ્ચે ઉઠાવી, પગને સીધા કરીને કમરથી કાટખૂણા થાય તેવી સ્થિતિ લેવી. આ સ્થિતિને 'હાક લીવર' કહે છે. (ચિત્રાંક-૭) આ સ્થિતિ જગવી

રાખીને વારાફરતી હાથને દોરડા ઉપર લઈ જવા અને એ જ રીતે નીચે ઉત્તરવું. આ કસરત વખતે દોરડું એક બાજુએ અથવા બે પગની વચ્ચમાં રાખ્યા શકાય.

૮. દોરડા ઉપર આરામ : આ કસરતમાં ઐલાડી પોતાના શરીર વડે જ આરામ લઈ શકે છે. દોરડા ઉપર અમૂક અંતર ચદ્યા પછી દોરડાને બે પગની વચ્ચમાં રાખવું અને પગના પંજા વડે દોરડાની પકડ રાખવી. પછી દોરડાને એક બાજુ કમર અને ગરદનની પાછળા લઈ જવું. ત્યાર બાદ બન્ને હાથ છોડી દેવા. આ વખતે દોરડા ઉપર કોસ લેવો આકાર બને છે (ચિત્રાંક-૮). આ સ્થિતિમાં ઐલાડી પોતાનો થાક ઉતારીને ફરીથા જરૂર પડે તો દોરડાની ઉપર ચઢી શકે છે.

બ. બે દોરડાં ઉપરની કસરતો

આ કસરતો મોટા ભાગે 'રોમન રીંગ'ની કસરતો નેવી જ છે. તથાવત એટલો છે કે આમાં રીંગને બદલે ઐલાડી દોરડાંને પકડે છે.

૧. પાછળની બાજુ વતું : બન્ને દોરડાં ઉપર, પગ જમીનને સ્પર્શ ન કરે એટલા અંતરે ચઢીને બન્ને ઉપર લટકી જવું. આ વખતે બન્ને હાથ સીધા અને એક બીજાને સમાંતર રાખવા. પછી હવામાં બન્ને પગના ઢીંચણુંને વાળીને પેટ તરફ લાવવા (ચિત્રાંક-૧). ત્યાર બાદ બન્ને પગને ઉપરથી પાછળની બાજુ લાવીને, હાથ સીધા રાખીને લટકવું (ચિત્રાંક-૨). આ ક્રિયા વિરદ્ધ દિશામાં કરીને ઐલાડી મૂળ સ્થિતિમાં આવી શકે છે અથવા બન્ને હાથ છોડીને નીચે પણ આવી શકે છે.

૨. લટકીને કમાન કરવી : આમાં પણ કસરત-૧ની જેમ જ લટકી જાય, શરીરને પાછળની બાજુ લઈને, દોરડા ઉપરની હાથની પકડ ઉપર પગના પંજા લેરવવા અને કમરમાંથી કમાન બને તે

જતની સ્થિતિ લેવી. (ચિત્રાંક-૩). પાછા આવતી વખતે આ જ દ્વિયા અવળા કુમમાં કરવી.

૩. ઊલટા લટકવું : દોરડા ઉપરની પકડ ઉપરોક્ત કસરતની જેમ જ રહેશે. ત્યાર પછી પગને સીધા ઉપર લઈ જવા. શરીરને બન્ને દોરડાની વચ્ચમાં સમાંતર રાખવું. પંજ ઉપરની બાજુ સીધા રાખવા (ચિત્રાંક-૪). આ સ્થિતિ શીર્ષસંન જેવી છે. હાથની પકડ ખૂબ જ મજબૂત રાખવી જરૂરી છે; કારણ કે, સમગ્ર શરીરનું વજન હાથ ઉપર રહેશે. આ જ રીતે નીચેની તરફ ઉત્તરવું.

૪. પગને શરીરના કાટખૂણે રાખીને લટકવું : દોરડા ઉપર એવી રીતે પકડ લેવી, કે જેથા પગ જમીનને સ્પર્શ ન કરે. પછી બન્ને હાથ ઉપર એક સરખું વજન રાખીને બન્ને પગને એક સાથે શરીરના કાટખૂણે લાવવું અને પગના પંજ એંચીને સીધા રાખવા (ચિત્રાંક-૫).

૫. પગને શરીરના કાટખૂણે રાખીને ઊલટા લટકવું : ઉપરની કસરત-૩ પ્રમાણે ઊલટા લટકવું. પછી બન્ને પગને સીધા રાખીને કુમરમાંથા કાટખૂણો બને તે રીતે લાવવા. આ વખતે બન્ને પગના પંજ એંચેલા હોવા જોઈએ (ચિત્રાંક-૬).

૬. પગ અને પંજ વડે દોરડા ઉપર ચઢવું : ‘ એક દોરડા ઉપરની કસરત-૩ ’ પ્રમાણે

બન્ને દોરડાને પગના પંજ વચ્ચે દ્વારાવીને રાખવા. પછી વારાક્રતી હાથને ઉપર લઈ જવા.

૭. વારાક્રતી હાથની મદદથી દોરડા ઉપર ચઢવું : બન્ને હાથની મદદથી દોરડા ઉપર લટકવું. ત્યાર ખાદ શરીરનું વજન એક હાથ તરફ લઈ જવું અને ખીંજ હાથની મદદથી દોરડાને લગભગ ૧૫ સે. મી. નેટલું જાચે પકડવું. પછી શરીરનું વજન ખીંજ હાથ તરફ લઈને ખીંજ હાથને ઉપરની બાજુ પકડવું. આવી રીતે આ દ્વિયા વારાક્રતી ચાલુ રાખવી. એક જ સમયે વધારે અંતર દોરડા ઉપર કાપવાની કોશીશ ન કરવી. આજ રીતે દોરડા ઉપરથી નીચે ઉત્તરી શકાય.

૮. પગને શરીરના કાટખૂણે રાખીને દોરડા ઉપર ચઢવું : ઉપર દર્શાવેલ કસરત-૪ પ્રમાણે દોરડા ઉપર સ્થિતિ લેવી. એ જ સ્થિતિ જળવી રાખીને વારાક્રતી હાથ ઉપર લઈ જઈને દોરડા ઉપર ચઢવું. આ કસરતમાં હાથની સાથે સાથે પગ અને પેટના સનાયુએ સશક્ત હોય તો જ આ સ્થિતિ જળવી શકાય છે.

૯. એ દોરડાં ઉપર આરામ : એક દોરડાની જેમજ ખેલાડી એ દોરડા ઉપર ચઢતી વખતે આરામ લઈ શકે છે. આમાં ખેલાડી દોરડા ઉપર અમૂક અંતર ચઢશે. ત્યાર ખાદ બન્ને દોરડાને



પગ વચ્ચે લાવશે અને બન્ને પગની આંદી એવી રીતે લગાવશે કે બન્ને દોરડાં પગના પંજ વચ્ચે આવી જથું. પછો બન્ને હાથ કોણીમાંથી વાળાને સીધા કરશે (ચિત્રાંક-૭). ત્યાર બાદ બન્ને દોરડાંને ક્રમર અને ખલાની પાણા લઈ જશે અને બન્ને હાથ ખલામાંથી સીધા કરશે. આ વખતે ખેલાડીનો સ્થિતિ કોસ આકારનો રહેશે (ચિત્રાંક-૮). આ સ્થિતિમાં ખેલાડી પોતાનો થાક ઉત્તારીને ફરીથી દોરડા ઉપર ચઢવાનું ચાલુ રાખો શકે છે.

૪. વોલબાસ્

પ્રાક્તાલિક : વોલબાસ્ સ્વીડિશ જુના-સ્ટીક્સનું એક સાધન છે અને પશ્ચિમના વ્યાયામની એક પદ્ધતિ છે. વોલબાસ્ એ અંગેજ શફ્ટોનો બનેલો શરૂ છે. 'વોલ' એટલે દ્વિવાલ અને 'બાસ' એટલે લાકડાનો પદ્દીઓ. આ સાધન દ્વિવાલ નેડે ચોંટલુ હોય છે અને લાકડાની પદ્દી-એની મદદથી વ્યાયામ કરવામાં આવે છે. વોલબાસ્ હરીકાઘનું સાધન ન હોવાને કારણે 'તેનુ' ચોક્કસ આદર્શ માપ નથી. છતાં પણ મોટા લાગે એની લંબાઈ ૨૩ થા ૪ મીટર અને પહેણાઈ ૨ થા ૩ મીટર સુધી હોઈ શકે. લાકડાની દરેક પદ્દી વચ્ચે આશરે ૧૫ સે. મી.નું અંતર હોય છે. પદ્દીનો ઘેરાવો આશરે ૧૦ થા ૧૫ સે. મી. અને કુલ ૧૫ થા ૨૦ પદ્દીઓ હોય છે. વોલબાસ્ હરીકાઈની આઈટમ ન હોવા છતાં પણ દરેક વ્યાયામશાળામાં આ સાધન મૂકવામાં આવે છે, કારણે કે તે એછી જગ્યામાં દ્વિવાલ સાથે ચોંટાડેલો હોય છે. વોલબાસના એ કે ત્રણું ભાગ પાડવામાં આવે છે, જેને કારણે એક સાથે એ કે ત્રણું વ્યાયામવીર એના પર કામ કરી શકે છે.

વોલબાસ્ કરોડરજુનું કસરત આપવા માટેનું અકુસીર સાધન ગણ્ય છે. એટલા માટે જ એનો ઉપયોગ 'ફીઝીયોથેર્પી'માં પણ કરવામાં આવે છે. તેથી આ જતની સારવાર આપતાં દ્વાખાના-

ઓમાં પણ આ સાધન મૂકવામાં આવે છે. આ સાધનનો ખાસિયત એ છે કે ક્રમસર કરોડરજુના મણુકાએને કસરતો આપી શકાય અને જરૂર જણ્યાય તો કરોડરજુના અમૃક ભાગને પણ કસરત આપી શકાય. આ સાધનની મદદથી રમતવોરોમાં લવચિકતા (ઇલેક્સીમીલીટી)નો ગુણ કેળવી શકાય છે. આ રીતે વ્યક્તિગત કસરત કરવા માટે વોલ બાસ એક આદર્શ અને ઉત્તમ સાધન ગણી શકાય.

વોલબાસની કસરતો

૧. બાજુ ઝૂક : વોલબાસ એક બાજુએ રહે તેમ ચિત્રાંક-૧ પ્રમાણે જિલા રહી, નજીકનો પગ નોચેની લાકડાની પદ્દીમાં ભેરવી બન્ને હાથ ગરદન પાણા રાખો વિચ્છ દિશામાં નમનું. આ કિયા ૮-૧૦ વખત કરી, તે જ પ્રમાણે ખીજ પગે ખીજ આજુ નમીને ૮-૧૦ વખત કરવું.


૨. હાંક લીવર : વોલબાસને પોઠ અડકે એવી રીતે જિલા રહેવું. પછી ધીમે ધીમે બન્ને પગને એક સાથે ચિત્રાંક-૨ પ્રમાણે ક્રમરથી કાટ-ખૂણો થાય ત્યાં સુધી લઈ જવા. પગના પંજ ખાડારની બાજુ ખેંચી રાખવા. આ સ્થિતિને 'હાંક લીવર' અથવા 'એલ પોઝિશન' કહેવામાં આવે છે. ધીમેથા મૂળ સ્થિતિમાં આવવું. આ કસરત ૮-૧૦ વખત કરવી. આ કસરતથી પેટના સ્નાયુઓ વિરોષ ઇપથી મજબૂત થાય છે અને સાથે સાથે વ્યાયામવીર પોતાના પગમાં તણુાવનો અનુસર કરી શકે છે સાથે સાથે હાથ અને ખલાના સ્નાયુઓને પણ શક્તિ મળે છે.

૩. ક્રમાન : વોલબાસની સામે જિલા રહીને બન્ને હાથ વડે ઉપર લાકડાની પદ્દા પકડીને સીધા હાથ રાખીને લટકી જવું. પછી ધીમે ધીમે ચિત્રાંક-૩ પ્રમાણે ધડ અને પગ પાછળની બાજુ વળાંક લે તેવી રીતે ક્રમાન જેવી આકૃતિ બનાવવી. આ કસરતને 'એક હોકો' પણ કહેવાય છે. આ

કસરત ૮-૧૦ વખત કરવી. આ કસરતથી કરેડ-રજબુના મણુકાઓને ખાસ કસરત મળે છે.

૪. પીછે કમાન : વોલબોસં પીડ પાછળ આશરે એ કૂટ દૂર રહે તેમ જિલ્લા રજી, જીને હાથને ઉપરથી પાછળની લરદ્દ લઈ જઈ લાકડાની પદ્ધી પકડવી. પછી ચિત્રાંક-૪ ગ્રમાણે કમરમાંથી પાછગ નમી કમાન

બનાવવી. પછી વારાફરતી જીને હાથ કમસર પદ્ધીઓ પર મૂફી નીચેની તરફ જમીન સુધી લઈ જવા, કે નેથી સંપૂર્ણ કમાન જમીન ઉપર થઈ જય. આ કસરતની વિરોધતા એ છે કે દરેક મણુકાને વારાફરતી કસરત મળે છે. આજ રીતે ધીમે ધીમે ઉપરની તરફ મૂળ સ્થિતિમાં આવવું. આ કસરત ૫ થી ૧૦ વખત કરવી.



વોલબોસંની કસરતો-૧ થા ૫

૫. સ્ટૂલ કમાન : વોલબાસની સામે નાના સ્ટૂલ ઉપર બેસીને, બન્ને પગને વોલબાસનું ભેરવના. બન્ને હાથ ગરદન પાછળ લઈ ગયા પછી ચિત્રાંક-૫ પ્રમાણે ધીમે ધીમે પાછળ નમીને કમાન નેવો. આકાર બનાવવો. આ કસરતમાં પગની પ્કડ મજબૂત રાખવી. ૫ થી ૧૦ વખત આ કસરત કરવી.

૬. શયનોત્થાન : વ્યાયામવીર પીડ ઉપર સ્થાને બન્ને પગ લાકડાની છેલ્ખી પદ્દીમાં ભેરવીને બન્ને હાથ ગરદન પાછળ રાખવો. આ સ્થિતિમાંથી જીભા થઈ કમરમાંથી આગળ ઝૂકીને હાથની ડેણુંને પગની સાથળ ઉપર સ્પર્શ કરવો. આ કસરતને 'સીટ અપ્સ' પણું કહેવામાં આવે છે. આ કસરતનો ઉપયોગ પેટના સ્નાયુઓની શક્તિના માપન માટે કરવામાં આવે છે. આ કસરતથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. બહેનો માટે આ કસરત ખૂબ જ આદર્શ ગણ્યાય છે.

૭. પશ્ચિમતાન : વોલબાસની સામે જીભા રહી, બન્ને હાથ વડે લાકડાની પદ્દીને ખલા જેટલી જિયાઈએ પકડવી. બન્ને પગ નીચેના ખાર સાથે ટેક્લી એંચાણું આપી હાથ વડે એક પછી એક ખાર ક્રમિક નીચે ઉત્તરવું. શક્ક્ય હોય તો નીચે બેસી શક્કાય એ સ્થિતિમાં આવવું. એ જ પ્રમાણે ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવું. આ કસરત ૫ થી ૧૦ વખત કરવી. ઉપર દર્શાવેલી કસરત નંબર-૪ પછી આ કસરત કરવામાં આવે તો વધારે લાલદાયી નીવડે છે.

૮. ઈન્વિર્ટ હેન્ગ : વોલબાસ સામે મેં રાખીને લગભગ ૨ કૂટ દૂર જીભા રહેવું. પછી કમરમાંથી ધીમે ધીમે આગળ ઝૂકી, હાથને પાછળની આજુથી ઉપર લઈને વોલબાસની પદ્દી પકડવી. પછી બન્ને પગને જમીન પરથી જિયક્ષા, ધીમે ધીમે જિયે લઈ જઈ વોલબાસને સમાંતર લાવવા. આ વખતે વોલબાસને પીડ અરીને 'શિર્ષસિન'

જેવી સ્થિતિ આવશે. આ સ્થિતિ ૫-૧૦ સેકંડ જળવી, પછી ધીમે ધીમે પગ આગળ લાવી જમીનને અડકે, એટલે હાથ વારાફરતી છોડી જીભા થવું. આ કસરત ૮-૧૦ વખત કરવી.

૯. એક લીવર : આગળના 'ઇન્વિર્ટ હેન્ગ' પ્રમાણે જ આ કસરત કરવાની છે, ૫રંતુ 'શિર્ષસિન'ની સ્થિતિમાં સ્થિર થયા પછી, પગ નીચે લાવતી વખતે, પગને વોલબાસના કાટખૂણું આગળની બાબુએ ઢીયણુંમાંથી સીધા લાંબા કરી, આ સ્થિતિ ૫-૧૦ સેકંડ સુધી જળવી, પછી પગ જમીન પર લાવી જીભા થવું.

૧૦. ચીન અપ : વોલબાસની છેક નીચેના પદ્દીની નીચે પગ રાખી જમીન પર જીધા સ્લેઇ જવું; અને બન્ને હાથ સીધા લાંબા રાખી મેડિસીન બોલ અથવા વજન પકડી રાખવું. પછી ૨ડો લીધા વિના હાથ, માયું તથા છાતી જિયાં કરી 'ભૂજ-ગાસન'ની સ્થિતિમાં આવવું. આ સ્થિતિ ૩-૫ સેકંડ જળવી, ધીમે ધીમે છાતી જમીન પર લાવી મૂળ સ્થિતિમાં આવવું. આ કસરત ૮-૧૦ વખત કરવી.

૫. ઐગ પંચિંગ

'ઐગ પંચિંગ' એટલે અંદર ચીંથરાં વગેરે ભરીને સજજડ બનાવેલી ચામડાની થેલી ઉપર ટેંસા મારવા તે. આ એક ઉત્તમ વ્યાયામનો પ્રકાર છે. આમાં ઉપયોગમાં લેવાતી થેલીનો આકાર જોગ હોય છે; તો ડોઈ ડોઈ સ્થળે લાંબા જમકળ જેવો પણ હોય છે. એ થેલીને જુદી જુદી રીતે ટાંગીને તનો ઉપયોગ કરાય છે. તે ચામડાની હોય છે અને તેમાં ઘોડાના વાળ તથા ચીંથરાં ભરેલાં હોય છે. તનો ઘેરાવો ઊરી ઈંચ જેટલો હોય છે. (જુઓ ચિત્ર)

આ વ્યાયામ પ્રકારથી બધાં અંગોને સારી મહેનત મળે છે અને બળવૃદ્ધિ થાય છે. પોક્સિંગ

શીખનાર માટે આ વ્યાયામપ્રકાર ખાસ ઉપયોગી છે. આના માટે ખાસ પ્રકારનાં મોઝાં તૈયાર મળે છે.

તૈયારની સ્થિતિ : ચિત્રાંક-૧ પ્રમાણે થેલી ઉપર ટોંસા ભારવા પૂરતું અંતર રાખી ઊભા રહેવું; અને ડાબો પગ આગળ મૂકવો તથા બોક્સીંગની જેમ પીઠના લાગને જાંચો કરીને સીધે રાખવો;

તેમ જ બંને ખલાને કંઈક પાછકી બાજુએ લાવવા. ડાબા હાથને દાઢીની સપાઠી નેટલો જાંચો લાવવો અને જમણુા હાથને ચિત્રમાં જતાવ્યા પ્રમાણે ચામા વાળાના ટોંસાને અટકાવી શકાય એવી સ્થિતિમાં છાતીની સામે રાખવો; તેમ જ હાથની મૂડી સંજગ રાખવી. પછી થેલી ઉપર જુદા જુદા પ્રકારના ટોંસા ભારતી વખતે જરૂર




૧. તૈયારની સ્થિતિ

પ્રમાણે હાથ તથા પગની સ્થિતિ બદલવી.

૧. ડાયા હાથને ટેંસો (લેઝટ લીડ) : થેલીથી ૨૩-૩ ક્રૂટના અંતરે તૈયારની સ્થિતિમાં જિભા રહેવું. થેલીને તે નાકની સપાઈએ રહે તે પ્રમાણે ટાંગવી. પછી બોકસિંગના ટેંસાની પેટે ડાયા હાથને સીધી લીટીમાં અને ચાલાકીથી આગળ


લાવીને ચિત્રાંક-૧ પ્રમાણે સામે ટાંગેલી થેલીના મધ્ય લાગ પર જોરથા ટેંસો મારવો. આ વખતે ખલા તથા પીઠમાં પણ પૂર્ણ જોર આપવું અને માયું જરા જમણી બાજુએ વાળવું; તેમ જ જમણા હાથને છાતીની સામે આડો રાખવો. વળી ટેંસો શક્ય તેટલા જોરથા મારવાનો છે; છતાં તે મારતાં



૨. લેઝટ લીડ

પોતાનો તોલ જળવાય તે માટે ખાસ કાળજી રાખવી અને થેલી ડેટલા અંતરે છે તે લક્ષ્યમાં લઈને તે પ્રમાણે ડાબા પગને આગળ મૂકવો. હોંસો માર્યા પછો અતિશય સ્કુર્તિથી એ પગ પરત લઈને મૂળ સ્થિતિમાં આવો જવું. આ કિયા ખૂબ અડધ્યથી કરવાનો મહાવરો કરવો. આ પ્રમાણે

જલદીથી ડોંસો ભારી પરત અવાય નહિ તો ખીને ડોંસો નેરશી ભારી શકાય નહિ. વળી થેલીના મધ્ય લાગ ઉપર ડોંસો ન લાગે તો થેલી જ વાંકીચૂંકી થઈને ભારનારો પરત હઠી નહિ ગયો હોય તો તેને જ તે અથડાશો. એટલા માટે આવા પ્રસંગે માથાને જરા ખાજુએ નમાવી લેલું.



૩. રાઈટ લીલા

નેરથી ટેંસો લાગતાં જ થેકી એકદમ પાછળ જશે. એટલે તે પ્રથમ આપણું ઉપર અંવે તે વખતે તેને ટેંસો મારી શકશે જ નહિ. તેથી ત્રણ વખત તેને તે રીતે આગળ પાછળ જવા દીધા પણી જ બીજો ટેંસો તેના પર મારવો; એમ કરવાથી યોગ્ય વખતે ટેંસો મારવાની કુશળતા કેળવારો અને પરિણામે નેરદાર ટેંસો મારી શકશે. હાથને સીધા આગળ લઈને જ ટેંસો મારવો. ગોળાકાર ફેરવાને મારવો નહિ. ટેંસો મારતી વખતે નજ્ર થેકી પર ડેન્ફિન્ડ ફરવો.

આ ટોંસાને 'લેઝટ હેન્ડ પંચ' પણ કહે છે.

૨. જમણા હાથનો ટેંસો (રાઈટ લાડ) : જમણા હાથને સામે લાંબો ફરીને ટેંસો મારવા માટે ચિનાંક-૧ પ્રમાણે જમણા પગને આગળ મૂકવો. તેને ડાખા પગની ખાલુએ ૧૮ ઈંચ અને તેની આગળ ૧૪ ઈંચ નેટલો રાખીને થેલી પર ટેંસો મારવો. આ વખતે ડાખા હાથને પેટ નજ્રક, દાઢી નજ્રક અગર છાતી નજ્રક બચાવ માટે આડો રાખવો. ટેંસો થેલીના ભધ્ય ભાગ પર મારવો, અને એ પ્રમાણે આગળ મૂકેલા જમણા પગને તેમ જ રાખીને, થેલી ખીજ વાર આગળ આવે કે તેને બીજો ટેંસો મારવો. પ્રત્યેક ટેંસો માર્યાં પણી પગને પાછળ લાની મૂળ સિથ્ટિમાં આવવું, અને ફરીથી પણ નીજ વાર થેલી સામે આવતાં જ જમણા પગને આગળ મૂકીને ટેંસો મારવો, અને લાગલા જ મુળની જગાએ આવી જવું. પગને આ રીતે આગળ પાછળ લેવામાં પવિત્ર બદલવાની કુશળતા કેળવાય છે. આ ટોંસા વખતે માથાને જરા ડાખી બાજુ લાવવું.

જમણો તથા ડાખો ટેંસો બરાબર મારતાં આવડે, એટલે એક વખત જમણો તો ખીજ વખત ડાખો, એ રીતે વારાફરતી ટેંસા મારવાની ટેવ પાડવી.

૩. ડાખા હાથનો વાંકો ટેંસો (લેઝટ હેન્ડ

હૂક) : હૂકના ટેંસા પણ બોક્સિંગમાં મહત્વના ગચ્છાય છે; હેમફે, સામાવાળો પાસે જ હોય ત્યારે આવો ટેંસો મારવામાં વધારે વેગ લાવવો પડે છે. આ માટે પ્રથમ તો એ પગ વચ્ચે ૧૪ ઈંચ નેટલું અંતર રાખીને અને ડાખા પગને જમણા પગથી ૬ ઈંચ આગળ મૂકીને જિલા રહેવું; અને બંને હાથને ડેણ્ણિમાંથી વધારે વાળીને રાખવા; તેમ જ ડાખા હાથની મૂડી ડાખા કુલાની સપાઠીએ રાખવી તથા ડાખા પગની ઘૂંઠી પર જરા ડાખી બાજુ ફરવું અને જમણા પગને જમીન પર સિથર રાખવો. પણી થેકીના ભધ્ય ભાગ પર જલદીથી ટેંસો મારવો; અને ટેંસો મારીને એ હાથને જલદીથી પરત આણુંનો તથા પુનઃ ચાલાકીથી ટેંસો મારવો. ટેંસો મારતી વખતે બચાવ માટે જમણા હાથની મૂડી છાતીની કે દાઢીની આગળ રાખવી. આ પ્રકારનો ટેંસો લાગતાં થેકી ત્રાંસી થઈ જઈને પાછળ ધકેલાય છે. આ ટેંસો નીચેથી ઉપર ત્રાંસો લગાવવાનો હેવાથી એ વખતે હાથને ખમામાંથી જિચો લાવવો પડે છે એટલે એવા હાથને ડેણ્ણિમાંથી સીધો લાંબો કરવાનો નથી, પણ ૧૫ અંશને ખૂણો કરીને વાંકો રાખવો પડે છે. માટે જ આ ટોંસાને 'હૂક' કહે છે.

પણી જમણા પગને એ જ રીતે આગળ મૂકીને જમણા હાથથી પણ એ જ પ્રમાણે ટેંસા મારવાનો મહાવરો કરવો.

૪. જમણા હાથનો ઉપરનો ટેંસો (એન અપર કટ વીથ ધ રાઈટ હેન્ડ) : આ ટોંસામાં અને ઉપર વર્ણવેલા વાંકા ટેંસા વચ્ચે ધણું જ સાચ્ય છે. પણ આમાં હાથને વાંકા ટોંસાના કરતાં, શરીરની વધારે નજ્રક રાખવો પડે છે; તેમજ આમાં બાજુ તરફ પણ વધારે જવાનું નથી. આ ટોંસા માટે ચિનાંક-૧ પ્રમાણે થેલીથી ૧૪ ઈંચના અંતરે જિલા રહેવું. જમણા હાથને ડેણ્ણિમાંથી વાળાને કાટખૂણો રાખવો. તેની મૂડી કુલાની સપાઠીની નીચે રાખવી અને હાથને જરા પાછળ રાખવો. પણી ત્યાંથી



૪. લેઝટ હેન્ડ હુક

હાથને ઉપર લાવીને જોરથી ડેંસો ભારવો. ડેંસો મારતી વખતે હાથને છાતીની સપાટીએ લાવતાં સુધી શર્દારથી દૂર લઈ જવો નહિ; તેમજ હાથને જીચે તથા આગળ લાવતાં, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જમણ્યા પગના પંજ ઉપર જ જિલ્લા રહેવું. આ ધણ્યું જ મહત્વનું છે, કારણું કે એથા ડેંસો બહુ

જોરથા લાગે છે. એ પ્રમાણે પંજ ઉપર જિલ્લા રહીને અવસાન લેવાથી, ડેઝ વખત સામેનો માણ્યુસ લડથડી પડે છે, એટલું એ ડેંસામાં જેર આવે છે, આવા પ્રસંગે સામેવાળો જમીન ઉપરથી લગભગ જથલી જઈને જ પાછળ પડે છે. એ વખતે તોલ સંભાળવા સારુ ડાબા પગને જમીન પર સ્થિર રાખવો.



૫. અપરકટ વીથ ધ રાઈટ હેન્ડ

પછી આજ પ્રમાણે ડાખા હાથથી પણ ટોંસા મારવાનો મહાવરો કરવો.

૬. મેડિસિન ઘોલ


પ્રાસ્તાવિક :- દડાનો રમતમાં ઉપયોગ ધણુા જૂના સમયથી થતો આવ્યો છે. દડા સાથેની

કસરતો ગ્રીસ, ઈજ્જાત, રોમ જેવા દેશોમાં જૂના સમયથી પ્રખ્યાત હતી. એવી જ રીતે 'મેડિસિન ઘોલ' સાથેની કસરતો પણ ખૂબ જ જૂની ગણ્યાય. છતાં પણ એવી ચોક્કસ શરૂઆત કઈ સાલમાં થઈ હશે, તે કષેવું ખૂબ જ મુશ્કેલ છે. 'મેડિસિન ઘોલ'ની કસરતોની પદ્ધતિસરની શરૂઆત અમેરિકા

દેશમાં થઈ; પછી જર્મની અને યુરોપના અન્ય દેશોમાં થઈ. આજે તો મેડિસીન બોલનો 'કસરત' તરીકે અને 'વજન તાકીમ' તરીકે વિશ્વના દરેક દેશમાં ઉપયોગ થાય છે.

પ્રચાર અને મહત્વ :- મેડિસીન બોલ માટા ભાગે ત્રણું પ્રકારના હોય છે (૧) ચામડાના કવરવાળો. (૨) રથરના કવરવાળો અને (૩) ડેનવાસના કવરવાળો. એનું વજન એકિદોથી પાંચ કિલો સુધી હોય છે. મેડિસીન બોલનો ઉપયોગ ૨૦૦૦નાત્મક કસરતો તરીકે પણ કરવામાં આવે છે, કારણું કે તે સહેલાઈથી ગણડી શકે છે, ટાપો ખાઈને ઉંચો આવી શકે છે અને જુદા જુદા વજનમાં ભણે છે. મેડિસીન બોલની કસરતો શીખવતી વખતે શરૂઆતમાં મેડિસીન બોલને વ્યવસ્થિત પકડવો અને વ્યવસ્થિત ઝેંકવો, તેના ઉપર

વધારે ભાર મૂકવો જોઈએ, કારણું કે માટા ભાગે ગતિમાં આવતા મેડિસીન બોલને પકડતી વખતે અંગળાચોમાં વાળી જવાની ખૂબ જ શક્યતાએ રહે છે ગતિમાં આવતા મેડિસીન બોલના બળને એછે. ૫૨૩ માટે મેડિસીન બોલને પકડતી વખતે હાથને સહેજ પાછો ખેંચવો, એ ખૂબ જ જરૂરી છે. તેને કારણે મેડિસીન બોલની ગતિનો આધાત એછે. થાય છે. મેડિસીન બોલ ઝેંકણી વખતે અને પકડતી વખતે ખેલાડીની એકાગ્રતા અને સમય-સૂચકતા ખૂબ જ જરૂરી છે. તેમ નહિ થતાં ઈન્જિનિયરની સંપૂર્ણ શક્યતા રહેલી છે. મેડિસીન બોલની કસરતો એકલા કે જોડીદાર સાથે કરી શકાય છે. વધારે સંખ્યા હોય તો એક જરૂર મધ્યમાં જિલો રહેશે અને બાકીના તેનાથી ૮-૧૦ ફૂટ દૂર વર્તુળાકારે જિલા રહેશે અને નિયત કસરત અનુસાર દડાની ઝેંક-અલ કરશે.



એકલા કરવાની કસરત-૧

એકલા કરવાની કસરતો

કસરત-૧ : ચિત્રાંક-૧માં બતાવ્યા પ્રમાણે માથા ઉપર દડાને રાખવો અને પછી ચિત્રાંક-૨ પ્રમાણે કમરમાંથી નીચા વળાને, દડાને બે પગની વયમાં પાછળ લાવવો; અને મુનઃ પહેલાં હતો ત્યાં જાંચે આખુવો. દડા જાંચે લાવતાં દીર્ઘ શ્વાસ લેવો અને નીચે આખુતાં શ્વાસને છોડવો. આ કસરત દીર્ઘ શ્વસન ભારે ધણી ઉપયોગી છે.

કસરત-૨ : ચિત્રાંક-૨માં વર્તુંણ બતાવેલું છે, તે પ્રમાણે બંને હાથને લાંબા રાખીને, શરીરના આગળના ભાગમાં ધડને ગોળાકારે ફેરવવું. પછી એથી જિલટી દિશામાં ધડને ગોળાકારે ફેરવવું. આમાં પીઠના સ્નાયુઓને તથા કરોડને સરસ કસરત મળે છે.

કસરત-૩ : ચિત્રાંક-૩ પ્રમાણે જમણી બાજુ વળાને બંને હાથથી દડાને પકડવો; અને હાથને તેજ પ્રમાણે લાંબા રાખીને, જમણી તરફથી ડાખી તરફ અને પછી ડાખી તરફથી જમણી તરફ વળવું. આમાં પણ કરોડને સરસ મહેનત થાય છે.

દડાને ફેરુંકવાની કસરતો


કસરત-૧ : ચિત્રાંક-૧ પ્રમાણે જિલા રહીને

જમણા હાથમાં દડા રાખવો. પછી હાથને તેવો જ આગળ લઈને દડાને સામે નાખવો. કિફેટની રમતમાં નેમ અંડરડેન્ડ દડા નાંખે છે, તેવીજ રીતે હાથને શરીર સાથે સમાંતર રાખીને આ કિયા કરવાની છે. આને ‘ફેરવર્ડ અન્ડર શ્રો’ કહે છે. આનાથી પીઠ, ચાંસળાં, છાતી અને ખલાના સ્નાયુઓને કસરત મળે છે.


કસરત-૨ : ચિત્રાંક-૨ પ્રમાણે જમણી હાથને જમણી બાજુ રાખીને, દડાને લઈને જિલા રહેવું. પછી હાથને બહારથી ફેરવીને અને શરીરને ડાખી તરફ ભરડીને દડાને ફેરવવો. આ કસરતથી પણ પાંસળાના અને પીઠના સ્નાયુઓને કસરત મળે છે. આ કસરતને ‘સાઈડ શ્રો’ કહે છે.

કસરત-૩ : ચિત્રાંક-૩ પ્રમાણે દડાને માથા ઉપર રાખીને જિલા રહેવું. પછી દડાને તોકની પાછળ લાવવો અને હાથને માથા ઉપરથી આગળ નોસબેર આણીને દડાને ફેરવવો. આને ‘ઓવર હેડ શ્રો’ કહે છે. આનાથી છાતી, ખલા તથા હાથના સ્નાયુઓને મહેનત થાય છે.

કસરત-૪ : ચિત્રાંક-૪ પ્રમાણે કમરમાંથી વળાને અને દડાને પકડીને જિલા રહેવું. પછી દડાને બે



એકલા કરવાની કસરત-૨, ૩



દો ઝેંકવાની કસરતો-૧ થી ૬

પગની વર્ચ્યેથી પાછળ, આગળ, સામે અગર આગળ જાયે નાખવો. આ કસરતથી પીઠના ચેટના અને ખલાના સનાયુઓને વ્યાયમ મળે છે.


કસરત-૫ : ચિત્રાંક-૫ પ્રમાણે દડાને છાતીની સામે રાખ્યો જિલા રહેલું. પછી બંને હાથને એક

સાથે જોસબંધ આગળ લાંબા કરીને દો ઝેંકવો. આને 'ચેસ્ટ શ્રો' કહે છે. આ કસરતથી છાતીના આગલા ભાગના તથા દંડના પાછલા આગના સનાયુઓ કસાય છે.

કસરત-૬ : ચિત્રાંક-૬ પ્રમાણે જમણું હાથમાં

દડાને રાખીને જિલ્લા રહેવું: પછી એકદમ હાથને ડેણુભિમાંથી લાંબો કરીને અને શરીરને આગળ લાવીને તથા બાજુઓ ફેરવીને દડાને ફેંકવો. એલ ફૂદમાં ' ગોળાફેંક 'ના જેવો જ આ કિયા છે. આનાથી છાતી, હાથ ખલા તથા પેટના સ્નાયુઓને કસરત મળે છે.

કસરત-૭ : ચિત્રાંક-૧ પ્રમાણે પગના પંખ ૫૨ બેઠક લઈ બેલું; અને દડાને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તેના ઉપર આંગળાં રાખીને છાતીની સામે પકડવો. પછી એકદમ બડીને અને બડતાં બડતાં જ હાથને-ડેણુભિમાંથી લાંબા કરીને દડાને જેસખંધ આગળ નાંખવો.



દડા ફેંકવાની કસરતો-૭ થી ૧૦

કસરત-૮ : પગને લાંબા રાખીને જમીન પર એસદુ અને બંને હાથને લાંબા કરીને ઢાને જંધ પર રાખવો. પછી કમરમાંથી પાછળ વળીને અને ચિત્રાંક-૨ પ્રમાણે ઢાને માથા ઉપરથી પાછળ લાવીને જમીન પર ટેકવો; અને એજ વખતે બંને પગને એક સાથે ઉપર ઉચ્ચકીને જમીનની નેડ કાટખૂણે રાખવા. પછી નેસબંધ બંને પગને નીચા લાવીને એડા થઈ જવું. આ કિયા વખતે પણ હાથને તો લાંબા જ રાખવા. આ કસરતથી પેટના બધા સનાયુઓને સુંદર વ્યાપામ ભળે છે.

કસરત-૯ : ચિત્રાંક-૩ પ્રમાણે ડાખી બાજુએ બંને હાથથી ઢાને પકડી જિલા રહેવું. પછી ધડને એકદમ નેશથી જમણી બાજુએ ફેરવી ઢાને નેસ-પૂર્વક જમણી બાજુએ નાખવો. આ વખતે બંને હાથને શક્ય તેટલા લાંબા રાખવા. આ કસરતથી જંધની ઉપરના પેટની બાજુના તિરક્કસ (એટો-મિનલ એઝિલક) સનાયુઓને સારી મહેનત થાય છે.

કસરત-૧૦ : ચિત્રાંક-૪ પ્રમાણે બાજુએ બંને હાથને લાંબા રાખીને અને ઢાને પકડીને જિલા રહેવું. પછી જમણા હાથથી એકદમ નેર કરીને ઢાને સામે જ નાખવો. આ રીતે ઢાને ફેંકાય તો થણ્ણા નેરથી તે જય છે. પછી આ જ પ્રમાણે ઢાને ડાખી બાજુએ પકડીને કિયા કરવી. આ કસરતથી છાતીના આગળના (પેકટોરફ્સ) સનાયુઓને તથા ઘસાના સનાયુઓને સારો વ્યાપામ ભળે છે.

૭. બુલવર્ક



બુલવર્ક એ અત્યંત લોકપ્રિય અને અધતન વ્યાપામ પ્રકાર છે. પ્રતિરોધ તાલીમ (Resistance training) ના સિદ્ધાંત પર રચાયેલા આ કસરત પ્રકારથી સનાયુઓનો ઝડપી વિકાસ થાય છે, કદ વધે છે અને અદ્ભુત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. સાચું

પૂછો તો આ એક આયચેમેટ્રિક તાલીમનો પ્રકાર છે અને તેમાં વિવિધ સનાયુઓની બેંચ તથા દાખની સ્થિતિ નિયત સમય સુધી જળવી રાખવાની હોય છે. ટયુખને બંને છેડે ગાં ટેલા દોરડાંના બનેદા બુલવર્કરમાં દબાણ (ડ્રાફ્ટપ્રેશન) માટે ટયુખના છેડાનો અને બેંચાણ (ટ્રેક્શન) માટે દોરડાંના ઉપયોગ કરવામાં આવે છે.

બુલવર્કરની કસરતોનો કાર્યક્રમ શરીરના બધા અવયવોને આવરી લે છે અને તેમાં પૃષ્ઠ ૨૫૬ ઉપર ચાર્ટ્માં દર્શાવ્યા સુજાય છાતીની ૨, બાંધની ૫, ખલાની ૩, ધડની ૪, પોડની ૫, તથા ચાથળ અને પિંડની ૫ મળો કુલ ૨ ડાન જેટલી કસરતોનો સમાવેશ થાય છે. દરેક કસરતમાં નિયત કર્યા સુજાય દાખ કે બેંચ માટે કસરતવીરે પોતાના બળના ૬૦-૭૦ ટકા જેટલું બળ વાપરવાનું હોય છે. આમાં શ્વાસ રાકવાનો નથી, પરંતુ ને તે કસરત કરતી વખતે શ્વાસ લેવાનો અને પછી સામાન્ય ગતિએ ૧ થી ૧૦ સુધી કુમસર સંખ્યા બોલતાં સુધી એટલે કે લગભગ ૭ સેકન્ડ સુધી શ્વાસ કાઢવાનો અને તેટલો સમય તે બેંચ કે દાખની સ્થિતિ જળવી રાખવાની હોય છે. કસરતવીરે રોજ આ ચોલીસેય કસરતોનો ડોર્સ નિયમિત કરવાનો હોય છે.

સનાયુસમૂહેનું વજન વધારવા માટે આ કસરતો ઉત્તમ પૂરવાર થઈ છે. આમ છતાં, ડોર્ચ સનાયુસમૂહનું વજન ધટાડવા માટે આ કસરતોનો ઉપયોગ કરવાનો હોય તો તે સનાયુસમૂહની કસરતમાં બેંચ કે દાખની સ્થિતિ જળવી રાખવાને બદલે તે કસરતની કિયા ઝડપથી ૨૦ વખત કરી ૧-૨ મિનિટ આરામ લેવો. આમ ત્રણ આવતીન કરવાં.

બુલવર્ક સાધન તથા તેની કસરતોનો ચાર્ટ રમતગમતનાં સાધનો વૈચનારાની દુષ્ટનેથી વૈચાતાં મળો શકે છે.





૮. સ્વમાલિસ (Self Massage)

પોતાના શરીરને અન્યની પાસે માલિસ કરાવવું, એ બધાને ભાટે શક્ય નથી; અને તેથી પોતે જ પોતાને માલિસ કરે, એ પ્રવૃત્તિ દરેકને અનુકૂળ આવે તેવી છે. વળી આનાથી માલિસનો લાલ તો

મળે છે જ, પરંતુ તે ઉપરાંત તેમાં ઉત્તમ વ્યાયામ પણ થાય છે. આના કેટલાક પ્રકારો અને આપ્યા છે.

માલિસ પ્રકાર-૧ : ચિત્રાંક-૧ પ્રમાણે ડાબા પગને જમણું પગની આગળ મૂક્ખને ઊભા રહેવું. પછી કમરમાંથા આગળ વળાને ડાબા પગની ધૂંઠીને બંને હાથથા પકડવી. આ વખતે બંને હાથના અંગૂઠા એકમેદની નજીક રાખવા, અને અંગળાંને




સ્વમાલિસ પ્રકાર-૧

પાણળની બાજુએ જવા દેવાં. પછી, બંને હાથને વચ્ચે અડક્યા વિનાં નીચેથી ઉપર લાવીને પગને માલિસ કરવું. તેમાં ચિત્રાંક-૨ પ્રમાણે જિલા થઈને જાંધની ઉપરના લાગમાં હાથ આવે એટલે હાથને જાંધ ઉપરથી ઉડાવી લેવા અને પુનઃ નીચા વળાને ચિત્રાંક-૧ પ્રમાણે પગની ઘૂંઠઓને પકડવી. બંને હાથને પગ ઉપર સજાડ દાખીને જોરથા માલિસ કરવું; એટલે સરસ માલિસ થશે અને સાથે

સાથે કસરત પણ થશે. વધારે મહેનત કરી હોય ત્યારે શરીરને બહુ થાક લાગતાં, અશુદ્ધ થયેલું લેાઢી જોઈએ તેટલી ઝડપે હુદ્દ્ય તરફ જતું નથી. આવા પ્રસંગે માલિસ કરવાથી લેાઢી હુદ્દ્ય તરફ ધોલાય છે. આ હેતુ લક્ષમાં રાખીને લેાઢી હુદ્દ્ય તરફ ધોલાય તે દિશામાં જ માલિસ કરવું જોઈએ.


માલિસ પ્રકાર-૨ : ચિત્રાંક-૧ પ્રમાણે પગ સીધા રાખી જિલા રહેવું, પછી કમરની ઉપરના



સ્વમાલિસ પ્રકાર-૨ તથા ૩

શરીરને ડાખી તરફ વાળોને ડાખા હાથને ચિત્રમાં અતાવ્યા પ્રમાણે એ પગની બાજુએથી નીચે આણવો. હાથને આ રીતે નીચે લાવતાં તેને અંગ ઉપર દખાવીને ન લાવવો; પણ છૂટા રાખીને લાવવો. પણ જમણા હાથને તે વખતે જાચે લેવો, તે અંગને દખાવતા જઈને લેવો. એટલે તે હાથથા તે બાજુનું માલિસ થશે. પછી જમણી બાજુએ શરીરને ત્રાંસું

નીચે વાળવું અને એ વખતે ડાખા હાથને નીચેથી ઉપર લાવતાં, અંગને દખાવતા જઈને તે બાજુનું માલિસ કરવું. આ રીતે બંને બાજુએ વારાફરતી વળીને પગની બાજુએ તથા ધડની બાજુએ માલિસ કરવું. પણ લક્ષ્યમાં રાખવું કે હાથને નીચેથા જાચે લાવતાં જ માલિસ કરવું; જાચેથા નીચે લાવતાં, કરવું નહિં.



સ્વમાલિસ પ્રકાર-૪ તથા ૫

માલિસ પ્રકાર-૩ : ચિત્રાંક-૨ (પૃષ્ઠ-૨૫૮) પ્રમાણે જિલ્લા રહીને બંને હાથથી જમણી જંધને ચિત્રમાં ખતાવ્યા પ્રમાણે પ્રકડવી. પછી આંગળાંથી જંધને સજજડ દાખી, હાથને એકખીનથી જિલ્લા દિશામાં જંધની આસપાસ સાવકાશ ફેરવવા. એ પ્રમાણે હાથને ગોળાકાર ફેરવીને, અને તેને ગોઠળુંથો તે જંધની ઉપરના ભાગ સુધીની જુદી જુદી જગતે રાખીને માલિસ કરવું.

માલિસ પ્રકાર-૪ : ચિત્રાંક-૧ (પૃષ્ઠ-૨૫૮) પ્રમાણે બંને હાથને બોચી પાસે રાખવા અને બંને હાથનાં આંગળાં વડે એ ભાગના સ્નાયુઓને દાખીને માલિસ કરવું. એ વખતે તે સ્નાયુઓને નેરથી પકડીને દ્વારવવા અને પછી એ પકડને ઢીલી કરવી. પછી

આંગળાંને ઉપર લઈને, મગજની નીચેના પાછલા ભાગ સુધી માલિસ કરવું.

માલિસ પ્રકાર-૫ : ચિત્રાંક-૨ (પૃષ્ઠ-૨૫૮) પ્રમાણે જિલ્લા રહીને જમણી હાથને આગળ લાંબો કરવો; અને તેની હથેલી જમીન તરફ રાખવી. પછી ડાયા હાથ વડે જમણું કંડાની નીચેના ભાગથી તે બગલ સુધીના ભાગને દાખીને માલિસ કરવું. પછી જમણું હાથના ઉપરના ભાગ ઉપર ડાયા હાથને રાખીને, તેના કંડાથી તે ખાબા સુધીના ભાગને જોરથી માલિસ કરવું. એ પ્રમાણે એક જ દિશામાં માલિસ કરવાથી લોડી ફદ્દય તરફ ધકેલાય છે. પછી ડાયા હાથને લાંબો કરીને, જમણું હાથ વડે તેને પણ ઉપર પ્રમાણે જ માલિસ કરવું.




૧૩. શારીર સ્તોષવ અને કલ્પાત્મક અંગવિનયાસો

સપ્રમાણ શારીર

દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે; અને તે માટે વિવિધ ફેશનનાં વસ્ત્રો પરિધાન કરે છે. પરંતુ માત્ર સુંદર અને ફેશનબલ વસ્ત્રોથી શરીર સુંદર દેખાવું નથી. વસ્ત્રો દેખાવમાં વધારો કરી શકે, પરંતુ ભૂગ વસ્તુ છે શરીરનો બાંધો. સુદ્ધદ બાંધાનાળું ધાટદાર શરીર માણસના વ્યક્તિત્વને અનેરો આપ આપે છે. શરીરનો સુદ્ધદ બાંધો બનાવવા માટે પાયાની જરૂરી-આત વ્યાયામના છે. નિયમિત વ્યાયામ, પૌષ્ટિક આહાર અને ખુલ્લા આરોગ્યદાયી નિવાસથી શરીરનો બાંધો ઘડાય છે. સુદ્ધદ શરીર ડોને કહેવું, એવો પ્રશ્ન સ્વાલાવિક દરેકને થાય. આ માટે અમેરિકામાં શરીર સૌષ્ઠવ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા અનેક વ્યાયામવીરોનાં અંગોનાં માપ લઈ તેનો તુલનાત્મક અભ્યાસ કરી, શરીર સૌષ્ઠવ અંગોનાં સર્વસ્વીકૃત ધોરણો નક્કો કરવામાં આવ્યાં છે, જે નીચે મુજબ છે.

- (૧) હાથને ડાણીમાંથી વાળતાં દંડ ઉપર ચઢતી જાઈનો ધેરાવા કંડાના ધેરાવા કરતાં ૨.૨૮ ગણો હોવો જોઈએ.
- (૨) કંડાના ધેરાવાથી ૬ ગણું છાતીનું (કુલાવ્યા, સિવાયનું) માપ હોવું જોઈએ.
- (૩) કમરનું માપ કુલાવેલી છાતીના માપ કરતાં $\frac{1}{4}$ નોઈએ.
- (૪) સાથળ ધૂંટણું કરતાં ૧.૫૩ ગણી જરી હોવી જોઈએ.



ધાટદાર શરીરનાં સપ્રમાણ અંગો

- (૫) પિડી ધૂંટી કરતાં ૧.૭૨ ગણી જડી હેલી જોઈએ.

તે, તે અવયવનું વેરાવાનું માપ ગણ્ય. સામાન્ય રીતે ચિત્રમાં દર્શાવેલા ક્રમ મુજબ નીચે પ્રમાણેનાં અંગોનાં માપ લેવામાં આવે છે.

શરીરતું માપ લેવાની રીત

શરીરના ને અવયવનું માપ લેવાનું હોય તે
અવયવને કૃતી માપ પડ્યો સાથેના ચિત્રમાં બતાવ્યા
પ્રમાણે વિંટાળીને, તેના એક છેડાથી તે પદ્ધી તે જી
જગ્યાએ પરત આવે, ત્યાં સ્ફુર્ધીનું ને માપ આવે

(۱) ٹاتی کُلَاوِلی

(२) अाती संडैचेली

(3) અાતી કુદરતી


(૪) કમર

(4) निताम्

(੬) ਸਾਥਣ

(୭) ଘୁମ୍ଭୁ


(*c*) ପିଟି



ઓ તથા પુરુષના શરીરનું માપ લેવાની રીત

શરીરસૌથી અને કલાત્મક અંગવિન્યાસ

- | | | | |
|------------------------------|--------------------------------------|-----------------------|--------------------|
| (૮) ધૂંઠી | (૧૩) કોણી | (૪) કોણી | (૧૧) ધૂંઠી |
| (૧૦) તોક | (૧૪) પ્રોફાઇટ | (૫) પ્રોફાઇટ | (૧૨) છાતી કુદરતી |
| (૧૧) ઉરો ભાગ | (૧૫) કાંકું | (૬) પ્રોફાઇટ (વાળાને) | (૧૩) છાતી ફૂલાવેલી |
| (૧૨) દસ્ત | | (૭) કાંકું | (૧૪) છાતી સંકાચેલી |
| પુરુષ શરીર | | | |
| (૧) તોક | (૩) ગોટી (હાથને કોણીમાંથી
વાળાને) | (૮) સાથાગ | (૧૫) કમર |
| (૨) દસ્ત | | (૯) ધૂંઠથુ | (૧૬) ફૂલા |
| આદ્દિન વારીરાચીં માપે | | | |



આદ્દિન પુરુષ શરીરનાં માપ

આદર્શ પુરુષ શરીરનાં માપ

જુદી જુદી ઊંચાઈ પ્રમાણે પુરુષના શરીરનાં વિલિન્ન અંગોનાં માપ ડેવાં હોવા જોઈએ, તે સાથેના ચાર્ટમાં દર્શાવ્યું છે.

સામાન્ય રીતે પુરુષના શરીરની આદર્શ ઊંચાઈ ૧૭૨.૫ સેન્ટીમિટર ગણ્યોએ તો ફરેક અંગોનાં આદર્શ માપ નીચે પ્રમાણે હોવાં જોઈએ.

અવયવનું નામ

આદર્શ માપ (સેન્ટીમિટર)

પ્રોફોઝ	—	૩૦.૦
ડેક	—	૩૬.૩
દંડ	—	૩૩.૦
દંડની જાગી	—	૩૭.૪
કુલાવેલી અઠી	—	૧૦૬.૨
સાઠી અઠી	—	૧૦૨.૮
કમર	—	૭૮.૨
કૂલા	—	૬૫.૮
સાથળ	—	૫૭.૪
પિઢી	—	૩૮.૩
વજન	—	૭૨.૫ કિ.ગ્રા.

ઊંચાઈના પ્રમાણમાં પુરુષશરીરનાં માપ

વિષ્યાત અમેરિકન શિક્ષણુશાસ્કી બનારસ મેફેડને વ્યાયામ વિષ્યક ૮ અંધોનેં એક શાનદાર તૈયાર કર્યો છે. તેમાં પાંચમા અંધમાં ઊંચાઈના પ્રમાણમાં પુરુષ શરીરનાં જુદાં જુદાં અંગોનાં માપ ડેવાં હોવાં જોઈએ, તે દર્શાવ્યું છે. પરંતુ એ રીતે સર્વોભાગ્ય માપ નહોં કરવું કરીન છે. ઉદાહરણું તરીકે લઈએ તો મેફેડના વ્યક્તિના શરીરનું બંધારણ અસ્તિથપ્રધાન વ્યક્તિ કરતાં અલગ હોય છે. આમ તમામ વ્યક્તિ એક સરખા ઊંચાઈવાળી હોવા અત્યારે તેમનાં શરીરનાં બંધારણ એક સરખાં હોતાં નથી. આથી સ્પષ્ટ વર્ગીકરણ કરવાના હેતુસર જુદા જુદા

શરીર બંધારણવાળી હંજરો વ્યક્તિઓનાં શરીરનાં માપ લઈ તેમને પાંચ વિલાગમાં વહેંચી નાપી નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

- (૧) નઅળા વિકાસ (Underdeveloped)
- (૨) સાધારણ વિકાસ (Average)
- (૩) ઈધ વિકાસ (Good)
- (૪) સરસ વિકાસ (Fine)
- (૫) શોષ વિકાસ (Superb)

બેઠો વ્યવસાય કરનારા અને વ્યાયામ તરફ તદ્દન બેદરકાર હોવાથી જોઓનો સનાયુઓનો નિકાસ થવો જોઈએ, તેટલો પણ થયો ન હોય, તેવા લોડો પહેલા વર્ગમાં આવે.

ને લોડો નિયમિત વ્યાયામ કે ૨મતગમતમાં ભાગ લેતા નથી, પરંતુ તેમના દૈનિક કાર્યમાંથી થોડો ઘણો વ્યાયામ મળ્ણ રહે છે, તેવા લોડો બીજી વર્ગમાં આવે.

ને લોડો નિયમિત સામાન્ય વ્યાયામ કરે છે, તેમજ તેમના દૈનિક કાર્યમાંથી કેટલોક વ્યાયામ મળ્ણ રહે છે, તેવા લોડો બીજી વર્ગમાં આવે.

ને લોડો વિશિષ્ટ વ્યાયામ અને પરિશ્રમ કરે છે, તેઓ ચોથા વર્ગમાં આવે.

ને લોડો અતિ વિશિષ્ટ પ્રકારનો વ્યાયામ અને ભારે પરિશ્રમ કરતા હોય, તેઓ પાંચમા વર્ગમાં આવે છે.

ઉપર્યુક્ત પાંચેય વર્ગોમાં ને વ્યક્તિઓનાં શરીરમાં વિશેષ ચરખીનું પ્રમાણું ન હોય, તેવા એનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉંચાઈના પ્રમાણુમાં પુરુષ શરીરનાં જુદાં જુદાં માપ

ઉંચાઈ	વજન	સેન્ટી	શરીરનો વિકાસ	કિલો	ડેક	ફ'સ	પ્રકોષ્ઠ	છાતી	કમર	કૂલા	સાથળ	પિંડી
મીટર	આમ											
૧૬૦.૦	૧ નખળો વિકાસ	૫૧.૨	૩૨.૫	૨૪.૦	૨૪.૮	૮૨.૦	૭૧.૮	૮૬.૪	૪૭.૭	૩૧.૭		
૨	સાધારણુ વિકાસ	૫૪.૮	૩૩.૬	૨૬.૬	૨૬.૦	૮૭.૬	૭૩.૭	૮૮.૩	૪૮.૫	૩૩.૦		
૩	ઇંઝિન્યુ વિકાસ	૫૮.૪	૩૫.૫	૨૮.૫	૨૭.૩	૮૨.૮	૭૫.૦	૮૮.૫	૫૧.૫	૩૪.૩		
૪	સરસ વિકાસ	૬૨.૦	૩૭.૫	૩૧.૭	૨૮.૫	૮૮.૪	૭૬.૨	૮૧.૫	૫૩.૩	૩૬.૨		
૫	ઓઝ્યુ વિકાસ	૬૬.૦	૩૮.૩	૩૪.૩	૩૦.૫	૧૦૪.૦	૭૭.૫	૮૨.૭	૫૫.૮	૩૮.૦		
૧૬૨.૫	૧ નખળો વિકાસ	૫૨.૬	૩૨.૪	૨૪.૧	૨૪.૭	૮૨.૫	૭૨.૪	૮૭.૦	૪૭.૬	૩૧.૭		
૨	સાધારણુ વિકાસ	૫૬.૨	૩૩.૬	૨૬.૭	૨૬.૦	૮૭.૬	૭૪.૨	૮૮.૦	૪૮.૫	૩૩.૦		
૩	ઇંઝિન્યુ વિકાસ	૫૮.૮	૩૫.૫	૨૮.૨	૨૭.૪	૮૩.૪	૭૫.૬	૮૦.૨	૫૧.૪	૩૪.૩		
૪	સરસ વિકાસ	૬૩.૮	૩૭.૫	૩૧.૭	૨૮.૫	૮૬.૦	૭૬.૮	૮૨.૦	૫૪.૦	૩૬.૨		
૫	ઓઝ્યુ વિકાસ	૬૭.૮	૩૮.૩	૩૪.૨	૩૦.૪	૧૦૪.૩	૭૮.૨	૮૪.૦	૫૬.૫	૩૮.૦		
૧૬૫.૦	૧ નખળો વિકાસ	૫૩.૮	૩૧.૭	૨૪.૨	૨૪.૨	૮૩.૫	૭૨.૪	૮૭.૬	૪૮.૩	૩૧.૭		
૨	સાધારણુ વિકાસ	૫૮.૦	૩૪.૨	૨૬.૬	૨૬.૬	૮૬.૦	૭૪.૩	૮૮.૪	૫૦.૨	૩૩.૦		
૩	ઇંઝિન્યુ વિકાસ	૬૨.૦	૩૬.૮	૨૮.૨	૨૭.૩	૮૪.૫	૭૬.૨	૮૦.૮	૫૨.૦	૩૪.૦		
૪	સરસ વિકાસ	૬૬.૦	૩૮.૦	૩૨.૪	૨૮.૨	૧૦૦.૩	૭૭.૫	૮૨.૭	૫૪.૦	૩૬.૮		
૫	ઓઝ્યુ વિકાસ	૭૦.૦	૪૦.૦	૩૫.૦	૩૦.૫	૧૦૬.૦	૭૮.૭	૮૪.૫	૫૬.૫	૩૮.૦		
૧૬૭.૫	૧ નખળો વિકાસ	૫૫.૨	૩૩.૦	૨૪.૮	૨૫.૪	૮૩.૮	૭૩.૦	૮૮.૨	૪૮.૮	૩૨.૪		
૨	સાધારણુ વિકાસ	૫૮.૮	૩૪.૨	૨૭.૩	૨૬.૭	૮૮.૫	૭૪.૦	૮૦.૨	૫૦.૨	૩૩.૬		
૩	ઇંઝિન્યુ વિકાસ	૬૩.૮	૩૬.૨	૨૮.૮	૨૮.૦	૮૫.૨	૭૬.૨	૮૧.૫	૫૨.૭	૩૪.૦		
૪	સરસ વિકાસ	૬૮.૦	૩૮.૦	૩૨.૪	૨૮.૦	૧૦૧.૦	૭૭.૫	૮૩.૨	૫૪.૬	૩૬.૭		
૫	ઓઝ્યુ વિકાસ	૭૨.૫	૪૦.૦	૩૪.૫	૩૧.૦	૧૦૬.૬	૭૮.૭	૮૫.૨	૫૭.૨	૩૮.૭		
૧૭૦.૦	૧ નખળો વિકાસ	૫૭.૦	૩૩.૦	૨૪.૮	૨૫.૪	૮૪.૪	૭૩.૭	૮૮.૦	૪૮.૮	૩૨.૪		
૨	સાધારણુ વિકાસ	૬૧.૬	૩૪.૦	૨૭.૩	૨૬.૨	૮૦.૨	૭૪.૦	૮૦.૮	૫૦.૫	૩૩.૬		
૩	ઇંઝિન્યુ વિકાસ	૬૫.૬	૩૬.૮	૨૮.૮	૨૭.૬	૮૫.૮	૭૬.૮	૮૨.૦	૫૨.૭	૩૪.૫		
૪	સરસ વિકાસ	૭૦.૨	૩૮.૭	૩૩.૦	૨૮.૮	૧૦૧.૫	૭૮.૦	૮૪.૦	૫૫.૩	૩૭.૫		
૫	ઓઝ્યુ વિકાસ	૭૪.૮	૪૦.૬	૩૫.૫	૩૧.૭	૧૦૭.૩	૭૮.૪	૮૬.૦	૫૭.૮	૩૮.૭		

જિલ્લાઈ	વર્ષ	સેન્ટી મીટર	શરીરનો વિકાસ આમ	કિલો	ટકા	દિન	પ્રકોષ્ઠ	છાતી	કમર	કુલા	સાથગ પિંડી
---------	------	-------------	-----------------	------	-----	-----	----------	------	-----	------	------------

૧૭૨.૫	૧	નખળો વિકાસ	૫૮.૮	૩૩.૦	૨૪.૮	૨૫.૪	૮૫.૦	૭૪.૩	૮૬.૪	૪૮.૫	૩૨.૪
	૨	સાધારણુ વિકાસ	૬૩.૪	૩૫.૦	૨૭.૩	૨૬.૬	૬૦.૮	૭૪.૬	૮૧.૪	૫૧.૪	૩૩.૬
	૩	ઇંદ્ર વિકાસ	૬૮.૦	૩૬.૮	૨૬.૭	૨૮.૫	૬૬.૫	૭૬.૮	૮૨.૭	૫૩.૩	૩૫.૫
	૪	સરસ વિકાસ	૭૨.૫	૩૮.૭	૩૩.૦	૨૬.૭	૧૦૨.૨	૭૮.૭	૮૪.૫	૫૫.૮	૩૭.૫
	૫	શ્રેષ્ઠ વિકાસ	૭૭.૦	૪૦.૬	૩૫.૫	૩૧.૦	૧૦૮.૦	૮૦.૦	૮૬.૫	૫૮.૪	૩૬.૩

૧૭૫.૦	૧	નખળો વિકાસ	૬૦.૬	૩૩.૬	૨૫.૪	૨૬.૦	૮૫.૭	૭૪.૦	૮૦.૨	૪૮.૫	૩૩.૦
	૨	સાધારણુ વિકાસ	૬૫.૦	૩૫.૫	૨૭.૬	૨૭.૩	૬૧.૪	૭૬.૨	૮૨.૦	૫૧.૪	૩૪.૨
	૩	ઇંદ્ર વિકાસ	૬૮.૫	૩૭.૪	૩૦.૪	૨૮.૫	૬૭.૮	૭૭.૫	૮૩.૩	૫૩.૩	૩૬.૨
	૪	સરસ વિકાસ	૭૪.૮	૩૮.૩	૩૩.૬	૩૦.૪	૧૦૨.૮	૭૮.૭	૮૫.૨	૫૫.૮	૩૮.૦
	૫	શ્રેષ્ઠ વિકાસ	૭૯.૨	૪૧.૩	૩૬.૨	૩૧.૭	૧૦૮.૨	૮૧.૩	૮૭.૨	૫૮.૪	૪૦.૦

૧૭૭.૫	૧	નખળો વિકાસ	૬૨.૫	૩૩.૬	૨૫.૪	૨૬.૦	૮૬.૩	૭૫.૬	૮૦.૮	૫૦.૨	૩૩.૦
	૨	સાધારણુ વિકાસ	૬૭.૦	૩૫.૫	૨૭.૬	૨૭.૩	૬૨.૦	૭૬.૮	૮૨.૮	૫૨.૦	૩૪.૨
	૩	ઇંદ્ર વિકાસ	૭૨.૦	૩૭.૪	૩૦.૪	૨૮.૨	૬૭.૮	૭૮.૨	૮૪.૦	૫૪.૦	૩૬.૨
	૪	સરસ વિકાસ	૭૭.૦	૩૮.૩	૩૩.૬	૩૦.૪	૧૦૩.૪	૭૯.૪	૮૫.૬	૫૬.૫	૩૮.૦
	૫	શ્રેષ્ઠ વિકાસ	૮૧.૪	૪૧.૩	૩૬.૨	૩૧.૭	૧૦૮.૮	૮૧.૩	૮૭.૨	૫૮.૦	૪૦.૦

૧૮૦.૦	૧	નખળો વિકાસ	૬૪.૨	૩૪.૨	૨૫.૪	૨૬.૦	૮૭.૦	૭૫.૬	૫૦.૮	૩૩.૬	
	૨	સાધારણુ વિકાસ	૬૬.૨	૩૬.૨	૨૭.૬	૨૭.૩	૬૨.૭	૭૬.૮	૮૩.૪	૫૨.૭	૩૪.૮
	૩	ઇંદ્ર વિકાસ	૭૪.૪	૩૮.૦	૩૧.૦	૨૮.૨	૬૮.૫	૭૮.૨	૮૪.૩	૫૪.૫	૩૬.૮
	૪	સરસ વિકાસ	૭૬.૦	૪૦.૦	૩૩.૬	૩૧.૦	૧૦૪.૦	૮૦.૦	૮૬.૫	૫૭.૧	૩૮.૭
	૫	શ્રેષ્ઠ વિકાસ	૮૪.૦	૪૨.૦	૩૬.૨	૩૨.૪	૧૧૦.૪	૮૨.૦	૮૮.૪	૫૮.૦	૪૦.૬

૧૮૨.૫	૧	નખળો વિકાસ	૬૬.૫	૩૪.૩	૨૫.૪	૨૬.૦	૮૭.૬	૭૬.૨	૫૦.૮	૩૩.૬	
	૨	સાધારણુ વિકાસ	૭૧.૫	૩૬.૨	૨૮.૪	૨૭.૩	૬૩.૪	૭૭.૪	૮૪.૦	૫૨.૭	૩૪.૮
	૩	ઇંદ્ર વિકાસ	૭૬.૫	૩૮.૦	૩૧.૦	૨૮.૨	૬૬.૦	૭૮.૭	૮૫.૨	૫૪.૫	૩૬.૮
	૪	સરસ વિકાસ	૮૧.૫	૪૦.૦	૩૪.૨	૩૧.૦	૧૦૪.૪	૮૦.૬	૮૭.૨	૫૭.૧	૩૮.૭
	૫	શ્રેષ્ઠ વિકાસ	૮૫.૪	૪૧.૮	૩૬.૮	૩૨.૪	૧૧૧.૮	૮૨.૫	૮૮.૦	૫૮.૭	૪૦.૬

ઊંચાઈના પ્રમાણમાં સ્ત્રીશરીરના માપ

આગળના ડોડામાં પુરુષશરીરના બંધારણુનાં વિવિધ ઊંચાઈએ પાંચ વિભાગમાં અલગ અલગ અંગોનાં માપ આપવામાં આવ્યાં છે, તે પ્રમાણે સ્ત્રી શરીરના પણ પાંચ વર્ગ પાડી શકાય. ૫૨ંતુ સ્ત્રી શરીરની કુદરતી રૂચના એવી છે, કે તેમાં મેદનું પ્રમાણ પુરુષની સરખામણીમાં વધારે હોય છે. તેમજ સ્ત્રીના સ્નાયુઓનો વિકાસ નૈસર્જિક રીતે ઓછા પ્રમાણમાં થાય છે. સ્ત્રીઓનો સ્વાભાવિક પ્રયત્ન પણ મેદનું (ચરખીનું) પ્રમાણ વધે નહિ, તે તરફ હોય છે. સ્નાયુને પુષ્ટ બનાવવા તરફ તેઓનું લક્ષ્ય પ્રમાણમાં ઓછું હોય છે. આથી સ્ત્રીશરીરના બંધારણુને પુરુષ કરતાં અલગ પાંચ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

- (૧) સુકલકડી (Thin)
- (૨) નાજુક, (Slender)
- (૩) આદર્શ, (Ideal)
- (૪) સ્થૂલ (Plump)
- (૫) અતિસ્થૂલ (Overweight)

પુરુષ શરીરમાં પહેલા વિભાગને ઓછા સ્નાયુ વિકાસવાળો ગણુવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓમાં પહેલા વિભાગમાં સુકલકડી શરીરને ગણુંયું છે. ઊંચાઈના પ્રમાણમાં નેઓનું વજન ધણું જ ઓછું હોય તેવી સ્ત્રીઓનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. આવી સ્ત્રીઓના શરીરમાં ડોઇક વિકાર થયો હોવાનો સંભવ નકારી શકાય નહિ. તેમજ આવી સ્ત્રીઓ સૌંદર્યની દર્શિયે પણ ખામીવાળી હોય છે.

ખીજ વર્ગમાં નાજુક શરીરવાળી ઓચો ગણુવાની શકાય. તેઓનું વજન ઊંચાઈના પ્રમાણમાં કંઈક ઓછું હોય છે; તેમજ સ્નાયુઓનો વિકાસ પણ પ્રમાણમાં ઓછો હોવાથી શારીરિક શક્તિની દર્શિયે આવી ઓચો ઉણી ઉત્તરે છે.

નોઝ વર્ગની ઓચો ઊંચાઈના પ્રમાણમાં, વજન તથા વિકાસની દર્શિયે નમુનેદાર હોય છે, નેથી તેમને આદર્શ ગણુવામાં આવે છે.

ચોથા વર્ગમાં મૂકવામાં આવતી સ્ત્રીઓનું વજન નેઈએ તે કરતાં કંઈક વધારે હોય છે, નેથી તેમને સ્થૂલ વજનવાળા વિભાગમાં ગણુવામાં આવે છે. આવી સ્ત્રીઓ સૌંદર્યની દર્શિયે પણ આદર્શના પ્રમાણમાં ઉણી લાગે છે.

પાંચમા વર્ગમાં અતિ સ્થૂલ શરીરવાળી સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમનું વજન ઊંચાઈના પ્રમાણમાં હોવું નેઈએ તે કરતાં ધણું વધારે હોય છે; તેમજ શરીરમાં મેદનું પ્રમાણ પણ ધણું વધારે હોય છે, નેથી તેઓ હેખાવે કદર્દીપી લાગે છે, તેમજ મેદનું અત્યંત પ્રમાણ રોગને જદ્દી નોંઠરે છે.

ઉપરના વર્ગીકરણના વિશ્લેષણ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે, કે પુરુષોનું વર્ગીકરણ કરતી વખતે સ્નાયુની સ્થિતિ ઉપર વિશેષ જોક મૂકવામાં આવ્યો હતો, જ્યારે સ્ત્રીશરીરના બંધારણું વર્ગીકરણ કરતી વખતે, મેદના પ્રમાણ ઉપર આધાર રાખવામાં આવ્યો છે.

જુદી જુદી ઊંચાઈએ સ્ત્રીશરીરનું વજન અને વિભિન્ન અંગોનાં માપ નીચે પ્રમાણે હોવાં નેઈએ.

ડૉંચાઈના પ્રમાણુમાં સ્વીશાર્દીરનાં જીવાં જીવાં માપ

જીંચાઈ	વળન	સેન્ટી	શરીરનો	કિલો	ટેક	દંડ	પ્રોફેષન	ઉરો-	કમર	નિતંખ	સાથળ	પિંડી	પોંચો
માટ્ર	વિકાસ	આમ						ભાગ					
૧૪૮	૧ સુકલકડી	૪૩.૦	૨૮.૫	૧૪.૨	૨૧.૦	૭૬.૨	૫૬.૭	૮૩.૪	૪૮.૫	૩૦.૪	૧૬.૦		
	૨ નાજુક	૪૬.૨	૨૮.૮	૨૫.૪	૨૨.૩	૭૮.૭	૬૧.૬	૮૭.૬	૫૧.૪	૩૧.૦	૧૬.૭		
	૩ આદર્શ	૪૬.૫	૩૦.૪	૨૬.૦	૨૨.૮	૮૧.૩	૬૩.૪	૮૬.૫	૫૩.૫	૩૨.૪	૨૦.૩		
	૪ સ્થૂલ	૫૨.૫	૩૧.૭	૨૭.૩	૨૪.૨	૮૩.૮	૬૫.૪	૮૨.૭	૫૪.૮	૩૩.૬	૨૧.૦		
	૫ અતિસ્થૂલ૫૫.૦	૩૨.૪	૨૭.૮	૨૪.૮	૮૬.૪	૬૮.૦	૬૫.૩	૮૫.૧	૫૭.૧	૩૪.૬	૨૧.૬		
૧૫૨.૪	૧ સુકલકડી	૪૪.૦	૨૮.૫	૨૪.૮	૨૧.૦	૭૬.૮	૬૦.૩	૮૪.૪	૫૦.૨	૩૦.૪	૧૬.૦		
	૨ નાજુક	૪૭.૦	૨૮.૮	૨૫.૪	૨૨.૨	૭૮.૪	૬૨.૨	૮૭.૭	૫૨.૦	૩૧.૦	૧૬.૬		
	૩ આદર્શ	૫૦.૪	૩૦.૪	૨૬.૦	૨૨.૮	૮૧.૯	૬૪.૧	૮૦.૨	૫૪.૦	૩૨.૪	૨૦.૩		
	૪ સ્થૂલ	૫૩.૫	૩૧.૭	૨૭.૩	૨૪.૨	૮૪.૪	૬૬.૦	૮૩.૪	૫૫.૮	૩૩.૬	૨૧.૦		
	૫ અતિસ્થૂલ૫૬.૬	૩૨.૪	૨૮.૫	૨૪.૮	૮૭.૦	૬૮.૫	૬૬.૪	૮૭.૮	૫૭.૮	૩૪.૦	૨૧.૬		
૧૫૪.૬	૧ સુકલકડી	૪૫.૩	૨૮.૨	૨૪.૮	૨૧.૪	૭૭.૫	૬૧.૦	૮૫.૮	૫૦.૮	૩૧.૦	૧૬.૭		
	૨ નાજુક	૪૮.૪	૩૦.૪	૨૬.૦	૨૨.૬	૮૦.૦	૬૨.૮	૮૮.૮	૫૨.૭	૩૧.૭	૨૦.૩		
	૩ આદર્શ	૫૨.૬	૩૧.૦	૨૬.૬	૨૩.૫	૮૨.૫	૬૪.૭	૮૧.૪	૫૪.૬	૩૩.૦	૨૧.૦		
	૪ સ્થૂલ	૫૫.૦	૩૨.૪	૨૭.૬	૨૪.૮	૮૫.૧	૬૬.૬	૮૪.૬	૫૬.૪	૩૪.૩	૨૧.૬		
	૫ અતિસ્થૂલ૫૮.૫	૩૩.૦	૨૮.૫	૨૫.૪	૮૮.૩	૬૮.૨	૬૭.૨	૮૮.૮	૫૮.૪	૩૫.૪	૨૨.૩		
૧૫૭.૪	૧ સુકલકડી	૪૬.૨	૨૮.૨	૨૫.૪	૨૨.૩	૭૮.૮	૬૧.૫	૮૬.૪	૫૧.૪	૩૧.૦	૧૬.૭		
	૨ નાજુક	૪૮.૪	૩૦.૪	૨૬.૦	૨૨.૮	૮૧.૩	૬૩.૪	૮૮.૫	૫૩.૩	૩૨.૪	૨૦.૩		
	૩ આદર્શ	૫૩.૦	૩૧.૧	૨૬.૬	૨૩.૫	૮૩.૮	૬૬.૦	૮૨.૦	૫૫.૩	૩૩.૬	૨૧.૦		
	૪ સ્થૂલ	૫૬.૫	૩૨.૪	૨૭.૬	૨૪.૮	૮૬.૪	૬૮.૦	૮૫.૨	૫૭.૧	૩૪.૬	૨૧.૫		
	૫ અતિસ્થૂલ૫૮.૮	૩૩.૦	૨૮.૨	૨૫.૪	૮૮.૬	૭૦.૫	૬૮.૪	૮૮.૪	૫૮.૦	૩૭.૪	૨૨.૨		
૧૬૦.૦	૧ સુકલકડી	૪૭.૫	૨૮.૮	૨૫.૪	૨૨.૩	૭૮.૩	૬૨.૨	૮૭.૦	૫૨.૦	૩૧.૭	૧૬.૭		
	૨ નાજુક	૫૦.૮	૩૧.૦	૨૬.૬	૨૩.૫	૮૨.૦	૬૪.૮	૮૦.૨	૫૪.૦	૩૨.૪	૨૦.૩		
	૩ આદર્શ	૫૪.૨	૩૧.૭	૨૭.૩	૨૪.૨	૮૪.૫	૬૬.૭	૮૨.૭	૫૫.૮	૩૩.૬	૨૧.૦		
	૪ સ્થૂલ	૫૮.૦	૩૩.૦	૨૮.૫	૨૫.૪	૮૭.૬	૬૮.૪	૮૫.૮	૫૭.૮	૩૪.૦	૨૧.૬		
	૫ અતિસ્થૂલ૫૧.૬	૩૩.૬	૨૮.૮	૨૬.૦	૬૦.૨	૭૧.૧	૬૬.૦	૫૮.૬	૩૬.૨	૨૨.૨			

શરીરસૌષ્ઠવ અને કલાત્મક અંગ વિન્યાસ

૨૬૮

ભિયાઈ સેન્ટી મીટર	શરીરનો વિકાસ	વજન કિલો- ગ્રામ	ડેક	દ'સ	પ્રક્રિયા	ઉરો- લાગ	કમર	નિતંબ	સાથી	પિંડી	ચેંચો
૧૬૨.૫	૧ સુકલકડી	૪૮.૦	૨૮.૮	૨૬.૦	૨૨.૮	૮૦.૦	૬૨.૨	૮૭.૬	૫૨.૦	૩૧.૭	૨૦.૩
	૨ નાજુક	૫૨.૬	૩૧.૦	૨૬.૬	૨૩.૫	૮૨.૫	૬૪.૧	૮૦.૮	૫૪.૦	૩૩.૦	૨૧.૦
	૩ આદર્શ	૫૬.૨	૩૧.૭	૨૭.૬	૨૪.૮	૮૫.૦	૬૬.૬	૮૪.૦	૫૫.૮	૩૪.૨	૨૧.૬
	૪ સ્થૂલ	૫૮.૮	૩૩.૦	૩૧.૭	૨૫.૪	૮૭.૫	૬૮.૨	૮૬.૫	૫૭.૮	૩૫.૫	૨૨.૨
	૫ અતિસ્થૂલ૫૩.૫	૩૪.૨	૩૨.૪	૨૬.૦	૬૦.૮	૭૧.૮	૬૮.૬	૫૮.૬	૩૬.૮	૨૨.૮	
૧૬૫.૦	૧ સુકલકડી	૫૦.૮	૩૦.૪	૨૬.૦	૨૨.૮	૮૦.૬	૬૨.૮	૮૮.૬	૫૨.૭	૩૨.૪	૨૦.૩
	૨ નાજુક	૫૪.૪	૩૧.૭	૨૭.૩	૨૪.૨	૮૧.૩	૬૪.૭	૮૨.૦	૫૪.૫	૩૩.૫	૨૧.૦
	૩ આદર્શ	૫૮.૦	૩૨.૪	૨૭.૬	૨૪.૮	૮૬.૩	૬૭.૩	૮૫.૩	૫૬.૪	૩૪.૦	૨૧.૬
	૪ સ્થૂલ	૬૧.૬	૩૩.૦	૨૮.૨	૨૫.૪	૮૮.૬	૬૮.૮	૮૭.૮	૫૮.૪	૩૬.૨	૨૨.૨
	૫ અતિસ્થૂલ૬૫.૮	૩૪.૩	૩૦.૪	૨૬.૬	૬૧.૪	૭૧.૪	૧૦૦.૮	૬૦.૩	૩૭.૪	૨૨.૮	
૧૬૭.૬	૧ સુકલકડી	૫૨.૦	૩૦.૪	૨૬.૬	૨૩.૫	૮૧.૬	૬૩.૫	૮૮.૫	૫૩.૩	૩૨.૪	૨૦.૩
	૨ નાજુક	૫૬.૨	૩૧.૭	૨૭.૬	૨૪.૧	૮૨.૬	૬૪.૪	૮૨.૭	૫૪.૩	૩૩.૬	૨૧.૦
	૩ આદર્શ	૫૮.૮	૩૩.૦	૨૮.૫	૨૫.૪	૮૬.૪	૬૭.૬	૮૫.૮	૫૭.૧	૩૫.૦	૨૧.૬
	૪ સ્થૂલ	૬૩.૪	૩૩.૬	૨૮.૭	૨૬.૦	૮૮.૫	૭૦.૪	૮૮.૦	૫૮.૦	૩૬.૨	૨૨.૨
	૫ અતિસ્થૂલ૬૭.૬	૩૪.૦	૩૧.૦	૨૭.૩	૬૨.૭	૭૩.૦	૧૦૨.૨	૬૧.૦	૩૭.૪	૨૨.૮	
૧૭૦.૧	૧ સુકલકડી	૫૪.૦	૩૧.૦	૨૬.૬	૨૩.૫	૮૨.૫	૬૪.૨	૮૦.૮	૫૪.૦	૩૩.૦	૨૧.૦
	૨ નાજુક	૫૮.૦	૩૧.૭	૨૭.૬	૨૪.૮	૮૫.૦	૬૬.૦	૮૪.૦	૫૫.૮	૩૪.૩	૨૧.૬
	૩ આદર્શ	૬૧.૬	૩૩.૦	૨૮.૨	૨૬.૦	૮૭.૫	૬૮.૪	૮૭.૨	૫૭.૮	૩૫.૫	૨૨.૨
	૪ સ્થૂલ	૬૫.૮	૩૩.૬	૩૦.૪	૨૬.૬	૬૦.૨	૭૨.૪	૧૦૦.૩	૫૮.૬	૩૬.૮	૨૨.૮
	૫ અતિસ્થૂલ૬૮.૬	૩૪.૦	૩૧.૭	૨૭.૮	૬૩.૪	૭૩.૬	૧૦૩.૫	૬૧.૫	૩૮.૦	૨૩.૪	
૧૭૨.૬	૧ સુકલકડી	૫૫.૦	૩૧.૦	૨૭.૩	૨૪.૨	૮૩.૩	૬૪.૮	૮૧.૪	૫૪.૬	૩૩.૦	૨૧.૦
	૨ નાજુક	૫૮.૨	૩૧.૭	૨૭.૬	૨૪.૮	૮૫.૮	૬૬.૭	૮૪.૫	૫૬.૪	૩૪.૨	૨૧.૬
	૩ આદર્શ	૬૩.૪	૩૩.૦	૨૮.૨	૨૬.૦	૮૮.૪	૬૬.૨	૮૭.૮	૫૮.૪	૩૫.૫	૨૨.૨
	૪ સ્થૂલ	૬૭.૬	૩૪.૩	૩૦.૪	૨૬.૭	૬૧.૪	૭૧.૮	૧૦૧.૦	૬૦.૩	૩૬.૮	૨૨.૮
	૫ અતિસ્થૂલ૭૧.૫	૩૪.૫	૩૧.૭	૨૭.૮	૬૪.૦	૭૪.૩	૧૦૪.૦	૬૨.૨	૩૮.૦	૨૩.૫	

સ્નાયુનિયમન (MUSCLE CONTROL)

શરીરના જુદા જુદા સ્નાયુએ ઉપર અંકુશ મેળવીને, તેને હલાવા બતાવવાની કિયાને સ્નાયુનિયમન કહેવાય છે. અમેરિકન તજ્જ્રણ ચાર્સ મેક્સેન્ઝનના મત સુજરૂ શરીરના હડકાને હલાવ્યા સિવાય, તેને સંલગ્ન સ્નાયુને હલાવવાની કિયા એટલે સ્નાયુનિયમન. હડ્યોગમાં નૌલીની કિયામાં પેટના એક એ સ્નાયુએને છંચા પ્રમાણે હલાવવાની કિયા કરવામાં આવે છે, એ પણ સ્નાયુ-નિયમનનો એક અધરો પ્રકાર છે. આપણા સ્નાયુ કેટલા તૈયાર છે અને તેના ઉપર આપણો કેટલો અંકુશ છે તે દર્શાવવા સ્નાયુ-નિયમનની કિયા કરવામાં આવે છે. આ પ્રમાણે સ્નાયુને હલન ચલન કરવાથી થોડાક વ્યાયામ મળે છે. પણ સ્નાયુએ તૈયાર કરવા માટે એટલો વ્યાયામ પૂરતો નથી. એ માટે વ્યવસ્થિત તાલીમની જરૂર પડે છે.

સામાન્ય રીતે સ્નાયુનિયમન જણુતા ન હોય તેવા કિશોરો-યુવાનો પણ પોતાના હાથના સ્નાયુ કેટલા તૈયાર છે, તે બતાવવા હાથને ડોણીમાંથી વાળી હાથના સ્નાયુ બતાવે છે. તે પણ એક રીતે સ્નાયુ-નિયમનનો જ પ્રકાર છે. શરીરની જોઈ પણ હિલબાલ કરવાના છંચા થતાં, મજબૂતંતુ દારા તે ખરાર ને તે સ્નાયુને પહોંચે છે, અને તે પ્રમાણે તે સ્નાયુ પ્રસરણ કે આકુંચનની કિયા કરે છે. આવી કિયા એટલી સહજ રીતે થાય છે, કે તેનું લાન પણ આપણુને હોતું નથી. અર્થાત્ આપણી છંચાશક્તિ દારા જ આપણે સ્નાયુને શિથિલ કે ટદાર કરી શકોછે.

સ્નાયુનિયમન સારી રીતે કરવા માટે ને તે સ્નાયુ ઉપર ચિતની એકાશતા ડેગવરાની ખાસ જરૂર પડે છે. શરૂઆતમાં સ્નાયુનું નિયમન યોગ્ય રીતે થતું નથી. પરંતુ હતારી થયા વિના સતત

અભ્યાસ-મહાવરો ચાલુ રાખવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.

સ્નાયુનિયમનની શક્તિ દરેક વ્યક્તિમાં ઓછા વત્તા પ્રમાણમાં હોય છે જે નાનાં બાળોએ પણ કેટલીક વખત પોતાના કાનને કે અમરને છંચા પ્રમાણે હલાવી બતાવે છે. અલાયત આવી કિયાને સ્નાયુનિયમન તરીકે ગણ્યાવી શકાય નહિ. છતાં યોગ્ય મહાવરાથી દરેક વ્યક્તિ સ્નાયુ ઉપર જરૂરી અંકુશ મેળવી શકે છે. શરૂઆતમાં આ કિયા ધીમી ગતિથી થાય છે, પરંતુ નેમ મહાવરો વધે, તેમ તેમાં જડપ લાવી શકાય છે. નેટલી જડપે આ કિયા કરી શકાય, તેટલું કૌશલ્ય વધારે હસ્તગત કર્યું ગણ્યાય.


સ્નાયુનિયમનની કિયા કરતાં ધ્યાનમાં રાખવું, કે ને સ્નાયુનું હલન ચલન કરાવવું હોય તેને પહેલાં ત્રદ્ધન શિથિલ કરવો જોઈએ. શરૂઆતમાં આ કિયા કરનારે સામે આરસી રાખીને, તેમાં જોઈ શકાય તે પ્રમાણે કિયા કરવી; જેથી સ્નાયુનું હલન ચલન કેવું થાય છે, તે જોઈ શકે અને તેમાં જરૂરી સુધારા વધારા કરી શકે. સ્નાયુના હલન ચલનની કિયા બરાબર આવડી જય, પછી મહાવરો કરતી વખતે સામે આરસી રાખવી જરૂરી નથી. વિવિધ સ્નાયુનિયમન માટે નીચે પ્રમાણે કસરતો કરવાની લક્ષામણું કરવામાં આવે છે.

કસરત-૧ : બાહુના સ્નાયુએનું નિયમન

ચિત્રાંક-૧ પ્રમાણે હાથને ડોણીમાંથી વાળી, હાથની આંગળોએ માથા પાસે આવે, તે પ્રમાણે કિયા કરવી. ત્યાર બાદ ચિત્રાંક-૨ પ્રમાણે બાહુ ઉપરના સ્નાયુને ટદાર કરવા.

કસરત-૨ : સાથળના સ્નાયુએનું નિયમન

ચિત્રાંક-૩ પ્રમાણે જમણો પગ ટદાર અને ડાઢો પગ ધૂંઠણમાંથી સહેજ વળેલો રહે તે પ્રમાણે



બાહુ અને સાથળના સ્નાયુઓનું નિયમન

જિલ્લા રહેવું. સાથળના સ્નાયુ શિથિલ રાખવા. ત્યાર બાદ જમણું સાથળના સ્નાયુને ચિત્રાંક-૪ પ્રમાણે ટદ્દાર કરવો અને પુનઃ શિથિલ કરવો તથા ફરી પાછો ટદ્દાર કરવો. જ્યારે સ્નાયુ ટદ્દાર હોય ત્યારે ઉપરના લાગમાં માછળી જેવો સ્નાયુનો આકાર ઉપસે છે. એ જ પ્રમાણેની કિયા પછી ડાબા પરો પણ

કરવી. હાથના સ્નાયુનું આવું હલનચલન પ્રમાણમાં સરળ છે, જ્યારે સાથળના સ્નાયુનું મુશ્કેલ હોવાથી તે માટે વધારે મહાવરો જરૂરી બને છે.


કસરત-૩ : દાઢની ગાઢીઓનું હલનચલન

- ચિત્રાંક-૧માં દર્શાવ્યા પ્રમાણે બને હાથની

આંગળીઓને એકમેફની સાથે ભરાવિને હેઠળ માથાના પાછળના ભાગમાં મુક્કી. આ સમયે બાહુના સનાયુઓને શિથિલ રાખવા. ત્યાર વિંદ સનાયુ ટદ્દાર કરવા તથા પુનઃ શિથિલ કરવા. આવી ક્રિયા વારંવાર કરવી.

કસરત-૮ : ટ્રેપેજિયસ સનાયુનું નિયમન

આ સનાયુ પીડના ઉપરના ભાગમાં ગરદન પાસે હાથ છે. ચિત્રાંક-૨માં દર્શાવ્યા મુજબ કોઈ પણ એક હાથની ત્રણ આંગળીઓ ભીજ હાથ વડે પદ્ધતિ ચિત્રમાં બતાવ્યા મુજબ જિલ્લા રહેલું. ત્યાર




હાથ, ટ્રેપેજિયસ, અને પીડના સનાયુનું હલન ચલન

બાદ હાથને નીચેની તરફ સહેજ બહારની બાજુ એંચવા અને તે જ વખતે ખાને જરા આગળ આણુવા. ખલા અને બગલ નીચેના સ્નાયુ શક્ય તેટલા શિથિલ કરવા, નેથી ગરદન ઉપરના સ્નાયુ જાંચા લાવી શકાશે. આ પ્રમાણેની કિયા વારંવાર કરવી. જ્યારે આ પ્રમાણેની કિયા ઉપર પ્રસૂતિ મેળવાય, ત્યારે એકેક બાજુના સ્નાયુને વારાફરતી હલાવવાનો મહાવરો કરવો.

કસરત-૫ : ખલાના સ્નાયુનું નિયમન

એક હાથની આંગળીઓને ખીંચ હાથ વડે પછી ચિત્રાંક-૩ પૃષ્ઠ-૨૭૨માં ખતાવ્યા પ્રમાણે હાથને માથા ઉપર જાચા રાખી જલા રદ્દેવું. પછી હાથને ઉપરની તરફ સહેજ બહારની બાજુએ : એંચવા, નેથી ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે બગલ નીચેના અને ખલાના સ્નાયુ ઉપસેલા જણાશે. આ કિયા.મહાવરા માટે અનેક વાર કરવી.



પીડના સ્નાયુનો વિકાસ

કસરત-૬ : પીડના સનાયુ ઊંચા-નીચા કરવા.

ચિત્રાંક-૪ (૫૪૮-૨૭૩) પ્રમાણે હાથને પીડ પાછળ રાખીને જિલ્લા રહેલું. પછી હાથને અંદરની બાજુએ થોડા નીચે એચવા. આ વખતે પીડની ઉપરના સનાયુઓ તદ્દન શિથિલ કરવા, નેથી પીડના સનાયુ ઊંચા નીચા થઈ શકશે. આ કિયાનો યોગ્ય મહાવરો કરવો.

કસરત-૭ : પીડના સનાયુને પહોળા કરવા.

ચિત્રાંક-૧ (૫૪૮-૨૭૩)માં બતાવ્યા પ્રમાણે એક હાથની અંગળીએ ખીંચ હાથ વડે પકડી, બન્ને હાથ કમરના પાછળના ભાગમાં રાખી જિલ્લા રહેલું. ત્યાર બાદ બન્ને હાથને એક ખીંચથી વિરક્ષ દિશામાં સહેજ ઉપરની તરફ એંચવા. આ વખતે પીડના ઉપરના ભાગના સનાયુને શિથિલ રાખવા. આમ કરવાથી ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પીડના સનાયુ એક ખીંચથી દૂર જરો, નેથી પીડ પહોળા થશે. પુનઃ સનાયુએને શિથિલ કરી, આ કિયાનો યોગ્ય મહાવરો કરવો.

કસરત-૮ : ખલાને એક ખીંચથી દૂર લઈ જવા.

ચિત્રાંક-૨ મુજબ કમર ઉપર હાથ મૂકી જિલ્લા રહેલું. પછી હાથને સહેજ અંદરની બાજુએ લાવવા. આ સમયે બગલની નીચેના પીડની બાજુના 'લેટિસિમસ' સનાયુને શિથિલ કરવા. ખલાને જરા આગળ તરફ જાયે જયકવા, નેથી ખલા પહોળા થશે; તેમજ છાતી પણ પહોળા થયેલી જણાશે. સનાયુને પુનઃ શિથિલ કરી, વારંવાર આ કિયા કરવી.

કસરત-૯ : દંડના પાછળા સનાયુ (ટ્રેપેજિયસ)- ઝું નિયમન

બન્ને હાથને પીડની પાછળ લાવી, એક હાથની ગણ અંગળીએ ખીંચ હાથ વડે પકડી, ચિત્રાંક-૩ પ્રમાણે જિલ્લા રહેલું. પછી ખલાને પાછળની તરફ

ખેંચી હાથને કાંડામાંથી વાળવા તથા દંડના પાછળા ભાગના સનાયુને ટદાર કરવા અને પુનઃ શિથિલ કરવા. આ કિયાનો જરૂરી મહાવરો કરવો.

કસરત-૧૦ : ઐઠને અંદર લેવું.

ચિત્રાંક-૪ પ્રમાણે બન્ને હાથ પકડીને માથા ઉપર ઊંચા રાખી જિલ્લા રહેલું. પછી શક્ય તેટલો ઉચ્છવાસ છોડીને, પેટને બને તેટલું અંદર લેવું. આમ થતાં મધ્યપટલના સનાયુ ઉપર ખેંચાશે. ત્યારબાદ પુનઃ સનાયુએને શિથિલ કરવા આ રીતે વારંવાર કિયા કરવી. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે જિલ્લા રહીને, આ કિયા કરવાનું અનુરૂપ ન પડે તો કમરમાંથી સહેજ આગળ જૂકી, હાથને સાથળ ઉપર ટેકવા અને ઉચ્છવાસ છોડી પેટને બને તેટલું અંદર લેવું. આ રીતે કરવાથી કિયા સુગમ બનશે.

કલાયુક્ત અંગમુદ્રાએ.

ધારદાર શરીરનાં અંગોનું કલાત્મક રીતે પ્રદર્શન કરવાની કળા છેલ્લાં ડેટલાંક વર્ષો દરમાન આપણું દેશમાં પણ લોકપ્રિય બની છે. વર્ષો પહેલાં, ડાઈ બાળવાન પહેલવાન ગામે ગામ ફરીને, સર્કસમાં પોતાના શરીરસામર્થ્યના પ્રયોગો કરી બતાવે, એ જ સામાન્ય રીતે 'વ્યાયામતું' ધ્યેય મનતું હતું. પરંતુ શરીરને એટલું બધું સ્થૂળ અને શક્તિમાન બનાવવું, એટલું જ ધ્યેય હાલના વ્યાયામશાસ્ક્રોએ સ્વીકારતા નથી. તેમના ધ્યેય મુજબ તમામ પ્રકારના વ્યાયામથી શરીર ધારદાર બનવું જોઈએ; અને તેને જ 'મસ્ક્યુલર રેનેસાં' એટલે કે સનાયુ વૃદ્ધિશાસ્ક્રોનો ઉદ્દ્દ્ય કહી શકાય. સુપ્રસિદ્ધ વ્યાયામવીર સેન્ટો આ નવિન કદ્યપનાના મુખ્ય પ્રવર્ત્તક છે. જ્યારે સેન્ટોએ પોતાના ધારદાર શરીરની વિવિધ કલાત્મક મુદ્રાએ નાટ્યગૃહોમાં પ્રયોગો કરીને બતાવી, ત્યારે એ કલા પ્રદર્શનથી જગત આશ્રમચક્કિત થઈ ગયું. અને ત્યારથી જ શરીરના અમાપ સામર્થ્ય જોડે તે દર્શનિય તથા ધારદાર પણ હોવું જ જોઈએ,

એવી કદ્દમના પ્રચાર પામી. પરિણામે વ્યાયામનો ઉદ્દેશ શરીરને ધાટદાર તથા સપ્રમાણુ બનાવવાનો મનાયો, અને તેના અનુસરણું શરીર બળ તો આપો આપ જ આવે એવો સિદ્ધાંત પ્રચલિત થયો.

ધાટદાર શરીરનું કલાયુક્ત પ્રદર્શન રણ પ્રકારે કરી શકાય.

(૧) પુરાતન શિદ્ધપાકૃતિઓના ધાટદાર શરીરના નસુનાઓનું અનુકરણું.

(૨) સનાયુઓનું પ્રદર્શન.

(૩) ઉચ્ચ ભાવનાપ્રદર્શન.

(૧) પુરાતન શિદ્ધપાકૃતિઓના...અનુકરણું

આ પહેલા પ્રકારમાં ઓઝ સંસ્કૃતિનાં ડિસ્કેષાલસ, ઎નેડિયેટર, ડેવિડ, એપોલો વગેરેનાં સુંદર પુતળાં જોઈને તે પ્રમાણે આપણું શરીરની કલાત્મક અંગમુદ્રાઓ કરવાની હોય છે. પ્રથમ દર્શને આ અનુકરણું એકદમ સહેલું લાગે, પરંતુ જ્યારે પ્રત્યક્ષ કાર્ય શરૂ કરીએ ત્યારે જ ખ્યાલ આવે છે કે તે કાર્ય ડેટલું કંડિન છે આવી શિદ્ધપાકૃતિનું અનુકરણું કરતી વખતે, પ્રથમ પગની સ્થિતિ લક્ષ્યમાં લેવી. ત્યાર બાદ શરીરના વિવિધ અંગોના વળાંડો તથા ચહેરાના ખૂણું એ વગેરેનો કાળજીપૂર્વક અભ્યંસ કરવો અને અનુકરણું કરવું. એડો આત્મવિશ્વાસ કેળવાય ત્યારે પુતળાને બાજુઓ રાખી, આરસી સામે જિલ્લા રધી, શિદ્ધપાકૃતિ પ્રમાણે કલાત્મક અંગમુદ્રા બનાવવાનો મહાવરો કરવો. સતત પ્રયત્નો દ્વારા જ આ કાર્ય જિદ્ધ થઈ શકતું હોઈ, ધ્યેયપ્રાપ્તિ પ્રત્યે સતત મંડયા રહેલું પડે છે. આત્મસૂઝ અને આત્મવિશ્વાસથી કાર્યસિદ્ધ ઝડપી બને છે.

(૨) સનાયુઓનું પ્રદર્શન

આ પ્રકારમાં માણુસના શરીરના સનાયુઓની પુષ્ટા તથા સુગંહિતાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. શરીરના સનાયુઓનું વિશિષ્ટ રીતે આકૃચન

કરવું, એ આમાં મુખ્ય છે. સાદા પ્રદર્શનમાં પણ કલાકારની કુશળતા જણ્ણાઈ આવ્યા વિના રહેતી નથી. આમાં સનાયુઓની વૃદ્ધિ ડેવો રીતે થાય છે તે, સનાયુઓની પ્રમાણુસરતા તથા સ્થિતિ-સ્થાપકતાનું પ્રદર્શન કરવાનું હોય છે. આ કાર્ય માટે વ્યાયામથી શરીરને ધાટદાર બનાવવું પડે છે; તેમજ વિશિષ્ટ વ્યાયામથી ખાસ પ્રકારના સનાયુઓનો વિકાસ કરવો જરૂરી બને છે. સતત પરિશ્રમ માળી લેતું આ કાર્ય એટલું જ આકર્ષક પણ છે.

(૩) ઉચ્ચ ભાવનાપ્રદર્શન :

ઉપર્યુક્ત વણે પ્રકારોમાં આ પ્રકાર ધણો જ મહત્વનો, અંતિ પરિશ્રમ માળી લે તેવો, અને કૌશલ્યપૂર્ણ છે. આથી ધણ્ણા ઓળા લેડો તે સાધ્ય કરી શકે છે. અતાં ઉચ્ચ ધ્યેય દર્શિ સમક્ષ રાખો, સતત પરિશ્રમ કરી ધ્યેયસિદ્ધ પ્રત્યે નિષ્ઠા-પૂર્વક મંડયા રહેવાથી કાર્યસિદ્ધ પ્રાપ્ત થાય છે. એ માટે જરૂર છે, જે ભાવના પ્રદર્શિત કરવાની હોય તેની સાથે એકદ્વિતી થઈ જવાની. આથી અભિનય જીવંત બનશે.

આ સંબંધમાં એક વાત હમેશાં યાદ રાખવી જોઈએ, કે ગમે તેવી ભાવનામય અંગમુદ્રા બતાવતા હોય, તો પણ સનાયુઓના ધાટદારપણ્ણા તરફ કુલ્લક્ષ્ય ન જ થવું જોઈએ. કલાકારે હમેશાં લક્ષ્યમાં રાખવું, કે ધાટદાર શરીર એ સાધન નથી, પણ સાધ્ય છે.

કોઈ પણ કલાના મૂળભૂત તત્ત્વો તો હમેશાં સરખા જ હોય છે. જે કૃતિનો ઢાક આપણે જતાવવો હોય, તેની ભાવના લેડો તદ્વન એકદ્વિતી થઈને કલાકારે પોતાની જતના અસ્તિત્વને વિસરી જવું જોઈએ. નાની બાબતો વિશે વધુ પડતું લક્ષ્ય નહીં આપતાં શરીરના એકદ્વિતી ઢાક અને જોનાર ઉપર તેની થતી અસર ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વળી એ પણ ભુલાવું ન જોઈએ, કે પ્રથમ પ્રયત્નો હમેશાં સફળ થવાતું નથી. એ માટે ધીરજપૂર્વક પુનઃ પુનઃ પ્રયત્ન કરવો ધટે.

આ સાથે કલાત્મક અંગવિન્યાસ દર્શાવતાં ઉપયુક્ત ત્રણે પ્રકારનાં ચિત્રો વર્ણિન સાથે દર્શાવ્યાં છે, ને કલાત્મક અંગવિન્યાસના આદર્શ નમુનારૂપ છે.


ધાટદાર પુરુષરીરનું પૂતળું



ડિસ્કોબોલસ (Discobolus)

‘માયરાન’ નામના શિલ્પકારે કંડારલી ખોન્જ ધાતુની આ શિલ્પાકૃતિ રોમની વેટિકન આટ્ટ ગેલેરીમાં રાખવામાં આવેલી છે. સનાયુઓની વડુરેખાઓ તેમજ હાથમાં રાખેલા ચકને જાણે હમણ્યાં જ ફેંકશો, એવું દર્શાવી, તેમાં ઉચ્ચ પ્રકારનું સોંદર્ય શિલ્પકારે ઉત્પન્ન કર્યાં હોઈ, આ એક ઉત્તમ શિલ્પાકૃતિ બની છે.


ધારદાર સ્ત્રીશરીરનું પૂતળું



વિનસ (Venus)

સ્ત્રીના પ્રમાણાંગદ શરીરનો આદર્શ નમુનો ગણ્યાતું વિનસનું આ પૂતળું છાયા પ્રકારની યોજનાથી કલાના ઉત્કૃષ્ટ નમુનારૂપ બન્યું છે.

સનાયુપ્રદર્શિન



સનાયુસીંદ્ર્ય અને વિકાસ (A Pose containing grace and muscular development)

આમાં શરીરના કુમર અને તોડતી વર્ચ્યેના લાગ (Torso)નો વિકાસ, બારિક કટિપ્રદેશ, નિશાળ સ્કંધ, ભરાવદાર સીનો, અને બાહુના બળવાન સનાયુઓ કૃતિને અનેરો ઓાપ આપે છે.


સ્નાયુપ્રદર્શન



શક્તિસ્થોત (Fountain of Vitality)

ઇંગ્લેંડના 'સ્પ્રેમેન' નામના માસિકની 'પોઝિંગ ડ્રામ્પીટીશન'માં પ્રથમ પારિતાષ્ટિકને પાત્ર ઠરેલ આ ચિત્રે પરીક્ષાકોણી પ્રશંસાનાં પુષ્પો પામવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યો છે.


ઉર્ય ભાવનાપ્રદર્શિન



તત્ત્વજ્ઞાની (The Philosopher)

ધાર્મિકતા અને તત્ત્વજ્ઞાનના સામાજિકમાં વિહાર કરીને, ઉર્ય પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી આપનાર ભારતીય તત્ત્વજ્ઞાનીની સ્થિતિ દર્શાવતી આ ચિન્હકૃતિ જોતાં જ જોનાર પણ ચિંતનમાં ઇન્દ્રાજી મારી હે છે.


ઉચ્ચ લાવનાપ્રેરણન



સ્થિતિસ્થાપક જદુગર (supple juggler)

અત્યંત કક્ષુ એવેં આ ઠાડી, તેટલી જ સાહજીકતા, આશ્રયોકારકતા અને રમણીયતાથી બતાવવામાં આવ્યો છે. સ્થિતિસ્થાપકતા અને રમણીયતા તરફ બરાબર ધ્યાન આપવામાં આવે, તો શક્તિ આપોઆપ જ આવે, એ કથનની સત્યતાની આ ઝૂટિ જોતાં ખાત્રી થાય છે.


ઉચ્ચ ભાવનાપ્રદર્શન



આગે ખંડો (Forward March)

આખા વિશ્વમાં આદરને પાત્ર ઠરેલ આ કૃતિ અંગ્રેજી, અમેરિકન અને બ્રિટીશ સામયિકીઓમાં પ્રસિદ્ધ થયેલી છે. કૃતિમાં રમણીયતા, સામથ્ય અને પ્રમાણુભૂક્તાનો સુંદર ત્રિવેણી સહયોગ થયો છે. ડોઈ પણ એ જ સ્નાયુને મહત્વ આપ્યા વિના, ડાબા પગના તળિયાથી તે ડાબા હાથનો લંઘાવેલી લાંઝી લંઘક અંગળી સુધીના સ્નાયુઓની સધાયેલી પ્રમાણુભૂક્તા ચિત્રને કૃતિ તરફ જકડી રાખે છે.

ઉચ્ચ ભાવના પ્રદર્શન



નિરાશા (Despair)

શુલામીનો શાખલામાં બદ્ધ થયેલા રાષ્ટ્રના નાગરિકોની નિરાશાને વાચા આપતી આ ચિર્નાકૃતિ, સૌ ડોઈ સ્વાતંખ્રેમ્ભોઓને વિચાર કરતા કરી મૂકે છે.

૨૪. વેઇટ લીફ્ટિંગ : સ્પર્ધા અને નિયમો

વેઇટ લીફ્ટિંગની રમતને 'લોખંડી રમત' તરીકે એળાખવામાં આવે છે. વેઇટ લીફ્ટિંગની સ્પર્ધામાં સ્પર્ધા કે વજન સહિતના બારને 'ટૂ હેન્ડઝ સ્નેચ' પદ્ધતિથી તથા 'કલીન એન્ડ જર્ક' પદ્ધતિથા ભયકવાનો હોય છે. દરેક ભયક પ્રકારમાં સ્પર્ધા કને ત્રણું તક આપવામાં આવે છે. આમાં સ્નેચ અને જર્ક માટેની અલગ અલગ તથા બંને માટેની સંયુક્ત એવી વૈયક્તિક અને ટીમ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

'ઈન્ટરનેશનલ વેઇટ લીફ્ટિંગ ફેડરેશન'ની સ્થાપના ૧૯૨૦માં પેરિસ મુકામે થઈ અને સૌ પ્રથમ વિશ્વ વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશીપ ૧૯૨૨માં અને ૧૯૨૭માં યોજાયું. તે પછી આ ચેમ્પિયનશીપ યુરોપિયન ચેમ્પિયનશીપ તરીકે ૧૯૭૭ સુધી યોજાતી રહી. ૧૯૭૭ની સાલથી વેઇટ લીફ્ટિંગની વિશ્વ



વેઇટ લીફ્ટર

ચેમ્પિયનશીપ દર વર્ષે યોજાય છે ૧૯૭૬ની સાલ સુધી ફાન્સ, એસ્ટ્રીયા અને જર્મની આ સ્પર્ધામાં આગળ પડતા દેશો હતા. પરંતુ ૧૯૭૬માં ચેમ્પિયનશીપ છુંજાતને ફાળે ગઈ અને ૧૯૭૮માં અમેરિકાએ વિશ્વ ચેમ્પિયન બની, ૧૯૭૩ સુધી વિશ્વ-વિનેતાપદ જાળવી રાખ્યું. ૧૯૭૩ માં રશિયા વિશ્વ ચેમ્પિયન બન્યું અને ત્યારથી રશિયાએ આ વિશ્વ વિનેતાપદ આજ સુધી જાળવી રાખ્યું છે; સિધાય કે ૧૯૭૬પમાં પોલેન્ડ અને ૧૯૭૨માં બદ્ગેરિયા વિશ્વચેમ્પિયન બન્યું હતું.

વેઇટ લીફ્ટિંગની હારીકાંઈમાં ૧૯૨૮થી ૧૯૭૨ સુધી. ૧. ટૂ હેન્ડઝ સ્નેચ, ૨. ટૂ હેન્ડઝ કલીન એન્ડ જર્ક અને ૩. ટૂ હેન્ડઝ પ્રેસ-એમ ત્રણ રીતે વજન ભયકવાની સ્પર્ધાઓનો સમાવેશ હતો. પરંતુ હવે ૧૯૭૨થી 'ટૂ હેન્ડઝ સ્નેચ' અને 'ટૂ હેન્ડઝ કલીન એન્ડ જર્ક', એ બે રીતોને સ્પર્ધામાં ચાલુ રાખવામાં આવી છે, જ્યારે 'ટૂ હેન્ડઝ પ્રેસ' ને ૨૬ કરી છે.

વિશ્વ કક્ષાએ આ રમતનું નિયમન કરનાર સંસ્થા છે-International weight-lifting Federation, 4 godfrey Avenue, Twickenham, Middlesex, U. K.

ખેળાડી વર્ગીકરણ : વેઇટ લીફ્ટિંગની સ્પર્ધામાં ખેળાડીઓનું વર્ગીકરણ તેમના વજનને અનુલક્ષીને, નીચે મુજબ ૮ વિસાગમાં કરવામાં આવે છે.

૧. ફલાય વેઈટ : ૫૨ કિ. ગ્રા. સુધી
૨. એન્ટમ વેઈટ : ૫૩ ..
૩. ફેથર વેઈટ : ૬૦ ..
૪. લાઇટ વેઈટ : ૬૭.૫ ..
૫. મિડલ વેઈટ : ૭૫ ..
૬. લાઇટ હેવી વેઈટ : ૮૨.૫ કિ. ગ્રા. સુધી
૭. મિડલ હેવી વેઈટ : ૬૦ ..
૮. હેવી વેઈટ : ૧૧૦ ..
૯. સુપર હેવી વેઈટ : ૧૧૦ કિ. ગ્રા.થી ઉપર

મેટી ચેપિયનશાપ હરીકાઈગ્રેમાં ભાગ લેનાર સંસ્થા ઓપરેટર વિલાગાને અનુભૂકીને વધુમાં વધુ ૮ સ્પર્ધાની તથા ૨ અવેજી મળી કુલ ૧૧ જણુની ટીમ મોફ્લી રહે છે, ને ચૈપ્રી એક વિલાગમાં વધુમાં વધુ એ સ્પર્ધાની રહી રહે છે.

ઉમરને અનુભૂકીને સ્પર્ધાના સીનીઅર (૨૦ વર્ષથા ઉપર) અને જુનીઅર (૨૦ વર્ષથા નીચે) એમ એ વિલાગ રાખવામાં આવે છે.

લેટેફ્ટેમ્ઝ: લાકડાના ૪ મીટર માપના ચોરસ લેટેફ્ટેમ્ઝ ૫૨ જિલ્લા રહીને, સ્પર્ધા ક વજન જીચકવાનું હોય છે. વજન જીચકવા દરમ્યાન સ્પર્ધાનું લેટેફ્ટેમ્ઝ પરથી નીચે આવશે તો તે 'નો લીઝ્ટ' (અમાન્ય જીચક) ગણુશે.


બારબેલ: ચિત્રમાં દર્શાવ્યા મુજબ બંને

છે એ ડાલસની વચ્ચે વજનની ડીસ્ક્સને બંધ ('Lock') કરી શકાય તેવો બારબેલ સ્પર્ધા માટે ઉપયોગમાં લેવાય છે. ડાલસ સાથે બારબેલનું વજન ૨૫ કિ. ગ્રા. નેટલું હોય છે.

ડિસ્ક્સ: દ્વેક ડિસ્ક ઉપર તેનું વજન અંકૃત કરેલું હશે મેટી ડિસ્ક્સ અંદરની બાજુ તથા નાની ડિસ્ક્સ બહારની બાજુ રહે તેવી રીતે તેમને બારબેલ પર ચઢાવવામાં આવે છે અને એ ડાલસની વચ્ચે તેમને શીટ (Lock) ફરવામાં આવે છે. સ્પર્ધા માટે ૫ કિ. ગ્રા., ૨૦ કિ. ગ્રા., ૧૫ કિ. ગ્રા., ૧૦ કિ. ગ્રા., ૫ કિ. ગ્રા., ૨૫ કિ. ગ્રા. તથા ૧૫ કિ. ગ્રા. એ પ્રમાણે વજનવાળી ડિસ્ક્સ રાખવામાં આવે છે.

પોથાક: સ્પર્ધાની ડાલર વિનાનું દ્વારા બાંધનું શર્ટ તથા ટ્રાંક્સ તેમજ લાંગોટ પહેરશે. કમર પર પટો પહેરશે. હશે, તો તેની પણોળાઈ ૧૦ સે. મિ. થા વધારે નહિ હોય તથા બૂટ સામાન્ય આકારના હશે અને એડી ૪ સે. મિ.થી વધારે પણોળાઈ નહિ હોય.

એન્ટેજિસ: સ્પર્ધા પેતાના કાંડાં અને ઢીચણું પર એન્ટેજિસ (પાટા) બાંધી શકશે; પરંતુ તેની પણોળાઈ ૮ સે. મિ. કરતાં વધારે નહિ હોય. કાંડા પરના પાટની લાંબાઈ ૧ મિ. સુધીની અને ઢીચણું પરના પાટની લાંબાઈ ૨ મિ. સુધીની રાખાની શકશે.



ડિસ્ક્સ સહિત બારબેલ

વજન ચકાસણી : સ્પર્ધાડાના વજનની ચકાસણી પંચો દારઃ સ્પર્ધાના ૧૫૨ કલાક પહેલાં થશે.

ઓચક કુમ હલકા વજનવિલાગથા શરૂ કરી કુમસર ભારે વજન વિલાગો માટેના સ્પર્ધાડાના યાદી નક્કો થયા પછી, સ્પર્ધાડાના કુમ ચિહ્ની ઉપાડથી નક્કી થશે. અમૃત એક વજન ઓચકના માટે વધારે હરાફોંના તૈયાર હોય ત્યારે આ કુમનું અતુસરણું કરવામાં આવશે. ડાઈ વજન ઓચકવા માટે જે સ્પર્ધાંકની પ્રથમ તક હશે તે ૨૭ કે ૩૭ તક લેનાર સ્પર્ધાંકનો પુરોગામી રહેશે અને તે જ પ્રમાણે ૨૭ તક લેનાર સ્પર્ધાંક ૩૭ તક લેનાર સ્પર્ધાંકનો પુરોગામી રહેશે.

સમયાવન્ધિ : વજન ઓચકવા માટે સ્પર્ધાંકનું નામ બોલાય, તે પછી તેને વજન ઓચકવાનો પ્રથત્ન કરવા માટે ૨ મિનિટનો સમય આપવામાં આવશે; અને તે બાદ ૧ મિનિટની સમયમર્યાદામાં પણ તે ઓચકવાનું શરૂ ના કરે, તો તેની તે તકને નિષ્ઠળ ગણવામાં આવશે.

ન્યાં સુધી બારખેલ પર વજન ફીટ કરવામાં ન આવે ત્યાં સુધી સ્પર્ધાંકને બોલાવવામાં આવશે નહિ. સ્પર્ધાંક પોતાના ટીચણુંની ઉપર બારખેલ લઈ જાય, એટલે સમય લેવાનું બંધ કરવામાં આવશે.

અધિકારીઓ : સ્પર્ધા માટેના અધિકારીઓમાં ૩ પંચો, ૧ ટાઈમકીપર તથા જ્યુરી, એટલાનો સમાવેશ થાય છે. સાધનો તથા ઓચક (લીફ્ટ) નિયમસર છે કે નહિ, તે જેવાનું કામ પંચો સંલાયે છે. મુખ્ય પંચ એટફેર્મના કેન્દ્રથી ઓછામાં ઓછા ૬ મિટરના અંતરે પોતાનું સ્થાન કેશે; અને દરેક ઓચકના અંતરો સંકેત આપે સ્પર્ધાંકને બારખેલ યથાસ્થાને મૂકવા આવેશ આપશે.

સ્પર્ધાંક પોતાની તક નિયત સમયમર્યાદામાં લે,

તે જેવાનું કામ ટાઈમકીપર સંલાયે છે, જ્યારે નિયમોનું યથાયોગ્ય પાલન થાય, તે કામગીરી જ્યુરી સંલાયે છે.

પંચકાર્ય : વજન ઓચકનારની ઓચક નિયમસર છે કે કેમ તેનો નિર્ણય ત્રણું પંચો કરશે; અને સ્પર્ધાંક બારખેલ એટફેર્મ ઉપર મૂકે તે પછી પોતાનો નિર્ણય (પ્રકાશ દારા) જાહેર કરશે. સદેદ પ્રકાશ સાચી ઓચક અને લાલ પ્રકાશ જોટી ઓચક એટલે કે 'નો લીફ્ટ' દર્શાવે છે.

ગુણુંકન : 'સ્નેચ' સ્પર્ધા અને 'જર્ક' સ્પર્ધા, એ દરેકમાં સૌથી વધુ વજન ઓચકનાર વિજયી ગણ્યાય છે; અને તેજ પ્રમાણે આ બંને સ્પર્ધામાં સંયુક્ત રીતે સૌથી વધારે વજન ઓચકનાર 'સંયુક્ત વિનેતા' ગણ્યાય છે. આમાં સરખું વજન ઓચકનાર વચ્ચે ગાંઠ પડે તો ઓછું વજન ધરાવતો સ્પર્ધાંક વિનેતા ગણ્યાશે. જે આમાં પણ સ્પર્ધા અગાઉ અને સ્પર્ધા બાદ બંનેનું વજન સરખું થાય તો બંનેને વિનેતા ગણવામાં આવશે.

ડાઈ સ્પર્ધાંક સ્નેચ અથવા જર્કમાં વજન ઓચકનામાં નિષ્ઠળ જાય, તો તે તે સ્પર્ધામાંથી સંયુક્ત ટાઈલની સ્પર્ધામાંથી તથા ટીમ સ્પર્ધામાંથી ખાતલ થાય છે. અલાર્ટ તે અન્ય પ્રકાર (સ્નેચ અથવા જર્ક) માં ચાલુ રહી શકે છે.

ટીમ સ્પર્ધામાં સમગ્ર ટીમના ખેલાડીઓના આંકના સરવાળાના આધારે વિજયી ટીમ નક્કો કરવામાં આવે છે. ટીમ સ્પર્ધાના પરિણામમાં ડાઈ ટીમો વચ્ચે ગાંઠ પડે તો જે ટીમના પ્રથમ વિનેતા ખેલાડીઓની સંપ્રાણી વધારે હોય તે ટીમ વિનેતા ગણ્યાશે. અને તેમાં પણ ગાંઠ પડે તો દ્વિતીય વિનેતા ખેલાડીઓ જે ટીમના વધારે હશે તે ટીમ વિનેતા ગણ્યાશે...વગેરે.

પકડ (ઓપ) : બારખેલ પર સ્પર્ધાંક 'હૂકીંગ' પકડ, કે જેમાં અંગૂહાના છેલ્લા સંધા પર તે હાથના અંગાળા વીંટળાય છે, તે લઈ શકે છે.

ઊચક : સ્પર્ધામાં 'સ્નેચ' અથવા 'જક' એ બે પૈકી ગમે તે એક પ્રકારે વજન ઊચકવાનું હોય છે.

વજન ઊચકનારને ઊચકના દરેક પ્રકારમાં વણ તક આપવામાં આવે છે. નો તે પોતાની તકમાં વજન ઊચકવામાં સદ્ગુણ થાય છે, તો તે પણીની તકમાં તે વધારે વજન ઊચકવા માટે પ્રયત્ન કરે છે; પણ નો તે નિષ્ઠળ જય તો પોતાની ખીજ તકમાં તે તે જ વજન પર પુનરાવર્તન કરે છે.

ઊચકનાર પોતાની શક્તિને અનુલક્ષીને, પોતે ઊચકવા માંગતા વજનની જાણ આગાઉથી કરે છે; તેમ છતાં સ્પર્ધા દરમ્યાન તે તેમાં ફેરફાર કરી શકે છે.

અમૃક એક પ્રકારની સ્પર્ધા દરમ્યાન બાર પર કુભિક રીતે વજન વધારવામાં આવે છે; અને આમ પોતાની ધારણા મુજબનું વજન થતાં, ને તે સ્પર્ધાની વજન ઊચકવાની પોતાની તક લે છે. ડોઈ સ્પર્ધા અમૃક વજન ઊચક તે પણી તેનાથી ઓછું વજન કરી શકશે નહિ, સામાન્યતઃ બારનું વજન એકી વખતે ૫ ક્રિ. આ. વધારવામાં આવે છે. પરંતુ ડોઈ સ્પર્ધાની પોતાની છેલ્ખી તક લેતો હોય, તો તે આગળના વજન કરતાં ૨૩ ક્રિ. આ. વજન વધારવાનું કઢી શકે છે.

દૂ હેન્ડઅ સ્નેચ

આ સ્પર્ધાપ્રકારમાં બારને ઊચકનારના પગ પાસે આડો રાખવામાં આવે છે.

ઊચકનાર હુથેલી જમીન તરફ રહે તે રીતે, બંને હાથ વડે બાર પકડી, તેને જમીનથાં બંને હાથ માથા ઉપર સીધા ઊચા થાય ત્યાં સુધી એક સળંગ ગતિમાં એચે છે, ને દરમ્યાન બંને પગ પહેણા કરી શકે છે; અથવા ઢીચણુભાંથી વાળી શકે છે.

બાર શરીર આગળથાં એક સળંગ ગતિમાં પસાર થવો જોઈએ.

જ્યારે માથા ઉપર પૂરેપૂરા સીધા હાથ પર વજન આવી જય, તે પણી વજન ઊચકનાર પોતાની સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જોઈતો જરૂર લઈ શકે છે.

તે પણી તે પોતાના હાથ તંથા પગને સીધા રાખી, તેમજ પગના પંખ એક સીધી રેખામાં રહે તેમ સ્થિર થાય છે.

પણી મુખ્ય પંચ તેને સંકેત કરે એટલે તે બારને યથાસ્થાને પાછો મૂકે છે.

નિયેધ : ૧. વજન ઊચકવા દરમ્યાન ઊચકનાર ક્ર્યાંય એટકી શકશે નહિ. ૨. બાર તેના માથાની ઉપર ન પહેણ્યે ત્યાં સુધી કાંડાને ફેરવી શકશે નહિ. ૩. હાથને અડધાપડધા કે વાંકાચ્ચુંકા સીધા કરી શકશે નહિ. ૪. બારને ધૂઢુલીને (પ્રેસ-આઉટ) હાથ સીધા કરી શકશે નહિ.

દૂ હેન્ડઅ કલીન એન્ડ જક

કલીન : બારને ઊચકનારના પગ પાસે આડો રાખવામાં આવશે.



દૂ હેન્ડઅ સ્નેચ

જિયકનાર પોતાની હુથેલી જમીન તરફ રહે, તેમ બંને હાથ વડે બારને પકડી, એક સળંગ ગતિમાં ખલા પાસે લાવે છે; જે દરમ્યાન તે પોતાના બંને પગ પહેલાણા કરી શકે છે; અથવા ઢીચણુમાંથી વાળી શકે છે.



તે પછી તે બારને પેતાની હાંસડી પર છાતી પર અથવા પૂરેપૂરા વાળેલા હાથ પર ટેકવી શકે છે.

નિયેદ : ૧. જિયકનાર બેદકની સ્થિતિમાં ‘કલીન’ કરી શકે નહિ. ૨. પોતાની ડાણી અથવા ઉપલા હાથ વડે, ઢીચણુ કે જાંધને અડકી શકશે નહિ. ૩. બાર ખલા સુધી પહેલાં તે પહેલાં શરીરને અડકી શકશે નહિ. ૪. ડાણી અવળી ફરી જથું તે પહેલાં બારને છાતી પર ટેકવી શકશે નહિ.

સમતુલ્યા : ૧. જિયકનાર ‘જ્ક’ શરૂ કરતાં પહેલાં પોતાના પગને સીધી રેખા પર લાવવા માટે જોઈતો સમય લઈ શકે છે. ૨. તેને જે અગવડ લાગતી હોય, તો તે બારને પોતાના ખલા પર નીચો લાવી શકે છે ૩. અંગૂહાને સંકોચી શકે છે અથવા બાર પરની ‘હૂકીંગ’ પકડને ઢીલી કરી શકે છે. ૪. બંને હાથની પકડ વચ્ચેના અંતરને વધતું ઓછું કરી શકે છે.

આ બધી દિયાઓ ‘કલીન’ કે ‘જ્ક’ ના ભાગ તરીકે નહિ ગણ્ય.

જ્ક : બંને પગને વાળીને પછી આંચકા સાથે બંને હાથ તથા પગને સીધા કરવામાં આવે છે.



દૂસિંહ કલીન એન્ડ જ્ક

પછી વજન જિયકનાર બંને પગને સરખા ગોઠવી સમતુલ્ય પ્રાપ્ત કરી સ્થિર થાય છે. અને છેલે મુખ્ય પંચ તરફથી સંજ્ઞા મળતાં બાર નીચે મુકે છે.

‘જ્ક’ની ગતિ સંપૂર્ણ થની જોઈએ. જિયક સંપૂર્ણ ન થાય અને ખલામાંથી જેર દાખવવામાં આવે તો તે ‘અમાન્ય જિયક’ ગણ્યાશે.

અમાન્ય જિયક (No Lift)

‘સનેચ’ અથવા ‘જ્ક’ સ્પર્ધા દરમ્યાન નીચેના સંજોગામાં ‘અમાન્ય જિયક’ (No Lift) જોઈએ કરવામાં આવે છે.

૧. બારને લટકતી (Hang) સ્થિતિમાંથી જોગે એંચવામાં આવે.

૨. જે અધુરા પ્રયત્નના પરિણામે બાર ઢીચણુ સુધી આવે.

૩. જે બાર સાથળને અડકે અને અટકી જથું (પરંતુ ઢીચણુની નીચેના ભાગમાં અડકે અથવા સાથળ ઉપરથી અટકયા વિના સરકે તો તે માન્ય છે.)

૪. બાર સરળતાથી સરકે તે માટે સાથળ પર તેથી કેચીસ લગાડવામાં આવે.

૫. શરીરનો પગ સિવાય અન્ય કોઈ લાગ જમીનને અડકે.

૨૮૮

૬. પંચની સંશો મળતાં પહેલાં, સ્પર્ધક બારને લેટેફોમ્ પર પાછા મુકે.
૭. પંચની સંશો મળ્યા પછી, સ્પર્ધક બારને નીચે ઝેંડે અથવા લેટેફોમ્ પર મૂકતાં સુધી બંને હાથ વડે મુક્કડી ન રાખે. (બારને સ્પર્ધા લેટેફોમ્ પર મૂકવો જોઈએ.)
૮. જીયકનાર વજન જીયકવા દરમાન લેટેફોમ્ પરથી નીચે આવે.
૯. જીયકનાર છેલ્યે સ્થિર સ્થિતિમાં આવવા માટે પ્રવતન કરે, ત્યારે સમતુલ્યા પ્રાપ્તિ દરમાન હાથને વાળે અથવા સીધા કરે.
૧૦. હાથ માથા ઉપર સીધા કરતી વખતે વાંકાચૂંકા થાય.



રપુ. બોડી બિલ્ડિંગ આથવા શરીર સ્પોર્ટ્સ ક્રેચ્યુલ

આગ્રણ શહેર ‘બોડી બીલ્ડિંગ’ એટલે સપ્રમાણું સ્નાયુઅંક શરીરનું ધડતર કરવું તે. સપ્રમાણ શરીરનું ધડતર કરવા માટે વજન વ્યાયામ પદ્ધતિ સૌથી વધારે પ્રચલિત છે; કારણું કે તેમાં વજન-માપન રહેલું છે અને ટૂંકા ગાળામાં જોઈ શકાય તેવાં પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. તેમાં સાથાદારની જરૂરત રહેતી નહિ હોવાથી ગમે ત્યારે મહાવરો કરી શકાય છે. વજનનો સપ્તાહમાં બે થી ત્રણ વાર બે માસ સુધી ઉપયોગ કરી, કોઈ પણ યુવાન વ્યક્તિ સ્નાયુઓનો ઘેરાવો વધારી શકે છે. સૌને જન્મગત અને સાહજિક ઈચ્છા હોય છે, કે પોતે મોટા અને વિકસિત સ્નાયુઓ ધરાવતા હોય. વજન વ્યાયામ સમગ્ર અને સંપૂર્ણ શરીરધડતર કાર્યક્રમમાં અને વિકસિત રિથતિ જગ્નવવામાં સૌથી અગત્યની બાબત છે. ને યુવાનો ધારીલા અને સ્નાયુઅંક શરીર માટે કૃતનિશ્ચય બન્યા છે, તેમને તે ઉપયોગી બની રહે છે. તેઓ વજન વ્યાયામના સખત પરિશ્રમથો ‘મી. ગુજરાત’ કે ‘મી. ઇન્ડિયા’ નેવાં બિઝ્ડો જીતવા પ્રયત્ન કરે છે. શરીર સૌંદર્યની સ્પર્ધાઓ રાજ્ય, રાજ્ય અને આતરરાજ્યીય તથા વિશ્વકક્ષાની યોજના છે.

માનવ શરીરના સુખ્ય ભાગો

ને રમત સ્પર્ધામાં વ્યક્તિ ઉત્કૃષ્ટ કરવા ભાગે છે, તેના પ્રકાર સુજબ શરીરનાં અંગો, ને વારંવાર ક્રિયાશીલ બનાવવાનાં હોય, તેનો ખાસ ઘ્યાલ રાખવો ધરે અને તેમને મજબૂત બનાવવાં પડે. આ બાબત એક અથવા કેટલાક શરીરના ભાગોનો વધારે પડતો વિકાસ કરવામાં નથો. તેમ થાય તો તે એકાંગી વિકાસ ગણ્યાય. નથળા વિલાગો પ્રત્યે પણ

ખાસ ધ્યાન આપવાની જરૂર છે. નીચે જણાવેલા સમૂહ પસંદ કરવામાં આવે અને સ્નાયુઓને તે ભાગો માટે જરૂરી કસરતોની પસંદગી કરવામાં આવે તે છચ્છવા યેઠ્ય છે. ને તે રમતમાં થતા હલત-ચલનને લક્ષણમાં રાખો, તેને અનુરૂપ ક્રિયાઓનો વિકાસ થાય તેવી કસરતો પસંદ કરવી જોઈજો.


(૧) ગળું : આ વિલાગમાં ટ્રેપેઝિયસ (Trapezius) નો ઉપરનો ભાગ અને સ્ટનેક્લેઇડ મસ્ટેઇડના સ્નાયુઓનો સમાવેશ થાય છે.

(૨) છાતી અને ખલા : આ વિલાગમાં શોલ્ડર ગર્ડલ (Shoulder Girdle), ડેલ્ટોઇડ્ઝ (Deltoids), ટ્રેપેઝિયસનો ડાલરબોનો ભાગ, તથા છાતીમાં પેક્ટોરલ્સ (Pectorals), અપર થોરેક્સ (Upper thorax) અને રીબ બોક્સ (rib box)નો સમાવેશ થાય છે.

(૩) ઉપરનો હાથ : આ વિલાગમાં સ્નાયુઓના સુખ્ય બે જુથ ટ્રાઇસેપ્સ - (Triceps) અને બાઇસેપ્સ (Biceps) નો સમાવેશ થાય છે.

(૪) નીચેનો હાથ : આ વિલાગમાં બ્રેચિયો રેડિયાલિસ (Brachio Radialis), રિસ્ટ એક્સ્ટેન્સર્સ (Wrist Extensors) અને ડીજિટ્સ (Digits) તથા કાંડાના એન્યુલર લીગામેન્ટ્સ (Annular ligaments) નો સમાવેશ થાય છે.

પીઠનો ઉપરનો ભાગ : આ વિલાગમાં લેટિસિમસ (Latissimus), ટ્રેપેઝિયસના કેટલાક ભાગ, ટેર્સ મેજર અને માઇનર (teres major



and minor), રહેમ્બોઇડેસ (rhomboideus) અને ઇન્ફ્રાસ્પાઇનેટ્સ (Infraspinatus) નો સમાવેશ થાય છે.

પીઠનો નીચેનો ભાગ : આ વિભાગમાં ઇરેક્ટર સ્પાઇન (Erector Spinae) તથા ઓપ્લીક સ્નાયુઓના પાણગંના ભાગનો સમાવેશ થાય છે.

નિતંધ : આમાં ગ્લુટિયસ (Gluteus) સ્નાયુઓનો સમાવેશ થાય છે.

જંધ : આમાં બાયસેપ્સ બિમેરિસ (Biceps femoris), ગ્રેસિલિસ (Gracilis) તથા સાર્ટોરિસ (Sartorius) સ્નાયુઓનો સમાવેશ થાય છે.

પગનો નીચેનો ભાગ : પિંડી અને ઘૂંઠીના સ્નાયુઓ જેવા કે ગેસ્ટ્રોકનિમિયસ (Gastrocnemius) અને સોલેસ (Soleus) વર્ગેનો આ વિભાગમાં સમાવેશ થાય છે.

તાલીમ શર કર્યા પહેલાં અને ત્યાર ખાદ ૬૨ ત્રણ માસે નીચે મુજબ માપ લેવાં જોઈએ.

ગળું : સૌથી પાતળો ભાગ.

પ્રકોષ્ઠ (કાણી ને કાંડા વર્ચેનો) : સૌથી

પાતળો ભાગ અને સૌથી જડો ભાગ; હાથ સીધો રાખી મૂડી બંધ.

દંડ (કાણી ને ખલા વર્ચે) : વર્ચેના ભાગમાં હાથ સીધો રાખ્યો.

દંડ (કાણી ને ખલા વર્ચે) : કાણી-માંથા વળદો.

સામાન્ય છાતી : સ્તન (તીપલ) ફરતે.

છાતી : શ્વાસ કાઢી નાખીને.

છાતી : ઝૂલાવેલી.

કાંડુ : સામાન્ય.

જંધ : સૌથી જડો ભાગ.

પગ : ઘૂંઠણુથા સહેજ ઉપર.

પિંડી : સૌથી જડો ભાગ.

હંમેશાં કોઈ પણ કસરત કર્યા પહેલાં માપ લેવાં.

શરીર સૌથી સ્પર્ધાના નિયમો

(૧) સ્પર્ધા માટે વજનના આધારે સ્પર્ધાકોના નીચે મુજબ વિલાગો પાડવામાં આવશે.

૧. એન્ટમ (૬૫ કિ. ગ્રા. સુધી); ૨. લાઈટ (૬૫-૭૦ કિ. ગ્રા.); ૩. મિડલ (૭૦-૮૦

કિ. ગ્રા.); ૪. લાઈટ હેવી (૮૦-૬૦ કિ. ગ્રા.);
૫. હેવી (૬૦ કિ. ગ્રા.થી વધારે).

નાંખ : અગાઉ સ્પર્ધેકની ઊચાઈના આધારે-શોટ (૬૪ ઘંચ સુધી); મિડિમ (૬૪-૬૮ ઘંચ) તથા ટોલ (૬૮ ઘંચથી વધારે) એ પ્રમાણે વિભાગ રાખવામાં આવતા હતા; પરંતુ ૧૯૭૭થી આ પ્રથા બંધ કરવામાં આવી છે અને વજનના આધારે વિભાગ પાડવામાં આવે છે).

(૨) સ્પર્ધા માટે ઓછામાં ઓછા ત્રણું પંચો રહેશે, જે પૈકી એક મુખ્ય પંચની કામગીરી સંલાગશે.

(૩) દરેક સમૂહમાં ઓછામાં ઓછા ચાર સ્પર્ધાંકા હોવા જોઈશે.

(૪) સામાન્ય રીતે સપ્રમાણું અને સુવિકસિત શરીર પ્રમાણે નિર્ણય આપવામાં આવશે.

(૫) કોઈ પણ પ્રકારની ક્ષતિઓ જેવી કે, કવર્ડ બેક બોન, સ્ટુપેંગ પોશર, બો-લેગ, કાય-ફિસીસ, પ્ટોસીસ વગેરે સ્પર્ધાંકને જોરલાયક ઠરાવે છે.

(૬) ચુણું વહેંચણી સનાયુઆના સમૂહ મુજબ કરવામાં આવેલી હોય છે, જેમાં સ્પર્ધા બાદ બધા જ સ્પર્ધાંક એક્ષુસાથે જુદા જુદા સનાયુ સમૂહોના વિકાસનું નિર્દર્શિત કરશે.

નિર્દર્શનના હેતુ માટે સનાયુ સમૂહોની વહેંચણી નીચે પ્રમાણે છે :

સમૂહ	સનાયુઓ	મહત્વમાં ચુણું	કુલ ચુણું
ક. હસ્ત સમૂહ	ટેટાઇડ બાઈસેપ્સ અને ટ્રાઈસેપ્સ ફાર આમ્સ ટ્રેપેઝિયસ	૫ ૫ ૫ ૫	૧૫
ખ. છાતી સમૂહ	પેક્ટ્રોલીસ મેજર રીઅભેક્સનો વિકાસ લેટિસિમસ ડાર્સી	૫ ૫ ૫	૧૫
ગ. પીડ સમૂહ	સમગ્ર પીડ	૫	૧૦
ધ. પેટના સનાયુઓ			૧૦
ય. પગના સનાયુ સમૂહ	બંધ પિંડીઓ	૫ ૫	૧૦
ઝ. પ્રશિષ્ટ અંગવિન્યાસ	આગળ પાછળ અન્ય	૫ ૫ ૫	૧૫
ઝ. અપળતા	કોઈ પણ કિયા જેવી કે, કાર્ટ્યુલિન, હેન્ડસ્પ્રોંગ એક્સ્ટ્રીલીપ, હેન્ડસ્ટેન્ડ, સમરસોલ્ટ વગેરે		૧૦
ઝ. વ્યક્તિત્વ	વ્યક્તિગત દેખાવ, આંખોની તેજસ્વીતા, ચામડીની રચના, અંગસપ્રમાણુતા વગેરે દારા, સ્પર્ધા દરમ્યાન પંચો પર પડેલી સામાન્ય છાપ.		૧૫
			કુલ ૧૦૦

(૮) દરેક સ્પર્ધાકવિભાગમાં પ્રથમ એ સ્થાન મેળવનારને અતુકુમે વિનેતાપદનું અને ખીજ નંબરનું પ્રમાણુપત્ર આપવામાં આવશે.

(૯) બધા સ્પર્ધાકમાંથી એષ્ટ સ્પર્ધાક શેધવા માટે દરેક વિભાગમાંથી પ્રથમ સ્થાન મેળવનારને જ ગણ્યનીમાં લેવામાં આવશે.

(૧૦) પ્રથમ સ્થાન ને તે સમૂહમાં મેળવનાર સ્પર્ધાક એ હોય તો બંનેને એષ્ટ સ્પર્ધાકના એવોઈ માટે ગણ્યનીમાં લેવા.

(૧૧) "બેસ્ટ ફિઝિક" (Best Physique) ની સ્પર્ધા માટે નીચે મુજબ વારી અપાશે.

અ. પ્રશાસ્ત્ર અંગવિન્યાસ-કોઇપણ ત્રણ-૧૫ ગુણુ

જેમાં ખાસ કરીને ચોક્કસ પ્રકારના સ્નાયુ-સમૂહો પ્રદર્શિત થતા હોય તેવા આવિભાવિપ્રધાન તથા પ્રવૃત્તિપ્રધાન અંગવિન્યાસો જેવા કે, રાજ્યધ્વજને જાચે પકડી રાખતો નિશ્ચયીયુવાન, સાંકળ તોડતો ખલવાન માનવી, ચક ઝેંકનાર, લાલો ઝેંકનાર વગેરે.

ખ. વ્યક્તિત્વ

૧૦ ગુણુ

પહેરવેશ :- સ્પર્ધાકએ ઇકત અંગવિન્યાસની પદ્ધીએ (અથવા એક જ રંગની ટ્રાન્ક) પહેરેલી હોવી જોઈએ. શરીર પર તેલ કે મોસ લગાઉણું ન હોવું જોઈએ. ખૂટ અને મોણ પહેરેલાં રાખ્યો શકાય નહિ.

(૧) સ્પર્ધાકને હંચાઈ પ્રમાણે નંબરો આપવામાં આવશે.

(૨) "ભારત શ્રી" ની શરીર સૌઠાવ સ્પર્ધા માટેના ખાસ નિયમો.

(૩) એક વર્ગના બધાં જ સ્પર્ધાકાનું સામાન્ય પ્રદર્શન એક સાથે રજુ થશે. તેના ગુણ આપવામાં આવશે નહિ.

(૪) સ્પર્ધાકાનું આગળ, પાછળ અને બાજુનું વ્યક્તિત્વગત નિર્દર્શન. કોઈ પણ અંગવિન્યાસનો પ્રકાર અથવા સ્નાયુસ-કોચનની મનાઈ રહેશે. ૦ થા ૨૦ ગુણુ સુધીમાં આપવામાં આવશે.

(૫) દરેક સ્પર્ધાકને વ્યક્તિત્વગત પસંદગી મુજબ સ્નાયુઓનું નિર્દર્શન કરવા ૬૦ સેકન્ડ જેટલે સમય આપવામાં આવશે અને તેમાં વ્યક્તિત્વગત પસંદગી મુજબ વિવિધ અંગદંગ બતાવવાની છૂટ રહેશે. આમાં સ્પર્ધાકને ૦ થા ૩૦ ગુણુ સુધી આપી શકાશે.

૩. દરેક સ્પર્ધાકનું નામ બોલાયા બાદ તેણે એ મિનિટમાં સ્ટેઝ ૫૨ હાજર થવાનું રહેશે. સમય-ગાળામાં ન હાજર થનાર સ્પર્ધાકને ચેતવણી સહિત બોલાવવામાં આવશે અને જે તે ત્રણ મિનિટ સુધીમાં હાજર ન થાય તો તેને સ્પર્ધામાંથી બાકાત કરી શકાશે. સમયપંચની નિમણુંક કરવામાં આવે છે. દરેક સમૂહ માટે ત્રણ નિર્ણયકાથા એધી સંખ્યા રાખી શકાશે નહિ અને વધુમાં વધુ પાંચ નિર્ણયકો રાખી શકાશે.



କାର୍ଯ୍ୟ କରିବାକୁ ପାଇଁ ଏହାରେ ମଧ୍ୟରେ ଏହାରେ ଏହାରେ

નાખપાત્ર અંક અને વિક્રમ

રાધીર સોંગદાર રાધી

રાધીય : મી. કણ્ણિયા, જિડુદ વિજેતાએ।

નોંધપાત્ર અંક અને વિકભ

નામ	સાહુ વાણી	મી. ચણ્ણિયા	વાણી સાહુ	મી. કણ્ણિયા
૧૬૫૪	કલકતા	ગુલામજુદ્ડેન ગાંધી (હ. અંગાલ)	૧૬૫૭	કલકતા ક્ષિતિશ જેટરલ (હ. અંગાલ)
૧૬૫૫	બેલેપુર	કુલાલકાંતિ દાસ (હ. અંગાલ)	૧૬૫૮	કલકતા શાંતિ દાસ (હ. અંગાલ)
૧૬૫૬	કલકતા	વિશ્વના� દાસ (હ. અંગાલ)	૧૬૫૯	આધ્યાત્મિક આદ (હ. પ્રદેશ)
૧૬૫૭	કલકતા	ગાન્ધારાચારી બાકુડી (આદિ)	૧૬૭૦	કલકતા મલથ રોય (હ. અંગાલ)
૧૬૫૮	કલકતા	સંકર સહો (હ. અંગાલ)	૧૬૭૨	દાળ્ઘિલી ગ કેન્દ્રાધાલ પૈંડુર (મહારાષ્ટ્ર)
૧૬૫૯	કલકતા	દશ નાનુમાર (દિલ્હી)	૧૬૭૩	કલકતા મલથ રોય (હ. અંગાલ)
૧૬૬૦	કેમ્પટર	ઓંકાર ઘેનરલ (કેમ્પટર)	૧૬૭૪	કેરેકેલા સુનિલ પાત્રા (સ્ટીલ ખાનાસ)
૧૬૬૧	કલકતા	રાધિન ચંદ્રવર્ણ (હ. અંગાલ)	૧૬૭૫	કલકતા અચ. કે. બોગેઝીન (કુવિસીય)
નાથ : ૧૬૭૬ની સાલ ખણી રાધીય કલ્યાણ 'મી. કણ્ણિયા, જિડુદ આપવાની આથા બ'ખ કરી બજાર વિલાગ અધુસર વિનેતાખ નકો કરવાની પથા અપનાખણમાં આવી છે.				
વાણી	મેન્ટમ	લાલાલ	મિસલ	લાલાલ હેવી
૧૬૭૬	અજાય જેટરલ (હ. અંગાલ)	મલથ રોય (હ. અંગાલ)	શેખ. કે. બોગેઝીન (કુવિસીય)	મલથ રોય (હ. અંગાલ)
૧૬૭૭	દાળ્ઘિલી	(સ્ટીલ ખાનાસ)	શેખ. કે. બોગેઝીન (કુવિસીય)	મલથ રોય (હ. અંગાલ)
૧૬૭૮	પુરી	(સ્ટીલ ખાનાસ)	શેખ. કે. અધિકારી (કુવિસીય)	શેખ. કે. અધિકારી (કુવિસીય)
૧૬૭૯	દાળ્ઘિલી	(સ્ટીલ ખાનાસ)	શેખ. કે. અધિકારી (કુવિસીય)	શેખ. કે. અધિકારી (કુવિસીય)

੩੬ ਮਾਂ ਸਾਡੇ ਮੁਹਿੰਮ ਅਧਿਤਨ ਮਾਲਿਤੀ ਗੁਜਰਾਤ ੨੦੭੨ ਵੇਖਿ ੧੯੪੧ ਲਈ ਆਂਦੋਲਨ। ਮੰਜੀ ਮੁਫ਼ਤ ਜ਼ਿਲ੍ਹਾ ਕਾਨਕ ਮੁਹਿੰਮ ਅਧਿਤਨ ਮਾਲਿਤੀ ਗੁਜਰਾਤ ਨਾਮ ਸੱਚੇ ਹੈ।

ପ୍ରାଚୀନତାକୁ ଦେଖିବା ଏହାର ମଧ୍ୟରେ କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା

੧੯੮੧ ਰਾਮਦਾਨ ੫ ਮਈ ੧੯੮੨ (੧੩੪੧) ਮਾਹੂ ਅਤੇ ਸ਼ਾਹੀ (੧੩੪੦)

૧૬૮૦ સાયેન્સ પંચાલ (વડોદરા) પદ્મભૂત કણ્ઠાર (કુરત) ગોપની ટોકર (વડોદરા) હસમુખ કણ્ઠાર કુરત)

ପାଦମୁଖ କିମ୍ବା ପାଦମୁଖ କିମ୍ବା ପାଦମୁଖ

၃၁၂

અને આ પરિસ્તિધિની વિશે એવી જો વિશેષ વિગતો હોય તો આ વિશેષ
જો વિશેષ વિગતો હોય તો આ વિશેષ

અશોક સેવક (વડોદરા) અશોક (વડોદરા) એન. ડી. હેસાઈ (વડોદરા) પ્રદીપ કહાર (સુરત)

ତେବେ ପ୍ରକାଶ କରିବାରେ ଏହାର ଅଧିକାରୀ ହେଲାମାତ୍ର ଏହାର ପରିଚାଳନା କରିବାରେ ଏହାର ଅଧିକାରୀ ହେଲାମାତ୍ର

સાધુબદ્ધ વિજયનગર

અધ્યક્ષ (સર્વભેદ) શ્રીમતી. મણિલાલ (પટેલ) અધ્યક્ષ (સર્વભેદ) શ્રીમતી. પણીલાલ (સાહેબ)

અનુભવ કેટાળ (રેખા) સુનીલ પટેલ
અનુભવ કેટાળ (રેખા) સુનીલ પટેલ
અનુભવ કેટાળ (રેખા) સુનીલ પટેલ

પ્રેરણાનું ખીજ

જરીરમાદ્ય ખલુ ધર્મ સાધનસ્ત । પૂજ્ય શ્રી મોટાને શરીરથી જે કાટમય સાધના કરવી પડી તે ઉપરથી તેમને પ્રતીતિ થઈ કે આધ્યાત્મિક માર્ગના પથિકને માટે જે આ પંચ આવે કાંઠાળો હોય અને પ્રગતિ કરવા માટે ખડતલ સુદૃઢ તનની આવશ્યકતા રહે છે તો સામાન્ય જનને તો ડેટલું બધું કહિન થઈ પડે !

આથી લાવિ પેઢીનાં બાળકો નાનપણુથી જ શારીરિક અને માનસિક વિકાસ કરતાં થાય તે મારું તરણું સ્પર્ધા મેરેથોન દોડ, જલદ ચાલ સ્પર્ધા, પગપાળા પ્રવાસ, સાયકલ સ્પર્ધા વ્યાયામથાળાઓને સહીય આર્થિક સહાય, પર્વતારોહણ આદિ પ્રવૃત્તિઓ યોજને નવી પેઢીમાં સાહસ, શૌર્ય, બહાદુરી, ધૈર્ય, સહનરીલતા, તપ, ત્યાગ, ઉદ્ધરતા, ભાઈચારો વગેરે ગુણેનો પણ વિકાસ થાય તેમ આયોજનો કર્યાં. સાથે સાથે ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય શાનકોપો, વેદ, લલિત કણાઓ વગેરેનો પરિચય થાય તે સારું તેવાં તેવાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કરાવ્યાં—જેથી માનસિક પુષ્ટિ મળે.

આ વ્યાયામ વિજ્ઞાનકોષ પૂજ્ય શ્રી મોટાની પ્રેરણા અને પ્રારંભિક આર્થિક સહાયતું હું ગળી રાકાય. વ્યાયામનાં આવાં સચિત્ર શાસ્ત્રીય (સાયન-ગીશીક) વિસ્તૃત. આયોજનખદ્દ પુસ્તકો હિન્દુસ્તાનની ક્રાંતિકા અન્ય ભાષામાં પ્રસિદ્ધ થયાં હોય તેવું, ઘ્યાલમાં નથી. આ અંથશ્રેષ્ઠીની એ રીતે સવિશેષતા છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ (રાજ્યીપવા)નું ગુજરાતનો પ્રણ સદૈવ ઝડપી રહેશે. આં આ અંથોના સંપાદકોએ ધર્ણી સારી જહેમત ઉકાની છે. તેઓને હાર્દિક ધન્યવાદ ધરે છે.

હુરિ : ડેં આથમ-

સુરત-નડીઆદ.

નંદુલાઈ શાહ
મેનળંગ દ્વારી

૨૧૭ટ્રીય નવપ્રસ્થાન

ભારતની એક અગ્રણી વ્યાયામસંસ્થા = ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તથા તેના ભૂતપૂર્વ કુર્ણાધારો સ્વ. પુરાણી ભાઈએ, જેએ વ્યાયામ પ્રકૃતિમાં રાષ્ટ્રીયતાનું આ દેશમાં પ્રદાન કરનારા અગ્રહૃતો હતા, તેમની વ્યાયામ ક્ષેત્રની યશસ્વી કામગીરીથી હું પરિચિત છું. ગુજરાતના આ લખ્યપ્રતિષ્ઠ મંડળે સ્વાતંત્ર્યોત્તર કાળમાં જેની ધર્ણી અગત્ય હતી તેવું, વ્યાયામવિજ્ઞાનકોષ યોજના હેઠળના દ્વારા પ્રચાર કરવાનું ભગીરથ ઉત્તમ કાર્ય હાથ ધર્યું છે, તેને હું એક ૨૧૭ટ્રીય નવપ્રસ્થાન ગણું છું, અને આ પ્રસ્થાનને હું આવકાસ છુ....

ભારતમાં આ વિષય પરનાં એન્સાયકોપેડિયાની ડક્ષાનાં માહિતી પ્રચૂર અંથે તૈયાર કરવાની પહેલ કરનાર ગુજરાત રાજ્ય સરકારને, પ્રેરણા આપનાર હુરિ : ડેં આથમને તથા જવાબદારી ઉપાડનાર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળને ધન્યવાદ ધરે છે.

દોરિયલ,

કેરલ

ડા. પી. એમ. જોસેન્સ

નિવૃત્ત પ્રિન્સીપાલ,

લક્ષ્મીભાઈ રાષ્ટ્રીય શા. રિ. કોલેજ વાલિયર